

શિબિર પુંગાને પણ પહાડ ચડાવે

પૂજ્યપાદશ્રીની શિબિરોએ તો મારા જીવનની રોનક બદલી નાંખી છે. પ્રભુભક્તિ અને તપના બે મહાન યોગ શિબિરની પ્રેરણાઓ દ્વારા પૂજ્યશ્રીએ ખૂબ સહજતાથી પકડાવી દીધા. જે આજે મને અદ્ભુત આધ્યાત્મિક સ્ફૂર્તિ આપી રહ્યા છે.

આજથી ગ્રીસેક વર્ષ પહેલાની વાત છે, ત્યારે વરખની થોકડી દોઢ રૂપિયામાં આવતી અને તેમાં ૧૬ પાના આવતા. પૂજ્યપાદશ્રીએ અચલગઢની શિબિરમાં સમજણ આપી, રોજ સ્વદ્રવ્યથી પ્રભુજીની થોકડી પણ આંગી રચો. એક વરખના પાનાના ૮ ટુકડા કરો તો ૧૬ પાનાની થોકડીના ૧૨૮ ટુકડા થાય. દોઢ રૂપિયામાં ૧૨૮ દિવસ સુધી વરખનો ટુકડો લગાવવા દ્વારા પ્રભુજીને આંગી રચી શકાય.

પૂજ્યશ્રીએ સમજાવેલા પ્રભુભક્તિનો મહિમા અને આ ગણિત અમારા મગજમાં ઉત્તરી ગયું. ઘણાં શિબિરાર્થીઓએ સ્વદ્રવ્યથી આંગી કરવાનો અભિગ્રહ લીધો. તે નાનકડા આંગીના નિયમે મને પ્રભુભક્તિનું અને આંગીનું ખૂબ વેલું લગાડ્યું. ભક્તિ કરતાં પૂજ્યશ્રીની કૃપાથી આંગીનો ક્ષયોપશમ પણ ખીલવા લાગ્યો અને આજે હું મહાપૂજાઓમાં પણ આંગીઓ રચતો થઈ ગયો. આજ સુધીમાં સેંકડો વાર ભવ્ય અંગરચનાઓ કરવાનો અનુપમ લાભ મને પ્રાપ્ત થયો. પણ, આ બધાના મૂળમાં પૂજ્યશ્રીની પાવન પ્રેરણા છે.

તેવી જ બીજી વાત તપની, બંભાતની શિબિરમાં પૂ. તપસ્વી મુનિરાજ શ્રી મહિપ્રભવિજય મ. ની ૧૦૦મી ઓળીના પારણા પ્રસંગે પૂજ્યશ્રીએ ફરમાવેલું : ‘વર્ધમાન તપ એટલે વધતો જતો તપ. પારણું આવે એ પહેલાં નવી ઓળી ક્યારે શરૂ કરણું એના મનોરથ સેવાય.’ આ પ્રેરણાએ મને ઓળીનું વેલું લગાડ્યું. જેનું સ્વખ પણ દુષ્કર હતું તે વર્ધમાન તપની ૧૦૦ ઓળીની આરાધના પૂજ્યપાદશ્રીના પુજ્યપ્રભાવથી મારા જીવનમાં પૂર્ણ થઈ.

પૂજ્યપાદશ્રીની ભવ્ય સાધના આગળ મારી આરાધના તો મેરુ આગળ સરસવ જેવી વામણી લાગે. છતાં મારી ૧૦૦ ઓળીના પારણા પ્રસંગે આશીર્વાદ પાઠવતા મને પત્રમાં લખ્યું હતું :

‘આ ૧૦૦ ઓળી કરી તે તો તારા પોતાના આત્મા માટે. બાકી ગામે ગામ તે રચેલી અંગરચનાના દર્શને હજારો ભવિજનોને તેં જે શુભ અધ્યવસાયનાં દાન કર્યા તેથી સામેથી કુદરત પાસેથી તેં ભવિષ્યમાં ઉચ્ચ કોટિનાં શુભ ભાવોલ્લાસ મળવાનાં રિજર્વેશન કરાવી દીધાં ! આ તારી કેવી કુનેહ ? તારે તો જીવનભરનાં સુખદ સંભારણા. અને જિનભક્તિની અનુમોદનાની મૂરી ઊભી થઈ ગઈ. સુકૃત કર્યું એકવાર પણ અનુમોદના વારંવાર...’

પૂજ્યપાદશ્રીની કૃપા અને પ્રેરણાએ મારા જીવનમાં ધર્મસંચાર કર્યો.

એ ઋણ ક્યારે ચુકવાશે ? શિબિરે કેવો મહાન ઉપકાર કર્યો ? એક નાની પ્રેરણાએ કેટલું બળ આયું ? શિબિરે તો મારા જેવા પંગુને પણ પહાડ ચડાવી દીધો જાણો !

:: અનુક્રમણિકા ::									
ક્રમ	વર્ષ	અંક	વિષય	પે.નં.	૧૮.	૨૦	૧૨	બે અમેરિકનનું દેખાન્ત	૧૩૨
			કષાય રોકો : છૂટવાનો મોકો						
૧.	૧૯	૪૦	પંડિતપુત્ર આગળ શું કરે છે ?	૧	૧૯.	૨૦	૧૩	અરિંહંત પ્રભુનો જ અનન્ય ઉપકાર કેમ ?	૧૪૦
૨.	૧૯	૪૧	પંડિતપુત્રનો પશ્ચાત્તાપ	૬	૨૦.	૨૦	૧૬	ધર્મપરિણાતિનો જંગી પ્રભાવ	૧૬૫
૩.	૧૯	૪૧	પંડિતપુત્રની વિક્રિ	૧૦	૨૧.	૨૦	૧૭	શાસ્ત્રકથન શું કહે છે ?	૧૬૬
૪.	૧૯	૪૩	મંદિરમાં અનુમોદવાનું કેટલું બધુ મળે ?	૨૨	૨૨.	૨૦	૧૭	વિવિધ નિમિત્તોમાં રાગાદિથી કેમ બચાય ?	૧૭૨
૫.	૧૯	૪૩	જિનમૂર્તિ વગેરેનો સાચો રાગ શું કરે ?	૨૪	૨૩.	૨૦	૨૦	અનોપભાઈ શ્રાવક	૧૮૩
૬.	૧૯	૪૩	પ્રશ્નસ્તના રાગ કેમ વીતરાગ બનાવે ?	૨૫	૨૪.	૨૦	૨૧	પ્રથમ સત્ત્વ કેળવો	૧૮૬
૭.	૧૯	૪૪	તામસભાવ ટાળવા ઊ ઉપાય	૨૮	૨૫.	૨૦	૨૧	સત્ત્વ વિકસાવવા શું કરવું ?	૨૦૦
૮.	૧૯	૪૫	મહાપુરુષોને કષે	૩૬	૨૬.	૨૦	૨૨	અનુબંધ એટલે ?	૨૦૮
૯.	૧૯	૪૫	જિનવચનની આરાધના એટલે ?	૪૨	૨૭.	૨૦	૨૪	ધાર્મિક વાંચનની જરૂરિયાત	૨૨૬
૧૦.	૧૯	૪૫	ગૌતમસ્વામીએ જિનવચનની આરાધના કરી	૪૦	૨૮.	૨૦	૨૬	વાંચેલાનો પ્રયોગ જીવનમાં	૨૩૬
૧૧.	૧૯	૪૭/૪૮	કિંમતી આત્મવીર્ય કચાં ખરચાય ?	૬૭	૨૯.	૨૦	૨૭	એકાદ પણ ધર્મસાધનાને મજબૂત પકડો	૨૪૮
૧૨.	૨૦	૧	જિનવાણીની શી શી કદર	૭૫	૩૦.	૨૫	૩૬	લક્ષ્મણના ઉદાર બોલ	૨૫૬
૧૩.	૨૦	૩	સત્ત્વવિકાસની ચાવી	૮૮	૩૧.	૨૫	૩૭	જીવને શિખામણ	૨૭૦
૧૪.	૨૦	૫	સંસારમાં કેવી કેવી વિટંબળાઓ	૧૦૦	૩૨.	૨૫	૩૮	ક્ષમા રાખીએ એમાં આપણું સત્ત્વ વિકસે છે.	૨૭૮
૧૫.	૨૦	૮	બુદ્ધિકોશમાં શું રોપશો ?	૧૧૧	૩૩.	૨૫	૪૪	મોડા સૂર્ય મોડા ઊદવાનાં તુકશાન...	૩૦૩
૧૬.	૨૦	૧૧	પ્રતિકૂળમાં પાંચ આધ્યાત્મિક અનુકૂળતા	૧૨૩					
૧૭.	૨૦	૧૧	લલિતાંગનું દેખાન્ત	૧૨૯					



કષાય રોકો : છૂટવાનો મોકો

(ગતાંકથી ચાલુ.....)

પંડિતપુત્ર આગળ શું કરે છે ? :-

જુઓ સંતાનને હિતની વાત કહેવાનું મનોબળ કહ્યું એના પર પેલું દાખાંત પૂરું જોઈ લો. બ્રાહ્મણનો દીકરો પંડિત થઈને આવ્યો, અને એને અભિમાન આકંઠ ભરેલું છે. એને બાપ તરફથી પંડિત તરીકેની પ્રશંસા જોઈએ છે, પણ બાપે કહ્યું ‘મૂર્ખ.’

છોકરો બાપને બતાવી આપવા નગરમાં વાદ કરવા માંડ્યા, એમાં જીતવા માંડ્યો; એમ શાળા ચલાવી વિદ્યાર્થીઓને પંડિત તૈયાર કરવા માંડ્યો. લોક આવીને પ્રશંસા કરે છે. પછી છોકરો બાપને કહે છે, ‘જોયું ? લોકો કેવી પ્રશંસા ઠાલવે છે ? બોલો હું મૂર્ખ કે વિદ્વાન ?’

બાપ કહે ‘મૂર્ખ.’

છોકરો કહે ‘હું મૂર્ખ ? કેમ ?’

બાપ કહે, ‘એટલા જ માટે.’

છોકરો હવે ધૂઆપુંથાં થઈ ગયો; બાપની સામે ગુસ્સાથી આંખ ચડાવે છે, હોઠ ફફડાવે છે. બાપ મનોબળવાળો છે, જરાય મચક નથી આપતો. એ જુએ છે કે ‘આમે ય આને વિદ્યાનો આફરો તો ચડ્યો જ છે, અભિમાનમાં તણાઈ રહ્યો છે, પવિત્ર વિદ્યાને માન-કષાયરૂપી ચંડાળને વેચી મહાન અહિત આચરી તો રહ્યો છે, એમાં જો હું ટેકો પૂરું તો તો પછી એને આ મહાન અહિતમાંથી કોઈ પાછો વાળનાર નથી. ઉલ્લંઘ એ વધુ અભિમાનમાં ચડશે. ત્યારે હું જો એમાં ટેકો ન પૂરું તો એના અભિમાનમાં ખીલી લાગશે, કંઈક માન ઓદ્ધું ચડશે. માટે મારે ખોટી શેહમાં તણાવું નહિ.’

અભિમાન માટે કાંટો :-

બાપે શું જોયું ? અભિમાનમાં ટેકો ન મળે એ અભિમાન માટે એક શલ્ય છે, કાંટો છે, તે અભિમાનને સીધું ચાલવા ન હે. પગમાં કાંટો પેઢો હોય તો સીધું ચલાય નહિ ને ? એમ અભિમાનીને એક જગાએ પણ જો માન ન મળે તો એને એ શલ્યની જેમ ખૂંચે છે; તેથી અભિમાન ઘવાય છે. જો બધે જ માન મળી જાય તો અભિમાન ઉછળવા-દોડવા લાગે છે.

આપણાં અભિમાનનું પણ એવું જ છે, એને બધેથી માન ન મળે એ જ સારું; તો જ એ કંઈક પણ મોળું રહે, નહિતર તો એ ફાલે ફૂલે છે. પછી અનર્થનો પાર

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“કષાય રોકો : છૂટવાનો મોકો ?” (ભાગ-૪૪)

નહિ. માટે જ જ્યાં માન ઓદ્ધું મળે ન મળે, અપમાન મળે, ત્યાં મુંજાવાની જરૂર નહિ. સંતોષ માનવાનો કે ‘સારું છે, મને અભિમાન ચડશે નહિ, વધશે નહિ.’

કષાયોને રોકવા છે ? દબાવવા છે ? નાથ કરવા છે ? કે એને સારી રીતે પોષી તગડા બનાવવા છે ? જેને સંસારનો ખરેખર ભય હોય એણે કષાયોનો ભય રાખવો જ પડે; સંસારનો ખરેખર ઉદ્દેગ હોય એણે કષાયો થઈ જાય ત્યાં ઉદ્દેગ કરવો જોઈએ, અને માન આદિ કષાય ઘવાય ત્યાં ખુશ થવું પડે. સંસારની જડ કષાયો. સંસાર ન જોઈએ તો આ કષાયજડને મજબૂત કેમ કરાય ? એને પાણી કેમ પવાય ? એ કષાયોને પોષી પોષી તગડા કેમ કરાય ?

જીવનમાં સાધના કરવી છે ? હા, શાની સાધના ? સંસાર-યાત્રાની નહિ, મોક્ષમાર્ગની. તો આ કરવા જેવું છે કે જ્યાં આપણા કોધ વગેરે કષાયોને પોષણ ન મળે ત્યાં ખુશી ઊભી કરવી. લોભ કરવા ગયા ને ધાર્યું ન મળ્યું, ન સચ્ચવાયું, ત્યાં આનંદ માનવાનો કે ‘સારું થયું કે આ લોભ સફળ ન થયો. નહિતર એ તગડો થાત, ને એ સફળતા ઉપર આત્મા ભાનભૂલો બનત; એમાં વળી વધુ લોભ કરવા જત, ને કદાય કર્મની તમાચ ખાત. માટે લોભ ઘવાયો એ સારું થયું.’

એમ કોધ કરવા ગયા, પણ સામેથી લપડાક પડી, કોધ સફળ ન થયો, તો ખુશી માનવાની કે ‘સારું થયું, હવે એકદમ કોધ ધમધમાવતાં વિચાર પડશે. આમ જ્ઞાનીના વચનથી કોધ ન કરવાનું સૂઝતું નથી, તે આણે સુઝાયું એ સારું થયું.’ આવડશે આ આનંદ માનવાનું ? ભૂલશો નહિ, આ ઊંચા માનવભવમાં જ આની સોનેરી તક છે. સીધેસીધા કષાયને ન રોકતા હોઈએ, પણ સંયોગો એના પર ઘા કરે, એમાં કષાય ઘવાય, એનો આનંદ માનવાની સોનેરી ધર્મસમજ આ ભવમાં જે કરી શકાય એવી બીજે કરવી મુશ્કેલ પડશે.

બીજી દાન-ત્રત-તપસ્યા વગેરે સાધના કદાય ઓછી થતી હોય, પરંતુ કષાયો પર ઘા પડવાના અવસરે આનંદ માનવાનું કરાય એ એક મહાન સાધના છે. એથી કષાયો મંદ પડશે.

આ કરી શકાય ને ? કરો છો ? ના, હવે કરવી છે ?

પેલો પંડિતપુત્ર બિચારો જિનશાસન પામ્બો નથી, તેથી આ સાધના ક્યાંથી કરી શકે ? બાપ તરફથી એનું અભિમાન ઘવાય છે એમાં આનંદ શી રીતે માની શકે ? એને તો બાપ પર દ્વેષ વધતો ચાલે છે. એ વધતાં વધતાં એટલો વધતો ચાલ્યો, બાપ આમ તો મૌન રાખે છે, પરંતુ કોઈ વાદમાં પુત્ર જતી આવે અગર કોઈ આવીને એની પ્રશંસા કરે, ત્યારે એ બાપને પૂછે છે ‘કેમ ? જોયું ને ? કહો હવે લાગે છે કે હું ભાષ્યો દું ?’ આમ બાપના મોંઢામાં આંગળા ઘાલી બોલાવે છે.

૨ લુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પંડિતપુત્ર આગળ શું કરે છે ?” (ભાગ-૪૪)

ત्यां बापनो जवाब एक ज छे के ‘मूर्ख;’ तेथी दीकराने द्वेष वधतो जाय छे, ते एटलो बधो वधी पड्यो के हवे ऐना मनने ओम थाय छे के ‘आ ते मारो बाप छे ? के वैरी राक्षस छे ? आम ने आम मने खतम करशे. माटे हवे तो हुं ऐना दम ज पूरा करी दउं.’

कोध कथाय अने क्यां सुधी ताडी गयो ? आट-आटली विद्या पामी आव्या पध्नी कथायने ओष्ठा करवाना के वधारवाना ?

शान-विद्या-बोध-केणवङ्गी-समजदारी शाने कहेवाय ? कथायो-कोध-लोभ मद-मायाने पावरधा करे अने ? के भोगां पाडे अने ?

अक्कलवानपाण्युं जनावर जेवा कथाय करवामां ? :-

जनावरने तो समजदारी नथी, बोध नथी, केणवङ्गी नथी, एटले ए तो कथायने अवसर भणे त्यां त्यां पोष्या करे पावरधा राख्या करे, परंतु मानवनी कक्षा य जनावर जेटली ? बोध-केणवङ्गी-समजदारी पाम्या पध्नी पाण जनावर जेटला कथायमां राचवानुं ? शान-विद्या-केणवङ्गी-समजदारी तो अनुं नाम के जे कथायो पर अंकुश करावे, खामोश, नम्रता, सरणता, संतोष, त्यागवृत्ति वधारता रहेवानुं करावी ज्ञवननुं उत्थान, आत्मानुं उधर्विकरण सधावे. आज जे डिग्री ने केणवङ्गी पर ओवारी ज्ञाओ छो एमां क्यांय आ शीखवानुं भणे ? जाते जे समजदारी अक्कलवानपाण्युं अने बुद्धिशाणीपाण्युं माथे लઈने फरो छो त्यां ए विचार शुं आवे खरो के ‘आनो उपयोग हुं मोहना-कथायना शोभणमां कुं दुं खरो ? के उलटुं वधु होशियारी पर वधारे कथायनां पोषण कुं दुं ?

पंडितपुत्र बापने मारवा जाय छे :-

पेलो पंडितपुत्र एक रात्रे उळ्यो, तलवार हाथमां लीधी अने चाल्यो बापनां शयनघर तरफ. त्यां अने मात-पिता वातचीत करता लाग्या. ए ओरडाना भहारना भागे उभो रही गयो, सांभणे छे.

पंडितनी माता बापने कही रही छे, ‘तमे आवा सारुं भशेला छोकराने मूर्ख कहो छो ते अनुं दिल केटलुं घवाय ?’

बाप कहे छे, ‘शुं हुं नथी समजतो के अना दिलने हुःभ लागे ?’

‘तो पध्नी शुं काम अेवुं बोलो छो ?

मूर्ख कहेवा पाइण रहस्य :-

एटला ज माटे के अने अभिमाननुं झेर न यडी जाय.’

‘ते अभिमान कोने नथी ? माणसमात्रने अभिमान तो रहे छे.’

बाप कहे, ‘अभिमान रहे खरुं, परंतु ए राखवा जेवुं छे ? तने खबर

नथी के अनी मात्रा वधी जतां ए माणसने केवो झुवार करी नाखे छे ? रावण-हुर्योधन वगेरे अभिमानमां खतम थई गया. आ तारो दीकरो सारुं भडी आव्यो छे ए हुं ज्ञाणु दुं, अने एटले ज मने अना पर भोटी आशा रहे छे के आ विद्वता-पंडिताईथी पोतानुं ज्ञवन उन्नत बनावे, शास्त्रोभांथी एझो तत्व ज्ञायु छे, एटले अने आत्मगुणो-सुकृत-सदनुष्ठानो आचरवा सहेला अने उचिकर. तेमજ बीजा पाण अनेकोने ओमां चडाववा माटे अने सरणता छे. अम ए स्वपरनो उद्धारक थाय एवी सुंदर विद्या पाम्यो छे. अथी ए भहान तत्वचिंतक अने शास्त्रलेखक बनी शके अम छे. माटे अनी विद्वता पर मने दिलमां घडो आनंद अने उछरंग छे. किन्तु ए अभिमानमां तशाय छे तेथी आवा उत्तम लाभ गुमावी रह्यो छे. आम ज्ञवनभर अभिमान पोषतो अने वधारतो रहे एटले सातेस सात. स्वपरनां कल्याण साधवानो कशो लाभ ए पामी शके नहि.

अभिमान पर सत्यानाश :-

विद्या छे एटले लोक मान तो आप्ये जवानुं. अमां ए अभिमान पोषतो रहेवानो. ओमां ज्यां आनी सामे बीजो कोई विद्वान आव्यो तो आ बणशे, पेलाने उतारी पाडवा मथशे, हलको पाडी झुशी थशे, पेलो कोई कदाच अथी अहीं आज्ञविका नहि पामी शके अनी आने दया नहि रहे एटले पोतानी विद्वताथी बीजाना पेट पर पाठु मारशे. आमां क्यां य आत्मानुं लक्ष ? आत्माना गुण सचवाया ? त्यारे ज्यां पोताना आत्मानुं-आत्मगुणोनुं लक्ष नहि, त्यां पध्नी ए बीजाने आत्मानुं अने आत्मगुणोनुं शुं लक्ष सधावी शके ? अभिमानी विद्वान तो बीजाओने विद्या आपे अमां य पोताना अभिमाननो दाखलो देखावानो, अने कहेतो रहेवानो के ‘भजो भजो, सारुं भजो, एटले विद्वान थशो, तो बीजाओ तमने मान-आदर आपशे. पैसा सारा कमाशो अने अथी पण लोकमां शेठ तरीके पूजाशो.’

त्यारे जे विद्याथी आवां अभिमाननां झेर चडतां होय, तो ए विद्वता आवी गणाय के मूर्खता ? अभश माणसने आवां झेर न यडे; अभिमानी विद्वानने ए यडे अने ए झेरथी ज्ञवनमां अनेक दोषो- दुष्कृत्यो पोषाय एटले ज्ञवन अशांति-अञ्जपा-उक्खाट भर्यु भने, भरण वधते य भगवान न सांभरे, त्यां य अभिमानमां तशायो वलोपात करतो होय, अने परभवे आ अभिमान अने अना पर उभा थयेला दोष-दुष्कृत्योथी दुर्गतिमां भटकनारो भने. कहे आट-आटला अनर्थ नीपज्ञवानुं केम भने छे ? विद्याथी अभिमान पोषवाना लीधे ज ने ? तो अने विद्वता पंडिताई कहेवाय के मूर्खता ?’

બ્રાહ્મણપત્ની આ સાંભળીને સજડ થઈ જય છે, કહે છે, ‘ખરી વાત તમારી, તમારી દીર્ઘદિશિ છે. આ જોતા તો લાગે કે તમો એનું મહાન હિત વિચારી રહ્યા છો...’

પંડિતપુત્રને મહાપીડા :-

માતા આ જ્યાં બોલે છે એટલામાં બહાર પેલો પંડિતપુત્ર જ્યાં ઊભો છે ત્યાં પાછળથી એક સાપ નીકળ્યો અને એને પાછળથી ડંસ મારી ચાલ્યો ગયો. જ્યાં સાપે ડંસ માર્યો કે તરત જ પંડિત ‘હાય ! સાપે ખાધો,’ એમ ચીસ પાડતાંક પડ્યો નીચે.

કષાય અને ચડસ પાછળ પછાડ ખાવાની આવે ? :-

બોલો અભિમાન ક્યાં રહ્યું ? બાપને મારી નાખવાનો ચડસ ક્યાં ઊભો રહ્યો ? શું તમને દુનિયામાં કોધવાળા અભિમાનવાળા કે, માયા લોભવાળા પછાડ ખાતાં જોવા નથી મળ્યા ? તો એક યા બીજા પ્રકારની ખોટી ચડસવાળા ચડસ પૂરી ન કરી શક્યા અને પૈસે પાયમાલ, શરીરે પાયમાલ, કુટુંબે પાયમાલ થયેલા કે મરી ગયેલા એટલે ચડસ માત્ર એમના મનમાં જ રહી ગયેલો, એવું જોવા નથી મળ્યું ? આ જોઈને શું આપણાને શિખામણ ન મળે કે ‘હું આ જાલિમ કષાયોમાં તણાયો શો સાર પામવાનો ? ખોટી ચડસ રાખ્યે ધાર્યું શું કરી શકવાનો ? શું કષાય અને ચડસ પછાડ નહિ ખવરાવે ?’

પેલો પંડિતપુત્ર બહાર ચીસ પાડતાંક જ્યાં પડ્યો નીચે કે તરત માબાપ એકદમ સફાળા ઊભા થઈ બહાર આવ્યા. બાપે તરત જ ડંખના ભાગ પર લાગેલો છોકરાનો હાથ ઊઠાવી ત્યાં જોરથી બચું ભરી માંસનો લબરકો બટકી લીધો અને બહાર થૂંકી કાઢ્યો, જેથી ઝેરુક્ત ડંખ બહાર નીકળી જાય. બીજી બાજુ નગરમાંથી ગારુડી મંત્રવાળાને બોલાવી લાય્યો અને બેભાન છોકરાનું માથું ખોળામાં લઈને બેઠો છે. માંત્રિક મંત્ર ભણી ભણી શરીરમાં પ્રસરેલું જેર ઉતારી રહ્યો છે. પુણ્ય જાગું એટલે ઝેર ઊતરી ગયું.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૧૯, અંક-૪૧, તા. ૨૪-૭-૧૯૭૧

જ્યાં જેર ઊતરી ગયું ત્યાં પંડિતપુત્ર આંખ ખોલી જુએ છે તો બાપના ખોળામાં પોતાનું માથું છે, પોતે સૂતો છે. ક્ષણભર કંઈ યાદ ન આવ્યું કે આ શું બની ગયું છે; એટલે પૂછી છે.

‘પિતાજી ! કેમ મને આમ સુવાડ્યો છે ? શું બન્યું છે ?’

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો: ધૂટવાનો મોકો”(ભાગ-૪૪)

બાપ સમજે છે કે ‘આને કદાચ સહેજ પણ જેર રહ્યું હોય તો સર્પ ઉસવાનું યાદ કરાવતાં ફેલાઈ સીધું હૃદય પર અસર કરતાં મોત જ પામે, અથવા જેર ન પણ હોય તો ય સર્પદંશ અચાનક સાંભળતાં હૃદય પર આધાત લાગી જાય,’ તેથી સર્પની વાત ન કરતાં કહ્યું ‘આ તો તને મૂર્ખ્ય આવી ગયેલી હતી તેથી તને ભાનમાં લાવવા બેઠા હતા.’

પંડિતપુત્ર યાદ કરે છે ‘મને મૂર્ખ્ય કેમ આવી ?’ એમાં પેલો સર્પદંશવાળો માંસનો ભાગ બટકાઈ ગયેલો ત્યાં બળે છે, તેથી એના પર ધ્યાન લગાવતાં ખ્યાલ આવ્યો કે ‘મને કાંઈક કરેલું.’ ‘શું...શું...શું કરેલું ?’ એ વિચારતાં સર્પ ઉસ્યાનું ધ્યાનમાં આવ્યું, અને પોતે શું કરવા આવ્યો હતો તેમજ માતા પિતા શી વાત કરતા હતા તે પણ ખ્યાલમાં આવી ગયું.

પંડિતપુત્રનો પશ્ચાત્તાપ :-

હવે ? હવે શું ? અભિમાન અને પિતા પર દ્રેષ ઓગળી ગયો. એને પારાવાર પસ્તાવો થઈ રહ્યો છે, ઊઠીને પિતાના પગમાં માથું મૂર્ખી ગદ્ગગદ સ્વરે કહે છે,

‘બાપુ ! બાપુ ! હું હુષ્ટ છું, નરાધમ છું, પાપાત્મા છું તમે મારી પાસેની તલવાર તો જોઈ જ હશે, હું શેતાન બન્યો હતો. તમે મને મૂર્ખ કહેતા તેથી મને ગુસ્સો વધી જતાં મેં તમારું ખૂન કરવા પ્રયત્ન કરેલો. કેટલો બધો હું નીચમાં નીચ ? તમો બંનેની વાતચીત મેં સાંભળી ત્યારે મને લાગ્યું કે ‘અહો ! આ પિતાજી તો દેવાંશી અવતાર છે. એમણે મૂર્ખ કોણ અને વિદ્વાન કોણ એની સુંદર સમજ આપી; અને મને મૂર્ખ કહેતા હતા તે પણ હું કારમા અહિતથી બયું અને મહાન સ્વ-પર-કલ્યાણના માર્ગ ચુંએ જ એક શુદ્ધ ભાવનાથી મને મૂર્ખ કહેતા હતા.’ તમોએ મારી માતાને કરેલા ખુલાસાથી લાગ્યું કે હું ખરેખર મૂર્ખ છું. આપ તો મારા અનુપમ હિતૈથી પરમ ઉપકારી; ત્યારે મેં તમને જાનથી મારી નાખવાનો વિચાર કર્યો, વિચાર કરીને બેસી ય ન રહ્યો, મેં નરાધમે એ માટે પ્રયત્ન કર્યો મારા જેવો પાપી નીચ કોણ હશે ? કુદરતે પણ મને જાણો સજા કરવા સાપ પાસે ઉસાયો. હું મરી કેમ ન ગયો ? મારા જેવા પાપીને જીવવાનો હક શો છે ? મારા જેવા પાપાત્માથી ધરતી ભારે થતી હતી, તો આપે મને શું કામ જીવતદાન આપ્યું ? પરંતુ સજજન તે સજજન; ચંદનને ગમે તેટલું લસોટો પણ એ ઠંડક જ આપે. તેમ આપે મારી બધી નાલાયકીને ગળી જઈ સાપના જેરમાંથી બચાવ્યો ! મારા જેવા નાલાયકનું માથું ખોળામાં લઈ બેઠા ? કેટલું બધું વાતસ્ય ? કેટલો ગજબ ઉપકાર ? આવા ઉપકારીનું બૂનું ચિંતવી મારે માથે અતિ દુષ્ટ વિચારણાનાં પાપનાં કેટલાં પોટલાં ? હે ભગવાન ! મારું શું થશે ?...’ એમ

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પંડિતપુત્રનો પશ્ચાત્તાપ”(ભાગ-૪૪)

બોલતાં બોલતાં રડી પડ્યો; આંખેથી પાણી ટયકે છે,

રોતાં રોતાં કહે છે, ‘પિતાજ ! માફ કરો, મારાં પાપનું પ્રાયશ્ચિત્ત કરાવો. મારાં પાપની મારી અધમતાની હંડ નથી.’

પાપનું મૂળ પહેલાં કાઢો : વિચિત્ર ઉપાય :-

બાપ કહે છે, ‘જો આ પાપનું મૂળ અભિમાન છે. એ મૂળ કાઢી નાખે તો જ પછી પાપનું પ્રાયશ્ચિત્ત થાય. જો અભિમાન ઊભું રહેશે તો ફરી નવાં પાપ જાગશે.’

‘પણ અભિમાનનું ભયંકર કાર્ય જોઈ મેં હવે એને ઉતારી નાખ્યું છે. છતાં આપ કહો તેમ કરું.’

બાપ કહે, ‘જો એમ તત્કાળના પશ્ચાત્યાપમાં લાગે કે અભિમાન ઊતરી ગયું. પરંતુ એનો વિશ્વાસ ન રખાય. માટે એક કામ કર. તું વેશ બદલીને જ્યાં તારી સગાઈ થઈ છે ત્યાં નોકરીએ જા; જ માસ નોકરી કરી આવ; પણ સાસરે તો જમાઈને મોટાં માન મળે. ત્યાં જ જો નોકરપણું કરી આવે તો અભિમાનને ધા લાગે. પણ જો ધ્યાન રાખજે કે તારી ભાવિ પત્ની સામે દણ્ણ પણ ન નાખીશ, કે એ સાસરિયા ધરમાં જરાય તારી સહેજ પણ ઓળખાજા કે વિદ્વત્તા ન દેખાડીશ. એટલી તૈયારી હોય તો જા ! બાપે કેવો વિચિત્ર ઉપાય બતાવ્યો, ને સાથે સાવધાની કેવી આપી ?

બાપ સમજે છે કે દારુ ને દેવતા બે ભેગા ન કરાય; પરંતુ જ્યાં જમાઈરાજ તરીકે સહેજે મોટાં માન મળે એમ હોય ત્યાં એ ઢોરાં ચારવા, ઝાડુ કાઢવું, વગેરેની નોકરી ભરી આવે, તો એનાં અભિમાનના ફૂર્યા ઊંડે. એટલે એ સમજ એને આપીને કહે છે, ‘જોજે હોં માનની જેમ કામથી પણ બચજે. નજર સામે તેં કરેલ પિતૃહત્યાના પ્રયત્નના ઘોર પાપને રાખ્યા કરજે, તો પિતૃઆજ્ઞા બરાબર પળાશો !

બાપે કેવો વિચિત્ર ઉપાય બતાવ્યો ? એ જુએ છે કે આ આમ મોટો પંડિત છે, વિદ્વાન છે, અનેક વિદ્યાર્થીઓના ગુરુ તરીકેનું માન મેળવે છે, એમાં જો આવી ઢોરાં ચારવા, ઝાડુ કાઢવું, વાસણ માંજવા વગેરેની નોકરી જો ભરે, તો એના દિલમાંના અભિમાનના ફૂર્યા ઊંડે; અને પાપનું મૂળ અભિમાન જો ધસારે પડી ગયું, તો પછી ભવિષ્યમાં પાપો પેસવાની જગા નહિ.

પાપોનાં ડાળ-પાંખણાં અભિમાનનાં મૂળ પર આવે છે, ઊગે છે.

આજે તો કેળવણી જ એવી અને એવી રીતે અપાય છે કે અભિમાન પોષાતું જ રહે. એના પર દેખો છો ને કે કોલેજ સુધી પહોંચેલા વિદ્યાર્થીઓ ય કેવાં તોફાન મચાવે છે ? સ્કૂલના વિદ્યાર્થીઓથી ય માસ્તરોને કેવા ડરતા ચાલવું પડે છે ? કેવી વાતવાતમાં હડતાલ પડાય છે ? એવા છોકરા ધરે મા-બાપ પર

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂલવાનો મોકો” (ભાગ-૪૪)

પણ કેવા રોક મારી ધમધમાટ કરે છે ? કારણ ? અભિમાન.

અભિમાનના મૂળ પર અનેક દુષ્ટ્યોને ફાલવા-ફૂલવાનું મળી રહે.

રાણી અભયા અભિમાનમાં ચઢી કે ‘હું સુદર્શનને આમ પાડી દઉં. એ કપિલા બ્રાહ્મણીને બનાવી જાય, મને શું બનાવે ? ‘આવા અભિમાનમાં ચઢી તો પછી એ કેટલા દુષ્ટ્યે પહોંચી ? સુદર્શન શેઠને કપટ કરીને મહેલમાં લાવી મૂક્યા ત્યાં સુધી અભિમાનની વાત હતી, પરંતુ જ્યાં એકાંતમાં રાતના રૂપાળા સુદર્શન શેઠને જોયા એટલે હવે ખરેખર કામાંધ બની ગઈ, ને ભોગની પ્રાર્થના કરે છે, કેટકેટલા હાવભાવ ને ચાળા કરે છે, મનામણાં કરી રહી છે. કામાંજિનથી સળગી ઊઠી ભાનભૂલી બની છે. પણ પવિત્ર સુદર્શન શેઠ નિર્વિકાર છે, પોતાના ધ્યાનમાં મસ્ત છે, ચામડાની રમતને ગલીચ ગંદી ગદ્વા જેવી અધમ સમજે છે.

અભયા કેમ ભૂલી પડી ? મૂળ અભિમાનનું પાપ પછી ઘોર દુષ્ટ્ય સુધી પહોંચ્યાએ છે. પંડિતપુત્ર ભૂલ્યો હતો ને ? અભિમાન પર બાપને મારી નાખવાના પ્રયત્ન સુધી પહોંચ્યો હતો ને ? માટે જ બાપ કહે છે ‘પાપોનું મૂળ અભિમાન પહેલાં સાફ કર.’

‘તસ્સ ઉતારી’માં બોલો છો ને ‘વિસોહીકરણેણ વિસલ્વીકરણેણ’ ? શા માટે ? આ જ કે પાપોનાં મૂળને ઊઘેડી નાખવું છે, એવી વિશુદ્ધિ કરવી છે, એવાં શાલ્ય ઊઘેડી નાખી વિશાલ્ય બનવું છે કે જેથી મૂળ સાફ થઈ જાય. દોષ-દુષ્ટ્યો સેવાઈ જાય એના પશ્ચાત્યાપની સાથે આ કરવા જેવું છે કે એનાં મૂળ પાપનો ય ભારે પશ્ચાત્યાપ સળગે, ને એ ઊઘેડી નખાય.

પંડિતપુત્રને બાપે મૂળ પાપ અભિમાન ઊઘેડી નાખવા માટે સાસરે ગુપ્તપણે નોકરી ભરવાનું બતાવ્યું.

પંડિતપુત્ર પછીથી તથાસ્તુ કહીને ઊપજ્યો સાસરે. સસરાએ આના વિદ્યાર્જન માટે બહાર ગયાના સમયે પોતાની કન્યાની સગાઈ કરી છે, એટલે એને દીઠે જોયો નથી. વળી આ ગરીબ નોકરનો વેશ કરીને ગયો છે, તેથી ય ઓળખાય એવો નથી. પંડિત ત્યાં જઈને નોકરીએ રહ્યો. ઢોર સંભાળે છે, ઘરનું વાસીદું સંભાળે છે, વાસણ માંજે છે. નોકર માણસ થઈને રહ્યો છે તેથી ક્યારેક ટોણાં ઠપકાં પણ સાંભળવાના આવે છે. માન તો કશું મળતું જ નથી.

પ્ર.- આ સહન થાય ?

૩.- પરંતુ નજર સામે પેલું પિતૃહત્યાના પ્રયત્નનું ઘોર પાપ અને સર્પદંશમાંથી મળેલું જીવતદાન તરવરે છે, તેથી અભિમાન ઊછળી આવતું નથી, તેમ કન્યા તરફ દણ્ણ પણ જતી નથી; તો વાતચીત તો શાની જ હોય ?

૮ લુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પંડિતપુત્રનો પશ્ચાત્યા ” (ભાગ-૪૪)

પ્ર.- આવો પંડિત આટલો બધો વિદ્વાન આવાં હોર સંભાળવા, વાસીઓં કાઢવા, ઠપકાં સહન કરવા એ કેમ કરી શકે ? તેમ ભાવી પત્ની બનનાર કન્યા સાથે સહેજ વાત પણ નહિ કે દાણિ પણ નાખવાની નહિ, એ કેમ કરી શકે ?

ઉ.- કરી શકવામાં એક જબરદસ્ત સમજ એની પાસે છે. સમજ આ જગતી છે કે, વાસના-અભિમાન કઈ સમજ પર અટક્યા :-

જીવ ! ધ્યાન રાખજે. તું સર્વ ઉસ્યાથી જો મરી ગયો હોત, તો તો આ ભાવી પત્ની સાથે સ્નેહની વાતચીત તો શું, પણ અભિમાન, પિતા પર દ્વેષ, એમને મારી નાખવાનો ધોર પ્રયત્ન, વગેરે કારમા પાપ ધોવાની તેમજ બીજાં પણ સુકૃત કરવાની તક જ હાથમાંથી ગઈ હોત એટલે આ તું જીવતો રહ્યો છે તે (૧) પાપ કરવા માટે નહિ, કિન્તુ પાપ ધોવા માટે, (૨) સુકૃત આચરવા માટે, ને (૩) વાસના-અભિમાનથી બચવા માટે.

જો આ માટે જ જીવતો રહ્યાનું સમજું છું. તો મારે આ જ કરવાનું.’

આવી પાકી સમજ રાખી હોવાથી હવે એ શાનો અભિમાનમાં ચેડે ? કે અયોગ્ય રીતે વાસના વિકસાવવા પોષવામાં પડે ? સ્ત્રીજીત પર દાણિ નાખવાથી વાસના ઉશ્કેરાય છે, વિકસ્વર બને છે. વિદ્વતાનું હુંપદ રાખવાથી બહાર અભિમાન ઊંઘળી આવે છે. આને આ કશું કરવું નથી. આને તો એક જ લેશ્યા છે કે માનવ તરીકે જીવતો રહ્યો છું તે પાપ ધોવા અને સુકૃત કરવા માટે. હવે એ શું કામ લલચાય ? શું કામ ઢીલો પડે ? મન આ લેશ્યા પર મજબૂત બની ગયું છે, તે મહિનાઓ પસાર થાય છે પણ ક્યાંય અભિમાન કે કામવાસનાને ઊઠવા દેતો નથી, એનો વિચાર જ કરતો નથી. છોકરીની સાથે એકાંત જ આવવા દેતો નથી.

અભિમાન વગેરે પાપથી બચવું છે ? કામવાસનાને મારવી છે ? સુકૃતો સારાં આચરવાં છે ? તો આ એક એની મહાન ચાવી છે. આટલું યાદ રાખ્યા કરો કે ‘માનવ તરીકે જીવતો છું એ મારું અહોભાગ્ય છે, અને એ મહાન ભાગ્યોદય પાપ આચરવા ને વાસના પોષવા માટે નહિ, કિન્તુ જૂનાં પાપો ધોવા માટે છે, વાસનાને કયરવા માટે, ને સુકૃતો સદ્ગુણો ખૂબ વધારવા માટે છે.

તમારે જીવનમાં ક્યારેક સહેજમાં મોતથી બચી જવાના પ્રસંગ નથી આવ્યા ? રસે ચાલતાં આજે બેફામ રીતે દોડાવી જવાતી મોટર ટ્રકો, એમાં વળી ડ્રાઇવરો કેટલાક દાડુ પીનારા, એમ ક્યારેક અજાણતા કે અંધારે થતી માથે અથડામણી, ક્યારેક હુલ્લાદિયું વાતાવરણ, વગેરે વગેરે એક યા બીજા પ્રકારના અકસ્માતમાંથી આબાદ બચી જવાનું ક્યારેક તો બન્યું હશે ને ? તો એ યાદ કરીને વિચારાય કે ‘હું જો ત્યારે જાનથી ગયો હોત તો તો પછી પાપ ધોવાની અને મોહ

ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

તથા કષાયનાં શોષ કરવાની તક જ ક્યાં રહેત ? આ જીવતો રહ્યો છું તે એ શોષણ કરવા માટે; તેથી હવે એ જ કરું.’

પંડિતપુત્રનો ચમકારો :-

‘મોહ અને કષાયનાં પોષણ માટે નહિ, કિન્તુ શોષણ માટે જીવતો છું’ આ લક્ષ જગતું રહે, તો કોધના પ્રસંગ સાવધાન બની જવાય, અને એને દબાવવા માટે મન પાકું રહે.

પેલા પંડિતપુત્રને છ મહિના થવા આવ્યા, એક વાર એવું બન્યું કે ભાવી પત્ની પેલી કન્યા બીજી સખી સાથે તર્કશાસ્ત્રનાં તત્ત્વ પર વાદ કરી રહી હતી, એમાં એક પ્રશ્નમાં એ બંધાઈ ગઈ, ઉત્તર ન કરી શકી; ત્યારે ત્યાં ખૂઝો બેઠેલા આ પંડિતપુત્રને લાગ્યું કે ‘આ નકામી હારી જાય છે,’ તેથી એણે તરત કહ્યું ‘અહો ! આ પ્રશ્નમાં શું છે ? આનો આ ઉત્તર છે,’ એમ કહી ઉત્તર કહ્યો; ઉત્તર એવો કે એના પર પણી પેલી સખી પ્રશ્ન જ ન કરી શકી, અને પત્નીના પક્ષનું સારું સમર્થન થયું.

પંડિતનું આત્મનિરીક્ષણ :-

પરંતુ ભાવી પત્ની-કન્યા ચોંકી ઊઠી કે આવા નોકરમાણસમાં આટલી બધી વિદ્વતા ? પૂછે છે, ‘હેં ? તે તમે આટલું બધું ભણેલા છો ? કેટલું ભણ્યા ? ક્યાં ભણ્યા ?’

પંડિતપુત્રને લાગ્યું કે ‘આ મારી ભૂલ થઈ. મારે અભિમાન કરવાનું નહીંતું; પિતાજીએ પણ ના પાડી હતી; ને મેં આ શું કર્યું ? અભિમાનરૂપી સૂતેલા સાપને જગાડ્યો ? એનો દંશ ખાધો ? હવે પાછું આનું ઝેર કેમ ઉતારવું ? હવે જો અહીં રહું તો કોણ જાણો કેવી ય આપદા ઊભી થાય ?’ બસ, એ વિચાર કરી ત્યાંથી ઊઠીને ચાલી ગયો. અને સસરાને દેશમાં જવાનું કહી ઘરે પહોંચી ગયો.

બાપને જઈને પંડિતપુત્રે બધો અહેવાલ આય્યો. બાપ કહે ‘હવે તું મૂર્ખ નહિ, પણ ભણેલો, કે જેણે પોતાના આત્માને ઓળખ્યો, મોહ અને કષાયને ખતરનાક જાણ્યાં, સ્વાત્માનું હિત સાચવવા સાવધાની ઊભી કરી.’

પિતા આગળ પુત્રની આત્મવાણી :-

પુત્ર કહે છે, ‘મારું કરો પિતાજી ! હવે તો આપના પ્રતાપે મને દેખાય છે કે મારામાં મૂર્ખતા જ છે કે હું આ માયાના ઘરમાં જાણવા છિતાં બેસી રહ્યો છું. પણ આપની કૃપાએ હવે એમ લાગે છે કે આ હું સાપના ઝેરથી બચી જીવતો રહ્યો છું તે માયાની ગુલામી મૂકી મહાકૃપાણું પરમાત્માનાં જ ભજન-ચિંતન-મનનમાં લાગી જવા માટે. ક્યારે એ ધન્ય દિવસ આવે ! પુત્રે આત્મવાણી ઉચ્ચારી.

૧૦ સુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પંડિતપુત્રનો ચમકારો” (ભાગ-૪૪)

માતા અને પિતા બંને ય આ સાંભળીને અતિ પ્રસન્ન થયા. પછી તો પંડિતપુત્રની રીતમાત આખી ફરી ગઈ, અને એ મહાન જ્યાતિ પામ્યો.

સત્ત્વ ક્યાં ? :-

વાત આ હતી કે જીવનમાં શું લાવવા-વધારવા જેવું ? કખાયોના ધમધમાટ ? કે ક્ષમા-મૈત્રી આદિ સદ્ગુણો ? આહારાદિ સંજ્ઞાઓ કે દાનાદિ વૃત્તિઓ ? આ વાતમાં એ વાત આવી કોધાદિ કખાયો અને આહારાદિ સંજ્ઞાઓ પોષવા-વધારવામાં મનોબળ અને મનની શાંતિ હણાય છે, ત્યારે ક્ષમા-મૈત્રી આદિ સદ્ગુણો તથા દાનાદિની વૃત્તિઓમાં મનોબળ વધે છે, મનની શાંતિ વધે છે. પંડિતપુત્ર જ્યાંસુધી અભિમાન અને બાપ પર કોધવાળો હતો ત્યાંસુધી એનું મન નિર્બળ-સત્ત્વહીન હતું; અને જ્યાં નભ્રમાવ-લઘુભાવ તથા ખામોશી આવી, ત્યાં એમાં એના મનનું સત્ત્વ જાગવા માંયું.

પત્નીને વશ કરી ? કે પોતે વશ થયો ? :-

આ ખૂબ ધ્યાનમાં રાખવા જેવું છે કે કામ-કોધ-લોભ-માન-મદ-માયા વગેરેમાં ઉપરથી લાગે કે હું મનોબળિયો છું, પત્નીને વશ કરી લીધી;...પાડોશીને દબડાવી બેસાડી દીધો,'...પરંતુ ખરેખર તો એમાં મનનું સત્ત્વ હણી નાખ્યું. પત્નીના બહુ ચાળા વધાવી લઈ એને ખુશ કરવામાં પોતે એને વશ નથી કરી, પરંતુ પોતે એના વશ પડી ગયો. તો પછી એમ કામાંધ પત્નીને આધીન બનવામાં મનનું સત્ત્વ શું રાખ્યું ? મનોબળ ક્યાં દાખવ્યું ? એમ પાડોશી સાથે જગડી પડવામાં અને કોધ ધમધમાવવામાં ય આત્માનું સત્ત્વ શું જાળવ્યું ? મનોબળ કયું વાપર્યું ? એવા માણસો તો પછી તણખિયા કોલસા જેવા થાય છે, ક્યાંય જરાક વાંકુ પહ્યું ત્યાં જેમ તણખિયા કોલસાને અનિ મળતાં ફૂટ ફૂટૂ ફૂટ ફૂટ થાય એમ ધમધમ કરવા માંડે છે.

ત્યારે મનને શાંતિ કામ-કોધાદિ કરવામાં નથી રહેતી. ત્યાં તો મન અશાંત વિહ્લવળ-અસ્વસ્થ બને છે એ તો એનાથી પાછો ફરી શીલ-બ્રહ્મચર્ય-ક્ષમામૈત્રી આદિમાં આવે, તો મન શાંત નિશ્ચિંત સ્વસ્થ બને છે.

જીવનું જીતવાનું છે મનની શાંતિથી, મનના વલોપાત તો જીવાર પણ કરે છે, અને ધર્મ નહિ પામેલા નહિ સમજેલા અનાર્ય જેવા મનુષ્યો પણ કરે છે. તો આપણે પણ શું એજ કક્ષાએ જીવન જીવવાનું ? સમજદાર માણસોએ મનની શાંતિ માટે તો કેટલાય ભોગ આપ્યા છે. કેટલુંય જતું કર્યું છે.

સ્થૂલભદ્રજીએ શું જતું કર્યું ? મનમાની રૂપ-સુંદરી કોશાવેશ્યા પ્રેમ કરનારી મળી હતી, એટલે ભોગસામગ્રી ભારે; હવે રાજા મંત્રીપદ આપવા તૈયાર થાય છે, એ સત્તા-સન્માનની સામગ્રી કોશા વેશ્યા એટલે એ કાળમાં મોટા રાજા-મહારાજાને

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

આકર્ષે એવી રૂપસુંદરી હતી. પાછી એ બીજા સાથે તો પૈસા પૂરતો વેશ્યા-સંબંધ રાખતી, પરંતુ સ્થૂલભદ્રજીને જીવનપ્રાણ ગણતી. એવા દિલના સ્નેહ અને સુખ પીરસતી કે સ્થૂલભદ્રજી બાર વરસથી એને ત્યાં જ પહ્યા-પાથર્ય રહ્યા હતા. આવી કોશાને એકાએક જતી કરાય ? ત્યારે નંદરાજા દિવાન બનાવવા માગે છે એ મોટા સામ્રાજ્યના સંચાલક મંત્રી તરીકે. લ્યો શું બાકી રહ્યું ? એક બાજુ મોટા સત્તાધીશ બનવાનું મળે છે. અને બીજી બાજુ પ્રાણપ્રાણી કોશા મળી છે. આને જતી કરવાનું મન થાય ? વિચાર પણ આવે ? પરંતુ ના, અહીં તો છોડવાનો વિચાર પણ તત્કાળ અને અમલ પણ એ જ વખતે.

સ્થૂલભદ્રજીએ કેમ આ સત્તા-સુંદરી-સન્માનના મહાન સુખ જતા કર્યા ? કહો, મનની શાંતિ માટે. નંદરાજા કહે છે ‘લ્યો આ મંત્રી-મુદ્રિકા મંત્રીપદ સંભાળી લો.’ ‘સ્થૂલભદ્રજી કહે, ‘જરાક આલોચી આવું’ એમ કહી ત્યાં જ પાછળ વાડીમાં આલોચવા યાને વિચાર કરવા ગયા. શું વિચાર્યુ હશે એમણે ?

સ્થૂલભદ્રજીએ આવું જ કાંઈક વિચાર્યુ હશે કે ‘આ મંત્રીમુદ્રિકા શું સુખ અને શાંતિ આપી શકે ? જેણે પિતાજીના પ્રાણ લીધા એ મને શું પરખાવે ? ઠીક છે, રાજાને પોતાના અવિચારી કાર્ય બદલ ભારે પશ્ચાત્તાપ થયો છે તેથી હવે ભવિષ્યમાં ફરીથી એવું અવિચારી કાર્ય ન કરે; તો પણ મંત્રીપણાની કશી જ જવાબદારી ને કાર્યવાહી વિના કોશાની સાથે નિશ્ચિન્તતાથી જે સુખમાં મહાલી રહ્યો છું, એ મંત્રીપણાની ભારે જવાબદારી અને ધૂમ કાર્યવાહીમાં મહાલવાનું ક્યાં રહે ? ત્યારે આના પર હવે તો એ પણ વિચાર આવે છે કે કોશાની સંગતમાં ય ખરેખર શાંતિ ક્યાં છે ? એના રિબાવામાં મારું મન વિહ્લવળ બને છે, ને એની રીતમાં મનને ઉન્માદનો આફરો ચરી, એ ન રિસાય એની ચિંતા રહે છે આમ બીજાની રાજનારાજીને જો મારે જોયા કરવાની હોય, જો એની અસર લેવાની હોય, તો મારા મનને સ્થિર શાંતિ ક્યાંથી રહેવાની હતી ? એટલે મંત્રીપણું જ શું, કે એકલી કોશા જ શું, આખાય ઘરવાસમાં ને સંસારી ભોગમય જીવનમાં પરના આધારે જ સુખ-દુઃખ જોતાં રહેવાય છે. એમાં મનને શાંતિ ન મળી શકે. ‘પરની આશા સદા નિરાશ.’

શાંતિ તો જ મળે કે પરની આશા મૂકી દેવાય, ભોગમય જીવનને બદલે ત્યાગમય જીવન જીવાય, તો જ મન શાંત સ્વસ્થ બને. કાયમી પ્રકૃતિલિત બન્યું રહે.’

સ્થૂલભદ્રજીએ મનની શાંતિ પર ભાર મૂક્યો, મન શાંતિ પર કેન્દ્રિત કર્યું, જીવન મનની શાંતિ પર જીતવાનું, અને મનની અશાંતિમાં હારવાનું જોયું. એના ઉપર શાંતિનો માર્ગ લેવાનું નક્કી કરી લીધું. એ પણ વિના વિલંબે એટલે ત્યાંજ કેશલોચ કરી સાધુ બની ગયા. તો પછી પૂછોને કે

૧૨ સુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પંડિતપુત્રનો ચમકારો” (ભાગ-૪૪)

પ્ર.- શું બાર બાર વરસ જેણે દિલ સોંપીને સુખ આપ્યું એ કોશાને પૂછવાનું કે કહેવા જવાનું નહિ કે હું શાંતિનો માર્ગ લેવા ઈચ્છું છું ? એને તો વિશ્વાસ આપીને આવ્યા છે કે ‘નંદરાજીનું તેનું આવ્યું છે તે રાજાને આ પાછો આવ્યો સમજ,’ તો એ વિશ્વાસનું પાલન કરવા પૂરતું ય અની પાસે પાછા જવાનું ને કહેવાનું નહિ ? તેમ પોતાના માતા-ભાઈ વગેરે કુટુંબીઓની રજ માગવા ય જવાનું નહિ ? તેમ નંદરાજાને ય પોતાની ઈચ્છા જગ્ઘાવવાની નહિ ?

૩.- ના, વૈરાગ્ય ઊછળ્યા પછી વિરાટનાં દર્શન થાય છે, પોતાના વિશ્વસાથેના ત્રિકાલ-સંબંધોનું ભાન થાય છે. એમાં અહીના માતાપિતા પ્રિયા પુત્ર વગેરે નહિલું લાગે છે એની સાથેના પૂછવા જવામાં બીજું પણ કારણ સ્પષ્ટ છે. ‘પોતાને મનની શાંતિ ક્યાં ?’ એનો વિવેક જાગી ગયો છે, નિશ્ચય થઈ ગયો છે; અને શાંતિનો માર્ગ લેવો છે. એટલે હવે જુએ છે કે કોશાને આપેલો વિશ્વાસ પાળવા પૂરતું ય અની પાસે જવામાં અશાંતિ છે. સમજ રાખો,

રાગીને રાગપોષક આપેલા વિશ્વાસ-કોલ-કબૂલાત પાળવામાં રાગનાં પોષણ છે; ને જ્યાં રાગનું પોષણ ત્યાં અશાંતિ.

ત્યારે એવી કબૂલાત ન પાળી રાગનું શોષણ કરવામાં ચિત્તને શાંતિ.

નહિતર તો પરણીને પહેલાં રાગની મૂઢ્ટામાં મોટા ભાગ માનેલી પ્રાણપ્રિયાને જીવનભર પાળવાના અને અખંડ પ્રેમ વરસાવવાના વિશ્વાસ આપ્યા હોય છે. પછી જો એ વિશ્વાસ પાળવાના જ હોય પણ ભાંગવાના ન હોય તો જીવનમાં ક્યારે ય એના પ્રેમ મૂકાય જ નહિ. એને છોડીને જવાય જ નહિ; અરે ! એ જીવતીને પાળવાનું મૂકીને મરાય પણ નહિ. ‘ધરમ જ આ વિશ્વાસ-કોલ-કબૂલાત પાળવાનો, ! ત્યાગનો ધરમ જ નહિ !’ એવો જ સિદ્ધાન્ત નક્કી થાય ! પછી તો કેમ, તો કે અંગ ચોર બાપને છોકરાએ જીવનભર ચોરી કરવાનો વિશ્વાસ આપ્યો, કસાઈ પિતાને પુત્રે કસાઈગીરીનો કોલ આપ્યો, ગુંડા બાપને દીકરાએ ગુંડાગીરી કરવાની કબૂલાત આપી,...આ બધા છોકરાએ જીવનમાં કદીય ચોરી, હિંસા, ગુંડાગીરી છોડાય જ નહિ ! પણ આ ખોટું છે.

ખરી વાત એ છે કે પાપની કબૂલાત પાળવાની ન હોય; કિન્તુ એનો ભંગ કરી પાપત્યાગ જ કરવાનો હોય; એ જ કર્તવ્ય,

એથી ઊલટું ધર્મની પ્રતિજ્ઞા પાળવી જ જોઈએ, એ કર્તવ્ય.

પાપ કરવાની પ્રતિજ્ઞાનો ભંગ એ ધર્મ; અને ધર્મપ્રતિજ્ઞાનો ભંગ એ પાપ,

ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

અધર્મ. આ જ હિસાબે કોશા પાસે પાછા જવાની કબૂલાત એ પાપની કબૂલાત હોવાથી એનો ભંગ એ પાપ, અધર્મ. આ જ હિસાબે કોશા પાસે પાછા જવાની કબૂલાત એ પાપની કબૂલાત હોવાથી એનો ભંગ એ ધર્મ; એ કર્તવ્ય.

સ્થૂલભદ્રજી આ સમજે છે કે વેશ્યાને આપેલો વિશ્વાસ પાળવા જતાં રાગનું પોષણ છે. અને એમાં ચિત્તને શાંતિ નહિ, પણ રાગની અશાંતિ મળે. માટે જો શાંતિનો માર્ગ લેવો હોય તો તો એ વિશ્વાસપાલન એટલે કે અશાંતિ પોષવાનું કરીને વિલંબ ન કરાય.

એમ ૧૨-૧૨ વરસ કોશાએ દિલ સોંપી સુખ આપ્યાં એનાં દાક્ષિણ્યમાં પડી એની રજ માગવા જવામાં પણ અશાંતિનું પોષણ છે. એ દાક્ષિણ્યમાં પડવાનો અર્થ જ એ છે કે એણે દિલ સોંપું અને સુખ આપ્યાં એની કદર કરવી. મોહંદંધ દિલ-સુપરત અને મૂઠ વિષયસુખદાનની કદર કરવી. એટલે એમાં કશું ખોટું ન માનવું આ માન્યતા બનવામાં તો મિથ્યાત્વની અશાંતિ ઊભી થાય. કદાચ એવી માન્યતા ન રાખે તો પણ એ દાક્ષિણ્ય પાળવામાં સહેજ પણ રાગ પોષાય અને રાગ ત્યાં અશાંતિ. સ્થૂલભદ્રજીને હવે જરાય અશાંતિ ખપતી નથી, પછી શું કામ કોશાને કહેવા જાય ?

એમ, કુટુંબીઓને કહેવા જવામાં પણ સ્થૂલભદ્રજીએ જોયું કે એટલું કહેવા જવાનું મન મારી મમતાને લઈને થાય; ને જ્યાં મમતા ત્યાં ચિત્તની અશાંતિ. તો હવે શા સારુ એટલી ય મમતાને પોષવી ? શાંતિ જ જોઈએ છે તો શાંતિનો શ્રેષ્ઠ માર્ગ રાગ, દાક્ષિણ્ય, મમતા વગેરેને પડતા મૂકી સર્વત્યાગ કરવો એ જ છે ! બસ, આ વિવેક ઉપર એમણે ત્યાં ને ત્યાં કેશનો લોચ કરી સાધુવેશ ધારણ કરી લીધો.

ત્યારે જુઓ ઈંડ્રભૂતિ ગૌતમ વગેરે અગ્નિયાર વિદ્વાન બ્રાહ્મણોએ પોતાના ૪૪૦૦ વિદ્યાર્થીઓ સાથે ભગવાન મહાવીર સ્વામીથી બોધ પામી ત્યાં ને ત્યાં જ પ્રભુ પાસે સંસારત્યાગ કરી ચારિત્રમાર્ગ સ્વીકાર્યો. એમાં ઘરે કુટુંબીઓને પૂછવા જવાનો વિલંબ ૪૪૧૧માંથી એક પણ જોણે ન કર્યો. કેમ વારું ? એટલા જ માટે કે જો ખરેખર શાંતિ જોઈએ છે તો એટલી ય મમતામાં શા સારુ જેંચાઈ પૂછવાના વિચારની ય અશાંતિ વહેરવી ? પ્રભુ પાસે તરત જ સર્વત્યાગ કરીને બેસી જવામાં શીંઘ શાંતિ મળે છે.

આવા તો કેટલાય દાખલા મળે છે. પ્રભવ ચોર, શયંભવ બ્રાહ્મણ, હરિભ્ર પુરોહિત, દશાંભદ્રરાજી, સનતુકુમાર ચક્રવર્તી, ઋષભદેવ પ્રભુનાં ૮૮ પુત્રો, આર્યરક્ષિત, બાહુબલી, વજબાહુ...વગેરે વગેરે કેટલાય દાખલા છે જેમણે કશું પૂછવા-કહેવા જવાનું રાખ્યું નહિ, અને ગુરુ પાસે બેસી ગયા, તે એટલા જ માટે

૧૪ સુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પંડિતપુત્રનો ચમકારી” (ભાગ-૪૪)

કે જીવન જીતવાનું ચિત્તની શાંતિથી છે, અને એ જોઈએ તો હવે સહેજ પણ અશાંતિકારક તત્ત્વને પોષવાની જરૂર નથી.

પ્ર.- ત્યારે શું જંબૂકમાર વગેરે કહેવા ગયા એ ખોટા ?

ઉ.- ના, એ જે ગયા તે સામાની દસ્તિથી ગયા કે એમને શાંતિ થાય ત્યારે આજે પૂછવા ન ગયા તે પોતાનું ભારે બળતું જોઈ, એને તરત શાંત કરવાની જરૂર જોઈને.

મનની શાંતિ અને મનોબળથી જીવન જીતી જવાય, ને એ વિના જીવન હારી જવાય. આ સૂત્ર જો બરાબર દિલમાં ઉત્તરી જાય, તો અશાંતિ અને નિઃસત્ત્વતાને કરનારા કોધનાં પોષણ શા સાંકું કરવા ?

આ વિચાર ઉપર કોધને અંકુશમાં લઈ શકાય.

(૧૧) કોધને રોકવા આ પણ એક વિચાર છે કે કોધ કરવા જતાં એના સંસ્કારની વૃદ્ધિ અને ભવની પરંપરા ખરાબ સર્જાય છે; તો શા સારુ કોધને આવકારું ? ચંડકોશિક સર્પના જીવ સાધુએ કોધને આવકાર્યો, તો ભવની પરંપરા બગડી ગઈ. એ સાધુ હતા, સાધુતા પાણી હતી, તેથી તો મરીને તરત જ્યોતિષી દેવ થયા. છતાં જરીક વરના પણ કોધે ચારિત્ર વિરાઘ્યું, તેથી વૈમાનિક દેવલોક ન પામતાં નીચેના જ્યોતિષીમાં ગયા; ને પછી તો પ્રયંદ ગુસ્સાવાળા કોશિક તાપસ થયા, અને ત્યાંથી મરીને વિષમય સર્પનો મહાકોધિષ્ઠ અવતાર પામ્યા. જ્ઞાનીઓ કહે છે,-

‘કોધે કોડ પૂરવતણું ચારિત્રફળ જાય.’

કોડ પૂર્વનું ચારિત્ર એટલે કેટલા વરસનું ? એક પૂર્વમાં ૭૦૫૬૦ અબજ વર્ષ વિશે. શું. સમજયા ? ૧-૨ અબજ નહિ, ૧૦૦-૨૦૦ નહિ, ૧૦૦૦-૨૦૦૦ નહિ, પરંતુ ૭૦ હજાર અબજ વર્ષ, ઉપર પદ્ધતિ અબજ વર્ષ. એટલો કાળ એ એક ‘પૂર્વ.’ એવા પૂર્વ પણ ૧૦૦૦-૨૦૦૦ કે લાખ કે બે લાખ નહિ પરંતુ ૧૦૦ લાખ એટલે કે એક કોડ પૂર્વ. આટલા મોટા જંગાંકાળના ચારિત્રનું ફળ કેટલું બધું ઊંચું ?

એ ફળને પણ રદ્ભાતલ કરવાની તાકાત કોધની આગમાં છે. આગની એક ચિનગારી કેટલી મોટી રૂ કે ધાસની ગંજને સાફ કરી નાખે ? જરાકશી આગથી આ ? હા, કારણ કે એ આગ છે. આગને બળતણ મળતાં આગ વધતી જાય, તેથી આગળ આગળનું બાબ્યે જાય એમાં નવાઈ નથી.

જેમ રૂ ધાસ લાકડાં વગેરે આગને માટે બળતણરૂપ થઈ નાનીશી ચિનગારીને વિકસાવી મહા આગ બનાવી દે છે, એમ ભાવી જનમો અહીંના કોધને માટે બળતણરૂપ બની મહાકોધને વિકસાવી દે છે.

અહીંના કોધનાં બળતણ આગમી જન્મો :-

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

એટલે શું સમજયા ? અહીંથી કોધ શરૂ કર્યો, એના માટે અહીંથી પછીનો અવતાર એ બળતણરૂપ. એટલે ત્યાં કોધ સારી રીતે ભભૂકવાનો, એના માટે વળી એની પછીનો જનમ એ બળતણરૂપ; તેથી ત્યાં પાછો કોધ ઓર હી ભભૂકશે.

ઈમારતી લાકડાં સારાં; મહેલ બનાવવા કામ લાગે. પરંતુ જો એને આગનો સંપર્ક થયો, તો એ જ બળતણરૂપ બની આગને વધારી જતે ય બળો અને મકાનને ય બાળે. એમ અહીંથી પછી દેવ કે મનુષ્યનો ભવ મળે એ સારો; આરાધના માટે ઉપયોગી થાય; પરંતુ જો એને અહીંના કોધસંસ્કારનો સંપર્ક થયો, તો એ જ ભવ કોધ માટે બળતણરૂપ બની કોધની આગ વધારવામાં ઉપયોગી થવાનો. એમાંથી ખરાબ ભવપરંપરા ચાલવાની. માટે અહીં કોધ કરવો એ ખતરનાક.

અહીંના નાના કોધમાંથી આગળના ભવોએ કોધ મોટો મોટો થાય :-

જુઓ અભિનશમાર્ય-કમઠ વગેરેના ચરિત્ર પણ આ જ ભતાવે છે; એમણે કોધ કર્યો તો ભવની પરંપરા સર્જાણી. ખૂબી આ છે કે અહીં તો કોધનું પ્રમાણ ઓછું ય હોય, પરંતુ પછીના ભવોમાં એ વધતું ચાલે છે; નહિતર પછી પછી નીચે નીચેની હુર્ગતિ કેમ થાય ? અભિનશમાર્યએ લાખો પૂર્વના કાળ માસઅમણના પારણે માસઅમણ કર્યા હતા, અને અંતે અણશન કર્યું હતું. છતાં કોધે એ બધાનું ફળ બાળી નાખ્યું. અલબત એ તપના પ્રભાવે એકવાર દેવલોકની ગતિ પામ્યો, પણ ત્યાં કોધે વધીને ગુણસેન મહાત્માનો નાશ કર્યો. આ કોધે દેવલોકમાંથી એક હલકો ભવ કરાવવા દ્વારા પહેલી નરક દેખાડી. પછીથી આનંદકુમારનો ભવ પામી કોધમાં ચંડ્યો, તો ત્યાંથી નીચેની નરકમાં પડ્યો. આગળ આગળ એ નીચી નીચી નરકમાં જતો ગયો. એ ભતાવે છે કે ભવે ભવે કોધનું પ્રમાણ વધતું ચાલ્યું.

કમઠની પણ એ દશા દેખાય છે એ ય નીચે નીચેની નરકમાં જતો ગયો. એ સૂચવે છે કે કોધ વધતો ગયો.

ચંડકોશિકના જીવ સાધુની પણ એવી દશા થતી ગઈ, સાધુજીવનમાં કરેલા કોધ કરતાં કોશિક તાપસના ભવે કોધની માત્રા વધી.

કોધ વધવાનું માપ એનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પરથી સમજ શકાય; જેમકે ચંડકોશિકને,-

(i) ચંડકોશિકને પૂર્વ સાધુપણે ગુસ્સો ચંડ્યો એનું (૧) દ્રવ્ય એટલે કે પાત્ર એક બીજો નાનો સાધુ; (૨) ક્ષેત્ર એ સાધુનો મુકામ; (૩) કાળ નાના સાધુને જરાક શિક્ષા કરવા સુધીનો; અને (૪) ગુસ્સાનો ભાવ એ નાના સાધુને એક ડુકી લગાવવાનો.

(ii) હવે આગળ કોશિક તાપસના ભવના કોધના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ

૧૬ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પંડિતપુત્રનો ચમકારા” (ભાગ-૪૪)

જુઓ. તાપસને (૧) કોધનું દ્રવ્ય પોતાના આશ્રમમાં રહેલા પાંચસો તાપસો, અને એમને ભગાડી મૂક્યા પછી જે કોઈ આશ્રમની વાડીનાં ફળ લેવા આવે એ, એમાં રાજકુમાર વગેરે આવ્યા તો એ; (૨) કોધનું ક્ષેત્ર એ વાડી; (૩) કાળ જ્યાં સુધી વાડીમાં ફળ અને એને કોઈ લૂંટવા આવવાનો સંભવ હોય ત્યાં સુધીનો; તથા (૪) ભાવ ફળ લેનારને ડંડા ઠોકવાનો, યાવત્ જો ડંડો લગાવવા પહોંચાય એમ ન હોય તો ફરસીનો ઘૂંઠો ઘા ઠોકી સામાને લોહીલુહાણ કરવાનો ભાવ.

વિચારો, કોધનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સાધુભવ કરતાં આ તાપસના ભવે કેટલા બધા વધી ગયા ? હવે આગળ સર્પના ભવે જુઓ એના કરતાં ય કેટલા વધે છે ?

(iii) ચંડકોશિક સર્પના ભવે (૧) કોધનું દ્રવ્ય માત્ર કોઈ પોતાનો ગુનેગાર જ એમ નહિ, કિન્તુ જે કોઈ દણિમાં આવે એ; તે પણ બાળ કે બુઢી, સ્ત્રી કે પુરુષ, અરે ! માણસ કે પશુ-પંખી જે કોઈ દણિમાં આવે એના પર ગુસ્સો; એટલે એ બધા ગુસ્સાનાં દ્રવ્ય થયાં; (૨) કોધનું ક્ષેત્ર પોતાનો સીમાડો તે દણિ પહોંચે ત્યાંસુધીનું ક્ષેત્ર; (૩) કાળ જ્યાંસુધી જીવે છે ત્યાંસુધીનો, કેમકે અહીં નિમિત્ત વિના જ કોધમાં ધમધમવું છે; અને (૪) કોધનો ભાવ જે જીવ કોઈ નજરે ચક્યો એને ઝેરથી મારી જ નાખવાનો ભાવ. આમ કોધની માત્રા હદ્દપાર વધી ગઈ.

વિચારજો મનુષ્યભવે કોધ કર્યો એની માત્રામાં પછીના ભવોમાં કોધ કેટલો બધો ચાલ્યો ? આ સૂચયે છે કે,

મનુષ્યજીવનમાં કરેલા કોધાદિ કષાયના આગળ ગુણાકાર થાય છે; એવા ક્ષમાદિ શુભભાવના પણ ગુણાકાર થાય.

સમરાદિત્યના જીવ ગુણસેન રાજાએ ક્ષમાદિ શુભભાવ અપનાવ્યા, તો પછીના ભવે એનામાં વધારો થતો ચાલ્યો, ને એના ફળમાં ઉપર ઉપરના દેવલોકે જતા ગયા, યાવત્ આઠમા મનુષ્ય ભવના અંતે સર્વોચ્ચ અનુત્તર દેવલોકના સર્વાર્થસિદ્ધ વિમાને પહોંચ્યા, અને નવમા સમરાદિત્ય રાજકુમારના ભવના અંતે કેવળજ્ઞાન પામી મોક્ષ સિધાવ્યા. આનો અર્થ એ કે મનુષ્યભવ એ ખેતર, અને એમાં કરેલા શુભ-અશુભ ભાવ એ ખેતરમાં પડેલું બીજ. બીજમાંથી પછી મોટા પાક ઉત્તરે.

ત્યારે આ વિચારવા જેવું છે કે અહીં આપણે દિલના ઉંખ વિના હોંશે હોંશે ગુસ્સો ને અભિમાન, માયા ને લોભ, વળી રાગ ને ભમતા, તેમ ઈર્ઝ્યા ને વૈર-વિરોધ કરવા જોઈએ છે, તો એના પછીના ભવોમાં કેવા ગુણાકાર થવાના ? મૂઢ્યતા-અજ્ઞાનતાથી અહીં તો લાગશે કે ‘કોધ કેમ ન કરાય ? સ્વમાન-સ્વાભિમાન કેમ ન રખાય ? લોભ-પ્રાંચ કર્યા એમાં શું થઈ ગયું ?...જીવન લઈ બેઠા છીએ એટલે એ તો બધું કરવું જ પડે. તો જ સુધે જીવાય...એમાં કાંઈ આપણે ગુનો

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : ઘૂંઠવાનો મોકો” (ભાગ-૪૪) ૧૭

નથી કરતા. આવો રોક રોષ ન હોય તો મુડદાલ જીવન. ઘરડા સાપે પણ ફૂંફાડો તો રાખવો જ પડે...’ આવું આવું મનમાં બેહું હોય છે, પરંતુ ત્યાં મિથ્યાત્વ ઝગમગવાથી પછીના ભવોમાં આ કષાયો અને મલિન ભાવોના ગુણાકાર થાય એનું શું ? એ કોને વેઠવાના ? એમાં કોણ ફસાવાનું ? આપણા આત્માએ જ ને ? ભૂલશો નહિ,

કામ-કોધ-લોભાદિ કષાયો પર અહીં મળનારી શાબદી તુચ્છ; પણ પરભવે ગુણાકારથી થનારા એનાં વિકરાળ સ્વરૂપ ભયંકર; ને એથી થતી દુર્ગતિપરંપરા અતિ દુઃખદ.

આ વિચાર બહુ જરૂરી અને સતત નજર સામે રાખવા જેવો છે. ચંડકોશિક અજ્ઞિશર્મા વગેરેના દાણાંત યાદ કરવા જેવા છે. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજને બૌદ્ધો પર બહુ ગુસ્સો ચક્યો ત્યારે ગુરુશ્રી જિનભદ્રસૂરિજી મહારાજે-ગુણસેન-અજ્ઞિશર્મના ભવોની ગાથાઓ વિચારવા મોકલી. એ વાંચતા જ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ ઉપશમભાવમાં આવી ગયા; કેમકે એમાં એમણે અજ્ઞિશર્મની ભવોભવ ચાલેલા ભયંકર હુદ્દશાનાં ચિત્ર જોયાં,

કષાયના ગુણાકાર ક્યાં નહિ ? :-

વાત બે છે; ભવની પરંપરા અને કુસંસ્કારની બુદ્ધિ, કામ તથા કષાયના કુસંસ્કારની વૃદ્ધિમાં ગુણાકારનો નિયમ નથી કે બધે ગુણાકાર જ થાય. કામ-કોધ-લોભ વગેરે થવા પાછળ હૃદયરુદ્ધન હોય તો એના સંસ્કારનો પછીથી ગુણાકાર ન પણ થાય; કિન્તુ આપણે કષાય કરતાં આ ભય રાખવાનો છે કે ‘જો આ હું કોધ વગેરે કષાય સેવું ને પછી એના સંસ્કારનો ગુણાકાર થાય તો ? તો તો મારા ભાર જ વાગી જાય ! માટે મૂક પડતા કષાય;’ ને કષાય કરવા જ પડે ત્યાં સાથે હૃદયરુદ્ધન હોય કે ‘હાય ! કેવું ખરાબ આ કષાયજીવન જીવવાનું ?’

આ ખાસ ધ્યાનમાં રહે કે મન ખોટો સવાસલો ન કરે કે ‘હમણાં ભલે કષાય કરું, પાછળથી પસ્તાવો કરી લઈશ.’ આ સવાસલો ખોટો છે. આપણે આપણું ગજું વિચારવું જોઈએ કે આપણે કષાય કરવા બેસીએ ત્યારે

કષાયનું જોસ કેટલું ? અને પાછળથી એના પસ્તાવાનું જોસ કેટલું ?

કષાય કેવા દિલના ઊંડાણમાંથી થાય છે ? અને પસ્તાવા કેવા ઉપરદ્ધલક્ષ થાય છે ? જો વિષય-કષાયનું જોસ સારી રીતે છે, અને એના ખેદનું કે પાછળ પસ્તાવાનું એવું જોસ નથી તો પરભવ માટે શી રીતે નિર્ભય રહી શકીએ કે આ વિષયાસકિત અને કષાયના ગુણાકાર નહિ થાય ?

ખરી રીતે કોધ વગેરે કષાય શું યા રૂપ-રસ-સ્પર્શાદિ વિષયો શું, કે હિંસાદિ

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પંડિતપુત્રનો ચમકારા” (ભાગ-૪૪)

બીજાં પાપસ્થાનક શું, એ સેવતી વખતે એનો બેદ જોરદાર થવો જોઈએ. સમકિતી જીવને પાપ સેવતાં ‘અપો સિ હોઈ બંધો,’ અશુભ કર્મ અલ્ય બંધાય છે. એનું કારણ આ, કે એ પાપ નિર્ધિસંપણે નથી કરતો, પાપની સાથે નિહુરતા નથી, બેદ છે. આ બેદ ઉપરછલકો નહિ, પરંતુ અંતરનો છે, દિલનો છે.

સમકિતીને પાપમાં જોસ નથી, બેદમાં જોસ છે. સમકિતના ડોળવાળાને પાપમાં જોસ છે, બેદમાં નહિ. મિથ્યાત્વીને પાપમાં જ જોસ છે; ને બેદ છે નહિ.

એટલે સમકિતી તરીકે જો કોષ કરતાં એના બેદનું જોસ વધુ હોય, તો જોટો બચાવ કરવાનું મન ન થાય કે ‘આ કષાય તો કરવો પડે. તો જ જીવાય.’ અથવા ‘ભલે કષાય સેવું દું પણ એ પસ્તાવાથી ધોવાઈ જશે, એના ગુણાકાર નહિ થાય.’ કષાયનો જોરદાર બેદ છે એનો અર્થ જ એ કે કષાય અત્યંત ભૂંડા લાગે છે, ને એ સેવાવાનું પારાવાર દુઃખ છે. જાત, કષાયને રોકવા સમર્થ નહિ એટલે, અત્યંત નિઃસત્ત્વ લાગે છે, હૈયે પારાવાર દુઃખ છે. પછી ત્યાં ‘ભલે’ શાનું આવે કે ‘ભલે હું કષાય કરી લઉં ?’

જૈનધર્મની શ્રદ્ધા મણ્યાની આ ખૂબી છે કે એમાં પાપના જોસ કરતાં એના બેદનું જોસ વધારે હોય. ભરત ચક્કવતની ઇ બંડ મણ્યા તો એ ભોગવતા તો હતા, પરંતુ એ ભોગવટાના જોસ કરતાં એમાં બેદનું જોસ વધુ હતું. તો પૂછો

પ્ર.- તો પછી કેમ એ ભોગવટો છોડી ન દીધો ?

૩.- કારણ કે એમને નિકાચિત ભોગાવલી કર્મ ઉદ્યમાં હતાં. એટલું સમજ રાખો કે

પાપમાં બેદ કરાવનાર છે મિથ્યાત્વનો અને અનંતાનુંબંધી કષાયનો ક્ષયોપશમ; ત્યારે પાપનો ત્યાગ કરાવનાર છે ચારિત્ર મોહનીય યાને અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાના-વરણીય કષાય-કર્મનો ક્ષયોપશમ.

તેથી આ ચારિત્રમોહ ઉદ્યમાં હોય ત્યાંસુધી મિથ્યાત્વનાશના બળે પાપમાં પારાવાર બેદ થવા છતાં પાપનો ત્યાગ ન કરી શકે.

પરંતુ ભરતચક્કની રંગરાગ-ભોગમાં પારાવાર બેદ રહેતો માટે જ અરીસાભવનમાં શુભભાવમાં કૂદકે ભૂસકે આગળ વધી અંતરથી સર્વપાપત્યાગ અને સર્વ-સંગત્યાગ કરી વીતરાગ-સર્વજ્ઞ બન્યા. અરીસાભવનમાં જ્યાં કાયાના શશગારનો ઠઠારો જોવા ગયા હોય ત્યાં આ સહેલું છે? સિદ્ધગિરિ પર પહેલી જ વાર ગયા હો, અનંતાને મોક્ષે પહોંચાડનારી ભૂમિ સ્પર્શવા મળી હોય છતાં ચારિત્રભાવ યાને સર્વપાપત્યાગ નથી આવતો, તો આરીસા-ભવનમાં આવે?

પ્ર.- તો પછી ભરત મહારાજાને કેમ આવ્યો ?

ભુવનભાનું અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો: ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

૪.- કહો, ઇ બંડ ભોગવતી વખતે પાપરૂપ ભોગવટાના જોસ કરતાં એના બેદનો જોસ વધારે હતો; ભોગવટાનો પારાવાર બેદ ધૂંટાયેલો હતો. ‘ધૂંટાયેલો’ સમજો છો ને? માત્ર એક બે વાર બેદ આવી ગયો એમ નહિ, પરંતુ વારંવાર બેદ થયા કરતો. એનું નામ બેદ ધૂંટાયેલો હતો. તેથી

અરીસાભવનમાં મોકો મળતાં એ પૂર્વેપાપના ધૂંટાયેલા બેદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. એણે માત્ર સર્વપાપ ત્યાગ નહિ કિન્તુ સર્વસંગ ત્યાગે ચડાવી દીધા.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૧૯, અંક-૪૫, તા. ૭-૮-૧૯૭૧

માટે ‘ભરતને ભોગ-વિલાસમાં જોરદાર બેદ હતો તો કેમ એમજો ભોગવિલાસ છોડ્યા નહિ?’ એ પૂછ્યા કરતાં એ પૂછો કે ‘એવા અઠળક ભોગવિલાસમાં બેઢા હતા છતાં કેવળજ્ઞાન કેમ થયું?’ એ પ્રેશનનો જવાબ આ, કે ભોગવિલાસ વખતે એના જોસ કરતાં એમાં બેદનું જોસ વધુ હતું. એ પારાવાર બેદ ધૂંટાયે જતો હતો તે મોકો મળતાં ઉગ્ર સ્વરૂપનો થઈ ગયો, ને એ ઉગ્ર બેદ દિલ પરથી ભોગવિલાસનો સંગ ઉતારી દીધો.

પાપ અને ભોગનો પ્રબળબેદ પાપ અને ભોગના સંગ છોડાવી દે.

એટલે આ મહાન જીવન-કર્તવ્ય છે કે ‘હિસાઈપાપનો બેદ ને કામ-કષાયનો બેદ જોરદાર રાખો, એને દિલની અંદર ધૂંટાવા દો. જિન-વચન આ કહે છે. આ અપાર સંસાર સાગરમાં જિનવચન પામવું દુર્લભ અતિ દુર્લભ છે. એ જો અહીં મણ્યું છે તો જરૂર પડ્યે બધું જતું કરીને પણ જિનવચનને સાર્થક કરો. જિનવચન દુર્લભ એટલે એણે કહેલા પરિગ્રહાદિ પાપોમાં અને કષાયોમાં પારાવાર બેદ કરવાનું અહીં મણ્યું છે એ અતિ દુર્લભ વસ્તુ મળી છે, એને સક્રિય કરો. પાપો અને કષાયોમાં મોહો નહિ, એનાથી દેખાતા હુન્યવી લાભમાં મોહ ન પામો. દિલમાં એ પારાવાર બેદ અનુભવતા રહો. આ જ અતિ દુર્લભ જિનવચન પામ્યાને સાર્થક કરવાનું કહેવાય.

કોધાધિ કષાયમાં પારાવાર બેદ અનુભવાય માટે આ વિચાર છે કે ‘એ ભવની પરંપરા વધારે છે અને એના સંસ્કારના ભવાંતરે ગુણાકાર થયા તો એ ભવો ભયંકર બનવાના.’ આ વિચારથી બેદ થતાં સહેજે મનને થશે કે લાવ ત્યારે કોષ કરીને બેદ કરવો એના કરતાં કોષ જ ન કરું.

(૧૨) કોધને અટકાવવા માટે વળી આ એક વિચાર છે કે ‘જો કોષ કરીશ તો મન તામસી અને નિઃસત્ત્વ બનશે. એ તામસીપણાના જીવનના બીજા અંગો

૨૦ ભુવનભાનું અન્સાઈક્લોપીડિયા-“પંડિતપુત્રનો ચમકારા” (ભાગ-૪૪)

અને ગુણો ઉપર ખરાબ અસર પડશે, તેમ નિઃસત્ત્વતાથી અંતિ લક્ષ્ય વીતરાગતાને પમાડનાર મહાસત્ત્વભર્યા અપૂર્વકરણથી વધુ દૂર ડેંકવાનું થશે. માટે એવા તામસભાવ તથા નિઃસત્ત્વતાને લાવનારો અધમ કોધ શા માટે કરું ? કોધને અટકવું.”

તામસભાવ અને નિઃસત્ત્વતા બંને ખતરનાક છે. બંને પર ખૂબ ધ્યાન દેવા જેવું છે.

(૧) કોધથી પોષાયેલા તામસભાવની અસર જીવનના બીજા પ્રસંગો અને ગુણો પર પડે છે.

દા.ત. તામસભાવના લીધે ઘરમાં કુંભાઓ સાથેનો વ્યવહાર મીઠો મુલાયમ નહિ રહે. અગર પત્નીએ કાંઈક જરા જેવી ભૂલ કરી તો તામસભાવવાળો પતિ એને સહન નહિ કરે, ધાંટાધાંટી કરશે, ઝગડો કરશે, અને પત્ની જો ભારે દમવાળી હશે તો પતિ બોલી તો નહિ શકે પણ તામસભાવને લીધે મનમાં ને મનમાં બળશે.

જો તામસભાવ ન હોય અને ઉદાર દિલ હોય તો મનને એમ થશે કે ‘ભૂલ તો હું ય ક્યાં નથી કરતો ? પત્ની ભૂલ કરે છે એ જોયા કરતાં એ બીજું સારું કેટલું ય કરે છે એ જોવાનું ક્યાં ઓછું છે ? તે બધું જોવાનું મૂકીને નાની ભૂલ જોવા બેસું ? લાવ, એને હિંમત આપું આશાસન આપું કે આ કોઈ મોટી ભૂલ નથી દિલમાં હુંઘ કરતા નહિ, મન બગાડશો નહિ.’

મંદિર-ઉપાશ્રયમાં તામસભાવ શું કરે ? :-

પણ તામસભાવવાળાને આ સૂજે નહિ. એ તો તામસી પ્રકૃતિમાં કુદ્રતાથી એકલી ભૂલ ખામીને એકલો અંધકાર જ જોતો હોય છે. સારું થયું હોય એમાં પણ ઓછું કેટલું રહ્યું, ખામી શી રહી, એ જ જોવા તરફ એની દાણી રહે છે. એટલે તો આજે દેખાય છે કે મંદિર-ઉપાશ્રયમાં પણ આવનારા તામસભાવવાળા માણસો એમાં ખામીઓની ફરિયાદ જ અને બૂમરાડ જ કરતા હોય છે. ‘પૂજારી મોડો આવે છે, બરાબર કામ નથી કરતો. કારભારીને કશી પડી નથી. ઉપાશ્રયનો માણસ એદી છે. કટાસણા-ધોતિયાનાં ઠેકાણાં નથી...’ એવી એવી તો કેટલીય ખામીઓનાં રોઢાં જ રોયાં કરે છે.

પ્ર.- તો શું ખામીઓ ચલાવી લેવી ?

૩.- ના, પણ બૂમરાડ કરવાથી સુધ્યુરુ ? ના, અને પોતે તો કષાય જ કમાયો ! મંદિરમાં આવી શું પાખ્યો ? ખૂબી તો એ કે એમાંનું કશું પોતે શક્ય પણ સુધારવા માટે ભોગ આપવાની વાત નહિ. દા.ત. ‘અંગલુંછણાં મેલાની ફરિયાદ ખરી, પરંતુ વરસમાં એક દહાડો ય પોતે ઘેર લઈ જઈ ધોવા ધોવરાવવાની વાત નહિ. કે ઘરેથી મહિને ફક્ત એક સારો અંગલુંછણાનો ટૂકડો લાવવાની ય વાત ભુવનભાનું અન્સાઈકલોપીયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : છૂટવાનો મોકો” (ભાગ-૪૪)

નહિ ! માત્ર રોઢણાં-બખાળા-નિંદા કર્યા કરશે. આવું તે પાછું ક્યાં સુધી ? તો કે જિંદગીના છેડા સુધી ! કેવી દુર્દીશા ? વીતરાગ પ્રભુના મંદિરમાંથી ઉપશમભાવ કર્માતા રહેવાની તો વાત જ ન રહીને ?

ત્યારે, આ ઊંચા આર્ય માનવભવમાંથી જૈનશાસન મળ્યું છતાં આ રોષ ફૂપણતા વગેરે જ કમાઈ જવાનું ? જિંદગીના છેડા સુધી તામસભાવના બખાળા અને છાણછાણ જ કમાઈ જવાના ? તામસભાવવાળાને આ કોઈ વિચાર જ નથી કે ‘બીજાનું હલકું જ જોયા કરીશ એમાં મારા આત્માનું શું લીલું વળ્યું ? હલકું મારા આત્માનું ક્યારે જોઈશ ? એને જો જોવાની ય વાત નહિ તો સુધારવાનું તો રહે જ ક્યાં ?’ ભાગ્યહીન એ બિચારો મંદિર-ઉપાશ્રયમાં સારું સારું કેટલું છે એની તરફ તો દાણી જ નથી નાખતો, પછી એથી ખુશી અનુભવવાની અને અનુમોદના કરવાની તો વાત જ ક્યાં રહે ? સારું અનુમોદવું હોય તો હાથવેંતમાં છે, પણ તામસભાવ એ કરાવે નહિ.

મંદિરમાં અનુમોદવાનું કેટલું ? ભાવીમાં ઉદય હોય એને સૂજે :-

ખૂબી જુઓ કે મંદિરમાં કેટકેટલું સારું છે કે જે પોતે સ્વયં કરી શકતો નથી, છતાં એની અનુમોદના કરી શકે; ને એ કરતાં આવકે તો કર્યા જેવો લાભ મળે એમ છે. પણ ભાવી ઉદય ન હોય એને એ ક્યાંથી સૂજે ? દા.ત.

(૧) દેરાસરમાં સેંકડો ભાવિકો આવે છે. ભક્તિ કરે છે. એ બધાને શું પોતે મંદિરમાં લાવે છે ? કે આવેલા એમની પાસે જિનભક્તિ શું પોતે કરાવે છે ? ના, છતાં પોતે એની અનુમોદના કરી શકે કે ‘વાહ ! મારા પ્રભુની ભક્તિ કરવા કેટલા બધા ભાગ્યશાળીઓ આવે છે ! એ કેવી જિનભક્તિ કરે છે ! આટલા બધા અહીં આવવાથી મારા પ્રભુનો કેવો સુંદર મહિમા ફેલાય છે ! યશ ગવાય છે !’ આમ અનેકના મંદિર-આગમન, ભક્તિકરણ, અને પ્રભુમહિમા-વર્ધનની અનુમોદના કરી શકે. આ અનુમોદનાનો જો વિચાર આવે તો પછી એ આવનારા ભાવિકોની ખામી જોવાનું મન જ કેમ થાય ?

(૨) એમ મંદિરમાં પંચમ કાળના અનુસારે કારભારી દ્વારા જેટલું સચ્ચવાય છે અને એટલી સગવડ ઉપર ભાવિકો દર્શન-પૂજનાદિ કરી શકે છે એટલું સચ્ચવાવાની અનુમોદના થઈ શકે.

(૩) એમ, દેરાસરમાં જે વીતરાગપ્રભુનાં દર્શન મળે, પૂજા-ભક્તિ મળે, પ્રભુને જોઈ એમના અપરંપાર ગુણો અને ઉપકારોનું સ્મરણ મળે, મંદિરમાં રહ્યા એટલો વખત કષાયોની કાંઈક શાંતિ અનુભવી શકાય, ને એટલો વખત સાંસારિક આરંભ-સમારંભ વ્યાપારો અને વિષયોની પ્રવૃત્તિથી સહેજે સહેજે છુટકારો મળે,

૨૨ ભુવનભાનું અન્સાઈકલોપીયા-“મંદિરમાં અનુમોદવાનું કેટલું” (ભાગ-૪૪)

એ બધાની ખુશી અનુભવી શકાય. ત્યારે એ પણ જુઓ કે મૂર્તિ ને મંદિર જ ન માનનારના ભાગ્યમાં આ ક્યાંથી ?

(૪) એવી રીતે મંદિર અને મૂર્તિ તથા મંદિરની વસ્તુઓ જેવી કે ભક્તિમાં વપરાતી ચીજોની ખુશી અનુભવી શકાય કે ‘વાહ ! કેવા સુંદર આ શુભ ભાવનાં નિભિત ?’ અહીં પૂછવાનું મન થશે કે

પ્રશસ્ત ચીજોના આનંદનું રહસ્ય શું ? :-

પ્ર.- આવી બધી ખુશીનો શો અર્થ ?

ઉ.- આનો અર્થ મોટો છે. પ્રશસ્ત ચીજોનો સાચો આનંદ હૈયામાં ઉધળે તો એ અપ્રશસ્ત ચીજોના આનંદને ધક્કો લગાવે છે. જીવને સંસાર અને સંસારની વસ્તુઓ બહુ ગમે છે, પરંતુ જો મોક્ષ અને મોક્ષ પામવામાં ઉપયોગી વસ્તુઓ બહુ ગમવા માટે તો પેલું સંસારનું ગમવાનું ઓછું થતું આવે. મંદિર ગમતું થાય તો ઘર ઓછું ગમે. મંદિર જોઈને ખુશી થાય કે ‘અહો ! આ જિનમંદિર પાપોને ઓછા કરવા માટે અને ધર્મ કર્માવવા માટે કેવું સુંદરસ્થાન !’

આવો આનંદ થાય એટલે સ્વાભાવિક છે કે પાપના ધામભૂત સંસારી ઘર બજાર વગેરે પ્રત્યે એવો આનંદ ન થાય.

(૫) એમ વીતરાગની મૂર્તિ જોઈને ખુશી થાય કે ‘અહો ! કેવી સુંદર આ કષાયોથી રહિત પ્રશાંત રસઝરતી વીતરાગ મુદ્રા !’ જો આ ખુશી થાય તો સહજ છે કે મોહમૃદ્દ અને રાગાદિ કષાયો ભરેલી સંસારીઓની રૂપાળી લાગતી મુખમુદ્રા અને ગમે તેવા રૂપાળા દેખાતા શરીર જોઈને પૂર્વના જેવા આનંદ ન થાય.

સારું જોઈ સાંસારિક રાગને ધક્કો લાગવાનો દાખલો :-

હરિભદ્રસૂરિજી મહારાજને પહેલાં જ્યારે રાજપુરોહિત બ્રાહ્મણ હતા ત્યારે એકવાર રસ્તે દોડ્યા આવતા તોફાની હાથીના ભયથી જિનમંદિરમાં પેસી જવું પડેલું; પણ ત્યાં વીતરાગ પ્રભુની મૂર્તિ જોઈને આનંદ ન થયો, ઊલઢું મશકરી સૂરી કે ‘વાહ ! આ લાષપુષ્ટ કાયા મિણાન્નભોજ હોવાનું સૂચવે છે.’ આવું દર્શન ક્યાંથી લાભ કરે ? પરંતુ પછીથી એકવાર જ્યારે સાધ્વીજીને ગાથાનો અર્થ પૂછવા એમના મુકામની અંદર જવાનું થયું ત્યારે ત્યાં સાધ્વીમંડળમાં જુદી જુદી સ્વાધ્યાય-ધ્યાન-કષાયોત્સર્ગ વગેરે પવિત્ર ચયારો જોવા મળી, અને એનો આનંદ થયો કે ‘વાહ ! વિષય-કષાયોથી મુક્ત, સંસારની મોહમય જળોજથા વિનાની અને પવિત્ર-જ્ઞાનાચારાદિમાં વ્યગ કેવી સુંદર આ આર્યાઓ !’ ત્યારે ઘરે ગયા પછી એમનું મન એના જ વિચારમાં રમતું રહ્યું; સંસારી સગાનાં મુખ જોવાનો જે એમને પૂર્વે આનંદ હતો એનો ધક્કો લાગ્યો; એ રાતના સાધ્વીઓના નિરાલા પવિત્ર જીવન પર

ભુવનભાનુ એન્સારીકલોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

વિચાર કરતા રહ્યા. એમના મનને આશ્ર્ય થાય છે કે ‘અહો ! મોહમૃદ્દ જગતમાં આવી પવિત્ર જીવનચર્ચા જીવતી આર્યાઓ જોવા મળે છે !’

હરિભદ્ર બ્રાહ્મણના અશુભ રાગને વીતરાગદર્શને ધક્કો ક્યાં સુધી :-

બોલો, પ્રશસ્ત વસ્તુ જોવા મળ્યાની ખુશી માનવાનો અર્થ છે કે નહિ ! હરિભદ્ર બ્રાહ્મણને જુઓ, એવી ખુશીથી અપ્રશસ્ત ચીજોની ખુશીને ક્યાં સુધી ધક્કો લાગે છે ! સવારે એ સાધ્વીજીના જગાવ્યા મુજબ ઉપદ્યક્તા આચાર્ય મહારાજ પાસે ગાથાનો અર્થ પૂછવા. ત્યાં ઉપાશ્રયમાં પેલા મંદિરમાં થઈને જવાનું હતું. તેથી પહેલાં મંદિરમાં જતાં વીતરાગ પ્રભુની મૂર્તિ જોઈ ખુશી થયા કે ‘અહો ! આ કોઈ સ્ત્રી, શસ્ત્ર વગેરેથી રહિત અને રાગદ્વેષ-મોહની ચેષ્ટા વિનાની આ કાયા વીતરાગ હોવાનું સ્પષ્ટ સૂચવી રહી છે. કેટલી સુંદર પ્રશાંત રસ-જરતી આ મુખમુદ્રા અને નયનો !’ પહેલાં કાયાની લાષપુષ્ટતા જોઈ હતી, હવે કાયાની પ્રશાંતતા જુએ છે, માટે અવનતિને બદલે ઉન્નતિ શરૂ થાય છે.

વીતરાગની મૂર્તિ જોવાના આનંદે હરિભદ્ર બ્રાહ્મણના દિલમાં રાગીઓની કાયા અને પ્રવૃત્તિ પરના આનંદને જોરદાર ધક્કો લગાડી દીધો; ધક્કો તે એવો કે જ્યાં પછી અંદર ઉપાશ્રયમાં આચાર્ય મહારાજ શ્રી જિનેભદ્રસૂરિજીએ એમને કહ્યું કે ગાથાનો અર્થ સમજવા માટે એકદેએકથી તત્ત્વનું તથા સૂત્રોનું જ્ઞાન મેળવવું પડે, અને તે સંસાર ત્યાગ કરી ચારિત્ર-જીવન અપનાવો તો એમાં એ મળી શકે’, ત્યાં હરિભદ્ર બ્રાહ્મણને સંસાર ત્યજ ચારિત્ર લેતાં વાર ન લાગી. જો સંસારવાસ સંસારી સગાઓ અને રાજશાહી માન-સન્માન સમૃદ્ધિનો રાગ તથા આનંદ પૂર્વવત્ત અકબંધ હોત તો અહીં સંસાર કેમ છૂટત ?

જિનમૂર્તિ વગેરેનો સાચો રાગ શું કરે ? :-

આત્મહિતની વસ્તુઓ, ધર્મસાધનાની વસ્તુઓ,

સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રની ચીજો, એ બધી પ્રશસ્ત વસ્તુ ગણાય. એની વારંવાર ખુશી સાંસારિક અપ્રશસ્ત વસ્તુની ખુશીને ધક્કો લગાડે છે. જેને વીતરાગ પ્રભુની મૂર્તિ પર સાચી ખુશી થાય છે. એને પેસાના આનંદને ધક્કો લાગે છે. તેથી તો એ પોતાના પેસા ખરચીને વીતરાગ પ્રભુની રોજ સારાં દ્વયથી પૂજા ભક્તિ કરે છે, અને અવસર મળતાં પેસા ઉરાઈને વિશેષ ભક્તિ કરે છે, તેથી આ પણ સમજ રાખો કે છતી ભક્તિએ પ્રભુભક્તિમાં પોતાનાં દ્વય લઈ જવાનું મન નથી થતું, તો એ સૂચવે છે કે ધનરાગને ધક્કો મારે એવો પ્રભુ પર રાગ નથી થયો.

ધરણશાહ પોરવાલે, વિમળશાહ મંત્રીએ, વસ્તુપાલ તેજપાલે ફક્ત એકેક મંદિર બંધાવવામાં કોડો રૂપિયા ખર્ચી નાખ્યા. ધરણશાહના ભાઈએ વીતરાગ પ્રભુની

૨૪ ભુવનભાનુ એન્સારીકલોપીડિયા-“જિનમૂર્તિ વગેરેનો સાચો રાગ શું કરે” (ભાગ-૪૪)

મૂર્તિ બનાવરાવવામાં હજારો મજા સોનું વાપરી કાઢવું, અચલગઢના શિખર પર આલીશાન ઊંચું મંદિર કરાવ્યું અને પ્રતિષ્ઠા માટે સંઘ લઈને ગયા, પ્રતિષ્ઠા કરાવી ધૂમ પૈસા ખરચ્યા, અને પ્રતિષ્ઠા પછી માણસોને ખાલી ખુશીદાન દેવામાં એક લાખ રૂપિયા વાપર્યા. એમ આભૂ સંઘવી, પૂનઃ શ્રાવક, પેથડશા, ઝંઝશશા, રાજ કુમારપાળ વગેરેએ સંઘયાત્રા અને મંદિરનિર્માણ વગેરેમાં અઠળક લક્ષ્મી વાપરી.

વીતરાગની મૂર્તિ પર સાચી ખુશી હોય તો આ બનવું કઠિન નથી.

બાકી ‘પ્રભુ તમે મને વહાલા, પણ તમારા કરતાં મારા પૈસા મને વધારે વહાલા’ એવી બનાવટી ખુશી હોય એનાથી પ્રભુભક્તિમાં પૈસો ન છૂટે.

પ્રશસ્તના રાગનાં તુ કાર્ય એ પરથી પ્રશસ્તના રાગ મપાય :-

મંદિર-મૂર્તિ-ઉપાશ્રય-સાધુ-સાધ્વી અને એની વસ્તુઓની ખુશી માનવાનો અર્થ જ એ છે કે (૧) સાંસારિક સગાસનેહી અને સંસારની પૈસા ટકા વગેરે વસ્તુઓની ખુશીને ધક્કો લાગે, ખુશી ઓછી થાય. એટલે પછી (૨) એકબાજુ એની દોડધામ ઓછી થતી આવે અને, (૩) બીજી બાજુ એને પેલી પ્રશસ્ત બાજુમાં વાળવાનું થતું આવે. આ ત્રણ કાર્ય, જોજો જીવનમાં છે ? તો એ પરથી પ્રશસ્ત વસ્તુઓના રાગ કેવા એને કેટલા છે એનું માપ નીકળશે.

પ્રશસ્તના રાગ કેમ વીતરાગ બનાવે ? :-

એટલું સમજી રાખો, જનમ-મરણની જંજાળમાંથી ધૂટવું છે ? તો એ માટે વીતરાગ બનવું પડશે. વીતરાગ થવું છે ? તો એ માટે પહેલાં અપ્રશસ્ત વસ્તુઓનો રાગ અને ખુશી ઓછા કરવા પડશે. એ કરવું છે ? તો પ્રશસ્ત વસ્તુઓના રાગ અને ખુશી દિલથી ઉભા કરવા પડશે; એને અધિક ને અધિક જમાવવા જોઈશે. ત્યારે પૂછો,

પ્ર.- પ્રશસ્તનો રાગ જમાવે જવામાં તો પછી રાગ જાઓ, તો વીતરાગ કેમ બની શકાય ?

ઉ.- આનો ઉત્તર સરળ છે. પહેલું આ સમજી રાખો કે અપ્રશસ્તનો રાગ સંસાર માટે એટલે કે બંધન માટે છે; ત્યારે પ્રશસ્તનો રાગ મોક્ષ માટે છે.

માણસને ઘર કેમ ગમે છે ? સંસારમાં બંધાયા રહેવા માટે. પણ મંદિર કેમ ગમે છે ? મોક્ષ માટે. એટલે હવે પ્રશસ્તનો રાગ કરશે એમાં લક્ષ્ય મોક્ષનું છે, અર્થાત્ બંધનથી ધૂટવાનું છે. એટલે હવે સ્પષ્ટ છે કે જેમ જેમ પ્રશસ્તનો રાગ વધતો જશે, તેમ તેમ મોક્ષનું લક્ષ્ય વધુ ને વધુ ધનિષ્ઠ-દઢ સતેજ બનતું જશે. તે એક દિવસ એવો આવશે કે જ્યારે મોક્ષનું લક્ષ્ય એટલે કે બંધનથી-આસક્તિથી

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોક્ષો”(ભાગ-૪૪)

ધૂટવાનું લક્ષ્ય મનમાં ઉત્કૃષ્ટ કોટિએ પહોંચી જતાં આસક્તિમાત્ર ધૂટી જશે ત્યાં પ્રશસ્તના રાગ પણ સહેજે ઓસરી જવાના આમ, પ્રશસ્તરાગનો જે ઉદેશ બંધનથી મુક્તિ, એ ઉદેશ ઉત્કૃષ્ટ દઢ થતાં આસક્તિમાત્ર ટળી જવાથી વીતરાગ બનાય છે. એટલે એ રાગની વૃદ્ધિ વીતરાગતાને નિકટ કરે છે.

જિન પર રાગ, મુનિ પર રાગ, સંયમનો રાગ, અહિસાનો રાગ, ત્યાગ ક્ષમાદિનો રાગ, દાન-શીલ-તપ ઉપર રાગ, શાસ્ત્ર-શાસન-તીર્થ ઉપર રાગ,...ઇત્યાદિ ઇત્યાદિ રાગ પ્રશસ્ત વસ્તુના રાગ કહેવાય. એ મોક્ષ માટે કરાય છે. એમાં આગળ વધતાં મોક્ષ એટલે સર્વસંગનો ત્યાગ એનું લક્ષ ઉત્કટ ઉત્કૃષ્ટ બની જતાં અસંગ-ભાવ જળકી ઉઠે છે, ત્યાં પછી જિન-મુનિ-સંયમ વગેરે પરથી પણ સંગ-રાગ હટી જાય એમાં નવાઈ નથી. આ બને છે ત્યારે ક્ષણમાં જ બની જાય છે. ક્ષણ પહેલાં તો સંયમ સાથે આવા અસંગભાવનો ય ઉત્કટ રાગ હોય, આકર્ષણ હોય, પરંતુ એનું ફળ ખરેખર અસંગભાવમાં આવી લાગે છે. ત્યાં ક્ષણમાં ગુણઠાણાની શ્રેણી ચડવાનું અને ક્ષણમાં વીતરાગ દશાએ પહોંચી જવાનું અને ક્ષણમાં કેવળજ્ઞાન-સર્વજ્ઞતા પામવાનું બની જાય છે.

તેથી બરાબર સમજી રાખો કે પ્રશસ્ત રાગનો ઉદેશ મોક્ષ માટે છે, તેથી એ રાગ બંધનરૂપ નથી બનતો, પણ અપ્રશસ્તના રાગના બંધનો તોડનારો બને છે. એમાં કાયા-અહંત્વના રાગ પણ અપ્રશસ્તના રાગ હોઈ એ તૂટતાં ઝટ અનાસંગભાવ આવીને ઉભા રહે છે,

બસ, વાત આ છે કે અશુભ-અપ્રશસ્ત મોહ-વર્ધક વસ્તુઓના રાગ તોડવા હોય તો પ્રશસ્ત વસ્તુના રાગ આનંદ ઉભા કરો, પુષ કરો, વધારતા રહો. એની ખુશી અનુભવો. એ ખુશી અનુભવવાનું પ્રયોજન અને પ્રમાણપત્રક આ કે અશુભની ખુશીઓ ઓછી થતી આવે.

મંદિરમાં અનુમોદવા જેવું શું શું ? એ વાત ચાલતી હતી, એમાં આ વાત હતી કે (૧) દર્શનપૂજા કરવા આવનારને જોઈને ખુશી થાય કે ‘કેવા ભાગ્યવાન આ જીવો કે અહીં પરમાત્માની ભક્તિ કરવા આવે છે !’ (૨) એમ પ્રભુની વિવિધ પૂજા-ભક્તિ-ધાર થાય એની અનુમોદના કરાય. (૩) ભાવિકો એમાં હજારો રૂપિયા ખરચી ઉત્તમ પાણે દાન કરે એ પર આનંદ અનુભવાય. એમ (૪) સુંદર અંગરચના, સ્નાત્રમહોત્સવ, સ્તવન-ગુણગાન, પ્રાર્થના, સ્વહૃદ્ધત-રૂદન, વગેરે વગેરે જે મંદિરમાં થતા હોય એ બધાં સુષૃતો છે, સત્કૃત્યો છે, એની અનુમોદના થઈ શકે. (૫) મંદિર-મૂર્તિની વસ્તુઓ શુભ ભાવનાં નિભિત છે, મૂર્તિ પ્રશશરસભરી છે એની ખુશી અનુભવી શકાય.

૨૬ ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-“પ્રશસ્તના રાગ કેમ વીતરાગ બનાવે ?”(ભાગ-૪૨)

આમ જોઈએ તો જિનમંહિરમાં અનુમોદવા લાયક ખુશી અનુભવવા લાયક એટલું બધું છે કે એની અનુમોદનાનાં જો ચિત્ત લાગે તો તામસભાવથી ત્યાં ખામીઓ ને ગુટિઓ જ જોયા કરવાની ને બખાળા જ કાઢવાની ફુરસટ જ ન મળે; અને સુહૃત્તાનુમોદન ભરપૂર કરીને ભવસ્થિતિનો પરિપાક કરી શકાય, તેમ પાપકથય, મહાન પુણ્યકમાઈ, તથા ધર્મબીજોનાં વાવેતરનો લાભ મળે. આવા લાભ કમાવાના મૂકી ખામીઓ જ જોવાનું અને તામસભાવ પોષવાનું કોણ કરે ?

પ્ર.- ખામી જ જોવાની ન હોય તો પછી સુધારો ક્યારે થાય ?

ઉ.- તો કહો બીજાની ખામીઓ જ જોનારા એમાં કેટલો સુધારો કરાવી શકે છે ? એમનાથી શેક્યો પાપડ ભાંગતો નથી. નથી તો એ બીજાને સુધારી શકતા, કે નથી એ મંદિરમાંની ખામી દૂર કરવા જાતે કથો ભોગ આપતા, એમની તો જિંદગી આખી ય કચકચને બૂમરાડ કરવામાં જ પૂરી થાય છે. પછી ત્યાં એમના ભાગ્યમાં પહેલાં કહી તેવી સુકૃતોની અનુમોદનાઓ કરવાનું કે પ્રશસ્ત વસ્તુની ખુશી અનુભવવાનું રહેતું નથી. આ બધું તામસભાવના લીધે બને છે. એ તામસભાવને પોથનાર કોધ છે. માટે કોધ કરવા જેવો નથી.

કોધ ઉઠવા જાય ત્યાં આ ભય લાગે કે ‘રખે ને કોધ કરું ને તામસભાવ પોથાય તો એ જીવનના બીજા ભાગોમાં ખરાબ અસર કરે તો ?’ આ ભયથી કોધ દબે.

આ તામસભાવ અને એને પોખનારા કોધની આદત ખાસ સુધારવા જેવી છે. મન કાહું કરીને અને ચાંપતી નજર રાખીને એ બંનેને ઉઠાતાં જ દબાવવા જેવા છે. નહિતર સમજ રાખજો કે જિંદગી આખી કોધ અને તામસભાવમાં પસાર થશે, અને એમાં સારું કશું નીપજશે નહિ. દુનિયામાં દેખાય છે કે જીવનના કાંઈ બેઠેલા એવા બુઝાઓના મોઢે પણ તામસભાવના જ અંધકારભર્યા અને બીજાઓની ભૂલો-ખામીઓના બાખાળા જ સાંભળવા મળે છે. એમને પૂછી જુઓ કે

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૧૮, અંક-૪૪૪, તા. ૧૪-૮-૧૯૭૧

‘જિંદગીમાં હજરો નહિ પણ લાખો વાર બીજાની ખામીઓના તામસભાવના વિચાર કર્યા અને બોલ બોલ્યા, પરંતુ (૧) એમાં તમે સુધારો કેટલો કરાવી શક્યા ? તેમજ (૨) આ આદતમાં રમ્યા જાત માટે સાચ્ચિકભાવ અને ઉપશમભાવના અભ્યાસ કેટલા કર્યા ?’

જો આના જવાબમાં મીઠું છે, તો વિચારવા જેવું છે કે એવા માણસ અંતકાળે ભુવનભાનુ અન્સાઈકોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો: છટવાનો મોકો” (ભાગ-૪૪) ૨૭

પણ શેમાં રમવાના ? એ વખતે ચાકરી કરનારા ચાકરી કરતા હશે, દવા-ખોરાક દેતા હશે, છિતાં આ બિચારા તામસભાવના ગાઢ અભ્યાસને લીધે મનમાં કે બહાર બણાબણતા રહેશે કે ‘દવા ટાઈમસર ન આવી, ચાહ ઠંડી આવી, બારી બંધ રાખી પણ અહીં ગભરામણ થાય છે, બરાબર પથારી પાસે કોઈ બેસી રહેતું નથી; સૌ સૌના તાનમાં છે; આ ખાંસી બહુ ઉપડી, તાવ બહુ, અશક્તિ ભારે, શરીર કણે છે, ડાક્ટર બરાબર ધ્યાન આપતા નથી,...’ આંદું આંદું તો કેટલું ય તામસભાવ અને કોથાં તાંડવ ચાલ્યા કરતું હશે.

ત્યારે આ પરથી વિચારવા જેવું છે કે શું આ ઊંચી જિંદગીમાં આવા તામસભાવના જ લાખો વારના કુસંસ્કાર કમાઈ જવાના રહે છે ? સાત્ત્વિક ભાવ, ઉદારભાવ અને ઉપશમભાવના કોઈ અભ્યાસ જ નહિ ? એના કોઈ જ સંસ્કાર અને પુરુણાનુભંધી પુરુણ કમાઈ જવાના રહેતા જ નથી ?

તામસભાવમાં બીજાની ખામીઓ જ જોયા કર્યે અને પારકી પંચાત જ ફૂટ્યે રાખ્યે જાતનું શું ભલું થશે ?

(૧) સંસાર વિચિત્ર છે, ખામીઓ ભરેલો છે, અને (૨) સારું જોવાનું આપણું એવું પ્રબળ પુષ્ય નથી, તેથી તામસભાવના લીધે નરસં-હલકું તો ઘણણું મળવાનું, તો શું એ જ જોયા કરવું ? સારું જોવાનું ક્યાંય મળતું જ નથી ? જ્યાં હલકું જોઈએ છીએ એનામાં ય સારું કશું જ નથી ? પરંતુ દિલમાં સાત્ત્વિકભાવ-ઉદારભાવ હોય તો એ દેખાય, ને બીજાની ખામી પર આંખ મિચાય. સાત્ત્વિકભાવ ન હોય તો ય એ કેળવવા માટે પણ બીજાના હલકા તરફ ખામી તરફ આંખ મીંચી સારા તરફ જ દસ્તિ રાખવી જરૂરી છે. મન કાઢું કરીને આ કરવું જોઈએ; તે એક જ વિચાર, કે

शुद्धिपात्र :-

‘મારું એવું પ્રબળ પુણ્ય નથી એટલે બીજાની ખામીઓ જોવા મળે છે, પરંતુ મારે એ જોવી, એના પર ધમધમવું, બખાળા કાઢવા, વગેરે તામસભાવનાં તાંડવ ઘેલવા નથી. એથી તો મારું રહ્યું-સહ્યું પુણ્ય પણ ખાખ થતું જાય છે, કુસંસ્કારો અને પાપકર્મના થોક જામે છે, અહીં પણ દિલને શાંતિ ય મળતી નથી, ને સાત્ત્વિક ઉદારવૃત્તિ તથા ઉપશમ ભાવ કેળવવાની સુવર્ણતક એળે જાય છે; જગતના માનવીઓમાં અને જગતની ચીજવસ્તુમાં મારા તેવા પુણ્યની ખામીએ ખામી તો હોય, પરંતુ એના પર હું તામસભાવ અને રોષ-ઉકળાટ જ કર્યા કરું તો પછી સાત્ત્વિકભાવ, ઔદાર્ય અને ઉપશમભાવ ક્યારે કેળવીશ ? એમ, જીવનભર નરદમ તામસભાવ તથા ઉકળાટ-ઉકળાટના અભ્યાસમાં અંતકાળ કેવો દેખવા પામીશ ? ને એવા અંતકાળની પછીનો અવતાર કેવો તથા એમાં શું કરવાનું મળશે ?’

બસ, આ વિચાર મનમાં રમાડ્યા કરો તો હલકા તામસભાવના વિચાર અને દિલમાં વાતવાતમાં ઉકળાટની ભયંકરતા સમજાશે ને એ ઓછા કરવાનું મન થશે, પ્રયત્ન થશે.

તામસભાવ ટાળવા ઉપાય :-

પ્ર.- પણ બીજાની ખામી મન સહન નથી કરી શકતું તેથી એના વિચાર આવે છે. એનું શું થાય ?

ઉ.- એ ટાળવાના ઉપાય આ, કે

(૧) પાયામાં આપણા પુષ્યની ખામી જુઓ કે આપણને એવું જોવા મળે છે; અને પછી એ પુષ્યની ખામી દૂર કરવા પરમાત્માનો વિચાર, જિનભક્તિ, તથા બીજાં સુફૂં અને શુભ ભાવો વધારો.

(૨) બીજો ઉપાય આ, કે બીજામાં એક જાતની ખામી છે તો શું આપણામાં બીજી જાતની ખામીઓ નથી ? એ સુધારવા આપણે ધરખમ શુભ વિચાર-ભાવના-ભાવો કરવાની જરૂર નથી ? જો એ કરીએ તો બીજાની ખામી પર મન ક્યાંથી જવાનું હતું ? અને

(૩) ત્રીજો ઉપાય આ, કે બીજામાં ખામી સિવાય જે જે સારું તત્ત્વ છે એની અનુમોદનાનો લહાવો લેવો, તથા ખામી બદલ મૈત્રી-કરુણાભાવની કમાઈ કરવી.

ટૂંકમાં વાત આ છે કે જીવન ઉત્તમ મળ્યું છે, તો એમાં ઉત્તમભાવ, સાત્ત્વિકભાવ, ઔદ્ઘર્થ અને ઉપશમભાવની પળે પળે કમાઈ પર લક્ષ રાખવું.

આ ઉત્તમ જીવન હૈયે ઉત્તમભાવ સાત્ત્વિકભાવ રમતો રાખવા માટે છે, એ પળે પળ યાદ રહે.

કારણ, જીવને મૃત્યુ બાદ સાથે આવનારી મહત્ત્વની ચીજ હૈયે રમાડેલા પવિત્ર કે મહિનભાવો છે.

કેમકે, અહીંના રમાડેલા ભાવને યોગ્ય પરલોકે ભવ મળે છે.

એટલે જો હૈયે તામસભાવ જ રમાડ્યા કર્યો, તો મૃત્યુ બાદ શું લઈ જવાનું મળે ? એ તામસભાવ જ ને ? પછી એનું પરિણામ શું ? કુદરતનો સામાન્ય નિયમ આ, કે જેવા ભાવ અહીં હૈયે રમતા રાખ્યા, પરલોકમાં એને યોગ્ય ભવ મળે, અને ત્યાં પછી એ ભાવ ફાલેકૂલે અને એમાં રચ્યાપચ્યા રહેવાય. આ હિસાબે વિચારો કે તામસભાવને યોગ્ય કેવો ભવ મળે ? ને એવો ભવ પામીને ત્યાં કરવાનું શું ?

માટે સાવધાન બનો. હૈયે તામસભાવ ન રમતો રહે એનું ખૂબ ધ્યાન રાખો. આત્માની નિકટની ચીજ પેસાટકા નથી, પરિવાર નથી, કાયા નથી, કીર્તિ ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

નથી, સત્તા-સન્માન નથી, પણ

ભાવ એ આત્માની નિકટની ચીજ છે.

કાયા-કીર્તિ-પરિવાર વગેરે બગડ્યા એમાં આત્માનું કાંઈ બગડતું નથી; પરંતુ જો ભાવ બગડ્યા તો આત્માનું બહુ બગડી જાય છે, કહે છે ને કે દાળ બગડી તો દાહાડો બગડ્યો, કપ્પું રાશિ આવ્યું તો ૨-૪ મહિના બગડ્યા, સ્ત્રી બગડી તો ભવ બગડ્યો, પરંતુ જો ભાવ બગડ્યા તો આત્માના ભવોભવ બગડી ગયા. દાળ વગેરે બગડે એમાં જો હૈયે ભાવ તામસી નહિ પણ સારા સાત્ત્વિક સલામત, તો આત્માનું કશું બગડતું નથી,

સન્તૂક્ષમાર ચક્વતનીને કાયા બગડી ગઈ, છતાં આત્માનું કશું બગડ્યું નહિ, કેમકે ભાવ સારા સાત્ત્વિક વૈરાગ્યના કર્યા, ને એમાં તો ચારિત્ર પામી ગયા. તે પછી પણ ૭૦૦ વર્ષ સુધી કાયા બગડેલી રહી, પરંતુ એમાં મહાન તપસમૃદ્ધિ કર્માયા. કેમકે ભાવ સારા સાત્ત્વિક હતા; પણ ‘હાય ! મારી કાયા બગડી ગઈ !’ એવા તામસભાવ નહિ. ત્યારે બ્રહ્મદંત એવા તામસભાવમાં ઠમી નરકે ગયો.

સીતાજીને રામે જંગલમાં તજવી દીધા, પણ એ ભાવ સંપત્તિ બગડવા છતાં સીતાના આત્માનું કશું બગડ્યું નહિ; કારણ કે ભાવ સારા સાત્ત્વિક હતા. તેથી તો એમણે મોકલેલ ધર્મસંદેશથી રામયંદજીને પારાવાર પશ્ચાત્તાપ થયો, અને તરત સીતાને પાછી લઈ આવવા એ વનમાં પહોંચ્યા. ત્યારે સીતાજીનો આત્મા તો શુભ ભાવમાં વખત જતાં અનિપ્રવેશનું દિવ્ય કરી મહાન યશ પામ્યાં, અને દરમિયાન કેળવેલા સાત્ત્વિકભાવના વૈરાગ્ય પર દિવ્ય પછી તરત જ ચારિત્રમાર્ગ પામી ગયો.

અહીં ખૂબી જુઓ,-રાવણને ત્યાં મૂક્યા ત્યાં શું, અને પછી વનમાં હક્કાલપદ્ધી થઈ ત્યાંથી ઠેઠ ચારિત્ર સુધી શું, જિનેશ્વર ભગવાનની આજ્ઞાપાલનની ભક્તિના ભાવ ખૂબ કેળવ્યા હશે, તે એ ભાવને યોગ્ય ૧૨ મા દેવલોકના ઈદ્રપણાનો ભવ મળ્યો; જ્યાં એમને અસંખ્ય તીર્થીકર ભગવાનના પહેલા જન્માભિપેકનો લાભ મળશે. અહીંના ભક્તિભાવે ત્યાં ભક્તિભાવની સગવડ કરી. પરંતુ એ અહીં કાયાનાં કષ્ટ અપમાન વગેરે પર તામસભાવના વિચાર ન કર્યા તો બન્યું.

ત્યારે બિચારા બ્રહ્મદંત ચક્વતનીને દુશ્મન બ્રાહ્મણદ્વારા આંખો ફૂટી, ને એ પછી ઠેઠ સુધી એની હાયવોયના તામસભાવમાં પડ્યો, તો પછી એને એવો સાતમી નરકનો ભવ મળ્યો કે ત્યાં જીલિમ હાયવોયના ભાવ જ કરવાના મળ્યા.

આ બહુ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે આત્માને અતિ નિકટની વસ્તુ હૈયે ઊઠાતા-રમતા ભાવ છે, ને એ એને યોગ્ય પરભવ તથા ત્યાં એવા ભાવના મંડાણ કરી આપે છે. મમ્માણશેઠ પૂર્વભવમાં લાડવો ગયાનો શોક કરેલો, તે મનમાં રાયવેલો, એટલે લાહુના સુપાત્ર દાનના પ્રભાવે મળેલા મમ્માણના ભવમાં શોકનો

ભાવ ચાલુ રહ્યો. અઢળક ધન પાસે છતાં, ‘હાય ! પણે સસ્તુ વેચાઈ ગયું, પેલું મહિતમાં લૂંટાઈ ગયું, ને મારે લેવાનું રહી ગયું. એવા ને એવા શોકના ભાવ કર્યા તો પછીથી સાતમી નરકમાં જાતિમ ત્રાસ પર પારાવાર શોકના ભાવ કરવાના આવ્યા

માટે જ હૈયે તામસભાવ, રોખનાભાવ વગેરે મલિન ભાવો રમાડતાં પહેલાં ખૂબ વિચાર કરવા જેવો છે. મનમાં મલિનભાવ પેસતાં જ ભય લાગવો જોઈએ કે ‘રખે ને આ ભાવને યોગ્ય હલકો પરભવ, અને ત્યાં આવો મલિનભાવ ઉગ્ર થઈને મળ્યાં તો આ ભય રહ્યા કરે તો સહેલાઈથી મલિનભાવ અટકાવી સારા સાત્ત્વિકભાવમાં મનને ચડાવી દેવાય. મનને એમ થાય કે ‘ભાવ સારા રાખવામાં શો ખરચ પડે છે ? કે ક્યાં કોઈ મહેનત પડે છે ?’

વાત આ છે કે મલિનભાવથી મન ન બગડે એ જ્યાલ રાખવો બહુ જરૂરી છે.

કૂરગડુ મુનિને કૃધાવેદનીયકર્મનું ભારે જોર ઊપરી આવ્યું, બાધ તપની સાધના બગડી ગઈ, પરંતુ ભાવ સારા સાત્ત્વિક હતા, તપ ન થઈ શકવાના પશ્ચાત્તાપના ભાવ હતા, તો કે કરીને ખાતાં ખાતાં જ કેવળજ્ઞાન થયું. આત્માનું શું બગડ્યું ? કશું નહિ, ભાવ ચોકખાથી આત્મા મહા નિર્મળ વીતરાગ-સર્વજ્ઞ બની ગયો.

ભાવ આત્માને બહુ નિકટની અને આત્મા સાથે સીધા સંબંધવાળી ચીજ છે. ભાવ બગડવાથી ભવોભવ બગડે છે.

માટે હૈયે તામસભાવને લેશ પણ સ્થાન ન આપો. અતિ કામ-કોધ-લોભ-અભિમાન-રોસ-ઈધ્રા વેરાએ વગેરે તામસભાવને પોષે છે; ને અહીં પણ અધમ કૃત્યો કરવે છે. માટે એનાથી બચવા જેવું છે. તામસભાવ ન પોષાય એ માટે કોધને દબાવવા જેવો છે.

કોધ સત્ત્વને હણે છે, એથી અનેક ધર્મગુણોને ધક્કો લાગે :-

કોધથી તામસભાવની જેમ નિઃસત્ત્વતા પોષાય છે; તેથી પણ કોધને દબાવવા જેવો છે. કોધ કરવામાં સત્ત્વ હણાય છે, નિઃસત્ત્વ બનાય છે, ને એ આત્માને માટે એક મોટી ખોટ છે. સત્ત્વ તો સુખે જીવવા માટે અને અનેક સત્કૃત્યો કરવા માટે તથા ધર્મ અને ગુણોને ટકાવી રાખવા માટે બહુ આવશ્યક તત્ત્વ છે, કાંઈ પણ પ્રતિકૂળ બન્યું, પરંતુ જો સત્ત્વ હશે તો મન સ્વસ્થ રહેશે. એ સત્ત્વ જો હણાઈ ગયું તો પછી સત્કૃત્યો આદિને ધક્કો લાગી કેટલી ખોટો આવવાની ? કોધ આ કામ કરે છે, સત્ત્વને હણી નાખે છે.

સત્ત્વથી કેવી રીતે કોધ દબાવાય છે ? :-

માણસ કોધમાં ચેતે છે તે કોઈ ને કોઈ પ્રતિકૂળ નિમિત્ત પામીને. માણસને પોતાને મનોવિરુદ્ધ કશું બને છે એટલે ગુસ્સો સ્કુરી આવે છે. એવું બન્યું એ સ્વેચ્છાએ સહી લેવા જોગું. ને એના પર ખામોશ રાખવા જોગું એની પાસે મનોબળ નથી, સત્ત્વ નથી; અગર છે તો કોધ કરીને એને હણી નાખે છે. કોધમાં ધમધમી ઉઠે છે ત્યાં ન ધમધમવાનું સત્ત્વ હણાય છે.

પોતે ધમધમવું ન હોય તો પોતાના ઉપર પોતાનું સ્વાતંત્ર્ય અને સામર્થ્ય છે. ‘મારે નથી ધમધમવું’ એ નિર્ધાર સાથે પોતાના મન પર દબાણ મૂકીને શાંત રહી શકે છે. ઘારી પત્ની કે પુત્ર કાંઈ વાંકું કરી બેસે તો હૃદયમાં રહેલા પ્રેમના બળ ઉપર માણસ એ ભૂલમાં ‘હવે આમાં શી મોટી ભૂલ ? આનો પ્રેમ કેટલો બધો અથાગ છે !’ એમ મનને વળાંક આપીને શાંત રાખી શકે છે ને ? ત્યાં ક્યાં ધમધમાટ કરે છે ? એટલે ન ધમધમવું હોય તો સામર્થ્ય છે. એમ બીજાની ભૂલમાં પણ ગમે તે પ્રકારે મનને વળાંક આપીને ન ધમધમવું હોય તો તે પોતાના સામર્થની વાત છે. મન પર આ સામર્થ્ય એ સત્ત્વ છે. સત્ત્વનો ઉપયોગ કરીને કોધને અટકાવી શકે છે. પરંતુ એના બદલે જો કોધથી ધમધમવા જાય છે તો એ સામર્થને સત્ત્વને હણી નાખે છે.

ત્યારે વિચારવા જેવું છે કે,

આપણે જીવનમાં કોધ-લોભ વગેરે કરી કરીને કેટલી વાર સત્ત્વને હણીએ છીએ ? બહુ બહુ વાર સત્ત્વ હણી હણીને નિઃસત્ત્વ બની ગયે પરિણામ એ આવે છે કે પછી કોઈ ધર્મ કોઈ પ્રત કે કોઈ ગુણ પર વિનં આવે એટલે એમાં ટકવાનું સામર્થ્ય રહેતું નથી; તેથી એ ધર્મ-પ્રત કે ગુણ બાજુએ મૂકી દેવાનું થાય છે; જેમ, દા.ત. દેરાસરમાં કારભારીને પોતે કાંઈ કશું, ને એણે અપમાન કર્યું, તો ત્યાં નિઃસત્ત્વ માણસ નક્કી કરે છે કે ‘બસ, આપણે આ દેરાસર હવે આવવું નહિ’ શું કર્યું આ ? મંદિરે આવવાનો ધર્મ મૂક્યો. કારણ ? નિઃસત્ત્વતા. સત્ત્વ હોત તો વિચારત કે ‘કાંઈ નહિ, હવે કારભારીને કહેવું નહિ; આપણી જાતે સારું થાય એ કરી લેવું.’ બસ, આ વિચારથી શાંતિ રાખી દેરાસર આવવાનું બંધ નહિ કરત.

એમ કોઈ બાધા પ્રત છે, પણ નિઃસત્ત્વ માણસને જો સગાસ્નેહી જરા દાખિયમાં નાખે કે કોઈ પ્રલોભન આવી લાગે તો પ્રત બાજુએ મૂકતાં વાર નહિ. કેમકે પ્રતમાં ટકવા સત્ત્વ જોઈએ ને ?

એવી રીતે માનો કે ઉદારતાનો કંઈક ગુણ કેળવ્યો છે, એટલે અમુક પ્રતધારી કે તપસ્વી સાધર્મિકોને જમણ આપ્યું, પરંતુ એમની પંગતમાં કોઈ ભળતો માણસ જમવા બેસી ગયો દેખાયો તો ત્યાં પોતાની નિઃસત્ત્વતા ઉદારતાને ફગાવી દેશે,

અને પેલાનું અપમાન કરવા પ્રેરશે, ‘તમે કેમ અહીં જમવા આવ્યા ? ગોલ્ફાં છો ? શરમ નથી આવતી મફતિયું જમવા આવતા ?’ આમ નિઃસત્ત્વતા ઉદારતાને બાજુએ મૂકાવશે નહિતર સો પચાસ માણસમાં એક વધારે જમી ગયો તો શી ખોટ આવી જાય છે ? પણ એ ખમી લેવાનું સત્ત્વ નથી.

સત્ત્વથી ધર્મ-પ્રત-ગુણ-સુકૃતની રક્ષા અને વૃદ્ધિ થાય છે, ત્યારે નિઃસત્ત્વતાથી અવસરે અને ધક્કો પહોંચે છે.

માટે સત્ત્વને ખૂબ સાચવવા વધારવાની જરૂર છે.

સુલસામાં સત્ત્વ હતું, તો અંબડ પરિવ્રાજ કે એની ગમે તેવી પ્રલોભક પરીક્ષા કરી, પરંતુ સુલસાએ સમ્યક્તવધર્મને-પ્રભુ મહાવીરદેવ પ્રત્યેની અથાગ ભક્તિના ધર્મને આંચ ન આવવા દીધી, એણે વીતરાગ પ્રભુને સ્મરવાનું છોડી બીજા સરાગી દેવને જોવા જવાની લેશમાત્ર ઈચ્છા જ ન કરી. ત્યારે જ્યાં અંબડે બાજુ સંકેલી સુલસા પાસે શ્રાવકવેશે જઈ પ્રભુનો સંદેશો કહ્યો ત્યાં સુલસા પ્રભુપ્રત્યેની ભક્તિના આવેગમાં પાણી પાણી થઈ ગઈ. સત્ત્વે એના ભક્તિધર્મમાં વૃદ્ધિ કરી.

સુદર્શનશેઠ સત્ત્વથી અભયા રાણીના પ્રલોભન અને પછી ભયંકર દમદારી વખતે પણ શીલપ્રત-બ્રહ્મચર્યનું રક્ષણ કર્યું. શૂળીએ ચડવાનો પ્રસંગ આવ્યો છતાં સત્ત્વના બણે રાજ આગળ રાણીનું કારસ્તાન પ્રગટ ન કર્યું. રાણીને અભય દેવાના ગુણની રક્ષા કરી. શૂળીનું સિંહાસન થઈ ગયું; અને પછી તો એ સત્ત્વે પ્રતવૃદ્ધિ એવી કરી કે સુદર્શનશેઠ ચારિત્રના મહાપ્રતમાં ચરી ગયા.

વિજય-વિજયાને શું બન્યું ? વિજયએ વિજયને પરણીને જ્યાં જાણ્યું કે ‘પોતાને શુક્લપક્ષનું બ્રહ્મચર્ય છે, પણ જે કૃષ્ણપક્ષમાં સંસારભોગની છૂટ છે એ કૃષ્ણપક્ષના બ્રહ્મચર્યનો પતિને નિયમ છે, ત્યાં જ સત્ત્વથી કૃષ્ણપક્ષના પણ બ્રહ્મચર્યનો એટલે કે જીવનભર સંપૂર્ણ બ્રહ્મચર્યનો નિયમ કરી લીધો, અને પતિને પોતાના નિયમની વાત કરીને પોતાની આશા મૂકી દઈ બીજી પત્ની કરી લેવાની છૂટ આપી. ત્યારે વિજય પણ સત્ત્વશીલ હતો તે એણે કહ્યું ‘તમારે અભળાને સંપૂર્ણ બ્રહ્મચર્ય ખપશે તો શું મને મરદને એ નહિ ખપે ? મારે પણ સંપૂર્ણ બ્રહ્મચર્યનો નિયમ.’ સત્ત્વથી બંનેએ પ્રતની રક્ષા કરી પ્રતમાં વૃદ્ધિ કરી; ને આગળ જતાં મહાપ્રતયુક્ત ચારિત્ર માર્ગ ચરી ગયા અને કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યો.

વિમળશાહમંત્રી અને એમની પત્નીને પુત્રની અને મંદિરની ઈચ્છા હતી, દેવીએ વરદાન આચ્યું પણ એ રીતે કે ‘તમારા ભાગ્યમાં કાં તો પુત્ર, કાં આબૂ પર જિનમંદિર, બેમાંથી એક છે; તો જે ઈચ્છા હોય તે એક માગી લો.’ ત્યાં બંનેએ સત્ત્વથી પુત્રેચા જતી કરી અને મંદિર બનાવવામાં દેવીની સહાયતા માગી લીધી.

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

૩૩

સત્ત્વે મંદિરનિર્માણના સુકૃતની રક્ષા કરી. ઢંઢણાંધિને પોતાની લભ્યની ભિક્ષાનો નિયમ, તે છ મહિના સુધી એવી ભિક્ષા ન મળવાથી છ માસના ઉપવાસ ચાલ્યા, અંતે એવી ભિક્ષા છે માની વહોરી લાવીને પ્રભુશ્રી નેમિનાથ ભગવાનને પૂછે છે ‘ભગવંત ! આ મારી લભ્યની ભિક્ષા ખરી ?’ પ્રભુ ‘ના’ કહીને કૃષ્ણની લભ્યની એ ભિક્ષા હોવાનું કહે છે. ઢંઢણમાં સત્ત્વ હતું, તેથી નિયમ પર કંટાળ્યા નહિ કે ‘તો પછી આ નિયમ તો ક્યારે પૂરો થાય ?’ એ તો તરત અને વનમાં પરઠવવા-મૂકી દેવા ગયા. મૂકી દેતાં સત્ત્વ હતું એટલે શુભ ભાવનાધર્મનો વેગ વધાર્યો અને ત્યાં જ ઘાતી કર્મનો ભુક્કો કરી કેવળજ્ઞાન પામ્યા, વીતરાગ-સર્વજ્ઞ બન્યા.

અણાણું ભાઈઓ પર ભરતે આજ્ઞામાં આવી જવાનો, નહિતર યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ મોકલ્યો. અણાણું કોધથી ધમધમ્યા, લડી લેવાનો નિર્ધાર કર્યો, પણ પિતૃ-આમન્યાનો ગુણ હતો, તેથી પિતા ઋષભદેવ પ્રભુને પૂછ્યા માટે ગયા. સત્ત્વ હતું તેથી ભરતની જોહુકમી છતાં પિતૃ-આમન્યાનો આ ગુણ બાજુએ ન મૂક્યો કે ‘આવી સંસારી વાતમાં પ્રભુને શું પૂછ્યા જવું હતું ?’ પરંતુ સત્ત્વથી ગુણની રક્ષા કરી, અને પ્રભુની પાસે પહોંચી ગયા. પ્રભુએ સમજાયું કે ‘ભરતને શું દુષ્મન દેખો ? ખરા આંતર શત્રુ રાગ-દ્રેષ-તૃષ્ણા વગેરે ને ઓળખો અને લડવું હોય તો એની સાથે લડી લો.’ સત્ત્વે આમન્યા ગુણમાં એવી વૃદ્ધિ કરી કે અણાણું એ તાંજ પિતા પ્રભુની વાણી સ્વીકારી લઈ આંતરશત્રુનો નાશ કરવા પ્રભુનાં ચરણનું શરણ સ્વીકારી લીધું, સંસાર ત્યજ મુનિ અણગાર બની ગયા. અહીં સત્ત્વ ન હોત તો ?

સત્ત્વથી શું શું ? :-

(૧) સત્ત્વ ધર્મ-પ્રત-ગુણ-સુકૃતની રક્ષા અને વૃદ્ધિ કરે છે. (૨) સત્ત્વ ગુણસ્થાનકની પાયરીએ ઉંચે ઉંચે ચાલે છે, ને (૩) ધર્મધ્યાન-શુક્લપક્ષમાં સત્ત્વથી અંગ રહી આગળ વધતાં અપૂર્વ-કરણાનો સામર્થ્યોગ પ્રગટાવાય છે. (૪) જેમાં આગળ વધતાં ક્ષપકશ્રેણી અને કેવળજ્ઞાને પહોંચી જવાય છે. આ બધું સત્ત્વને આભારી છે. સત્ત્વ ન હોય, અગર હોય તો વિકસાવે નહિ, તો ઉંચે ચરી જવાનું ન બને.

શ્રેણિક કૃષ્ણ મહારાજામાં સત્ત્વ હતું, પાછો એ સત્ત્વમાં વિકસ એવો કર્યો કે સમ્યક્તવધર્મ યાને અરિહંત પરમાત્મા ઉપરની અથાગ શ્રદ્ધા-ભક્તિનો ગુણ વધતો ચાલ્યો, તે ક્ષાયોપશમિક સમ્યક્તવમાંથી ક્ષાયિક સમ્યક્તવે ચરી ગયા, ત્યારે સત્ત્વ હશાઈ ગયાથી જીવો પામેલા સમ્યક્તવને પણ હારી જાય છે. જરાક વિષયોનું પ્રલોભન આવ્યું યા ક્ષાયનો પારો ચરી જવા નિમિત્ત મળ્યું કે તરત જ નિઃસત્ત્વતાને લીધે એમાં તણાઈ જતાં અનંતાનુંબધીના રાગ-દ્રેષ ખડા કરી સમકિતનો નાશ કરે છે.

૩૪ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“તામસભાવ ટાળવા ઉંપાય” (ભાગ-૪૪)

કમલપ્રભાચાર્યને સમ્પર્કત્વની ઉજજવળતામાં તીર્થકર નામકર્મનું પુણ્ય ઊભું થયું હતું, પરંતુ અનાડી ચૈત્યવાસી સાધુઓના પ્રસંગમાં આવતાં માન કષાયમાં એવા ચડ્યા કે ‘મને થઈ ગયેલ સાધીના સંઘડાને સ્પર્શને કેમ કબૂલ કરું ?’ આ કષાયે સત્ત્વ હણી નાખ્યું, તેથી પેલાના ‘તમે સાધીને કેમ અડ્યા ? સાધુથી સ્ત્રીને અડાય ?’ એવા પ્રશ્નના ઉત્તરમાં કહી દીધું કે ‘શાસ્ત્રમાં ઉત્સર્ગ-અપવાદ ઘણા છે. તમને શું ભાન ?’ ત્યાં એમણે આ કષાયના જોરે સમ્પર્કત્વ ગુમાવ્યું તીર્થકર નામકર્મનું પુણ્ય ગુમાવ્યું, સાવદ્ધાચાર્યની પ્રસિદ્ધ પામી સંસારમાં ભટકતા થઈ ગયા.

મદનરેખા મહાસતીના મોહમાં જેઠે એના પતિ યુગબાહુને મારી નાખવા તલવારનો જીવલેશ ધા કર્યો, યુગબાહુ કોધમાં ચક્યો, પણ મહાસતીમાં સત્ત્વ હતું તો પોતાની આ આપત્તિ અને ભાવી આપત્તિની એ વખતે ચિંતા મૂકી દઈ પતિને ક્ષમા રાખવાનો અને નવકારમંત્ર યાદ કરવાનો ઉપદેશ આપ્યો. સતીના સત્ત્વભર્યા ઉપદેશે પતિમાં સત્ત્વ ચ્યમકાવ્યું, એ સત્ત્વથી કપાઈ મરવાની ધોર પીડા ભૂલી જઈ મારનાર ભાઈ પર ક્ષમાનું આલંબન કર્યું અને પરમેષ્ઠીનું ધ્યાન કરતાં મરીને પાંચમાં દેવલોકે ચી ગયા.

સત્ત્વહીનની અંતકણે દુર્દ્શા :-

સત્ત્વ શું કરે ? અંતિમ કાળ સુધારી આપે.

સત્ત્વ હોય તો અંતકણે નિર્યામણા કરવનારનો ઉપદેશ જીલાય, ઉપદેશને મન દઈ દિલમાં ઉતારાય; હવે જો જવાનું જ છે તો સત્ત્વ ધરી જીવવાનો મોહ મૂકી દઈને પાપનો પશ્ચાત્યાપ, સર્વ જીવોને ક્ષમા-ક્ષમાપના, અને અરિહંત પરમાત્મા આદિનું શરણ સ્વીકારવાનું કરાય. પરંતુ સત્ત્વ નહિ હોવાને લીધે બિચારો મુઢદાલગીરીથી ફાંઝા મારે છે કે હજ વધુ જીવી જવાય છે ? દીન બને છે, - ‘અરેરે ! મારે મરવાનું ? કોઈ જીવાડો ને ડાક્ટર ! ભાઈસાબ કાંઈ ઈજેક્શન લગાવોને, તો મને સારું થઈ જાય...’ આ દીનતા ને મુઢદાલગીરી હોય ત્યાં એની લોથમાં જીવનભરનાં પાપોને પશ્ચાત્યાપથી હળવાં કરવાનું શે યાદેય આવે ? કોઈ સાધુ કે સાધ્યમિક યાદ કરાવે તો ય પેલી જીવવાની ને મરણ ટાળવાની જંખનાની લોથમાં એ શે સૂઝે ? પાપ હળવા કરી પરભવમાં દુઃખ ઓછા કરવાનું ન સૂઝે પછી સર્વજીવ-ક્ષમા-ક્ષમાપના તથા અરિહંતાદિ-શરણ અને પરમેષ્ઠ-સ્મરણથી પરભવ સુધારવા સદ્ગતિ સરજવાનું તો સૂઝવાનું જ ક્યાં ? વિચારો, સત્ત્વ નહિ એની કેટલી દ્યાજનક દુર્દ્શા ?

એ તો જીવનભર સત્ત્વ દાખવાતો રહ્યો હોય તો અંતકણે એ કામ કરે.

પરંતુ કોધી પ્રકૃતિ વારે વારે કોધમાં ધમધમાટ કરાવી સત્ત્વ હણી નાખે છે. વિચારવું તો આ જોઈએ કે,-

‘અહીં મારે એવા કોઈ નરક-તિર્યચ જેવા ભયંકર દુઃખ નથી, એની અપેક્ષાએ તો બહુ સારાસારી છે; આ સારાસારીમાં જો સામાન્ય અગવડ કે વાંકું થવામાં ક્ષમા-શાંતિ રાખવાનું સત્ત્વ નહિ કેળવું તો પછી સત્ત્વ ક્યાં કેળવીશ, અને અહીં સત્ત્વહીનતામાં અંતકાળ કેવો આવશે ?

સારાસારીમાં સારું કમાઈ લેવાનો વિચાર સદ્ગુણો-સત્કૃત્યોને સહિષ્ણુતા માટે બહુ પ્રેરક છે.

નરકગતિમાં ગ્રાસનો પાર નથી, ત્યારે સમુદ્રમાં જ્યાં મત્સ્ય-ગલાગલ ચાલે છે એ માછલાં વગેરે તેમજ પશુ-પંખીની કેટલી દુર્દ્શા છે એ પણ આપણે જાણીએ છીએ. ત્યારે કીડા વગેરે વિકલેંડિય જીવો અને એકેંડિય પૃથ્વીકાયાદી જીવોની દુર્દ્શાનું પૂછવું જ શું ? તેમ મનુષ્યોમાં ધર્મહીન અનાર્થ-અલેચ્યો અને આર્યોમાં જે ક્ષાઈ જેવા ધોર પાપમાં પડેલા છે તેમજ બીજા જે ભયંકર રોગ, ગુલામી અને જાલિમ વિટંબણામાં પડ્યા છે, અને બધા જીવો કરતાં આપણે કેટલી સારી સ્થિતિમાં છીએ એનો વિચાર કરો, આ સારાસારીમાં જો સદ્ગુણો ક્ષમા, નમતા, ઉદારતા-ગંભીરતા, દ્યા-સત્ય-પ્રામાણિકતા વગેરે નહિ કેળવી લઈએ, તેમજ જિનભક્તિ-સાધુસેવા સંયમ-દાન-પરોપકાર, ત્યાગ-તપસ્યા-બ્રહ્મચર્ય વગેરે સુકૃતો નહિ આચરી લઈએ, તેમ અણગમતું સહી નહિ લઈએ, તો પછી આ સારાસારી નહિ હોય અને પેલી મહાદુર્દ્શા-વિટંબણ હશે, ત્યારે આપણે સારું શું કરી શકવાના ? સારાસારી એ તો સારું કરી લેવા માટે સોનેરી તક છે.

વર્તમાનમાં આપણને એક યા બીજી તકલીફ હશે, અગવડ-દુઃખ-કષ્ટ હશે, પરંતુ એને બહુ મોટી માનવા જેવી નથી, ને એનું રોએણું રોવા જેવું નથી. તુલનાથી જોજો કે પેલા નરકાદિ ગતિના જીવોની દુર્દ્શા કેવી છે, અને એની તુલનામાં આપણને કઈ સ્થિતિ છે ? પેલા જીવોની અપેક્ષાએ તો આપણે બહુ સારી સ્થિતિમાં છીએ. માટે આ સારાસારીમાં સદ્ગુણ-સુકૃતો કમાઈ લેવાના છે.

મહાપુરુષોને કષ્ટ : નળ-દમયંતી :-

એ પણ જોવા જેવું છે કે મહાન આત્માઓને અવસરે જે વેદવાનું આવ્યું છે એમાંનું આપણને દસમા-સોમા ભાગનું દુઃખ નથી. ભાઈ સાથે નળરાજના જુગારના ચડસમાં નળને અને દમયંતીને કેટલું વેદવાનું આવ્યું ? જ્યારે એ બહું હારીને ચાલી નીકળે છે, ત્યારે હવે રાજ બનેલ ભાઈ પુષ્કર પ્રજાને સખ્ત હુકમ આપ્યો છે કે કોઈએ નળ-દમયંતીને આશ્રય આપવો નહિ, તેમ લેશ પણ સહાય કરવી નહિ.’

પ્રજા નળ-દમયંતીને ખૂબ ચાહે છે, એમના પર અનહં માન ધરાવે છે, પરંતુ સત્તા આગળ શાશ્વતપણ નકામું. આખી પ્રજા મોં વિકાસી જોઈ રહે છે, આંખમાંથી આંસુ પાડે છે, પરંતુ કશી સહાય કરી શકતા નથી. ત્યારે વિચારો નળ-દમયંતી કેટલી હુર્દશામાં મૂકાયા ? વળી જંગલમાં દમયંતીને છોડીને નળ ચાલી ગયો અને દમયંતી એકલી ભટકતી ચાલી એમાં ચોર-રાક્ષસ વગેરેના ઉપદ્રવ આવ્યા, સાત વરસ ગુજ્ઝામાં એકલીએ કાઢવા પડ્યા,...માશીને ત્યાં મૂકાઈ પણ માશીએ ઓળખી નહિ, તો દાસી જેવી સ્થિતિમાં રહેવું પડ્યું. વિચારો આ કષ્ટો-ઉપદ્રવોની અપેક્ષાએ તમારે શા કષ્ટ-ઉપદ્રવ છે ? ત્યારે એમણે ધીરતા કેવી રાખી !

રાજા હરિશંદ્રને શમશાનની નોકરી જેવી ભંગાની દશામાં મૂકાવું પડ્યું, ને રાણી તારામતીને વેચાવાનો અવસર આવ્યો, બ્રાહ્મણને ત્યાં દાસીપણું પામવું પડ્યું. કઈ કેવી હુર્દશા ? છતાં બંનેના દિલની સ્વસ્થતા કેવી ?

સીતાજી મહાન રાજરાણી, રાજા રામયંકણીની પ્રિય પહૃતરાણી, અને ગર્ભિજી અવસ્થામાં પહેર્યે લૂગડે જંગલમાં એકલી અટૂલી તરછોડાવાનો અવસર આવ્યો; એની અનેક પ્રકારની મહાવિંબણાઓ વિચારો કે કેવી હુર્દશા ?

રાજા કુમારપણ દેવીને બોકડાનો ભોગ નથી આપતા તો દેવીએ એમને ત્રિશૂળ મારી ભયંકર વેદના સાથે કોઢિયા કર્યા ‘જાઓ બોકડાનો ભોગ નથી આપવો તો આવા રહો !, આ દેવીનો કોપ છે.

મહાપુરુષોએ વેઠેલી વેદના-વિંબણા-હુર્દશાઓ દેખો તો માલુમ પડે કે એ બધાની તુલનામાં આપણે શું વેદવાનું આવે છે તે જરૂર ઉકળી ઊઠીએ છીએ ? ને મનને મલિન વિચારો-કાળીલેશ્યા-આર્તધ્યાન અને કોધાદિ કષાયોથી કાળું કરીએ છીએ ? એવી ધોર વેદના-વિંબણામાં પણ એ મહાન આત્માઓએ મન નથી બગાડ્યું, હાયવોય નથી કરી, સામા પર દેખ-ધમધમાટ નથી કર્યો. ત્યારે એમના કરતાં તો આપણે બહુ થોડી આપત્તિ આવી એ વખતે આપણે પેલી મહા ભારે વિંબણાની અપેક્ષાએ તો સારાસારી કહેવાય. આ સારાસારીમાં જો સત્ત્વ જાળવી રાખી ક્ષમા સમતા નિર્લોભતા-ઉદારતા વગેરે નહિ કેળવી લઈએ તો પછી ભવિષ્યમાં કર્મવશ કપરી સ્થિતિમાં મૂકાયે શું કરી શકવાના ? અને જિંદગીભર જો આ જ રોષ ને રોક, હાયવોય ને ધમધમાટ લોભિયાપણું ને ક્ષુદ્રતા રાખ્યા કરી તો અંતકણ કેટલો દુઃખ અને રોતડ આવવાનો ? ત્યાં શાંતિ રાખવાનું સત્ત્વ જ નહિ.

વાત આ છે કે કોધને રોકવા વિચારવાનું કે કોધ કરીશ તો મારું આંતર સત્ત્વ હણાશે, નિઃસત્ત્વ થઈશ, અને એની બૂરી અસર જીવન પર પડશે. માટે સત્ત્વને જાળવવા-કેળવવા કોધ પર અંકુશ મૂકી દઉં.

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : હૂદવાનો મોકો” (ભાગ-૪૪)

(૧૩) કોધને અટકાવવા માટે વળી એક વિચાર આ છે કે કોધ કરવામાં ઔદ્યિક ભાવમાં પડવાનું થાય છે, અર્થાત્ મોહનીય કર્મનો ઉદ્ય વેઠવાનું એટલે કે મોહની આજ્ઞા પણવાનું થાય છે. ત્યારે જો કોધને અટકાવી શાંત-ઉદાર-ક્ષમાશીલ રહેવાનું કરાય તો ક્ષાયોપાશમિક ભાવમાં જીલવાનું યાને કર્મના ક્ષાયોપશમને અનુભવવાનું મળે છે એમાં જિનની આજ્ઞા પણવાનો લાભ મળે છે.

મોહની આજ્ઞાને બદલે જિનાજ્ઞા પણવાનો લાભ મળે એ માનવ જીવનની એટલી સુંદર સફળતા છે, ને જિનાજ્ઞા કોધાદિ કષાયોને દબાવવાની છે.

જરાક કોધને દાબીએ આ વિચારથી કે “મારા જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે કે કોધાદિ કષાયોને દાબો, શાંત કરો, ઉપશમભાવ રાખો’ તો હું કોધને દાબીને એ જિનાજ્ઞાનું પાલન કરું,” ને કોધને દાબ્યો તો આમાં કષાયનિશ્વરનો તો લાભ મળ્યો જ, વધારામાં પ્રભુની આજ્ઞા પર સક્રિય બહુમાન ધર્યું, આજ્ઞાપાલન કર્યું; અને એ મહાન લાભ થયો. જિનાજ્ઞાનું પાલન એ જબરદસ્ત ઉન્તિનું સાધન છે. એનાથી કર્મની બેખડો તૂટે, કર્મનાં આવરણની ભીત ભંગાવવાનું થાય. કવિ પ્રભુને સત્તે છે,

‘તપ-જપ-કિરિયા મોઘરે રે, ભાંગી પણ ભાંગી ન જાય;

પણ તુજ આજ લહો થકે, એક હેલામાં પરહી થાય,

અનંતજિન ! આપજો રે મુજ એહ અનંતા ચાર.’

અર્થાત્ કર્મ-આવરણની ભીત આત્માના અનંતજાન-દર્શન-વીર્ય અને સુખ એ ચાર અનંતાની અડે એવી ઊભી છે કે એ ભીત ભાંગ્યા-તોડ્યા વિના આ નિજની પણ ચાર અનંતાની સમૃદ્ધ પ્રગટ ન થાય. ત્યારે આ ભીત ભાંગવા માટે લોખંડી મોઘર જોઈએ. એવી મોઘર તરીકે તપ જપ કે ધર્મક્રિયા જે કામ નથી લાગતી એવી જિનાજ્ઞા કામ લાગે છે. અહીં પ્રશ્ન થાય,

જિનાજ્ઞાનુસાર બનવા કેવા કેવા ઉદેશથી સાધના કરાય ? :-

પ્ર.- શું તપ-જપ વગેરે જિનાજ્ઞામાં નથી આવતા ? જો આવે છે, તો એ શું મોઘરનું કામ ન કરે ?

૩.- તપ-જપ વગેરે જો જિનાજ્ઞા મુજબના હોય તો એ જરૂર મોઘરનું કામ કરે. જોવાનું એટલું જ કે એ જિનાજ્ઞાનુસાર છે ? હોય તો તો એ જિનાજ્ઞામાં જ છે.

પરંતુ તપ આદિ એ જિનાજ્ઞાનુસાર ત્યારે બને કે

(૧) એ તપ-જપ-કિરિયા માત્ર કર્મક્ષર્યાર્થ કરાય, અથવા

(૨) આત્માના રાગ-દેખ અને કામ-કોધ-લોભાદિ દોષો મોળા પાડવા માટે

એ કરાય; યા

(૩) જીવનમાં ખાનપાન-સંસારવ્યવહાર નહિ પણ આ જ કરવા યોગ્ય કર્તવ્ય છે, આ કરવામાં જ આત્માની શોભા છે, શાંતિ છે, એમ માનીને કરાય; કે

(૪) જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા છે માટે એ તપ-જપ-કિયા કરાય; યા

(૫) બાધ્યભાવથી બચી શુભ ભાવમાં રહેવા સારુ કરાય, કેમકે આહારાદિ સંજ્ઞા ખાતર દિલના ભાવ બગડે છે; યા

(૬) એમાં જીવદ્યા-અહિંસા પળે એટલા માટે એ આચરાય; કારણ કે ખાનપાનાદિ માટે જીવહિંસા થાય છે; અથવા

(૭) ‘મહાસુકોમળ અને મહાસમૃદ્ધ શાલિભદ્ર જેવા, મહાસમ્રાટ સનતકુમાર ચક્રવર્તી જેવા, કે મહાબુદ્ધિમાન હિંદ્રભૂતિ-હરિભદ્ર બ્રાહ્મણ જેવાએ જીવનને તપ-જપ-ધર્મકિયાથી જ દીપાબ્યું છે, માટે હું પણ એ જ કરું;

આવા કોઈ હેતુથી તપ-જપ-કિયા કરાય તો એ જિનાજ્ઞામાં આવે, અને એ કર્મ-આવરણની ભીત તોડવામાં મોઘરનું કામ કરે. પરંતુ જો આ ઉદ્દેશને બદલે કોઈ લૌકિક કીર્તિ-વાહવાહ કે ધન-માલ વગેરે મેળવવા માટે કરાય તો એ જિનાજ્ઞામાં ન આવે. એ તો મોહની આજ્ઞાથી થયા. દિલની અંદરના ધન-માલ-કીર્તિ આદિના લોભ મોહનીયે પ્રેરણા આજ્ઞા કરી કે ‘તપ-જપ-કિયા કર, તો આ ધન-માલ મળશે.’ ત્યારે એવી પ્રેરણાથી કરવામાં તો લોભ-મોહનું પોષણ થાય, કર્મની જડ મજબૂત કરે. ત્યાં કર્મ તોડવાનો એ મોઘર શે બને ?

તપ-જપ-કિયા વગેરેને કર્મ તોડનારો મોઘર બનાવવા જિનાજ્ઞાનુસાર આરાધવા જોઈએ, એ માટે આટલું પણ બસ છે કે જિનાજ્ઞાના જ એક પાલન તરીકે એ આરાધાય,

કોઈ પૂછે ‘કેમ તપ કરો છો ?’ ‘કેમ જપ લઈ બેઠા છો ?’ ‘કેમ પૂજા-પ્રતિક્રમણ કરો છો ?’

બધાનો એક જ જવાબ દેવાય કે ‘ભગવાનની આજ્ઞા છે માટે.’ કોઈ ન પૂછે તો પણ મનને આ ઉલ્લાસ રહ્યા કરે કે ‘લાવ તપ કરું, જપ કરું, દેવ-દર્શનાદિ ધર્મકિયા કરું, દાન દઉં, પ્રત લઉં,...તો એટલી જિનાજ્ઞા પાળવાનો એમાં મહાન લાભ મળશે. આ જગતમાં જિનાજ્ઞા કયાં મળે ?’

‘એવં અણોરપારે સંસારે સાયરંમિ ભિમંમિ ।

અમયમય જિણવયણ સુદુલ્હં માણુસે વિ ભવે ॥’

અર્થાત્ આ પ્રમાણે અસંખ્ય અને અનંતા કાલયકોની કાયસ્થિતિથી અપાર ભયેકર સંસાર-સમુદ્રમાં મનુષ્યભવમાં પણ અમૃતમય જિનવયન મળવું અત્યંત દુર્લભ છે.

ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો: ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૩૮

‘અસંખ્ય-અનંત કાળયકોની કાયસ્થિતિ’નો અર્થ સમજો છો ને ? એનો અર્થ એ છે કે જીવ આ સંસારમાં જનમ-મરણ કરતો કરતો જો એકેન્દ્રિય તિર્યાગતિમાં ઊતરી જાય છે તો ત્યાં કોઈ પૃથ્વીકાય અપ્રકાય વગેરેનો ભવ યાને પ્રત્યેકકાય સ્થાવરનો અવતાર પામે છે, યા અનંતકાય સ્થાવર વનસ્પતિનો અવતાર પામે છે. હવે અહીં એવું બને છે કે જીવ જો પ્રત્યેકકાય સ્થાવરમાં ગયા પછી એમાં ને એમાં જ મરીને જન્મે, એમ વાર વાર મરી મરીને એજ સ્થાવરકાયમાં જનમ્યા કરે, અર્થાત્ એની એજ કાયસ્થિતિમાં જન્મ-પરંપરા કરે તો એ ઉત્કૃષ્ટ યાને વધુમાં વધુ કેટલો કાળ ચાલે ? તો કે અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી, એટલે કે અસંખ્ય કાળયક ઉત્સર્પિણીના હ ચડતા આરા, અને અવસર્પિણીના હ ઊતરતા આરા; એમ કુલ ૧૨ આરાનું એક કાળયક થાય. આમાં ૨૦ કોટિ કોટિ સાગરોપમ વર્ષ પસાર થાય; એ એકેક સાગરોપમ વર્ષમાં ૧૦ કોટિકોટિ પલ્યોપમ વર્ષ જાય; અને એ એકેક પલ્યોપમમાં અસંખ્ય વરસો વીતે. ત્યારે ૨૦ કોટીકોટી સાગરોપમમાં વર્ષોની સંખ્યા કેટલી એટલું તો માત્ર ૧ કાળયકના સમયમાં; પરંતુ એવા અસંખ્ય કાળયકમાં કેટલા વર્ષ જાય ? એટલા વર્ષોની સ્થાવરમાં કાયસ્થિતિ છે, એટલે જીવ એકેન્દ્રિય પ્રત્યેક સ્થાવરકાયમાં જ વારંવાર જનમ પામી પામી સ્થિતિ કરવાનું કરે તો વધુમાં વધુ એટલા બધા વરસ સુધી કરવાનું બને; તેમ જો અનંતકાય સ્થાવરમાં પૂરાય તો ઉત્કૃષ્ટ અનંતા કાળયકની કાયસ્થિતિમાં મૂકાવાની શક્યતા છે. ત્યાં સંસાર સાગર કેવો અપાર ?

ત્યારે વિચારવા જેવું છે કે જો આપણો જીવ-અહીં કોઈ ગાઢ મૂઢળ્યા યા પ્રમાદના પાપમાં પડી એકેન્દ્રિયપણામાં ચાલ્યો ગયો અને ત્યાં એવી અસંખ્ય કે અનંત કાળયકોની મોટી કાયસ્થિતિમાં ફસાઈ પડ્યો તો એની દશા કઈ ? મોકથી કેટલો કાળ દૂર રહેવાનું ઊભું થાય ?

હિંસાથી બચવા એક અનેરો વિચાર :-

એવું આ પણ એક મહત્વાનું વિચારવા જેવું છે કે આપણા પ્રમાદથી કોઈ ક્રીડી-કીડા માખી-મય્યર-માકણ વગેરે જીવની યા પંચેંદ્રિય ઉંદરડી ગિરોલી આદિ કે પંખીના દુડા આદિની જો હિંસા થઈ ગઈ અને એ જીવને મરતાં ગાઢ સંકલેશથી કદાચ એકેન્દ્રિયપણાનો અવતાર મળ્યો, તો પછી એને ઉત્કૃષ્ટ કે એના જેવી જંગી કાયસ્થિતિમાં મૂકાઈ જવાનો સંભવ ખરો ને ? હવે વિચારો કે જો એ જીવ આપણા પ્રમાદ બેપરાવાઈથી ન મરતાં કુદરતી મોતે શાંતિથી મર્યો હોત તો એને ઉપર ચડી પંચેન્દ્રિય સારા માનવભવમાં આવી મોકશમાર્ગ પામવા-સાધવા અને અંતે મોકશ પામવા જે વહેલો અવકાશ રહેત, તે આપણા પ્રમાદથી સંકલેશમાં મરી

૪૦ ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“મહાપુરુષોને કષ્ટ” (ભાગ-૪૪)

એકેદ્રિયપણામાં જવાના અને ત્યાં સંભવિત ઉત્કૃષ્ટ કાયસ્થિતિમાં મૂકાઈ પડવાના લીધે વહેલો અવકાશ ક્યાં રહ્યો ? એ મોકથી કેટલો કાળ દૂર ફેંકાઈ ગયો ? જીવની હિંસા ન કરવામાં આ પણ એના પ્રત્યે દયાભાવ છે કે ‘એ બિચારો આપણી હિંસાથી મરી આમ ઉત્કૃષ્ટ કાયસ્થિતિમાં જતાં મોકથી દૂર-અતિદૂર ફેંકાઈ જાય; તો એવું ન બનો.’

સંસારી જીવન જીવો છો, જાતને ધર્મભાનો છો, ‘સંસાર અસાર છે, ગ્રાસરૂપ છે, જન્મ-મરણાદિ વિટંબળા-ભર્યો છે’ એમ માનો છો, આપણે શું કે બીજા કોઈ પણ જીવ આમાંથી બચે અને વહેલા મોક પામે એવું પડ્યા ઈચ્છો છો, આ વાત સાચી ને ? તો પછી સંસારના ધર-હુકાનના આરંભ-સમારંભોમાં ધ્યાન રાખો છો ખરા કે આપણાથી નિર્દોષ કીડી કીડા વગેરે જીવો ન મરે ? એ માટે

ક્યાં ક્યાં જયશ્ચ ? :-

- (૧) નીચે જીવજંતુ જોઈને જ ચાલો છો ને ?
- (૨) વાસણમાં ચીજવસ્તુ લેતા પહેલાં એમાં કોઈ જીવજંતુ પડ્યું નથી એ જોઈ લો છો ને ?
- (૩) ચૂલો ફૂક્તા કે અજિ સળગાવતા પહેલાં સુંવાળી પીછી-પુંજણથી પૂંજ લો છો ને ?
- (૪) સરેલા હલકા અનાજ કે શાકભાજ નથી લાવતા ને ?
- (૫) અનાજ તમારા ધરનું માણસ જાતે વીણી કરી, ધનેરા વગેરે જીવથી રહિત તપાસીને પછીજ દળાવવા આપે છે ને ?
- (૬) ધર-હુકાનમાં પાટલા ટેબલ ખુરસી કોચ, કબાટ વગેરે ધસડતા પહેલાં જમીન જોઈ પૂંજ લો છો ને ?
- (૭) અભક્ષ વિદળ, વાણી બોળ અથાણું વગેરે યા રાત્રે નથી ખાતા ને ?
- (૮) કપડાં ધોવા દેતા પહેલાં એમાં જૂ માકણ નથી એ જોઈ લો ખરા ?
- (૯) માકણભરેલા ખાટ ગાઢલા વગેરેને ધૂમ તડકામાં નથી તપાવતા ને ?

(૧૦) માખી મચ્છર કરડે ત્યાં એના પર સપાટ થપાડ નથી લગાવતા ને ? આવું આવું તો કેટલું ય જાળવવાનું છે. ઉપરાંત બિન જરૂરી આરંભ સમારંભ મોજશોખ વગેરે તો બંધ જ કરવા જેવા છે; કેમકે એમાં કેટલાય જીવોનો નાશ થવાને અવકાશ છે.

તો તપાસો કે એક ધર્મ જીવ તરીકે આ બધી કાળજી કેટલી રખાય છે ? નિર્દોષ કીડીઓ કીડા માણી માકણ મચ્છર પર દયા હોય કે ‘એ બિચારો આપણાથી સંકલેશમાં મરી એકેન્દ્રિય અવતારે ફસાઈ મોકથી અતિ દૂર ન ફેંકાઈ જાઓ,’ તો

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો”(ભાગ-૪૪)

બને તેટલી હિંસા-આરંભસમારંભથી બચવાનું કરાય. મોકથી બહુ દૂર ફેંકાઈ જવાનું પરિણામ સમજો છો ને ? એટલો બધો દીર્ઘકાળ એ સંસારમાં દુઃખમાં જ રિબાવાનો ને ! આપણા જરાકશા પ્રમાદે, જરાકશી બિનસાવધાનીએ, જરાકશી હંડિયલોલુપતા, કાયહરામીવેડા કે સુખશીલતાના હિસાબે મરતાં જીવની એ કેવી ભાવી હુદ્દશા ?

તપસ્યા, ત્યાગ, પર્વતિથિએ રસસંકોચ, પ્રતનિયમો, વગેરેમાં આ પણ એક ઉદ્દેશ છે કે એથી જીવો ઓછા મરે. જો એ નહિ તો જીવહિસા વધુ રહેવાની અરે ! નવરા પડ્યા ફોગટિયા ફરવાનું, ઈધર ઉધર બજારમાં બાગમાં કે નથુભાઈ પેથાભાઈને મળવા જવા કરવાનું, એ બધું જો જીવદ્યા દિલમાં રમતી હોય તો, બંધ કરાય. મહારાજા કુમારપાળને ચોમાસામાં પાટણની બહાર જ શું, પણ પાટણમાં ય મંદિર ઉપાશ્રય અને પોતાના મુકામ સિવાય લગભગ બહાર જવાનું નહિ, એવો નિયમ. કેમ વાંદું ? ફોગટ જીવહિસા ન થાય એટલા માટે. આવી જીવરક્ષા એ વિચારીને થાય કે મારા પ્રમાદથી જીવ મરે તો કદાચ એ એકેદ્રિયપણે દીર્ઘ કાયસ્થિતિમાં મૂકાઈ ગયે મોકથી બહુ દૂર ફેંકાઈ જાય.

સમકિતી શ્રાવક જિનાજ્ઞા પર ખૂબ જ ઓવારી જતો હોય, પોતાને આ માનવભવે જિનાજ્ઞા મળ્યા ઉપર આ ભવને બહુ મૂલ્યવાન સમજતો હોય. મનને એમ વારે વારે થયા કરતું હોય કે “અહો ! અસાર જન્મ-પરંપરામાં આ કેવો સારભૂત જન્મ કે આમાં મને મહાસારભૂત જિનાજ્ઞા મળી ! જિનવચન મળ્યાં ! જગતમાં માત્ર જિનવચન જ અતિસૂક્ષ્મ અનંતકાય એકેન્દ્રિય જીવો સુધીની ઓળખાશ કરાવે છે, ને એની દયા-અહિસાના ઉપદેશ આપી એના સચોટ ટંકશાળી ઉપાય બતાવનાર પણ જૈનધર્મ જ.

• જિનવચનની આરાધના એટલે ? •

જીવોનો ઠાર્યા વિના આપણાને દરવાનું ક્યાંથી મળે ? કહેવત છે ‘ઠાર્યા તેવા ઠરો, બાળ્યા તેવા બળો,’ બીજાને શાતા આપીએ તો આપણાને શાતા મળે, અશાતા આપીએ તો અશાતા મળે. જેવું દાન તેવું પમાય, જેવું વાવીએ તેવું લાણાય. બેતરને બંટીનું દાન કરીને બાજરો લાણવા ન મળે. માટે જો આવા મહામૂલ્યવંતા જીવપરિચય કરાવનારા અને જીવ-અહિસા ઉપદેશનારા જિનવચન મળ્યા છે કે જે અપાર સંસારસાગરમાં ભમતાં મળવા અતિ અતિ દુષ્કર છે, તો એ મળ્યાને હું શક્ય દયા-અહિસાથી સફળ કરું.

અતિદુર્લભ જિનવચન મળ્યા પર બે કાર્ય, (૧) શસ્ત્રો અને પ્રમાદથી બીજા જીવોની હિંસા ન કરું, અને (૨) વિષયવિકારો તથા કષાય-વિકારોથી મારા પોતાના આત્માની હિંસા ન કરું.

૪૨ લુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“જિનવચનની આરાધના એટલે ?”(ભાગ-૪૪)

જિનવચનવાળા આ ભવે આ દ્વિવિધ હિંસાથી નહિ બચું તો પછી કયા ભવે બચી શકવાનો ?”

શ્રાવક સમ્યકત્વના બળે જિનવચનની આ મહાન કદર કરનારો હોય; તેથી બને તો તો હિંસાથી સર્વથા મુક્ત થવા જંખતો હોય; અને એ ન બને તો ત્યાં સુધી શક્ય એટલી હિંસા ટાળવા માટે બિનજરૂરી હિંસક પ્રવૃત્તિ ન કરે, શસ્ત્રપ્રયોગ ન કરે, હુધ્યાન, પાપોપદેશ અધિકરણ દાન અને નદીસનાન-તમાસા-દર્શનાદિ પ્રમાદાચરણ ન કરે. વળી ચોમાસામાં તો ખાસ કરીને બિનજરૂરી ફરવા જ ન નીકળે. પર્વતિશિના દિવસે આરંભ-સમારંભ ઓછા કરી નાંખે. પર્વતિશિંહે લીલોતરી ન ખાય એ શું ? જિનવચને જીણા જીવોની સમજ આપી એ જિનવચનની કદર કરીને જીવોને અભયદાન.

આજે જે ૩૦ દિવસના મહિનામાં માત્ર પાંચ દિવસ એટલે બે આઠમ બે ચૌદશ અને અજવાળી પાંચમ પણ લીલોતરી-ત્યાગ ઉડવા માંડ્યો દેખાય છે, કાચાં કેળાં અને ફળ તો નિઃસંકોચ વપરાવા માંડ્યા, કપડાં ધોવા-ધોવડાવવાનું ચાલી પડ્યું, અનાજ દળાવવા વગેરે આરંભ-સમારંભમાં સંકોચ રહ્યો નહિ, હરવા-ફરવાની ધૂમ પ્રવૃત્તિ ચાલી પડી, પવિત્ર તીર્થસ્થાનોમાં ત્યાગ મોંઘા, અને ઉજાણીઓ ઉડાવવાનું ચાલ્યું, રાત્રિભોજનમાં અરેકારો રહ્યો નહિ,...વગેરે જે જૈન આચારોથી વિરુદ્ધ ચાલી પડ્યું દેખાય છે. એની પાછળ મોટું કારણ આ છે કે જીવો પ્રત્યેની દ્યા-કરુણા ખતમ થઈ ગઈ, અને મહા કિંમતી જિનવચન પામ્યાની કદર જ ઉડી ગઈ, એની શ્રદ્ધા જ ઓસરી ગઈ;

ભૂલશો નહિ, અતિ દુર્લભ જિનવચન મળ્યા છતાં જો લોકવણના પ્રવાહે ચાલવું છે, જમાનામાં ભયા રહેવું છે, તો ફરીથી જિનવચનની પ્રાપ્તિ મોંઘી થઈ જશે.

શાસ્ત્ર કહે છે કે

‘જો અહીં મળેલા જિનવચનને પાળવા દ્વારા સફળ નથી કરતો, તો કયા મૂલ્ય ઉપર ભવાંતરે બોધિ યાને જૈનધર્મ તથા જિનવચન શ્રદ્ધા માગી રહ્યો છે ?’

માગીએ છીએ ને કે (૧) ‘આરુગ-બોધિલાભં સમાહિવર-મુતમં દિંતુ,’ (૨) ‘સમાહિમરણં ચ બોધિ-લાભો અ સંપજ્જણ મહ એઅં...’ (૩) ‘તહવિ મમ હુજ્જ સેવા ભવે ભવે તુમ ચલણાણં ?’ આ માગતી વખતે વિચાર રહે છે ખરો કે “પરભવ માટે આ ‘બોધિલાભ’ યાને જૈનધર્મ માગું છું. તેમ ‘જિન-ચરણ-સેવા’ એટલે કે ‘જિન વચનની ઉપાસના માગું છું, તો પહેલાં તો અહીં જે મને જૈનધર્મ અને જિનવચન મળી ગયા છે એનો ઉપયોગ કેટલો કરું છું ? એને કિયામાં-પ્રવૃત્તિમાં ઉતારી સક્યે કેટલા કરું છું ? જે જિનેશ્વર ભગવાન મળી ગયા છે એમને

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો”(ભાગ-૪૪)

ચિત્તનમાં વિચારમાં કેટલા રાખું છું ?”

બોધિલાભ શા માટે માગવાનો ? :-

નવી માગણી કરીએ છીએ કે ‘મને બોધિલાભ મળો, જિનચરણસેવા મળો, ‘પરંતુ એ વિચાર ક્યાં છે કે ‘શા માટે આ માગવાનું ? પરભવે એની શી જરૂર છે ? એનું શું કામ છે ?’ જો એમ લાગે કે ‘એની જરૂર એટલા માટે કે પાપથી છૂટાય અને પવિત્ર જ્ઞાનાચારાદિ આચારો ભર્યું જીવન જીવાય તેથી મોક્ષ થાય,’ તો તો પછી વર્તમાનમાં મળેલ બોધિલાભ યાને જૈનધર્મપ્રાપ્તિનો તથા જિનચરણ યાને જિનવચનનો ઉપયોગ પાપથી છૂટવા અને પવિત્ર જ્ઞાનાચારાદિ આચારો આચરવાના ઉદ્ઘમમાં ન થાય ? કાળજી ન રહે ? પણ ના, પરલોકની બોધિલાભની માગણી શા માટે એનો ય વિચાર નથી, તેથી અહીં મળેલ બોધિલાભનો ઉપયોગ કરી લેવાનો વિચાર પણ થતો નથી. માત્ર સૂત્રમાં એ શબ્દો ગુંથી લેવાયા છે તેથી બોલી કાઢવાના આટલો જ હિસાબ છે. કેમ ? શા માટે ? શું ? એ કશું વિચારવાનું નહિ, આ સંમૂહીંમ કિયા છે.

કિયા ચૈતન્યવંતી બનાવો. એ માટે જાગતા બનો, માનવસમય અને પુરુષાર્થશક્તિ બરબાદ જઈ રહ્યા છે, માટે ભયભીત બનો કે ‘અરેરે ! આ અમૂલ્ય સમય-શક્તિ એમજ નિષ્ફળ ગયે મારું શું થશે ?’ ફરી આવા અમૂલ્ય સમય સમજ ને પુરુષાર્થશક્તિ ક્યાં મળશે ?’ કોડ રૂપિયાની સંપત્તિમાંથી સહા-જુગારમાં લાખો વેડફાઈ ગયે શું સારા માણસને ભય ન લાગે ? જો ભય લાગે તો જાગતો ન થઈ જય ? બસ, ઉત્તમ કિયા મળી ત્યાં જાગતા થઈ જવાનું કે ‘જો આમાં બરાબર ધ્યાન નથી રાખ્યું, ને શુભભાવ નથી ચકાવ્યા, તો અમૂલ્ય માનવસમય અને પુરુષાર્થ શક્તિ વેડફાઈ જશે !’ આમ તો સાંસારિક જ્ઞાનજ્યામાં તો માનવસમય, સમજ, ને પુરુષાર્થશક્તિ વેડફાઈ રહ્યા જ છે, પણ ધર્મકિયા હાથમાં છતાં એ ત્રણેય વેડફાઈ એ કેટલું હુંબદ ?’

વાત આ છે કે મળેલ બોધિ અને જિનવચનને સફળ કરવાના છે. કેમકે આ અપાર સંસાર સાગરમાં જિનવચન મળવા ખૂબજ મુશ્કેલ છે, અતિ દુર્લભ છે; છતાં અહીં આપણા માટે જો એ સુલભ બન્યા છે; તો પછી એને બરાબર સચોટ અમલી કરવામાં કસર પ્રમાદ કેમ કરાય ? સંસારસાગર અપાર કેમ ? એકેન્દ્રિયપણાની દીર્ઘકાયસ્થિતિથી અપાર એકવાર જીવ જો ત્યાં એકેન્દ્રિય અવતારે જઈ પડ્યો અને કદાચ કાયસ્થિતિ ઉત્કૃષ્ટ નિર્માણ થઈ તો અસંખ્ય કોટાકોટિ સાગરોપમ વર્ષ સુધી એમાંથી બહાર નીકળી બેઈક્રિયપણું ય જોવા ન પામે !

‘સંસાર અણોરપાર’નો આ અર્થ છે કે જીવ સંસારમાં ભટકતાં ઊંચે ચક્કો

૪૪ લુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“જિનવચનની આરાધના એટલે ?”(ભાગ-૪૪)

હોય પરંતુ પાછો નીચે છેક એકેન્દ્રિયપણામાં પટકાઈ જતાં સંભવ છે આવી ઉત્કૃષ્ટ કાયસ્થિતિમાં ફસાઈ જાય; તો એને ઉલેચતાં એ પૂરી કરતાં દમ નીકળે. એમાંથી શે ધૂટાય વળી એમાંથી માંડ નીકળી ઊંચે ચક્કો, તે પાછો ત્રસ્પણામાં એટલે કે બેઠંડ્રિય-નેઠંડ્રિય-ચારંડ્રિય-પંચંડ્રિયપણામાં કુલ માત્ર ૨૦૦૦ સાગરોપમ વર્ષ સુધી જ રહી શકે. એટલામાં જો મોક્ષ પામી ગયો તો વાહવાહ; નહિતર વધુમાં વધુ એટલો કાળ રહીને પાછો નીચે એકેન્દ્રિયપણામાં પટકાય. ત્યાં વળી જો ઉત્કૃષ્ટ કાયસ્થિતિમાં ફસાયો, તો અસંઘ્ય કોટાકોટિ સાગરોપમ વર્ષ કાઢવાના. આમ સંસાર-પરિભ્રમણ પાર વિનાનું એટલે કે અણોરપાર ચાલે છે.

અણોરપાર સંસારથી થાક ખરો ? :-

વિચારજો, આવા અણોરપાર સંસારમાં ભમી આવ્યા એનો થાક લાગ્યો છે ? મનને કંટાળો આવે છે ખરો કે ‘અરરર ! આ માંડું ભ્રમણ ? બધું આ ભ્રમવાનું.’ એક ઊંચા માનવભવમાં હુનિયાના પદાર્થોના મોહમાં તણાયા, રાગ-તૃષ્ણા-મમતા સારી રીતે કર્યે ગયા, એની પાછળ રોઝ-રોઝ-પ્રપંચ ધૂટથી કર્યા તો પછી નીચે પટકવાનું; તે સંભવ છે એકેન્દ્રિયપણામાં ય પૂરાઈ જવું પડે, ને લાંબી લચક કાયસ્થિતિમાં એટલે કે ફરી ફરીને એકેન્દ્રિયપણાની કાયોમાં જનમ-મરણ અનંતકાળ સુધી કરવાની સ્થિતિમાં મૂકાઈ જવાનું થાય. ત્યાં કોઈ ઉદ્ધાર કરનાર નથી. આ શાની ખાતર ? વિષયો અને કષાયોમાં રાચ્યા માચ્યા તેથી. ત્યારે એ કરતાં વિચાર ખરો કે આ ફરીથી અણોરપાર સંસારભ્રમણ જો ઊભું થયું તો કઈ દશા ? આ વિચાર હોય તો બચવાનો ઉપાય જિનાજ્ઞા છે.

શાસ્ત્ર કહે છે આવા અણોરપાર સંસારમાં દેવતાઈ ઋદ્ધિ વગેરે મળવું સહેલું છે, પરંતુ જિનવચન મળવું ધંશું કઠિન છે. એવું અતિ અતિ દુર્લભ જિનવચન અહીં મળી ગયું છે, એની કદર કરો. અણોરપાર સંસાર ઉપર ધીણી મૂકનાર જિનવચન છે. એ અહીં મળી ગયું છે એ મહા અહોભાગ્ય સમજો, જેથી એ ભાગ્યોદય એણે ન કઠાય. હુનિયામાં જુઓ કે મનુષ્યોને પણ કેટલાને જિનવચન મળ્યું છે ? આજ અહીંની શોધાયેલી પૃથ્વી પર ત-તા અબજ એટલે કે ૩૦૦-૩૨૫ કોડ મનુષ્યોમાંથી લગભગ ૨૮૮૮ કોડ મનુષ્યો બાદ ! એમને જિનવચન મળ્યું નથી. ત્યારે તમારો નંબર જિનવચન પામેલામાં લાગ્યો છે એ કેટલું મોટું સદ્ગુર્ભાગ્ય !

અતિદુર્લભ જિનવચનન મળ્યા પર તો મનને એમ થાય કે

(૧) ‘ક્ષણ પણ જિનવચનને ન ભુલું.’ (૨) જે કાઈ કરું બોલું કે વિચારું એમાં જિનવચનને આગળ કરું. (૩) એ જોતો રહું કે હું જિનાજ્ઞાથી વિરુદ્ધ તો ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો”(ભાગ-૪૪)

નથી જતો ને ? જિનાજ્ઞા તારણાહાર છે, અનંત સંસારનો અંત લાવનાર છે, રખે ભૂલચૂકે પણ એની વિરાધના ન થાઓ. એટલું જ નહિ પણ એ જ ધગશ રહે કે (૪) મન-વચન-કાયાથી બને એટલી જિનાજ્ઞાની આરાધના કરતો રહું ! આ ધગશના હિસાબે જિનાજ્ઞાનુસારી ઉત્તમ વિચારો પવિત્રવાણી અને જિનભક્તિ-સાધુસેવા-જીવદ્યા તથા દાન-શીલ-તપ-ભાવનાના સુફૂતો કરતા રહેવાય. (૫) પાછું એ સુફૂતો કરવામાં આ જ્યાલ રહ્યા કરે કે ‘હું જિનાજ્ઞાની આરાધના કરતો રહું.’ આ જ્યાલ શા માટે ? આટલા માટે કે આમ તો અનેક ઉત્તમ વિચારો વગેરે સુફૂતો કરીને એનો લાભ તો મળે જ છે, ઉપરાંત જિનાજ્ઞાની આધીનતાનો વિચાર કરવાથી એની આરાધનાનો અપૂર્વ લાભ મળ્યા કરે છે.

ત્યારે શાસ્ત્ર કહે છે,-

પૂજા કરતાં આજ્ઞાપાલન શ્રેષ્ઠ :-

‘વીતરાગ સપર્યાત્સ્તવાજ્ઞાપાલનં પરમ् ।

આજ્ઞાડરાદ્વા વિરાદ્વા ચ શિવાય ચ ભવાય ચ ॥’

હે વીતરાગ પ્રભુ ! તમારી પૂજા કરતાં તમારી આજ્ઞાનું પાલન ચઢિયાતું છે; (કેમકે) આજ્ઞા આરાધાય તો તે મોક્ષ માટે થાય છે, અને વિરાધાય તો તે સંસાર માટે થાય છે.

શું કહું આમાં ? જિનની પૂજા કરતાં પણ જિનની આજ્ઞાનું પાલન વધુ મહત્વનું છે. જિનની પૂજા જિનાજ્ઞાનુસારે કરે, જિનાજ્ઞાને બંધાઈને કરે, તો તે જિનાજ્ઞાનું પાલન જ છે. પરંતુ પૂજા લાભ રૂપિયા ખરચીને કરે છીતાં જિનાજ્ઞાની પરવા ન રાખે, તો તે જિનાજ્ઞાપાલન નહિ. એના કરતાં માત્ર પાંચ રૂપિયાથી જ પૂજા કરનારો, પણ જિનાજ્ઞાને લક્ષમાં રાખી પૂજા કરતો હોય તો તેની પૂજા પેલા કરતાં ચરી જાય. લાભ રૂપિયાથી પૂજા કરનારે કોઈ કહે ‘આ તમે અવિવિધી કરો છો, જિનાજ્ઞા તો વિધિ આવી આવી બતાવે છે;’ ત્યાં જો એ તડૂકે કે ‘આમાં અવિધિ શાની ? લાભ રૂપિયા ખરચીએ છીએ એ જોતા નથી ? લાવો કોણ છે આવી પૂજા કરનાર !...’ તો આ શું કર્યું ? વિધિની એટલે કે જિનાજ્ઞાની બેપરવાઈ કરી. ત્યાં જિનાજ્ઞા-પાલન ઊરી જાય પછી પૂજાની કશી કિંમત ન રહે.

એમ, એક બાજુ તો પૂજા વિધિસર, જિનાજ્ઞાનુસાર કરે, પરંતુ બીજી બાજુ બીજી બાબતમાં જિનાજ્ઞાની પરવા ન રાખે, દા.ત. વ્યાખ્યાન સાંભળવાની વાત આવે તો કહે અમને તો જિનભક્તિમાં આનંદ આવે છે, વ્યાખ્યાનમાં કંટાળો આવે છે.

એને જો કહો, ‘અરે પણ જિનની આજ્ઞા છે જિનવાણી સાંભળવી જોઈએ’ તો કહે કે ‘પૂજામાં દોઢ કલાક થાય પછી સમય કયાંથી મળે ? એને કહીયે ‘પૂજાનો સમય ૪૬ લુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“જિનવચનની આરાધના એટલે ?” (ભાગ-૪૪)

આધોપાછો રાખી જિનવાળીશ્રવણ સાચવી શકાય ને ?' ત્યારે લોચા વાળે કે 'સંસારનું ય બધું સાચવવું પડે ને ? શું ધર્મ માત્ર વ્યાખ્યાન સાંભળવામાં જ છે ? જિનભક્તિમાં ધરમ નથી ?...?' આનો અર્થ એ જ કે એને જિનાજ્ઞાની પરવા નથી.

જિનાજ્ઞાની પરવા હોય તો ખોટા બચાવ ન કરતા કહેવાય કે 'વાત સાચી છે જિનવાળીશ્રવણ પણ કરવું જ જોઈએ, કિન્તુ મારાથી નથી બનતું. શ્રાવકે શ્રાવકપણાના શક્ય બધા આચારનું પાલન કરવું જોઈએ, એવી જિનાજ્ઞા પાળવા યોગ્ય જ છે.' મનમાં આ બેહું હોય તો મૌંઠે આવે ને ? મનમાં જ ન રમતું હોય તો વાણીમાં શી રીતે ઉત્તરે ? અને મન વિનાનું કદાચ બોલાય તો એથી પોતાના આત્માને લાભ કર્યાંથી થાય ? મનમાં જો જિનાજ્ઞાનું બંધન નથી, યથેચ્છચારિતા છે, આપમતિ છે, પછી બહારથી કોઈ સારી જિનપૂજાનું કાર્ય કર્યું, છતાં જિનાજ્ઞાની આરાધના ન આવે.

જિનાજ્ઞાની આરાધના મન પર જિનાજ્ઞાનું બંધન માગે છે.

'મન પર એનું બંધન' એટલે મનથી જિનાજ્ઞાનો સ્વીકાર પૂરેપૂરો હોય, પછી ભલે જિનાજ્ઞાનો બહારથી અમલ યથાશક્તિ હોય એટલે જિનાજ્ઞા-પાલન સર્વેસર્વા જોઈએ, કિન્તુ થોડી જિનાજ્ઞાનું પાલન-આરાધના અને થોડીનું ઉલ્લંઘન-વિરાધના, એ ન ચાલે, આ કહેવાનો અર્થ એ કે મન પર જિનાજ્ઞાનું બંધન યાને જિનાજ્ઞાનો સ્વીકાર પૂરેપૂરો જોઈએ. 'સમકિતી જીવ થોડો આરાધક થોડો વિરાધક એમ નહિ, કિન્તુ જિનાજ્ઞાનો સંપૂર્ણ આરાધક હોય' તે જિનાજ્ઞાના આ સર્વાંશે બંધનથી, જિનાજ્ઞાના સંપૂર્ણ સ્વીકારથી. 'જિનાજ્ઞાપાલન' એટલે પહેલે પગથિયે સંપૂર્ણ જિનાજ્ઞા સ્વીકાર. પછી અમલ તો શક્તિ અનુસાર થતો આવે. એ ઉપરના પગથિયાનું જિનાજ્ઞા-પાલન કહેવાય.

ત્યારે હવે વિચારો કે મન પર જિનાજ્ઞાનું પૂરેપૂરું બંધન છે ? મન એમ કહે છે ખરું કે 'હું જિનાજ્ઞાને પૂર્ણ બંધાયેલ છું, જિનાજ્ઞા જ સાચી છે; કલ્યાણ એના જ અમલમાં છે, પણ એ વિનાના કાય-કષ્ટમાં કલ્યાણ નહિ. મન પર જિનાજ્ઞાનો આ ભાર, આ બંધન, આ અસ્થિમજજા શ્રદ્ધા છે ખરી ? જો હા, તો તો આરાધક બનાશે, નહિતર આપમતિમાં તો વિરાધક બનવાનું થશે.

એ તો અહોમાગ્ય માનવું જોઈએ કે આજે પાપ-ગીભરાતી પૃથ્વી પર આપણને મહાપવિત્ર જિનવચન મળ્યાં છે. જાઓ બહાર જગતમાં જઈને જુઓ કે જિનવચન ક્યાં મળે છે ? અરે ! આપણને જ પૂર્વના અનંતા કાળમાં જિનવચન ક્યાં મળ્યા ? માણસેના ઢેર મળ્યા હશે, સત્તા-ઠકરાઈને મોટી મિલકતો-મહેલાતો મળી હશે, પરંતુ જિનવચન નહિ. ત્યારે અહીં પણ દિલને મહાશાંતિ, મહાપ્રકાશ અને

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો”(ભાગ-૪૪)

મહાન સ્ફૂર્તિ આપી જીવનને ધન્ય બનાવનાર તથા પરલોકે ઉચ્ચ સદ્ગતિ વગેરે આપી ભવ્ય ઉન્નતિના રાહે ચડાવનાર જિનવચન ન મળ્યાં, ને હીરામાણેક વગેરે મળ્યા, તો એથી શી વડાઈ થઈ ?

જિનવચન વિનાની સંપત્તિથી વડાઈ કશી નહિ, પણ ભારે અશાંતિ-અજંપો, શોક-સંતાપ અને અંધકાર-શૂન્યકારમાં અટવાયા રહેવું પડે છે.

જિનવચનની જિનાજ્ઞાની બલિહારી છે. જિનેન્દ્ર પ્રભુશ્રી અનંતનાથ ભગવાનને સુતિ કરતાં કવિ કહે છે,

‘પાખ્યા, પામે, પામશે રે, જે કોઈ જ્ઞાનાદિ અનંત;
તે તુજ આણ થકી સવે રે, કહે માનવિજ્ય ઉલ્લસંત,
અનંતજિન આપજો રે...’

માનવિજ્ય ઉલ્લાસમાં આવીને કહે છે ‘હે અનંતજિન !

ભૂતકાળમાં જે કોઈ અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર પાખ્યા, વર્તમાનમાં જે કોઈ પામે છે, પામી રવ્યા છે, તેમજ ભવિષ્યમાં જે કોઈ એ પામશે, એ બધા, હે પ્રભુ !, તારી આજ્ઞા વહન કરીને.’ જિનેશ્રદેષનું શરણું સ્વીકાર્યુ એટલે જિનવચનનો સ્વીકાર સહેજે થઈ જાય. ‘ભગવાન મારે તારું શરણ છે, તું જ મારે શરણભૂત છે,’ એવો સ્વીકાર કરીએ એટલે મનને સહેજે થાય કે જીવનો નિસ્તાર ભગવાન થકી જ છે, આ અનંત જન્મ-મરણમય સંસારમાંથી જીવનો ઉદ્ધાર કરનાર સર્વજ્ઞ શ્રી જિનેન્દ્ર ભગવાન જ છે, ભગવાનનાં વચન જ છે, ભગવાનના કહેલા મોકશમાર્ગની આરાધનાથી જ ઉદ્ધાર છે. આરાધના માટે સર્વજ્ઞ શ્રી જિનેશ્ર ભગવાનનાં વચન જ પ્રમાણભૂત તરીકે સ્વીકાર્ય અને આદરણીય છે. મારે એ જ માન્ય હો.’

જિનવચન સ્વીકાર્યાનું પ્રમાણ શું ?

જિનવચનના સ્વીકારની જીવન પર એવી અસર પડે છે કે જીવનની કોઈ પણ વાત-વસ્તુને કોઈ પણ પદાર્થ-પ્રવૃત્તિ-પ્રસંગને જિનવચનની દિષ્ટિથી જોવાય છે કે પ્રભુનાં વચન અને કેવા સ્વરૂપનાં બતાવે છે ? શેય, હેય કે ઉપાદેય ? માત્ર જાણવા યોગ્ય ? કે ત્યાગ કરવા યોગ્ય ? યા આચરવા-આદરવા યોગ્ય ? હજી ત્યાગ કે આદર કરવામાં વિલંબ હોય, કેમકે એ ત્યાગ-આદર અમુક કક્ષાનું બળ શક્તિ-વીર્યોલ્લાસ માગે છે. પરંતુ ત્યાગ કે આદરનો સ્વીકાર તો હૃદયમાં અંકિત થઈ જ ગયો હોય. મન ચોક્કસપણે કહેતું હોય કે ‘હું આ છોડી શકતો નથી, પરંતુ જિનવચનના હિસાબે છોડવા યોગ્ય જ છે. એમ આ આદરી શકતો નથી, પરંતુ આદરવા યોગ્ય જ છે; ક્યારે એવો ધન્ય દિવસ આવે કે ત્યાજ્યને ત્યજી દઉં અને આદરણીયને આચરતો રહું.’ આમ જિનવચનનો સ્વીકાર થાય. શ્રેણિક-કૃષ્ણ

૪૮ લુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“જિનવચનની આરાધના એટલે ?”(ભાગ-૪૪)

મહારાજા આથી ઉંચે આવી ગયા.

જિનવચનનો આ પહેલે પગથિયે સ્વીકાર કરાય, એ જિનાજ્ઞાનું પાલન છે. તેથી સમકિતી આત્મા, કદાચ વ્રત લીધાં ન હોય, સંસારમાં બેઠો હોય છતાં જિનાજ્ઞાનો પાલક આરાધક બને છે. એથી ઉલ્લંઘન, અભવી કે મહામિથ્યાદષ્ટિ જીવ સંસાર છોડી મહાવતો લઈ સાધુ બન્યો છતાં સર્વ જિનવચનને સ્વીકારનારો નથી હોતો તેથી એ જિનાજ્ઞાપાલક નથી.

દ્વાદશાંગીનો એક જ અક્ષર ઉત્થાપતાં સમકિત નષ્ટ :-

જિનાજ્ઞાનું પાલન જિનનાં સમસ્ત વચનોનો સ્વીકાર માગે છે. સ્વીકારમાં ટૂકડા નહિ કે આટલાં જિનવચન તો મારે માન્ય છે ને આટલાં અમાન્ય છે. જિનવચનને આચરવામાં ટૂકડા હોય કે અમુક આચરી શકતો હોય. અને અમુક ન આચરી શકે; પરંતુ સ્વીકારવામાં તો સર્વેસર્વજ માન્ય કરવાનાં હોય. તેથી કહું કે દ્વાદશાંગી યાને આચારાંગ વગેરે દષ્ટિવાદ સુધીના ૧૪ પૂર્વસહિત ૧૨ અંગરૂપ દ્વાદશાંગ જિનાગમ-જિનવચનમાંનો એક અક્ષર પણ ન માને અને બાકીનાનો સ્વીકાર કરે. તો પણ તે મિથ્યા દષ્ટિ છે. ત્યાં સમ્યક્તવ ઉડે. મહાવૈરાગી જમાલિ સાધુ વગેરેય એમ સહેજ પણ જિનવચન ઉત્થાપવા ગયા, તો તે મિથ્યાદષ્ટિ નિનહુવમાં ગણાયા, જિનવચન-જિનાજ્ઞાના વિરાધક બન્યા; અને એના ફળમાં એમનો સંસાર વધી ગયો.

શું જમાલિ વગેરેએ ચારિત્ર મૂકી દીધું હતું ? શું એમને વૈરાગ્ય ભટીને સંસારનો રાગ થઈ ગયો હતો ? ના, પરંતુ જિનાજ્ઞા વિરોધથી એમનું સમ્યક્તવ નષ્ટ થઈ ગયું. સમ્યક્તવ નાશ પામ્યા પછી ચારિત્રની કશી કિંમત નહિ. એટલે સમ્યક્તવની મોટી કિંમત છે; ને એના માટે જિનાજ્ઞાનો સંપૂર્ણ સ્વીકાર જોઈએ છે, જિનાજ્ઞાના એકાદ પણ વચનનો અસ્વીકાર નહિ.

ત્યારે વિચારો સંપૂર્ણ જિનાજ્ઞા-સ્વીકારનું કેટલું બધું મહત્વ છે ? જિનાજ્ઞાના સંપૂર્ણ સ્વીકારથી સમ્યગ્દર્શન આવે; ને એ પછી ચારિત્રને તાણી લાવે છે. કદાચ નિકાચિત ભોગાવલિ-કર્મના ઉદ્યે એજ ભવમાં ચારિત્ર ન પમાય, તો પણ એ સમ્યક્તવ આત્માને વિશેષ ઉન્નતિ પમાડે છે. શ્રેષ્ઠિક અને કૃષ્ણ મહારાજા ચારિત્ર ન લઈ શક્યા, છતાં પણ સમ્યક્તવના બળ ઉપર ક્ષાયિક સમ્યગ્દર્શન અને તીર્થકર નામ કર્મનું ઉત્કૃષ્ટ પુણ્ય પામ્યા.

એવા એમના સમ્યક્તવના બળમાં શું શું હતું ?

‘સમસ્ત જિનવચન સત્ય છે, એ જ અર્થ અને પરમાર્થ છે, અર્થાતું ઈષ્ટ અને પરમ ઈષ્ટ પરમ હિતકર છે; બાકી બધું અનિષ્ટ અનર્થ અહિતરૂપ છે;’ એવી જિનવચન પર સંપૂર્ણ શ્રદ્ધા, જિનાજ્ઞાનો સર્વેસર્વ સ્વીકાર, એ સમ્યક્તવનું બળ ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કૃપાય રોકો : ધૂટવાનો મોકો”(ભાગ-૪૪)

હતું. આવી દઢ પ્રતીતિ, દઢ વિશ્વાસ દિલમાં ઊભો થઈ ગયો, ને એથી જ એમને જિનેશ્વરદેવ ઉપર અથાગ અનન્ય રાગ બંધાઈ ગયો, વીસર્થાનકના પહેલા પદના આરાધક બની ગયા.

ગૌતમ કેમ ચડ્યા ? :-

જિનાજ્ઞા-સ્વીકારની કેવી બલિહારી છે ! ગૌતમ ઈંદ્રભૂતિ બ્રાહ્મણ વૈદિક યજ્ઞ કરાવતા હતા, મિથ્યાત્વમાં પડ્યા હતા, પરંતુ જ્યાં એમના મનની શકાનું મહાવીર પ્રભુએ સમાધાન કર્યું, ત્યાં એમને જિન સાચા સર્વજ્ઞ લાગી જિનવચન પર અથાગ રાગ ઊભો થઈ ગયો, એમણે જિનવચનનો સર્વેસર્વ સ્વીકાર કર્યો, એ સમ્યક્તવ પામ્યા, અને એ સમ્યક્તવે એમને ત્યાં ને ત્યાં ચારિત્રમાં ચડાવી દીધા.

ઈંદ્રભૂતિ ગૌતમને જો જિનવચન સમસ્ત સ્વીકાર્ય ન બન્યા હોત તો શું ત્યાં ને ત્યાં સંસારત્યાગ કરવો અને ચારિત્ર પામવું સહેલું હતું ? બ્રાહ્મણ જ્ઞતિમાં એમની એક પ્રખર પંડિત અને યજ્ઞ વગેરે અનુષ્ઠાન કરાવનાર તરીકે મહાન પ્રતિજ્ઞા હતી, વિદ્યાધીઓના મોટામોટા પરિવારવાળા ૧૦ બ્રાહ્મણ પંડિતોના એ નેતા હતા. એવા માનભર્યા સંસારને એ એકાએક શું કામ છોડે ? એવો સંસાર છોડી ભગવાનના ચરણે સેવક-શિષ્ય શું કામ બની બેસે ? પરંતુ એમને જિનવચન પર અપાર રાગ પ્રગટ્યો, અને જિનવચનમાંથી એ જાણવા મળ્યું કે “મનુષ્ય-જન્મ સંસારમાં ભમાવનારા સર્વ સંગનો ત્યાગ કરી ચારિત્ર લેવા અને પાળવા માટે જ છે. વળી જગતમાં આ બતાવનાર જિનવચન પામવાનું અત્યંત દુષ્કર છે; તેથી જો અહીં જિનેશ્વર ભગવાન અને એમનાં વચન મળે છે, તો શા માટે જીવનભર એ મહાતારક જિનવચનની સંપૂર્ણ આરાધના ન કરી લેવી ? એ માટે શા સારુ જિનેન્દ્ર ભગવાનનું જ શરણું ન લેવું ?” આ વિચારથી એમણે ત્યાં જ ચારિત્ર લઈ લીધું.

એટલે કહો, ઈંદ્રભૂતિ ગૌતમ બ્રાહ્મણે જિન વચનની ખૂબ ખૂબ આરાધના કરવા માટે જિનેશ્વર ભગવાન શ્રી મહાવીર સ્વામીને પોતાનું જીવન સોંપી દીધું, પ્રભુનાં ચરણે ચારિત્ર લઈ બેસી ગયા. પછીય એમણે શું કર્યું ?

ગૌતમસ્વામીએ જિનવચનની કેવી આરાધના કરી !

ઉપદેશમાળામાં અવધિજ્ઞાની મહર્ષિ શ્રી ધર્મદાસગણીજી મહારાજ કહે છે, ‘ભદ્રો વિણીઅવિણાઓ, પદમગણહરો સમત્તસુયનાણી ।

જાણાતો વિ તમત્થં, વિમ્હિઅહિયયો સુણઙ સવ્બં ॥

અર્થાત્ ભદ્રક સરળ પ્રકૃતિના તેમજ બીજાને પણ ભદ્ર યાને કલ્યાણરૂપ વિનયને સિદ્ધ કરનાર (ઈંદ્રભૂતિ ગૌતમસ્વામી) પ્રથમ ગણધર છતાં અને સમસ્ત શ્રુતજ્ઞાનના પારગામી છતાં દ્વાદશાંગી-રચના દ્વારા ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની છતાં, વળી ૫૦ ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“ગૌતમસ્વામીએ જિનવચનની કેવી.” (ભાગ-૪૪)

પ્રભુ જે કોઈ તત્ત્વપદાર્થ કહે છે તેને જ્ઞાતા-સમજતા હોવા છતાં પ્રભુથી કહેવાતું બધું જ વિસ્તિત આશ્રયચક્તિ હથે સાંભળે છે !

ત્યારે વિચારો કે આ વિશેષજ્ઞોમાંનું માત્ર એક પણ વિશેષજ્ઞ શિષ્યમાં હોય તો ગુરુથી કહેવાતું બધું જ સાંભળવાની તૈયારી હોય ? (૧) પ્રથમ ગણધર એટલે મુખ્ય શિષ્ય, ગુરુના પ્રથમ શિષ્ય બનવાનું પુણ્ય હોય, પછી ગુરુનું બધું સાંભળતાં રહેવાનું બને ? એમ, (૨) સમસ્ત શુત્રજ્ઞાન-શાસ્ત્રબોધ થઈ ગયો હોય તો હવે ગુરુનું સાંભળ્યા કરવાની જરૂર લાગે ? (૩) વળી ગુરુ જે કહે છે એ બધું પહેલેથી આવડતું હોય, તો ગુરુનું સાંભળતાં રહેવાય ? અને (૪) આવડતી વસ્તુ એટલે કે જેણી પોતાને પૂરી ખબર છે એવી વસ્તુ ગુરુ કહેતા હોય એ આશ્રયચક્તિ બનીને સંભળાય ?

ત્યારે ગૌતમસ્વામી, મહાવીરપ્રભુ જ્ઞાયા ત્યાં સુધી, એમનું સાંભળતા જ રહ્યા. તે પણ વિસ્તિત હથે ! જાણો પોતે જ્ઞાતા નથી એ નવું જ સાંભળવા મળે છે માટે આશ્રય થાય. આમ તો પોતાને અગાધ જ્ઞાન; અને પ્રભુ ઉપદેશ કરે તે સામાન્ય માણસને યોગ્ય પણ હોય; છતાં આશ્રયથી-સંભળથી અર્થાત્ અપૂર્વ નિધાન મળ્યા જેટલા હર્ષથી સાંભળતા રહ્યા. ત્યારે પૂછો,-

પ્ર.- પ્રભુ તો અનંતજ્ઞાની છે, ગૌતમસ્વામી એમની સામે અલ્પજ્ઞ છે, કંઈ અનંતજ્ઞાની છે નહિ, એટલે પ્રભુનું સાંભળવાનો ઉલ્લાસ રહે ને ?

૩.- પ્રભુ ભલે અનંતજ્ઞાની છે, કિન્તુ શબ્દથી જે કહે છે કે બધું ૧૪ પૂર્વોના રચયિતા શ્રી ગૌતમસ્વામી જાણો છે; તો જાણેલી વસ્તુ કહેવાતી હોય એ સાંભળવા ઉલ્લાસ શાનો રહે ? સાંભળતાં આશ્રય શાનું થાય કે ‘અહો ! પ્રભુ કેવી સરસ વાત કહી રહ્યા છે ? કેટલું અદ્ભુત કહી રહ્યા છે ?’

જાણેલું સાંભળતાં હર્ષનું કારણ :-

પ્ર.- તો પછી ગૌતમ મહારાજને જાણેલું સાંભળવા એટલો બધો ઉલ્લાસ અને સાંભળ્યા પર એવો અપૂર્વ હર્ષ આશ્રય શાથી ?

૩.- કહો, એમને જ્ઞાનની આરાધના-ઉપાસના કરી જીવનને ધન્ય બનવાનું હતું. જ્ઞાનની પર અથગ રાગ હોય, એ તરણતારણ લાગતા હોય, એની અતિ દુર્લભતા દેખાતી હોય, એટલે પછી મનને એમ રહે કે ‘લાવ, જ્ઞાન કર્યાં મળે છે ? મારું ગમે તેટલું પણ વિશાળ જ્ઞાન મૂળ તો જ્ઞાનના આધારે જ છે, જ્ઞાનના પ્રતાપે જ છે. માટે જ્ઞાનની તો મારે પ્રાણ છે, સર્વેસર્વ છે. અને આરાધ્યા જ કરું, આરાધ્યા જ કરું.

જ્ઞાનની સતત આરાધનાથી (૧) સતત કૃતજ્ઞતા જળવાય છે, (૨)

ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

સતત જ્ઞાનપ્રેમ બન્યો રહે છે, (૩) સતત પાપકર્માંની ભેખડો તૂટી રહે છે. ત્રણે વસ્તુ જીવનમાં જરૂરી છે,-

(૧) કૃતજ્ઞતા : જ્ઞાનવાણીની આરાધનાના ઉપાય :-

પ્રભુએ આપણા પર જે અનંત ઉપકાર કર્યો છે, એની કૃતજ્ઞતા બજાવતા રહેવાનું જરૂરી છે. એ પ્રભુની વાણીની સતત આરાધનાથી સુશક્ય બને, અને સુંદર રૂપે બને. જ્ઞાનવાણીની આરાધના (૧) જેટલાં જ્ઞાનશાસ્ત્ર આવડતા હોય એને રટવાથી થાય; (૨) નવું નવું શાસ્ત્રજ્ઞાન વધારતા રહેવાથી થાય; (૩) શાસ્ત્રસ્વાધ્યાયનું જીવન બનાવી દેવાથી થાય; અને (૪) વાતવાતમાં જ્ઞાનવચનને બહુમાનવાથી થાય કે ‘અહો ! કેવાં અનંત કલ્યાણકર અને ટંકશાળી જ્ઞાનવચન ! કેવાં મારાં અહોભાગ્ય કે મને જ્ઞાનવચન મળ્યા !...’ વળી (૫) પ્રસંગ-પ્રસંગમાં જ્ઞાનવચનને લાગુ કરવાથી જ્ઞાનવચનની આરાધના થાય. ‘લાગુ કરવું’ એટલે કે ‘જ્ઞાનવચન આ અમુકને ત્યાજ્ય અને ખતરનાક કહે છે,...આ અમુકને ઉપાદેય આદરણીય કહે છે;’ એમ જાગૃતિ રાખવાની તેમજ (૬) જ્ઞાનવચન યાદ કરી કરી યથાશક્ય એનો અમલ કરવાથી જ્ઞાનવચનની આરાધના થાય.

કૃતજ્ઞતા એ પાયાનો ગુણ છે. જો જ્ઞાનો અને જ્ઞાનવચનનો અત્યંત ઉપકાર સમજતા હોઈએ તો એમની પ્રત્યે કૃતજ્ઞતા સારી બજાવવી જ પડે, અને તે આ એ ઉપાય દ્વારા જ્ઞાનવચનની આરાધનાથી થાય.

જ્ઞાનવચનો શું શું બતાવે છે ? :-

મનને એમ થયા કરે કે

(૧) જ્ઞાનવચન સિવાય આ વિશ્વની સાચી ઓળખ કોણ આપે છે ?

(૨) આત્માનાં સત્ય સ્વરૂપનું અને એને સંસારમાં ભટકવાનાં ખરેખર કારણોનું ભાન જ્ઞાનવચન સિવાય કોણ કરાવે ?

(૩) આઠ કર્માંનું વિસ્તૃત અને સૂક્ષ્મ સ્વરૂપ, એનાં બંધ-ઉદ્ય-નિર્જરા, સંકમણ-ઉદ્વર્તન-અપવર્તન ઉપશમન, જીવવાર અને ગુણસ્થાનક-વાર એની પરિસ્થિતિ, વગેરેને જ્ઞાનવચન વિના કોણ બતાવે છે ? એમ,

(૪) જ્ઞાનવચન સિવાય સમ્યજ્ઞનાદિ મોક્ષમાર્ગ, ૧૪ ગુણસ્થાનક, વિરતિનું મહાત્વ, સૂક્ષ્મ અહિંસા, આશ્રવ અને સંવર, મૂળ પર આધારિત યોગ, જીવનસ્પર્શી શુભ-અશુભ ધ્યાન, નવવાડ યુક્ત બ્રહ્મચર્ય વગેરે કોણ સમજાવે ? એમ,

(૫) એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવોનો વિસ્તાર વગેરે વગેરેનું સ્વરૂપ કોણ સમજાવે ?

(૬) સ્વાદ્વાદ સિદ્ધાન્ત અને નય-નિક્ષેપ-સપ્તભંગી...વગેરે જ્ઞાનવચન વિના

પર ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“ગૌતમસ્વામીએ જ્ઞાનવચનની કેવી.” (ભાગ-૪૪)

ક્યાં મળે છે ?

જિનવચનની આ એકેક વિશેષતા સમજવા જેવી છે, જિનવચનના આ વિષયો મનમાં રમાડ્યા કરવાથી મનને અનેક બિગાડાથી બચાવી શકાય છે. માટે આ વિષયો વિસ્તારથી વિચારવા જેવા છે. મનમાં બીજા ત્રીજા કેટલાં લફરાં ધાતી પોતાના જ મહામૂલ્યવંતા મનને દિવસમાં કેટલીવાર બગાડાય છે ? કુજૂલ વિચારો કે જેની પાછળ કશું સારું ઉપજતું ન હોય, ઉપજાવી શકતા ન હો, એ વિચારધારા પૈકી એક પણ વિચારને સફળ કરવા શેક્યો પાપડ ભાંગવા જેટલી ય તાકાત ન હોય, એવા વિચારો કેટલા અને કેટલીવાર ચાલે છે ? એમ, કામ-કોધ-લોભ માન-મદ-માયા, ઈર્ઘા-અસૂયા-દીનતા વગેરેની લાગણીઓ કેટલીવાર ઉઠચા કરે છે ? આ નિષ્ફળ વિચારો અને કામ-કોધાદિ કષાયોથી પોતાના જ મહાકિંમતી મનને બગાડ્યા કરવાનું કેવું કેટલું ચાલી રહ્યું છે ?

ભૂલશો નહિ, અસ્ત્ર વિચારો અને કષાયોથી મન બગડે જ છે, મન આવેશી અને તામસભાવવાળું બને છે, કુદ્ર અપવિત્ર અને દુર્બળ બને છે. આ આવેશ તામસભાવ કુદ્રતા અપવિત્રતા દુર્બળતા વગેરે બિગાડો નથી તો શું છે ? મનના એ રોગ છે, અને

રોગિષ મન સારાં કામ કરવાને માટે નાકામિયાબ બને છે.

જુઓ, મનના કયા રોગ કઈ ખરાબી સરજે છે,-

(૧) આવેશવાળું મન પ્રસંગ પર સ્વસ્થતાથી ગંભીર ને વિશાળ રીતે વિચાર કરવાને બદલે ઉપલક્ષ્યો, ઉછાંદ્ઘો અને ઢૂંકો વિચાર કરે છે.

(૨) તામસભાવવાળું મન અંધકારમય નિરાશા ભર્યા અને સ્વાર્થ-સ્વોત્કર્ષના તથા બીજાની હલકાઈના જ વિચાર કર્યા કરે છે.

(૩) કુદ્ર મન હલકટ, નિઃશુક, સ્વાર્થ અને અભિમાનભર્યા તથા ધર્મની બેપરવાઈવાળા વિચારમાં મળું રહે છે.

(૪) અપવિત્ર મનમાં મેલા, આચારભ્રષ્ટ અને હિંસાદિ ભાવોવાળા વિચાર ઉઠે છે.

(૫) દુર્બળ મન શુભ વિચારણા-ધારણા અને શુભ પ્રવૃત્તિમાં ચોંટી શકતું નથી, સ્થિર રહી શકતું નથી, ખોટા ભય અનુભવે છે, ઉચ્ચ ભાવનાઓ વગેરે માટે અસમર્થ બન્યું રહે છે. એમ

(૬) કામ-કોધાદિ કષાયવાળું મન તો એ બધા બગાડવાળું છે જ.

ત્યારે આ બધી ખરાબીઓ લાવનારા આવેશ વગેરેથી મન બગડેલું જ ગણાય ને ? કુજૂલ અંટસંટ વિચારો અને કામ-કષાયોની લાગણીઓ મનને એવું

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો”(ભાગ-૪૪)

બગાડવાળું બનાવે છે. એ બગાડો અટકાવવો હોય તો અનુપમ સાધન જિનવચન છે.

જિનવચનનાં આલંબનથી એ બધો બગાડો અટકીને આપણું મહાકિંમતી મન નિરોગી અને સ્વચ્છ બને છે, સ્વચ્છ નિર્મળ નિરોગી બન્યું રહે છે.

જિનવચનનું આલંબન એટલે મનમાં જિનવચન-જિનવચનની વાતો રમ્યા કરે. મન આશરો લે તો અનો, આરામ કરે તો અમાં, પર્યટન કરે તો એ જિનવચન અને એના પદાર્થોમાંજ. આને જિનવચનનું આલંબન કર્યું ગણાય.

જિનવચનનાં આલંબને મનને કેટલાય રોગોથી બચાવી શકાય છે. મનનો એક રોગ છે કુજૂલ વિચારોની હારમાળા. ત્યાં જો મનમાં જિનવચને કહેલા પદાર્થો, દા.ત. નવતત્ત્વ યા જીવતત્ત્વ કે કર્મ સિદ્ધાંતને વિચારવા માંડીએ તો મન એમાં પરોવાયેલું રહેવાથી કુજૂલ વિચારોની હારમાળા અટકે. અરે ! જિનવચન તરીકે આગમ-સૂત્રો કે જીવવિચાર આદિ પ્રકરણ-સૂત્રો યા પંચસૂત્ર, તત્ત્વાર્થસૂત્ર, ધર્મબિંદુ, ઉપદેશમાળા વગેરેની માત્ર ગાથાઓ કે સૂત્રોનું પુનરાવર્તન ચલાવીએ તો પણ મન એમાં રોકાઈ જાય. એથી મન કુજૂલ વિચારો ન કરી શકે.

પ્ર.- પણ ખાટલે મોટી ખોડ, સૂત્રો જ આવડતા ન હોય, ત્યાં પુનરાવર્તન શું કરાય ?

૬.- પ્રતિકમણનાં સૂત્રો આવડે ને ? એની ગાથાઓનું પારાયણ થઈ શકે. એ પારાયણ એવું કે ગાથે ગાથાના શબ્દ અલગ પાડી પાડીને યાદ કરી જવાય, બોલી જવાય. મોતીની માળામાં મોતીના દાણે દાણા કેવા સ્પષ્ટ દેખાય, એ પ્રમાણે શબ્દ શબ્દ સ્પષ્ટ દેખાય; જાણે સામે લખેલા વાંચીએ છીએ એ રીતે યાદ કરતા જવાય. અક્ષરે અક્ષર વાંચવા છે એટલે મનને એમાં બરાબર લગાડવું પડે. કુજૂલ વિચાર શરૂ થતા દેખાય કે તરત મનને આ રીતે સૂત્રગાથાઓના શબ્દ શબ્દ પર લગાડી પારાયણ કર્યે જવાય એટલે ફુજૂલ વિચારોને મનમાં જગા ન રહે.

બોલો, આ શુતપારાયણ-શાસ્ત્રરટન તો બની શકે એવું છે ને ? કુજૂલ વિચારોમાં મન કેવું રોગિષ બને છે, એમાં આવેશ વગેરે કેવા ભયંકર અનર્થ ઊભા થાય છે એ તો જોયું ને ? હવે એની ભયંકરતાથી જો દિલ ડરું હોય તો આ કાંઈ અશક્ય નથી. સાથે એ આવશ્યક-પ્રતિકમણના સૂત્રો આ રીતે ધ્યાનપૂર્વક રટવાના લાભ પણ અદ્ભુત છે.

પ્ર.- પરંતુ આજે તો પ્રતિકમણનાં પણ સૂત્ર ન આવડતા હોય ત્યાં શું થાય ?

૭.- એનો અર્થ જ એ, કે જીવનમાં તમારે બીજું દુનિયાભરનું શીખવાની જરૂર છે, કે જે મનને બગાડ્યા જ કરે, બગાડ્યા જ કરે; માત્ર મનને સુધારે મનને પાપ વિચારોથી બચાવે એવા આ ઉત્તમ પ્રતિકમણસૂત્રો શીખવાની જરૂર નથી.

૮.- ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“ગૌતમસ્વામીએ જિનવચનની કેવી.”(ભાગ-૪૪)

તમારા પોતાના માટે જરૂર ન લાગે તો પછી સંતાનો માટે તો જરૂર લાગે જ શાની ? ભૂલા ન ભમો, ગણધર મહારાજાનાં રચેલા આ સૂત્રો, અને તે પણ તીર્થકર ભગવાનની સમક્ષમાં રચાયેલા અને ભગવાનથી મહેરણપ પામેલા આ સૂત્રો મહામંત્ર સમા છે...

(૧) એ સૂત્રો રાગદ્વેષનાં ઝેર ઉતારી નાખે છે, ને એથી ભવના ફેરા ઘટે છે.

(૨) વળી એ પાપકર્મની ભેખડો તોડે છે, ને એથી હુર્ગિત્માં પામવા પડે એવા દુઃખોનો અંત લાવે છે.

ભારે કર્મી પણ જીવ આનાથી ન્યાલ થઈ જાય છે. કહ્યું છે,-

‘આવસ્સાયેણ એયેણ, સાવસો જઈ વિ બહુરાઓ હોઈ;

દુક્ખાણમંતકિરિયં કાહી અચિરેણ કાલેણ’

આ પ્રતિકમણ સૂત્રોથી કરતા સામાયિક-ચતુર્વિશતિસ્તવ-વંદન-પ્રતિકમણ-કાયોત્સર્ગ અને પચ્ચક્ખાણા, એ છ આવશ્યકથી શ્રાવક, જો કે બહુ કર્મભારવાળો હોય છતાં, દુઃખોની અંતક્યાને કરે છે, નાણ કરે છે.

જુઓ, કેવો સ્ટેમ્પ મારી આપ્યો છે ?

બહુ કર્મભાર પણ હેઠે ઉતારી આપે એવી આવશ્યક કિયાની તુલનામાં સંસારની કઈ ચીજ છે ? સંસારના પદાર્થો અને સંસારની પ્રવૃત્તિઓ તો કર્મના ભારને વધારનાર છે. એવા સંસારી જીવનમાં રહ્યા છતાં અને કર્મનો ભાર વધવા છતાં આવશ્યક સૂત્રો વડે કરાતું પ્રતિકમણ દુઃખનો નાશ કરી આપે એવું એ મહાકિર્મતી પ્રતિકમણ રોજ ઉભયકાળ કરવાની ચીવટ ખરી ? હોંશ ખરી ? દિવસમાં એકવાર પણ કરવાની ધગશ ? બાર તિથિએ કે છેવટે પાંચ તિથિપણ પ્રતિકમણની હોંશ-ધગશ-ચીવટ ખરી ? તો પછી જીવનમાંથી શું લઈ જશો ? એકલા કર્મના ભાર ?

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ” વર્ષ-૧૮, અંક-૪૭-૪૮, તા. ૨૮-૮-૧૯૭૧

જૈન બચ્યો કે જેને એકલાને આ આવશ્યક પ્રતિકમણનાં સૂત્રો અને કિયા મળે છે, દુનિયાના કોઈ ધર્મવાળાને નહિ, ને એકલા શ્રાવકને મળે છે, અને શું ગૌરવ ન હોય કે હું આ સૂત્રો તો ખાસ ભણું ? પ્રતિકમણ તો ખાસ કરું ?’

એમ કહેતા નહિ કે ‘હવે મોટી ઉમરે શું થાય ?’ કેમકે રોજ એક ગાથાય કરતા રહો તો ય છ ભહિનામાં તૈયાર થઈ જાય.

પ્રતિકમણસૂત્રો મોટી ઉમરે કોણ ભણ્યા ?

વર્તમાનમાં એક કેળવાયેલા ભાઈને ૭૦ વરસની ઉમરે લગન લાગી તે છોકરાની વહુ સારી ભણેલી, એની પાસે ગાથા લઈ લઈને પ્રતિકમણ સૂત્રો ભણ્યા. પૂર્વના કાળમાં જુઓ મહારાજા કુમારપાળ પણ વરસની ઉમર સુધી તો રાજ સિદ્ધરાજ જયસિંહના ભયથી પોતાના પ્રાણ બચાવવા ભટકતા હતા. પછી પણ વરસની વયે રાજ્ય પાભ્યા ત્યારે અમના શત્રુ ધણા, ને રાજ્યને વ્યવસ્થિત કરતાં પંદર વર્ષ ગયા. એ જૈનકુળમાં જન્મેલા નહિ કે જેથી કુળરિવાજથી પણ અમને પ્રતિકમણસૂત્રો ભણ્યા હોય. એ તો રાજ્ય પાભ્યા પછી ઉપકારી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના સંપર્કમાં આવ્યા. અમણે ૭૦ વર્ષની ઉમરે શ્રાવકધર્મ સ્વીકાર્યો, જૈનધર્મનું ભણ્યા, કેટલું ? યોગશાસ્ત્ર વીતરાગસ્ત્રોત્ર વગેરે અને હેમચંદ્રાચાર્ય-વિરચિત સિદ્ધહેમ સંસ્કૃત વ્યાકરણ ભણ્યા. ત્યારે આવશ્યક પ્રતિકમણ જે રોજ કરવાનું, તેનાં સૂત્રો તો ભણ્યા જ હશે ને ? બોલો, એ કઈ ઉમરે ભણ્યા ?

પેથડશાહ મંત્રી માળવદેશના કારભારી, રોજ રાજસભાએ જતી વખતે પાલખીમાં બેઠા બેઠા ઉપદેશમાળાની ૧-૧ ગાથા ગોખી લેતા. આવું મોટું શાસ્ત્ર ગોખે ત્યારે એ પણ પ્રતિકમણસૂત્રો તો ભણ્યા જ હશે ને ? પ્રતિકમણ કરવાનો પણ અમને એવો નિયમ હતો કે સાધુ મહારાજ નજીક નહિ ને બે ગાઉ દૂર પણ હોય ત્યાંસુધી ત્યાં જઈ એમની સાથે પ્રતિકમણ કરવું.

ત્યારે વિચારો કે,

આવા મોટા ૧૮ દેશના સમાટ રાજા કુમારપાળ અને માળવદેશના મહામંત્રી પેથડશાહ પ્રતિકમણ-સૂત્રો અને પ્રતિકમણકિર્યામાં કેવુંક અનેરું તત્ત્વ સમજ્યા હશે, કેવોક એમણે જીવનનો મહાસાર જોયો હશે, અને એમાં કેવીક મહાસાધના પીછાણી હશે કે એવા મોટા વૈભવ, સત્તા અને ભારે ઉપાધિમાં પણ એ સૂત્રોના જ્ઞાતા અને એ પ્રતિકમણના આરાધક બન્યા ! મોટી ઉમરે પણ તમે આ ભણવાનું કરી શકો, પરંતુ કાળના પ્રવાહમાં જમાનાના વાયરામાં ન વહી જાઓ તો.

કાળનો પ્રવાહ જમાનાનો વાયરો આ શીખવે છે કે ‘(૧) આ સૂત્રો ન આવડતા હોય તો ય ચાલે. એમાં વળી કયું મોટું એવું જ્ઞાન આવી ગયું ? સૂત્રોનું જ્ઞાન તો નાના બચ્યા ય મેળવી શકે, એમણે જ મેળવવાનું. તેમ, (૨) પ્રતિકમણકિર્યા એ કોઈ એવી મોટી પુણ્યની સાધના નથી, તેમ, (૩) કરવી જ પડે એવું કશું જ નહિ. ન કરીએ તો ય કાંઈ શ્રાવક મટી નથી જતા. (૪) પ્રતિકમણ કરનારા તો વેદિયા હોય છે, રૂઢિયુસ્ત હોય છે...’ વગેરે વગેરે આજની હવાની અસર છે. એ અસરમાં આવી જવાથી પ્રતિકમણના ઉલ્લાસ નથી રહ્યા એવું દેખાય છે. નહિતર છેવટે રજાના દહારેય કેમ પ્રતિકમણ ન થાય ?

પ્રતિકમણનો અદ્ભુત પ્રભાવ શાથી ? :-

બાકી, પ્રતિકમણ એ એવું અદ્ભુત અનુષ્ઠાન છે કે જીવને સાંસારિક જીવનમાં જેટલા અશુભ ભાવ સત્તાવે છે, એની સામે એટલા શુભભાવ પ્રતિકમણમાં કરવા મળે છે. જે પેલા અશુભ ભાવોને અને એની આદતને ધક્કો પહોંચાડે છે.

આવું અદ્ભુત બીજું ક્યું અનુષ્ઠાન છે ? ભૂલશો નહિ, ચિત્તના અશુભ મલિન ભાવો સંદર્ભ નાબુદ્ધ કર્યા વિના વીતરાગ નહિ બનાય, અને મોક્ષ પણ નહિ થાય. પ્રતિકમણની મહાન કિયા એ અશુભ ભાવોના અનુબંધ તોડે છે, તેથી એ અશુભ ભાવોનો પાવર ઘટી જાય છે. એ ઘટતાં ઘટતાં સર્વવિરતિ ચારિત્રના ભાવને ઊભા કરી દે છે ત્યાં પણ પ્રતિકમણથી અપ્રમત્તભાવ અનાસક્તભાવ વગેરેમાં ચડવા જોમ મળે છે. અને એ ભાવ પરાકાણાએ પહોંચે એટલે વીતરાગદશા આવીને ઊભી રહે છે.

પ્રતિકમણના પાયા ઉપર આવી સુંદર ઈમારત રચાતી જાય; તો પછી કોણ વિચારક મનુષ્ય આવા અદ્ભુત પ્રતિકમણમાં પ્રમાદ કરે ? કોણ વિચારક એની ઉપેક્ષા કરે ? નિર્વિચાર દિલ હોય, જીવનમાં સહેજે સહેલાઈથી કમાવા મળતા શુભ ભાવો વગેરેનાં ઉચ્ચ લાભ અંગે વિચાર જ ન કરવો હોય એને કશું કહેવાનું નથી પરંતુ વિચારક તો જરૂર આ પ્રતિકમણ પ્રત્યે આકર્ષાય.

પ્રતિકમણમાં કયા કયા સૂત્ર અને કદ્દ કદ્દ કિયા કેવા કેવા શુભ ભાવ જગાડે છે, અને એ કયા કયા અશુભ ભાવને કેવી કેવી રીતે ધક્કો પહોંચાડે છે, એ વિષય મોટો છે; એને ચર્ચવા-વિચારવા અત્યારે અવસર નથી. બાકી એ એક મોટું સાયન્સ છે, ને એ ખાસ શીખવા જેવું છે.

આજે ધર્મસુસ્તી કેમ ? :-

પ્રતિકમણનાં સૂત્રોથી એવા અનેરા ભાવ જાગે છે; કેમકે એના પદે પદ એટલા બધા અલોકિક છે. આવા પદોભર્યા સૂત્ર ન આવડે અને દુનિયાભરનું ડહાપણ આવડે, વળી એ ડહાપણ લાવવા વર્ષોના વર્ષો શાળા-કોલેજમાં ભણાય, આ કદ્દ બુદ્ધિમત્તા ? મને તો લાગે છે કે આજના જેવી બુદ્ધિહીનતા-પાગલતા પૂર્વના લાખો વરસોમાં નહિ ઊભી થઈ હોય. અનું કારણ આજનાં વૈજ્ઞાનિક સાધનોથી ભૌતિકવાદ પૂર્વે નહિ એટલો બધો જોરમાં ફાલ્યોફૂલ્યો છે. વિજ્ઞાનની શોધોએ કરેલી વેપાર અને સુખવિલાસની ભૌતિક સગવડોએ ધર્મ જેવાનાં પણ મનને આંજી દઈને એના ગુલામ બનાવી દીધા છે. એ અંજામણે અને ગુલામીએ શ્રદ્ધાનાં-જિનવચનનાં અને ધર્મનાં દિલ તોડી નાંખા છે પછી ભલે છેવટે પર્યુષણાના શ્રાવક બની ત્યાં પ્રતિકમણ કરતા હોય, પરંતુ ભૌતિક સિનેમા, પાર્ટી, મીટિંગ,

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

લગ્નાદિ પ્રસંગ વગેરેમાં જે રસ હોય છે, જે દિલ ચોટે છે, એ પર્યુષણામાં ય પ્રતિકમણમાં ક્યાં ? ક્યાં એમાં દિલના રંગ ઊછળે છે ?

ત્યારે દિલના રંગ ભજ્યા વિનાની કિયા દિલને હયમચાવનારી ક્યાંથી બને ? એમાં એવી અનેરી રોનક ક્યાંથી આવે ? કિયા એની એ જ પણ દિલનો રંગ જો એમાં ભણે તો એની રોનક ઓર. આના પર એક દણ્ણાંત છે.

દિલના રંગનો એક પ્રસંગ :-

સૌરાખ્યમાં એક ઠાકોરને ત્યાં એના પુત્રના લગ્નનો પ્રસંગ આવ્યો. ઠાકોર વિચાર કરે છે કે લગ્નના વરધોડામાં અને લગ્નકિયા વખતે દીકરાનો વેશ એવા ઠાઠવાળો જોઈએ કે દુનિયા જોઈ જ રહે. એમાંય માથે સાઝો તો અવ્યલ રંગનો હોવો જોઈએ. તો એવો અનેરો સાઝો કોણ તૈયાર કરી આપે ?

આ અંગે ઠાકોર ચિંતામાં છે ત્યાં દિવાન આવ્યો.

ઠાકોર દિવાનને કહે ‘દિવાનજી ! આપણા કુમારને લગ્નના વેશમાં અવ્યલ સાઝો જોઈએ, એ કોણ તૈયાર કરી આપે ?’

દિવાન કહે છે, ‘બાપુ ! એમાં ચિંતા શી કરવાની ? આપણો અબદુલ્લો છીપો ભારે હોંશિયાર છે. એને એ કામ ભળાવી દઈએ.’

ઠાકોરના મનને એ વાત બેઠી અને તરત છીપાને બોલાવવા સિપાઈ મોકલ્યો. એ જઈને અબદુલ્લાને કહે છે, ‘ચાલ ! મહારાજા તને યાદ કરે છે.’

પરંતુ છીપો પૂછે, ‘કેમ શું કામ છે ?’

‘ભાઈ ! કામની તો ખબર નહિ, પરંતુ કુમારનાં લગ્નની તૈયારી ચાલે છે, દિવાનસાહેબ ત્યાં બેઠા હતા, એમણે તને બોલાવવા મોકલ્યો છે.’

છીપો એ સાંભળી ખુશી ખુશી થઈ ગયો કે ‘ચાલો, આજે તો કોઈ સારું કામ ઠાકોર સાહેબનું જ મળવાનું લાગે છે. આપણે ઠિક જ કમાઈ પડશું.’

ધર્મને ક્યાં આનંદ ઊછળે ? :-

જીવને સારા અર્થ અને કામની આશા બંધાય છે. ત્યાં આનંદના પૂર ઊછળે છે. એવા આનંદના પૂર ધર્મ જીવને કોઈ ધર્મકમાઈની આશા બંધાય ત્યાં ઊછળે. કેમ ખરું ને ? તો બોલો, કોઈ ધર્મગુરુ પધારે ત્યારે તમને સારી ધર્મપ્રાપ્તિની આશાના આનંદના પૂર ઊછળે ખરા ? આ સંસારમાં જનમ જનમ ભટકતાં અર્થ અને કામ મળવામાં બાકી રહી નથી. આ જનમમાં ય કેટલીય વાર મળ્યા. છિતાં પાછી નવું મળવાની આશા ઊભી થઈ કે શી વાત ? જાણે આજ સુધીમાં કાંઈ દેખ્યું જ નથી, તે હરખ હરખ ઊભરાય છે ! પણ ધર્મની વાત આવે ત્યાં કોઈ એવી આશા નહિ, કોઈ હરખ નહિ; કેવી દુર્દશા !

૫૮ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“ગૌતમસ્વામીએ જિનવચનની કેવી.” (ભાગ-૪૪)

કંગાળ જીવને ખબર નથી કે ‘પૈસા ટકા અને સુખસાધન તો કેર્દવાર મેળવ્યાં; અનંતી વાર મળ્યાં, પણ એનાથી દળદર શું ફિલ્ટ્યું ? અને આજે નવું શું મળવાનું હતું ? આજ સુધીમાં નથી મેળવ્યો શુદ્ધ ધર્મ; અને એ વિના જીવનું દળદર ફિટે એમ નથી. તો લાવ, જો એ મળવાની આશા છે તો નિધાન મળવા જેવો આનંદ માનું.’

ધર્મ કેમ નથી લેવાતો ? :-

ત્યારે ધર્મ મળવાની આશાનો એવો આનંદ ન ઉભરાય, તો પછી ધર્મગુરુ મળે, ધર્મ સમજાવે, છતાં ધર્મ લઈ જવાની એવી ઉત્કટ ઠિચ્છા જ શાની થાય ? તમે ધર્મ સાંભળો તો છો ને ? મહાન આત્માઓ કેવો કેવો ધર્મ પામીને કેવા ન્યાલ થઈ ગયા એ સાંભળવા મળે છે ને ? તો એ સાંભળતી વખતે, બોલો, ‘હું આટલો આટલો ધર્મ લઉં’ એવી જંખના જગે છે ખરી ? કે પછી માત્ર ‘વ્યાખ્યાન સાંભળવાનું એટલે સાંભળવાનું. ધર્મ લેવાની, કોઈ પ્રત નિયમ લેવાની, ઉતાવળ નહિ કરવાની,’ આવી જ મનોવૃત્તિ ને ? કારણ ? અહીં આવતાં પહેલાં એવા હરખનાં પૂર નથી ઉછળ્યા કે ‘ચાલો આજે તરણતારણ ધર્મની કાંક કમાઈ થશે, ફાવી પડ્યા. ‘બસ,

ધર્મ મળવાની આશા અને એમાં હરખનાં પૂર ન ઉભરાય તો ધર્મ લેવાની એવી તાલાવેલી ન થાય; તેમ દિલમાં ધર્મપ્રેમમનું માપ નીકળે.

એટલે પહેલું કામ આ કરવા જેવું છે કે અનંત કલ્યાણકર ધર્મ મળવાનો આનંદ ઉભો કરવો જોઈએ. એક, દેવાધિદેવનાં દર્શને નીકળીએ, ત્યાં પણ મનને એમ થાય કે ‘વાહ ! મને વીતરાગ પરમાત્માનાં પાવનકારી દર્શન મળશે,’ અને એનો હૈયે હરખ હરખ ઉભરાય. એવું બધે જ દાનાદિ ધર્મ મળવાની આશામાં જીવદ્યા-સામાયિક-પ્રતિકમણ-જપમાળા વગેરે ધર્મ મળવાની આશામાં આનંદ ઉછળવો જોઈએ. પછી જુઓ એમાં કેવી એકતાન પ્રવૃત્તિ થાય છે. બાકી અર્થકમની આશાના આનંદ તો શું જનાવર કે શું તુચ્છ માણસો, સૌને થાય છે.

પેલો છીપો આનંદમાં આવી ગયો, તરત કપડાં સજી ઉપડ્યો ઠાકોર પાસે જઈને ઝૂકીને હાથ જોડી ઉભો, પૂછે છે, ‘બાપુ ! શી આજ્ઞા ?’

દિવાન કહે ‘જો અબહુલ્લા ! કુંવરસાહેબનાં લગ્ન છે, એમાં કુંવરસાહેબ માટે સાફો એવો અવ્યાલ તૈયાર કરવાનો છે કે એ પહેલીને કુંવરસાહેબ વરઘોડામાં નીકળે ત્યારે દુનિયા એ જોઈ રહે,’

છીપો કહે, ‘ભલે સાહેબ ! એ તો માનું જ કામ. બધાં જ કામ પડતાં મૂકીને સાફો તૈયાર કરવામાં લાગી જઉં છું.’

દિવાન કહે ‘પણ જોજે હોં સમયસર થઈ જ જવો જોઈએ; અને વેઠ નથી

ઉતારવાની, સમજ્યો ?’

‘બાપુ ! એમાં કહેવું ન પડે. મારાં એવાં અહોભાગ્ય સમજું છું કે મને કુંવરસાહેબનો લગ્ન-અવસરનો સાફો તૈયાર કરવાનું મળે છે. પછી એમાં કમી રાખું ?’ બસ, છીપો ગયો અને મંડળો સાફો તૈયાર કરવા માટે એના પર ભાતભાતના રંગ ચડાવવા.

જે કાર્ય હાથમાં આવ્યાનાં મહાન અહોભાગ્ય મનાય એ કાર્ય કરવામાં હોંશ, ચીવટ, ને ભોગ આપવામાં કમીના ન જ રહે.

આપણી ધર્મસાધનાઓ કંગાળ કેમ ? અને સાંસારિક કોઈ શેઠના કામની, ઓફિસરના કામની, વગેરે પ્રવૃત્તિઓ ખૂબ હોંશ-ઉલ્લાસભરી ભારે ચીવટવાળી અને સારો ભોગ આપીને કેમ થાય છે ? જોઈએ તો દેખાય કે ધર્મસાધન કરતી વખતે અહોભાગ્ય નથી સમજાતાં. એક નાનકડું ગુરુવંદન જો અહોભાગ્ય સમજાને કરાય તો એ કરવાનો ઢંગ, વિધિની ચીવટ, હોંશને ઉલ્લાસ એ બધું અદ્ભુત હોય.

કૃષ્ણ મહારાજાએ ૧૮૦૦૦ સાધુને વંદના કરી પછી આવીને પ્રભુશ્રી નેમિનાથ ભગવાનને કહે છે, ‘ભગવન્ ! હવે જરા થાક લાગ્યો.’

પ્રભુ કહે છે, ‘મહાનુભાવ ! ખૂલ્યો, થાક લાગ્યો નહિ, પણ તેં તો થાક ઉતાર્યો, સાતમી નરકનાં કર્મની સ્થિતિમાંથી તેં નીચેની ચાર નરકની સ્થિતિ તોડી નાખી.’

કૃષ્ણ એ સાંભળી ચમત્કાર પામ્યા, કહે છે, ‘તો તો પ્રભુ ! હવે ફરીથી વંદના કરું જેથી બાકીની ત્રણ નરકનાં કર્મ પણ તૂટી જાય’

પ્રભુ કહે, ‘હવે એ ભાવ ગયા હવે ન તૂટે.’

પૂર્વના ભાવ કેમ ગયા ? કારણ આ, કે પૂર્વ વંદના સહજભાવે અહોભાગ્ય સમજાને નિરાશાસ ભાવે કરાઈ હતી; હવે આશંસા આવી એટલે સહજભાવનાં એવાં અહોભાગ્ય સમજવાનું ન આવે. ત્યારે વિચારવા જેવું છે કે ચાર નરકની કર્મની સ્થિતિ તોડી નાખે એ સાધુવંદન કેવા ઉચ્ચ ભાવથી કરાયા હશે ?

એ ઉચ્ચ ભાવ આવવામાં એક ઉપાય આ, કે જીવને આ વંદનક્રિયા કરવાનું મળવામાં મનને પારાવાર અહોભાગ્ય સમજાયાં.

કે ‘મારાં કોઈ અપૂર્વ અને અપાર અહોભાગ્ય કે મને આ પવિત્ર મહાત્માઓને વંદન કરવાનું મળે છે !’

પેલો અબહુલ્લા રાજાના કુંવરનો સાફો તૈયાર કરવામાં ભારે અહોભાગ્ય સમજે છે, તેથી એ રંગવામાં તલ્લીન થઈ ગયો છે; બીજાં બધાં કામ પડતા મૂકી આમાં લાગ્યો છે. સાફો તૈયાર થઈ ગયો, ને એ લઈને પહોંચ્યો દિવાન પાસે.

દિવાન સાફો જોઈ ખુશ થયા, ને લઈ ગયા ઠાકોર પાસે, ઠાકોર પણ જોઈને રજી રજી થઈ ગયા.

રાજકુમારના સાફાને જાંખો પાડતો સાફો :-

પરંતુ હવે બન્યું એવું કે રાજકુમારનો વરધોડામાં તો એ સાફાથી ઠાડ સારો દીઘ્યો, પરંતુ જ્યાં લગ્ન-મંડપમાં આવીને બેઠા ત્યાં એનો પાસે એનો જે એક મુસ્લિમ મિત્ર મોહમ્મદ સાફો પહેરીને બેઠેલો એનો સાફો ખૂબજ દીપી ઉઠતો હતો, એવો કે રાજકુમારના સાફાને જરા જાંખો પાડી હે. એનો રંગ વળી કોઈ અનેરો જ ચમકતો હતો. એ જોઈ ઠાકોરના મનને જરા લાગી આવ્યું, તે લગ્ન પત્યા પછી એ મિત્રને બોલાવી પૂછે છે,-

‘આ તારો સાફો કોણે તૈયાર કરેલો ?’

મિત્ર મોહમ્મદ કહે છે, ‘મહારાજા ! એ અબદુલ્લાની દીકરીએ તૈયાર કર્યો છે.’

ઠાકોર કહે ‘રંગવાના પૈસા કેટલા આય્યા ?’

પેલો કહે “બાપુ ! હું તો ગરીબ માણસ, એટલા પૈસા ક્યાંથી લાવું ? પરંતુ બન્યું એવું કે મારે મારા કુમાર મિત્રના લગ્નમાં આવવું હતું, સારા સાફો વિના એમની સાથે બેસું એમાં એમની ય શોભા નહિ, તેથી ચિંતામાં હતો ત્યાં અબદુલ્લાની દીકરી સાથે જરા મોહબ્બત, તે એણે મને ચિંતા-મગ્ન જોઈ કારણ પૂછ્યું. મેં વાત કરી એટલે કહે ‘એમાં શું છે ? સાફો હું તૈયાર કરી આપીશ.’ તે આ એણે મફતમાં તૈયાર કરી આય્યો.”

ઠાકોરના મનને થયું કે એવા તે કેવા રંગ એણે આમાં ઘાલ્યા હશે કે આ એણે એના બાપ કરતાં પણ વધુ સરસ બનાયો ?’

ઠાકોર તરત અબદુલ્લાની દીકરીને બોલાવી પૂછ્યું બેન ! આ સરસ સાફો તેં તૈયાર કરેલો ?’

‘હા બાપુ ! આપના પ્રતાપે કરી શકી.’

ઠાકોર પૂછે, ‘તે એમાં તારા પિતાજી કરતાં એવા તે કેવા વધુ સરસ રંગ ઘાલેલા ?’

જુઓ અહીં અબદુલ્લાની પુત્રી શો ખુલાસો કરે છે. એ કહે છે, ‘મહારાજા ! રંગ તો હું બીજા ક્યાંથી લાવું ? રંગ તો એમણે વાપર્યા એ જ મેં વાપર્યા છે, પરંતુ આમાં મારા દિલનો રંગ ઉમેરાયો છે. મોહમ્મદ ઉપર મને જુગરજાન પ્રેમ, તે એની સેવા કરવા આ મેં તૈયાર કરેલ. એટલે આપ સમજો છો કે સહેજે એમાં દિલના પ્રેમનો રંગ ભણે, પછી કેમ સરસ તૈયાર ન થાય ?’

ઠાકોર સમજ ગયો કે છીપાએ ભલે ખૂબ હોંશ ને ચીવટ તથા ભારે

મહેનતથી સાફો રંગ્યો, પરંતુ એમાં મારા તરફથી સારા ઈનામની આશા હતી, જ્યારે આ છોકરીને એવી કોઈ આશા જ નહિ, તેથી નિઃસ્વાર્થભાવે માત્ર દિલના પ્રેમથી આ કામ કર્યું એટલે એનો રંગ ઓર આય્યો.

ઠાકોર પછી અબદુલ્લાને સારું ઈનામ આપી એની પુત્રીને ય ઈનામ આપવા માંગ્યું, પરંતુ પુત્રી કહે છે ‘બાપુ ! ક્ષમા કરજો, ઈનામ મારે ન ખપે. આ થોંયું જ મેં ઈનામ માટે કર્યું છે ?’

ઠાકોર કહે, ‘તેં તો દિલના પ્રેમથી કરેલું તે થઈ ગયું, હવે ઈનામ લેવામાં શું બગડી જાય ?’

‘બાપુ ! બગડી એ જાય કે, એકવાર વળતર લીધાથી જીવને ફરીથી આવાં કોઈ દિલથી કરવાના કામ આવે ત્યારે એમાં ભાવી ઈનામ વળતરની આશાનું ઝેર પેસે, મનને એમ થાય કે ભલે આપણે સ્વાર્થ વિના આ કામ કરો, પણ પછી સમાજ આપણી કદર કરશો, અને આ ઝેર છે. ત્યાં કામમાં ખરેખરો રંગ ન ભળે !’

ઠાકોર આ સાંભળી વધુ ખુશ થયો, એને શાબાશી આપી.

આપણી વાત આ હતી કે,

ધર્મક્રિયામાં દિલના રંગ ભષ્યા વિના એ કિયામાં રોનક ક્યાંથી આવે ?

આપણને હજુ ય ધર્મક્રિયા કરવાની, કોઈ દયા-દાનાદિ ધર્મ સાધવાની, તમના હોય છે,

પરંતુ ત્યાં હિસાબ એટલો કે આ કિયા આ સાધના પતાવી દેવાની ! ‘ચાલો દર્શન પતાવો, પૂજા પતાવો, સામાયિક-પ્રતિકમણ પતાવો... આમ પતાવવાની જ વાત. પરંતુ એમાં દિલનો રંગ ભેળવવાની ખાસ તમના ક્યાં હોય છે ? અરે ! એનો વિચાર પણ ક્યાં આવે છે કે ઊભો રહે, ધર્મની કિયા કે સાધનાની સાથે દિલમાં અપૂર્વ ઉલ્લાસ, તગતગતની ધર્મલેશ્યા. ને ઉછણતા ભાવ રાખવાની ચીવટ ક્યાં છે ?’

એ વિના તો લૂષ વિનાની દાળ કે સાકર વિનાની ચા જેવી એ મોળી ફિક્કી કિયા થશે એનો લાભ તુચ્છ મળવાનો. કિયા કે સાધના કરું કરું ને માત્ર ભાવ વિના યાને દિલના રંગ વિના એને તુચ્છ લાભમાં જવા દઉં ? થોડા નિમક્તની કસર કરી ખીચડી કોણ બગડે ?’ આવો વિચાર પણ ક્યાં છે ? વિચાર જ નહિ તો પછી તમના ક્યાં અને પ્રયત્ને ક્યાં ?

આ તો જે કિયા કરે છે એની ચૂકવાની વાત થઈ કે, ધ્યાન માત્ર ધર્મક્રિયા કરી લેવાનું હોય છે, પરંતુ એમાં તેવા તેવા ભાવ ચમકતા રાખવાનું નહિ. તેથી દા.ત. પ્રતિકમણ કિયામાં એના મહામૂલ્યવંતા સૂત્રોનું આલંબન મળવા છતાં એથી

ભાવોલ્લાસ ચમકાવવાનું-મધમધાવવાનું લક્ષ નહિ, તમજ્ઞા નહિ, એટલે ચિત્ત અમાં તન્મયતાથી પરોવાનું નથી, અને આડાઅવગા વિચાર ચાલ્યા કરે છે, તેવા વિચારમાં કષાયની લાગડી પણ થઈ જાય છે, અને એમ પરિણામે તામસભાવ પોખાયા કરે છે. ધર્મ કરવા છિતાંય ભાવનું લક્ષ નહિ એટલે આ સ્થિતિ બને છે.

પરંતુ જે ધર્મક્રિયા ધર્મસાધના કરતાં જ નથી એમનો તો એ સારા આલંબન વિના મરો જ છે, એમના મનને સાધનાનું સારું આલંબન નહિ, પછી સારા આલંબને જગાવી શકતા શુભ ભાવોલ્લાસ એમને જોવાના જ ક્યાં ? એમનું મન તો પૈસા-ટકા, વેપાર-રોજગાર, કુટુંબ-પરિવાર, ખાન-પાન, સત્તા-સન્માન-સુખાકારિતા વગેરેમાં જ રમ્યા કરતું હોય છે, એટલે આ બધાના આધારે અર્થાત્ બધાં આલંબને મનમાં મોહના જ ભાવો ચ્યમક્યા કરે ને ? મન મોહના જ ભાવોમાં મહાલ્યા કરે ને ? કુજૂલ વિચારો અને કામ-કોધ-લોભ વગેરેની લાગડીઓ તો વારે વારે ઊઠ્યા જ કરે ને ? ભૂલશો નહિ,

ઉત્તમ ભાવો-ભાવોલ્લાસ ધર્મસાધનાના આલંબને જગાવવા અને ઝગમગતા રાખવા જે સુશક્ય છે, સરળ છે, એ પૈસા-પરિવાર-કાયાઆદિના આલંબને નહિ.

(૧) દેવાધિદેવનાં દર્શન કરતાં રહો ત્યાં જે ઉત્તમભાવ સહેલાઈથી જગાવી શકો, એ પત્ની-પુત્રાદિને જોતા રહેવામાં નહિ; (૨) જિનવાણી-શાસ્ત્રબોધ કમાતા રહેવામાં જે શુભ ભાવોલ્લાસ જાગતા રાખવા સહેલા, એ પૈસા કમાતા રહેવામાં નહિ. (૩) ધંધોધાપો કરતી વખતે શુભ ભાવો ઉછાળવા દુષ્કર ! પણ સામાયિક સ્વાધ્યાયાદિ ધર્મપ્રવૃત્તિ કરતી વખતે એ સહેલા. (૪) પ્રભુપૂજન-જિનભક્તિમાં શુભભાવોલ્લાસ જગાવવો-વિકસાવવો સરળ; પણ પોતાની કાયાની ભક્તિ-પલેવણમાં એ સહેલું નહિ. (૫) ધનના સંચયમાં નહિ એવા સુંદરભાવ ધનના દાનમાં આવી શકે. (૬) વિષયોના સંપર્કમાં શુભ ભાવોલ્લાસ શો લાવી શકાય, જે ત્યાગમાં, સંયમમાં, પ્રત-નિયમમાં લાવી શકાય ? (૭) તીર્થોની યાત્રામાં જે શુભ ભાવોની છોળો ઊછળતી રાખી શકાય, એ વેપાર કે મોજ-આનંદ નિમિત્તના પ્રવાસોમાં શીરીતે બની શકે ?

વિચારમાં જેવું છે, બહુ વિચારવા જેવું છે, કે

જીવન સુંદરતમ બને છે શુભ ભાવોથી; અને ચિત્તમાં શુભ ભાવો રાખવા હોય તો એ શુભ પ્રવૃત્તિ દ્વારા જ રમતા ને વિકસતા રાખવા સરળ છે,

એમાં વળી એ શુભ પ્રવૃત્તિ વખતે જિનવચનનું આલંબન રખાય તો શુભભાવો ભવ્ય-અતિભવ્ય જાગો છે.

હવે જ્યારે વિશ્વમાં પ્રાપ્ત કરવા અત્યંત મુશ્કેલ એવાં પણ જિનવચન જો ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

આપણાને મળી ગયા છે, તેમ એક યા બીજી માનસિક-વાચિક-કાચિક શુભ વિચાર-વાણી-વર્તાવ રાખવાની અતિશય કિમતી પુરુષાર્થશક્તિ મળી ગઈ છે, તો પછી એ શક્તિથી શુભ પ્રવૃત્તિઓ દિવસરાત કેમ ન કર્યે જવી ? એમાંય જિન-વચન કેમ વારેઘડીએ યાદ નહિ કરવાં ? પ્રશ્ન થાય કે,

પ્ર.- દ્યા દાન વગેરે ધાર્મિક પ્રવૃત્તિ કરીએ, પછી જિનવચન યાદ કરવાની જરૂર રહે છે ?

૩.- હા, જરૂર એટલા માટે કે ધાર્મિક પ્રવૃત્તિ વખતે જિનવચન યાદ કર્યાથી સાથે સાથે સમ્યગ્દર્શન પામવાની યા નિર્મળ થવાની ભૂમિકા ઊભી થાય છે. ધાર્મિક વિચારણા કરીએ, ધર્મની વાણી બોલીએ, યા કાયાથી ધર્મપ્રવૃત્તિ કરીએ એ એક વાત છે, અને સાથે મનમાં એ લાવીએ કે ‘અહો ! મને આ જિનાજ્ઞા પાળવાનો મહાન લાભ મળે છે,’ એ એમાં વિશેષતા છે.

પ્રભુની આજ્ઞા છે માટે શુભ વિચાર-ઉચ્ચાર કે ધર્મપ્રવૃત્તિ કરું. જીવનમાં જિનાજ્ઞાપાલન જેવું કોઈ શ્રેષ્ઠ કાર્ય નથી; આ વિચારથી કેટલા લાભ ?

(૧) ધર્મપ્રવૃત્તિમાં કંટાળો નથી આવતો,

(૨) જિનવચનનો રસ રહેવાથી ધર્મ પ્રવૃત્તિમાં જોમ આવે છે.

(૩) જિનાજ્ઞાને મુખ્ય કરવાથી સમ્યગ્દર્શન પામવાનું યા પામ્યા હોય તો નિર્મળ કરવાનું સહેલું બને છે.

(૪) ‘મારે તો જિનેશ્વર ભગવંતની આજ્ઞા બને તેટલી વધુ પાળવાની છે, જિનાજ્ઞા અને એનું પાલન મળે છે એ મારાં અહોભાગ્ય છે...’ એવું વારેવારે યાદ કરવાથી જિનેશ્વર ભગવાન અને એમનાં વચન પ્રત્યે મમત્વ વધે છે. ૧. વીતરાગ પ્રભુનું મમત્વ વધવાથી રાગનાં બંધન તૂટવાને અવકાશ મળે છે. ૨. જિનવચનનું મમત્વ વધવાથી મિથ્યાત્વીનાં ગમે તેવા વચન પણ આંશુ શકતા નથી.

(૫) સ્થૂલ પાપનો ત્યાગ જો જિનની આજ્ઞાની રૂએ કરતા હોઈએ તો જે સૂક્ષ્મ પાપનો ત્યાગ કરી શકતા નથી એ ત્યાગ તરફ સાપેક્ષ ભાવ-અભિલાષા-રુચિ ઊભી થાય છે. તેથી શક્ય એટલી એ અહિસા યાને જ્યાણા પાળવા ઉત્સાહ અને બળ મળે છે.

જિનવચનનો ખ્યાલ કોધને કેમ રોકે ? :-

આમ દરેક શુભ વિચાર-વાણી-વર્તાવમાં જિનાજ્ઞાપાલનનો ખ્યાલ ભેળવવાથી આવા બધા વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. આ જ હિસાબે કોધ થવાનો પ્રસંગ આવે ત્યાં આ વિચારી શકાય કે ‘કોધ કરવામાં મોહના આજ્ઞાનું પાલન થશે, ત્યારે કોધ અટકાવવામાં જિનની આજ્ઞાનું પાલન થશે. આમ કોધ અટકવાની સાધના સાથે

૬૪ ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“ગૌતમસ્વામીએ જિનવચનની કેવી.” (ભાગ-૪૪)

જિનાજ્ઞાપાલનનો પણ મહાન લાભ મળશે.’ આ રીતે વિચારી કોધને અટકાવે ત્યાં એ સાધનામાં જિનાજ્ઞાપાલનના ખ્યાલને પણ ભેળવવાનું થયું.

આ જિનાજ્ઞાના ખ્યાલનો એ પ્રભાવ પડશે કે ફરી ફરી કોધને અટકાવવાનું, જિનાજ્ઞાપાલન પરના અતિ બહુમાનને લીધે, વધુ બળ મળશે.

જિનાજ્ઞાપાલન પરનું અતિશય બહુમાન આ વિચાર આપે છે કે ‘અહો ! આ માનવભવમાં મને જિનેશ્વર ભગવાનની આજ્ઞા પાળવાની મળે છે ? મારા અહોભાગ્ય છે કે આ જિનાજ્ઞા મને મળી તો જિનાજ્ઞાપાલનનો શ્રેષ્ઠ ધર્મ મને મળે છે ! લાવ, ખૂણે ખૂણે જ્યાં જ્યાં વિચારમાં વાણીમાં કે કાયા અને ઈન્દ્રિયોના વર્તાવમાં મને જિનાજ્ઞા પાળવાની મળે એ શોધી શોધીને ત્યાં ત્યાં એનું પાલન કરું.’

આ વિચારથી નિત્ય હોંશ બની રહે છે કે ‘વિચાર-વાણી-વર્તાવમાં બને ત્યાં સુધી જિનાજ્ઞાનું પાલન ઉત્તરું;’ અને જરાક કરીને જુએ તો દેખાય કે આજ્ઞાવિરુદ્ધના વિચાર-ઉચ્ચાર-આચરણમાં બહુ કમાવાનું હોતું નથી, તેમ એ અટકાવવામાં જાણું ખોવાનું છે નહિ; ત્યારે એ અટકાવીને જિનાજ્ઞાપાલન બજાવવામાં કમાવાનું ભારે ! તો આ અટકાયત એ તો સસ્તો સોઢો ને કમાણી અપરંપાર ! અને શું કામ જતો કરું ?’ આમ આજ્ઞાપાલનને અથળક કમાણીનો સસ્તો સોઢો સમજી આજ્ઞાપાલનની નિત્ય હોંશ રહેવાથી અસાર અશુભ, કુજૂલ, કે રાગદ્રેષભર્યા વિચાર-વાણી-વર્તાવ અટકાવવા બળ મળે છે, ને બને તેટલા એ અટકાવ્યે જવાય છે.

જિનવચન-પાલનનું મહત્વ શાથી ? :-

પ્ર.- શું જિનાજ્ઞાપાલનના ખ્યાલનું આટલું બધું મહત્વ છે ?.

ઉ.- હા, એનું કારણ આ, કે એ ખ્યાલવાળો સમજે છે કે જિનાજ્ઞાપાલન એ શુદ્ધ અને શ્રેષ્ઠ ધર્મ છે. શ્રી હરિબદ્રસૂરિજી મહારાજે કહ્યું છે ને કે ‘ધર્મો આજ્ઞાએ પડિબદ્ધો !’ અર્થાત્ ધર્મ જિનાજ્ઞાની સાથે સંકળાયેલો છે. જિનાજ્ઞાએ જે વિધિ-નિષેધ કહ્યા હોય, જે આચરણીય અને ત્યાજ્ય બતાવ્યા હોય તેનું આચરણ અને ત્યાગ એ જ ધર્મ. ટૂંકમાં કહીએ તો જિનાજ્ઞા એ જ ધર્મ.

પ્ર.- જિનાજ્ઞા એ જ ધર્મ શાથી ?

ઉ.- સમજી રાખો કે ધર્મ અને અધર્મને એનાં ફળ સાથે અતીન્દ્રિય સંબંધ છે, એ આંખેથી ન દેખાય. એની આત્મા પરના કર્મ ઉપર તથા સંસ્કાર-વારસા પર કેવી કેવી અસર પડે છે એ નજરે ન દેખાય, યા એમાં તર્ક ન પહોંચી શકે; એટલી બધી એની સૂક્ષ્મ વિસ્તૃત અને ગંભીર અસર હોય છે. એ તો સર્વજ્ઞ ભગવાન જ પ્રત્યક્ષ જોઈ શકે છે. જગતમાં સરાગી કોઈ દેવ નહિ પણ, વીતરાગ જિનેશ્વર દેવ જ સર્વજ્ઞ હોય છે, ને ધર્મની એ એ અતીન્દ્રિય અસરને પ્રત્યક્ષ

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો”(ભાગ-૪૪) ૬૫

નિહાળી સર્વજ્ઞ જ જગત આગળ યથાર્થરૂપે પ્રકાશે છે, માટે એ જે સફળ ધર્મ બતાવે છે એ જ સાચો શુદ્ધ ધર્મ; સર્વજ્ઞવચનથી જ શુદ્ધ ધર્મ જણાય.

ધર્મ કે અધર્મથી કેવાં કેવાં કર્મ બંધાયાં, પૂર્વે બંધાયેલા કર્મોનાં વર્તમાન બંધાતા કર્મોમાં સંકમણ કેવા થયાં, કર્મોમાં કેવાં કેવાં સ્થિતિ અને રસનાં ઉદ્વર્તન-અપવર્તન થાય છે, કર્મોના કેવાં કેવાં કેટલાં કેટલાં ક્ષય થાય છે; આ બધું પ્રત્યક્ષ નિહાળવાનું ગણું અ-સર્વજ્ઞમાં ક્યાંથી હોય ? પછી એ પ્રત્યક્ષ અનુભવ્યા વિના ધર્મ-અધર્મનું સ્વરૂપ બતાવે એમાં કેવું અગંબગં હોય, ને એના પર શા વિશ્વાસ મૂકાય ?

હિંસા ક્યાં ક્યાં છે છતાં એ ધર્મ ?

અજ્ઞાન અસર્વજ્ઞ તો બિચારો એટલું લઈ બેઠો હોય કે ‘હિંસા એ અધર્મ ને અહિસા એ ધર્મ. પરમાત્માની પૂજામાં જલ-પુષ્પ આદિની હિંસા થાય છે, માટે એવી પૂજા એ અધર્મ ! આવું લઈ બેઠેલાને પ્રત્યક્ષ ક્યાં દેખાય છે કે ‘પરમાત્માની એવી પૂજા કરવામાં કર્મ પર કેટલી સુંદર સારી અસર પડે છે ?’ પછી એને બિચારાને પૂછો, ભગવાનની હ્યાતીના કાળમાં ભગવાન જ્યાં પદ્ધાર્યા ત્યાં રાજા-મહારાજાએ જે ભારે સમારંભથી સ્વાગત કર્યા, એમ રાજા શેઠ શાહુકારો ઠાઠથી પ્રભુને વંદન કરવા ગયા, એ બધાને શું અધર્મ કહેશો ? એમ, શ્રાવક વરસતા વરસાદમાં સાધુને વાંદવા કે વ્યાખ્યાન સાંભળવા જાય એણે ય શું અધર્મ કર્યો ? સાધુ પણ વિહારમાં નદી ઊતરે, શું એના પર પણ અધર્મનો સિક્કો લગાવશો ?

મૂળમાં સર્વજ્ઞ પ્રત્યક્ષ જોઈ સુઝ્ય અહિસાને ધર્મ પણ ક્યાંક હિંસાને ધર્મ કહ્યો હોય, તે માનવું નથી, એટલે પોતાને ફળ-અસર પ્રત્યક્ષ ન દેખાવા છતાં ધર્મ-અધર્મનું સ્વરૂપ કહેવા બેસવું છે, એટલે એમાં ભળતી જ વાતો આવે, ઊલદું જ સ્વરૂપ આવે, પણ મિથ્યાત્વનો નશો એ જ પકડી રખાવે છે, પછી ભલે એક બાજુ તો સર્વજ્ઞ જિનની આજ્ઞા ભાંગવાનું ઊભું થાય, અને બીજી બાજુ પોતાને જ બીજી પ્રવૃત્તિ અંગે લોચા વાળવા પડે ! મિથ્યાત્વનો કેફ આની પરવા નથી રાખવા દેતો.

ખરી વાત આ, કે સર્વજ્ઞ જિનેશ્વર ભગવાન કઈ અહિસા-હિંસા આદિમાં ધર્મ કે અધર્મ, એનું ફળ પ્રત્યક્ષ જોઈ શકે છે, તેથી એ જોયા પ્રમાણે ઉપદેશે એના ઊપર જ ધર્મ-અધર્મનું માપ રખાય. માટે જિનવચન એ જ પ્રમાણ. જિનાજ્ઞા એ જ ધર્મ. એ જિનાજ્ઞા જેને ત્યાજ્ય કહે એનો ત્યાગ એ ધર્મ; એ જેને આદરણીય બતાવે, એનો આદર એ ધર્મ.

આમ, ‘જિનાજ્ઞા એ જ શુદ્ધ ધર્મ, એ જ શ્રેષ્ઠ ધર્મ. જિનાજ્ઞાને છોડીને શું, કે જિનાજ્ઞાથી વધીને શું, કોઈ ધર્મ નથી. આપણાને આવી જિનાજ્ઞા પાળવાની મળે એમાં આપણો પરમ ભાગ્યોદય છે. આ સમજનાર તો વિચાર-વાણી-વર્તાવમાં બધે

૬૬ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“ગૌતમસ્વામીએ જિનવચનની કેવી.” (ભાગ-૪૪)

જ યથાશક્ય જિનાજ્ઞાપાલનને શોધી ગોઈવતો હોય. એટલે કોધને અટકાવી ક્ષમા રાખવામાં પણ જિનાજ્ઞાપાલન કરી ધન્ય બન્યાનું સહેજે માને.

બસ, કોધને અટકાવનારી અનેક વિચારણાઓમાં આ એક વિચારણા થઈ કે એથી જિનાજ્ઞાપાલનનો સુંદરલાભ મળે છે.

● કિંમતી આત્મવીર્ય ક્યાં ખરચાય ? ●

(૧૩) કોધને અટકાવવા વળી આ એક વિચાર છે કે મનમાં એ લાવવું કે ‘મને જે બળ મળ્યું છે તે બહારનાને હંફાવવા-દબાવવા નહિ, પણ આ કોધાદિ જાલિમ આંતર શરૂને દબાવવા માટે મળ્યું છે. તો એને જ દબાવું.’

મહાતીર ભગવાન પર હલકા જીવોએ ઘોર ઉપદ્રવ કર્યા, તો શું પ્રસુ પાસે કોધ દેખાડવા બળ નહોતું ? કેમ એમણે એ દેખાડવાનું ન કર્યું ? કહો, બળ તો એ જીવો કરતાં અનંતગુણું હતું, પરંતુ એનો ઉપયોગ અંદરના કોધને જ દબાવવામાં કરવો હતો, બહારના એ ઉપદ્રવકારી જીવોને દબાવવામાં નહિ.

બહારનાને દબાવ્યે જઈશું તો અંદરનાને દબાવવાનું ક્યારે ? :-

જો આ ખ્યાલ ન રાખીએ અને મોકે મોકે કોધ કર્યે જઈએ તો પછી એને દબાવવાનું ક્યારે કરીશું ? ક્યો એવો જનમ મળશે કે જ્યાં કોધ કરાવનાર તત્ત્વ નહિ હોય ? બધે જ એ રહેવાનાં; અને બધે જ એમ બહારનાને દબાવવા કોધ કર્યે જવાના. તેથી ભવભ્રમણ અખંડ ! ચાલવાનું. માટે બળનો ઉપયોગ કોધ કરી દુઃખ-આપત્તિને ટાળવામાં કરવા કરતાં એ દુઃખ-આપત્તિને સહી લેવામાં અને કોધને દબાવી દેવામાં કરવા જેવો છે. એ માટે આ વિચારતા રહેવાનું કે ‘અહીં મને મળેલું બળ એક અનેરી બદ્ધિસ છે, મહા પવિત્ર છે, એનો ઉપયોગ અંતરના કોધાદિને દબાવવામાં કર્યે જાઉ’

માનશો નહિ કે ‘એમ માત્ર અંતરના કોધને દબાવવામાં બળ ખરચીએ અને બહારનાને દબાવવામાં નહિ, તો તો પછી બહારનાઓ આપણા પર ચરી જ બેસે;’ આવું માનવાની જરૂર નથી, કેમકે બહારનાઓ આપણાને અનુકૂળ વર્તે કે પ્રતિકૂળ એનો મુખ્ય આધાર આપણાં શુભ-અશુભ કર્મ ઉપર છે તેથી જો અશુભ કર્મ ઉદ્યમાં હશે, તો કોધ કરવા છતાં સામો પ્રતિકૂળ વર્તશે; ને કોધ કરેલો માથે પડશે, ત્યારે કોધ દબાવી ખમી ખાવામાં, કદાચ આપણાં અશુભના ઉદ્યે સામો દબાવી જશે, તો પણ કોધને દબાવ્યાથી આપણાને અનેરો લાભ થશે, એવું એક પુષ્યતેજ પ્રગટશે જેનો અજબ પ્રભાવ પડશે.

ખમી ખાવા પર વર્તમાનનો જ દાખલો જુઓ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજ મહારાજે તેવા તેવા પ્રસંગમાં કોધને દબાવી ખમી ખાવામાં

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

પોતાનું બળ ખર્ચું, ત્યાં સામાએ ચડભડવાનું પણ કર્યું, છતાં ગુરુદેવની ક્ષમા અળકતી રહી. શું બગડ્યું ? સરવાળે એઓશ્રીના જીવનને કેવું માનો છો ? યશસ્વી કે કંગાળ ? યશસ્વી જ શું, મહા યશસ્વી ને ? એનું કારણ આ, કે પવિત્ર સંયમ સાથે આ કોધના નિગ્રહ અને સહિષ્ણુતાથી એઓશ્રીનું પુષ્યતેજ વધતું ચાલ્યું. એમાં પછી ભૂલ કરનારા પણ આકર્ષાઈ ગયા; અને જનતાનાં ય આકર્ષણ વધ્યાં. પૂઢ્યશ્રીનો યશ ભારતમાં ચારે દિશામાં પ્રસરી ગયો. તે એવો કે એઓશ્રીના જતાં ચારેકોર ભારે આધાત થયો. આ યશના મૂળમાં એઓશ્રીના અનેકવિધ સંયમ આદિ ગુણો પૈકી આ એક જબરદસ્ત ગુણ હતો કે હ્યા વરસના ચારિત્રકાળમાં એઓશ્રીએ પોતાના બળને અંતરના કોધ કષાયને શાંત રાખવામાં ખૂબ જ વાપર્યું છે.

આપણે પણ કોધ કષાયને દબાવવા આ વિચાર્યા કરવાનું કે ‘મારે મારા કિંમતી બળને બીજાઓને દબાવવામાં વેરડી નથી નાખવું. એને હું કોધાદિ-કષાયોને એ કષાયી મારા આત્માને દબાવવામાં ખરચી સફળ કરીશ, એનાં મહાફળ નિપજાવીશ.’ મનનું વલણ જ આવું બની જાય.

સવાલ માત્ર મનનાં વલણનો છે. મનનું વલણ કઈ બાજુ ઠણે છે એ જોવાનું છે. એક મનનું વલણ બીજાઓને દબાવવા તરફ યા ઈંડ્રિયોનાં યથેચું તર્પણ કરવા તરફ ઊતરે છે, બીજું પોતાના કષાયી-વિષયી પાપી આત્માને દબાવવા તરફ અને એના એ કષાયો પાપો અને વિષયગુલામી અટકાવવા તરફ ઊતરે છે. એમાં ફરક કેટલો મોટો પડે ?

બીજાને દબાવવા તથા ઈંડ્રિયોને મહલાવવાનું વલણ દુષ્ટ-દુર્જન-શેતાન બનાવે; પોતાના કષાયી વિષયી આત્માને દબાવવાનું વલણ શિષ્ટ-સંત-સજ્જન બનાવે. મનનું વલણ આપણે જ ઊભું કરીએ છીએ. માનવ તરીકેનું ઉચ્ચ ઉમદા જીવન મળ્યું એની ઉચ્ચતા ઉમદાપણું વિષયલંપટ અને કષાયરક્ત બચ્ચા રહેવામાં નહિ, પણ ઈંડ્રિયસંયમન, વિષયવિરાગ, તથા કષાય-ઉપશમ કેળવવામાં છે એ વાત હૈયે વસી ગઈ હોય તો પછી મનનું વલણ પોતાના વિષયી-કષાયી પાપી આત્માને દબાવવા તરફ રહ્યા કરશે. પોતાની બુદ્ધિશક્તિને આત્મબળ એ બાજુ કામ કરતા રહેશે.

બે ય જાતનાં મનનાં વલણનાં દાણાંત જુઓ,

ટ્રેનમાં મુસાફરી કરતાં એક ભાઈ ડાખામાં જુએ છે કે એક સુરદાસ સુંદર ગીત ગાઈ રહ્યો છે,

‘કરમ તેરી અજબ લીલા મેં પાઈ

સુંદર સાધન દેત હુઅા ભી, ઈસ પર હી દુઃખદાયી, કરમ.

દુર્જનકું દુર્જનતા કરતે ભી, સુખ સુવિધા વિરચાઈ, ... કરમ૦

૬૮ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“કિંમતી આત્મવીર્ય ક્યાં ખરચાય ?” (ભાગ-૪૪)

સજજન સજજનતા રખતા હુએ, દેખો કબી માર ખાઈ..કરમો

પ્રવાસી ભાઈને આ સાંભળી મનને લાગ્યું કે ‘આ અંધ સુરદાસ જરૂર પોતાનું કોઈ દિલનું દરદ ગાઈ રહ્યો છે. તો જોઈએ એનો શો અનુભવ છે.’ એમ કરી એણે સુરદાસના હાથમાં પહેલાં તો એક રૂપિયો મૂક્યો, પછી પૂછે છે,

‘ભાઈ ! આ તું ગાય છે એની પાછળ તારે શો અનુભવ છે ?’

સુરદાસ કહે છે ‘સજજન ! ઘરની વાત કહેવામાં શો માલ છે ?’

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૨૦, અંક-૧, તા. ૪૯-૧૯૭૧

પ્રવાસી કહે, ‘તારી વાત સાચી છે, માણસે બીજાના ઘરની વાત જાણવા આગ્રહ ન રાખવો જોઈએ. પરંતુ તું ક્યા ગામનો છે એ અહીં કોઈ જાણતું નથી. તેથી તારો જાત-અનુભવ કહેવામાં અહીં બેઠેલાને વ્યક્તિકુપે કોઈ ચોક્કસ માણસ પર દ્રેષ્ટ તિરસ્કાર નથી થવાનો; અને અનુભવ સાંભળીને સંભવ છે કોઈને પોતાના જીવન માટે હિતશક્ષા મળે. તને ઢીક લાગે તો જણાવ.’

પ્રવાસી સજજન હતો, બીજાના ઘરની વાત જાણવાનો એણે આગ્રહ ન રાખ્યો, સાથે લોકનું ભલું થતું હોય ને બાધ ન હોય તો અનુભવ કહેવાનું સામા પર છોડ્યું. પાછું એણે સુરદાસના દુઃખમાં સહાનુભૂતિ બતાવવા રૂપિયો પહેલો દીધો છે, એટલે સુરદાસને એ આત્મીય જેવો લાગ્યો. તેથી સુરદાસ અનુભવ કહે છે,-

બ્રાહ્મણીની કથા :-

બંધુ ! એક ગામમાં એક બ્રાહ્મણને સ્ત્રી રૂપાણી મળેલી. પણ કરમની ગતિ ન્યારી. સુખનું સાંદર્થન તો મળ્યું, પરંતુ એ બિચારાનાં કર્મ કેવા કે એ જ એના દુઃખ માટે નીવડે છે. ભાઈ આમ તો ધણીની સેવા-સગવડ બજાવતી તેથી ધણીને એના પર સારો ભરોસો રહેતો કે ‘આ ભાઈ પતિભક્તા છે,’ પરંતુ એને પોતાનાં વાંક કરમની કયાં ખબર હતી કે ‘એ કર્મ અંદરખાને કેવો પ્રપંચ રચી રહેલ છે, અને ભાઈને ક્યા માર્ગ લઈ જઈ રહેલ છે, ‘સેવાના ઓઠા હેઠળ જ ધણીને વિશ્વાસમાં રાખી ધાણ આખો બગડી જાય ત્યાં સુધી એને કશી ગંધ જ ન આવવા દીધી, કે એ ક્યારે ય પણ જરાક તપાસ કરે કે ‘લાવ, જોઉં એની આખા દિવસની શી પ્રવૃત્તિ છે.’

બ્રાહ્મણી ખોટાં નિમિતે ભૂલે છે :-

બન્યું એવું કે ભાઈ બપોરે ધણીને ખેતરમાં ભોજન આપવા જાય ત્યારે

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : દૂટવાનો મોકો” (ભાગ-૪૪)

પોલિસથાણા પર જમાદારનો જુવાન છોકરો એને પ્રેમના ઈસારા કરે. બાઈ પણ જુવાન ઉંમરની તે ધીરે ધીરે એના મોહમાં લપટાણી. નરસાં નિમિત્ત સારાને ય ભૂલાવે છે. માટે એવાં નિમિત્તથી જ દૂર રહેવું જોઈએ જો સદાચાર સજજનતા રક્ષવી હોય, આની કિંમત હોય તો પેસા-ટકાને બહુ મહત્વ ન આપે. બ્રાહ્મણને શી ખબર કે એ ભોજન આપીને સીધી ધરે જાય છે કે જમાદારના પુત્રની પાસે ?’ એ તો સાંજ પડ્યે ધરે જાય ત્યારે પેલી એને આવકારવા ને આગતાસ્વાગત કરવા તૈયાર હોય.

પાડેશને કોઈને વહેમ આવ્યો હશે તે બ્રાહ્મણને કહ્યું હશે, પણ બ્રાહ્મણે પેલીની સેવાના વિશ્વાસમાં ગણકાર્ય નહિ. એમાં એક દિવસ એવો આવીને ઊભો કે હવે એ બ્રાહ્મણી જમાદારના પુત્રને ત્યાં જ પડીપાથરી એટલે બ્રાહ્મણ ચોંક્યો. બાઈને પૂછે છે ‘કેમ તું પેલાને ત્યાં પડીપાથરી રહે છે ?

બાઈ કહે ‘ચૂપ રહો, મારી મરજી.’

‘અરે ! તું આવી પતિભક્તા આજે આમ બોલે ?’

‘કેમ એમાં શું છે ? તમારી કાંઈ ગુલામડી ધું ?

બ્રાહ્મણ કહે ‘આ શું બોલી રહી છે ? સાર નહિ નીકળે.’

‘એટલે તમે શું કરી નાખવાના હતા ? જાઓ થાય તે કરી લો.’

બ્રાહ્મણનો પિતો ગયો. ઉઠીને ગયો વક્કિલ પાસે અને કોરટમાં જમાદારના પુત્ર સામે દાખલ કર્યો કે ‘આ માણસ મારી પત્નીને ભરમાવે છે, માટે આની સામે રક્ષણ મળવું જોઈએ.’

સુરદાસ આટલું બોલી જરા અટક્યો, હવે જે કહેવાનું છે એના વિચારમાં એનું દિલ ભરાઈ આવ્યું, આંખમાં પાણી આવી ગયાં, આંસુ લૂછતો એ કહે છે.

‘સાંભળો સાહેબ ! કરમકી ગતિ ન્યારી. કર્મ શું કરે છે ?

‘હુર્જન હું હુર્જનતા કરતે ભી સુખ-સુવિધા વિરચાઈ,’

કરમ તેરી અજબ લીલા મેં પાઈ.

હુર્જન હુર્જનતા કરે છિતાં કર્મ એને સુખસગવડ રચી આપે છે ! વાહ કર્મ !’ તારી અજબ લીલા મને જોવા મળી. હુષ્ણને હુષ્ણતા પર સુખ શાનું મળવું જોઈએ ?

પરંતુ અહીં આચરાતી હુષ્ણતા એક ચીજ છે, અને અહીં મળતા સુખ-સાધન પાછળ કરતી પૂર્વની પુણ્યાઈ બીજી ચીજ છે.

બેને સાંકળવાની જરૂર નથી. અહીંનું આચરણ નવી ચીજ છે. એનાં કર્મનું ફળ આગળ મળશે. ત્યારે અહીંની પ્રાપ્તિ પૂર્વ કર્મને આધીન છે.

૭૦ સુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“કિંમતી આત્મવીર્ય ક્યાં ખરચાય ?” (ભાગ-૪૪)

પૂર્વના શુભ-અશુભ ભાગ્યથી અહીં સુખ-દુઃખ મળે છે, પછી ભલે અહીં જીવ સારું-ખોટું કરતો હોય. યા સારો ખોટા આચરણને અહીંના સુખ-દુખની પ્રાપ્તિ સાથે કશો સંબંધ નથી. પૂર્વનું સારું ભાગ્ય જોર કરતું હોય તો અહીં જૂઠ-ચોરી અનીતિ કસાઈંગિની આચરવા છતાં સારાં ધન-માલ મળ્યા કરે, અને પૂર્વ જનમનું નરસું ભાગ્ય બળવાન હોય તો, અહીં ધર્મનું પરોપકારનું આચરણ કરવા છતાં, દુઃખ-આપત્તિ આવે.

બ્રાહ્મણ કેમ હાર્યો ? :-

પેલા જમાદારના પુત્રની દુર્જનતા છતાં, જુઓ, એનાં પૂર્વકર્મ એને કેવો બચાવ આપે છે ! કોરટમાં કેસની સુનાવણીમાં બ્રાહ્મણીની જુબાની લેવાતાં એણે કહી દીધું કે હું મારી રાજ્યખુશીથી જમાદારના પુત્રને ત્યાં જાઉં છું, રહું છું હું ઉમરલાયક છું, મને જે ગમે તે કરવા હું સ્વતંત્ર છું.

કહો, બ્રાહ્મણીને કશી લાજ રહી ? ના, કેમકે એ અનીતિમાં માર્ગ પર હતી, ને અનીતિ આચરનારને લાજ શરમ શી ? એ અનીતિ અનુચિત આચરે છે એ જ શરમ મૂકીને. નહિતર કુળની કે વડેરાની યા લોકની શરમ પડતી હોય તો શાની એવા માર્ગ એ જાય ! કુળ-વિલિ-લોકની લજજા તો પાપથી બચાવનાર છે. બાકી ‘જેણે મૂકી લાજ, એને નાનું સરખું રાજ’, એ કહેવતના અનુસારે લજજા મૂકી દેનાર તો એક ડાકોર-રાજની માફક બાદશાહી મળી માને છે. એ કોઈથી શરમાતો નથી, તેથી હવે પાપમાં શું કામ ડરે ? શું કામ શરમાયે ?

આત્મામાં બળ છે, શક્તિ છે, એને સંયમનમાં વાપરી શકાય, અને અસંયમમાં ય વાપરી શકાય. અગર મનનું વલણ ઈન્દ્રિયોની ઉજાણી તરફ ઢળતું રહ્યું તો પછી એ અસંયમમાં રમશે; સંયમનો શું કામ વિચાર જ કરે ? એથી ઊલંઘું જેનું માનસિક વલણ એવી ઉજાણીને આત્મા માટે વિષ્યમ્યોગરૂપ સમજી એવાં વિષ્યમ્યોગ બને તેટલા ઓછા કરવા તરફ ઢળતું હોય, એ સહેજે ડગલે ને પગલે પોતાનું આત્મબળ સંયમનમાં લગાવવાનો. શું સમજ્યા ?

ઇન્દ્રિયોની ઉજાણી એ આત્મા માટે વિષ્યમ્યોગ છે, આત્માની સંયમની ચેતનાનો નાશ કરે છે.

બ્રાહ્મણીને પતિ ખોટો નથી મળ્યો, રૂઠો મળ્યો છે, પરંતુ એના મનનું વલણ ઈન્દ્રિયોની રસલહાણ લુંટવા ઉજાણી ઉજવવા તરફ હોઈ એને સંયમને ખપતું નથી, કિંમત આત્મ-શક્તિને લોકલાજ પતિનું દાક્ષિણ્યની પરવા મૂકી અ-સંયમમાં ખરચી રહી છે. પશું કરતાં કોઈ વિશેષતા છે ? માનવના ખોળિયે પશુનું દિલ રાખી પશુના ખેલ ખેલી રહી છે. એને ભાન નથી કે આ આ ખેલ કેટલા કાળ માટે ?

ખેલમાં ઈન્દ્રિયો કઈ ધરપત પામી જાય છે ? ના, કશી ધરપત નહિ, રોજ એની વિઝ્વળતા ઊભી. એ વિઝ્વળતા આજે બ્રાહ્મણીની પાસે બેશરમથી કોરટ વચ્ચે આ બોલાવી રહી છે કે ‘હું મારી રાજ્યખુશીથી જમાદારના પુત્રને ત્યાં જાઉં છું, રહું છું, હું ઉમરલાયક છું. મને જે ગમે તે કરવા હું સ્વતંત્ર છું.

બસ, બ્રાહ્મણનો બિચારાનો કેસ કાઢી નાખવામાં આવ્યો; અને હવે તો બ્રાહ્મણી રોકબંધ રહેવા-વર્તવા લાગી, વધારામાં જમાદારપુત્ર રોષમાં ચડ્યો કે ‘બ્રાહ્મણો મને કોરટમાં ઘસડ્યો ? હવે બતાવું એને.’

સ્ત્રી એટલે નદી, નીચે ઢાળ મળતાં ત્યાં ઊતરી જાય :-

સુરદાસ કહે છે ‘બોલો સજજનો ! બ્રાહ્મણનો કોઈ દોષ ? કોઈ દુર્જનતા ? હા, એક સ્ત્રીજીત પર ભરોસો મૂક્યો એટલી એની ભૂલ ગણાય. ભરોસો ન મૂક્યો હોત તો એના બીજે જવા ઉપર મન ન બગાડત, કે કોરટે ન ચડત. અજુગતું જોવા પર સમજી લેત કે ‘હાય, એમજ બને સ્ત્રી એટલે નદી, નીચો ઢાળ મળતાં એમાં ઊતરી જાય.’ આમ કરી એની ઉપેક્ષા કરત. પરંતુ આપાત્ર પર વિશ્વાસ મૂકવો એ ખતરનાક છે, ને બ્રાહ્મણો એ કરવાની ભૂલમાં જુઓ કોરટમાં કેવી હાર ખાલી. અલબત અસલમાં એના પૂર્વકર્મ કામ કરી રહ્યાં છે. અને કર્મની ગતિ ન્યારી, એથી અહીં સજજનતા રાખવા છતાં પૂર્વકર્મ એના પર આપત્તિ વરસાવે છે.

એક દિવસની વાત છે, જમાદારપુત્ર લાગ શોધતો હતો, એમાં લાગ આવ્યો. ત્યારે ખેતરમાં બ્રાહ્મણ એકલો છે, એ વખતે બ્રાહ્મણ સાથે પોતાના બે માણસો પાસે જમાદારપુત્રે રગડો મચાવરાવ્યો, અને એ બેએ બ્રાહ્મણને ભારે કૂટ્યો. એમાં એને માથા પર એવી ચોટ લાગી ગઈ કે એ મૂર્ધિત થઈને પડ્યો.

બ્રાહ્મણ સુરદાસ :-

પેલા બે જણ તો કૂટીને ભાગી ગયા, પણ પછીથી કોકને ખબર પડતાં એણે લોકને ભેળા કરી બ્રાહ્મણીને કોઈક ખબર આપી, પરંતુ એને ધણી પર કશો રાગ મમતા હતી નહિ. ઊલંઘું અહીં બ્રાહ્મણને બીજી રીતે સારું તો થઈ ગયું, પરંતુ ચોટ લાગવાના લીધે આંખનું તેજ ચાલ્યું ગયું, અંધ થઈ ગયો; બ્રાહ્મણી આંધળાને શું કામ સંભાળે ? એ ચાલી ગઈ જમાદારના પુત્રને ત્યાં, અને અંધ બ્રાહ્મણો હવે ખેતી ય શી કરે ? તે ભીખ માગતો થઈ ગયો, એજ હું અંધ બ્રાહ્મણ સુરદાસ. આજે તમારી સામે ઊભો છું કરમકી ગતિ ન્યારી, તે સજજન સજજનતા રાખે છતાં એનાં તેવાં પૂર્વકર્મ એને ક્યારેક માર ખવરાવે છે. આમ કહેતાં સુરદાસ મસ્તીથી ગાય છે,-

સજજનતા રખતા હુઆ, દેખો કભી માર ખાઈ,
કરમ તેરી અજબ લીલા મેં પાઈ.’

પ્રવાસી એને પૂછે છે ‘સુરદાસજી ! હવે તમને દુઃખ નથી લાગતું ?’
સુરદાસ ક્યા તત્ત્વજ્ઞાન પર દુઃખી નહિ ? :-

સુરદાસ કહે છે, ‘શેઠજી ! મનુષ્યનું મન છે એટલે ક્યારેક યાદ આવતાં દુઃખ તો લાગી જાય છે, પણ તે ક્ષાળવાર. તરત પાછી દાણિ પૂર્વનાં શુભ-અશુભ કર્મ પર જાય છે, ને મન સ્વસ્થતા અનુભવે છે કે ‘હોય, અહીં આપણે ગમે તેટલા સારા હોઈએ, પરંતુ ભૂતકાળનાં અશુભ કર્મનાં બંડલ ઊંચકી લાવ્યા હોઈએ, એ મિથ્યા કેમ થાય ? દુઃખ આવે એમાં તો એ બંડલ ઓછા થાય, ત્યાં મુંઝવાનું શું ? ભગવાનનાં ભજનમાં મસ્ત રહેવું, જેથી પેલી ખોટી રોદણામાં પાછા નવાં અશુભ કર્મનાં બંડલ ઊભા થતા હોય તે અટકે, અને ભગવદ્-ભજનની મસ્તિથી ભવિષ્ય માટે સારી સ્થિતિ ઊભી થાય.

બસ લ્યો, માફ કરજો આપનો બહુ સમય લીધો. “એમ કહીને સુરદાસ ભજનમાં ચંગ્યો.”

પેલો પૂછનાર પ્રવાસી વિચારમાં ચંગ્યો કે મેં પૂર્વની મુસાફરીમાં એક બેનનો પ્રસંગ સાંભળેલો તે ક્યાં અને આ પ્રસંગ ક્યાં ? મનનાં વલણ અને આત્મશક્તિના ઉપયોગ પર કેટલો મોટો આધાર છે કે એ જીવનને સીધા યા ઊંધા પાટે ચડાવી દે ! મુસાફરી લાંબી છે, તેથી લાવ, બીજા પ્રવાસીઓને એ બનેનો પ્રસંગ સંભળાવું, જેથી એમાંથી સારો બોધ પામે.’

સુરદાસે મોટી ભેટ લેવા કેમ ના પાડી ? :-

આ વિચાર કરીને પહેલાં તો સુરદાસની ભગવાન પર નિષ્ઠા જોઈ, ઘણું સહન કરેલું જોયું, અને એણે સુંદર તત્ત્વજ્ઞાન જીતે ઉતારી અહીં પીરસેલું જોઈ એના પર ખૂબ સહનુભૂતિ ઊભરાઈ એટલે સો રૂપિયાની નોટ કાઢી સુરદાસના હાથમાં મૂક્તાં કહે છે,-

‘લ્યો, આ સો રૂપિયાની નજીવી ભેટ છે, તમારે થોડી રાહત રહેશે, અને પ્રભુભજન વિશેષ નિશ્ચિન્ત પણે કરી શકશો.’

સુરદાસ આ સાંભળતાં જ ભડકે છે, કહે છે,- ‘અરે ! અરે ! આ તમે મને માયા કાં વળગાડો ? એથી તો મારું ભગવદ્-ભજન મોળું પડશે. ઉધાડો હિસાબ છે કે માયાને મહત્વ આપ્યું તો ભગવાન ગૌણ થઈ જવાના. માફ કરજો, તમે મને પહેલાં રૂપિયો આપ્યો છે એનાથી આજનાં ભોજનની ચિંતા મટી ગઈ છે, એટલે હવે બીજો એક પણ રૂપિયો ન ખપે. બાકી કાલની ચિંતા તો ઉપરવાળો

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૭૩

બેઠો છે એ કરશે. હું તો એની જ ચિંતા ન કરું કે આ માયાની ચિંતામાં પું ? લ્યો આ તમારી સો નોટ પાછી. આજના ખીસાકાતરુના જમાનામાં વળી એ સાચવવાની ચિંતામાં ભગવાન ભૂલાઈ જાય. માંડ તો ધરવાળાની ચિંતામાંથી મુક્ત થઈ ભગવાનનું ચિંતન કરવા મળ્યું છે. પાછી નવી આફીત નવી ફિકરની લપ કાં વળગાનું ?

બસ પેલા પ્રવાસીને પોતાને મળેલ ભગવદ્દિષ્ટાના જાગતા દિલ્લીનાં આલંબન અને મળેલું કર્મનું તત્ત્વજ્ઞાન, એના પર કૃતજ્ઞતા રૂપે ઘણો આગ્રહ કરી રૂપિયા સુરદાસને પકડવા હતા, જગા જ ન રહી. એને લાગ્યું કે સુરદાસની વાત સાચી ને, એ ચિંતા રહે જ, અને એમાં ભગવાન ભૂલાય.’ રૂપિયા બહુ કયવાતા મને પાછા લેવા પડ્યા.

આ પરથી વિચારવા જેવું છે કે ગરીબ સુરદાસ પાસે મફતમાં અને બહુ માન સાથે મળતા સો રૂપિયા જેવી રકમ સ્વીકારી લેવાની શું શક્તિ નહોતી ? પણ ના, એણે આત્મશક્તિનો ઉપયોગ રૂપિયા પાછા ઠેલવામાં કર્યો. કઈ શક્તિ વધુ જોરદાર ? મળે છે તો લઈ લેવાની ? કે ન લેવાની ?

કદાચ પ્રવાસીએ અભિમાનથી કચ્ચું હોત કે ‘યાગલા શું કામ થાઓ ? તમારું જરા સાંભળવા મળ્યું એના પર સો રૂપિયા જેવી રકમ આજે ભેટ કરનાર કેટલા મળે ?’

દાતાર હજુ મળે, ત્યાગી મળવા મુશ્કેલ :-

તો સુરદાસ હ્યે કલેજે કહેત કે ‘ભાઈસાહેબ ! માફ કરજો, હજુ ભેટ આપનાર દાતાર તો મળે, પણ આટલી ગરીબીમાં બહુમાન અને આગ્રહથી મળતી આવી રકમ ન લેનાર ત્યાગ કરનાર કેટલા મળે ? આ રૂપિયા અભિમાનથી નથી પાછા વાળતો, પરંતુ ભગવાનને સારી રીતે ભજવા માટે ખાસ જરૂરી છે ત્યાગ નિસ્પૃહતા અને અપરિગ્રહ; એ ટકાવવા માટે આ રૂપિયા પાછા વાળું છું.’

બોલો ત્યારે, આત્માની શક્તિ બે ય, દાનની અને ત્યાગરૂપે અસ્વીકારની. બેમાં કઈ શક્તિની અધિકતા ગણાય ? શેમાં બળ વધુ વાપરવું પડે ? દાનમાં કે ત્યાગમાં પ્રવાસીનું દાન હતું, સુરદાસને ત્યાગ હતો. બેમાં કોને વધુ આત્મબળ વાપરવું પડે ? સુરદાસને જ ને ?

એટલે જ પહેલાં જો પ્રક્રિયા કર્યો હોત,

પ્ર.- કે સુરદાસે રૂપિયા લઈ લીધા હોત તો શું ખોટું હતું ? એને માયા નહોતી રાખવી તો બીજા બિખારીઓને દઈ શકતે ને ?

૩.- તો એનો આ જ ખુલાસો હતો કે રૂપિયા લઈ લીધા પછી દાન

૭૪ લુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“કિંમતી આત્મવીર્ય ક્યાં ખરચાય ?” (ભાગ-૪૪)

કરવામાં જે આત્મબળ ચળકે એના કરતાં રૂપિયા પહેલેથી જ ન સ્વીકારવામાં વધુ ચળકે. સાધક આત્માને આ માનવભવ સાંભળામાં વધુમાં વધુ આત્મબળ ચળકાવવા માટે કિમતી મહત્વ લાગે છે.- સુરદાસ આ કિમતી અવસરને સમજે છે, તેથી એણે પહેલાં રૂપિયા સ્વીકારી ને પછી દાન દઈ દેવાનાં આત્મબળ કરતા પહેલેથી એનો ત્યાગ જ રાખવામાં આત્મબળ વધુ ચળકે છે. પહેલેથી જ ન સ્વીકારવાના વધુ આત્મબળને વિકસાવવાનું પસંદ કર્યું.

ત્યારે પ્રવાસીનું આત્મબળ આત્મવીર્ય પણ સામાન્ય નથી હો. એણે પોતાને ભગવદ્ધનિષ્ઠા માટે આલંબનરૂપે જીવનું જીગતું દાખાન્ત મળ્યું અને અટલ કર્મતત્વનો બોધ કરાવે એવું થોડી વાર માત્ર સાંભળવા મળ્યું, એ મજ્યાની જે કદર કરી એ કદર માટે પણ કૌવત જોઈએ છે, આત્મબળ જોઈએ છે. એવું ખાસ આત્મબળ ચમકાવાય, તો જ ફ્રટ કરતાંક સો રૂપિયાની નોટ જેવું આગૃહથી ધરી દેવાની કદર થાય. એ બળ ન ચમકાવવું હોય તો તો માત્ર શબ્દથી આભાર મનાય કે ‘ભાઈ ! તમે બહુ સરસ વાત કરી. તમારો આભાર માનું છું કે આવું સુંદર સંભળાયું,’ બસ, આટલું બોલવા સિવાય બીજું કશું નહિં.

જિનવાણી શી શી કદર ? :-

બોલો, તમને રોજ જિનવાણી સાંભળવામાં કાંક ને કાંક અવનવું આત્મહિતકર સાંભળવા મળે છે ને ? એની શી કદર કરો છો ? અલબત સાધુને કશું જોઈતું નથી, ખપતું નથી, પરંતુ પ્રભુની વાણીને શાસ્ત્ર જ્ઞાન તો ખપે છે ને ? જોઈએ પણ છે ને ? આજના કાળે જ્યાં જૈનોમાં જૈનધર્મનું અજ્ઞાન વર્તે છે ત્યાં જિનવાણીના પ્રચારની, જૈનધર્મના જ્ઞાનના પ્રચારની કેટલી બધી જરૂર છે ? આજની નવી જૈન પ્રજા કે જો સ્કૂલ કોલેજનું અને છાપા મેગેજિન-નોવેલોનું ખૂબ વાંચે છે અને જૈનધર્મનું અમારી પાસે સાંભળવા પણ આવતી નથી, એને જૈનધર્મનું સાંભળ્યા વિના જ એ ધર્મના અભૂત અને અશ્રદ્ધાળું રહીને ભવિષ્યમાં જૈનધર્મ ટકાવશે ? આનો કશો વિચાર છે ? તમારે એટલા ય નિયમ છે કે મારે મારા સંતાન પૂરતું પણ દર મહિને ૨-૩ રૂપિયાનું કે વરસે પ-હ રૂ.નું ધર્મનું પુસ્તક ઘરમાં વસાવવું ?

પ્ર.- એમ તો પુસ્તક વસાવતાં આશાતના થાય તો ?

ઉ.- ત્યો, આશાતનાનો ભય છે, પણ બીજી બાજુ આજના દેવ-ગુરુ ધર્મની શ્રદ્ધા અને ભૌતિકતા વિલાસપ્રિયતારૂપી ટી.બી.ના કીડા તમારા અને બીજના સંતાનોના આત્માને કોરી ખાઈ રહ્યા છે એનો કશો ભય નથી ! કે એ જીવન કેવું નાસ્તિક જેવું અને વિષયાંધ જીવશે, ને પછી મરીને ક્યાં જશે ? આ તો છોકરો ભુવનભાનું અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

૭૫

કદાચ ખાય ને અજ્ઞાં થાય તો માટે છોકરાને ખાવાનું જ બંધ કરાવવા’ જેવું છે. એમાં એ મરે કે બીજું કાંઈ થાય ? આશાતના ટાળવાના ઉપાય નથી આવડતા ? અરે ! ચાલો ને સૌ વાંચી રહે પછી કોઈને ભેટ કરી દેજો, જીહેર વાચનાલયમાં મૂકી દેજો. પછી તો ઘરમાં આશાતના નહિ ને તો બોલો પ્રતિજ્ઞા કરવી છે કે સારું ધર્મનું સાહિત્ય મારે દર મહિને દર ચાર કે છ મહિને અમુક રકમનું તો ઘરમાં લાવવું જ ? ઘરમાં હશે તો વંચાશે.

આજ નોવેલ-નવલિંકા વગેરેની હજારો નકલો ઊપડી જાય છે, ને ધર્મનાં ગ્રન્થવાળા બૂમ મારે છે કે અમારા ગ્રન્થ ખપતા નથી. પણ ક્યાંથી ખપે ? દરેક જૈન ઘરને આ નિયમ ક્યાં છે કે અમુક રકમનું ધર્મસાહિત્ય તો મારે અવશ્ય ખરીદી લાવવું ? ઘરમાં તેલ-મરચુંથી માંડીને ફરનીયર સાડી, કપડાં બૂટ ચંપલ, રેણ્યો છાપાં વગેરે બધું વસાવવાની જરૂર લાગે છે, પણ ધર્મપુસ્તક નહિ ! અને છતાં તમે જિન વાણીના રાગવાળા છો ?

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૨૦, અંક-૨, તા. ૧૧-૬-૧૯૭૧

જિનવાણીની કદરના વિવિધ માર્ગ :-

વાત એ હતી કે જિનવાણીમાં સારું સાંભળવા મળ્યું, પછી એની કદર શી કરો છો ? પેલા પ્રવાસીએ ખટ સો રૂપિયાની નોટ ધરી દીધી, કેમ ? થોડું સુંદર સાંભળવા મળ્યું એની કદર કરવા કૃતજ્ઞતા બજાવવા; જેથી સો રૂ. ખરચીને લીધેલ બોધ વારે વારે યાદ આવે.

તમે જિનવાણીમાં અદ્ભુત સાંભળવા મજ્યાની શી કદર કૃતજ્ઞતા કરો છો ? (૧) અરે ! સાંભળીને ઊઠ્યા પછી બે શબ્દનાં ફૂલ વેરતાં ય નથી આવડતા કે ‘સાહેબ ! આજે સુંદર સંભળાયું કેવા સુંદર તત્ત્વ !’ કેવી મજેની વૈરાગ્ય પ્રેરણા ! આપનો કેટલો બધો ઉપકાર !’ આટલીય કૃતજ્ઞતા બજાવતાં ન આવડે એ બીજી પૈસા ખરચીને તો શી ય કદર કરે ? (૨) ‘લાવ, કદરરૂપે પાવલી આઈ આના રૂપિયો જિનવાણીના પ્રચાર માટેના યા પાઠશાળાની પેટીમાં નાખું; કે (૩) જિનભક્તિની પેટીમાં નાખું.’ આ શાનું આવડે ? યા (૪) કદરરૂપે ‘ચાલ આજે અમુક ચીજનો ત્યાગ, કે (૫) બે બાંધી માળા ગણીશ.....,’ આવું આવું કશું ક્યાંથી આવડે ? આટલું કદરનું સાંભળીને અહીં જ પાછું સોંપી જવાના ને ? કે ઘરે લઈ જવાના ? અમલમાં ઉત્તરવાના ?

પેલા પ્રવાસીએ સારું થોડું સાંભળવા મજ્યાની કદરરૂપ સો રૂપિયાની નોટ

૭૬ ભુવનભાનું અન્સાઈક્લોપીડિયા-“જિનવાણીની શી શી કદર ?” (ભાગ-૪૪)

ધરી દીધી, પણ પછીથી સુરદાસની નિસ્પૃહતા આગળ કાંઈ ચાલ્યું નહિ, તેથી નોટ પાછી લઈ લેવી પડી. ત્યારે સુરદાસનું ય તત્ત્વજ્ઞાન કેવું ? કે માયા વધારો તો ભગવાન ભૂલાય.

હવે એ પ્રવાસીએ પોતે પૂર્વે સાંભળેલો આનાથી ઉલટો પ્રસંગ ઉબાના પ્રવાસીઓને બોધ મળે એ હેતુથી કહેવા કહે છે, ‘ભાઈઓ સાંભળજો ત્યારે, આ સુરદાસની પત્નીથી ઉલટા પવિત્ર ચારિત્રવાળી એક બેનનો પ્રસંગ, જે મેં પૂર્વે પ્રવાસમાં સાંભળેલો.

સૌના એના તરફ કાન મંડાયા, એટલે એ શરૂ કરતાં કહે છે.

પવિત્ર ચારિત્રવાળી બેનની કથા :-

એકવાર મુંબઈથી ગુજરાત તરફના પ્રવાસમાં હું હતો, ત્યાં ગાડીના ઉબામાં એક બેન ખૂણામાં ઉદાસ મોંઢે બેઠેલા જોયા. એક સ્ટેશન ગયું, બીજું ગયું, હું જોતો જ રહ્યો તો બેનને મુખ પર ભારે ગ્લાનિ નિરાશા-ચિંતા જ દેખાયા કર્યા. માનું દિલ જરા લાગણી વશ, તેથી મારાથી એનું દુઃખ જોયું ન ગયું. મારા મનને થયું કે ‘આ બેનને એવું તે શું દુઃખ હશે ? કોઈ આપત્તિ હશે ? મારાથી એમાં કોઈ રીતે સહાયક થઈ શકાય એવું હશે ? લાવ ત્યારે પૂછવા જ દે,’ એમ બહુ વિચાર કરી મેં પૂછ્યું,-

‘બેન ! કાંઈ ગમગીન છો !

બેન બોલ્યા ‘હા ભાઈ ! આ જગતનાં જીવનમાં ગમગીની ક્યાં મોંઘી છે ?’
પ્રવાસી પૂછે છે ‘આપને શું દુઃખ છે ? હરકત ન હોય તો કહેશો ?’

બેન પોતાનું દુઃખ સંભારી જરા ઉકળ્યા, ‘દુઃખ ? જ્યાં પતિ જ ન ઓળખે ત્યાં દુઃખનું શું પૂછ્યું ? આ જગતમાં કોનો ભરોસો કરવો ? માણસને સ્વાર્થમાં અંધતા કેટલી બધી આવી ગઈ છે કે વિશ્વાસ દીધેલાને છેહ દેતાં આંચકો જ નહિ ?’

કોણ કોને ભૂલે છે ?:-

મેં કહ્યું, “બેન ! પતિ ન ઓળખે એ આશ્ર્ય છે. પરંતુ આ જગત જ વિચિત્ર છે એમાં આશ્ર્ય શું માનવું ? આજે એવું બને છે કે (૧) છોકરા મોટા થાય, પગભર થાય એટલે માબાપને ઓળખતા નથી. (૨) નોકરને એકદી એકથી શીખવાડી હોશિયાર કર્યો બજારમાં જ્ઞાણીઓ કર્યો, પછી એ શેઠની સામે જ જુદું માંડી શેઠને જ્ઞાણો ઓળખતો જ નથી. (૩) કોઈની ભીડમાં કોઈ ઉદાર માણસે પૈસા આપી એને બજારમાં ઉલ્લો રાખ્યો હોય, ભીડ ભાંગી હોય, પણ પછી અવસર આવ્યે પેલા મદદકર્તને જરૂર પડી હોય ત્યારે આ જાણો એને ઓળખતો જ

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૭૭

નથી....આવું આવું બને છે ખેર, પણ તમારે શું હકીકત બની છે, એ જો હરકત ન હોય તો કહો; કદાચ તમને મદદરૂપ થવા મને તક મળે !

મારાં આશ્વાસન પર એ બેન કહે,-

‘જુઓ ભાઈ ! વાત એમ બની કે હું સારા ધરની દીકરી, મને અમુક જગાએ ઘર સારું જાણી પરણાવવામાં આવી. થોડા વખત પછી મારા સસરા ગુજરી ગયા. મારા પતિને ધંધો બરાબર ન ચાલ્યો એટલે એ ધંધા માટે મુંબઈ ગયા, પણ ૧-૨ વર્ષ સુધી એક પૈસો ન મોકલ્યો. ઘરે હું મારી બે નાનકી દીકરી અને સાસુ; અમે અમુક વખત સુધી તો કરકસર કરી રીતે ચલાયું. મનમાં સમજા કે મુંબઈમાં હજુ ધંધો નહિ લાગ્યો હોય તેથી શી રીતે પૈસા મોકલે ?

એમાં વરસ બે વરસ નીકળી ગયા. શરૂ શરૂમાં મારી સાસુ ઉપર ૨-૩ કાગળ આવ્યા પરંતુ પછીથી તો એ પણ બંધ થઈ ગયા. મેં પત્રો લાગ્યા પણ કશો જવાબ નહિ. ત્યારે અમને થયું કે કાંક શું અકસ્માત જેવું તો નહિ બન્યું હોય ? મુંબઈ મોટું શહેર છે, કોને ખબર એમાં ક્યારે કોને શું બને ?’

પરંતુ એવામાં મુંબઈથી એક ભાઈ આવ્યા, એમની પાસે જઈ પતિના સમાચાર પૂછ્યા, તો એમણે અમને વાત કરી કે, એમને ધંધો સારો ચાલે છે, અને તબીયત પણ મજામાં છે,’ ત્યારે જરા ધરપત વળી. પરંતુ અમારા ધરની વાત અમે જાણીએ, પેલા ભાઈને અમારે શું કહેવાનું હોય કે ‘તો પછી પત્રોના જવાબ કેમ નહિ ?’

એ સમાચાર પછી મારી સાસુ મને કહે ‘આ દીકરાને શું થઈ ગયું છે કે એ સારું કમાય છે છતાં થોડાય પૈસા મોકલતો નથી ને પત્ર પણ લખતો નથી ?’

પ્રતિકૂલ વાતમાં સમાધાનવૃત્તિ :-

મેં કહ્યું દૂર બેઠા આપણને શી ખબર પડે ? પરંતુ તમે ચિંતા કરશો નહિ, ધંધામાં બહુ વ્યત્રતા હોય તેથી કાગળ ન લખી શક્યા હોય; અને પૈસાનું કામ તો એવું છે ને કે ધંધો શરૂ કર્યા પછી ધંધાને જમાવવા માટે એમાં કમાણી થતી જાય એ રોકવી પડતી હોય, એવું કાંઈક હોય તેથી પૈસા ન મોકલી શક્યા હોય. થોડો વખત ધીરજ ધરવાની. ભગવાન સારું કરશે. હું બેઠી દું તમારે લેશ પણ ચિંતા કરવાની નહિ; જરૂર પડ્યે મને રોટલો કમાતાં આવડે છે.’

દુઃખ કોનું વધારે ? :-

માતાનું દિલ છોકરાના આવા વર્તાવ પર હતાશ થઈ જાય, પરંતુ એમને તો થોડી જિંદગી કાઢવાની, ત્યારે મારે તો હજુ પરણાને પાંચ વરસ જ થયા, ઊંભર માત્ર ૨૩ વરસની; ત્યાં પતિ જો વિમુખ જ થઈ બેસે તો મારે તો જિંદગીનો

૭૮ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“જિનવાણીની શી શી કદર ?” (ભાગ-૪૪)

મોટો ભાગ કાઢવાનો, ત્યાં મારું અને નાની બે બેબીઓનું શું થાય ? એ ચિંતા પર હૈયે દુઃખ ઘણું. છતાં સાસુના દિલના દુઃખને હું વિશેષ સમજતી; કેમકે જેણે ૨૦-૨૦ વરસ સુધી પાળી પોશીને દીકરાને મોટો કર્યો, અને જો આ રીતે દીકરા તરફથી છેહ મલતો હોય, હવે કશી સંભાળ ન મળવાની હોય, તો દિલના કેવા ટૂકડા થઈ જાય ? મેં કાંઈ પતિ ઉપર ઉપકાર કર્યો નથી એટલે મને કદાચ ન સંભાલે, પરંતુ માતાનો તો અપરંપાર ઉપકાર, અના બદલામાં જો અને પુત્ર તરફથી છેહ દેવાતો હોય તો અના દિલને પારાવાર દુઃખ હોય. એની સામે મારું દુઃખ શી વિસાતમાં છે ? બસ, મારું દુઃખ ભૂલી મારાં કશાં રોદણાં ન ગાતાં સાસુના દિલને શાંતિ કેમ મળે એ જ હું જોતી અને ધરપત આપતી કે થોડી ધીરજ ધરો.'

પ્રવાસી કહે છે જુઓ ભાઈઓ ! આપણાને આ સુરદાસની પત્નીનો હેવાલ સાંભળવા મજ્યો હતો, અને આ પણ એક પત્નીની હકીકત જોવા મળે છે; કેટલો બધો ફરક છે ? આ બાઈ આવી કટોકટીમાં સાસુને ટોંશા નથી મારતી કે લ્યો મને લાવીને નાખી આવા ઘરમાં આવા ઉત્તાર જેવા તમારા દીકરા સાથે પરણાવીને મારી જિંદગી ધૂળધાડી કરી નાખી.' ના, આવાં કશાં ટોણાં-મેણાં નહિ, પણ ઊલદું સાસુને એ આશાસન આપે છે કે હું બેઠી છું, તમારે ચિંતા કરવી નહિ.

ભાઈને નવી આપદા :-

પ્રવાસી આગળ વધતાં કહે છે, પછી તો એ સાસુ-વહુ દિવસો ગુજરતા હતા, મુંબઈ પત્ર પણ લખતા હતા છતાં કશો જવાબ મળતો નહિ. એ બેનજા શબ્દમાં કહું બેન કહે છે, 'હવે મારી ધીરજ ખૂટવા લાગી, ત્યારે બાજુમાં એક ભાઈ રહે, સુખી અને સહાનુભૂતિવાળા તેમ મીઠા સ્વભાવના, મેં એમને વાત કરી;-

'જુઓને આ ૩-૩ વરસ થયા, તમારા ભાઈ મુંબઈ ગયા છે પણ કશો પત્ર નહિ કે એક પૈસો ય મોકલતા નથી ધર કેવી રીતે ચાલે ? તેમે તમારા કોઈ ઓળખીતા મુંબઈ રહેતા હોય એની પાસે તપાસ કરાવો નહિ ?'

પેલા ભાઈ સહાનુભૂતિ દેખાડતાં કહે છે 'એમ છે ? ઓછો તમારે કેટલી બધી આપદા ? મને કેમ આટલા વખત સુધી કહું નહિ ? ચાલો, ફિકર ન કરો, હું તપાસ કરાનું છું, અને તમારે પૈસા વિના તંગી તો ઘણી જ પડતી હશે; તો લો આ બસો રૂપિયા લઈ જાઓ; હું અને તેમે બે જ જાણીએ. મારે કોઈને વાત કરવાની છે નહિ એટલે વાત બહાર નહિ જાય તેથી સંકોચ ન રાખશો.'

બેન કહે 'મારાથી એમ પારકા પૈસા કેમ લેવાય ?'

ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-'પ્રવચન મહોદધિ-કખાય રોકો: ધૂટવાનો મોકો' (ભાગ-૪૪)

પેલો પાડોશી કહે,-'સંકોચ ન રાખો. આ પૈસા સમજો તમારા જ પુણ્યના ઘરમાં આવી પડ્યા હશે. માટે લઈ જાઓ. દુઃખી ન થશો; તમને એમ લાગતું હોય તો પછી અવસરે સગવડ થયે પાછા આપજો,' બેન કહી રહી છે,-' ભાઈનો બહુ આગ્રહ થવાથી અને ઘરખર્યમાં ભારે તંગી હોવાથી મેં પૈસા લીધા. પરંતુ મને શી ખબર કે આની પાછળ એ ભાઈની દાનત ખોટી હશે. એ ભાઈ અવરનવર ખબર પૂછવા આવતા કે 'કેમ ! મુંબઈથી કાંઈ કાગળ આવ્યો ?'

'હું એમને કહેતી કે 'ના, કશો કાગળ નથી, પરંતુ તમે તપાસ કરાવી કે નહિ ?' ત્યારે ભાઈ કહેતા કે મેં તપાસ તો કરાવી છે, પણ હજુ કશા સમાચાર નથી.'

આમ વાતચીતમાં એક વાર એ કહે 'હજુ ય કોઈ પત્રો નથી ? ?અરેરે ! આ તમારી નાની ઉમરમાં તમારે કેટલું દુઃખ ? છતાં ફિકર ન કરશો ભગવાન મને બહુ આપે છે; અને એ ય તમારા જેવાના પુણ્ય-પ્રતાપે તો લ્યો આ સો રૂપિયા, ખરચમાં વાપરજો.'

મેં કહું, 'ના, એમ પારકા પૈસા વારેવારે ન લેવાય.'

પાડોશીના દિલનું પાપ :-

ત્યારે ભાઈ કહે, આ કાંઈ પારકા પૈસા નથી. તો શું કામ ન લેવાય ? મને તમે પારકો ગણશો નહિ; કોણ જાણો મને તમારા પર બહુ લાગણી થઈ આવે છે. મને એમ થાય છે કે પૈસાનું દુઃખ તો ઠીક, પરંતુ આ ભીલતી યુવાની, ને પતિ ઉ-ઉ વરસથી પરદેશ પડ્યો રહે. તમારે દિવસરાત શી રીતે જાય ? એટલે મને એમ થાય કે મારે તો તમારા બંને દુઃખ ભાંગવા છે; જરાય મનમાં ચિંતા ન કરશો.'

પ્રવાસી કહે,- બસ, બેન અહીં મને કહે છે 'ભાઈ ! તરત હું એના એ બોલ પર થીજુ ગઈ ! એના પેટનું પાપ સમજી ગઈ, મને લાગ્યું કે એ પૈસા કેમ આપે છે ? મારે યુવાની છે, અને પૈસાની જરૂર છે. એનો આ લાભ ઉઠાવવા માંગે છે. એમાં જો હવે જરાય હું પૈસાના લોભમાં પડી તો શીલ ગુમાવીશ. પાપના ઉદ્યે એક તો સ્ત્રીનો અવતાર મળે, એમાં વળી જો શીલ ભંગનું મહા પાપ કર્યું તો તો કોહેલી છાશને ઉકરે ઢોળી, પછી કોહવાટમાં શું બાકી રહે ? એક જ વાર જો આચારનો ભંગ કર્યો તો ઈંડ્રિયોનો એ હરામ ચસકો એવો લાગે કે પછી અનાચારની પરંપરા ચાલે.

મેં તરત હથ જોડી એ ભાઈને મક્કમ અવાજે કહું, - મોટા ભાઈ ! આ તમે શું બોલ્યા ? માફ કરો મારે તમારા રૂપિયા નથી જોઈતા, અને તમારું આશાસને ય નથી

૮૦ ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-'જિનવાણીની શી શી કદર ?'" (ભાગ-૪૪)

જોઈનું. જુઓ પધારો, મહેરબાની કરી ફરીથી અહીં આવશો નહિ, નહિતર મારે એર ખાવું પડશો.’

મારાં સહૃભાગ્ય કે આ મારા મક્કમ અવાજે ભાઈ ઉધાઈ ગયા. સમજુ ગયા, બોલ્યા ‘હશે ભલે હું નહિ આવું તમારે જ્યારે જરૂર લાગે ત્યારે મને કહેજો પૈસા લઈ જજો.’ એમ કહીને ભાઈ ચાલ્યા ગયા, ફરીથી હજુ સુધી મારે ત્યાં એ આવ્યા નથી, મેં ભગવાનનો પાડ માન્યો કે મને મોટા નરકાગારના પતનમાંથી બચાવી.

પેલો પ્રવાસી કહે ‘ભાઈઓ ! જુઓ આ બાઈ ક્યાં જઈ રહી છે ? અને આ સુરદાસજીની પત્ની શું કરી રહી હતી ? સુરદાસની પત્નીને ખાવાપીવા તથા સંસારસુખનો કશો તોટો નહોતો, છતાં એ બાઈ વહી ગઈ. ત્યારે આ બેને, જોયું ને ? પતિ તરફથી ૩-૩ વરસથી કોઈ સંદેશો નથી, ખાનપાનની તંગી છે, તો પણ પૈસા ખાતરે ય આચાર લોપવાની વાત નહિ. બેઉનાં મન કેવી જુદી દિશામાં કામ કરી રહ્યા છે ? અને બંનેને મળેલી આત્મશક્તિ કેવા સામસામા માર્ગે ખરચાઈ રહી છે ? એકને એનાથી યથેચ્છ રંગરાગ જેલવા છે, બીજને આત્મશક્તિથી શીલનાં જતન કરવાં છે. અસ્તુ.

પેલા બેન કહે, પછી તો મને ઘર કેમ નભાવવું એની ચિંતા વધી ગઈ. તેથી મેં સાસુને કહું, ‘હું જ મુંબઈ જઈ આવું. બીજાની શી આશા કે એ તપાસ કરે હું જાતે જ જાઉ અને જોઉ શા હાલ છે, કેમ પત્ર નથી લખતા, કેમ પૈસા મોકલતા નથી ?’ સાસુએ દુભાતે મને રજા આપી. આ એમ કરીને હું મુંબઈ આવી જુના સરનામે જઈને તપાસ કરી તો જાણવા મળ્યું કે એ હમણાં ઘર બદલી દરિયા કિનારે બ્લોકમાં રહેવા ગયા છે. મેં ત્યાંનું સરનામું લીધું; લઈને હું ત્યાં પહોંચી,

કલ્યાન બહારની સંસારની દુઃખદ ઘટના :-

બેનના આ બ્યાન ઉપર સંસારની ઘટનાઓ વિચારવા જેવી છે. માબાપે કન્યાને પરણાવી હોય ત્યારે એમની અને કન્યાની કલ્યાનામાં ય ન હોય એવું બને છે ને ? ધણીને ટી.બી. અગર એવો કોઈ રોગ આવી જાય, યા અક્ષમાતમાં ફસાઈ જાય, અને પડી જાય એમ બને ને ? અથવા પત્ની અંગે એવું કશું દેખી-સાંભળી કલ્યાનામાં ચડી પત્ની પર અભાવવાળો થઈ જાય, યા સાસુ જ એવી વઢકણી દ્યુર્ઘાટો ગુર્સાખોર હોય અને છોકરો દબાઈ જતો હોય, કે એના પક્ષમાં જ ઉભો રહેતો હોય, યા જેઠ-દિયરિયા, જેઠાણી-દેરાણી, નણંદ વગેર તુમાખી મળ્યાથી રોજ હૈથૈ શેકણાં રહેતા હોય, આવું બધું બને ને ? ત્યારે ત્યાં પરણાવેલી કન્યાની દશા કેવી ? ગઈ તો બિચારી સંસારનાં સુખ-લહાવા લેવા, પણ ત્યાં જવાળામુખીના ઉના લાવારસ જેવા રંડાપા યા તિરસ્કાર, ટોણાં-મેણાં, મારપીટ

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

વગેરે લમણો લાગ્યા. એકને એક, તો બીજને બીજું આપદા લગભગ લાગેલી જ દેખાય છે. પરણા એ પહેલાં આની કશી કલ્યાન નહિ, ઊલંઘું સારાં સારાં સુખવિલાસ મળશે એની જ ધારણા, છતાં આજનો સંસાર શું દેખાડે છે ?

આજના રગડાનું નથી કારણ :-

પ્ર.- આજ ધેર ધેર માટીના ચૂલા કેમ દેખાય છે ? લગભગ મોટા ભાગના ઘરોમાં રગડા ઝગડા શાથી ? મન વાતવાતમાં ઊંચા નીચા કેમ ?

૩.- એનું કારણ આજની માનવજીતનો મોટો ભાગ સત્તવહીન બની ગયેલ છે. એનું કારણ આજનો ફાલેલો ફૂલેલો નર્યો ભૌતિકવાદ અને વિલાસવાદ છે. જ્યાં આત્માનો વિચાર જ નથી, ને એકલા જડ સુખો જડ વિષયો જેટલા મળે એટલા ઊંચામાં ઊંચા મેળવી અને ભોગવી લેવાની જ લંપટતા છે, ત્યાં પછી સત્ત્વ સાત્ત્વિકતા ઊભી ન રહે, સત્ત્વહીનતા જ આવે. સત્ત્વહીન માણસો તામસી પ્રકૃતિમાં રાચતા હોય, એ સહેજ સહેજ પ્રતિકૂળ બનતાં ખળભળી ઊંઠે, રગડો માંડે, ઝગડો માંડે, એમાં નવાઈ નથી. વિષયલંપટ માણસોને સહેજ અધિક વિષય-સુખ ગમે ત્યાં મળે છે ? ગમે તે રીતે મળે છે ? બસ, ધન-વિષય-લંપટોને ન્યાય-અન્યાય, આચાર-અનાચાર કશું જોવાનું સત્ત્વ જ નહિ, તે નિઃસત્ત્વ માણસો એ અન્યાય રગડા માંડવાના.

‘આ જે બોલું-ચાલું, ખાઉં-પીઉં, એ મારી આચાર-મર્યાદામાં છે ?’ આટલું જોવા માટે પણ સત્ત્વ જોઈએ છે, પછી આચારને પકડી રાખવા અને આચારબાધ્યનું છોડવા માટે તો વળી વિશેષ સત્ત્વ જોઈએ, ત્યારે આજે જુઓ અભક્ષયભક્ષણ અને રાત્રિ ભોજન કેટકેટલાં ચાલી પડ્યા છે ? જૈન બચ્યો અભક્ષય કંદમૂળ બટાટા ખાય ? જેના પરમાત્મા વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાન એકલાએ જ એકેન્દ્રિય જીવોનો વિસ્તાર બતાયો, એમાં વળી નિગોદ અનંતકાય કંદમૂળ લીલકૂળ વગેરેમાં કણે કણે અનંતાનંત જીવો બતાવ્યા એવા પરમાત્માના ભક્ત જૈન બચ્યાને ગૌરવ નથી કે ‘હું જિનનો સેવક, એવા અનંતાનંત જીવોના ભક્ષણ ન જ કરું, હું મહાપાપનાં સ્થાનભૂત રાત્રિભોજન ન જ કરું આ ગૌરવ નહિ, એટલે સત્ત્વ નહિ. પછી ‘અજ્ઞાન મૂઢ હુનિયા કેમ વર્તે છે ?’ બસ, એ જોઈને એની પૂંઠે ઘેટાનાં ટોળાની જેમ ચાલવું છે. નહિતર જગતમાં ઉચ્ચ સ્થાનને પામેલી જૈન શ્રાવિકા બેનો ગણિકા જેવા પહેરવેશ પહેરે ? બજાર વચ્ચે અંગોપાંગનાં પ્રદર્શન કરે ? અરે ! વીતરાગ પ્રભુનાં પવિત્ર મંદિરોમાં આ ચાળા કરે ? પણ જ્યાં જિનેશ્વરદેવ અને સત્ત્વ ઓસરી ગયાં, નષ્ટ થઈ ગયા, ત્યાં ગૌરવહીન કંગાળ નિઃસત્ત્વ જીવો સુંદર આચાર-મર્યાદા પાલનનો વિચાર-સરખો પણ ક્યાંથી કરી શકે ?

૮૨ જુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“જિનવાણીની શી શી કદર ?” (ભાગ-૪૪)

ધર્મમાં ભય, સંસારમાં નહિ, તો ધર્મ પોતાનો કે સંસાર ? :-

પરંતુ આ તો હકીકત થઈ. આના પરથી સંસારને ઓળખી રાખવો છે ? આજના સંસારની બેહૂટી કે ગલીય ઘટનાઓ જોઈ હૈયામાંથી સંસારના પક્ષપાત મૂકવા છે ? ધર્મના પાકા પક્ષપાત ધરવા છે ? ધર્મની વાત આવે ત્યા પહેલેથી જ ભયની વાતો કરો છો, અને દીકરા દીકરીને પરણાવવાની વાત આવે તો પહેલાં કહું તેમ બહાર દુનિયામાં પરણ્યા પછી અનેક વિટંબણાઓ દેખાવા છતાં, કોઈ ભયની વાત નથી કે ‘આ દીકરાને પરણાવું પણ કન્યા માથાભારે મળી તો ? અને જ પજવશે તો ?’ અગર દીકરીને પરણાવું પણ પછી અને એક યા બીજી આપદાએ હૈયા શેકડાં ઉભાં થયા તો ?’ ના, આ કોઈ ભય નથી રાખવો. એ તો જાતે કે દીકરા-દીકરીએ તપસ્યા કરવાની વાત આવે, દાન કરવાની વાત આવે, ધર્મ કિયા કરવાની વાત આવે, દીકરાની વાત આવે, ત્યા પહેલેથી ભયનો હાઉ ઉભો કરવો છે કે ‘આ કરવા જતાં આમ બગડે તો ? તપ કરતાં શરીર નરમ પડી જાય તો ? બીજું બગડે તો તો ? આવા આવા ભય ધર્મની વાત વખતે આગળ કરવા છે, ને સંસારની વાતમાં નહિ, ત્યારે વિચારવું પડે કે ધર્મ પોતાનો, કે સંસાર પોતાનો ? પક્ષપાત ધર્મનો કે સંસારનો ?

‘ધર્મને ને મારે શું લાગે વળગે છે ?’ એ ખૂબ વિચારવા જેવું છે. વિચારીને અહીં જ ધર્મ સાથે સગાઈ ધર્મનો પક્ષપાત ઉભો કરવા જેવો છે, પછી ભાવના વાયદે ન મૂકાય. ને એ સંસારનો પક્ષપાત પડતો મૂક્યાથી જ ધર્મનો પક્ષપાત ઉભો થાય, એ પણ સમજ રાખવાનું. સંસારનો પક્ષપાત મૂકી ધર્મનો પક્ષપાત ધર્યા વિના તો ધર્મ થઈ તો જાય, પણ એથી ધર્મ સાથે લાગતું વળગતું યાને સગાઈ ન ગણાયં ત્યાં તો સંસારની એવી કોઈ વાત આવતાં ધર્મને રજણતો મૂકાય છે.

ધિંધાઈ બીજાની આપદામાં મન વળાવે છે :-

સંસારનો પક્ષપાત સંસાર પરથી આસ્થા બહુમાન ઉઠાડી મૂકવા માટે. પેલી બેન જેવી કેટલીય ઘટનાઓ આજે નજર સામે જોવા મળે છે, સાંભળવા મળે છે. આ જોવા-સાંભળવા મળ્યા પછી પણ હૈયું ધિંધું નઠોર રાખવું છે ? ‘હોય ભાઈ ! સંસાર છે એટલે બધું ય હોય,’ એમ મન વાળી સંસારમાં ભૂંડની જેમ રાચ્યા રહેવું છે ? બીજાનું દુઃખ હોય ત્યાં તો મન વાયું, પણ પોતાની ઉપર આપદા એવી આવી પડે તો કેમ ઉંચા નીચા થવાય છે ? કેમ હાય ને વોય કરાય ભુવનભાનુ અન્સાઈકલોપીયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : દૂદવાનો મોકો”(ભાગ-૪૪) ૮૩

છે ? મન વાળી દોને કે ‘હોય, સંસારમાં આજ જ ચાલે ?’ હૈયાની ધિંધાઈ છે નહિતર બીજાની આપદાઓ જોઈ મન વાળવાનું ન થાય.

પેલી બેનના પર કેવી આપદા ? ધણી મુંબઈ ગયો, ૩-૩ વરસથી સામે જોતા નથી, પેસો મોકલતો નથી, છતાં બેન ધીરજ ધરી રહી હતી, અને સાસુને આશ્વાસન દઈ રહી હતી ? માતાને આશ્વાસન દીકરાનું કે દીકરાની વહુનું ? વહુઓ તો સાસુના માથે છાણાં થાપનારી જોવામાં આવે છે. પણ કહોને,

પ્ર.- એ તો ધણીના જોર પર. અહીં ધણીનું ટેકાણું નથી એટલે સાસુના માથે શી રીતે છાણાં થાપે ?

૬.- એટલે તમારો સંસાર આવો જ ને કે ધણીના જોર પર વહુરો સાસુને કનદે ? ને એવી સ્થિતિ ઉભી થવાની આજે મોટી સંભાવના છતાં દીકરાને માટે હોંશે હોંશે એવી વહુ લાવો છો ? ખરે, પણ ધણીનું જોર ન હોય ત્યાં વહુ સાસુને શાંતિ-આશ્વાસન આપનારી હોય એવા દાખલા ય જુજ. એવા જુજ દાખલામાંની આ બેન સાસુને આશ્વાસન આપતી તે એ સમજ્ઞને કે મેં કાંઈ ધણી પર ઉપકાર નથી કર્યો તેથી એ મને ન સંભાળે અનું એટલું દુઃખ ન કરાય, પરંતુ આ માતાએ તો ગર્ભથી માંડીને ૨૦-૨૦ વરસ સુધી આ દીકરાની સેવા કરી, એવા આ મહાન ઉપકારની સામે દીકરો હવે સામું ય ન જુઓ, અનું માતાને અપરંપાર દુઃખ હોય તો મારે એવા દુઃખિત દિલવાળા સાસુને ખાસ શાન્તિ દેવી જ પડે, આશ્વાસન આપવું જ પડે, મારાં દુઃખમાં ધીરજ ધરવી જ પડે.

કેટલો વિવેક છે ? સામાન્ય રીતે માણસને પોતાનું નાનું પણ દુઃખ મોટું લાગે છે, ને બીજાનું મોટું ય દુઃખ નાનું અગર નહિવત્ત લાગે છે, ધરોમાં જુઓને, બાઈને ત્રાણ ડીન્હી તાવ હશે તો ભાઈ કહેશે ‘શાંતિ રાખો, ઉતરી જશો.’ પણ ભાઈને પોતાને જો અડવી ડીન્હી ય તાવ આવ્યો તો ધમાધમ કરી મૂકશે. જ્યાં સગી સ્ત્રી અંગે ય આમ બને તો પછી પારક માણસના દુઃખ અંગે પૂછવાનું જ શું ? દિલ સાંકડા છે; એવા સાંકડા દિલમાં પોતાનાં સુખ-દુઃખ જગા લઈ લે પછી બીજાનાં સુખ-દુઃખ માટે એટલી જગા જ રહેતી નથી,

એ તો દિલ પહોળા વિશાળ હોય ત્યારે એમાં બીજાનાં સુખ-દુઃખ સમાય.

દિલમાં સુખ-દુઃખ સમાવાનો અર્થ :-

દિલમાં બીજાનાં સુખ-દુઃખ સમાવાનો અર્થ શો ? આ જ કે જેવી રીતે આપણાં સુખ દુઃખ સમાય છે તો દિલ સુખ માટે તલસાટ-આનંદ-અનુમોદના અનુભવે છે, અને દુઃખ પ્રત્યે નીસાસા-બેદ-ગભરામણ અનુભવે છે, એવી રીતે બીજાનું સુખ અંગે તલસાટ-આનંદ-અનુમોદના અને બીજાનાં દુઃખ અંગે નીસાસા-

૮૪ જુવનભાનુ અન્સાઈકલોપીયા-“જિનવાણીની શી શી કદર ?” (ભાગ-૪૪)

બેદ ગભરાટ અનુભાય. આ જો થાય તો પરનાં સુખ-હુઃખ આપણાં દિલમાં સમાયા ગણાય. હવે અંદરમાં પૂછી જુઓ કે પરનાં સુખ-હુઃખ આ રીતે દિલમાં સમાય છે ખરા ? શું બીજાનાં સુખનો તલસાટ-આનંદ રહે છે ? ‘કેમ બીજ જીવો સુખ પામે,’ એવી ધીખતી ભાવના એ તલસાટ; અને બીજાને સુખ પામેલા જોઈ હૈયે બેદ ન થાય કે ‘આને કેમ આ સુખ મળ્યું ?’ કિન્તુ હરખ થાય, ‘હાશ !’ થાય કે ‘સારું થયું આને સુખ મળ્યું ;’ કેમકે વહાલા સગા ભાઈને સુખ પામેલો જોઈ આનંદ થાય છે. બીજાનાં સુખ પ્રત્યે આ તલસાટ-આનંદ થતો હોય, તો મનાય કે એ આપણા હૈયામાં આપણાં દિલમાં એ સમાયો.

એવી રીતે બીજાનું હુઃખ દિલમાં ઉકળાટ થાય, બેદ થાય કે ‘અરેરે ! આ બિચારાને હુઃખ ક્યાં આવ્યું ?’ પછી ત્યાં હિસાબ નહિ કે ‘સામો આપણો વિરોધી નથી ને ? દુશ્મન નથી ને ? અભિમાન શ્રીમંત યા બીજાને પજવનારો નથી ને ? તો જ એના હુઃખ પર બેદ કરવાનો નહિતર નહિ ;’- આવો બેદ પાડનારો હિસાબ ન માંડી મૂક્યો હોય; એમ વિના બેદ પાડનારો હિસાબ ન માંડી મૂક્યો હોય; એમ અભિમાન હો, યા બીજાને પજવનારો હો, પરંતુ એને હુઃખ આવ્યું તો એના માટે પણ દિલમાં બેદ થાય.

દુશ્મન કે એવા અનાડી જીવનાં હુઃખ પર પણ બેદ જરૂરી છે. નહિતર એમાં ખુશી થવાનો તામસભાવ આવે.

દા.ત. બિલાડી ઉપરથી પડી, ઘવાઈ, હવે જો મનને એમ બેદ ન થાય કે ‘અરેરે ! બિચારાને ખૂબ વાગ્યું, તો દિલમાં આનંદ ધૂસી જશો કે ‘હાશ ! હત્યારીને ઢીક વાગ્યું : યા સારું થયું મરી.’ તો શું આ ભાવ સારો છે ? ના, એ ગમે તેવી પાપી છે, પણ આપણે એ હુઃખી થઈ એમાં રાજી થયા ત્યાં આપણું હદ્ય દિલ નિષ્ઠુર તામસી બન્યું.

કોઈનાય હુઃખે રાજી થવું એ નિષ્ઠુરતા છે, તામસભાવ છે.

ગુણો નિષ્ઠુર દિલમાં ન આવે, કોમળ દિલમાં આવે. માટીનો પિંડો કોમળ હોય તો જ એના પર નવનવા ઘાટ ઉતરી શકે છે.

પ્ર.- તો ભલે એવા કૂર જીવોનાં હુઃખ પર રાજ્યપો કરીએ; પછી એનાં હુઃખ પર બેદ ન થાય તો તો વાંધો નહિ ને ?

ઉ.- પ્રશ્ન મજેનો છે. અહીં એક વસ્તુ ખાસ સમજવા જેવી છે કે

આપણે વીતરાગ નથી, તેથી આપણાં ઉપયોગવાળા દર્શન શ્રવણાદિ કે સ્મરણ પ્રાય: રાગ યા દ્વેષથી મિશ્રિત હોય છે.

રસ્તે ચાલ્યા જતાં પાકી સરક કે ધૂળ વગેરે દેખાતા હોય છે, પરંતુ એનાં

દર્શનમાં આપણાં ચિત્તનો ખાસ ઉપયોગ નહિ, એટલે એ રાગ કે દ્વેષ કર્યા વિના એ જ ચાલ્યું જાય છે. બાકી ઉપયોગવાળાં દર્શન તપાસો, એમાં કાં રાગ કે કાં દ્વેષ ભળેલો દેખાશે એટલે હવે જો કૂર ગ્રાણીના હુઃખ પર બેદ-દ્વેષ નથી કરવો, તો રાગ-રાજ્યપો આવીને ઊભો રહેવાનો આપણા ચિત્તનો ઉપયોગ એ તરફ ન હોય તો જુદી વાત; બાકી ઉપયોગ છે તો રાગ કે દ્વેષ ધૂસવાનો. બિલાડી ઉપરથી ધબાક પડી જોઈ, યા કૂતરાથી ફેંદાઈ જતી જોવામાં આવી, તો શું ચિત્તનો ઉપયોગ નથી ગયો ? ગયો છે. તો હવે એ દર્શન સાથે દિલમાં શું રાગ કે દ્વેષ થયા વિના રહેશે ? જો એના હુઃખ પર દ્વેષ એટલે કે બેદ નથી કરવો, તો શું રાજ્યપો આવ્યા વિના રહે ? આપણું દર્શન શું વીતરાગ દર્શન છે ?

એટલા માટે તો સમજો કે જ્ઞાનીઓએ પ્રશસ્ત રાગ-દ્વેષની વ્યવસ્થા બતાવી છે વ્યવસ્થા આ કે

જ્યાં અપ્રશસ્ત રાગ થાય છે, ત્યાં પ્રશસ્ત દ્વેષ લાવવો, અને જ્યાં અપ્રશસ્ત દ્વેષ થાય છે ત્યાં પ્રશસ્ત રાગ લાવવો,

સ્ત્રી પર ગુણાનુરાગ, સ્ત્રીશરીર પર દ્વેષ :-

દા.ત. સ્ત્રી પર અપ્રશસ્ત રાગ થાય છે કે ‘આ મને બહુ પ્રિય, કેમકે એ મને સારી સુખ-સગવડ આપે છે.’ હવે જો આ રાગથી બચવું હોય તો મૂળ પાયામાં એ સંસારસુખ અને સગવડ સ્વાર્થ પર તેમજ સ્ત્રીના શરીર પર દ્વેષ ઊભો કરવો જોઈએ. સંસારસુખ ઝેર રૂપ લાગવા જોઈએ, એ ઝેરમાં ફસાવનારું સ્ત્રી શરીર ઝેરી સાપણ જેવું લાગવું જોઈએ. જોજો આમાં સ્ત્રી ઉપર દ્વેષ નથી કરવાનો. એના પર તો એની સુશીલતા, સેવાભાવિત, ધર્મરૂપ વગેરના હિસાબે ગુણાનુરાગ રાખવાનો. પરંતુ જીવની દસ્તિ તપાસો કે ક્યાં જઈ રહી છે ? એનું શરીર જીવને વૈષ્ણિક સુખ આપી રહ્યું છે, તથા જીવનો બીજો પૌદ્રગલિક સ્વાર્થ એ સાધી આપે છે, માટે એના પર રાગ થાય છે ને ? એ રાગ કંઈ પ્રશસ્ત ગુણાનુરાગ નથી, કિન્તુ અપ્રશસ્ત કામરાગ સ્નેહરાગ છે. એ રાગ ખરેખર તો સ્ત્રીશરીર પર છે, માટે એને હટાવવા એ સુખ, સ્વાર્થ અને શરીર પર દ્વેષ જરૂરી છે.

બસ, એ જ રીતે બીજી વસ્તુઓમાં આપણાં દર્શન શ્રવણ વગેરેમાં અપ્રશસ્ત રાગ કે દ્વેષ ભળી જતા હોય ત્યાં રાગની સામે અપ્રશસ્ત દ્વેષ અને દ્વેષની સામે પ્રશસ્ત રાગ ઊભો કરી દેવાની જરૂર છે. એટલે કૂર જીવને હુઃખ આવેલું આપણને દેખાય ત્યાં રાગ રાજ્યપો થવા સંભવ છે, માટે ત્યાં એના હુઃખ પર દ્વેષ ઊભો કરવાની જરૂર છે.

પ્ર.- કૂર જીવનાં હુઃખ પર બેદ કેમ થાય ?

૩.- આપણાં દિલને સાચવવા માટે જેદ થાય. આપણે એ વખતે આ વિચારવાનું કે ‘રહે ! આનાં હુઃખ પર રજી થતાં મારો દ્યાગુણ મારી કોમળતા ઘવાય તો ? માટે દિલમાં હુઃખી પર દ્યા અખેડ રાખું.’ આમ દ્યા સાચવવા ચીવટ રહે. એ સામાનું હુઃખ અણગમતું કર્યા વિના ન બને માટે જ ત્યાં હુઃખ પર જેદ થાય.

પેલી બેન શું કરે છે ? :-

પેલી બેનને પોતાને ઓદ્ધું હુઃખ નથી, ૩-૩ વરસથી પતિ મુંબઈ ગયેલો એક પૈસો નથી મોકલતો સંસારસુખ તો ક્યાંય ગયું છતાં એ બેન સાસુના હુઃખને મોટું દેખે છે, તેથી આશાસન આપે છે કે ધીરજ રાખો. પરંતુ હવે અનાજના જ સાંસા પડવા આવ્યા એટલે પોતાની જ ધીરજ કેટલી રહે ? માટે સાસુને સમજાવી પોતે મુંબઈ ગઈ. ત્યાં જોયું તો પતિએ પહેલાનો મુકામ બદલી નાખી દરિયાકાંઠે બ્લોકમાં રહેવાનું કર્યું છે. તો એનું સરનામું લઈ પહોંચી બ્લોક પર.

પતિના બ્લોકમાં કોણા ? :-

બ્લોકની બહાર પતિના નામનું પાટિયું હતું એટલે નક્કી થયું કે અહીં જ રહેતા હશે. બહાર ધંટીની ચાવી હતી તે દબાવતાં અંદર ધંટી રણકી. સફેદ કિંમતી સાડીમાં સજ્જ એક બાઈએ આવી બારણું ખોલ્યું, મને આવકારી, હું અંદર ગઈ, કોચ પર બેસાડી પાસે એ બેઠી, મને પૂછે છે ‘કોણ તમે ? ક્યાંથી આવો છો ?’

મેં પતિનું નામ આપી પૂછ્યું ‘એ ઘરમાં નથી ? ક્યાં ગયા છે ? મારે મળવું છે. તમારે એમને શો સંબંધ ?’

પેલી બાઈ હસી પડી. એ કહે ‘મારો સંબંધ પૂછો છો ? મારા વિના એમને ગમે જ નહિ એવો મિત્રચારીનો સંબંધ છે. તમે એમને ક્યાંથી ઓળખો ?’

મારા મનને વહેમ પડ્યો, યુવાન માણસને પારકી યુવાન બાઈ સાથે મિત્રચારીનો સંબંધ કેવો ? પતિ કદાચ આના પ્રેમમાં તો નહિ પડ્યા હોય ? ખેર, હુમણાં ખબર પડશે. આણે મારી ઓળખ માગી એના જવાબ મેં કહ્યું; તમે મને સહાયક થશો ? તો હું મારી ઓળખ આપું.’

પેલી બાઈએ કહ્યું. ‘મારી શક્તિ હશે તો હું સહાય કરી શકીશ. કહો, તમે કોણ છો ?’

મેં થોડું આશાસન મળતાં કહ્યું ‘હું એમની પરણેતર પત્ની છું. ત્રણ વરસથી એ ધંધાર્થ અહીં આવેલા છે, અમે પત્રો લખેલા, પણ ન તો કોઈ જવાબ ન કોઈ પૈસા મોકલવાની વાત. હું, બે દીકરી, એને એમની માતા, ચારનો નિભાવ શાના ભુવનભાનું અન્સાઈકલોપીલિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

પર થાય ? તમે એમની સાથે મિત્રચારીનો સંબંધ ધરાવો છો તો એમને આ અંગે કાંઈ કહી ન શકો ?’

પતિ પત્નીને ઓળખતો નથી :-

બાઈ વિચારમાં પડી, એટલામાં પતિ આવી ગયા, મને જોતાં જ સાવ અજાણ્યા થઈ મને કહે છે ‘તમે કોણ છો ? કેમ અહીં ચરી ગયા છો ?’

હું તો આ સાંભળીને હેબતાઈ જ ગઈ કે ‘અરે ! આ કોણ બોલી રહ્યું છે ? જેણે લગ્ન પહેલેથી ખાનગી મળીમળીને કેવા અતૂટ જીવનસંબંધ અને અખૂટ પ્રેમના કરાર કરેલા ! એ આજે આમ બોલે છે ? ખેર ! મેં જવાબમાં કહ્યું,- ‘તમારી હું પરણેતર પત્ની તમે મને આ સવાલ પૂછો છો ?’

ત્યારે એ કહે, ‘અરે ! બાઈ તું કોઈને ગળે કાં પડે ? તું મારી પત્ની કેવી ? જ જ ઉઠ અહીંથી હું તને ઓળખતો નથી.’

ત્યાં હું પેલી બાઈ સામે જોતી હતી કે એ મારી સહાયમાં આવે. પરંતુ અહીં તો પતિએ તરત મને બહાર જ ધકેલી દઈ બ્લોકનું બારણું બંધ કરી દીધું.

સંસારનું સ્વરૂપ નિર્ગુણ, એટલે ? :-

બસ ? પતિના નામનું નહાઈ નાખવાનું ને ? પતિએ કહી દીધું ‘હું તને ઓળખતો નથી,’ અને વધુમાં પોતાના મુકામમાંથી એને ધકેલીને કાઢી મૂકી હવે કોઈ એની આશા ? આ સંસારને ઓળખી લેવા જેવો છે. કેવું છે એનું સ્વરૂપ ? નિર્ગુણ, નગુણ. નગુણો માણસ કેવો હોય ? તમે એના પર ગમે તેટલો ઉપકાર કરો એનું ગમે તેટલું સાચવો, પરંતુ એને એની કશી કિંમત નહિ, કશો ગુણ એ માને નહિ; માટે એ નગુણો પછી એના સ્વાર્થ એ તમારા પર અપકાર કરતાં સંકોચાય નહિ. સંસાર પણ આવો છે.

ગોશાળા ઉપર મહાવીરપ્રભુનો ઉપકાર હતો, સાથે ફરવા દીધો હતો, ધક્કો મારીને કાઢી નહિ મૂકેલો. આપણે કહીએ પ્રભુ તો બાબુ પ્રત્યે ઉદાસીન ભાવવાળા એટલે રાગ-દ્રેષ્ટ વિનાના હતા એથી એમને એની સામે કશું જોવાનું નહોતું. પછી એને રાખવાનું શું કે કાઢી મૂકવાનું શું ?

ના, પ્રભુ એવા ઉદાસીન નહોતા કે એના સામે કશું ન જુએ. પ્રભુએ એને વૈશ્યાપન તાપસની તેજોલેશ્યાથી બળી જતો જોયો તો કરુણાથી શીત લેશ્યા મૂકી, અને એને બચાવી લીધો હતો. એની સામે જોયું જ ન હોત તો શું કામ પોતાનું ધ્યાન મૂકી એના પર કરુણા કરવાનું કરે ? કેટલી કરુણા ? પ્રભુનું એણો શું ભલું કર્યું હતું ? શી સેવા બજાવી હતી ? કશું જ નહિ, છતાં એવા ડાંડ પર પ્રભુએ જીવનદાતાનો અનુપમ ઉપકાર કર્યો. સંસાર આવો નહિ કે આપણી સેવા પર એ

૮૮ ભુવનભાનું અન્સાઈકલોપીલિયા-“જિનવાણીની શી શી કદર ?” (ભાગ-૪૪)

ઉપકાર કરે.

પ્રભુને ગોશાળાની કશી અપેક્ષા નહિ પ્રભુ તો બીજાની કશી અપેક્ષા રાખ્યા વિના સંયમ-માર્ગનું પાલન કર્યે જતા હતા. રહેઠાજા માટે કોઈનો મુકામ યાચવાની અને કોઈનું મન વધારીને એના મકાનમાં રહેવાની વાત નહિ. એ તો ગામ નગરની બહાર ભંગાર ઉજડ મકાનમાં ઊતરતા હતા. તેમ બોજન ગોચરીમાં સીધેસીધી તિમશા નથી મળતી તો કોઈની દીનતા કરીને એ લેવાની વાત નહિ. કપું તો એ રાખતા જ નહોતા કે જેથી કડકડતા શિયાળા જેવામાં ય અંગ ઢાંકવા કોઈની આગળ વસ્ત્ર માટે યાચના કરે. ત્યારે ઉપસર્ગ-ઉપદ્રવમાં એકલું સહી લેવાનું જ એમણે રાખ્યું હતું તેથી કોઈ બચાવનારની અપેક્ષા જ નહોતી.

વિચારવા જેવું છે પ્રભુનું નિરપેક્ષ જીવન. નિરપેક્ષતા એટલે બાધ્યમાં ઠીક-અઠીકની વહેંચણ જ નહિ.

કોઈ અનુકૂળ જડ કે ચેતન દ્વારા, કોઈ અમુક અનુકૂળ ક્ષેત્ર, અનુકૂળ કાળ, કે અનુકૂળ ભાવની અપેક્ષા જ નહિ કે આવું મળે તો ઠીક. ના આ દ્રવ્યાદિ ચારેમાંથી કશાની આ ઠીક, આ અઠીક' એવી વહેંચણ જ નહિ. ઊલટું અઠીક કહેવાય એવા દ્રવ્ય-ક્ષેત્ર-કાલ ભાવ આવી પડ્યા તો પ્રભુએ ઠીકની માફક વધાવી લેવાનું રાખેલું. વધારામાં મહા અઠીક ગણાય એવા અનાર્ય અનાડી દેશમાં ચાહીને વિચારવા ગયેલા. એટલે ? અઠીક આવી પડ્યું તો તો ઠીકની જેમ વધાવી લીધું, પણ એટલેથી બસ નહિ, કિન્તુ વધુમાં અઠીકનો સંયોગ જાતે ઊભો કરી એને ઠીકની જેમ પ્રસંગતાથી વધાવવા ચાલ્યા. સમજાય છે ? કેવી સાધના ?

કદી મગજમાં લાવો છો ખરા કે પ્રભુએ ધર્મ કેવી રીતે સાધ્યો ?

કશું અનુકૂળ જોવાની વાત જ નહિ, માણસો અનુકૂળ મળે છે ? જગા ઠીક છે ને ? સમય અનુકૂળ છે ને ? ભાવ સારા મળે છે ? આ કશું જોવાની વાત નહિ. જે મળે તે બરાબર કરીને ચાલવાનું. ગૌતમ બુદ્ધ વગેરે કોઈ ધર્મફિરસ્તામાં આવી સાધના જોવા નહિ મળે, પ્રભુએ એ સાધી. એમાં મહાસત્ત્વ છે, મહાસત્ત્વિકતા છે.

સત્ત્વવિકાસની ચાવી :-

પ્ર.- પ્રભુમાં આટલું બધું સત્ત્વ શી રીતે વિકસ્યું ?

ઉ.- એ રીતે વિકસ્યું કે પ્રભુએ બધું પ્રતિકૂળ વધાવી લેવાનું રાખેલું, ગમે તેવું પણ દુઃખ-કપરું અસદ્ય પણ સહી લેવાની જ વાત રાખેલી; તે ય પ્રસંગતાથી સહવાની મનોદશા પ્રભુએ કેળવેલી. મન જ એવું બનાવી દીધેલું કે સહી સહી જે આવે તે સહી. બધું પ્રસંગતાથી સહી. સહ્ય લાભમાં છે.'

પ્ર.- બધું જ શે સહન થાય ?

ઉ.- થાય, અગર મનને એ નિશ્ચિત થઈ જાય કે સહ્ય લાભમાં છે. સહવાને બદલે સામનો કર્યો, સહવામાંથી ભાગ્યા ન સહતું પડે એવા સંયોગ ઊભા કર્યો, ત્યાં લાભ ગુમાવ્યો, તક ગુમાવ્યો.

કર્મ સિદ્ધાન્તનો આ હિસાબ છે કે જેટલું સહી એટલા પાપ કર્મના ક્ષયનો લાભ મળે, જેટલા સુખશીલ બની સહવામાંથી ભાગો એટલા કર્મક્ષય તો દૂર પણ ઊલટું કર્મબંધન વધે.

સહવામાં કર્મક્ષય શાથી ? :-

સહ્ય એ કાયકલેશ કાયકષ્ટ છે, ને મનઃસંલીનતા છે, મનને અસદ્ય ભાવથી કષાયથી ગોપવવાનું છે; એટલે એમાં નિર્જરા તત્ત્વના બે અંશ છે,-‘કાયકલેસો, સંલીનયા ય.’ એનાથી પાપકર્મોની નિર્જરા થાય, ક્ષય થાય. વળી એ સ્વેચ્છાથી સહવાનું કર્યું છે, તેથી એમાં ધ્યાન શુભ છે. એ પણ આભ્યંતર તપ યાને નિર્જરાતત્ત્વ જ છે, તેથી એ હિસાબે પણ કર્મક્ષયનો લાભ મળે છે.

સહવાથી ભાગવામાં કર્મબંધ શાથી ?:-

એથી ઊલટું સહવાને બદલે સુંવાળા-સુખશીલ બનો તે ઈદ્રિયોની અવિરતિ છે, આશ્રવ છે, વળી એમાં મનના ભાવ દુઃખની કાયરતાના છે. સુખની લંપટતાના છે. તેથી એ કષાય અને અશુભ મનોયોગ નામના પણ આશ્રવ છે. આશ્રવથી કર્મબંધ થાય; અશુભ આશ્રવથી પાપકર્મ બંધાય. આમ, આમાં કર્મક્ષયની વાત તો દૂર રહી, ઉપરથી કર્મબંધ વધવાનું આવ્યું.

હવે વિચારજો કષ્ટ સહી લેવાને બદલે જેટલું અનુકૂળ અનુકૂળ શોધતા ફરાય, અનુકૂળ મળે એટલું વધાવી ભોગવી લેવાય એમાં સાત્ત્વિક લાભ શો ? પૂર્વનું પુણ્ય પતાવી ખલાસ કરવાનું, અને નવાં પાપકર્મ જમા કરી લેવાના, આ જ લાભ ને ? ત્યારે એના બદલે જીવનમાં સહી લેવાનો જ મુદ્રાલેખ બનાવ્યો હોય તો શોધી શોધીને સહવાનું કરાય, સહવાનું આવી પડે એ પ્રસંગતાથી વધાવતા જવાય, અને એમાં એકાંતે પાપકર્મક્ષયનો લાભ મળે, પાપબંધની વાત જ નહિ, એમાં જીવની ધન્યતા થાય. કહો,

ધન્ય આત્મા એકલું સહી લેવાનો હિસાબ માંડે.

એમ તો નરકના જીવ પણ એકલું સહવાનું કરે છે, એમને કશી અનુકૂળતા જ નહિ. પણ એથી એ જીવો ધન્ય નહિ, એમનું જીવન ધન્ય બન્યું ન કહેવાય; કેમકે એ સહે છે ખરા, પણ એમણે સહવાનો હિસાબ નથી રાખ્યો. સહવામાં રાડો પાડે છે, ત્રાસ દેનાર પર ગુસ્સો થાય છે, ને ક્યારે આમાંથી છૂટાય એ ઝંખે છે.

એટલે આ કંઈ પ્રસન્નતાથી સહવાની વાત નથી. સહવાનો જ હિસાબ રાખ્યો હોય તો પ્રસન્નતાથી સહવાનું કરાય. ત્યાં જીવન ધન્ય બને, જીવ ધન્ય બને.

માટે જ મહાવીર પ્રભુ, ખંડકમુનિ, ગજસુકુમાળ મુનિ, મેતારજ મુનિ સાગરચંદ્ર, કામદેવાદિ શ્રાવકો વગેરે, ને જેમને જેમને ગજબનાક સહવાનું આવ્યું, એ એમણે પ્રસન્નતાથી સહી લેવાનો હિસાબ રાખ્યો, તો એ ધન્ય બની ગયા, જીવન એમનું ધન્ય બની ગયું. બસ, સહો, સહો, સહ્યું એકાંતે લાભમાં છે. આ જીવન મંત્ર, જીવનસિદ્ધાન્ત બનાવવાનો છે. એના પર વીરપ્રભુએ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની કશી અનુકૂળતા ઉપર મન જ ન લઈ જવાનું રાખ્યું.

“દ્રવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૨૦, અંક-૪, તા. ૨૫-૮-૧૯૭૧

જીવની કંગાળ દશા કેવી ? :-

ત્યારે આપણી કંગાળ દશા વિચારો, વાતવાતમાં આ જોવા જોઈએ છે કે ‘માણસો આપણાને પ્રતિકૂળ નથી ને ? અનુકૂળ મળે છે ને ? ચીજ વસ્તુ પણ ઠીક સગવડભરી અનુકૂળ મળે છે ને ? સ્થાન અનુકૂળ, ઓછી ઠંડી-ગરમીવાળું, અને સુશોભિત છે ને ? રસ્તો કંટા કંકરા કે ખાડા-ટેકરાવાળો નથી ને ? કાળ સમય અનુકૂળ છે ને ? સામાના આપણી પ્રત્યે ભાવ પ્રકૃતિ સ્વભાવ સારા છે ને, મુલાયમ, પ્રેમાળ, આપણું સન્માન સાચવનાર છે ને ? એમ વસ્તુના ભાવ એટલે કે રૂપ-રસ-સ્પર્શ આદૃતિ વગેરે સારા અનુકૂળ છે ને ?...’

આમ બધે અનુકૂળતા-અનુકૂળતાની જ દાણિ રહે છે ને ? અનુકૂળ શોધતા ફરાય છે ને ? પ્રતિકૂળથી ભાગતા રહેવાનું કરાય છે ને ? જીવની આ કંગાળ દશા છે, સત્ત્વહીન દશા છે. તપાસજો, શું સંસાર પ્રવૃત્તિમાં કે શું ધર્મપ્રવૃત્તિ વખતે, સહવાનો મુદ્રાલેખ ક્યાં છે ? એક ઉપવાસ કરવો હોય તો ય આગામે દિવસે જરા દાખવાનું મન થાય, ટોનિક ધી-દૂધ-દહી લેવાનું કરાય, એ શું છે ? ઉપવાસમાં ભૂખ ન લાગી જાય, અશક્તિ ન આવે,- આ અનુકૂળતાનો જ હિસાબ. પ્રતિકૂળ જે ભૂખ અશક્તિ વગેરે, એને ઊભી જ ન થવા દેવાની પહેલેથી જ વિચારણા અને ગોઈવણ.

ધર્મ વખતે ય આમ, તો સાંસારિક જીવનમાં અનુકૂળતાનો હિસાબ કેટલો બધો વ્યાપક ? ચાહીને પ્રતિકૂળ સહી લેવાની ને એમાં આનંદ માનવાની વાતે ય ક્યાં ?

કંગાળદશા મિટાવવા શું વિચારવું ? :-

ભુવનભાનું એન્સાઈલોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

દા.ત. પત્ની મિજાસવાળી કજિયાળી મળી; સહી તો લેવી જ પડે છે, પરંતુ ચાહીને સહવાની વાત ક્યાં છે ? ક્યાં મન વળાય છે કે, ચાલો આ પણ ઠીક મળી, એથી ભલું સહવાનું મળે છે, એમાં એકબાજુ આપણાં પાપકર્મ ખપે છે, ને બીજબાજુ ક્રમાસમતા કમાવવાની મળે છે.

પાપકથ્ય અને ક્રમાધર્મની કર્માઈ મળે એ તો ધન્ય જીવન. માટે આનંદથી સહી લો.

આવો હિસાબ ક્યાં મંડાય છે ? માંડો તો તો કંગાળદશા અટકાવાય અને પુષ્યદશા ખૂલે.

આવું આવું તો જીવનની ઘણી બાબતોમાં બને છે કે ધાર્યું અનુકૂળ નથી મળ્યું, નથી મળતું, અણગમતું-અગવડભર્ય-પ્રતિકૂળ આવી પડે છે, ને એ સહી લેવું ય પડે છે. પરંતુ જીવનમાં સહી લેવાનો મુદ્રાલેખ નથી, હિસાબ નથી, ‘સહ્ય લાભમાં છે’ આવો સંતોષ નથી, તેથી હાય ને વોયમાં દહાડા જાય છે, છણછણ થયા કરે છે. મન દીન રાંક બની, ‘શું કરીએ ભાઈ ? ભોગ લાગ્યા અમારા કે આવું લમણે લાગ્યું !’ આમ નિસાસા નખાય છે. સહવાનું તો છે જ, ઉપાય નથી, પણ સહવાનું પ્રસન્નતાથી લાભ માનીને વધાવી લેવું નથી. કેવી, કંગાળદશા !

શ્રી મહાવીર ભગવાને સહર્ષ સહવાનો જ હિસાબ રાખેલો એટલે સત્ત્વ વિકસ્વર હતું,

તેથી અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ કશાની અપેક્ષા જ નહોતી. એ ગોશાળાની શી અપેક્ષા રાખે કે એ મારો સહચારી રહે તો સારું ? એ તો એની મેળે સાથે ફરતો ઊલટું એની અવળચંડાઈના લીધે પ્રભુને ક્યાંક લોકનું સહવું ય પડતું. છતાં પ્રભુએ એના પર શીતલેશ્યા મૂકી તેજોલેશ્યાથી બચાવી લેવાનો ઉપકાર કર્યો. વળી ઓઝે પ્રભુ પાસે તેજોલેશ્યાની વિધ માગી તો એ પણ બતાવવાનો પ્રભુએ ઉપકાર કર્યો. છતાં જુઓ,-

પ્રભુના અનુપમ ઉપકાર છતાં ગોશાળાએ અવસરે શું કર્યું ? શ્રાવસ્તિમાં પ્રભુની સામે જ પોતે જિનસર્વજ્ઞ હોવાનો મોરચો માંડ્યો; અને પ્રભુએ સાચી વાત કરી તો પ્રભુના ઉપર ઓઝે તેજોલેશ્યા મૂકી. બસ, આ જ નગુણાપણું ઉપકારીના ઉપકારને અવગણી ઊલટું અપકાર કરવો એ નગુણાપણું,

સંસાર આવો નગુણો છે.

એનું જીવ ગમે તેટલું સાચવે તો ય એ જીવનો કશો ગુણ કશો ઉપકાર ન માનતાં જીવ પર આફકો વરસાવે છે. સંસાર એટલે ધન-માલ-પરિવાર, ધરુકાન-વાહન, આ બધાનું ગમે તેટલું સાચવો, ગમે તેટલી સેવા કરો, પણ અટે

૮૨ ભુવનભાનું એન્સાઈલોપીડિયા-“સત્ત્વવિકાસની ચાવી” (ભાગ-૪૪)

એ બધા શું દેખાડે ? તમે જાઓ, અમે અહીં સલામત બેઠા છીએ,’ આ જ ને? ક્યાં જાઓ ? તિર્યંચાઈ ગતિમાં; અર્થ-કામમાં રાચ્યા રહ્યાથી વળી બીજી કર્દી સદ્ગતિ મળે ? ત્યાં કેટલાં હુંઘ ? કેવી પરાધીનતા ? કેવી રીભામણ પિસામણ ? સંસાર અંતે આ જ દેખાડે ને ? સંસાર એટલે કખાયો, એને બહુ સેવો, જ્યાં જ્યાં પ્રસંગ આવ્યો ત્યાં ત્યાં કોધને સેવ્યો, યા મનને મહલાયો, માયાને પાળીપોખી, કે લોભને આવકાર્યો, પછી એ કખાયરૂપી સંસાર અંતે શું દેખાડે ? હલકી ગતિઓમાં પરિભ્રમણ. માટે કહો, સંસાર નગુણો છે, ઉપકાર સેવા ઉપર અપકાર કરનારો છે, દ્રોહ વિશ્વાસધાત કરનારો છે.

પેલા બેનનો પતિ આવા જ સંસારનો અંશ ને ? પછી એ પત્નીને દ્રોહ હે, માતાનો વિશ્વાસધાત કરે એમાં નવાઈ શી ? ઉ-ઉ વરસથી તો દૂર મુંબઈમાં રહી કશી સંભાળ કરી નહિ, પરંતુ પત્ની સામેથી ચાલીને આવી તો એને ય રોકું પરખાવી દીધું.- ‘હું તને ઓળખતો નથી, તું કોક ભળતી બાઈ છે, મારી પત્ની નથી. બ્લોકની બહાર ધકેલી દીધી.

હવે બાઈ શું કરે ? બ્લોકની બહાર બેસી કરુણ પોક મૂકી લોક બેંગુ કરે ? ધાંધલ જમાવે ? પેલાને ફજેત કરે ? લોકમાં ઉશ્કેરાટ જગાવે ? ના, આ બાઈ આમાંનું કશું કરતી નથી. એ સમજે છે કે

આપણાં કર્મ પાસેથી બળાત્કારે કશું સારું આંચકી નહિ શકાય. કર્મ જ દૂબળા હશે તો આવી કશી ધાંધલ કરવા છિતાં પતિના હદ્યમાં ફરક નહિ પડે. બહુ તો કદાચ ૨-૪ મહિના ભરણ-પોષણ ખર્ચ આપી દે, પણ પછી પાછી ગાપચી એવી મારે કે હવે ફરીથી એની સાથે લડવું હોય તો લડો. મૂળ, આપણાં કર્મનો હિસાબ છે. બાઈ સમજું છે, કર્મનો હિસાબ સમજે છે, તેમ એ પણ સમજે છે કે દુનિયાના માણસ સાથે પરાણે પ્રીત કેટલી થાય ? કેટલી ચાલે ? માટે હવે તાણવું વ્યર્થ છે.

બેનનું આગળ શું ? :-

બેન પેલા પ્રવાસીને કહી રહી છે કે ‘બસ, હવે અહીં કોઈ વાતની આશાજ, નહોતી, તેથી હું ચાલી, ત્યાં બીજા બ્લોકવાળાએ મને બોલાવી પૂછ્યું ‘તમે કોણ છો ? આ ભાઈના કાંઈ સગા થાઓ ?’

મેં કહું ‘કેમ એમ પૂછ્યું પડ્યું ?’

‘તમને અહીં પહેલાં કદી જોયેલા નથી, આજે જ જોયા, તેથી જો કોઈ સગા-સ્નેહી હો તો તમને સાવધાન કરવા છે. એટલે તમને પૂછ્યું.

ત્યારે મેં મારી ઓળખ આપી, તો એ બિચારા એકદમ હુંઘિત થઈ મને

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

કહે, ‘તો હવે તમારે એમના નામ પર મીઠું મૂકવું પડશે. કેમકે એ કોઈક રખાત સ્ત્રીને રાખીને રહેલ છે.’

એ સાંભળી મને સમજાઈ ગયું કે એમાં જ એ પૈસાનું પાણી કરતા હશે, પછી ઘરે પૈસા કયાંથી મોકલે ? તેમ એ પરસ્તીને રાખવી હોય એટલે પછી મને શું કામ ઓળખે ? ખેર, જેવું આપણનું ભાગ્ય તેટલી અને તેવી જ આપણને પ્રાપ્તિ થાય.. એમ કરી હવે હું ઘર તરફ પાછી ફરી રહી હું. આમાં મારી ગમગીનીનું તમે શું પૂછો છો ? ગમગીની વધારે તો સાસુ અંગે છે કે એને હું જવાબ શો દઈશ ? અને એ જો ખરી હકીકિત જાણે તો ટિલના કેવા ટૂકડા થઈ જાય ? ઘરનું તો હું મજૂરી કરીને નભાવી લઈશ.’

પતિ સામે કેસ નહિ ? :-

પ્રવાસી ઉભામાં બેઠેલા બીજા પ્રવાસીઓને આ અનુભવ કહી રહ્યો છે એ હવે આગળ વધતાં કહે છે, ‘પછી મેં બેનને કહું તમારી શીલબદ્ધતા અને શાંતિ તથા ધીરજને ધન્ય છે. છતાં આમાં તમે કાયદેસર ભરણપોષણ માણી શકો. કહો તો હું એ કાર્યમાં સહકાર આપું.’

ત્યારે બેન કહે, ‘ભાઈ ! એ પતિ સામે લડવાનું અમો પતિત્રતા સ્ત્રીને ન છાજે; અને એવા ઓશિયાળા શા સારું કરવા ? રોટલા માટે ? પુઝે હાથ-પગ સાજા છે ત્યાં સુધી મહેતન કરી રોટલા કમાઈ લેવા એમાં શી મોટી વાત છે !

બાકી, પતિ સાથે તો જેવી પૂર્વની લેણાદેણી; એ પૂરી થઈ એવા સંયોગમાં ચોપડો ચૂક્તે કરવાનો, પણ આર્ય બાળાની મર્યાદા નહિ ચૂકવાની.’

વિચારજો બેનના આ શબ્દો. પતિ પર ગુર્સો નથી, પતિ માટે એલફેલ બોલ નથી, પણ મગજ ખૂબજ સ્વસ્થ છે. કેમકે હિસાબ માંડ્યો કે બીજા સાથે મેળ મિલન લેણાદેણી જેટલું જ થાય. હવે લેણાદેણી જ પૂરી થઈ એ સામો મેળ-સંબંધ તોડી નાખે છે એ પરથી સમજાય છે. તો પછી હવે લારા શા કરવા ? ગુર્સો-ચડભડાટ-લવારા કરીને શું મળવાનું ? લેણાદેણી પતી ગઈ પછી બેંચતાણનો કોઈ અર્થ નથી. બેંચતાણ કરવામાં નવા પ્રપંચ અને નવી હૈયાહોળી ઊભી કરવાનું થાય છે.

શું સુંદર માનવજીવન આવા અસુંદર કાર્ય માટે છ ?

બેંચતાણ કરીને પ્રપંચ-ખટપટ હૈયાહોળી કરવી એ કોઈ સારાં સુંદર કાર્ય નથી માટે લેણાદેણી પતી ગયા પછી એવી બેંચતાણ કરવામાં મૂર્ખતા છે, બુદ્ધિહીનતા છે, એ આ બેન સમજી રહી છે, તેથી કહે છે, ‘આવા સંયોગમાં ચોપડો ચૂક્તે કરવાનો.’

‘ચોપડો ચૂક્તે કરવાનો’ એટલે સમજે છો ને ? ધારો કે તમારે કોઈની સાથે

૮૪ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“સત્ત્વવિકાસની ચાવી” (ભાગ-૪૪)

પैસાની લેવડેવડ છે. હવે સામા ધડીએ વેપારમાં ભારે ખોટ કરી, દેવાળું કાઢ્યું, એના લેણદારોને કશું મળે એમ નથી, છતાં તમે એની પાસે ગયા અને એની સાથે તમે સારા સંબંધ રાખ્યાનું જણાવી પૈસા દેવા કહ્યું; એઝો દાખિણ્યથી કહ્યું. ‘આમ તો કાંઈ અપાય એમ નથી, પરંતુ અડધા આપું. તમે હિસાબ સંપૂર્ણ ચૂક્તે કરી નાખો; તો તમે શું કરો? અડધા ય મળે છે ને? એમ આશાસન લઈ અડધા લઈને ચોપડો ચૂક્તે કરી નાખો ને? ‘ચૂક્તે’ એટલે પછી ‘એની કોઈ આશા રાખવાની નહિ, તેમ એની સાથે હવે લેવડેવડનો કશો સંબંધ પાડવાનો નહિ, તેમ એની દિશા જુદી, આપણી દિશા જુદી,’ આવો જ હિસાબ માંડો ને? કે રૂપિયા ગણગણ કરો કે ‘મારા આટલા રૂપિયા એની પાસે રહી ગયા?’ ના, ડાખ્યો માણસ તો મન વાળી લે કે ‘હવે એ ગણવાના નહિ; એટલા આપણા ભાગ્યમાં નહોતા તે દબાઈ ગયા. તો ભાગ્યમાં જ નહિ એને શું યાદ કરવું?’

બસ, પૈસાની જેમ દુન્યવી સંબંધને પણ એ જ રીતે લેખવાનો. ‘સંબંધ પૂરો થયો? ચાલો, ચોપડો ચૂક્તે કરો. હવે એ યાદ જ નહિ કરવાનો, ને ફોગટ હૈયું બાળવાનું નહિ.’

સંસારમાં જીવન જીવતાં ચિત્તમાં સમાધિ સ્વસ્થતા રાખવી હોય તો આ ચોપડો ચૂક્તો કરવાની કળા આવડવી જોઈએ.

જીવતમાં એવી ધડી બાબતો બને છે જેને ચોપડો ચૂક્તે કરવા જેવો હોય છે. એથી હૈયાને ધડી શાંતિ મળે. દા.ત. સારી ચીજ ખરીદી લાવેલા એ કૂટી ગઈ યા ચોરાઈ ગઈ, ત્યાં તરત હિસાબ માંડવો જોઈએ કે ‘હવે એ કાંઈ પાછી વળે એમ નથી. તો સમજો કે ભાગ્યમાંથી ઉત્તરી ગઈ. માટે હવે એનો ચોપડો ચૂક્તે કરો.’ આમ જો દિલથી હિસાબ માંડી ચોપડો ચૂક્તે કરાય તો પછી એ યાદ કરવાનું નહિ રહે, ને હૈયું બાળવાનું નહિ રહે.

એમ, ધારો કે છોકરો આડો ફાટ્યો, હવે બાપનું કહ્યું સાંભળતો જ નથી, સમજીવવા ધડી મહેનત કરી છતાં ઊલટો વધુ ઉદ્ઘત થાય છે, હવે શું કરવાનું ચોપડો ચૂક્તે કરવાનો. સમજ રાખવાનું લેણાદેણી પૂરી થઈ. ‘હે? મેં આટલો પાળી પોણીને મોટો કર્યો, એની પાછળ મેં લોહીનાં પાણી કર્યા, હવે આ ઉલંઘાઈ કરે છે?’ એમ મનમાં જરાય લાવવાનું નહિ; નહિતર રોજનો લોહીબાળો થશે; કેમકે એ દેખાયા કરે, યાદ આવ્યા કરે, એટલે એ જ ઉકળાટના વિચાર આવવાના. માટે હવે તો ચોપડો જ ચૂક્તે, કે ‘મારે ને એને કશો સંબંધ નથી. એમ તો પૂર્વ જન્મમાં ય પાળેલાપોષેલા કેઈ હશે એ આડો ફાટ્યા હશે. તો આજે કયાં એ યાદ કરીને હાયબળાપો કરું દ્ધું? બસ જેમ ભૂતકાલનાઓનો ચોપડો ચૂક્તે, એમ આ

ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ-કખાય રોકો: ધૂઠવાનો મોકો” (ભાગ-૪૪)

છોકરાનો પણ ચોપડો ચુક્તે, મનને યાદ આવી જાય તો એને ભૂતકાળના લિસ્ટમાં મૂકી દેવાનો, જેથી પછી એનો વિચારે ય નહિ, ને દિલબળાપો ય નહિ.

એમ, પહેલાં શરીર સારું ચાલતું હતું, હવે નથી ચાલતું; પહેલાં ધંધો સારો ચાલતો, હવે સંયોગો ફરી જવાથી એવો નથી ચાલતો; એમ પહેલાં અમુક શ્રીમંત માણસ બોલાવતા હતા, હવે નથી બોલાવતા.....આવી આવી કેઈ બાબતોમાં ધસાતું બને, ત્યાં લેણાદેણી પૂરી થઈ, ચોપડો ચૂક્તે,’ આ જ હિસાબ આજ ધોરણ રાખવું જોઈએ એથી ઘસારા સંબંધે ચિત્તબળતરા અટકી જાય, ચિત્ત સ્વસ્થ રહે.

ચિત્તની સ્વસ્થતા-સમાધિ બહુ જરૂરી છે. માટે ‘લોગસ્સ’ સૂત્રમાં ‘સમાહિવર-મુત્તમં દિન્તુ’ માગવામાં આવે છે. ‘મને ઉત્તમ ભાવસમાધિ આપો,’ આવું શા માટે માગવાનું? એટલા માટે કે

સમાધિ હોય તો સાંસારિક પ્રવૃત્તિઓ ઘેરા કુર્મબંધ ન કરાવે. અને ધર્મપ્રવૃત્તિઓ દીક્ષિમાન આરાધાય.

ચોપડો ચૂક્તે કરવાથી આ અદ્ભૂત લાભ મળે છે. નહિતર તો ધર્મપ્રવૃત્તિ દા.ત. દેવદર્શન-પૂજા-ચૈત્યવંદન નવકારવાળીમાં પેલી બળતરાના વિચાર આવ્યા કરવાના, તેથી ધર્મકિયા દુબળી પાંગળી ફોંફા જેવી જેમ વિનાની થવાની. પ્રતિકૂળની અરતિ-ઉદ્ઘેગ-બળતરા ખતરનાક વસ્તુ છે, એ અમૃત જેવી ધર્મસાધનાને માલિવિનાની બનાવી દે છે. આપણી ધર્મસાધનાને કોઈ પારકો માણસ નથી બગાડતો, આપણે જ બગાડીએ છીએ, તે આવી રીતે, ચિત્તમાં એક યા બીજા પ્રકારની બળતરા ચાલતી હોય એટલે એ સાધનાને બગાડી નાખે છે. બળતરા આપણે જ ઊભી કરીએ છીએ, એથી આપણે પોતે જ આપણી સાધના બગાડી નાખનાર બનીએ છીએ.

પ્ર.- બળતરા તો સામાના વાંકા થવાથી થાય છે, એટલે સામાને કરવી ગણાય ને?

૩.- ના, સામો વાંકો થયો એ તો સામાનો વાંક, પરંતુ પછી બળતરા તો આપણે ચોપડે ચૂક્તે નથી કરતા તેથી થાય છે. એનો અર્થ એ કે, આપણે ચોપડો ચૂક્તે ન કરીએ એ આપણો વાંક. જે વસ્તુ સુધરવાની નથી એના લારા એની ચિત્તા એ ખામી છે, અપરાધ છે. પછી એ આપણા જ વાંકે બળતરા થાય એ આપણે જ ઊભી કરી ગણાય. નહિતર તો ઉત્તમ આત્માઓનું બીજાઓએ ધણું બગાડ્યું, છતાં એમને કેમ બળતરા ન ચાલે?

સીતાજીને પોતાના જ પતિ રામે વનમાં કાઢી મૂકી પછી શું મહાસતીએ બળતરા કર્યા કરી? રાજ શ્રેષ્ઠિકને પોતાના જ વહાલથી ઉછેરેલા દીકરા કોણિકે

૮૬ ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“સત્ત્વવિકાસની ચાવી” (ભાગ-૪૪)

જેલમાં પૂર્યા, તો શ્રેણિકે શું બળતરા કર્યા કરી ? ના, જો એ કરી હોત તો તો પછી અભયકુમાર ઉપર રોષ થવા સંભવ હતો કે આણે ક્યાં દીક્ષા લઈ મને નોંધારો કરી મૂક્યો, ને મારી આ દશા થઈ ? પરંતુ શ્રેણિકે આવો લશ વિચાર કર્યો નથી, ઉલટું અંતકાળે અભયકુમાર વગેરેને ધન્યવાદ આપ્યા છે કે ધન્ય છે એ બધાને કે વીરપ્રભુનાં ચરણો ચારિત્ર લઈ આત્માનો નિસ્તાર કરી ગયા !’ આ સૂચ્યવે છે કે એમણે કોણિક પર બળતરા નથી કરી. એનું કારણ એમણે કોણિક અંગેનો ચોપડો ચૂક્યે, અને માત્ર પોતાનાં પૂર્વની કર્મની સ્થિતિ અને એમાં કારણભૂત પોતાનાં પૂર્વ દુષ્કૃત્યોનો વિચાર રાખ્યો.

એટલે વાત આ છે કે બળતરા આપણે જ ઉભી કરીએ છીએ. એ રોકવા ચોપડો ચૂક્યે કરવાનો. પેલી બેન પતિ સામે ભરણપોષણ માટે લડી લેવાની પ્રવાસીની સલાહ સામે આ જ કહી રહી છે, કે ‘ના, રોટલા માટે લડવાનું ? રોટલા તો હું કમાઈ લઈશ, પતિ સાથે તો લેણાદેણી પૂરી થઈ માનવાની અને ચોપડો ચૂક્યે કરી દેવાનો. મર્યાદા બહારનું કરવું અમો આર્યબાળાને છાજે નહિ.’

બેનનો વિવેક, ધૈર્ય અને આર્યમર્યાદા પાલન મન પર લેવા જેવા છે. પૂર્વે મહાન આત્માઓ મર્યાદાનું પાલન ઘણું કરી ગયા છે; દા.ત. રામે પિતાએ ભરતને રાજ્ય આપવા પર પુત્ર તરીકેની મર્યાદા સુંદર પાળી પિતાનું વચન અખંડિત રાખવા વનવાસ સ્વીકાર્યો. સીતાએ પરપુરુષના સ્પર્શને અને પરપુરુષ સાથેના ગમનને નહિ આવકારવાની મર્યાદા પાળવા રાવણની કેદમાં પડી રહેવાનું કર્યું પરંતુ કેદમાંથી છોડવા હનુમાનજી જે સીતાને ખાંધે બેસાડી રામ પાસે લઈ જવા માગતા હતા એને હા પાડી નહિ. સતી સુભદ્રાએ સાસરે ગયા પછી જ્યાં જોયું કે આ તો બૌદ્ધધર છે, ત્યાં બળવો કરી ભાગવાનું ન કર્યું, પણ નભાવી લીધું, સાસુએ એને અલગ રૂમમાં રાખી તો તે સ્વીકારીને પોતાના શ્રાવકાચાર પાળવાનું અખંડિત રાખ્યું. સુર સુંદરીને નર્મદાસુંદરી ને પતિએ અજાણ્યા દ્વિપમાં છોડી દીધા તો સતીઓએ શીલમર્યાદા અખંડ પાળી.

આમ પ્રાચીન દાખલા ઘણા મળે, પરંતુ એ પરથી મર્યાદા પાલનની વાત આવે ત્યાં મનને એમ થાય છે કે ‘એ તો સત્યુગના યા જુના ઈતિહાસના દાખલા;’ પરંતુ આ બેનનો દાખલો તો વર્તમાનનો; એટલે એનું આલંબન લઈ મર્યાદાપાલન કરી શકાય ને ? બેને પતિ સામે લડવાનું પસંદ ન કર્યું.

ત્યારે પેલો પ્રવાસી પૂછે ‘તો બેન ! આજીવિકા માટે શું કરશો ?’

આજીવિકાનો ઉપાય :-

બેન કહે, જો કોઈ તૈયાર કરેલો માલ વેચી આપનાર મળે તો હું કાચા

માલમાંથી પાકો માલ જેવો કે કાગળની કોથળીઓ, પાપડ, સીવેલ તૈયાર કપડા વગેરે બનાવવા ધારું છું.’

પ્રવાસી બેનની આ વાત પર બીજા પ્રવાસીઓને કહે ‘જુઓ મારાથી મારું ગવાય નહિ, પરંતુ ભાઈઓને ઘ્યાલ આવે કે અવસર પરની યથાશક્તિ મદદ કરેલું કામ કરે છે, માટે કહું છું કે મેં એ બેનને કાચો માલ લાવી આપવા અને એમણે તૈયાર કરેલ પાકો માલ વેચી આપવા વચન આપ્યું. બેન કહે ‘ભાઈ ! આજે હું નવું જીવન પામી રહી લાગું છું તમારો બહુ ઉપકાર.’ બસ, પછી તો એ બેનનું કામ એ રીતે સરસ ચાલ્યું, અને આજે એ સારું ધર્મધ્યાન ધર્મસાધના કરી શકે છે. સુરદાસની પત્ની અને આ બેનમાં કેવાં અંતર !

આ બંને દાખલા એટલા માટે જોયા કે આત્મામાં સારા-નરસા બેઉ માર્ગે જવાની શક્તિ છે, પણ મનનું વલણ સારું હોય તો શક્તિને સારા માર્ગમાં ખરચાય. બસ, કોધ દબાવી ક્ષમા રાખવા માટે પણ આત્મ શક્તિનો સદ્ગુપ્તયોગ વિચારવાનો છે.

દૈવી-દાનવી શક્તિ :-

કોધ દબાવવાનું ઉપાયમાં આ એક ઉપાયભૂત વિચારણાની વાત છે કે કોધ આત્મા જ કરી શકે છે, ૪૩ નહિ. તેમ કોધ દબાવી ક્ષમા-સમતા રાખવાનું પણ આત્મા કરી શકે, આત્માએ કરવાનું છે. આમ આત્માની બે જાતની શક્તિ એક, કોધ કરવાની દાનવી શક્તિ, અને બીજી ક્ષમા-સમતા રાખવાની દૈવીશક્તિ ત્યાં ઉહાપણથી વિચારવાનું છે કે ‘કઈ શક્તિનો ઉપયોગ કરવો ? આત્મભલ ક્ષયાં વાપરવું ?’ જેવું માનસિક વલણ હશે એવો શક્તિનો ઉપયોગનો પ્રયત્ન થવાનો, એના પર આ બે જી કુશીલ-સુશીલ સ્વીઓનાં દિશાંત જોયાં. એમાં એ જોયું કે

બંનેનાં માનસિક વલણ જુદાં હતાં, એકને યથેચ્છ રંગરાગ ભોગવી લેવા તરફ મનનો ટળાવ હતો, પતિનું સુખ મોજુદ છતાં સંતોષ નહિ, તેથી આચાર-બાચ પણસુખ મળતું હોય તો તે લેવા મનની રુચિ હતી, એટલે પછી આત્મશક્તિ અનાચારમાં વપરાય એમાં નવાઈ નહિ. બીજને પતિ તરફથી સુખ બંધ થઈ જવા છતાં મનનો નિર્ધાર શીલની અખંડિતતા માટે હતો, એટલે સહેજે એ આત્મશક્તિને એમાં જ ખરચે.



આમ મનનાં વલણ પ્રમાણે આત્મવીર્યનો ઉપયોગ થાય છે. તો પ્રશ્ન થાય,-
પ્ર.- ત્યારે શું મનનું વલણ સુધરતું ન હોય ત્યાં સુધી આત્મશક્તિનો સહૃપયોગ
થાય જ નહિ ?

ઉ.- આનો જવાબ એ છે કે એવો એકાંત નથી. પ્રારંભે સારાં વલણ વિના
પણ આત્મવીર્યનો સહૃપયોગ થાય, કિન્તુ જીવને જો આટલો વિવેક જાગી જાય કે
‘ઉંચા માનવભવની સફળતા કરવી હોય તો તે આત્મબળ-શક્તિ-વીર્યનો સહૃપયોગ
કરવાથી જ થઈ શકે, દુરુપયોગ કરવાથી નહિ.’

સારાં વલણ વિના સહૃપયોગ થાય ?

અને આ વિવેક પ્રમાણે પોતે નિર્ધાર કરે કે મારે બને ત્યાં સુધી સહૃપયોગ
કરવો છે, તો પછી કદાચ પૂર્વભવોના ધેરા મોહસંસ્કારવશ મન વિષયો તરફ
ઢળતું હોય, મનને વિષયોની મિઠાશ લાગતી હોય, છતાં આ વિવેકપૂર્વકનો નિર્ધાર
મન મારીને પણ આત્મ-વીર્ય શીલ-સદાચારો અને ક્ષમાદિ સેવવામાં સહૃપયોગ
કરાવશે, પણ વિષય-કખાયોના સેવનમાં દુરુપયોગ નહિ. આમ વારંવાર સહૃપયોગથી
જુના કુસંસ્કાર ઘસારે પડશે અને મનનું વલણ બદલાશે પ્રારંભિક સાધક આ રીતે
જ આગળ વધે છે.

આત્મવીર્યથી સત્પ્રવૃત્તિ સદ્ગુણિયારો ખૂબ ખૂબ કરતા રહેવાથી મનનાં વલણ
સુંદર ઘઢાય છે. એટલો નિર્ધાર જોઈએ કે મારે મારા કિંમતી આત્મવીર્યનો બને
તેટલો દુરુપયોગ અટકાવી સત્પ્રવૃત્તિમાં સહૃપયોગ કરતાં રહેવું છે.

પેલી કુશીલના માર્ગ જનારી બ્રાહ્મણપત્નીને પોતાના આત્મવીર્યનો સહૃપયોગ
કરવાનો કોઈ વિચાર જ નહોતો તેથી સુંવાળા મનનાં રંગરાગી વલણ અને કુશીલ
ઉપરાંત પતિના ભયંકર દ્રોહ તરફ દોરી, કુણને કલંકિત કરવા તરફ ઘસડી ત્યારે
બીજા પ્રસંગની બાઈને નિર્ધાર હતો કુશીલનો માર્ગ ખપે નહિ, અર્થાતું આત્મવીર્યને
આચાર-બહારના વિષયમાં ભરચું જ નથી, પછી પૈસાની ઘણી તંગીને ચલાવી
લીધી, પણ આત્મવીર્યનો દુરુપયોગ કર્યો નહિ.

એ સુશીલ બાઈની (૧) ધીરજ કેટલી ? (૨) ડહાપણ કેટલું ? (૩) ખામોશ
કેટલી ? (૪) સાસુની સેવા કેવી ? (૧) ત-ત વરસથી પતિ તરફથી કોઈ પત્ર
નહિ, સમાચાર નહિ, પૈસા મોકલાયા નહિ, છતાં એ આકુળી ઉતાવળી ન થતાં
ઉપરથી સાસુને હિંમત આપનારી બની કે હું બેદી તમે ચિંતા કરશો નહિ ! એ
એની ધીરજ (૨) ડહાપણ એવું કે બહારમાં પતાના ભારે પણ દુઃખનો કોલાહલ

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂતવાનો મોકો” (ભાગ-૪૪)

ન કર્યો. (૩) ખામોશ એવી કે પતિ સામે કેસ ન કર્યો, યા ચાર જણને વચ્ચમાં
પાડીને ધાંધલ ન જમાવી. (૪) સાસુની સેવા તો અદૃષ્ટ બજાવી. ત્યારે સુશીલતાએ
લબાડ શ્રીમંતને ય તડકાવી નાખ્યો.

ધીરજ-ડહાપણ-ખામોશ-સેવા-સુશીલતા, આ બધામાં આત્મવીર્ય ખરચવું પડે
છે, પરંતુ એ સહૃપયોગ છે. ત્યારે અધીરાઈ-મૂર્પત્તા-ગુસ્સો-સ્વાર્થી, હરામીપણું કુશીલ
વગેરે આચરવામાં આત્મશક્તિનો દુરુપયોગ છે. કોધને રોકવા માટે આ નિર્ધાર
જોઈએ કે ‘મારે મારા આત્મવીર્યને વેડફી નથી નાખવું એનો દુરુપયોગ નહિ પણ
સહૃપયોગ કરવો છે, અને તે ક્ષમા-સમતા રાખવામાં થાય. માટે મારે ગુસ્સો
હરગીજ ન ખપે.’ આમ આત્મવીર્ય પર અંકુશ મૂકવાથી કોધ અટકે.

(૧૪) કોધ વગેરે કખાયને અટકાવવા માટે વળી એક વિચાર આ કરાય કે
મારે મોકે જવાની ઉતાવળ છે, અને કખાયના ત્યાગ વિના મોકે જવાતું નથી,
તેથી જો કોધાદિ કખાય કરું તો એટલો સંસાર લંબાવાથી મોક્ષ-પ્રાપ્તિમાં વિલંબ
થવાનો. કેમકે કખાયથી (૧) કર્મ બંધાય, તેમજ (૨) કખાયના નવા સંસ્કાર વધે;
પછી (૩) એ કમને ભોગવવા સંસારમાં રહેવું પડે, તેમજ (૨)એ સંસ્કારથી
ફરીથી કખાયને જાગવાને અવસર મળે. એ બધું સંસાર લંબાવનારું બને. મારે જો
મોક્ષ પામવાની એટલે કે સંસારને સમાપ્ત કરવાની ઉતાવળ છે, તો શા માટે કોધ
વગેરે કખાય સેવી સંસાર લંબાવું ?

આ પણ વિચાર મહત્વનો છે. પહેલાં એ નક્કી કરવા જેવું છે કે ‘મોક્ષ
પામવાની ઉતાવળ છે ખરી ?’ અલભત મોક્ષ જોઈએ છે ? મોક્ષની ઈચ્છા છે ?
એવો પ્રશ્ન આવે ત્યાં તો હજુ હા કહી દઈએ છીએ, પરંતુ ઉતાવળનો સવાલ
આવે કે મોકે જવાની ઉતાવળ છે ? ત્યાં જવાબમાં જીબ અટકી પડે છે. કેમકે
મોક્ષ પામવાનો એટલે તો કાયા-કંચન-કુંટલ, ખાનપાન, વિષયો વગરે બધું છૂટી
જવાનું; ને એ એકાએક એકદમ જ છૂટી જાય એવી વાત પર તો જીવને મુંજવણ
જેવું લાગે છે.

ત્યારે, ખરી રીતે જો મોક્ષની ઈચ્છા જ છે, તો એની ઉતાવળ શું કામ ન
હોય ? મોક્ષ શા માટે જોઈએ છે એ વિચારો છો ખરા ? જો એ વિચારવામાં આવે
તો સંસારને એક ક્ષાળ પણ રાખવાનું મન ન રહે. કેમકે એમાં તો દેખાય કે
સંસારમાં તો મહા વિટંબણાઓ છે, એને શું કામ ક્ષાળ પણ નભાવવી ? ત્યારે એ
જોઈએ કે

સંસારમાં કેવી કેવી વિટંબણાઓ છે ?

(૧) સંસારમાં મોટી વિટંબણા જનમ મરણમાં ધૂમવું પડે છે એ. જનમની

૧૦૦ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“સંસારમાં કેવી કેવી વિટંબણાઓ છે” (ભાગ-૪૪)

પાણ તો અનેક કલેશ-કષ-દુઃખ-ચિંતાઓ ઉભી થાય છે; એવાં જનમ એ વિટંબણા નહિ ? મરણની બિલકુલ ઈચ્છા નથી, છતાં મરવું જ પડે એ વિટંબણા નથી ? જનમ મરણની પરંપરા ચાલે એમાં હલકી યોનિઓમાં પણ જનમ મળે એ પણ જીવની વિટંબણા જ છે.

(૨) વળી સંસારમાં કર્મની શિરજોરી, કે સારાની ઘણી ઈચ્છા અને નરસાની તદ્દન અનિચ્છા હોવા છતાં કર્મની શિરજોરીથી જીવને સારું ન મળે અને નરસુ લમણે લાગે એ જીવની વિટંબણા છે.

(૩) સંસારમાં પાપ કરવા પડે છે, તેમજ બીજાને પાપ કરવામાં તથા દુઃખ પામવામાં નિમિત્ત થવું પડે છે, એ વિટંબણા જ છે, ગૃહસ્થને દુકાન, ચૂલોઓલો, કાયાનાં જતન, પરિવારપાલન વગેરેમાં કેટલાંય પ્રાણાત્મિકતાની વગેરે પાપ કરવાં પડે છે, અને બીજાનાં એવા પાપમાં નિમિત્ત બનવું પડે છે. સાધુને રૂપાળા જોઈ કોઈને રાગ થતો તો એ રાગ પાપમાં સાધુનું શરીર નિમિત્ત બન્યું.

બળદેવ મુનિને જોવામાં પણિયારી આકર્ષાઈ ભાન ભૂલી દોરું ઘડાને બદલે બાળકના ગળામાં ફાંસવા ગઈ, તો મુનિને લાંયું કે ધિક્કાર છે આ રૂપને અને નગરભ્રમણને જ્યા આ રૂપાણું શરીર બીજાને રાગ કરાવી અકાર્યમાં નિમિત્ત બને છે, માટે ગામ-નગરમાં ભીક્ષા લેવા જવું જ નહિ.’ એમ કરી બીજાને પાપમાં નિમિત્ત ન બનવા વનમાં જ રહેવાનું અને વનમાં જ ભીક્ષા મળે તો લેવાનું નક્કી કરીને ગામ નગરમાં ભમવાનું જ બંધ કર્યું. શરીરને શું માન્યું ? બીજાને પાપમાં નિમિત્ત થતું હોવાથી વિટંબણા.

સમરાદિત્યનો જીવ ચોથા ભવમાં ધન્યમુનિ; તે એમની વૈરી પત્નીએ ઉધાન માં કાઉસરગધાને રહેલા એ મુનિની ચારે બાજુ બાળવાના લાકડાની ઊંચી ચિત્તા ગોઠવી ને ચોમેરથી એ સળગાવી...મુનિ બળવા લાગતાં આ ભાવના કરી રહ્યા છે,-

‘અરે ! આ મારું શરીર કોઈ બિચારા જીવને પાપ કરવામાં નિમિત્ત બની રહ્યું છે ધિક્કાર છે શરીર બલવાળા સંસારવાસને ! ધન્ય છે તે સિદ્ધ ભગવંતોને કે જે અશરીરી બનીને કોઈને ય પાપમાં નિમિત્ત બનતા નથી. તો એની કોઈ શરીરાદ વસ્તુના નિમિત્તે જીવને બિચારાને પાપ કરી દુઃખમાં પડતું પડતું નથી. ધિક્કાર છે આ શરીરરૂપ સંસારની વિટંબણાને !’

અર્ણિકાપુત્ર આચાર્ય મહારાજ ગંગાનદી નાવમાં પસાર કરતા હતા. વૈરી દેવતાએ નાવને ડેલંડેલ કરી નાવના લોકને ભરમાવ્યાથી લોકોએ જ મુનિને ઊંચી નદીમાં નાખવા ઊંચે ઉછાય્યાં ત્યાં જ દેવતાએ એમને ભાલા પર જીવ્યા મુનિના ભુવનભાનુ અન્સાઈકલોપીયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો”(ભાગ-૪૪) ૧૦૧

શરીરમાં ભાલો ભૌકાયાથી શરીરમાંથી લોહી નીચે નદીમાં ટપકવા માંડયું. એ જોઈ આચાર્ય મહારાજ ચિંતવે છે કે,-

આચાર્યની ભવ્ય વિચારણા :-

‘અરે ! આ મારું લોહી નીચે પાણીના બિચારા સૂક્ષ્મ અસંખ્ય જીવને હણી રહ્યું છે ! ધિક્કાર છે આ શરીર તે ! આ શરીરધારી સંસારવસ્થા ને આમ શરીર પરથી પણ આસક્તિભાવ ઊઠી જવાથી અનાસંગ યોગે મુનિ કેવળજ્ઞાન પામી મોક્ષ ગયા. સંસાર યાને શરીરરૂપ સંસારવસ્થા બીજા જીવને પાપમાં અને દુઃખમાં નિમિત્ત બને છે, માટે એવો સંસાર જીવને માટે એક વિટંબણા છે.

(૪) એમ, સંસાર પુણ્ય વેચી પાપ ખરીદાવે છે. માટે એ વિટંબણા છે. સંસારમાં જીવને બધું અનુકૂળ મળે છે તે પૂર્વનાં સંગૃહીત પુણ્યના યોગે, પુણ્ય ઉદ્દ્યમાં આવ્યા નથી, પરંતુ એ અનુકૂળ મળવા પર એક બાજુ એટલી પુણ્ય-હુંઠી વટાવાઈ જાય છે, વેચાઈ જાય છે, અને બીજી બાજુ એ અનુકૂળ મેળવીને જીવ વિષય-કષાયમાં ચક્કયૂર બની દુષ્ટ્યાંથી આચરે છે. તેથી અઠળક એ પાપ ઉપાર્જિ છે. આમ પુણ્ય વેચી પાપની ખરીદી થાય છે. માટે સંસાર એ જીવનાં સન્માન નહીં, પણ વિટંબણા જ કહેવાય.

(૫) સંસારમાં સામાન્ય રીતે પુણ્યના ઉદ્દ્ય તો સાથે પાપના ઉદ્દ્યથી કલંકિત હોય છે, એ પણ એક વિટંબણા જ છે. કોઈ સ્વાગત કરવા તો કેશરનો ચાંલ્ટો કરે, પરંતુ ઉપર અક્ષત ચોડવાને બદલે કોલસાની ભૂકી ચોડે તો એ વિટંબણા નથી ? એવી ખબર પહેલેથી હોય તો તો કહી દેવાનું મન થાય કે ‘ભાઈ ! રહેવા દો તમારો કેશરનો ચાંલ્ટો, અમારે એવાં સ્વાગત જોઈતા નથી.’ પરંતુ સંસારમાં પુણ્ય ભેગા પાપનો ઉદ્દ્ય હોય ત્યાં કોને ના કહેવા જાય ? પૈસાનું પુણ્ય હોય, પરંતુ સાથે નિઃસ્તાનતાનો પાપોદ્દય હોય. અથવા સંતાનનું પુણ્ય હોય, પરંતુ નિર્ધનતાનો પાપોદ્દય હોય આ કલંકિત પુણ્યોદ્દય છે. કદાચ બંને પુણ્ય છે. પરંતુ રોગ પરાધીનતા, આ બીજા અંતરાયનો ઉદ્દ્ય હોય; તો ય એ કલંક છે. સુર કોયલ જેવો પણ રૂપ કદ્દુપુ હોય, યા રૂપ દેવકુંવર સમાન, પરંતુ અવાજ ભેંસાસુર જેવો મળ્યો હોય તો એ પણ કલંકિત પુણ્ય. કદાચ ચક્વર્તિપણામાં કે ઈદ્રપણામાં પુણ્યની રેલંછેલ મળી તો પણ એ દિવસ એનો અંત હોય છે. માટે એ પુણ્ય ખૂટી જાય અને સમૃદ્ધિ જાય એ પણ વિટંબણા છે.

(૬) વળી સંસારમાં કર્મ-આવરણોને લીધે આત્માની અનંત શાનદર્શન, અનંત વીર્ય, અનંત સુખ વગેરે સમૃદ્ધિ દબાઈ જાય છે. માટે સંસાર વિટંબણા છે, સન્માન નહિ. અનંતજ્ઞાન-સુખ જીવના સ્વભાવમાં છે, પરંતુ સંસારમાં એ દબાઈ ૧૦૨ ભુવનભાનુ અન્સાઈકલોપીયા-“સંસારમાં કેવી કેવી વિટંબણાઓ છે”(ભાગ-૪૪)

ગયાથી જીવની કંગળ દશા કેવી, કે સામેનું થોડું ય દેખવા માટે આંખની ભીખ માગવી પડે; એમ થોડું મીઠાશનું સુખ લેવા વિષયની ભીખ માગવી પડે; ‘સાકર ! મીઠાઈના હુકડા ! તું જરા મારી જલ પર આવ, મને જરા મીહું મીહું લાગે.’ આ કેવી દુર્દશા છે ? એ કરનાર કર્મસંયોગરૂપ સંસાર છે. માટે એ વિટંબજા

(૭) એવા સંસારમાંય દુઃખ ધણું સુખ બિન્દુ જેટલું. ચારે ગતિઓનાં દુઃખ શાસ્ત્રકારોએ વર્ણાયા છે, એ વાંચતા સંસારની દુઃખરૂપતા જ દેખાય સુખ તો બાબ્ય જવેરાત વગેરે કે અનુકૂળ સ્વસ્થતા, મસ્તી, નિશ્ચિત આહ્લાદ હોય એ છે. જ્યારે, જીવને દીનતા, ઈર્ઝિં, મદ-ઉન્માદ, રોષ, શોક-ઉદ્ઘેગ, ચિંતા વગેરે સ્મરણ કે વિચાર માત્રથી એવા પીડતા રહે છે, કે શાન્તિ વગેરે તો ક્યાંય ગૂમ થઈ જાય. વૈભવી દેવ પણ એમાંથી બાદ નથી. કહો, એનું બાબ્ય સુખઃદુષને ઊભું કરે છે. માટે સંસાર દુઃખરૂપ છે, એ જીવની વિટંબજા જ છે.

(૮) સંસારમાં કર્મની પરાધીનતા છે મોટી વિટંબજા છે. મોટો ચમરબંધી દેવ હોય, છતાં કર્મના ઉદ્ય આગલ એનું સ્વાતંત્ર્ય નહિ. ખુદ તીર્થકરદેવને પણ કર્મની પરાધીનતા વેઠવી પડે મહાવીર પ્રભુને લાખો દેવતા સેવામાં હાજર છતાં કર્મના ઉદ્યે ગોશાળાની તેજોલેશ્યાની જાળ વેઠવી પડી એ વિટંબજા જ ને ? એમ પ્રભુને અંતે ઈંગ્રે જીવનદોરી બે ઘડી લંબાવવા વિનંતી કરી, તો પ્રભુએ ના કહેતાં કહું કે ‘એ તો આયુષ્ય કર્મ આધીન છે, ને અમારે હવે એ ભોગવાઈને પૂર્ણ થયું છે. તેથી જીવનદોરી વધારી શકાય નહિ.’ આ શું ? સંસારમાં કર્મની પરાધીનતા કે જીવ આયુષ્ય કર્મથી વધારે જીવી શકે નહિ. આમ સંસાર છે ત્યાં સુધી જો કર્મની ગુલામી છે, તો એ સંસાર વિટંબજા જ છે.

(૯) સંસારમાં અનેક પ્રકારની ઉપાધિ વળ્ગે છે, સ્વારથિયા સગ-સ્નેહી મળે છે, શરીર ધન-યૌવન આદિ નાશવંત મળે છે. અને એના કારણે વિવિધ આધિ યાને ચિંતા રહે છે. એથી સુખ દુઃખ મિશ્રિત બને છે; એ અસલમાં નિર્ભેળ અનંત સુખના માલિક જીવને માટે વિટંબજા નથી તો બીજું શું છે ?

(૧૦) સંસાર યાને ધરવાસમાં નિર્દોષ સ્થાવરકાય જીવોનો સંહાર કરવો પડે છે. વનસ્પતિ-અજિન-પાણી વગેરેના અસંખ્ય જીવોનો સંહાર કરવો પડે છે. એ તથા ૧૭ પાપસ્થાનક સેવવા પડે છે, એ પણ સમજુને વિટંબજા જ લાગે છે; તેથી એ વહેલામાં વહેલી તકે એથી છૂટવા ઈચ્છે છે. પુણિયો શ્રાવક આમ મહાસંતોષી અને સુંદર સામાયિક જિન ભક્તિની અપૂર્વ આરાધના કરનારો છતાં સંસારમાં આ જીવસંહારની વિટંબજા સમજતો હતો તેથી અલ્ય આરંભ-પરિગ્રહ રાખી એને સંસાર ત્યાગની જંખના હતી. માટે જ એનું સામાયિક મૂલ્યવંતું હતું.

(૧૧) સંસારની ઉપાધિઓ એવી કે વહાલા દેવ-ગુરુની સેવા મૂકાવી એને વેઠ કરવી પડે છે. દેવાધિદેવ અને ત્યાગી ગુરુના ભક્તને શું આ વિટંબજા ન લાગે કે મારે પરમાત્મા અને ગુરુને મૂકી ધંધો બૈરી-છોકરા, અને કાયાની પલેવણમાં અમૂલ્ય માનવસમય શક્તિ અને પુણ્ય વેડફી નાખવા પડે ? ‘અરે ! સાધુને ય સ્વાધ્યાયમાંથી ઊઠી ગોચરી જવું પડે ત્યારે એમ થાય કે ‘અહો આ કાયા-ઉપાધિની કેવી વિટંબજા કે રુડો જિનવચનનો સ્વાધ્યાય મૂકી એની સેવા માટે જવું પડે છે ! માટે ગોચરીમાં એવી નિર્દોષતા જાળવું અને પછી સ્વાધ્યાયમાં તથા ક્ષમાદિ ધર્મમાં એવી તન્મયતા રાખું, તેમ બીજી સાધુસામાચારી આવશ્યકાદિની એવી આરાધના કરુ કે ‘મારા સંસારનો જ અંત આવે. પછી આ વિટંબજા જ નહિ, ને મોક્ષમાં મારા પ્રભુની આત્મજ્યોતિમાં મારી આત્મજ્યોતિ સમાવી દઉં.’

પૂજામાં બોલો છો ને કે

‘એમ સંસાર-વિટંબજા દેખી, ચાહું ચરણ જિનયંદના રે
જિનરાજકું સદા મોરી વંદના,’

આ તો મોટી મોટી ગણતરી કરી બાકી અલગ અલગ બાબતો જોતાં સંસારની વિટંબજાઓ પાર વિનાની દેખાય. તેથી જ જીવને સંસારથી જટ છૂટી મોક્ષે જવાની ઉતાવળ હોય; જેથી પછી કોઈ વિટંબજા જ નહિ.

સીતાજીને પતિ રામ વડે વનમાં તરછોડવાનું આવ્યા પછી જ્યારે પોતાના બે દીકરા લવણ અને અંકુશે રામ લક્ષ્મણને લડાઈ આપી, ને રામ-લક્ષ્મણ જીતી શક્યા નહિ, તેમજ સીતાજીએ અજિનપ્રવેશનું દિવ્ય કરી બતાવ્યું, ત્યારે એમનો ભારે જ્ય-જ્યકાર થયો. હવે અતિ માનબેર રહેવાનું આવ્યું ત્યારે ન રહેતાં એમણે ચારિત્ર માર્ગ કેમ લીધો ? આવી કોઈ વિટંબજા જોઈ હશે ને કે,-

સીતાજીએ સંસારની શી વિટંબજા જોઈ ? :-

(૧) રામચંદ્રજી જેવા સુયોગ્ય પુરુષને પતિ કરવા છતાં વનમાં તરછોડવાનું પડ્યું એ પતિ કરવાનો લોભ ખોટો, મૂળમાં પરમાત્માને મૂકી એવા લૌકિક પતિ કરવા એજ વિટંબજા છે. માટે હવે એ વિટંબજાથી છૂટી અનંત કલ્યાણકર પરમાત્માની જ ઉપાસનામાં લાગ્યું. વળી,

(૨) કોઈ એવા પૂર્વના કર્મના લીધે અપયશ અને વનમાં તરછોડવાનું આવ્યું. તો કોને ખબર હજુ આત્મામાં બીજા એવા કેવા ય કર્મો પડ્યા હોય કે જે નિરનિરાળી વિટંબજા આપે ? માટે હવે તો એ કર્મોનો નાશ કરવામાં સમર્થ એકમાત્ર સર્વવિરતિ-સંયમ અને તપના માર્ગને જ ભજું, સમસ્ત સંસારની વિટંબજાનો અંત આવે.

આમ સંસાર વિટંબજાથી છૂટી એમને મોક્ષે જવાની ઉતાવળ થઈ તો તરત

દીક્ષા લીધી, અને અહિસા-સંયમ-તપની એવી આરાધના કરી કે એ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને તરતમાં બારમાં દેવલોકના હૃદ અચ્યુતેન્દ્ર થયા. પૂછો,

પ્ર.- મોક્ષ પામવાની ઉતાવળ હતી તો મોક્ષ કેમ ન પામ્યા ?

ઉ.- મોક્ષ પામવા માટે વીતરાગ બનવાની આરાધના જે કરવી જોઈએ એ આયુષ્ય આદિની કમીનાએ સંપૂર્ણ ન થઈ શકી, તેથી તરત મોક્ષ ન પામ્યા. બાકી મોક્ષે જવાની ભારે તમજા અને ઉતાવળ તથા પ્રયત્ન હતા તો જ એવા મહા માનવંતા પણારાણીપદ અને મહા માતૃભક્ત લવણ-અંકુશની ભક્તિ લેવાનું મૂકી દઈ સંસારત્યાગ અપનાવ્યો, તેમજ સંયમ આરાધના પણ જવલંત કરી શક્યા, જેથી મહા માનવંતુ અચ્યુતેન્દ્રપણું પામ્યા.

વાત આ છે કે, તમારે મોક્ષે જવાની ઈચ્છા તો હશે, પણ ઉતાવળ છે' એ હોય તો મનને એમ થાય કે 'મારે મોક્ષે જવાની ઉતાવળ છે ? અને કોધાદિ કષાય કરું તો એટલો સંસાર લંબાવવાથી મોક્ષે જવામાં એટલો વિલંબ થાય, માટે એ કોધાદિને દાબું, અટકાવું, કોધને અટકાવવા માટે આ વિચારણા એક આલંબન છે. આ વિચારણાને વારંવાર મનમાં પલોટાવી દિલને અનાથી ભાવિત કરવું જોઈએ. દિલ ભાવિત થયું હોયતો કોધનો પ્રસંગ આવતાં જ મારે તો મોક્ષે જવાની ઉતાવળ છે, અને કોધથી તો સંસાર વધે.' એમ સાવધાની આવી જાય અને કોધને ઉઠતો જ અટકાવવાનું કરાય જેથી એ ઉઠવા જ ન પામે.

જાણ્યું તો ખરું, પણ એથી દિલ ભાવિત કર્યા વિના પ્રસંગે એ સાવધાની ન આપે; 'દિલ ભાવિત કરવું ?' એટલે સમજો છો ? તત્ત્વના કેટલા ય વિચાર આપણે જાણતા હોઈએ છીએ પરંતુ એ અવસરે કામ કેમ નથી લાગતા ? જાણ્યું કે જગતના જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવ રાખવા જેવો છે. આ જીવન જીવાની સુવાસ આ છે કે અનાદિના ચાલી આવતા દ્રેષ વેર વિરોધ કુરતા વગેરેને હવે વોસ્સિરાવી મૈત્રીસ્વભાવ બનાવીએ જેથી અહીં શાંતિ અનુભવાય અને આ ભવ પછી આગળ શુભ પરંપરા પામીએ. આટલો તત્ત્વ વિચાર જાણ્યો તો ખરો, પરંતુ તેવા પ્રસંગોમાં મૈત્રીભાવ ભૂલીને બીજા પ્રત્યે હૈયામાં કેમ દ્રેષ વેર વિરોધ ઘલાય છે ? કોઈ સમજાવે તો ય સમજવા તૈયાર નહિ. શું કારણ ? આ જ કે એ તત્ત્વવિચાર વારંવાર હૃદયથી કરી કરીને દિલને અનાથી ભાવિત નથી કર્યું. અર્થાત દિલમાં એવો પરિણામ નથી ઉભો કર્યો. દિલ મૈત્રીની રટણાવાનું મૈત્રીના સ્વભાવવાનું, મૈત્રીના રંગવાનું, ઢાળવાનું પક્ષપાતવાનું નથી બનાવ્યું. આંતર રુચિથી વારંવાર એ તત્ત્વવિચાર દિલમાં પલોટાવ્યા કરીએ તો દિલ એથી ભાવિત થાય, રંગાય; પછી દિલ બોલે કે 'અમૈત્રી થાય જ નહિ. મારે ને વૈર-વિરોધ-દ્રેષ ? છટ એ મને

ભુવનભાનું અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો: ધૂતવાનો મોક્ષો”(ભાગ-૪૪) ૧૦૫

બંધ બેસે જ નહિ, મારાથી એ થાય જ કેમ ?'

બસ, દિલ ભાવિત થાય એ રીતે વારંવાર આ વિચાર કરવાનો કે જો કોધાદિ કષાય કરું તો મારો મોક્ષ દૂર કેલાય. મારે તો મોક્ષ પામવાની ઉતાવળ, આવું ભાવિત કરવાનું, બીજા અભિમાનાદિ કષાયો, વધુ પડતી ખાનપાનની લપ, રૂપ-રસાદિ વિષયોની ઘેલધા, અને વધુ પડતા પરિગ્રહબંધન અને વધુ પડતી આરામી અંગે પણ, કરવાનું કે મારે મોક્ષની ઉતાવળ છે, તો આ બધી લપ-બંધન-ઘેલધાને કાં પોષું ?' વારંવારની આ ભાવનાથી અવસરે એથી બચાય.

(૧૫) કોધને દબાવવા વળી એક વિચાર આ છે, કે અહીં મને વિશિષ્ટ બુદ્ધિ શક્તિ મળી છે, અર્થાત-બુદ્ધિનું રસાળ ક્ષેત્ર મળ્યું છે.

એમાં વાવેલાં સારાં નરસાં બીજની પછી મોટી વડવાઈ થઈ મબલખ પાક ઉતરે છે, તો કોધાદિ કષાયો અને આહારાદિ સંજ્ઞાઓના આ માનવ બુદ્ધિક્ષેત્રમાં વાવેતર કર્યે ગયા પછી ભવાંતરે એ કષાયો અને સંજ્ઞાઓની મોટી વડવાઈઓ થશે. ને એને ભરપૂર પાક ઉતરવા રૂપે જાલિમ કષાયો-સંજ્ઞાઓભર્યા જીવન બનશે એ કેમ પાલવશે ? અને ત્યા પછી એ શે કાબુમાં આવશે ? એના પર પાપાચરણ કેવાં, કેટલાં ? બસ, આ બધા પરિણામથી બચાવ કોધ ન કરું.

આપણી નજર સામે પ્રાણી જગત દેખાય છે ને ? એમાં જુદી જુદી જાતના જીવો કેવા કષાયોમાં અને કેવી આહારસંજ્ઞા વિષયસંજ્ઞા વગેરેમાં પડેલા છે ? એક કીડી ની જાતને પરિગ્રહ સંજ્ઞા કેવી ? આખો દિવસ શોધતી જ ફરે, ને ઈષ મળ્યું તે દરભેગું કરવા મથતી હોય. માઝી-મય્યર-મંકોડાને ખાવાની સંજ્ઞા કેવી ? જીવનમાં એ ખાતર ભમવા સિવાય ને મળ્યું તે આરોગ્યાં સિવાય બીજું કાંઈ કામ જ નહિ ગિરોળી બિવાડી વાધ વરુ વગેરેના શિકાર પ્રત્યે શત્રુભાવ કેવો ?

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૨૦, અંક-૬, તા. ૮-૧૦-૧૯૭૧

નાના મોટા એકેક જીવના જીવન પ્રત્યે જોઈએ તો દેખાય કે આહાર વિષય એક યા બીજા કષાય, પરિગ્રહ, આરામી વગેરે પૈકી કોઈની સંજ્ઞાથી જીવન વ્યાપ છે. એની પાછળ પાપાચરણ પણ કેવાં કેવાં થાય છે ? જીવન પર જોખમ હશે તો ય પાપાચરણ નહિ મૂકે. મય્યરને ઉડાડ ઉડાડ કરો તો પણ આવી આવીને શરીર પર બેસી કરક્યા કરશે, સંભવ છે એમાં લયલીન થઈ ગયો ને માણસના હથની અચાનક ઝાપટ વાગી તો ખત્મ જ ને ? પથારીમાં માકણ કેટલા મરે છે ? કેમ વારું ? જીવન પર જોખમ છતાં અજ્ઞાનતાનાં કારણો એનું ભાન નથી ને

૧૦૬ ભુવનભાનું અન્સાઈક્લોપીડિયા-“સંસારમાં કેવી કેવી વિટંબણાઓ છે” (ભાગ-૪૪)

આહારસંશાની વડવાઈ ઊગી છે એનાં કારણે માણસનું લોહી પીવું છે.

વિચારવાનું આ છે કે આ નાના જીવોમાં આ રસ, આ લત, આ ભાવ કર્યાંથી આવ્યા ? કહે,

આ નાના જીવો કે પંચેન્દ્રિય પશુ-પંખી પૂર્વ કોઈ ભવમાં મનુષ્ય થયેલા; ત્યાં રસાળ બુદ્ધિક્ષેત્રમાં આહારાદિ સંશાઓની ના કષાય સંશાના વાવેતર કરેલા; એની વડવાઈ ઊગી ગઈ, તે એના હવે ભરચક પાક ઉત્તરી રહ્યા છે, એટલે એમનાં સમસ્ત જીવન જ સંશામય બન્યા છે.

પ્રાણીસૂષિને જોતાં આવે તો એની દુર્દર્શા પર આ વિચાર આવે કે ‘અહો ! આ જીવ એક વાર મારી જેમ મનુષ્યભવ પામેલા, ત્યાં આવા ખાનપાન વિષયો પરિચાલ રગડા-જગડા ઈર્ધ્યા-ગુમાન વગેરે વગેરેના જ ધંધા કર્યા હશે, તે બિચારાને આવા હલકા ભવ મળ્યા, ને અહીં એનાં જ જીવન બન્યા છે, તો હું કેમ ગાફેલ છું ? હું ય આ મનુષ્ય ભવમાં શું કરી રહ્યો છે ? બુદ્ધિક્ષેત્રમાં શું વાવી રહ્યો છું ? જે વાવું છું એની જ વડવાઈઓ થશે ને ?

મોટા કલ્પવૃક્ષ ઉગાડનારી રસાળ જમીન કરતાં પણ બુદ્ધિરૂપી જમીન કેઈ ગુણ સતેજ રસાળ છે. માત્ર એમાં કલ્પવૃક્ષના બીજ જેવા ઉત્તમ ઉમદા વિચારો-ભાવનાઓ-વૃત્તિઓનું વાવેતર કરવું જોઈએ.

ભૂમિ તો બહુય રસાળ હોય, પરંતુ એમાં જેરી બીજનું વાવેતર થાય તો એમાંથી વિષવૃક્ષો જ ફાલેકૂલે. એમ, માનવ જનમની રસાળ બુદ્ધિભૂમિમાં અધમ પાપી વિચારો, અધમ ભાવનાઓ, અને નીચ વૃત્તિઓનું વાવેતર થાય તો એના પર એજ વિષમય અધમ વિચારો-વૃત્તિઓની જ વડવાઈઓ થવાની ને ? અધમ અને ઉત્તમ વિચારો ભાવનાઓ વૃત્તિઓ કઈ કઈ તે સમજી લો, સમજીને એનો વિવેક દિલમાં અંકિત કરી લો.

અધમ-ઉત્તમ વિચાર ક્યા ક્યા ?

ઇન્દ્રિયોને ગમતા અણગમતા વિષયોના રાગ, દ્રેષ્ભર્યા વિચાર એ અધમ વિચાર છે. ‘આ રૂપ સારું પેલું ખરાબ; આ ચીજ ટેસ્ટદાર, પેલી ઠમ-કલાસ, આનો સ્પર્શ સુંવાળો, પેલો તો બહુ બરછ્યા;’...આવા આવા વિચાર અધમ છે. એમ, ‘આપણાને તો પિક્ચરના સંગીત બહુ ગમે આપના દેરાસરોમાં તો ભાઈસાબ ! ભારે કોલાહલ ! પૂજાઓ પણ પુરાણી સાવ નીરસ પદ્ધતિએ બોલાય,’- આ વિચાર શ્રોત્રેન્દ્રિયના ગમતા અણગમતા વિષયનો રાગ-દ્રેષ્ભર્યા હોઈ અધમ વિચાર છે. ત્યારે,

આત્માનો હિત અહિતની દાખિએ વિચાર એ ઉત્તમ વિચાર છે, ભલે તે

ભુવનભાનુ અન્સાઈકલોપીયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો”(ભાગ-૪૪) ૧૦૭

ઇન્દ્રિયના વિષયનો હોય. દા.ત. પ્રભુની વાણી બહુ મીઠી, એનાથી કલ્પવૃક્ષની વેલડી અને દ્રાક્ષ પણ મીઠાશમાં હારી ગઈ. કવિ કહે છે.-

“જિનમુખ દીઠી વાણી મીઠી સુરતરુ-વેલડી,
દ્રાક્ષ વિહાસે ગઈ વનવાસે, પીલે રસ શેલડી,
સાકર સેતી તરણાં લેતી મુખે પશુ ચાવતી,
અમૃત મીઠું સ્વર્ગ દીઠું સુર વધુ ગાવતી.”

અર્થાત् જિનેશ્વર ભગવાનનાં મુખમાં વાણી મીઠી જોઈને હારી ગયેલી (૧) સુરતરુ-કલ્પવૃક્ષની વેલડી, ‘વિહાસે’-‘વિહાયસે’ આકાશમાં દેવબગીચામાં ચાલી ગઈ, અને (૨) દ્રાક્ષ વનવાસમાં ગઈ, (૩) શેરડી (આપથાત કરવા કોલુમાં પેઠી તે લોકો એને) પીલીને રસ કાઢે છે; (૪) સાકર તો બિચારી સીદાઈ જ ગઈ, અને (૫) મીઠાં, તૃશુ-ઘાસ-જનાવરના મુખમાં જ પેસી ગયા તે પશુ અને આવે છે. (૬) મીઠું અમૃત પણ સ્વર્ગમાં નાસી ગયેલું જોવામાં આવ્યું. આવી આ બધાને મીઠાશથી હરાવનારી જિનવાણીના સુરવધૂ-અપ્સરાઓ ગુણ ગાય છે.

આ શું કર્યું ? જિનવાણીની મધુરતાની પ્રશંસા કરી. પરંતુ કઈ દાખિએ ? આત્માના હિતની દાખિએ. ભવ્ય જીવો ભલે કાનને મીઠી એટલે ઇન્દ્રિયની દાખિએ હિતકર પણ આ વાણી સાંભળીને એમાંથી શું પામે છે ? ત્યાગ; વૈરાગ્ય દ્યા, સંયમ, શ્રદ્ધા, ઉપશમ વગેરે જ ને ? કારણ કે જિનવાણીને આ જ કહેવાનું હોય છે માટે એ આત્મહિતની દાખિએ ઉત્તમ થઈ.

એમ જિનમૂર્તિ બહુ ભવ્ય આકર્ષક; એની આગળ મોટા ઈંગ્ર-ઈંગ્રાણીનાં રૂપ પણ વિસાતમાં નહિ, એમ જિનમૂર્તિનાં રૂપના ગુણ ગાયા, તે પણ આત્મહિતની દાખિએ; કેમકે ઈંગ્ર-ઈંગ્રાણીના રૂપ આમ ગમે તેવા દિવ્ય રૂપાળાં પરંતુ એ રાગ કરાવનારા ને રાગથી સંસાર વધે. ત્યારે જિનમૂર્તિ એટલે વીતરાગ પ્રભુની મૂર્તિ ઉપર શાંતરસ ઉપશમરસ વીતરાગતા નીતરતી હોય છે. એ જોનારની કષાય અને વિષયવૃત્તિઓને શાંત કરી સંસાર ટૂંકો કરી આપે છે.

વાત આ છે કે કોઈપણ વિચાર આત્માને ભૂલીને માત્ર ઈંગ્રિયોને સારો નરસો લાગવા પર હોય, તો તે અધમ છે, જ્યારે આત્માના હિત અહિતની દાખિએ હોય તો તે ઉત્તમ છે. હીરો કિંમતી, ખુબ સુંદર, એ વિચાર અધમ છે, પરંતુ હીરો કિંમતી શું ? જેટલો કિંમતી અને બહુ સુંદર દેખાય છે એટલો જ એ ભયંકર રાગ-મમતા કરાવી આત્માને બરબાદ કરનારો છે....મમ્માણ શેઠ એવા હીરાની મમતામાં સાતમી નરકે ગયો;’ આમાં હીરાની સુંદરતાનો વિચાર આવ્યો ખરો, પરંતુ આત્માના ભયંકર અહિત કરનાર તરીકે, તેથી એ ઉત્તમ વિચાર છે.

૧૦૮ ભુવનભાનુ અન્સાઈકલોપીયા-“સંસારમાં કેવી કેવી વિઠંબણાઓ છે”(ભાગ-૪૪)

પામર જીવ પ્રભુ પર ક્યારે આકષર્ય ? :-

અથવા ભગવાનનો હીરાનો હાર હીરાની આંગી સુંદર બની આ વિચાર ઉત્તમ વિચાર છે, કેમકે એમાં આત્મહિતની દાખિ છે. ભગવાનનો આવો સરસ હાર યા આંગી વીતરાગ પ્રભુની ભક્તિ છે. પ્રભુનાં સત્કાર સન્માન છે; ને એ સુંદર કેમ ન હોય ? પ્રભુ અતિશય સારા સુંદર અને હંડ્રોએ પૂજેલા, તો એમનો હાર આંગી એવા હોવા જ જોઈએ. તેમજ એ જોઈને દર્શનો કરનારનું મન વીતરાગ પ્રભુ ઉપર જવાનું. સંસારના પામર જીવોને વીતરાગ પ્રભુ પર મન જ કયાં જાય છે ? એ તો સરસ આંગી રચી હોય, તો એ નિમિત્તે પ્રભુનાં દર્શન આવે છે, તો મન સહેજ પણ વીતરાગ પ્રભુ પર જાય છે, આ બધો વિચાર ઉત્તમ વિચાર છે.

ખૂબી આ છે, તમે કહો છો ને કે ‘સાહેબ ! સંસારમાં બેઠા એટલે વિષયના વિચાર તો ડગલે ને પગલે આવી જાય છે ! પરંતુ જો એને આત્મહિતની દાખિએ જોવા વિચારવાનું કરે તો એ વિચાર અધમ મટીને ઉત્તમ બને છે. ‘બંગલો સરસ બંધાયો’ એ વિચારને લંબાવીને એમ વિચારો કે ‘પણ આ જેટલો સરસ એટલા જ બહુ સાવધાન રહેવાનું છે, કેમકે આ જ અતિશય રાગ મમતા કરાવી કરાવી રાગના કુસંસ્કારોના દેર વધારશે, ને કાળાં પાપ બંધાવશે.’ તો એ ઉત્તમ વિચાર બની જાય અથવા એમ વિચારો કે ‘કમનસીબી છે, કે આ પાપ ઘરવાસનો બંગલો છે. જો આ દેરાસર કે પોષધશાળા હોત તો ખુશનસીબીની વાત હતી,’ તો પણ એ ઉત્તમ વિચાર બને.

વિષયના વિચારમાં બધે જ આત્મહિતની દાખિ જોડી ઢો, જોડી ટેવાનો અભ્યાસ રાખો, અભ્યાસ કરતાં કરતાં પછી વિચારમાત્રને આત્મહિતની દાખિ આપવાનું સહજ સ્વભાવિક સરળ બની જશે.

દા.ત. પત્ની સારી સેવાકારી અને આમન્યાધારી મળી, તો એના વિચારની સાથે જ મનને થશે કે હું બહુ સાવધ બની જાઉં. અને એની સેવા આમન્યાનો ગેરલાભ ઉઠાવી એને વધુ રાગ-મોહ-આસક્તિમાં પાડનારો ન બનું. મારા નિમિત્તશી આ બિચારો જીવ વધુ રાગ વધુ પાપમાં શા માટે પડવો જોઈએ ? હું ય મરું ને બીજા જીવને ય મારું ? ના, કમમાં કમ મારે બીજાને પાપમાં ન પ્રેરવા.’ આવો વિચાર ઉત્તમ બની જાય. બાકી તો પત્નીના એકલી સેવા-આજ્ઞાકિતતાની સુંદરતાનો વિચાર કામવાસનાના ઘરનો અધમ વિચાર બનશે.

અહીં બુદ્ધિ ક્ષેત્ર રસાળ મળ્યું છે. એમાં ઉત્તમ વિચારોનું વાવેતર કર્યું જવાનું છે. વિષયોના વિચારને આત્મહિતની દાખિના બનાવવાના છે. દા.ત. રસપૂરીનું ભોજન મળ્યું, મનને થયું કે, ‘સુંદર ભોજન મળ્યું,’ તો એની સાથે તરત

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કૃત્યા રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૧૦૮

વિચાર આત્મહિતનો લાવવાનો; જેવો કે, (૧) ‘પરંતુ એ તો જીહ્વા હંડ્રિય અને કાયાને ઉજાડી, બાકી આત્માને તો ખોટનો ધંધો; બીજી બાજુ રાગના જેરી સંસ્કાર વધ્યા. ચિકણાં પાપકર્મનો ઉમેરો થયો.’ અથવા

(૨) ‘ભોજન જેટલું સુંદર, એટલું જીવનું રસત્યાગ, આંબેલ, વગેરે કરવાનું સત્ત્વ હથાયું.

હવે હટ આંબેલ તો શું, પણ તિથિના દિવસે ય કેળા-કેરીની લીલોતરી છોડવાનું મન નહિ થાય, અગર ત્યાગ થશે તો ય પરાણે. તે બીજે દિવસે સાંદું વાળવાનું મન થશે, એમ વિચારાય

અથવા કમમાં કમ એ વિચાર પણ આવે કે ભોજન સુંદર લાગે એ તો જિલ્બાની ગુલામી છે, પરંતુ હવે એ વધાયું છે તો એના વળતરરૂપે કાલે ત વિગઈ ત્યાગ રાખીશ, યા ૧૦૦ લોગસ્સનો કાઉસ્સંગ કરીશ, અથવા રૂપિયો પ્રભુભક્તિમાં ખરચીશ, કે ૫-૧૦ દેરાસરે દર્શન કરી આવીશ,’

ઉત્તમ વિચારનું બળ કેમ ઊભું થાય ? :-

આમ વિષયના વિચારને એક યા બીજી રીતે આત્મહિતની દાખિનો બનાવવા તરફ લક્ષ રહેવું જોઈએ. એમ કહેતા નહિ કે ‘માત્ર એટલા વિચારથી શું વળે ?’ કેમકે વિચારો તો સંસ્કાર પાડે છે આજ સુધી એકલી હંડ્રિયોના ગમતા અણગમતા તરીકેના જ વિચારો કર્યે રાખ્યા છે. માટે તો એના સંસ્કારો ઘેરા પડ્યા છે, ને તેથી ડગલે ને પગલે વિષયોના જ વિચાર આવે છે. એટલે જો હવે આત્મહિતની દાખિએ જ વિચાર કરવાનું રાખશો તો એના સારા સંસ્કારો ઉત્તમ વિચારો માટેનું બળ ઊભું કરશે, ને ઉત્તમ વિચારોને સુલભ બનાવશે.

અધમ વિચારો જેમ વિષયોના, તેવી રીતે ખાનપાનના અને પરિગ્રહના ય હોય, તેમજ કષાયોના કે હિંસાઈ પાપોના પણ હોય.

કયો એવો દિવસ હશે કે જ્યાં ખાનપાનનો વિચાર નહિ આવ્યો હોય ? આજે તો સવારે ઊઠે ત્યાંથી ચાહપાણીનો વિચાર આવે છે. ચાહ પીએ ત્યાં ‘આ ગરમ કે ઢાંકી કડક કે ચાલુ ગળી કે ફીકીનો વિચાર આવે છે ! ભોજન જભ્યા પહેલા જમતાં, જભ્યા બાદ ભોજનના કે ભોજનની ચીજનો વિચાર આવે છે. આ વિચારમાં જો આત્મહિતની દાખિનો કોઈ સંબંધ નથી તો એ અધમ વિચાર બને છે. માણસ ભોજન અંગેની ચર્ચા માંડે છે ત્યાં વિસ્તાર કરવા જોઈએ છે. એમાં કોઈ સંકોચ કે અફ્સોસ નહિ. એ વખતે મનમાં એના વિચાર કેવા ચાલતા હોય ? ત્યાં હરામ, આત્મહિતના વિચારને કસી લેવા દેવા હોય તો.

‘બુદ્ધિક્ષેત્રમાં શું રોપશો ?’

ત્યારે પરિગ્રહ ધન-માલ-રાચરચિલું અંગેના વિચાર પણ અધમ વિચાર છે આજે જરૂરિયાનો વધી ગઈ. ત્યાં એના વિચાર કેટલા ? વેપાર રોજગાર ધંધાના વિચાર કેટલા બધા ? એમાં આત્મહિતની દસ્તિએ ક્યાં છૂપાયેલી હોય ? એ નહિ એટલે એ વિચારો અધમ બને છે. ઉત્તમ નહિ.

એમ આરામી-સુખશીલતાના પણ વિચારો તેમજ ભયના વિચાર પણ અધમ હોય છે. એવા કોથ કે માન-મદ-અભિમાન, યા માયા કે લોભની વૃત્તિમાંથી ઉઠતા વિચારો પણ અધમ હોય છે.

કુચરાપદ્ધી વિચારો કેમ ચાલે છે ? એ કેમ મળે ?:-

ત્યારે માપવા જેવું છે કે દિવસ-રાતમાં અધમ વિચારોનું સામ્રાજ્ય કેવું ચાલે છે ? મન મળ્યું છે, બુદ્ધિ મળી છે. એટલે એના આ ઉપયોગ ? અધમ કુચરાપદ્ધી વિચારો ચાલ્યા જ કરે ? એનો સંસ્કાર કેવા અને કેટલા પડે ? પછી એવા સંસ્કારોના જુથના જુથ હોય એની અસર નીચે ધર્મ મ્રવૃત્તિ પણ એવા કુચરાપદ્ધી વિચારથી અલિમ શી રીતે રહી શકે ? એ તો પહેલાં કહ્યું તેમ (૧) આત્માના કલ્યાણની દસ્તિ મુખ્ય રાખી હોય, અને (૨) એવા વિચારોને પલટાવીને આત્મ કલ્યાણના ઘરના બનાવ્યા હોય, તો ખોટા સંસ્કાર ન પડે (૩) અધમ વિચાર કદાચ આવી ગયા, તો તરત એના પર પછી એ અંગે પારાવાર અફ્સોસી ચાલે, અને (૪) એથી વિપરીત આત્મહિતના ભરપૂર વિચાર ચલાવ્યા કરતા હોઈએ તો પેલાની કારભી અસરથી બચાય બાકી તો બુદ્ધિક્ષેત્રમાં એવા અધમ ને અધમ વિચારોનાં વાવેતર આગળ પર એની મોટી વડવાઈઓ ઊગાડે.

અધમ વિચારોની જેમ અંતરની કખાયની વૃત્તિઓ પણ ચાલતી હોય, એ ય અધમ હોય છે. આ વૃત્તિઓ ઘર કરી ગઈ હોય છે કે બીજા ગ્રીજા કામ ચાલે પણ અંદરખાને એક યા બીજા કખાયની વૃત્તિ કામ કરતી હોય છે. માણસ કોઈની સાથે વાત કરે એમાં ય ગર્ભિત કખાયની વૃત્તિ હોય, કાં રાગની કાં દેખની, કાં માનની કાં દીનતાની. અરે ! જીવની આ કેટલી બધી કગાળ દશા કે કોઈ પણ વસ્તુનું દર્શન, યા શ્રવણ, કે સ્મરણ થાય તે રાગ યા દ્વેષ વગેરે અધમ વૃત્તિથી લગભગ ખરડાયેલું જ હોય ?

ઉત્તમ વૃત્તિઓ કઈ કઈ ?:-

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

ઉત્તમ વૃત્તિઓ (૧) કખાયના ઉપશમની હોય, ક્ષમા-સમતાની, નમ્રતા-મુહુતા-લધુતાની, નિષ્ઠપટતા સરળતાની યા નિર્લોભતા-નિસ્પૃહતા અનાસક્તિની હોય. એમ, (૨) મૈત્રીભાવની, કરુણાની, ગુણપ્રમોદની કે પરપંચાત પ્રત્યે ઉપેક્ષાભાવની વૃત્તિ પણ ઉત્તમ વૃત્તિ છે. (૩) એવી વૈરાગ્યની, (૪) પ્રભુભક્તિની, સાધુસેવાની, દેવ-ગુરુ-બહુમાનની એમ, (૫) જીવદ્યાની અહિસાની સત્યની બ્રહ્મયર્થ-સદાચારની વૃત્તિ પણ ઉત્તમ વૃત્તિ છે. દિલમાં ચાહીને આવી વૃત્તિઓ ખૂબ ખૂબ કેળવીએ તો અધમ વૃત્તિઓ પર અંકુશ આવે, કાપ પડે; એ ઓછી થતાં થતાં ઘસારે પડવા માંડે.

ત્યારે વિચારવા જેવું છે કે જો આ ઉત્તમ ધર્મ વૃત્તિઓનું લક્ષ જ નથી, આવા ઉંચા જીવનમાં એવી ઉંચી ઉમદા વૃત્તિઓ ઘડી લેવાની કોઈ પરવા જ નથી, તો બુદ્ધિક્ષેત્રમાં અધમ વૃત્તિઓ ઘડી લેવાની કોઈ પરવા જ નથી, તો બુદ્ધિક્ષેત્રમાં અધમ વૃત્તિઓ વવાઈ વવાઈને આગળ ભવિષ્ય કેવું ઊભું થશે ? કોથ કખાયને પણ રોકવા માટે આ એક વિચાર રહે કે બુદ્ધિક્ષેત્રમાં કોથની વૃત્તિ અને વિચારોનાં વાવેતર કરેલા કેટલા એના ભયાનક ઝડ ઝડ કરશે ?

વીતરાગ શી રીતે બનાશો ? :-

શું બુદ્ધિક્ષેત્રમાં ક્ષમાદિની મૈત્રી કરુણાદિની વૈરાગ્યની દ્યાદિ ને દેવગુરુ બહુમાન વગેરેની વૃત્તિઓ કેળવવાની જરૂર જ નથી એનો કશો પ્રયત્ન નહિ? ને વિષય કખાયાદિની અધમ વૃત્તિઓ જ વાયે જવાનો ધરખમ ધંધો ચાલુ ?

ભલે કદાચ જીવન જીવતાં પ્રસંગે કોથ અભિમાન વગેરે કરવું જરૂરી લાગ્યું, એ કર્યા વિના ન રહેવાયું, છતાં પણ એવા પ્રસંગ સ્થિવાયના સમયમાં અંતરમાં ક્ષમાદિની વૃત્તિ કેળવીએ તો કાંઈ બગડી જાય ? શું મનને એમ ન થાય કે,-

‘અરે જીવ ! આ માનવકાળ એ તો તારા માટે સોનેરી કાળ છે. એમાં ઉત્તમ ક્ષમાદિ મૈત્રી આદિની વૃત્તિઓ નહિ કેળવે તો પછી એ ક્યાં ક્યારે કેળવીશ ? શું ક્યારે ય તારે વીતરાગ નથી બનવું ? વીતરાગ બનવાનું અંતરમાંથી કોધાદિની વૃત્તિઓ કાઢી નાખ્યા વિના અને ક્ષમાદિની વૃત્તિઓને પગભર કર્યા વિના થઈ શકવાનું છે ? ત્યારે ભવિષ્યમાં ક્યારેક એકી કલમે આ પવિત્ર વૃત્તિઓ ઊભી થઈ એકદમ જ ઉત્કૃષ્ટ બની જશે ! એકદમ જ રાગાદિ અધમ વૃત્તિઓને ફળાવી દઈ વીતરાગ બની જવાશે ? ના, એ તો આજથી જ એ કેળવવા માંડીશ એની માત્રા વધારતો રહીશ ત્યારે ભવોએ ઠેકાણું પડશે.’

જીવનનું મૂલ્ય ઉપજાવવા એક મહાનતાવ :-

એટલું ભૂલશો નહિ કે આ ક્ષમાદિની ઉત્તમ વૃત્તિઓ કોના સંબંધમાં ઊભી

કરવાની છે ? કોધાદિ વૃત્તિના જેને પાત્ર બનાવીએ છીએ, દા.ત. શત્રુ વગેરે, એના અંગે ખાસ ઊભી કરવાની છે.

આ બહુ મહાત્વનું તત્ત્વ છે, જીવનવિકાસ, આત્મ વિકાસ અને માનવભવનાં મહામૂલ્યે ઉપજીવવા માટે ખૂબજ ઉપયોગી તત્ત્વ છે. આને જરા સ્પષ્ટતાથી જોઈએ.

કોધની વૃત્તિ કોના તરફ રહે છે ? આપણું કોઈ કશું બગાડે, પ્રતિકૂળ કરે, કે એ દુશ્મન-વિરોધી-નિદાખોર વગેરે થાય, એના પ્રત્યે કોધની વૃત્તિ થાય છે, આપણા કોધનું એ પાત્ર બને છે. તો પછી ક્ષમા પણ એની પ્રત્યે ઊભી કરવાની છે. નહિતર આપણી સેવા કરનાર, આપણને અનુકૂળ વર્તનાર, આપણા પર પ્રેમ રાખનાર, આપણા મિત્ર થઈને રહેનાર...વગેરે પ્રત્યે શી ક્ષમા કરવાની હતી ?

એમ ગરમીના દિવસોમાં બહુ ગરમી પ્રત્યે ને ઠંડીના દિવસોમાં બહુ ઠંડી પ્રત્યે દ્વેષ થાય છે, એવી રીતે પ્રતિકૂળ રસોઈ-પાણી ચીજવસ્તુ વગેરે પ્રત્યે દ્વેષ થાય છે; એ પણ એક પ્રકારે જડ પ્રત્યે કોધ છે. તો હવે ક્ષમા યાને સહિષ્ણુતા પણ જે કેળવવી છે તે પણ આ પ્રતિકૂળ ગરમી-ઠંડી-ખાનપાન-ચીજવસ્તુ પ્રત્યે કેળવવાની નહિતર અનુકૂળ અનુકૂળ માટે શી સહિષ્ણુતા રાખવાની હતી ?

એટલે જો કોધની દ્વેષની વૃત્તિને આપણે દબાવવી છે તો એ જે જે ચેતન કે જડ પદાર્થ ઉપર થાય ખાસ તે તે પદાર્થ ઉપર આપણે ક્ષમા સહિષ્ણુતા ઉપશાંતતા કેળવવી પડે. ‘એને બાદ રાખીને બાકી જીવો પર મારે ક્ષમા છે. બાકીનાને હું ખમાંબું બાકીની જડ વસ્તુઓ પ્રત્યે મારે સહિષ્ણુતા છે, મને ઉકળાટ અરુંચિ નથી,’ એવો ક્ષમા સહિષ્ણતાનો ભાવ ન ચાલી શકે; સાંવત્સરિક ક્ષમાપના વખતે મન અહીં ભૂલું પડે છે કે એ વિરોધીને દુશ્મનને બાદ રાખીને બાકી બીજાની ક્ષમા માંગે છે, બીજાને ક્ષમા આપે છે ‘ફલાણો તો મારો વિરોધી છે, ફલાણાએ મારું બહુ બગાડયું છે, મારું ધાણું અપમાન કર્યું છે,’ એમ કરી એને એક બાજુ રહેવા દે છે આમાં કોધની વૃત્તિ શી રીતે શરે ?

ક્ષમામાંથી વિરોધીને બાદ રાખતાં કોધનું શલ્ય : એથી સાનુબંધ કર્મબંધ :
એથી કોધ પરંપરા :-

બહુ ધ્યાન રાખવા જેવી આ બાબત છે કે ક્ષમામાંથી આ દુશ્મન વિરોધી વગેરેને બાદ રાખવા જતાં એ ઉપરના કોધની દ્વેષની વૃત્તિનું દિલમાં શલ્ય પડી જાય છે; ને તે શલ્ય કદાચ જિંદગીના છેડા સુધી કાઢી નખાતું નથી, ત્યારે શલ્ય એ બહુ ભૂંડી ચીજ એ દિલમાં ખૂંચ્યું તે ખૂંચ્યું પછી એથી એ કોધ દ્વેષ વગેરે દોષનાં સાનુબંધ કર્મ બંધાય છે. દોષના ગાઢ સંસ્કાર નખાઈ જાય છે, જે પછી ભવાંતરે કોધ દ્વેષ વગેરે વૃત્તિની આવૃત્તિ સલામત રાખે છે. એટલે એ વૃત્તિ એ દોષ

ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો: ધૂટવાનો મોકો”(ભાગ-૪૪)

વારંવાર જોયા જ કરે છે. ત્યારે તે તમે એટલું જ જુઓને કે, અહીં આપણાને કોધ દ્વેષ વગેરે દોષ કેમ બહુ નડ્યા કરે છે ?

એટલા જ માટે પૂર્વ ભવોમાં એના શલ્ય દિલમાં દાટી મૂકેલા એના સંસ્કાર ગાઢ બનાવી રાખેલા. કદાચ પૂર્વે ક્ષમાદિ કરવાનો મોકો મળ્યો હશે તો ય ત્યાં કોધાદિના ખાસ પાત્રને એમાંથી બાદ રાખેલા, મનને થયું હશે કે ‘ના, એ પેલી વ્યક્તિ પ્રત્યે ક્ષમા નહિ.’ એને ક્ષમા શાની આપવાની ? એણે તો મારું બહુ બગાડયું છે.’ આમ કોધનું શલ્ય દિલમાં ખૂંચ્યું રહ્યું. પછી ભવ પલટાતાં ભલે એ વ્યક્તિ હવે કદાચ સંબંધમાં ન આવી; પરંતુ કોધનું દ્વેષનું શલ્ય સલામત છે, એ વળી બીજી અહીંની વિરોધી લાગતી વ્યક્તિ ઉપર કોધ-દ્વેષને ધમધમાવશે.

P.- પેલી પૂર્વભવની વ્યક્તિનો સંબંધ તો છૂટી ગયો, એટલે કોધનો સંબંધ છૂટી ન જાય ?

૩.- ના, કોધ દ્વેષ ઉકળાટ એ આત્મામાં વણાઈ ગયેલ અશુભ વૃત્તિ છે, અસત્તુ ગુણ છે, અવર્થા છે, પરયિ છે. એને વજી લીધા પછી તો એ જો એક પાત્ર નહિ તો બીજા પાત્ર ઉપર પરંતુ અવશ્ય ઉત્તરી પડે છે. વ્યક્તિ ગઈ, પણ દ્વેષથી ભાવિત થયેલ રંગાઈ ગયેલ આત્મા તો ઊભો જ રહ્યો એ ક્યાં જાય ?

રાગાદિનું પાત્ર બદલાવાના દિશાન્ત :-

દા.ત. જુઓ, કેરીની મોસમમાં કેરી ઉપર ખૂબ રાગ કેળવ્યો, હવે મોસમ પૂરી થઈ તો પછી એ રાગ બીજી વસ્તુ પર ઉત્તરી પડે છે ને ? એમ દા.ત. પરણેલી પત્ની પર રાગ બહુ હતો એ પત્ની ગુજરી ગઈ, ને બીજી પરણ્યા, તો પછી હવે જો એ પણ રૂપાણી ને વિનયવંતી છે તો એના ઉપર રાગ જામે છે ને ? ત્યાં ક્યાં વ્યક્તિનો હિસાબ રહ્યો ? આત્માની રાગ-દ્વેષ ઈર્ઘા વગેરેની વૃત્તિને ગમે તે પાત્ર લઈને ભાવિત કરી, દિલને એનાથી રંગી નાખ્યું, હવે એવી વૃત્તિના રંગવાળો જીવ એ વ્યક્તિ નહિ, તો બીજી વ્યક્તિ ઉપર એ વસ્તુ નહિ તો બીજી વસ્તુ પર એ રાગાદ દોષ જગાવ્યા વિના નહિ રહે.

P.- તો તો પછી આ રાગ-દ્વેષ વગેરે વૃત્તિઓનો દોષોનો અંત જ ન આવે ને ?

૩.- એટલા માટે તો આ કહેવાય છે કે

રાગાદિનો અંત લાવવા જેની પ્રત્યે આ દોષ જાગે છે, ખાસ એની પ્રત્યે એ દોષના નિવારક વૈરાગ્ય-ક્ષમા વગેરે ગુણ કેળવવાના છે.

એટલે જ આ ધ્યાનમાં રાખો કે જો ક્ષમા સહિષ્ણુતા ઉપશાંતતા ગુણ કેળવવા છે, તો તે ખાસ કરીને જે વ્યક્તિ ઉપર કોધ થાય છે, જે વસ્તુ ઉપર દ્વેષ થાય

ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“બુદ્ધિક્ષેત્રમાં શું રોપશો”(ભાગ-૪૪)

છે, એના પ્રત્યે તો ખાસ ક્ષમા-સહિષ્ણુતા-ઉપશાંતતા કેળવવી જોઈએ.

એમ, વૈરાગ્ય-અનાસક્તભાવ કેળવવો છે તો તે, જેના પ્રત્યે રાગ આસક્તિ-આકર્ષણ થાય છે, એના પ્રત્યે ખાસ કેળવવાની જરૂર છે.

એવી રીતે ગુણાનુરાગ-પ્રમોદભાવ-મૈત્રીભાવ પણ, જેના પ્રત્યે ઈર્ઝ્ય-અસૂયા (સહિષ્ણુતા)-દ્રેષ્ટ થાય છે, એની પ્રત્યે તો ખાસ કેળવવા જરૂરી.

એમ, જેની તૃષ્ણા-લોભ-મમતા પીડે છે, એ વસ્તુ પર ખાસ કરીને નિસ્પૂહભાવ-નિર્લોભતા-નિર્મળતા કેળવવી જોઈએ. દા.ત. જો સત્તા-સન્માન-આરોવાનીની તૃષ્ણા થઈ આવે છે તો એ સત્તાદિ પ્રત્યે ખાસ કરીને નિસ્પૂહભાવ નિર્મળભાવ કેળવવા જરૂરી ગણાય.

પાછા ભૂલતા નહિ, આ બધું આ ઉચ્ચ ભવમાં મળેલા બુદ્ધિક્ષેત્રમાં રોપવાનું છે. રોપવું શક્ય છે, રોપવું સરળ-સુલભ હોઈ અવશ્ય રોપવા જેવું છે,

સૌરાષ્ટ્ર ભાલ પ્રદેશની રસાળ ભૂમિ જેવું માનવ-બુદ્ધિ ક્ષેત્ર મળ્યા પછી એમાં ઘઉં કપાસ જેવા અનાસક્ત ક્ષમાદિનું વાવેતર ન થાય, તો શું બીજની ઉખર ભૂમિ જેવા પશુ કીડાનાં બુદ્ધિક્ષેત્ર મળ્યેથી થશે ?

અહીંનું બુદ્ધિક્ષેત્ર રસાળ છે સુંદર ક્ષમાદિ ગુણોના વાવેતર માટે. પરંતુ એ ક્ષમાદિગુણ કોધાદિનાં પાત્ર પ્રત્યે ખાસ કેળવવાના છે.

પત્ની પ્રત્યે કેવો ભાવ ? :-

બુદ્ધિક્ષેત્રમાં ઉચ્ચ પવિત્રતા ગુણ કેળવવો છે, તો તે કેળવવાનું કામવાસના દબાવીને થાય. તે વાસના કોના પ્રત્યેની ? માત્ર પરસ્તી પ્રત્યેની નહિ, કિન્તુ સ્વસ્ત્રી પ્રત્યેની પણ વાસના દબાવીને પવિત્રતા ગુણ કેળવાય. ‘ના, હું પરસ્તીને તો મા-બેન સમાન દેખીશ, પરંતુ સ્વસ્ત્રી તો કાયદેસર છે, માટે એમાં તો લીન બન્યો રહીશ,’ આવું ધોરણ જો રાખે તો ઊંચી પવિત્રતા ન કેળવાય. એ તો પત્ની પ્રત્યે પણ વાસનાની દિલ્લિ ભોગની દિલ્લિ પડતી મૂકવી જોઈએ. પત્નીના જ્યારે જ્યારે દર્શન થાય ત્યારે બુદ્ધિ ક્ષેત્રમાં એનાં શરીર કે એકપણ અંગ માટે આ ભોગ છે, રમણીય છે એવો વિચાર ન ઉઠવા દેવો જોઈએ. માતાના કે સણી બેનનાં દર્શન થતાં શું એવો વિચાર ઉઠે ? ના, તો બસ, ઊંચી પવિત્રતા જો ઊભી કરવી છે, બુદ્ધિ ક્ષેત્રમાં રોપવી છે, ને કેળવવી છે, તો પત્ની પ્રત્યે વાસનાની દિલ્લિ ભોગની દિલ્લિથી નહિ જોવાનું ત્યારે એના આત્મામાં જે પ્રભાવ ઓજસ-પવિત્રતા ઉત્પત્ત થાય એ અદ્ભુત હોય છે. જાણો છો ને પેથડશાનો આ આત્મપ્રભાવ ?

પેથડશાહનો આત્મપ્રભાવ :-

પેથડશાએ તર વર્ષની ભર યુવાન વયે સજોડે બ્રહ્મચર્ય ઉચ્ચર્યુ. હવે કેમ ?

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-ક્ષાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૧૧૫

તો કે પત્ની પર પણ સજોડે બ્રહ્મચર્ય ઉચ્ચર્યુ. હવે કેમ ? તો કે પત્ની પરની પણ રહીસહી પણ ભોગદિલી પડતી મૂકી દીધી. ‘રહીસહી’ સમજો છો ને ? તીવ્ર વેદોદય થાય ત્યારે જ માત્ર દવાની પડીકી જેટલી ભોગકિયા વેદોદય એ રોગ. રોગમાં દવા કેટલી ખવાય ? ભોજન જેટલી નહિ. એમ અહીં ભોગદિલી પૂજા નહિ, ગાંડાતુરની દિલ્લિ નહિ. જો એવી દિલ્લિ હોત તો જે સંયોગમાં આ વયે એમણે બ્રહ્મચર્ય લીધું એ લઈ શકત કે કેમ એ વિચારણીય હતું.

પેથડશાએ કેવા સંયોગમાં સંપૂર્ણ પ્રત લીધું ? એક શ્રાવક તરફથી ગામોગામના બ્રહ્મચારી શ્રાવક-શ્રાવિકાને ભેટ આપાતી કાંબળ પેથડશાને ખાસ પહેરામણી તરીકે આવે છે; ત્યારે પેથડશાને એમ લાગે છે કે ‘સાર્ધમિકની પહેરામણી પાછી કાઢવામાં એનું અપમાન થાય, અને બ્રહ્મચર્ય પ્રત લીધા વિના સ્વીકારવાનું થાય, અને બ્રહ્મચર્ય પ્રત લીધા વિના સ્વીકારવાનું કાયદેસર કેમ ગણાય ?’ બસ, એટલા વિવેક પર સીધા ત્યાંથી ઉઠીને પત્ની સાથે ગુરુ પાસે જઈ માત્ર તર વર્ષની વયે જીવનભરનું બ્રહ્મચર્ય પ્રત ઉચ્ચરી લે છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૨૦, અંક-૮, તા. ૬-૧૧-૧૯૭૧

તર વર્ષની વયે પૂર્ણ બ્રહ્મચર્ય કેમ સહેલું ?

બોલો, આવા કાંબળના પ્રસંગમાત્રમાં આ વયે અને મહામંત્રીપદની વૈભવયુક્ત ઠકરાઈમાં આ મહાન પ્રત ઉચ્ચરી લેવું સહેલું છે ? ના, તો પછી પેથડશાને કેમ સહેલું પડ્યું ? કહો, એમના બુદ્ધિક્ષેત્રમાં પવિત્રતા ખૂબ રમતી હોશે, તે સ્વપત્ની પ્રત્યે પણ વાસનાદિલ્લિ ઘણી ઘણી દબાવીને રહી સહી યાને નહિવત કરવા પૂર્વકની પવિત્રતા હોશે, માટે પૂર્ણ બ્રહ્મચર્ય સહેલું પડ્યું. સ્વપત્ની ઉપર ગાંડાતુરની દિલ્લિ હોય તો આ શે બને ? એ તો રહી સહી વાસનાદિલ્લિ તે આ કાંબળની પહેરામણીનું નિમિત મળતાં સાવ ઊઠી ગઈ, હઠી ગઈ, ને પૂર્ણ બ્રહ્મચર્ય સ્વીકારી ઊંચી પવિત્રતા બુદ્ધિક્ષેત્રમાં સ્થાપિત કરી દીધી.

પૂર્ણ બ્રહ્મચર્યની ઉચ્ચ પવિત્રતાના જતન કેવી રીતે ? :-

હવે આ ઉચ્ચ પવિત્રતાનાં જતન કેવી રીતે કરવાનાં ? પત્નીના અંગ અંગોપાંગ પર લેશ પણ ભોગદિલી નહિ રાખીને, આ બદન, આ ચક્ષુ, આ ગાલ વગેરે સુંદર છે, રમણીય છે. એવું જોવાનું આત્માના એક રુવાડે નહિ. પત્ની ને સણી બેન જેવી ચિત્તમાં સ્થાપી દીધી. હવે લેશમાત્ર પણ ભોગદિલી જ નથી. એટલે બુદ્ધિક્ષેત્રમાં ઉચ્ચ પવિત્રતા ઝાક્જમાળ ખીલી ઊઠી.

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“બુદ્ધિક્ષેત્રમાં શું રોપશો” (ભાગ-૪૪)

પેથડશાની આ પવિત્રતાનો પ્રભાવ કેવો પડ્યો ?

એક વારના પ્રસંગે રાજાની પહુંચાણીને તાવ આવ્યો. ઔષધ-ઉપચારથી એ ઉત્તરતો નહોતો, એમાં પહુંચાણીને કયાંયથી ખબર પડી કે મંત્રીશર પેથડશાની કામળીનો અજબ પ્રભાવ છે, તેથી એણે એ કામળી મંગાવી ઓઢીને સૂઈ ગઈ. બસ, એના પ્રભાવે તાવ તરત ઉતરી ગયો. અને રાણીને આરોગ્યની ઘસઘસાટ ઉંઘ આવી ગઈ. બોલો પેથડશાની પવિત્રતાનો કેવો પ્રભાવ એમની ઓફેલી કામળીનો સંસર્ગ તાવ ઉતારી નાખે ? પવિત્ર શરીરનો આણો પર્સીનો કામળીમાં લાગી ગયો, એ દવાનું કામ કરી ગયો.

એમ કહેતા નહિ કે પણ એ તો કાકતાલીય ન્યાયથી બને ને ? તાડ પડવાની તૈયારી હતી ને એના માથે કાગડો બેસી ગયો, ને ત્યાં તાડ પડ્યું, તેથી એમ થોડું જ કહેવાય કે કાગડો બેસવાથી તાડ પડી ગયું ? એમ અહીં તાવ ઉત્તરવાનો હોય ત્યાં કામળીનો સંપર્ક થઈ ગયો તેથી એમ થોડું જ કહેવાય કે કામળીથી તાવ ઉતરી ગયો ?' આવું કહેતા નહિ, આગળ જુઓ હજ શું બને છે.

રાણી પેથડશાની કંબળ ઓઢી ઘસઘસાટ ઊંધી રહી છે, ત્યાં ઈઝ્યાનું શોકયરાણી છિદ્ર શોધતી જ હતી એમાં એને આ નિમિત્ત મળી ગયું. તેથી હવે રાજાને એ દેખાડી ચઢાવે છે, 'જુઓ આ આપની અત્યંત પ્રેમપાત્ર પ્રિયા ! પેથડશા પર એને કેટલો બધો રાગ છે કે આ એની કામળી ઓઢીને સૂતી છે ! એથી કલ્યી લો એનું ચારિન્ય.'

બસ, રાજ વાજ ને વાંદરા, ઠેકાણાં નહિ, જેમની હૂંક મળે એમના વાગે. રાજ ત્યાં ઊભો ન રહ્યો અને તે ઘડીથી આ પહુંચાણીનો ત્યાગ કરી દીધો. રાણી તો પછી જાગી જુઓ છે કે 'તાવ નથી, ખુશી ખુશી થઈ ગઈ,' પરંતુ એ ખુશી કેટલા સમયની ? રાજાએ આને ત્યાં આવવાનું કે એને બોલાવવા સરખું ય બંધ કરી દીધું છે. રાણીને ખબર ન પડી કે રાજાએ કેમ ત્યાગ કર્યો; અને અત્યારસુધી રાજાના લાડ લીધેલા, હવે એકાએક બંધ થઈ ગયા, તે સહ્યું જતું નથી, મુંજવણનો પાર નથી. કોઈના પર ખોટો આક્ષેપ પૂર્વ ભવે કરી નાખ્યો, હવે એનું પાપકર્મ આ ભવે કેવી સીફતથી સારા આત્મા પર પણ બદલો લે છે ? માટે અહીં આક્ષેપ-નિંદા-ચુગલી કરતાં બહુ વિચાર કરો.

મનુષ્યનું બુદ્ધિક્ષેત્ર કેવુંક છે ? એમાં ક્યારા ભંસા ભરવા હોય તો ભરી શકાય છે, ને રસાળ માલ ભરવો હોય તો તેમાં ય કોઈ અટકાવતું નથી. કપડાં ચોકાં કરવા હોય, શરીર ચોકાં કરવું હોય તો એમાં હજ અટકાવનારા મળે, સાબુ વગેરે સામળીના અભાવે અટકાયત થાય પરંતુ બુદ્ધિ ચોકાં કરવી હોય,

એના ક્યારા બહાર કાઢી નાખવા હોય, એમાં નવા ક્યારા ન ભરવા હોય તો કોણ અટકાવનાર છે ? કોઈ જ નહિ.

મોટો જુદ્મગાર પણ કરી કરીને શું કરી શકે ? બહારનું કાયા સુદ્ધાનું બગાડી શકે, પરંતુ અંદરની બુદ્ધિનું ન બગાડી શકે.

બુદ્ધિ તો આપણો જ બગાડવી હોય તો બગડે; આપણો જાતે એમાં ક્યારા ઘાલવા હોય તો જ ક્યારા અંદર પેસે.

બાકી બહારની આપત્તિ ગમે તેવી આવે, તો પણ આપણે જો બુદ્ધિને સમતોલ ધીર ગંભીર રાખીએ તો તેથી આપણને કશો વાંધો નથી આવતો, એથી આપત્તિ કાંઈ વધી જતી નથી. માનો કે ચાર દીઢી તાવ ચડી ગયો છે, હવે ત્યાં જો બુદ્ધિમાં મનમાં હાયવોય ન ધાલીએ તો તેથી શું તાવ ચારનો પાંચ દીઢી થઈ જાય ? કશું જ નહિ; આપત્તિ વખતે બુદ્ધિમાં દીનતા-હાયવોય-દ્રેષ-ગુસ્સો વગેરે ક્યારો ઘાલવાથી આપત્તિ ઘટતી નથી. ને ન ઘાલવાથી આપત્તિ વધતી નથી. એવું જ સંપત્તિ વખતે બુદ્ધિમાં રોફ-અભિમાન-આસક્રિટરૂપી ક્યારા ઘાલવાથી સંપત્તિમાં વધારો થતો નથી. અને ક્યારો ન ઘાલવાથી સંપત્તિમાં ઘટાડો થતો નથી. તો પછી બુદ્ધિમાં ક્યારાને ઘાલવાનું કામ શું ? આપત્તિમાં બેદ-દિનતા-રાંકપણું કે સંપત્તિમાં ગર્વ-અતિહર્ષ આસક્રિટ; બુદ્ધિને અડાડવા જ નહિ

પેલી પહુંચાણી રાજાએ ત્યાગ કરવાથી મુંજાય છે, હાયવોય કરે છે કે મહારાજાને મનમાં મારો શું લાગી ગયું કે મારો ત્યાગ કરી દીધો' બોલો, આ મુંજવણ-હાયવોય બુદ્ધિમાં ચાલ્યા તેથી એની આપત્તિ ટળવાની ? ઓછી થવાની ? શું રાજા એને થોડું થોડું માનતો થશે ? કશું જ નહિ,

બુદ્ધિના-ક્યારાથી બહારની આપત્તિમાં લેશમાત્ર ફરક ન પડે.

રાણી હવે પેથડશાના હાથ નીચેના મંત્રીને બોલાવી પોતાની સ્થિતિ કહે છે, અને રાજાને સમજાવવા કહે છે.

મંત્રી કહે તમે ધીરજ રાખો. એમ કાંઈ મહારાજાના ગમે તે કારણે ઊકળેલા મન વખતે સમજૂતી ન થાય; કે ત્યાગનું કારણ ન પૂછાય. બાકી હું તપાસ કરીશ કે શું કારણ બન્યું છે. તમારે ધીરતા રાખવી.'

શું છે આ ? મંત્રીની બુદ્ધિમાં સમતોલતા છે, સ્વસ્થતા છે. તેથી અવસરને ઓળખે છે, યોગ્ય સમયની રાહ જુઓ છે. પાછી એની શોધ ચાલુ છે. એમાં એને પતો મળી ગયો કે ક્યા નિમિત્ત પર આ ઊભું થયું પહુંચાણીના પવિત્ર ચારિન્ય તેમજ પેથડશાના પવિત્ર બ્રહ્મચર્ય માટે એને પાકો વિશ્વાસ છે તેથી હવે રાજાના મનની ઊંધી સમજ કેમ દૂર કરવી એની તકની રાહ જુઓ છે. એમાં એને મોકો

મળી ગયો.

એક વાર એવું બન્યું કે રાજને જ તાવ આવ્યો અને કેમે ય એ ઉત્તરતો નહોતો. શરીરે વ્યકૃપણ ધણી હતી. એ વખતે મંત્રીએ કહ્યું મહારાજા ! આપને જો વિશ્વાસ પડતો હોય તો પેથડશાહની ઓઢેલી કંબળ મંગાવો, અને તે ઓઢીને આપ થોડી વાર સૂઈ રહો, તો આ તાવ ઉત્તરી જશે. પેથડશાહ બ્રહ્મચારી છે, તેથી એમની ઓઢેલી કામળી પ્રભાવવંતી છે.”

તાવ ઉતારવા બીજો તો કોઈ ઉપાય હતો નહિ, તેથી રાજને લાગ્યું કે લાવ, આ પ્રયોગ કરી જોવા દે.’ રાજા જેવા મોટા માણસ આવી વાત પર એકદમ શ્રદ્ધા શાના કરે ? પરંતુ સંયોગ ફરજ પાડે છે.

જીવની દશા જ આવી છે કે સારી વાત આમ સીધી રીતે ન માને, ન આચયે; પરંતુ એવાં સંયોગમાં મૂકાય ત્યાં માનવું-આચરવું પડે છે.

બોલો, ક્ષમા સારી નથી ? પણ સીધે સીધી ક્ષમા રાખનારા કેટલા ? છતાં સંયોગ એવા બની જાય અને કોધ કર્યા પર પસ્તાવાનો સમય આવી લાગે તો મનને એમ થાય છે કે આ કોધ ન કર્યો હતો તો સારું હતું આટલું ખમી ખાંધું હોત તો શું બહુ બગડી જવાનું હતું ? માટે હવેથી ખમી લેવું સારું,’ વાર્યો ન રહ્યો તે હાર્યો રહ્યો. અલબત્ત આમ હારીને ય ક્ષમામાં આવનાર બધા નહિ; છતાં જે આવે, એણે એના કરતાં પહેલેથી ક્ષમામાં રહેવું શું ખોટું ? પરંતુ એમ ચાલુ સંયોગમોં સીધો સીધી રીતે ક્ષમા શાની રાખે ? એ તો સંયોગ પલટાય, ફરજ પાડનારા સંયોગ ઉભા થાય ત્યારે એ સ્ફૂર્જ છે. ત્યારે, સમ્યગદર્શન આ કરાવે છે કે જ્ઞાનીનાં વચ્ચનથી સારી વાત સીધે સીધી ગળે ઉતારી દે છે.

રાજાએ પેથડશા પાસે કામળી લેવા માણસ મોકલ્યો એ જઈને કહે છે. ‘મહારાજાએ આપની કામળી મંગાવી છે.’ પેથડશા નવી કામળી કાઢીને આપવા જાય છે ત્યાં માણસ કહે એ નહિ, આપની ઓઢેલી કામળી મંગાવી છે.

‘અરે ! મહારાજાને એવી પસીનાવાલી અપાય ?

પેલો કહે ‘પણ એમણે પોતે જ એ મંગાવી છે ને ?’

પેથડશાએ ઓઢેલી કામળી આપી; માણસે લાવીને એ રાજને આપી, અને રાજ એ ઓઢીને સૂઈ ગયો. બસ, થોડી વારમાં જ તાવ ઉત્તરી ગયો, અને રાજને ઘસઘસાટ ઉંઘ આવી ગઈ. જાગીને જુએ છે તો આરામ થઈ ગયો છે, ત્યારે દિવાનને કહે,

‘હે દિવાનજી ! પેથડશાહની કામળીનો આટલો બધો પ્રભાવ ?’

દિવાન કહે ‘મહારાજા સાહેબ ! એ પ્રભાવ પેથડશાના બ્રહ્મચર્યનો છે.

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કૃપાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૧૧૮

ત્યારે તો મહારાજી સાહેબને એક વાર તાવ આવેલો તો ઔષધથી ઉત્તરતો નહોતો, તે પેથડશાહની કામળી મંગાવી ઓઢીને સૂતા એટલે તાવ ઉત્તરી ગયો આટલો બધો પ્રભાવ ?’

રાજને પસ્તાવો :-

રાજા કહે એમ છે ? ઓહો ! ત્યારે એણે પેથડશાહની કામળી ઓઢેલી મારા જોવામાં આવી તેથી મને તો જુદી જ કલ્પના થઈ અને મેં એના ત્યાગ કર્યો આ બહુ ખોટું થયું.’

દિવાન કહે મહારાજા ! એ તો બિચારા પોતાનું પવિત્ર ચારિત્ય અને આપના પ્રત્યે અથાગ પ્રેમ અને વિનય આદર છતાં કશું કલંક ચેતલું જોઈ બહુ હુંભી થઈ રહ્યા છે, રાત ને દિવસ એમનું દિલ સળગી રહ્યું છે. હજુ પણ આપને તો એ ઉદાર અને સર્વ આશ્રિતો પર અથાગ વાત્સલ્ય વાળા જુએ છે, અને પોતે પ્રેમ ગુમાવ્યો એમાં પોતાનાં કર્મનો જ દોષ માને છે.’

રાજને એ સાંભળી પારાવાર પસ્તાવો થઈ રહ્યો છે, એ કહે છે, હવે શું થાય ? આ મારો ભયંકર ગુનો છે, એની મારે શી સજા લેવી જોઈએ ?’

દિવાન કહે, સાહેબ ! સજામાં બીજું કશું નહિ, પણ એમને પૂર્વવત્ત અપનાવી લો.’

રાજ તરત ઉઠીને પહૃતરાણીના મહેલમાં પહુંચેલી જઈ પોતાની ખોટી કલ્પનાની ભૂલ કહી એના ક્ષમા માગવા જાય છે, ત્યાં પહૃતરાણી પગમાં પડી ને કહે છે, ‘નાથ ! માફ કરો, આપને ક્ષમા માગવાની હોય નહિ. મારે જે બન્યું તેમાં આપનો કોઈ દોષ નથી. દોષ તો મારા ભાગ્યનો છે. પરંતુ હવે મારું સદ્ગ્રામ્ય જાગ્યું છે. કે આપે સામે પગલે આવીને આ રંક દાસી પર આટલો બધો અનુગ્રહ કર્યો હું આપનો બહુ ઉપકાર માનું છું ? પત્યું રાજાનો રાણી પર પૂર્વવત સ્નેહ ચાલુ થઈ ગયો, પેથડશાહની પવિત્રતાનો આત્મામાં અદ્ભુત પ્રભાવ ઉભો થઈ ગયો એણે એ રાજા રાણી બંનેના તાવ ઉતારી નાખ્યા.

વાત આ હતી કે બુદ્ધિક્ષેત્રમાં પૂર્ણ પવિત્રતા કેળવવી હોય તો પત્નીને પણ વાસનાની દિણીએ નહિ જોવી જોઈએ. પેથડશાએ એવી પવિત્રતા કેટલી બધી વિકસાવી હશે કે એ પવિત્રતા દેહ પર પણ ફેલાઈ ગઈ, અને એના મેલથી સ્પર્શાયેલી કામળી ઔષધરૂપ બની ગઈ, અને એના મેલથી સ્પર્શાયેલી કામળી ઔષધરૂપ બની ગઈ ! બ્રહ્મચર્ય કાયાથી પાળવું એક વાત છે, અને પોતાની પણ સ્ત્રીના દેહને ને એના અંગોને સહજ પણ આ રૂપાણા છે, દેખાવડા છે.’ એવી ભોગયદિણી ન જોવા એ બીજી વાત છે. મનમાં પવિત્રતા એમજ નથી આવી

૧૨૦ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“બુદ્ધિક્ષેત્રમાં શું રોપશો” (ભાગ-૪૪)

જતી; મન પર ભારે અંકુશ આ, કે સ્ત્રીના એક પણ અંગ પર રમણીયતાનો વિચાર જ ન ઉઠે. કેમ પુરુષ રમણીય અંગ પર એવો વિચાર નથી આવતો ને સ્ત્રીના અંગ પર આવે છે? એ જ બતાવે છે કે,

સ્ત્રી એ પુરુષ માટે, ને પુરુષ સ્ત્રી માટે વિજ્ઞતીય છે, ને વિજ્ઞતીયના અંગ તરફ આકર્ષણ વાસનામાંથી ઉઠે છે, ભોગ્યદાસિમાંથી કે ભોક્તૃદાસિથી ઉઠે છે.

આંખ તો પુરુષ સ્ત્રી બનેને એક સરખી હોય; પરંતુ આ સ્ત્રી છે એ ઘ્યાલ ઉપર એની આંખ મીઠી લાગવા જાય એ વાસનાના ધરનું ભોગ્યદાસિના ધરનું દર્શન છે, બસ, મનના ઉપર પાકો અંકુશ મૂકી આ દર્શન જ બંધ; આકર્ષણ મીઠાશ જ બંધ; સ્ત્રી તરીકે સમજ્યા પછી એના એક પણ અંગમાં રમણીયતાનું દર્શન જ નહિ કરવાનું; પહેલે તથકે તો અંગનું દર્શન જ નહિ, ને કદાચ થઈ ગયું તો આ સાવધાની કે રમણીયતા દેખાવડાપણું વગેરેનો કશો વિચાર જ નહિ કરવાનો. શાસ્ત્ર આ જ કહે છે કે સામે આવી પડેલું રૂપ ચક્ષુ ટાળી નહિ શકે, છતાં ત્યાં કર્તવ્ય આ, કે એમાં રાગ નહિ કરવો એટલે? સારા રમણીય તરીકે રૂપ નહિ જોવું.

માનવભવે મહાકિમતી બુદ્ધિક્ષેત્ર મળ્યું છે, એમાં સુંદર વિચારો રોધે જવાના છે, સુંદર ભાવનાઓ વાયે જવાની છે, સુંદર ક્ષમાદિ ભાવો સંગૃહીત કર્યે જવાના છે. આના પર વિચાર ચાલ્યો કે આ ક્ષમા આદિ ભાવ પણ, જેના પર કોધ વગેરે થાય છે, એના પર ખાસ કરીને દાખવવાના છે. એટલે કંધું કે ઊંચી પવિત્રતાનો ભાવ લાવવો છે તો સ્વરૂપી પ્રત્યે પણ વાસનાનો ભોગ્યદાસિનો ભાવ હટાવી દેવો પડે.

કોધને અટકાવવા માટે આ વિચાર, કે ‘મને સુંદર બુદ્ધિક્ષેત્ર મળ્યું છે તો એમાં કાળો કોધ નહિ પણ ઉજ્જવળ ક્ષમાને જ રોપું; જેથી ભવિષ્યમાં બુદ્ધિક્ષેત્રમાં એ ક્ષમાની મોટી વડવાઈ તૈયાર થાય. નહિતર કોધની વડવાઈ તૈયાર થયે એ શે સહાશે, અને પછી એ શે નાશ કરી શકાશે?

(૧૬) કોધને અટકાવવા માટે વળી એક ઉપાય કે

જેના અંગે કોધ થાય છે. તેના સંબંધમાં અનુકૂળતાની કલ્પના કરવાથી યા તાત્ત્વિક સ્વરૂપ જોવાથી કોધ દબાઈ જાય છે. દા.ત.

ગજસુકુમાળ મહામુનિ સ્મશાનમાં ધ્યાનમાં ઉભા છે, ને ત્યાંથી પસાર થતા સોમિલ સસરાએ અતિ ગુસ્સે ભરાઈ ‘હુદ્ધ! મારી દીકરીનો ભવ બગાડ્યો? લે એની સજા,’- એમ ચિંતવીને એણે મુનિના મસ્તક પર માટીની પાળ કરી એમાં ધગધગતા અંગારા ભર્યા. હવે અહીં મુનિનું મસ્તક બળવા માંયું, ત્યાં એમને

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કૃત્યા રોકો: ધૂટવાનો મોકો”(ભાગ-૪૪)

ગુસ્સો ન આવે? પરંતુ ગુસ્સો મનને કશું પ્રતિકૂળ થવા પર થાય છે, ત્યાં જો પ્રતિકૂળને બદલે અનુકૂળની કલ્પના ઉભી કરવામાં આવે તો એ અનુકૂળ કરનાર પ્રત્યે ગુસ્સો શું કામ થાય?

ગજસુકુમાળની પ્રતિકૂળમાં અનુકૂળતાની ભાવના :-

ગજસુકુમાળને આ પ્રતિકૂળ થતું હતું કે એમનું મસ્તક બળી રહ્યું હતું, વેદના અતુલ હતી, શરીર ખંખ થવાની સ્થિતિમાં મૂકાયું હતું, આ બધું પ્રતિકૂળ છતાં એમણે પ્રતિકૂળતાની કલ્પના જ ન ઉઠવા દીધી, સીધી, અનુકૂળતાની જ કલ્પના જગાવી; કવિ કહે છે,-

‘મોક્ષપાદ બંધાવી સસરાને દોષ નવિ દીધો રે,
વેદના અતુલ સહી સમતા રસ પીધો રે;
ચિરંજ્વા કુંવર મારા ! ગજસુકુમાળ રે.’

ગજસુકુમાળે વિચાર્યુ કે આ તો મને સસરાએ મસ્તકે મોકણી પાદદી બંધાવી, એમ કરીને એમણે સસરાનો દોષ ન કાઢ્યો. બળવાની અતુલ વેદના એમણે સહી અંમાં કેવળ સમતારસ શાંત સુધારસ પીધો.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૨૦, અંક-૧૧, તા. ૨૦-૧૧-૧૯૭૧

શું કર્યું? ‘મારે મોક્ષે જલ્દી જવું છે; મોક્ષ આવી વેદના આપનારાં કર્મ હટે નહિ ત્યાં સુધી થાય નહિ; ને એવાં કર્મ આવી વેદના આવ્યા વિના ખત્મ થાય નહિ; તો મારાં માથે અંગારા મુકનાર સસરાએ આ ઠીક જ કર્યું જેથી વેદના આવીને કર્મને રવાના થવાની ફરજ પાડે છે, ને મોક્ષને સુલભ બનાવે છે. એવી મોક્ષદાયી વેદનાની સગવડ કરનાર સસરો તો ઉપકારી છે. આ કરનાર સસરાએ મોક્ષને અનુકૂળ અંગારા ભરી માટીની પાળ કરી તે તો મોક્ષની પાદદી જ બંધાવી! ધન્ય સસરાને! ધન્ય તમારો મહાન ઉપકાર કે તમે મોક્ષને અનુકૂળ સ્થિતિ કરી આપી!

બસ, આમ અનુકૂળતાની જ કલ્પનામાં ચડ્યા, પછી ત્યાં સસરા પર ગુસ્સો કે અંગારા પર દેખ શાનો થાય?

બુદ્ધિમત્તા આ કે પ્રતિકૂળ દેખાતા પ્રસંગમાં અનુકૂળ તત્ત્વ શોધી એના પર દાખિ કેન્દ્રિત કરવી. ને એનો આનંદ માનવો.

હવે વિચારો કે જ્યાં પ્રતિકૂળતા દેખાય છે એમાં શું કશું અનુકૂળ તત્ત્વ નથી?

(૧) પ્રતિકૂળમાં પાંચ આધ્યાત્મિક અનુકૂળતા :-

અનુકૂળ તત્ત્વ જ નથી ? અનુકૂળ તત્ત્વ ત્રણ રીતે હોવાનું વિચારાય.

(૧) અમુક આપત્તિ આવી છતાં બીજા અંશમાં અનુકૂળતા;

(૨) આપત્તિ પોતે જ અમુક દસ્તિએ અનુકૂળ તત્ત્વ,

(૩) આપત્તિ છતાં ઉત્તમ ભવ વગેરે મળ્યા એ મહા અનુકૂળ તત્ત્વ.

(૧) આમાં પ્રતિકૂળ લાગતા બનેલ પ્રસંગમાં યા આવી પડેલ વસ્તુમાં અમુક અંશ અનુકૂળ હોય; દા.ત. શરીરમાં તાવ આવ્યો ત્યાં ‘તાવ સિવાય બીજી બિમારી જેવી કે ખાંસી કષ વગેરે નથી ને ? તો એ બાબતે સારું છે,’ એ અનુકૂળ તત્ત્વ, અથવા તાવ છે, પણ મન સ્વસ્થ છે, ભાનમાં છે, બેભાન નથી. (૧) નમસ્કાર મંત્ર ગણી શકે છે, (૨) ચોવીસ ભગવાનનાં નામ કમસર અનેકવાર યાદ કરી શકે છે, (૩) કર્મ વિપાક ? યાને શુભાશુભ કર્મના ઉદ્યનો વિચાર કરી શકે છે, (૪) તત્ત્વચિંતન, (૫) પરમાત્મચિંતન કરી શકે છે,...આ અનુકૂળ તત્ત્વ ગણાય. આના પર મુખ્ય દસ્તિ રહે તો મનને વ્યાકુળતા ન થાય. તો શું આપણને કશા પ્રતિકૂળ વખતે બીજું ધંશું ધંશું અનુકૂળ નથી ?

(૨) બીજી રીતે અનુકૂળ તત્ત્વ એ, કે જે બનેલ પ્રસંગ કે આવી પડેલ વસ્તુ આપણને અણગમતિ પ્રતિકૂળ લાગે છે, એ અમુક દસ્તિએ જોઈએ છીએ માટે અણગમતી પ્રતિકૂળ લાગે છે; પણ બીજી દસ્તિએ જોઈએ તો એ જ અનુકૂળ હોય.

બિમારીમાં જ અનુકૂળ તત્ત્વ :-

દા.ત. એજ તાવ વગેરે બિમારી એ ધંધો નોકરી કે ઘરકામ વગેરે બગાડે છે, યા શરીરને કષ આપે છે માટે પ્રતિકૂળ લાગે છે, પરંતુ એને બીજી દસ્તિએ જઈએ, દા.ત. (૧) સંભવ છે બજારમાં ઉથલ પાથલ હોય અને ધંધો કરવા જતાં ખોઈ બેસીએ અવું હોય ને બજારમાં ગયા પછી જીવ હાથમાં ન રહેતો હોય, તો આ બિમારીથી એ સાહસ અટકી જવાની દસ્તિએ બિમારી લાભમાં છે, એ અનુકૂળ તત્ત્વ છે, અથવા,

(૨) બિમારી એટલે સમય વિશેષ આરંભ સમારંભથી બચાવનાર છે, એ દસ્તિએ લાભમાં છે. આ લાભ ઓછો છે ?

માનવજીવનનું મૂલ્ય સમજો તો જેટલી જીવોની દ્યા થઈ એટલો મહાલાભ દેખાશે. વળી,

(૩) આમ તો શાંતિથી વધુ સમય બેસી નવકારમંત્ર જાપ કરતા નહોતા, અનિત્યાદિ શુભ ભાવના ભાવતા નહોતા, તે આ બિમારીએ એ કરવા અનુકૂળતા કરી આપી; એ અનુકૂળ તત્ત્વ.

(૪) અથવા, બિમારી આવી એ અશુભ કર્મ યાને પાપકર્મના ઉદ્યથી, પરંતુ એ સાથે સાથે એટલાં અશુભને ભોગવાવી ખત્મ કરતી ચાલે છે; એ અનુકૂળ તત્ત્વ છે. આટલું વારંવાર યાદ રાખજો કે આ જગતમાં

સુખ-દુઃખ જેમ પુણ્ય પાપના ઉદ્યથી મળે છે, એમ સુખ-દુખ એટલાં પુણ્ય-પાપ આત્માની સિલિકમાંથી ઓછાં કરે છે.

બંકમાંથી નાણાં ચેકથી મળે, પણ પછી ચેકનું શું ? બંક બેલેન્સનું શું ? એ એમ જ ઉભા તો ન જ રહેને ? ચેક રદ થાય ને બેલેન્સ કપાય. એમ અહીં સુખ પુણ્યના ઉદ્યથી મળે એ વાત સાચી, પરંતુ એટલી પુણ્ય મૂડી આત્મામાંથી ઓછી થવાની ? કે એટલું પુણ્ય પાછું ઉભાનું રહે ? ના, એટલું રવાના થાય. એટલે શું આવ્યું ? બંકમાંથી નાણાં લાવ લાવ કર્યે ગયા એટલી જમા મૂડી સાફ; એમ જીવનમાં સુખ-સગવડ મળ્યે ગયે એટલા પ્રમાણમાં પુણ્યમૂડી સાફ જ ને ?

એમ, બિમારી વગેરે દુઃખ ભલે આવ્યું તો પાપના ઉદ્યથી, પરંતુ સાથે એટલો પાપકયરો સાફ થવાનો, પૂર્વનાં ઉપાર્જિતાં પાપ દુઃખ તો આપે છે પરંતુ દુઃખ ભોગવાઈ જવા સાથે એ પાપકયરો ભોગવાઈ જઈ ખત્મ થાય છે. પાપ એ આત્મામાં કયરો છે. માટે દુઃખ કયરાને સાફ કરે છે એમ કહેવાય એટલે ?

સુખમાં મૂડી સાફ દુઃખમાં કયરો સાફ.

બોલો, શેમાં રાજુ થવાનું ?

મૂડી સાફ થવામાં રાજુ થવાનું ? કે કયરો સાફ થવામાં ? આપણે શું કરીએ છીએ ? સુખ-સગવડ મળી ત્યાં રાજુ રાજુનો પોટલો થઈ જઈએ છીએ ! એનો અર્થ મૂડી સાફ થતી આવે ત્યાં રાજુ ? અને દુઃખમાં પોક મૂકીએ એટલે કે કયરો સાફ થતો આવે ત્યાં નારાજ ? મૂર્ખાઈ નથી આ ?

સુખમાં અભિમાન થાય છે કે ‘હું કેવો સુખી ! કેવો પુણ્યશાળી !’ અલ્યા ! પણ.

પુણ્યશાળી કોણા ? પુણ્ય સફાયટ કરે એ ? કે પુણ્યની ભરતી કરતો રહે એ ?

પરંતુ પુણ્યથી સુખ મળે એટલું અડધિયું યાદ છે. તેથી પોતાના વિશેષ પુણ્ય-સુખ પર ગુમાન થાય છે; ને ગુમાનના અંધાપામાં પુણ્યમૂડી ઘઠી રહી દેખાતી નથી, તેથી નવું પુણ્ય એકત્રિત કરવાનો વિચાર જ નથી આવતો. ત્યારે, જો ત્યાં બીજું અડધિયું યાદ રહે કે સુખથી એટલું પુણ્ય નાથ થાય છે,’ આ જો યાદ આવ્યા કરે તો તો સુખ-સગવડ મળતી વખતે જટ મનને થાય કે ‘ભાઈ ! આટલું પુણ્ય વેતરાયું, અને આગળ માટે સિલકમાં કેટલું છે એ ખબર નથી, માટે નવાં પુણ્યની

ભરતી કરો.' મનને આ લાગ્યા પછી પુણ્યના ઉપાય પહેલાં આદરવાનું કરાય ધરવાળાને કિંમતી હાર શા માટે ? :-

આ તો બજારમાંથી ૫-૨૫ હજાર કમાઈ લીધા, પછી હજાર બે હજાર રૂપિયાનો નેકલેસ (હાર) ખરીદી લઈ જવાનું મન થાય છે, પણ કોના માટે ? આદેશર ભગવાનના ગળામાં ચડાવવા માટે ? આવો આધા, ભગવાનને તો ચડાવનારા ઘણા છે, તેમ ભગવાનના તો દાગીના પડેલા જ છે; અમારા ધરવાળાને બીજું કોણ પહેરવાનાર હતું ? અને એમના દાગીના આમ પડ્યા તો છે, પણ તે તો વાર તહેવારે પહેરવાના; પણ ચાલું રોજ માટે પહેરવા જોઈએ ને ?' બોલો મનની આ જ દશા છે ને ? ભગવાનને ચાલું રોજ પહેરવાના જોઈએ, ધરવાળાની ડોકે રોજ જોઈએ. કેમ વારું ? લોકમાં એ સારા દેખાય એટલા માટે ? ના રે ના પોતાને એ એમ ને એમ જોવા મળે એના કરતાં ગળામાં નેકલેસવાળા જોવા મળે એમાં આનંદ વધારે થાય એટલા માટે અથવા એ ખુશ રહે તો સારું સુખ આપે આ આનંદની પાછળ મોહ કામરાગ વધે કે ઘટે છે ?

વીતરાગ પ્રભુને હાર શા માટે :-

કહે છે 'ભગવાનને તો હાર પહેરાવનાર ઘણા છે, આ કહેવાનો અર્થ શો ? પહેરાવનાર શું ભગવાન માટે પહેરાવે છે, કે પોતાના માટે ? હાર પહેરાવીને શું ભગવાનને લાભ કરાવવો છે ? કે પોતાને (૧) કૃતજ્ઞતાનો (૨) જિનભક્તિનો, (૩) પુણ્યનો અને (૪) પાપક્ષયનો લાભ જોઈએ છે માટે ? ભગવાન તો વીતરાગ સર્વજ્ઞ શુદ્ધ-બુદ્ધ-સુકૃત થઈ ગયા, અનંત લાભ પામી ચુક્યા એમને હવે કશા લાભની અપેક્ષા નથી. છતાં એમને ઊંચા દ્રવ્યોથી ભક્તિ કરાય છે. એમાં તો એ ભક્તિ કરનારને પોતાને લાભ થાય એ માટે હાર વગેરે પ્રભુ ચડાવવાની વાત છે. તો એમાં તો જે કરે તે પામે પ્રભુને હાર ચડાવનારા ઘણા હશે, તો એ ઘણાલાભ પામશે પણ તને શો લાભ ? પરંતુ આ વિચાર જ નથી ઉઠતો એટલે આહું બોલાય છે;

મૂળ વાત આ છે કે, જેમ દિવસમાં સૂર્ય તપતો હોય, પરંતુ દિવસ પૂરો. થયે સૂર્ય અસ્ત; એમ સુખમાં પુણ્ય તપતું પરંતુ સુખ પૂરું થયેથી અસ્ત પામી જવાનું.

એટલે સુખમાં પુણ્યનો ઉદ્ય યાદ કરી મલકાતા રહેવાને બદલે સુખભોગ, પુણ્ય ક્ષય,- આ જો યાદ રહે તો સાવધાની આવી જ્ય અને પુણ્યની ભરતી કરવા, પુણ્ય-સંચય કરવા એના ઉપાય પહેલા લેવાય, ત્યારે પૂછો,-

પ્ર.- શું પુણ્ય સંચયની જરૂર છે. પુણ્ય માટે ધર્મ ઉપાય કરાય ?

૩.- હા,

પુણ્યની જરૂર છે, પરંતુ તે સુખ વિલાસ કરવાની સગવડ-સામગ્રી માટે નહિ, કિન્તુ મોકશમાર્ગની આરાધનાની સગવડ મળે એ માટે.

મોકશમાર્ગની આરાધના માટે જુઓ કેટ-કેટલી સગવડ જોઈએ છે ?

મનુષ્યભવ, આર્થકુળ, આરોગ્ય, સંઘયશબળ, સ્વસ્થ મન, ખાનપાન, દેવ-ગુરુનો સંયોગ, દીર્ઘ આયુષ્ય,.....વગેરે જરૂરી છે. એ ન હોય અને (૧) જનાવર કે કીડાનો અવતાર હોય, યા (૨) મનુષ્યપણું પણ અનાર્થ કુળમાં મળ્યું હોય, અથવા (૩) શરીર ભયંકર રોગિએ હોય, યા (૪) મન પાગલ ચિત્તઅમવાળું મળ્યું હોય, કે (૫) ખાવાના ફાંઝા હોય. અથવા (૬) દેવ-ગુરુનો સંયોગ જ ન મળ્યો હોય, યા (૭) આયુષ્ય જ ટૂંકું હોય, તો એ મોકશમાર્ગની આરાધના શી રીતે કરી શકવાનો ? માટે આરાધનાર્થે મનુષ્યભવ આદિની જરૂર છે, અને એ પુણ્ય વિના મળે નહિ, તેથી પુણ્યની પણ જરૂર છે; પરંતુ તે મોકશમાર્ગની આરાધનાની સગવડ માટે હો. એ સગવડ આપનારું પુણ્ય પુણ્યનુંબંધી જોઈએ. કેમ ?

પુણ્યનુંબંધી પુણ્યથી એ સગવડો મળ્યે સંસારની લીલાલહેરની યા હિંસાદિ પાપો આચરવાની, કે અભિમાનાદિ કષાયોની નહિ, પણ આરાધનાની બુદ્ધિ રહે, અને શક્ય આરાધના થયે જાય.

આ પરથી સમજાશે કે શાસ્ત્ર જે પુણ્યનુંબંધી પુણ્યને ઉપાદેય આદરણીય કહે છે તે યથાર્થ જ છે, વાસ્તવિક છે.

પુણ્યના સહારા વિના આરાધનાનું ગાડું અટકી પડે.

પાર્શ્વપ્રભુને વચ્ચેના ભવમાં મોકશ કેમ નહિ ? :-

નહિતર, જુઓ, શ્રી પાર્શ્વનાથ પ્રભુને યોથા ભવ મનુષ્યભવથી ચારિત્રની આરાધના જવલંત હતી, રૈથા હદ્ધા ૮મા ભવના અંતે અંતે ધોર ઉપસર્ગમાં પણ મહાસમાધિ અને વધતી શુભ ભાવના હતી, તો રૈથા હદ્ધા, ૮મા ભવમાં મોકશ કેમ ન પામ્યા ? ત્યાં કહેવું પડે મોકશ પામવા માટે કેવળજ્ઞાન જોઈએ, ને એ માટે વીતરાગતા જોઈએ. એ લાવવા શુક્લ ધ્યાન જોઈએ, એ માટે ઉચ્ચ ઉચ્યતર ભાવનાથી ધર્મધ્યાનની ધારા લહેરાવવી વધારવી જોઈએ; પણ અહીં ધર્મધ્યાનમાં ઊંચે ચઢતાં એવા શુક્લ ધ્યાન પર ચઢાવી દેનારી ઉચ્ચ ધર્મધ્યાનની કક્ષાએ એ પહોંચે એ પહેલાં આયુષ્યનું પુણ્યકર્મ પૂર્ણ થઈ ગયું. હવે એ જીવન જ હાથમાં ન રહ્યું, તો ધ્યાનધારા આગળ ઊંચે ચેડે જ ક્યાંથી ? આમ આયુષ્ય પુણ્યનો સહારો છૂટી ગયો પછી ઊંચી અપ્રમત્તાભાવની આરાધના તો શું, કિન્તુ ચારિત્રની આરાધના ય અટકી પડી. અહીંથી કણ કરીને દેવલોકમાં ગયા ત્યાં ચારિત્રભાવ

ક્યાંથી લાવે ?

પુરુષાર્થ સાથે માનવ આયુષ્યનું પુણ્ય પહોંચે તો જ ધ્યાનધારા ચરી શકે .

પ્ર.- આયુષ્ય પહોંચતું હતું ત્યાં સુધીમાં ધર્મ ધ્યાનની ધારા કેમ એટલી ઊંચી ન ચરી ?

ઉ.- એનું કારણ એ છે કે ધર્મધ્યાનને ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચાડવા માટે અનાસંગ્યોગ અનાસક્તભાવ સમત્વયોગની નિકટ પહોંચવું પડે. એ એવું સંઘયજીબળ મનોબળ હોય અને સામર્થ્યોગ સધાય તો બની શકે. આ બળ માટે પણ પુણ્યનો સહારો જોઈએ. વળી ધર્મધ્યાનનું જોસ જેવા પ્રમાણમાં હોય તે મુજબ આગળ સામર્થ્યોગ આવે અને ઊંચે ધ્યાનધારા વધે. એમાં સમય લાગે, પણ આયુષ્ય જો તેટલું પહોંચતું ન હોય. ને ઉચ્ચ કક્ષાએ પહોંચતા પહેલાં જ આયુષ્ય પૂરું થઈ જાય, તો કામ અટકી પડે. એટલે વાત આ છે કે આરાધના અલબાત આત્માના પુરુષાર્થી થાય છે, છતાં એમાં માનવ-આયુષ્ય આદિનાં પુણ્યનો સહારો જોઈએ છે, એવું આરાધનામાં સરખી સામગ્રી આપવા દ્વારા સહારો કરનાર પુણ્ય ત્યાજ્ય ગણાય ? કે આદરણીય ગણાય ?

વાત આ ચાલતી હતી કે સુખ પુણ્યથી મળે અને દુઃખ પાપથી આવે, આ પહેલું અડધિયું જોયા કરતાં બીજું અડધિયું નજર સામે રાખ્યા કરો કે ‘સુખમાં પુણ્ય ભોગવાઈ ખત્મ થતું જાય અને દુઃખમાં પાપ ભોગવાઈને નાશ થતું જાય.’ આ જો નજર સામે, રધ્યા કરે તો સુખ વખતે પુણ્યને ખાતાં પુણ્ય વધારવાનો વિચાર રહે, પ્રયત્ન થાય; અને દુઃખ વખતે એટલું પાપ ઓછું થતું જાણી ખેદ નહિ પણ આનંદ રહે કે ‘ચાલો કચરો સાફ થાય છે.’

એટલું તો નક્કી ને કે અંદરમાં કચરો છે તો જ દુઃખ આવે ?

શરીર અંગે શું છે ? પેટમાં આંતરડામાં ખરાબી હોય ગરબડ હોય તો જ માથું દુઃખે, શરીર તૂટે, ખાટા ઉકાર આવે. બહારની પીડા અંદરના કચરાને સૂચવે છે. ત્યારે કુદરત આ જ કામ કરે છે, કે અંદરના કચરાને સાફ કરવા બહારમાં તાવ લાવે છે, કળતર લાવે છે, અને ખોરાકની અરુચિ લાવે છે, એને જો ધીરજ રાખી નભાવી લો, તો એથી અંદરનો કચરો સાફ થતો આવે છે. પણ આંદું અવળું કરવા જાઓ તો કચરો સલાતમ રહે છે, યા વધે છે. માનો કે ખાવાની અરુચિ છે, ચાલુ ભોજન ભાવતું નથી, ત્યાં જો મીહું મીહું કે ખાટું તીખું ખાવા જાય, યા શેર દૂધ ચાડવી જાય, તો શો લાભ ? કચરો વધવાનો પણ જો ઉપવાસ જ કરી દીધો તો અંદરનો કચરો સાફ થવાને અવકાશ રહેશે.

બસ, આત્મા માટે પણ આવું છે. આત્માને બહારથી દુઃખ આવ્યું, પીડા

આપતી અગવડ આવી, ત્યાં સમજી લેવાય કે આ અંદરખાને રહેલ કચરાના લીધે છે. અંદર પાપનો કચરો છે તો જ આ પીડા આવે.

શરીરની અંદરના દોષ-કચરાની જેમ આ કર્મ-કચરો પાકીને દુઃખ-પીડા-અગવડ આપવા દ્વારા બહાર નીકળી જાય છે.

તાવ દેખાડ્યા વિના અંદરનો મળ બળીને સાફ થાય નહિ એમ પીડા દેખાડ્યા વિના અંદરનો કર્મ કચરો પણ સાફ થાય નહિ. હવે જો જેમ અરુચિનો સામનો કરી આહુઅવળું ખાવા જઈએ, તો શરીર બગડે, મળ વધે; એમ કર્મ જન્ય બાધ દુઃખ-પીડા અગવડનો સામનો કરી એને હટાવવા આહુઅવળું કરવા જઈએ, યા સામના રૂપે હાયવોય સંતાપ આર્તધ્યાન વગેરે કરવા જઈએ તો અંદરમાં કર્મકચરો વધે, આત્મા વધુ બગડે, મલભર્યો થાય.

માટે સુખમાં પુણ્ય પરવારે, દુઃખમાં પાપ પરવારે’ આ હિસાબ નજર સામે રાખ્યા કરી સુખમાં સંચિત નમ્ર અને ઉદાસીન બન્યા રહેવાનું; તથા દુઃખમાં નિશ્ચિન્ત અને પ્રફુલ્લિત બન્યા રહેવાનું.

દુઃખમાં ‘નિશ્ચિન્ત’ એટલા માટે કે કર્મના નિર્ધારિત હિસાબ સ્વતંત્ર ચાલ્યા કરે છે, આપણી દખલને ગણકારતા નથી. માટે ત્યાં ચિંતા અધીરાઈ નકામી છે.

દુઃખમાં ‘પ્રફુલ્લિત’ એટલા માટે કે પાપ કચરો સાફ થઈ રહ્યો છે.

બસ, આ વાત છે કે પ્રતિકૂળ પ્રસંગ (દા.ત. બિમારી વગેરે) ને જોવાની ચાલુ દાણી બદલી આ દાણીએ જોવાનું કરાય તો એ પ્રતિકૂળને બદલે અનુકૂળ લાગે. એવું કોધ અંગે કરવાનું છે જે નિમિત્ત કોધ થાય છે, એ નિમિત્તને બીજી દાણીએ અનુકૂળ તરીકે જોઈએ, તો કોધ અટકી જાય. એટલે શીખવાનું આ છે કે પ્રતિકૂળને અનુકૂળ તરીકે જોવું, ત્યાં પ્રતિકૂળમાં અનુકૂળ તત્ત્વ શોધી કાઢવું, ચાચ્ય તે પહેલાં કર્યું તેમ

(૧) પ્રતિકૂળ લાગતા બનાવ કે પદાર્થનો કોઈ અંશમાં અનુકૂળ તત્ત્વ હોય, યા

(૨) એ પ્રતિકૂળને જ દાણ ફેરવીને અનુકૂળ તરીકે જોવાય અથવા

(૩) અથવા ત્રીજી રીતે અનુકૂળ તત્ત્વ એ જોવાય કે

‘મારે આ કે બીજી ગમે તેટલી આપદા આવે, પીડા આવે, પણ ખરી રીતે મારા આત્માને આની સાથે શું લાગે વળગે છે ? મારા આત્માને તો મને જે ઉત્તમ માનવભવ દીર્ઘ આયુષ્ય, દેવ-ગુરુ-ધર્મ નમસ્કારમંત્ર, શાસ્ત્ર, આચાર અનુષ્ઠાન વગેરે મળ્યા છે, અની સાથે જ સંબંધ છે, એ જ મારી ચીજ છે, મારા આત્માની ચીજ છે, અને વળી એ અતિ સુંદર અતિદુર્લભ અતિ કિંમતી છે. આ જ મારે

૧૨૮ સુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

ભારેમાં ભારે અનુકૂળ પ્રાપ્તિ છે, અને એનો મને ભારેમાં ભારે આનંદ આનંદ છે.’

વારંવાર જો આ માનવભવ આદિ મળ્યાના આનંદને દિલમાં ઉછાળ્યા કરીએ માણ્યા કરીએ, તો હુન્યવી બાબતો સામે દિલ એટલું બધું ફોરું રહે છે કે એ બાબતોનો કશો દિલ પર ભાર નથી લાગતો પછી હુઃખ આવો પીડા આવો, આપદા આવે, અપમાન આવો, પણ દિલ પેલા આનંદમાં ગરકાવ હોઈ દિલ પર આનો કશો ભાર નહિ, કશી અસર નહિ, દિલ બોલશે, આ તો કુછ નહિ, મારે અસંખ્ય હંડ્રોના પૂજ્ય દેવાધિદેવ, ત્યાગી ગુરુ, અનુપમ જૈન ધર્મ, વગેરે વગેરે એટલું અદ્ભુત મજું છે, આહા ! એનો આનંદ આનંદ ઉછળે છે. ત્યાં આ હુન્નિયાનું સારું ઓછું વધુ મજું શી વિસાતમાં છે ?’

‘લલિતાંગનું દષ્ટાન્ત’

પાર્શ્વચરિત્રમાં આવે છે,-લલિતાંગ રાજકુમારને દાનનું વ્યસન હતું, એનો મિત્ર નામથી સજજનકુમાર પણ દિલનો દુર્જન હતો, એના પ્રત્યે ઈર્ઝાળું હતો. એણો રાજાને ચઢાવ્યો કે આ તો પૈસા ઊડે છે, તો ભંડાર ખાલી થઈ જશે.’ રાજાએ એ પર રાજકુમારને શિખામણ આપી કે ‘જો ભાઈ ! આવી રીતે પૈસા ઉછાળીશ તો પછી એમ તો ભંડાર ખાલી થઈ જશે, પછી તારે જ રાજ થવાનં છે, ત્યારે ભંડાર વિના મંત્રી સેનાપતિ વગેરે મોટાનાના રાજ્ય નોકરો ક્યાંથી રાખીશ-પાળીશ, ને એ નહિ, તો રાજ્ય શી રીતે ચલાવીશ ? માટે દાનમાં બહું ન ઉછાળાય’

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૨૦, અંક-૧૨, તા. ૨૭-૧૧-૧૯૭૧

લલિતાંગ કુમારે દાક્ષિણ્યથી રાજાને પગે પડી ‘સારું’ એમ કહ્યું. પણ જેને જે વ્યસન એને એ શે છુટે ? લલિતાંગને દાનનું વ્યસન જ લાગેલું, પૈસા પોતાના ઉપભોગમાં લીલાલહેરમાં ખરચવા તરફ કશું ધ્યાન નહિ, કે પોતાની મૂડી કરવાનો વિચારે ય નહિ; યાચક માગતો આવ્યો, યા કોઈ હુઃખી દેખાયો કે તરત દઈ દેવાની જ વાત. દાન દેવાનો એને સ્વભાવ બની ગયેલો, ને એમાં એને અપરંપાર આનંદ હતો, એટલે પિતાની સલાહ દાન નહિ દેવાની છતાં એને દાન-સ્વભાવ એમ જ ઉભો હતો.

તે એક પિતાએ હીરાનો હાર એને ગળે પહેરાવ્યો. એ પહેરીને કુમાર બહાર નીકળ્યો ત્યાં યાચકો વળગ્યા, કહે-‘કુમાર સાહેબ ! અમને કાંઈ આપો,

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : હૂટવાનો મોકો” (ભાગ-૪૪)

અમે હુઃખી છીએ’ કુમારને તો દાનનો સ્વભાવ તે યાચક મળતાં કેમ દબાયો રહે ? બસ, જોયું કે ખીસામાં પાસે કાંઈ નથી, તો તરત જ ગળામાંથી હાર કાઢી યાચકોને દઈ દેતાં કહ્યું ‘લ્યો, આનાં નાણાં ઉપજાવી વહેંચી લેજો.’

બોલો, આ સાંભળતાં તમને મનમાં શું થયું ? એજ ને કે ‘અરરર ! આટલો કિંમતી હાર તે અપાય ? કાંઈ આપવું હતું તો યાચકોને મહેલ આગળ લઈ જઈને મહેલમાંથી પોતે થોરું ધન લાવી ને દેવું હતું બાકી આવો હીરાનો હાર હમણાં ભેટ મજ્યો ને હમણાં જ દાનમાં દઈ દીધો એ તો બહુ મૂખ્યાઈ કરી; આવું જ લાગે ને ? તમને જો આવું જ લાગતું હોય તો સમજો કે દિલમાં જેવો સારી ચીજનો સંગ્રહનો સ્વભાવ છે. ઉપભોગનો સ્વભાવ છે, એવો દાનનો સ્વભાવ નથી.

સ્વભાવ ચીજ જ એવી છે કે જેનો સ્વભાવ તેનો પ્રસંગ આવતાં એ વિચાર વિના સહેજે સહેજે બની જ જાય.

પછી ત્યાં બીજો ત્રીજો વિચાર જ ન આવે.

જીવને અનાદિનો સ્વભાવ છે તો જ્યાં મોટી રકમ લેવાની વાત આવે ત્યાં ક્યાં વિચાર આવે છે કે હે ? આટલા બધા રૂપિયા એકદમ લેવાય ?’ એ લઈ લેવામાં મૂખ્યાઈ કર્યાં લાગે છે ? એ તો ફિટોફિટ લઈ લેવાય છે; ને જાતને ભાગ્યશાળી મનાય છે કે ‘ચાલો ભાગ્ય ખૂલ્યું લોટરી લાગી ગઈ.’ ‘ફાવી પડ્યા’ મનાયેછે. આ બધાની પાછળ કયું તત્ત્વ કામ કરી રહ્યું છે ? કહો, લેવાનો સ્વભાવ એ ગમે તેટલું લેવામાં વિચાર ન રખાવે. જેનો સ્વભાવ એને પ્રસંગ આવતાં એ વિચાર વિના સહેજે બની આવે.

બસ, આ રીતે વિચારશો તો લાગશે કે જેને દેવાનો સ્વભાવ જ બની ગયો છે એને દેવોનો પ્રસંગ આવતાં ગમે તેટલું દેવામાં કશો વિચાર ન આવે. મૂખ્યાઈ ન લાગે, પણ જાત ભાગ્યશાળી લાગે કે અહો ! આવો દેવોનો સુંદર અવસર મજ્યો !’ દાન દેતાં ‘ફાવી પડ્યા’ લાગે. માટે જ દેવાનું શોધતો ફરે, શું અનાદિના લેવાના સ્વભાવવાળો જો લેવાનું શોધતો ફરે, તો દેવાના સ્વભાવવાળો દેવા માટે એમ ન કરે ?

એવી રીતે સંઘરવા કે ભોગવવાના સ્વભાવવાળો શું કરે છે ? ગમે તેટલું મજ્યું, લાખો કરોડો અબજો મજ્યા, તો તે બધાય સંઘરી રાખવામાં કશો આંચયકો કે વિચાર સરખોય નથી આવતો કે આટલા બધા દાટી મૂકાય ? જાત ભાગ્યશાળી લાગે છે, ફાવી પડ્યા લાગે છે;

એમ ભોગવવાના જ રસિયાને ભોગવવાનો અનાદિ સ્વભાવ તે ભોગવવામાં

માપનો વિચાર નથી. શું એને સંસારના સુખ ભોગવવામાં માપ છે કે એટલું જ ભોગવાય, વધારે નહિ ? ના, બાવો બેઠો જે, જે આવે તે ખપે, ગમે તેટલું ભોગવવા મળે તો ખપે છે.

એમ જમણ જમતાં પેટ ના પાડે છે. મોં ના પાડે છે કે ‘બસ ના, હવે વધુ નહિ ચાલે, નહિતર ઊલટી અકળામજા થશે,’ તેથી જમવાનું બંધ રખાય બાકી મન થોંઠું જ કહે છે કે હેં ? આટલું બધું જમાય ?’ પેટ ને મોં હા પાડતા હોય ત્યા સુધી તો એટલે બધું ચાલે છે.

એમ સંગીત, પિફ્ફચર, સારા વેશ-ઠઠારા, બંગલા મોટર-ફરનીચર વગેરે વિષયો ભોગવવામાં ય કયારે ય એમ નથી થતું કે ‘હેં ? આટલું બધું ભોગવાય ?’ આવું જો થતું હોત તો તો વૈરાગ્ય થાત, મન વાળત, કે ‘અનંતા કાળ અનંત ભોગવ્યું, હવે હોય ?’ આ જીવનમાં ય સાકર મીઠાઈ કેટલા શેર, શેર નહિ, કેટલા મજા ખાઈ નાખો ? હેં આટલી બધી ખવાય ? હવે બસ કર, આજથી જીવું ત્યા સુધી મીઠાઈ બંધ’ આવું મન ક્યાં વાળવાનું બને છે ?

ના, સારું સારું ભોગવવા જેટલું મળે એમાં ‘હેં ?’ નો ચ્યમકારો નથી કે ‘હેં ? આટલું બધું ?’ એમ દાનના સ્વભાવવાળાને-વસનવાળાને ચ્યમકારો નથી કે ‘હેં ? આટલું બધું દેવાય ?’ ત્યાગના વસનવાળાને માપ નથી કે ‘હેં ? આટલું બધું ત્યજાય ?’ એમ ક્ષમાના સ્વભાવવાળાને હિસાબ નથી કે ‘હેં ! આટલી બધી ક્ષમા ના કરાય ?’ એવું પ્રભુભક્તિના વસનવાળાને.

અહીં દાનના સ્વભાવવાળા લલિતાંગ રાજકુમારને યાચકોને હીરાનો હાર આપી દેવામાં કશો આંચકો કે વિચાર યા ચ્યમકારો ન થયો કે ‘હેં ? આવો કિમતી હાર કેમ દેવાય ?’ હાલતાં ને ચાલતાં દાન દઈ દઈ તમે ય દાન દેવાનો સ્વભાવ બનાવી દો, દાનનું વસન પાડી દો, પછી જુઓ તમને ય ચ્યમકારો નહિ થાય કે ‘હેં ? આટલું બધું દેવાય ?’ ત્યારે પૂછો,

પ્ર.- તો શું લેવા સંઘરખાનો જ અને કૃપણતાનો જ સ્વભાવ મટીને દેવાનો સ્વભાવ પરી શકે ? પેલો સ્વભાવ જ પડ્યો હોય તે ફરે ?

૩.- હા, ઉદ્યમથી શું સાધ્ય નથી ? બધા જ આત્મગુણો પુરુષાર્થથી ઉદ્યમથી સિદ્ધ થાય છે. નહિતર અનાદિકાળથી જીવ દોષોના સ્વભાવવાળો, જો એ સ્વભાવ બદલાતો જ ન હોય તો, સુધરે કેવી રીતે ?

દોષના સામા ઉપાય સતત અને હોંશ બહુમાનથી લાંબાકાળ સુધી આદરતા જવાથી દોષનો સ્વભાવ બદલાઈને ગુણનો સ્વભાવ બની આવે છે.

કૃપણતા દોષનો સામો ઉપાય દાન. સતત દાનનો ઉદ્યમ કર્યે જવાથી

કૃપણતાનો સ્વભાવ બદલાઈ દાનનો સ્વભાવ બની આવે, દાનનું વસન પરી જાય. પછી તો દાન કર્યા વિના ચેન ન પડે.

બે અમેરિકનનું દ્યાન્ત

પેલા બે અમેરિકનનું દ્યાન્ત જ્ઞાણો છો ને ? એકે બીજાને રાતના દરિયાકાંઠે સાદા કપડામાં અને દરિયા તરફ જઈ જઈને પાછો આવી બાંકડા પર બેસતો જોયો. જોઈને બરડામાં ધબ્બો મારી બે ડોલર અને વિજિટિંગ કાર્ડ આપતાં કહે છે ‘મૂર્ખ ! બેકારીનો માર્યો આપધાત કરવા આવ્યો છે ? લે આ બે ડોલર, ખાવાનું ખાઈ લેજે, અને કાલે આ કાર્ડના સરનામે આવજે, નોકરી અપાવી દઈશ.’

બીજો અમેરિકન આશર્ય પામી ગયો કે મારી મોટર આવે ઊભી છે આણે કદાચ એ ન જોઈ હોય તેથી મને ગરીબ બેકાર તરીકે જુએ છે, ‘ખેર, પણ એના પર ખોટું લગાડવાની જરૂર નથી. આના દાન સ્વભાવની મારે કદર કરવી જોઈએ. હું કૃપણ, સામો માગતો આવે તો ય દેતો નથી; ત્યારે આ ? મને ઓળખતો નથી પારખતો નથી, તેમ હું એની માસે માગતો નથી, છઠાં એકદમ જ બે ડોલર કાઢીને આપી હે છે, ને વધારામાં નોકરીની ઓફર કરે છે. કેટલો બધો ફરક ! પૈસા તો મારી પાસે ય છે, ને એની પાસે ય છે. પણ અમારા બેમાં આટલું બધું અંતર ? બસ, હું પણ આ ડોલર અને કાર્ડ તિજોરીમાં સાચવીને આગળ રાખીશ, અને રોજ એનાં દર્શન કરી દાનની પ્રેરણા લઈ દાન દેવા માંડીશ.’

બસ, એ રીતે બીજા દિવસથી એણો ચેરીટી કરવા માંડી, દાન કરવા માંડ્યું, એમ કરતાં કરતાં દાનનો રસ લાગ્યો. સંગ્રહ કરતાં હવે દાનમાં આનંદ આવે છે. એકવાર જ્યારે છાપામાં વાંચ્યું કે એજ કાર્ડવાળી કંપની મુશ્કેલીમાં આવી છે, દેવાણું કાઢે એમ છે, ત્યાં એ ચેકબુક લઈ દોડ્યો કંપનીનાં સરનામે, ત્યાં જઈ જુએ છે તો લેણદારોનું ટોણું જામ્યું છે. ‘અમારા પૈસા લાવો.’ એક જ અવાજ છે. સેકેટરી બધાને શાંતિથી ધીરજ ધરવા સમજાવી રહ્યો છે ત્યાં આ શ્રીમંત જઈ સેકેટરીને ખાનગીમાં લઈ જઈ કહે છે,-

‘મારે માલિકને મળવું છે.’

સેકેટરી કહે હમજાં નહિ મળી શકે.

આ કહે હું લેવા નથી આવ્યો, દેવા આવ્યો હું.’

ત્યાં સેકેટરીની આંખ ચમકે છે ‘હેં ? દેવા ?’

‘હાં સારું દેવા આવ્યો હું. મને માલિકને લેગો કરી આપો ?’

બસ, એની મોટરમાં જ સેકેટરીને લઈ ચાલ્યો. પહોંચ્યા માલિક પાસે,

માલિકને ય એકાંત રૂમમાં બેસાડી પેલી રાતનો પ્રસંગ કહી અંધાડીમાં કાર્ડ દેખાડી કહે છે, ‘તમે મને ઓળખ્યો ?’

પેલો યાદ લાવી કહે, ‘હાં, ઓળખ્યા, પણ માફ કરો હમણાં મારી પાસે નોકરી આપવાના સંયોગ નથી. તમને દુઃખીને મારે નોકરી આપવી જોઈએ. પરંતુ કંપની દેવાળામાં જઈ રહી છે; Wind up થઈ જશે, સંકેલાઈ જશે. નોકરી ક્યાંથી આપી શકું ?’

જુઓ, પૈસા ગયા છે, પણ સજજનતા સહાનુભૂતિ ઊભી છે. સામાને તિરસ્કારતો નથી કે ‘અત્યારે શું આવ્યા છો ? મારા સંયોગ સમજતા નથી ? અહીં તો મરી રહ્યા છીએ, ને હાલી નીકળ્યા નોકરો લેવા. ઊભા થાઓ જાઓ અહીંથી.’ ના તિરસ્કાર નહિ, પણ હમદર્દી બતાવે છે. ‘મારે તમને દુઃખીને નોકરી આપવી જોઈએ’ શું આ ? સજજતાનો સ્વભાવ, પૈસા જાય, પણ સ્વભાવ જાય ? ગમે તેવા કપરા સંયોગમાં ય સજજનતા સહાનુભૂતિ મૂકવાની વાત નહિ.

પેલો આવેલો અમેરિકન કહે છે, ‘તમે મને પહેલાં ય ઓળખેલો નહિ. હું ગરીબ બેકાર નહોતો. શ્રીમંત હતો, ને અત્યારે વધારે શ્રીમંતાઈ છે તેથી હું નોકરી કે પૈસા લેવા નથી આવ્યો. તમે બે ડોલર અને નોકરીની ઓફર આપીને જે ઉપકાર કર્યો એનું મોટું દેવું મારા માથે છે, એ ચૂકવવા આવ્યો છું. બોલો, કંપનીને કેટલી મુશ્કેલી છે ?’ આમ કહીને તરત એણે ગજવામાંથી ચેકબૂક અને પેન કાઢી ચેક લખવાની તૈયારી કરી.

ત્યાં આ કહે છે, ‘તમે મુશ્કેલી જાણીને શું કરશો ? મુશ્કેલી એટલી બધી છે કે તમને કહેવાય નહિ. તમારી પાસેથી એટલું પડાવવાની આશા ય ન રખાય બે ડોલરના બદલામાં ?’

‘અરે ! એ શું બોલ્યા ? તમે મને માત્ર બે ડોલર નહિ પણ દાન અને ઉદારતાનો ગુણ તથા એથી જીવનમાં આનંદ આનંદ અનુભવવાનું આપ્યું છે. એનો બદલો વળે એમ નથી. બોલો બોલો, ઝટ બોલો, કેટલી મુશ્કેલી છે ?’

આ કહે, ‘પાંત્રીસ લાખ ડોલરનું દેવું છે.’

બસ, ઝટ પેલાએ એટલાનો ચેક લખી નાખ્યો, અને આના હાથમાં આપતાં કહે છે, ‘લ્યો આ, અને રોકડા મંગાવી લઈ લેણદારોને હમણાં ને હમણાં આપી દો. પરંતુ આથી તો માત્ર દેવું પતી જશે. પણ પછી કંપની કઈ મૂડી પર ચાલશે ? માટે જુઓ આજથી તમે મારી કંપનીમાં અડધા ભાગીદાર, વર્કિંગ પાર્ટનર, કંપનીનું દેવું ચૂકવીને આવી જાઓ આપણી કંપનીની ઓફિસ પર; એમ કહીને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું.

આ દેવામાં આવી ગયેલો અમેરિકન તો આ જોઈને આભો જ બની જાય છે. ગળગળો થઈ આંખમાં આંસુ સાથે કહે છે, ‘અરે ! આટલું બધું ? મેં તમારું શું કર્યું છે ? મારે શી રીતે ચૂકવવાનું ?’ મેં તમને બે ડોલર આપેલા એની તો તમારે જરૂર પણ નહોતી.

પેલો દાતાર કહે આ કોઈ મોટી રકમ નથી; અને આ કોઈ લોન નથી કે ચૂકવવાની હોય આ તો તમારા લેણામાંથી થોડી રકમ પાછી આવે છે. વખતે મારે અલબત કે ડોલરની જરૂર નહોતી, પરંતુ દાન ગુણની બહુ જરૂર હતી ને તે તમે આપેલો એનું તો મૂલ્ય જ અંકાય નહિ. એ તમે મને દાનગુણ શિખવાડતાં મારે જેમ જેમ દાનપ્રવૃત્તિ વધી તેમ તેમ એક બાજુ આનંદ વધતો ચાલ્યો, અને બિજ બાજુ આવક પણ વધતી રહી. એટલે મારી કંપની પર તમારો અનહદ ઉપકાર છે. તેથી એમાં અડધા ભાગીદાર બનો એ હક્કદારનું છે.

હવે હું બીજું તો શું કહું ? તમારો બહુ આભાર માનું છું.

બોલો, એકી કલમે વગર પિછાણે ઉપ લાખ ડોલર અને લાખો ડોલર કમાતી કંપનીમાં અડધો ભાગ આપી દેવાનું સાંભળતા ચ્યમકારો થયો ને ? પેલો દેનારને દેતાં ચ્યમકારો આંચકો ન આવ્યો કે ‘હેં ? આટલું મોટું દેવું ? આટલી બધી રકમ તે શે અપાય ?’ કેમ આંચકો નહિ ? કારણ કે એને દાનનું વ્યસન લાગી ગયેલું એનો દાનનો સ્વભાવ બની ગયો હતો. દાનના સ્વભાવમાં પછી માપ ન રહે કે ‘આટલું બધું ?’ પહેલાં દાન સ્વભાવ હતો ? ના, પહેલાં તો ભારે કૃપણતાનો સ્વભાવ હતો તો તે બદલાયોને ? શી રીતે ? કહો

મન પર પહેલાં દોષ સ્વભાવની ભારે ખૂંચ-ધૂણા-ગ્લાનિ-શરમ લાગી જાય અને પછી મન મારીને પણ ગુણની પ્રવૃત્તિ કર્યે જવાય તો દોષસ્વભાવ નાશ પામીને ગુણસ્વભાવ બની જાય.

દોષ કેટલા ભર્યા છે :-

બધા દોષો માટે આ લાગુ પડે. દોષ સુધારવા છે ? તો પહેલાં દિલમાં એ ખૂંચતા કરો, એના પર ખૂંચા તિરસ્કાર ઊભો કરો, એની ભારે ગ્લાનિ-ભિન્નતા શરમ અનુભવો, પછી એની સામેના ગુણની પ્રવૃત્તિ કરવા માંડો, મન ના માને તો ય મન મારીને ગુણની પ્રવૃત્તિ રાખો. જુઓ પછી ગુણનો સ્વભાવ આવે છે કે નહિ ?

પણ પહેલાં દોષ ખૂંચવા જોઈએ ને ? દોષો છે ખરા ? કેટલા છે ? એ ખૂંચે છે ? ખટકે છે ? જૂઠ કેટલું બોલાય ? અન્યાય અનીતિ માયા કેટલી થાય ? ઇચ્છા કેટલી આવે ? અભિમાન કેટલું દેખાડાય ? માનાકંશા ને બીજાને સારું લગાડવામાં

નિંદા કેટલી કરાય ? ધનનો લોભ કેટલો ? ભગવાનની બેપરપાઈ કેટલી થાય ? છતી શક્તિએ ભગવાનની ભક્તિની બેપરવાઈ કેટલી ? સાધર્મિક ગ્રત્યે ઘૃણા-અવગણના કરતાં સંકોચ ખરો ? ખાનપાનના રસ કેટલા ? સ્ત્રીનાં આકર્ષણ ને વિકાર કેટલા ?... બોલો બોલો દોષો ગણવા છે ? મોહું લિસ્ટ થાય ને ? આ બધા દોષ દિલમાં ઝૂચે-ખટકે ખરા ? હૈયે કાંટાની જેમ ભોંકાય ખરા ? નિરંતર એના જેદ-જ્ઞાનિ રહ્યા કરે ? જાત પર ઘૃણા થાય ? માનવભવ બરબાદ રહ્યો દેખાય ?

ગુજાનો સ્વભાવ કેમ ઘડાય ? :-

આ બધું હોય તો પછી એના સ્વભાવ મટાડવા એની સામેના ગુજાની પ્રવૃત્તિઓ મન મારીને ય આચર્યા કરવી પડે. દા.ત. હજુ સત્યબોલવાનો સ્વભાવ સહજ નથી બન્યો, છતાં ઉભા થતાં. જૂઠના પ્રસંગે ચાહીને મન મારીને પણ સત્ય બોલવાની હિંમત કરાય, સત્ય બોલાય.

એમ માયા અનીતિની સામે ચાહીને મનને દબાવીને સરળતાની પ્રવૃત્તિ રખાય. ગભરાવવાનું નહિ કે દિલમાં છે તેવું સરળભાવે બોલવા વર્તવા જઈશું તો લૂંટાઈ જઈશું; ના, પુણ્ય સલામત ત્યાં સુધી સબ સલામત;

કશું લૂંટાવાનું નથી. બાકી આમ તો અનતા ભવોમાં ઓછું લૂંટાયા છીએ ?

મોટા દેવતાઈ વિમાન કે પૃથ્વી પરના સામ્રાજ્ય ને અઢળક સંપત્તિ વગેરે પણ કર્મસત્તાએ આપણી પાસેથી ઝુંચવી લીધા ને ? ને આપણને ડિસમીસ કર્યા ને ? તો અહીં શું ભારે લૂંટાવાના છીએ કે એ બચાવવા ખાતર જૂઠ-માયા-અનીતિ રમીએ ?' બસ, સત્ય ને સરળ બોલ, સરળ વર્તવ, કર્યે જવાનો, એમ કરતાં કરતાં એનો સ્વભાવ ઘડાવા માંડશે.

એમ, નિંદાની સામે પરની પ્રશંસાની, ગુજાનુવાદની સારી પ્રવૃત્તિ રખાય. સ્વાભિમાન-માનાંકનાની સામે નમતા લઘુતાની વાણી નીકળે.

લઘુતા એવી બતાવાય કે સારી વાતનો જશ જાત ખાતે જમા નહિ, પણ દેવ-ગુરુ યા વડીલને ખાતે જમા; જશ એમને મળે એવું બોલાય, આવડે આ ? સારું કામ આપણે કરીએ, બુદ્ધિ આપણે લડાવીએ, મહેનત આપણી, ને જશ બીજાને આપવાનો ? હા, એમ કહેવાય કે 'મારામાં શું છે ? હું મારી જાતને જાણું છું કે અમુક વખત પહેલાં હું કેવો અજ્ઞાન-મૂઢ-ઝુડુથલ હતો. આ તો વહિલે ગુરુએ કાળજી રાખીને ભણાવ્યો. હોશિયારી મળવાના સંયોગ કરી આપ્યા, ત્યારે આ કાંઈક દેખાય છે. માટે બધો પ્રતાપ વડીલનો છે, દેવગુરુની કૃપાનો છે. બાકી મારી પહોંચ કેટલી હતી એ મને ખબર છે.' આમ જશ એમને અપાય, તો જાતમાં લઘુતાગુજા કેળવાય.

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ-કખાય રોકો: ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૧૩૫

એમ, ધનના લોભની સામે દાનની પ્રવૃત્તિ સારી ચલાવવી પડે; તેમ ધન કરતાં ધર્મનો લાભ વધારતા રહેવું જોઈએ.

મનને થાય કે 'લાખ, ચાર દેરાસર વધુ દર્શન કરી લઉં, બે માળા વધુ ગણી લઉં, એક બે રસનો ત્યાગ કરી લઉં, બે સામાયિક વધુ કરી લઉં; તપસ્યા કરતો રહેવા દે દાન પરોપકાર તો હાલતા ચાલતાં કરતો રહું; સાધુ મહારાજ બધાને વંદના કરી લેવા દે, સમય મખ્યો છે તો એમનો સત્સંગ કરી લેવા દે. આમ કરીને જેટલો ધર્મ કમાયા એ લાભમાં છે, એ જ અંતકાળે શાંતિ આપશે, એજ પરભવે જવાબ દેશે, આમ ધર્મ વધારવાથી ધર્મની લગન વધે, બોધ વધે, વૈરાગ્ય વધે, એટલે સહેજે પૈસાની લગન ઓછી થાય. ત્યાં દેવાનો સ્વભાવ ઘડાવા માંડે એટલે હવે જિનભક્તિ, દાન, દયા, ઇંડ્રિયદમન...વગેરેનો સ્વભાવ ઘડાતો આવે.

આ જ રીતે બીજા બીજા દોષો માટે સમજ લેવાનું એના પ્રતિપક્ષી ગુજાનોની પ્રવૃત્તિ આચર્યે જવાની એમ કરતાં કરતાં એ ગુજાનો સ્વભાવ ઘડાતો આવે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૨૦, અંક-૧૩, તા. ૪-૧૨-૧૯૭૧

ખોડશક શાસ્ત્રમાં બતાવ્યું છે કે,

કોઈપણ દાનાદિ-અહિસાદિ ધર્મ કે ક્ષમાદિ ગુજાની સાધનાનો કુમ આ, પ્રણિધાન-પ્રવૃત્તિ વિધનજ્ય-સિદ્ધિ-વિનિયોગ.

આમાં ‘સિદ્ધિ’ એટલે તે તે ધર્મ યા ગુજાનો સ્વભાવ સિદ્ધ થાય તે. આ માટે,

(૧) પહેલાં એનું પ્રણિધાન કેળવો, ‘પ્રણિધાન’ એટલે ‘આ મારે કર્તવ્ય છે, કરવાનું છે,’ એવો જાગતો જ્યાલ, મનનું એમાં પ્રકર્ષેપ નિધાન અર્થાત્ અત્યંત સ્થાપન, મનની તન્મયતા. વિશુદ્ધ ભાવના સાથે યથાશક્તિ કિયામાં સમજપૂર્વક મનનું સમર્પણ એ ‘પ્રણિધાન’. (૨) આ પ્રણિધાન સાથે તે તે ધર્મ યા ગુજાની કિયામાં પ્રવર્તવું એ ‘પ્રવૃત્તિ’. (૩) એમાં ઉભા થતા નાના-મોટા વિનોથી જરાય ગભરાયા કે પાછા પડ્યા વિના કિયા અને ભાવને અંદર રાખી વિનો પાર કરી જવા એ ‘વિધનજ્ય’ (૪) આત્મામાં એ ધર્મ કે ગુજા સહજરૂપે બની જાય, એનો સ્વભાવ બની જાય એ ‘સિદ્ધિ’. (૫) પછી બીજા જીવો પર એની સારી અસર પડે, બીજામાં એ ધર્મ કે ગુજા આવે એવી પ્રવૃત્તિ એ ‘વિનિયોગ.’

જુઓ, આમાં શું બતાવ્યું ? પ્રવૃત્તિ કરે જાઓ એટલે સિદ્ધ થાય. આપણું કામ તે તે ધર્મ યા ગુજાની કિયામાં તન્મય થઈ પુરુષાર્થ કર્યે જવાનું. એના પર એ

૧૩૬ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“બે અમેરિકનનું દણ્ણાન્ત” (ભાગ-૪૪)

धर्म या गुणानो स्वभाव अंशे अंशे धडातो आववानो.

दिलमां प्रभु प्रत्ये प्रेमनो स्वभाव सिद्ध करवो छे ? तो एम वातो कर्ये के खाली भावना राख्ये सिद्ध नहि थाय; ए तो ए प्रेमनी प्रवृत्ति किया तन्मय थर्हने करता रहेवुं पडे. बोलो प्रेमनी किया शी शी ? हुनियामां जुओ, शेठ प्रत्ये नोकर, पति प्रत्ये पत्नी, पिता प्रत्ये पुत्र, भित्र प्रत्ये भित्र प्रेम खातर शुं शुं करे छे ? विनय केवो केवो साचवे ? सेवा केवी केवी करे ? ऐनी खातर सहन केवुं केवुं करे ? तन-मन-धननो भोग केवो केवो आपे ? ऐने दिलमां अनुं स्मरण केटलीवार अने क्यारे क्यारे थया करे ? बहार ऐनी प्रशंसा यशवाद गुणगान ए केवा करे ? बस, भगवाननी प्रत्ये प्रेमनी ऐवी भरयक प्रवृत्ति जोઈअे; तो प्रेमनो स्वभाव बनतो आवे. ज्वनमां जुओ, छे आ बधुं ? ‘हुं प्रभुनां दर्शन रोज कुं छुं’ ‘रोज पूजा कुं छुं,’ ‘रोज प्रभुना नामनी एक माणा गशुं छुं.’ एटला मात्रथी प्रभु पर सहज प्रेम बनी आवे ? प्रेमनो स्वभाव बनी आवे ? दर्शन-पूजा करवा जाओ त्यारे भक्तिनी तमारी चीज लई जाओ छो ? एटलो य भोग नथी आपवो, ने प्रभु प्रेम सिद्ध थशे ? जोजो, आटलाथीय बस नथी, पहेलां कह्युं तेम प्रेम खातर धशुं धशुं करवानुं छे. त्यारे लांबे गाणे प्रेम सहज उभो थाय; एवो के त्यां पछी हुन्यवी प्रेम फिक्का पडी जाय. पछी अवसर आव्ये एवा प्रेमस्वभाव पाइण लाघो करोडो रूपिया खरयतां आंचको नहि आवे के ‘हुं ? आटलुं बधुं खरयाय ?’

पेला करोडपति अमेरिकने एकी कलमे पांत्रीसलाख डोलर अने पोतानी कुपनीमां अउधी भागीदारीनुं दान करी दीधुं ने ? पेला ललितांग राजकुमारे हीरानो हार याचकोने एकी कलमे दानमां दर्ह दीधो ने ? एमने आंचको न आव्यो के ‘हुं आटलुं बधुं ते वजी देवाय ?’ कारण ? दाननी वारंवारनी प्रवृत्तिथी दाननो स्वभाव बनी गयो हतो, दाननुं व्यसन पडी गयुं हतुं.

ललितांगनुं हार-दान पछी शुं थयुं ? :-

ललितांगे आवो हीरानो हार हमणां भज्यो ने हमणां दानमां दर्ह दीधो. ए पेलो ऐनो ‘सज्जन’ नामनो ईर्ष्याणु भित्र के, सही शके ? तरत एँडो राजाने ऐनी चारी दीधी. बस, राजाने एकदम गुस्सो चरी आव्यो, हुं ? में ऐने बहु दान न देवानी शिखामण आपेली छतां एषो आवुं कर्हु ? हरामी शुं समजे छे ऐना मनमां ?’ तरत ऐने बोलावी तडकावे छे, ‘हार क्यां गयो ?’

कुमार कहे ‘दानमां दर्ह दीधो.’

‘आटलो बधो किमती हार दानमां ? तने ना नहोती कही ?’

‘कहेली, पश याचको बिचारा हुःभे टणवणता हता, एटले दर्ह दीधो.’

राजा कहे ‘ते तुं राज्य आवी रीते करीश ? नालायक ! ज अहीथी.’

कुमारने बहु खोटुं लाग्युं, दाक्षिण्य विनयथी कशुं बोल्यो नहि, पश पितानो ढपको ऐना खानदान दिल माटे असह्य बनी गयो, ते त्यांथी नगर बहार नीकणी गयो, चाल्यो गयो परदेश. हवे राजाशाही वैभव-विलास-सगवडो मूकी बहार भटकवानुं आव्युं, बोलो ऐनां दिलने हुःभ छे ? ना जोजो क्यां सुधीनी पीडामां हुःभ नहि ? हज पेलो हुर्जन भित्र जपतो नथी, ते ए पश चाल्यो कुमारनी पूठे, जंगलमां भेगो थर्ह कहे छे ‘जोयुं दाननुं फण ?’

ललितांगे धशुं समजाव्यो के ‘धर्मथी तो सारुं ज थाय.’ परंतु पेलो माने शानो ? ए तो कहे ‘चाल पासेना गाममां जर्ह अभिमाय लईअे के ‘धर्मथी ज्य ? अधर्मथी ? के जो धर्मनी ज्य कहे तो मारी आंभो जाय, अने ‘अधर्मथी ज्य’ एम कहे तो तारी आंभो जाय.’ ललितांगने तो धर्मथी ज्यनो पूरो विश्वास ते मंजुर कर्हु. पश पेलाअे गाममां जर्ह लोकोने ऐवी रीते वात रजु करीने पूर्धयुं बोलो अत्यारे शुं देखाय छे ? ‘लोक कहे’ अत्यारे तो अधर्मथी ज्य देखाय छे.’

पत्युं, ललितांगने क्सोटी आवी, पश ए गभरायो मूङ्गायो नहि, जंगलमां जर्हने तरत पोतानी बे आंभ काढीने आपी दीधी, हुर्जन भित्र ऐने घेरा जंगलमां दोरी जर्ह ऐना अंग परथी बधुं लूंटी ऐने रघडतो मूकीने चाल्यो गयो. केटली मोटी आपदा आवी ?

अहीं सवाल आ छे के ललितांगने ऐथी भारे हुःभ लाग्युं के नहि ? शुं पोकेपोक रोवा लाय्यो ?

ललितांगने हुःभ केम नहि ? :-

ना, ऐना मनने ठेठ राज्यमांथी नीकणी जवुं पञ्चुं त्यारथी अहीं आंभो ने धन गया त्यां सुधीनी आपदा आवी छतां जराय हुःभ न लाग्युं के वारुं ? कहो, अनुकूण तत्त्व पर दृष्टि हती, अनुकूण मज्यानो आनंद आनंद हतो, शुं अनुकूण ? दान पोतानी शक्ति हती त्यां सुधी दान करवानुं भल्ये गयुं ए पोताने अनुकूण वात छे, शावती गमती वात छे, चालो, गमे ते थयुं पश दान तो मजेनुं थर्ह गयुं ?’ ऐनो ऐने आनंद आनंद छे, पछी ऐनी आगण तो ऐने मन मामूली जेवी आ आपदाओथी हुःभ शानुं लागे ?

वात आ छे के कोध थाय छे ते कशुं प्रतिकूण आवी पडे ने मनने ऐथी हुःभ लागे ऐना पर थाय छे. त्यां कोधने अटकाववा आ जोवानुं छे के शुं आमां कशुं अनुकूण तत्त्व ज नथी ?

भुवनभानु अन्साईक्लोपीडिया-“प्रवयन महोदधि-कृष्ण रोकोः धूटवानो मोक्षो” (भाग-४४) १३७

- (૧) શું આ પ્રતિકૂળ દેખાતું બીજી કોઈ જ દૃષ્ટિએ અનુકૂળ નથી ?
 (૨) અથવા શું આ સિવાય બીજી બીજી કેટલીય અનુકૂળતાઓ વર્તી રહી છે એની વડાઈ નથી ?

(૩) અથવા આ બાધ્ય કરતાં તો કેટલાય ગુણા કિમતી દેવ-ગુરુ-ધર્મ વગેરે મળ્યાં છે, એ અનુકૂળતા શું નાનીસૂની છે ? એનો આનંદ આનંદ નહિ ? ને આ મામૂલી પર ધર્મધમાર્ટ ? કે રોદણું ?

કોધને અટકાવવા માટેની અનેક રીતની વિચારણા પૈકી આ એક અનુકૂળ તરફ દૃષ્ટિ નાખવાની વિચારણા છે એવી તાત્ત્વિક સ્વરૂપ જોવાની વિચારણા છે.

ગજસુકુમાળ મહામુનિએ આ બંને વિચારણા કરીને સોમિલ સસરા પર કોધ ઉઠવા જ ન દીધો,-

ગજસુકુમાલની બે વિચારણા :-

(૧) એક વિચારમા તો એમણે આ કરી કે ‘આ મારા મસ્તક પર ધીખતા અંગારા સાથેની માટીની પાળ એ તો મોક્ષ માટેની પાઘડી બંધાવ્યા જેવી હોઈ પ્રતિકૂળ નહિ, કિન્તુ ભારે અનુકૂળ છે.’ શિવસુંદરીને પરણવા જવું હોય તો પાઘડી બંધાવી વરરાજાની શોભા વધારવી પડે ને ? આ માથે સગડીથી જે કર્મ બળી બળીને ખાખ થવા પર આત્મતેજ-આત્મશુદ્ધિ જગહળતી થઈ રહી છે એ આત્માની શોભા છે. એથી

બળ, બળ, કાયા બળ; તું બળે એમ મારાં કર્મ બળે’ એવી અનુકૂળતાની કલ્યાના કરી.

(૨) બીજું એમણે તાત્ત્વિક વિચાર આ કર્યો કે

જે બળે છે તે મારું નથી, ને જે મારું છે તે બળતું નથી.’

તત્વથી જોતાં દેખાય છે કે ‘બળે છે કાયા, પણ તે કાંઈ આત્માની કાયમી સ્વભાવભૂતથી જ નથી. નહિતર અનંતી કાયા મૂકવી બદલવી ન પડત. એમ, જે આત્માની કાયમી સ્વભાવભૂત વસ્તુ જ્ઞાન-દર્શન-ચારિત્ર છે, તે કાંઈ અભિનથી બળતા નથી. ત્યારે પોતાની ચીજ નહિ, એવી દુર્જન પાડોશી જેવી કાયા બળે એનું દુઃખ શું કરવું ? તેમ જ નહિ બળી શકતા જ્ઞાન-દર્શન-ચારિત્ર જો પાસે જ છે, તો સંતોષનો દમ જ ખેંચવો ને ?

આમ બંને રીતની વિચારણાથી ગજસુકુમાળ મહામુનિએ કોધને તદ્દન અટકાવી દીધો, એવો અટકાવ્યો ને એવા ઉપશમ ભાવમાં ચડ્યા ચડ્યા કે ત્યાં બળીને મૃત્યુ થાય એ પહેલાં જ શુકલધ્યાન ક્ષપકશ્રેણી અને કેવળજ્ઞાન પામી મોક્ષ સિધાવ્યા, અનુકૂળતાની કલ્યાના અને તાત્ત્વિક વિચાર કેટલું અદભુત કામ કરે છે ?

તાત્ત્વિક વિચાર તો એક જાતનું પોલાઈ બખ્તર છે, આત્માને મોહદેણિના, દુખુદ્ધિના, આર્તધ્યાનના, કાળી લેશયાના, દીનતા કોધ કે ઉન્માદ-અભિમાનના કશા બાણ લાગવા ન હે.

તત્વવિચારની વડાઈ :-

ગજસુકુમાલ મહામુની કેટલા બધા સુકોમળ શરીરવાળા ? એમના પર દીક્ષા લઈને હજી બીજા પરીસહ વગેરે સહી શરીરનો કસવાનો અભ્યાસ પણ નથી થયો, ત્યાં માથે સગડી મૂકાવાની અને ઊભા બળવાની ઘોર પીડા આવી ! ત્યાં સગડી મૂકનાર પ્રત્યે કોધાદિ કષાય એને મારવાની કાળી લેશ્યા, પીડાનું ભારે આર્તધ્યાન વગેરેના ઘા લાગવાનો પૂરો સંભવ ગણાય, પરંતુ ‘બળે છે તે મારું નથી, મારું છે તે બળતું નથી, એવા તાત્ત્વિક વિચારે બખ્તરનું કામ કર્યું પછી પેલા કષાયાદિના ઘા શાના લાગો ? ઊલટું તત્વવિચારે શુભ ભાવનાની વૃદ્ધિ કરી, ધર્મધ્યાનનો વેગ વધાર્યો શુકલધ્યાને સુલભ કરી દીધું, અને અસંખ્ય વરસોની આથી પણ અનંતગુણી વેદનાઓ સહેવા છતા પામવું અશક્ય એવું કેવળજ્ઞાન અને મોક્ષ વાત વાતમાં પ્રામ કરી લીધા. તત્વવિચારની વડાઈ કેવી ?

અરિહંત પ્રભુનો જ અનન્ય ઉપકાર કેમ ?

ચાલુ જીવનમાં તત્વવિચારની વડાઈનો એક દાખલો જુઓ,-

સીતાજીને રામયંત્રજીએ વનમાં ધકેલી મૂક્યા પછી જ્યારે સીતાજીના બે પુત્રો લવણ-અંકુશે રામ-લક્ષ્મણને લડાઈ આપી, રામ-લક્ષ્મણ જતી શક્યા નહિ, ચિંતામાં પડ્યા, નારદજીએ ઓળખ કરાવી, ને પાછા સીતાજ મળ્યા, એમણે અભિનમાંથી પસાર થવાનું દિવ્ય કર્યું, અભિની ખાઈ પાડીનું સરોવર બની ગયું ત્યારે રામયંત્ર સીતાજ આગળ પારાવાર પસ્તાવો કરે છે કે મેં કેવી ભૂલ કરી કે મહાસતી એવા તમને મહાસંકટમાં મૂક્યા ? ત્યાં સીતાજ, જુઓ, કેવો એક તાત્ત્વિક વિચાર આપે છે કે જેથી રામનું મન ફોરું થઈ જય છે.

સીતા કહે છે, ‘તમારે સંતાપ કરવાનો હોય નહિ તમારે આનંદ માનવા જેવો છે, કેમકે (૧) કોઈ દૈવ મને જંગલમાં મૂકાવી, પરંતુ મારા દિલમાં તમારા સિવાય બીજા કોઈને સ્થાન નહોતું, માત્ર એક જે તમે મારા દિલમાં વસેલા હતા એણે મને જંગલમાંથી આશ્રયદાતા ધર્મનો ભાઈ મેળવી આપ્યો એમ, (૨) કોઈ દૈવ મને આ અભિની ખાઈમાં ઉતારી, પરંતુ એક તમે મારા હદ્યમાં છતે દિવ્યક્ષોટી પસાર થઈ ગઈ, અભિની ખાઈ જલાશય બની ગઈ તમે દિલમાં છતે આ બંને બન્યું એવા પ્રભાવવાળા તમારે તો એ પ્રભાવ પર ઝુશી જ માનવાની; સંતાપ

શાનો ?

કેવો સુંદર તત્ત્વવિચાર ! પૂછતા નહિ કે

પ્ર.- પણ આમાં રામનો પ્રભાવ શાનો ? પ્રભાવ તો સીતાના સતીત્વનો ને ?

ઉ.- સાચું કિન્તુ ‘સતીત્વ’ એટલે શું ? ‘માત્ર એકલા પતિને હૃદયમાં રાખવા’ એજ ને ? તો એ તો સીતાજી કહી રહ્યા છે કે હૃદયમાં એકલા પતિ રામ જ વસેલા હતા રાવણ વગેરે બીજું કોઈ નહિ, તેથી દિવ્ય ક્ષેમકુશળ પસાર થયું. બીજાને દિલમાં રાખ્યા હોત તો સતીત્વ નહિ, ને એ નહિ તો અજિન પાણી બને નહિ; દિવ્યપરીક્ષામાં ઉતીર્ણ થવાય નહિ. ત્યારે પૂછો,-

પ્ર.- તો એ તો સીતાજીના દિલની વિશેષતા ને ? રામે આવીને શું કર્યું ?

ઉ.- અહીં જ ભૂલ થાય છે, આલંબનનું મહત્વ ભૂલાય છે, આલંબનની મહાન વિશેષતા જ્યાલમાં નથી આવતી, તેથી આ પ્રશ્ન થાય છે. વિશેષતા સીતાના સતીત્વભર્યા દિલની ખરી, પરંતુ એ દિલમાં રામયંત્રજીનું સ્વામી તરીકે આલંબન ધરવા પર જ વિશેષતા હતી. સતીત્વ એટલે દિલમાં એકમાત્ર પતિને જ સ્થાન દિલની પ્રીતિનું પાત્ર, પ્રીતિનું આલંબન એકમાત્ર પતિ, બીજો કોઈ પુરુષ નહિ. ત્યારે જો આ પતિના જ આલંબને સતીત્વ, અને એના જ હિસાબે દિલની વિશેષતા, તથા અજિન પરીક્ષામાં ઉતીર્ણતા, તો શું મૂળ વિશેષતા પતિની ન આવી ? સીતા રામને આ કહે છે કે ‘તમે મારા હૃદયમાં છતે અજિન પરીક્ષા પાસ થઈ ગઈ.’

સજ્જન માણસ આલંબનની મહત્વાનું ભૂલે, એ મૂકીને જાતવડાઈ ન ગય.

આલંબનનો તો મહાન ઉપકાર છે. એટલે તો અરિહંતદેવનો સર્વ સાધનામાં અને સાધનાના ફળમાં શ્રેષ્ઠ ઉપકાર શાસ્ત્રકારો કહે છે.

જાતમહેનત કરતાં આલંબનની ટેકાની વિશેષતાનું દેખાન્ત :-

દા.ત. માનો કે તમે શ્રી શત્રુંજય ગિરિરાજ કે સમેતશિખર મહાતીર્થી યાત્રાએ ગયા. મુસાફરીમાં તબીયત કોઈક ઢીલી પડી ગઈ છતાં તમે ગિરિરાજ કે શિખરજી પહાડ પર ચડવા માંડયું પણ થોંણું ચડવા એમાં લાગ્યું કે, શાસ ચરી જાય છે, પગ લથે છે, સામે નજર નાખી તો પર્વત બહુ ઊંચો દેખાય છે. હિંમત હારી ગયા, મનને થયું કે ‘આપણું કામ નહિ, ચાલો પાછા.’ એમ કરી પાછા વળતા હતા ત્યાં કોઈ સજ્જન મળી ગયા, પૂછે છે કેમ એટલામાં પાછા ?’ તમે હકીકિત કહી, ત્યારે એ કહે ‘અરે ભાગ્યવાન ! ગભરાઓ શાને ? ચાલો હું હાથનો ટેકો આપું, મારા હાથ પર તમે હાથ ટેકાવીને યા મારા ખબે હાથ મૂકીને ચડવા માંડો. વાંધો નહિ આવે ? એનાં આશાસન અને ટેકા પર ચડવા માંડયું. હવે માનો કે એમ ચડતાં ચડતાં

ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

રાહત લાગી અને ઉલ્લાસ વધ્યો, ને એમ ટેક ઉપર સુધી ચરી ગયા હો; ત્યાં ચડવા તો તમારા પગે, તમારા પગની મહેનતે, અને ટેકો પકડવાની તમારી કુશળતા તથા તમારા પુરુષાર્થી ચડવા છતાં પેલા ટેકો બનનારનો આલંબન બનનારનો ઉપકાર કેવો માનો ? શું કહો એને ? આ જ ને કે ‘ભાઈ ! મારે તો આજે ઉપર ચરી જવાની આશા જ નહોતી, પાછા જ જવાનું હતું, પરંતુ આ તમારા ટેકે ચરી જવાનું; તમે જ મને ઉપર લઈ આવ્યા. તમારો બહુ ઉપકાર માનું છું.

શું કહ્યું ? ‘તમારા ટેકે ચડાયું, તમે ચડાવ્યો.’ અલ્યા ! તારા પગે ચડાયું, કે ટેકે ? તે ટેકો પકડવાની મહેનત કરી એ તારી મહેનતે તને ચડાવ્યો ? કે પેલા ટેકો બન્યા એમણે ચડાવ્યો ? કોણો ઉપર ચડાવ્યો ?

ટેકાએ નહિ, ટેકો પકડવાની મારી મહેનતે ચડાવ્યો; આવું તો કૃતજ્ઞ નિમક્હલાલ ન હોય, ધિંહો અભિમાની હોય એ બોલે.

કોણ બોલે ? ટેકો પકડવાની મહેનત કરતાં ટેકાનું વિશેષ મહત્વ છે એ સમજવા અભૂત હોય, ભોડ બુધ્ય હોય યા ધિંહો કે અભિમાની હોય એ બોલે.

આપણી મહેનત કરતાં ટેકાનું આલંબનનું મહત્વ વધારે ?

હા, દેખો જ છો ને કે મહેનત એટલે પુરુષાર્થ-શક્તિનો ઉપયોગ શક્તિ તો પડી હતી, તો વિના ટેકાએ એનો ઉપયોગ કરી પર્વત ચરી જવો હતો ને ? અથવા કોઈ દૂબળાકલાસ માણસનો ટેકો લઈ ચડવું હતું ને ? ‘ના ભાઈસાબ ! ટેકા વિના લથડિયું ખાઉં તો ? દુર્બલ કલાસના ટેકે કદાચ એ લથડે પડે તો હું ય પડું’ આ જ જવાબ છે ને ? એનો અર્થ જ આ છે કે ‘પુરુષાર્થ શક્તિ કરતાં સબળ ભરોસાપાત્ર ટેકાનું આલંબનનું વિશેષ મહત્વ છે,’ એમ મન કહી રહ્યું છે. પછી બહાર બોલવામાં જાતમહેનતની વડાઈ કહેવી એ ધિંહાઈ છે, અભિમાન છે; કૃતજ્ઞતા નિમક્હલાલી નથી.

બસ, જેવી રીતે ગિરિરાજ ચડતાં ટેકો આપનારની મહત્વાની લાગે છે, એનો ઉપકાર મનાય છે, એવી રીતે સીતા રામનો ઉપકાર માની રહી છે કે તમે હૃદય માં છતે જંગલમાં આશ્રયદાતા મળી ગયો, અને તમે હૃદયમાં છતે અજિની ખાઈ પાણીનું સરોવર બની ગઈ. ‘બંનેમાં તમારી જ વિશેષતા છે. માટે ખેદ ન કરો.’

એટલે ? ખાઈનું સરોવર કોણે બનાવ્યું ? સીતા શું કહે છે ? ‘મારા સતીત્વે નહિ, અર્થાત એક તમને જ દિલમાં ધરવાની મારી વડાઈએ મારી મક્કમતાએ નહિ, કિન્તુ દિલમાં મક્કમતાથી ધરાયેલા તમે.’ મહત્વ પોતાની મક્કમતાનું નહિ, સતીત્વનું નહિ, પણ મક્કમતાથી ધરાયેલ પતિ રામનું ગાઈ રહી છે. ગિરિરાજનો દાખલો ભૂલશો નહિ ઉપર કોણો ચડાવ્યા ? ટેકો પકડવાની જાતમહેનતે ચડાવ્યા

૧૪૨ ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“અરિહંત પ્રભુનો જ અનન્ય ઉપકાર કેમ ?” (ભાગ-૪૪)

નહિ, પણ મહેનતથી પકડાયેલ ટેકાએ ઉપર ચડાવ્યા.

‘મહેનતથી ચડાવ્યા’ ને ‘ટેકાથી ચડાવ્યા’ એ બેમાં બહુ ફરક.

‘ચડાવ્યા’ એમાં ચડવાની કિયાનો કર્તા આત્મા છે, આત્માધિષ્ઠિત શરીર છે, અને ટેકો પકડવાની મહેનતથી ચડાવ્યા, માટે મહેનત એ મુખ્ય સાધન અને ટેકો એ ગૌણ સાધન છે. પરંતુ મહેનતથી પકડેલા ટેકાએ ચડાવ્યા એમાં ટેકો મુખ્ય સાધન અને મહેનત એ ગૌણ સાધન છે.

એમ, મહેનતે ચડાવ્યા ને ટેકાએ ચડાવ્યા,-બેમાં બહુ ફરક ‘ચડાવ્યા’ એમાં જો મહેનતે ચડાવ્યા તો ચડવવાની કિયાનો કર્તા મહેનત છે, અને ટેકો એમાં માત્ર સાધન છે. એનાં બદલે જો મહેનત પકડેલા ટેકાએ ચડાવ્યા, તો ટેકો કર્તા છે, અને મહેનત એમાં માત્ર સાધન છે.

સાધના અરિહંતના પ્રભાવે કેમ :-

‘ચડાવ્યા’ કે ‘ચડાવ્યા’ બંનેમાં ખ્યાલ ક્યાં જાય છે એ જોવાનું છે; મુખ્યતા કોને અપાય છે, એ સમજવાનું છે. આટલું ખ્યાલ-સમજનું પૃથક્કરણ કેમ કરાય છે? એટલા માટે કે જો ગિરિરાજ પર ચડવાના દાખલાથી ટેકાનું આલંબનનું મુખ્ય મહત્વ વિશેષ મહત્વ સમજાય, તો પછી એ હિસાબે આપણી બધી ધર્મસાધનાઓમાં મુખ્ય આલંબનભૂત અરિહંત પરમાત્માનું મુખ્ય મહત્વ વિશેષ મહત્વ સમજાય, સાધના એમના જ પ્રભાવે થઈ એમ લાગે, અને એથી એમનો અનન્ય ઉપકાર મનાય.

ગિરિરાજ શત્રુંજ્ય કે સંમેતશિખર ચડવાની બહુ ગરજ હતી અને ટેકા વિના ચડાવ્યા એમ લાગતું નહોતું, પાણી ફરતા હતા એટલામાં ટેકો આપનાર મળી ગયાથી ચડી ગયા, ત્યાં એ ટેકાભૂત આલંબનભૂત વ્યક્તિનું જ ભારે મહત્વ મનાય છે. ગદ્યગદ્ય દિલે એનો ભારે ઉપકાર મનાય છે કે ‘આ તમારા પ્રતાપે ચડી શકાયું, તમારો અનહંત ઉપકાર,’ બસ, એ રીતે,

આપણે બધી સાધનામાં અને એની ફળની પ્રાપ્તિમાં પ્રભુશી અરિહંત પરમાત્માનું જ મહત્વ અને એમનો જ ઉપકાર માનવાનો છે; કેમકે એમના આલંબને જ એ બને છે.

દા.ત. આપણે લાખ રૂપિયાની પ્રભુની ભક્તિ માટે ઉદારતા કરી. આંગીમૂગટ બજાવીને જિનભક્તિની સાધના કરી, તો ત્યાં પ્રશ્ન છે કે આ જિનભક્તિ પ્રભુને પકડીને થયેલી ઉદારતાના પ્રતાપે થઈ? ઉદારતાએ અગર બીજા કોઈ રાગ દ્વેષથી મેલા દેવ યા ધરવાળાને પકડ્યા હોત અને એમના પર લાખ રૂપિયા ખર્ચ્યા હોત તો જિનભક્તિની અતિ ઉત્તમ સાધના થાત? એ ફળ મળત? ના, એ તો અરિહંત દેવને પકડાય, ને એમના પર ઉદારતા થાય, તો જ જિનભક્તિનો લાભ મળે, અને

ફળમાં અનહંત અચિત્ય પુણ્ય અને કર્મક્ષયનો લાભ થાય. એટલે મહત્વ ઉદારતા કરતાં પાત્રનું છે. અરિહંતદેવનું છે.

પાકમાં પાણી કરતાં પાત્રનું મહત્વ :-

પાણી તો ઉખર ભૂમિ પર પણ પડે અને પાત્ર રસાળ ભૂમિ પર પણ પડે, કિન્તુ પાક પાત્રભૂત રસાળ ભૂમિનું મહત્વ પાણી કરતાં વધુ છે.

એમ અહીં જિનભક્તિમાં જિનનું મહત્વ, પૈસાનું નહિ.

જિનભક્તિની ઉત્તમ સાધના થવામાં અને એનું વિશેષ ફળ મળવામાં મહત્વ પૈસા-પૈસાની ઉદારતા કરતાં પાત્ર દેવાધિદેવ અરિહંત પરમાત્માનું છે, પૈસા એ પાણીના સ્થાને છે. એ પૈસા બીજે ન જતાં અરિહંતરૂપી શ્રેષ્ઠ, પાત્ર પરમપાત્રમાં જાય તો જ એ ઉચ્ચ સાધના બને ને? અને ઉચ્ચ ફળ આવે ને? પછી એ ઉચ્ચ સાધના બની, ને ફળમાં પહેલાં સારો દેવભવ, પછી સુંદર મનુષ્યભવ, ઉત્તમ જૈનકુળ, નીરોગી સુંદર શરીર ધન વગેરે મળ્યું એ બધામાં મુખ્ય ઉપકાર કોનો? તમે પરમપાત્ર અરિહંત પ્રભુમાં લાભ રૂપિયાના આંગીમૂગટનું દાન કર્યું, ઉદારતા કરી એનો? કે એ દાનને એ ઉદારતાને પરમપાત્ર મળ્યું એનો?

પૈસાનું મહત્વ કેમ નહિ?

કહેવું જ પડે કે પૈસા તો ધણો બધે ખરચાય છે, ઉદારતા કરાય છે, પરંતુ ખર્ચ માટે અરિહંતપ્રભુનું આલંબન મળ્યું માટે જ એ ઊંચી દાનસાધના ભક્તિસાધના બને છે, ને ઊંચા ફળ આવે છે; પણ બીજાનાં આલંબને નહિ. બીજાને એ ચડાવો તો નહિ, માટે પ્રતાપ અરિહંતનો છે. તો જેવી રીતે કોઈના ટેકાથી ગિરિરાજ ચરી ગયા, તો કહો છો, એઝો મને ચડાવો, એમ અહીં અરિહંતના ટેકે બધું સાચું થાય છે, માટે કહેવું જોઈએ કે ‘મેં કે મારા પૈસાએ શી ધાડ મારી? મેં પ્રભુનું કર્યું પ્રભુ મેં મુગટ ચડાવ્યો, આંગી મેં રચાવી એમ નહિ, કિન્તુ પ્રભુએ મને દાન કરાયું, પુણ્ય આયું, દેવ-મનુષ્ય સદ્ગતિ અને તન-મન-ધનની સગવડ સામગ્રી આપી.’ આ ખ્યાલ નથી. એટલે જિનભક્તિમાં પૈસા ખરચીને અભિમાન થાય છે. તકતી લગડાવાય છે, જાણે પ્રભુ ઉપર ઉપકાર કર્યો? બાકી દ્યા પાળો, દાન કરો, પ્રત કરો, નિયમ કરો, તપસ્યા કરો, સામાધિક પ્રતિક્રમણ કરો, યાવત્ ચારિત્ર લો પાળો, એ બધું પણ અરિહંત ભગવાનના આલંબને ભગવાનની આજ્ઞાના આલંબને થાય છે; માટે એમાં વડાઈ જાતમહેનતની નહિ, પણ અરિહંતપ્રભુની. શ્રી લલિત વિસ્તર શાસ્ત્રની ટીકામાં શ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજા ત્યાં સુધી કહે છે કે કેદીક શુભ ભાવ આવે એ પણ ભગવાનના પસાયથી આવે છે.

અરિહંત પ્રભુનો જ અનન્ય ઉપકાર કેમ ?

દ્યા-દાનાદિ કે શુભ ભાવ પ્રભુના પ્રતાપે ? હા, કારણ આજ કે એમાં પ્રભુનું પ્રભુના સ્વરૂપનું, પ્રભુની આજ્ઞાનું આલંબન છે. ટેકો છે;

એના આધાર પર જ ભાવ એ શુભ ભાવ અને દ્યાદિ એ ધર્મ બને છે.

દ્યા-દાન-શીલ-પ્રતનિયમ-બ્રહ્મચયર્થ-તપસ્યા-સામાયિક-પ્રતિકમણ-ચારિત્ર, વગેરે પ્રભુના આલંબને જ હોય તો જ એ ધર્મરૂપ બને. ભાવમાંથી વીતરાગ પ્રભુનું સ્વરૂપ, યાને વૈરાગ્ય કાઢી નાખો, તો એ અશુભ ભાવ થવાનો દા.ત. અભવી સાધુના દિલમાં જવરક્ષાનો ભાવ છે, પરંતુ એ તો સ્વર્ગના સુખ યા હુન્યવી યશ-સન્માન સારભૂત માની એ લેવા માટે છે, એટલે ત્યાં વૈરાગ્ય નથી; માટે એ ધર્મરૂપ નથી.

દ્યા બ્રહ્મચયર્થ વગેરે ધર્મરૂપ ક્યારે નહિ ? :-

એમ-દ્યા કરે કસાઈખાનેથી જીવ છોડાવે પરંતુ એ તો શેઠની માત્ર નોકરી બજાવવા ખાતર, તો ધર્મ નથી. બ્રહ્મચયર્થ પાળે, પણ ટી.બી. મટી જાય અને પછી સંસાર સારી રીતે ભોગવી શકે એ માટે તો એ ધર્મરૂપ નથી. પગારદાર બ્રાહ્મણ-પૂજારી પ્રભુભક્તિ બહુ કરે છે, શું એ ધર્મ કરે છે ? ના અર્થોપાર્જનની પ્રવૃત્તિ કરે છે. પતિ ધર્મિષ્ટ હોય, એ રીજવવા પત્ની પ્રત-નિયમ-તપસ્યા કરે છે, તો શું ધર્મ કરે છે ? ના, પતિપ્રેમનો ઉપાય સેવે છે.

આ બધામાં ધર્મરૂપતા કેમ નહિ ? કહો, એ પ્રભુનું પ્રભુની તારક આજ્ઞાનું પ્રભુના સ્વરૂપનું અંશે આલંબન નથી. પ્રભુ વીતરાગ છે, વીતરાગતાનું આ સ્વરૂપ વૈરાગ્ય છે. અહીં કંઈ વૈરાગ્યનાં આધાર પર એ બધું થતું નથી. અહીં તો હુન્યવી ધન, સુખ, માનપાન વગેરેમાં સર્વસ્વ માની એના તીવ્ર રાગ ઉપર ધર્મપ્રવૃત્તિ થાય છે.

ત્યારે લઘુકર્મા નિકટમોક્ષમાગામી ભવ્યાત્મા ચારિત્ર લે પાણે એ ય પ્રભુના આલંબને એમાં બીજી કોઈ કામના નથી. કામના માત્ર પ્રભુની આજ્ઞાનું પાલન કરવાની, વીતરાગ પ્રભુના આલંબને વીતરાગતા તરફ આગેકૂચ્ય કરવાની છે. એટલે એ ચારિત્ર ધર્મરૂપ બને છે, અને એમાં પોતાનાં પુરુષાર્થ કરતાં પ્રભુના આલંબનને જ વધુ મહત્વ આપે છે મને કહે છે,-

ભક્ત પ્રભુને નિવેદન :-

‘ઓ મારા વીતરાગ અરિહંત નાથ ! તમારો આ કેટલો બધો અનુપમ ઉપકાર કે તમે નજર સામે રહો છો, તમારું જીવન અને તમારી આજ્ઞા નજર સામે રહે છે. તેથી જ સાધનામાં જબરદસ્ત આત્મ બળ મળે છે, બાકી મારું શું ગજું કે તમે ન મળ્યા હો, તમારા વચ્ચન ન મળ્યાં હોય, ને હું આ સાધના કરી શકું ? બળ તો પાડાને ય મળ્યું છે, પણ એ બિચારો તમારા ટેકા વિના એ બળનો આ ઉપયોગ કરી શકે ? તપ વગેરેનું બળ તાપસો વગેરેમાં ય હોય છે, પણ નાથ ! તમારા ટેકા વિના ક્યાં છે એની પાસે આ વિવેકભરી નિર્મળ સાધના ? મારે તો પ્રભુ ! તું જ સર્વેસવાં છે, તું જ મને પાપના ધોર ગર્તભાંથી ઊંચા ચડાવી રહ્યો છે.

શ્રી ડેમચંદ્રસૂરિજી મહારાજ પ્રભુને કહે છે,

‘ભવત્પ્રસાદેનૈવાહ-મિયર્તી પ્રાપિતો ભુવમ !

‘પ્રભુ ! તમારા પસાયે જ મને આટલી ભૂમિકાએ ચડાવ્યો છે, મતલબ, મારું ગજું નથી, મારી હોશિયારી વડાઈ વિશેષતા નથી. બધો પ્રભાવ પ્રભુનો છે. જુઓ અહીં પ્રાપિતો લખ્યું છે, પ્રામો નહિ આટલી ભૂમિકા હું ચડાવ્યો મેં પ્રામ કરી એમ કહેવું હોત તો તો પ્રામો કહેત; અને એમાં ભવત્પ્રસાદેન-પ્રભુનો પસાય એ એક સાધનમાત્ર થાત. પરંતુ પ્રામો ન કહેતાં પ્રાપિતો કહ્યું. પ્રેરક ધાતુપ્રયોગ કર્યો, એનો અર્થ પ્રામ કરાવાયો, થાય. કોના વડે પ્રામ કરાવાયો ? ભવત્પ્રસાદેન અર્થાત પ્રભુના પસાય વડે, એટલે ઊંચી ભૂમિકાની પ્રાપિતીમાં પ્રભુનો પરસાય પ્રભાવ એ માત્ર સાધન નહિ. પણ કર્તા બન્યો. પ્રાપિત કરાવનાર પ્રભુનો પ્રસાદ અર્થાત્ પ્રભુ એ અર્થમાં કહેતાં કવિનો ભાવ આ છે, - પ્રભુ ! આટલી ઊંચી ભૂમિકા પ્રામ કરવામાં મારું ગજું નથી, મારી વડાઈ વિશેષતા નથી. તારા પ્રભાવે જ આ પ્રામ કરાવી છે. સાધનામાં ઉત્ત્રતિમાં અને સદ્ગુણોના વિકાસમાં તારો જ પ્રભાવ કામ કરી રહ્યો છે. કેટલો સર્વાત્કૃષ્ણ ઉપકાર તારો ! કેવો અજબ તું જ ધર્મદાતા, તું જ ધર્મપાલક તું જ ધર્મોદ્યક્ષા-પ્રાપક અને અંતે તું જ મોક્ષદાતા !’

શું ? પ્રભુ હાથ પકડવા આવ્યા છે ? હાથોહાથ દેવા આવ્યા છે ? ના, છતાં કવિ કહે છે, પ્રભુ જ ઊંચે સાધના ગુણ-ઉત્ત્રતિમાં ચડાવનાર છે.’

આ શ્રી મનોભાવના ચાલી ? અરિહંત પ્રભુનો બધે જ અનન્ય ઉપકાર માનવાની એ ભાવનામાં આ આવ્યું કે,

“મારું બધું સારું અરિહંતે કર્યું. દાન મેં નહિ કર્યું, અરિહંતે દાન કરાવ્યું; શીલ મેં નહિ પાણ્યું, ત્રણ મેં નહિ કર્યું, પણ અરિહંતે મારી પાસે શીલ પળાવ્યું

ગ્રત નિયમ કરાવ્યા તપ હું શું કરી શકું ? એ તો મારા અરિહંત પ્રભુએ મને તપ કરાવ્યો. એમ મનુષ્ય જન્મ અને અનેકાનેક વાતની શરીર આરોગ્યાદિની અનૂકળતા હું શું પામી શકું ? દ્યાળું ટેવાધિદેવે એ પમાઝું...યાવત્ત અંતિમ વીતરાગતા અને મોક્ષ પણ હું શું પામી શકું ? એ તો પ્રભુ મને પમાડશે, ગણધરો પ્રભુને નમસ્કાર કરતાં કહે છે “જિણાણં જવયાણં...મુત્તાણ મોયગાણં” પ્રભુ જિન બનાવનાર...મોક્ષ પમાડનાર છે. તાત્પર્ય બધું સારું મળ્યું એ મેં જાતે નથી મેળવ્યું, પણ પ્રભુએ આપ્યું છે.

શું ? પૈસા કોણે આપ્યા ? પ્રભુએ, પરિવાર-પ્રતિષ્ઠા કોણ આપનાર ? પ્રભુ.

પ્ર.- એ તો બધું પુણ્યે આપ્યું ને ? ધર્મ આપ્યું ને ?

ઉ.- પણ એ પુણ્ય ઉલ્લં કોના આલંબનને થયું ? ધર્મ કોના આલંબને થયો ? બસ, કહેવું જ પડશે, પ્રભુનાં જ રુડાં આલંબન ધર્મ થયો, ને પુણ્ય ઉલ્લં થયું. માટે એ બધું કરી આપવામાં મુખ્ય પણે અસાધારણ કારણ તરીકે આલંબન જ કહેવાય. કહો, પરમાત્માએ એ બધું ગ્રામ કરાવ્યું. પરમાત્મા એ બધાના દાતા છે.

પ્રભુ દાતા છે અનું શાસ્ત્રપ્રમાણ :-

માટે તો ‘નમુંથ્યાણં સૂત્રમાં ભગવાનની સુતિ કરી કે અભ્યદ્યાણં ચક્ષુદ્યાણં, મર્ગદ્યાણં, સરણદ્યાણં, બોહિદ્યાણં, ધર્મદ્યાણં...જવયાણં, તારયાણં, બોહ્યાણ મોયગાણ. આમાં પ્રભુને અભ્યના દાતા ચક્ષુના દાતા, માર્ગના દાતા, શરણના દાતા બોહિના દાતા, અને ધર્મના દાતા કદ્યા, તેમજ રાગાદિ જીતાનાર, તારનાર, બોધ પમાડનાર અને મુક્ત કરનાર તરીકે બતાવ્યા. આ શું ઉપચારથી ? ના, આ તો ગણુધર ભગવાને રચેલું સૂત્ર છે. પ્રભુની ઔપચારિક એટલે કે વસ્તુસ્થિતિ વિનાની સુતિ ગુણગાન કરે નહિ, એમ શ્રી લલિતવિસ્તરા, શાસ્ત્રમાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે કહ્યું છે. શું પ્રભુમાં એવા અભ્યદ્યાતાપણું, વગેરે ગુણ ખરેખર છે નહિ, એને આવા મહાક્ષાની ગણુધર મહારાજ અને ગાય ? તો તો પછી ભગવાનનો અરિહંત ભગવંત સ્વયંબદ્ધ પુરુષોત્તમ લોકનાથ, ધર્મનાયક, ધર્મસારથિ, જિન-તીર્થ-બુદ્ધ-મુક્ત-સર્વજ્ઞ-સર્વદર્શી વગેરે તરીકે ઓળખાવ્યા, એ બધું પણ ઔપચારિક હરે ! તારે એમ પણ ન કહેવાય કે થોડા તો વાસ્તવિક ગુણગાન અને થોડા ઔપચારિક ગુણગાન કર્યા છે; કેમકે એમાં પછી નિયમ શો રહે કે આ આ વાસ્તવિક ને આ આ જ ઔપચારિક ? તારે પ્રશ્ન થાય.-

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો: ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૧૪૭

પ્ર.- નિયમ આ રહે ને કે વિશેખણ વસ્તુ ગત્યા ખરેખર ઘટી શકે એ વાસ્તવિક, અને ન ઘટી શકે એ ઔપચારિક ?

ઉ.- હાં બરાબર, એ હિસાબે અભ્યદાતાપણું ઘટી શકે છે માટે અને વાસ્તવિક જ ગણાય આ રીતે ઘટી શકે છે કે અભ્ય નિર્ભયતા એટલે કે ચિત્ત સ્વાસ્થ્ય; એ આપણે વીતરાગ ભગવાનનું આલંબન કરીએ તો જ પામી શકીએ છીએ. મેળવી શકીએ છીએ, માટે મુખ્ય અસાધારણ કારણ એ ભગવાન બન્યા; એટલે એ જ ચિત્તસ્વાસ્થ્ય યાને અભ્ય આપનાર બન્યા.

ગિરિરાજ ચડવાનો દાખલો ભૂલતા નહિ, આપણે આપણા જ પગે ચડવાનું હતું, દૂબળા હતા એટલે કોઈ ના હાથ કે ખભા ઉપર ટેકો આપ્યો, સામાના હથને કે ખભાને આપણે ટકો કર્યો તો જ ચીરી શક્યા; અને એટલે જ ત્યાં સામાને આપણે અને કહીએ છીએ કે ભાઈ ! આજે તો હું હિંમત હારી ગયો હતો, ચડયા વિના પાછો જ જવાનો હતો; આ તો તમે વળી મહેરબાની કરી અને ટેકો આલંબન આપીને મને ઉપર ચડાવી દીધો, બાકી મારું ગજું નહોતું.’ આટલી જ્યારે સ્પષ્ટ વસ્તુ છે કે ટેકો વિના પોતાનું કશું ગજું નહોતું, અને ટેકાએ ચડાવી દીધો, તો ચડાવનાર ટેકો જ છે, એમ માને છે. તો પછી અહીં જ્યારે વીતરાગ પ્રભુના આલંબન વિના જ ચિત્ત સ્વાસ્થ્યનું ગજું નહિ, અને એ આલંબને જ ચિત્ત-સ્વાસ્થ્ય આવ્યું, તો એ પમાડનાર તરીકે ટેકાભૂત વીતરાગ કેમ ન કહેવાય ?

ઉપદેશમાં પુનરોક્તિ કેમ ? :-

આ વાત ફરી ફરીને એટલા માટે કહેવાય છે કે મનમાં પ્રભુનો અનન્ય ઉપકાર બરાબર છસી જાય. ભલે મહેનત આપણી પણ (૧) પ્રભુનું આલંબન. (૨) પ્રભુનું તત્ત્વ-માર્ગદર્શન. અને (૩) પ્રભુના જીવનનું દર્શન; એના આધારે જ આપણે દેવદર્શન-પૂજન-ભક્તિ અને દ્યા દાનાદિ ધર્મ સાધી શકીએ છીએ, અભ્ય યાને ચિત્તસ્વસ્થતા તથા શાસ્ત્રજ્ઞાન પામી શકીએ છીએ. તેમજ પુણ્યોપાર્જન અને ઉત્તમ માનવભવ વગેરે સામગ્રી પામી શકીએ છીએ, એ બધું પ્રભુના જ આધારે; માટે પમાડનાર પ્રભુ કહેવાય આ મન પર જો બરાબર છસી જાય તો આપણું અભિમાન ઓગળી જાય. કે ‘હું મારી બુદ્ધિ અને મહેનતથી આટલું ભણ્યો...’ મેં અઢીસો રૂપિયાની આંગી રચાવી... ‘મેં રૂપિયા ૧૦ હજાર આપ્યા ત્યારે ઉપાશ્રય થયો...’ મેં સંઘ કાઢ્યો... ‘મેં મોટો તપ કર્યો...’ મેં આત્મબળથી આવાં આવાં વ્રત લઈ લીધાં... ફલાણા શું લેતાં-કરતા હતા, મુફ્લીસ ?... આવાં આવાં અભિમાન ઓગળી જાય. જો એ બધામાં પ્રભુએ એ બધું કરાવ્યું માનતા હોઈએ, મનને લાગતું હોય કે મારું શું ગજું ? એ તો પ્રભુનું આલંબન હતું, પ્રભુનું માર્ગદર્શન હતું, પ્રભુનું

૧૪૮ ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-“અરિહંત પ્રભુનો જ અનન્ય ઉપકાર કેમ ?” (ભાગ-૪૪)

જીવન સામે હતું, તો આ બની શક્યું.’

એકલું આમાં જ નહિ, આપણામાં ક્ષમા દ્યા, સત્ય, ન્યાયનીતિ, ઉદારતા, ગંભીરતા, પરોપકાર, વગેરે ગુણો જીલે ત્યાં પણ ઉપકાર પ્રભુનો માની મન કહે ‘મારું શું ગજું? હું તો જંગલી રોજ જેવો હતો આ તો પ્રભુના આલંબને આ ગુણ મળ્યા, પ્રભુએ આ ગુણ પમાડ્યાં, પ્રભુએ ગુણ આખ્યા.’

આટલું જ નહિ, આપણે માનવભવથી માંડી બુદ્ધિ હોશિયારી પૈસાટકા, પરિવાર, સત્કાર-સન્માન વગેરે પામ્યા, એમાં પણ પ્રભુનો જ ઉપકાર માનીએ. મનને એમ થાય કે હોશિયાર થવાનું મારું શું ગજું? પૈસા કમાવવાનું મારું શું ગજું? આ તો પ્રભુની કૃપા, પ્રભુનો ઉપકાર, પૂર્વભવ પ્રભુનું આલંબન પ્રભુનું માર્ગદર્શન હશે એણે જ સારી ધર્મસાધના કરાવી પુણ્ય ઊભું કરાવ્યું, તેથી આ બધું મળ્યું, એટલે કહેવાય કે પ્રભુએ જ આ બધું આખ્યું. ત્યારે પૂછો,

પ્રભુ-ઈશ્વર જગત્કર્તા કેમ નહિ?

પ્ર.- તો પછી પ્રભુએ મનુષ્ય જન્મ તથા પૈસાટકા વગેરે આખ્યું એમ કેમ આપણે બોલતા નથી?

ઉ.- એનું કારણ કે જગત્કર્તા માનનાર ઈતરોની હવા ન લાગી જાય કે બધું ભગવાને બનાવ્યું અને ભગવાને આખ્યું, એ લોકો જે રીતે આપવાનું માને છે એવું આપણે માનતા નથી; કેમકે આપણે પ્રભુને વીતરાગ અહિસક અને સર્વદ્યાળું માનીએ છીએ પ્રભુ વીતરાગ અને અહિસક હોઈ હુનિયા બનાવવાની ખટ-પટમાં પડે નહિ, સર્વદ્યાળું હોઈ કોઈનેય હુંખ આપે નહિ. હુંખ આપે તો દ્યાળું શાના? દ્યાળું તો (૧) હુંખ પણ ન આપે અને (૨) હુંખનાં સાધન પણ ન બનાવે, કે (૩) હુંખ આવે એવા કર્યો કે (૪) પાપ બુદ્ધિ પણ ન કરાવે, ‘ઈશ્વર બધું જ કરનાર છે’ એવું માનનારાને તો ઈશ્વરને આ બધું કરનાર તરીકે માનવું પડે. એટલે એમની શૈલીએ આપણે ભગવાનને હુંખ દાતા સુખદાતા ન માનીએ.

પ્રભુ કેટકેટલું દેનારા :-

ઇતાં (૧) પરમાત્માના આલંબને જ બધી ધર્મ સાધના ગુણસાધના તથા શુભભાવ છે. અને (૨) એથી પુણ્ય ઊભું થવા દ્વારા સદ્ગતિ-સામગ્રી-સુખ તેમજ (૪) દોષક્ષય ઊભો થવા દ્વારા ઉપર ઉપરના ગુણસ્થાન કે આરોહણ તથા (૫) સર્વકર્મક્ષય સરજવા દ્વારા મોક્ષ થાય છે. આ બધું મૂળ પ્રભુનાં આલંબને જ થઈ શકે છે; માટે પ્રભુ એ સુખસંપત્તિ દેનાર માનવાના છે.

પ્રભુનો આ રીતે અનુપમ ઉપકાર માનીએ તો ઉગલે પગલે પ્રભુનું સ્મરમ કેવું થાય? પ્રભુ પ્રત્યે કૃતજ્ઞભાવ કેવો ઊભો થાય? એ કૃતજ્ઞતા અદા કરવા ભુવનભાનું એન્સાઈલોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ-ક્ષાળ્ય રોકો: ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૧૪૮

અર્થાત્ પ્રભુના એટલા બધા અમાપ ઉપકારને વસ્તુ ગત્યા દિલમાં અંકિત કરવા માટે એનો માથે ભાર રાખવા માટે પ્રભુની સેવા કેવી થાય?

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ” વર્ષ-૨૦, અંક-૧૫, તા. ૨૫-૧૨-૧૯૭૧

પુરો આયુષ્ય સમય આપનાર પ્રભુ માટે થોડો ય સમય નથી?

આજે પ્રભુપૂજાની વાત આવે તો બચાવ કરે છે કે ‘મને સમય નથી મળતો. અલ્યા! આ આખો માનવસમય માનવ-આયુષ્યકાળ તું શી રીતે પામ્યો? પ્રભુનાં આલંબને પ્રભુના ઉપકારથી જેણે આખો ને આખો આવો સુંદર અતિ દુર્લભ માનવકાળ આખ્યો શું એમને તું કહે છે કે મારી પાસે તમારા માટે સમય નથી?’ સંસારના જરૂરી બિનજરૂરી અનેકાનેક લફરા માટે સમય છે, ને માત્ર આખો માનવસમય દેનાર પ્રભુની થોડી પણ ભક્તિ કરવા માટે સમય નથી?

પરંતુ આજે જે મા બાપે પોતાનો ભારે સમય ભોગ આપી છોકરાને સારી રીતે ઊછેરી મોટો કરી એને હવે સારા સુખભોગનો સમય તૈયાર કરી આખ્યો, એજ માબાપને એ છોકરો કહે છે ને કે તમારા માટે તમારી સેવાભક્તિ માટે મારી પાસે થોડો પણ સમય નથી?’ ત્યાં પછી તમે પ્રભુને ય એવું કહી દો એમાં શી નવાઈ?

માબાપે તો છોકરાને સમય નથી આખ્યો, આયુષ્ય નથી આખ્યું, એમણે તો સમયને, છોકરો સારા સુખ સારી સામગ્રી પામી શકે, એવો બનાવી આખ્યો છે, જ્યારે પ્રભુએ આ આલંબન અને માર્ગદર્શક બનવા દ્વારા આખો માનવસમય આખ્યો છે, અને સુખ સામગ્રી મળવાનું કરી આખ્યું છે, એવા પ્રભુની ભક્તિ માટે થોડો ય સમય નથી? થોડા ય ધન-માલ-પુત્ર વગેરે નથી? કારણ આજ છે કે જેમ દરિદ્ર બિખારીને જમાઈ બનાવી લાખોનું ધન ફેક્ટરીમાં ભાગ, રૂપાળી કંન્યા, વગેરે આપનારો, એ બિખારીને પરમ ઉપકારી તરીકે વારંવાર યાદ આવે, ને ઉગલે ને પગલે એ ઉપકાર યાદ કરે, એમ પ્રભુ પરમ ઉપકારી તરીકે વારંવાર યાદ આવતા નથી, ડગલે ને પગલે એ ઉપકાર યાદ આવતો નથી. આ યાદ આવ્યા કરે, અને એથી પ્રભુની ભક્તિ તથા પ્રભુની આજ્ઞાનું પાલન ખૂબ સારી રીતે કરવામાં પ્રભુએ જ આપેલા માનવસમયને માનવબુદ્ધિને અને શરીર-ધન-માલ-પરિવારને સારા લગાવવાનું થાય, એટલા માટે આટલા વિસ્તારથી ને પુનરુક્તિ કરીને કર્યું છે એ ભૂલશો નહિ.

આ વાત ચાલી સીતાજીના પ્રસંગ પર, સીતાજીએ રામનો ખેદ દૂર કરવા

૧૫૦ ભુવનભાનું એન્સાઈલોપીડિયા-“અરિહંત પ્રભુનો જ અનન્ય ઉપકાર કેમ?” (ભાગ-૪૪)

જ કહું કે કોઈ તેવા ભાગ્યે તો મને અભિપ્રવેશ આપ્યો, પરંતુ આપે મારા હૃદયમાં છતે અભિપરીક્ષા સફળ પસાર કરાવી, એમ અભિનું પાણી, થઈ જવામાં રામનો જ ઉપકાર મુખ્ય ગણાવ્યો એવી રીતે આપણે બધે અરિહંતનો ઉપકાર મુખ્ય માનવાનો છે, અને એના પર અરિહંત તથા અરિહંત વચનના તન-મન-ધનથી ઉપાસક બની જવાનું.

જંગલમાં ભૂલેલાનો માર્ગદર્શકના જેવા અરિહંત :-

અરિહંતનો આ આલંબન તરીકે ઉપકાર છે, એમ અરિહંત પ્રભુનો માર્ગદર્શક અને તત્ત્વદર્શક તરીકે પણ અતીવ ઉપકાર છે. જંગલમાં ભૂલા પડ્યા હોઈએ અને માર્ગ ન મળે તો એ જંગલમાં વાધવરું આદિ અને ચોર-ડાસુનો ભારે ભય હોય, વળી આપણી હોશિયારી અને ચાલવાની મહેનતથી માર્ગ મળે એમ ન હોય ત્યાં જો કોઈ માણસ દેવના દૂત જેવો આવીને ઊભો રહે, અને આપણને માર્ગ પકડવાનો રસ્તો બતાવે, માર્ગ બતાવે તો આપણને એ કેવો ઉપકારી લાગે ? માર્ગમાં ય કોઈ લુંટારા ન નડે એ માટે વળી એ સાથે રહે, તે ઠેઠ ધારેલા શહેરમાં પહોંચી જઈએ ત્યાં સુધી, તો પહોંચી જવા પર શું માનીએ ? અને શું કહીએ ? આજ ને કે ;

આ તમે અમને ક્ષેમકૃષણ શહેરમાં પહોંચાડ્યા, તમે ન મળ્યા હોત તો અમે વનમાં છૂટાઈ મરત, આજ કહીએ ને ? બોલો, એ સાચું કે ખોટું ? આપણે એની પૂંઠે ચાલવાની બુદ્ધિ અને મહેનત ન કરી હોત તો પહોંચ્યત ? છતાં શું મનમાં એવું આવે ખરું કે હું તો મારી બુદ્ધિથી અને ચાલવાની મહેનતથી શહેરમાં પહોંચ્યો? ના, મન તો પેલા માર્ગ બતાવનાર ઉપર ઓવારી જતું હોય કે એના માર્ગ બતાવવા પર જ હું ઠેકાણો પડ્યો; એણે મને અહીં પહોંચાડ્યો, એણે મને શહેર ભેગા કર્યો. વનમાંથી એણે ઉગાર્યો.

બસ, આ રીતે અરિહંત પરમાત્માનો ઉપકાર છે. આપણે સંસાર-અટીમાં ભટકીએ છીએ. એ પ્રભુ સંસારથી છૂટવાનો ને મોક્ષ પામવાનો માર્ગ બતાવે છે. એ માર્ગ ચાલવાની બુદ્ધિ આપણી, મહેનત આપણી, છતાં સંસારથી બહાર કાઢનાર અને મોક્ષે પહોંચાડ્યાનાર તરીકે તો અરિહંત પરમાત્માને જ કહેવા પડે; એમ માનવું પડે. એમ જો ન માનીએ તો નગુણા કહેવાઈએ. પ્રભુનો ગુણ ભુલાય ? એવા નગુણાપણાને લીધે જ ઉપકારી અરિહંત પ્રભુની પેસા ખરચીને ભક્તિ કરવાનું મન થતું નથી.

નગુણો માણસ ઉપકારી પ્રભુની પાછળ તન-મન-ધનથી શાનો તૂટી મરે ?

નગુણાને અભિમાન છે કે મારી અક્કલ અને આયાસથી પુણ્ય મળે છે. મોક્ષ-મળશે, તેથી હજી તપસ્યા કરશે, પ્રતનિયમ પાળશે, ધર્મની કિયા કરશે, ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : છૂટવાનો મોક્ષો” (ભાગ-૪૪) ૧૫૧

મફતિયા દેવદર્શન-પૂજા અને ગુરુવદન વ્યાખ્યાન શ્રવણ કરશે, પરંતુ (૧) દેવ-ગુરુની ભક્તિમાં પૈસો ખરચવાની વાત નહિ; (૨) ચાર દીકરામાંથી એક પણ દીકરો દેવ-ગુરુને દેવાની વાત નહિ ! રહેવાના મકાનમાં દેવને ઘાલવાની ગૃહમંહિર બજાવવાની વાત નહિ ? કેમ કે એ નગુણો છે, દેવ-ગુરુના અનન્ય ઉપકારને માનતો નથી, અભિમાનથી જાતમહેનતને તારક માને છે, ‘મારી તપસ્યા મારા પ્રત, નિયમ ને મારી ધર્મકિયા મને ઊંચે લઈ જનારી છે, બધે મારું કર્યું થાય છે, એવું માનવાથી જ એમાં પ્રયત્ન કરે છે. આ બધો માર્ગ બતાવનાર દેવગુરુ જ એ બતાવવા દ્વારા ઊંચે પહોંચાડનાર છે. એવું એને હૈયે બેસતું નથી. નહિતર તો જે ભારે ખર્ચ કરી દેવ-ગુરુ-ભક્તિ-વાહવાહ-પ્રભાવના કરે, એટલો ખર્ચ ન જાત ઉપર કરે કે ન કુટુંબ ઉપર કરે. પણ નગુણા પાસેથી આ શી આશા ?

ભાન નથી કે આ મોહ અને અજ્ઞાનાં જાડવાથી ગીય ભરેલા સંસારવનમાં માર્ગદર્શક પ્રભુ વિના રસ્તો જ કયાં જડે એવો હતો ? આજે દેખાય છે ને કે અનાર્ય દેશોમાં જન્મેલાને જો પ્રભુ નથી મળ્યા, પ્રભુનું માર્ગદર્શન નથી મળ્યું તો એમનું જીવન શું છે ? મોહ અને અજ્ઞાનની જ વિચારણા વાણી અને વર્તાવ, એ જ જીવન ને ? વાત આ છે કે

આપણી બુદ્ધિ-હોશિયારી-મહેનતનો મહિમા જોવાને બદલે પ્રભુએ આપેલા માર્ગદર્શન અને આલંબનના મહિમા પર દસ્તિ રહેવી જોઈએ.

જશ આપણી જાતને નહિ, પણ પ્રભુને આપવો જોઈએ.

દસ્તિ આપણી બુદ્ધિ-શ્રદ્ધા-મહેનતની વિશેષતા પર નહિ. કિન્તુ પ્રભુનાં આ દ્વિવિધ ઉપકાર પર રહેવી જોઈએ.

તો જ પ્રભુની પ્રભુતા આલંબનની પ્રભુના માર્ગ પ્રકાશનની કદર કરનાર બનીએ. નહિતર આપણું જ ગાયા કરવા પર નગુણા થવાનું બને.

સીતાજીએ દિવ્ય કરતાં શું કહેલું ? ‘જો મેં હૈયે રામ સિવાય બીજાને ધર્યો હોય તો હે અભિ ! તું મને ભસ્મ કરજે, અને જો મારા હૈયે રામ જ હોય તો મને તારામાંથી પસાર થઈ જવા દેજે. આમ બોલી અભિમાં પગ મૂકૃતાં જ અભિ પાણીરૂપ બની ગયો. સીતાજીએ પોતાના સતીત્વના પ્રભાવ પર નહિ, કિન્તુ પોતાના હૈયે રહેલા પટિ રામના પ્રભાવ પર દસ્તિ નાખી અને રામચંદ્રજીને કહું કે આ તમે હૈયે હતા તો અભિનું પાણી થઈ ગયું.

મોટા આત્મ-નુકશાન પર દસ્તિ નાખવાથી ગુસ્સો અટકે :-

બસ, દસ્તિ સંકુચિત માત્ર જાત પર તુચ્છ લાભ નુકશાન પર નહિ કિન્તુ વિશાળ રાખો, મોટા લાભાલાભ પર નાખો આજ હિસાબ પર ગુસ્સાને અટકાવી ૧૫૨ ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“અરિહંત પ્રભુનો જ અનન્ય ઉપકાર કેમ ?” (ભાગ-૪૪)

શકાય છે. ગુસ્સો કરવા જઈએ છીએ એ અમુક બાબત પર દણ્ઠિ નાખીને, એવી કલ્પના રાખીને; પરંતુ જો દણ્ઠિ ફેરવીએ, કલ્પના ફેરવીએ, તો ગુસ્સાને શમી જવું પડે. છોકરે દૂધ ઢોળ્યું, એ જોતા ગુસ્સો કેમ ચેતે છે ? મારી સારી ચીજનું એણે નુકસાન કર્યું એ કલ્પના મગજમાં આવે છે; માટે ગુસ્સો ચેતે છે. ત્યાં જો દણ્ઠિ ઉટાવીને છોકરાના અને પોતાના આત્મા તરફ લઈ જવાય કે ‘જીવ ! ધ્યાન રાખજે આ હુધનાં નુકસાને બનેનું બગાડનારા કષાયને ઉભો કરવાનો પ્રસંગ આઝ્યો છે, તું ગુસ્સો કરીશ એટલે તારે નુકસાન ઉભું થવાનું કર્યું નુકસાન, કર્મબંધ અને કષાયના કુસંસ્કારની દફતાનું નુકસાન. તેમ તારા ગુસ્સો કરવા પર છોકરો કદાચ અંદરખાને ગુસ્સો કરશે, ખીજાશે, યા તારા પર અભાવ અરુચિ કરશે, તો એને પણ વડીલ ઉપર અરુચિ એ એને નુકસાન, વળી એ અરુચિથી તું એનો સદ્ગુલ્લાબ ગુમાવે એ તને નુકસાન એવું વારંવાર થતા એ તને નહિ માને, તારા પર અથાગ પ્રેમ શ્રદ્ધા નહિ રાખે. આજે કેટલેક ઠેકાણે દેખાય છે કે છોકરાને કાકા-મામા પર શ્રદ્ધા ભક્તિ હશે એટલી બાપ પર નહિ; કેમકે બાપે ગુસ્સો કરી કરી દીકરાના દિલમાંના સદ્ગુલ્લાબને તોડી નાખ્યો છે.

૩. અનુકૂળતા થવા પર દણ્ઠિ જાય તો ગુસ્સો અટકે :-

આમ, (૧) દણ્ઠિ આ ઉભયના આત્મ-નુકશાન તરફ લઈ જઈ ગુસ્સો ન કરવામાં એ નુકસાનો રોકવાની અનુકૂળતા જોવાય, તો એવું નુકસાન કરનાર ગુસ્સાની માંડવાળ કરાય. અથવા (૨) એ અનુકૂળતા પર દણ્ઠિ જાય કે ચાલો, આ ક્ષમા-સમતા-શાંતિનો પ્રયોગ કરવાની એક અનુકૂળ તક મળે છે ? મનજે કશું અણગમતું બને અને મન ધૂઆપુંથી થવા જતુ હોય ત્યાં શાંતિ રાખવાની તક ગણાય, સામાને ક્ષમા અને વાત્સલ્યથી નવરાવી નાખવાની અનુકૂળતા થઈ કહેવાય. ત્યાં ગુસ્સો શો ? આમ પ્રતિકૂળને બદલે અનુકૂળ તત્ત્વ જોવા પર દણ્ઠિ જાય તો ગુસ્સો અટકી જાય.

જીવનમાં આપત્તિના જુદા જુદા પ્રસંગ પર (૧) આમ જે તુચ્છ અને તાત્કાલિક નુકસાન પર દણ્ઠિ જાય છે ને ગુસ્સો થાય છે, એના બદલે એમાં ગર્ભિત કોઈ મહાન અને લાંબા કાળનાં નુકસાન ઉપર દણ્ઠિ જાય તો ગુસ્સો થવાને જગા ન રહે, ગુસ્સો અટકાવી શકાય. એમ (૨) જે માત્ર પ્રતિકૂળ પર દણ્ઠિ જઈને કોઇ ઉઠે છે, તેના બદલે અનુકૂળ ઉપર દણ્ઠિ નખાય તો કોધને ઉઠવાનું ન બને; કોધને ઉઠતો રોકવાનું થાય. માત્ર, એવું અનુકૂળ એમાં શું છે એ શોધી કાઢવાની આવડત જોઈએ.

તીર્થકર ભગવાનની તત્ત્વ-વ્યવસ્થાએ કોધથી થતાં (૧) આ મહાન અને

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૧૫૩

દીર્ઘકાળનાં નુકસાન તથા (૨) પ્રતિકૂળમાં ધૂપાયેલ ભવ્ય અનુકૂળતાઓ સુંદર બતાવી છે. એના પર કોધને અટકાવવાનું સહેવું બની જાય છે. એથી મન બગડતું અટકે છે.

ગુસ્સો અટકાવી મનજે બગાડવાનું અટકાવવાની આ એક વિચારણા થઈ.

(૧૮) કોધને અટકાવવા માટે વળી એક વિચારણા આ છે કે તુલનાત્મક નુકસાનનો ઘ્યાલ કરવો અર્થાત દા.ત. કોઈએ આપણાને કાઈક કડવો અપ્રિય શર્બદ કર્યો. ત્યાં એમ વિચારાય કે આણો માત્ર કડવો અપ્રિય શર્બદ જ કર્યો ને ? ગાળ તો નથી દીધી ને ? અગર ગાળ દીધી છે. તો ય બીજું કશું તો નથી બગાડચું ને ? યા બગાડચું છે, પણ પ્રહાર તો નથી કર્યો ને ? ના, પ્રહાર કર્યો છે, તો પણ લોહી લુહાણ તો કર્યો નથી ને ? અથવા એ પણ કર્યું છે, તો ય મારી તો નથી નાખતો ને ? યા મારી નાખે છે. તો પણ મારા અંતરની ધર્મપરિણિત તો નાણ નથી કરતો ને ?

આમ ઉપર ઉપરનું નુકસાન નથી કર્યું એનું આશાસન લઈ ચિત્તને શાંત રાખી શકાય; કોધને અટકાવી શકાય. કદાચ સવાલ ઊઠશે,-

પ્ર.- તે શું મોટા નુકસાનમાં કોઇ થાય, ને નાના નુકસાનમાં ન થઈ આવે ?

૩.- વ્યવહારમાં આવો અનુભવ થાય છે કે મોટા નુકસાનથી બચી જવામાં ચિત્તને ઠંડકનો અનુભવ થાય છે. દા.ત. માણસ બહાર જવા નીકળતો હોય અને ખીસામાં સો રૂપિયાની નોટ નાખીને જવાનો વિચાર આવ્યો પરંતુ વળી વિચાર ફર્યો, તેથી માત્ર પાંચ રૂપિયાની જ નોટ ગજવામાં નાખીને બહાર નીકળ્યો હવે રસ્તામાં મોંઢું લુધ્યા ખીસામાંથી રૂમાલ બહાર કાઢ્યો, એમાં ઉતાવળમાં ધ્યાન રહ્યું નહિ, તે રૂમાલ સાથે પાંચ રૂપિયાની નોટ બહાર નીકળીને રસ્તા પર પડી ગઈ. એનું ધ્યાન રહ્યું નથી એટલે મોંઢું લુંધ્યાં ભાઈ સાહેબે જપાટાબંધ ચાલ્યે રાખ્યું. પછી આગળ જ્યાં કોઈ હુકાન પર કંક ખરીદી કરતાં, ખીસામાંથી નોટ કાઢવા ગયા, તો નોટ દેખી નહિ. એ વખતે મનજે શું થશે ? અલબત જરા આંચકો તો આવશે કે ‘અરે ! રૂમાલ કાઢતાં નોટ પડી ગઈ ? પરંતુ ડાંધ્યો માણસ હોય તો પછી એમ થશે. કે હાશ ! ઠીક થયું કે નોટ સો રૂપિયાની નહોતી લીધી, નહિતર એય જાત ચાલો હ્યું રૂપિયાનો બચાવ-થયો.’ શું કર્યું આ ? વધારે નુકસાનથી બચવાનું મળ્યું એનું આશાસન લે છે, અને તેથી ચિત્તને આધાત મટીને શાંતિનો અનુભવ થાય છે.

પ્ર.- પણ એ તો ઘરેથી સોની નોટ લેવાનો વિચાર માંડી વાળ્યો હતો એટલે આ વિચાર આવે ને આશાસન લે ને ?

૧૫૪ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“અરિહંત પ્રભુનો જ અનન્ય ઉપકાર કેમ ?” (ભાગ-૪૪)

૩.- ના, એમ ને એમ પણ વિચારી શકાય કે સારું થયું આજે સોની નોટ લેવાનો વિચાર ન આવ્યો, નહિતર એ વિચારથી સોની નોટ લીધી હોત તો સો એ જાત.

બસ, કોથ અટકાવવા આ કરવાનું છે કે ઉપર ઉપરનું નુકસાન વિચારી, એ નથી આયું એનું આશ્વાસન લઈને ચિત્તને શાંત રાખવાનું. મનને એમ થાય કે ‘ચાલો ટૂંકે પત્સું છે. ટૂંકે પતે ત્યાં ચિત્ત બાળવાની અને સામા પર ધમધમવાની જરૂર નથી, કેમકે એમાં લાંબે ગાળે નુકસાન છે, અને વર્તમાનમાં ય ચિત્ત ડાઢોળાઈ જવાથી તેમજ ઉશ્કેરાટમાં આવી જવાથી સંતાપ સળગવાનું અને બીજા કામ બગડવાનું થાય છે. તો એવી મોટી નુકસાની શા માટે આપણા હાથે કરીને ઊભી કરવી ? સામાના વાંકે આપણી જાતે આપણા પર આવા દંડ લેવાની જરૂર નથી.’

આમ નુકસાન ટૂંકે પતવાના હિસાબ ઉપર કોથ અટકાવી શકાય છે. નક્કર ધૈર્યવાળા માણસ તો કોઈ પણ નુકસાનમાં એમ વિચારે છે કે જે થાય તે સારા માટે.

ખબર છે ને પેલા વાણિકની વાત ? ડેલીનું બારણું ભાંગ્યું અને પત્નીએ ધા નાખી કે ‘હાય ! જુઓ આ બે પાડા લડતા આવ્યા ને ડેલીનું બારણું તોડી નાખ્યું ?’

ઠેડે કલેજે વાણિક કહે -‘હશે શાંતિ રાખો જે થાય તે સારા માટે ?

બાઈ તડૂકે છે, ‘શું સારા માટે ?

આ કહે છે, ‘તને ખબર નથી એમાં ય કાંક કુદરતનો સંકેત હશે.

‘એમાં વળી શા સંકેત ?’

એર; પણ પછી બારણું તરત રીપેર ન કરાયું તે સાંજ પડ્યે પાછી બાઇ તડૂકી આ તમને કેટલી આપસ કરો છો ? બારણું તૂટેલું પડ્યું છે, કાંઈ કર્યું નહિ ?’

વાણિકનો આ જ જવાબ, -જે થાય તે સારા માટે.’

એમાં બે દિવસ એમ જ નીકલી ગયા, ને સાંજે કોઈ માંદલી ભેંસ ડેલીમાં ઘૂસી પડી ને મરી ગઈ. શેઠ બહારથી આવ્યા, ત્યાં પાછી પત્નીએ ધડાકો કર્યો કે જુઓ આ તમે બારણું ન સમરાયું ને ભેંસ પેસી ગઈ ને મહંગું થઈને પડી વચ્ચમાં’

વાણિક કહે એમાં શું થઈ ગયું ? જે થાય તે સારા માટે.’

હવે બાઈ જાલી રહે ? ગરજ. બળ્યું તમારું આ જે થાય તે સારા માટે ! શું સારા માટે ? આ રાત વરત ધ્યાન ન રહ્યું ને મડદા પર પડ્યા તો ?

‘જે થાય તે સારા માટેની પાછળ વિચારણા :-

વાણિકનો ઠેડે કલેજે એક જ જવાબ કે જોતો ખરી, એમાં ય કાંક કુદરતનો સંકેત હશે; વધુ નુકસાનથી બચવાનું હશે, યા બીજો લાભ થવાનો હશે. માટે જે થાય તે સારા માટે.’

વાણિયો એદી નહોતો. પણ કામકાજમાં તરત ને તરત બારણું સમરાવી શક્યો નહી તો, તમે એમ ખાલી બોલવા ખાતર નહોતો બોલતો, પણ સમજતો હતો કે,

જગતની વચ્ચમાં જીવન લઈને બેઠા છીએ, ને ઓછા વધતા પુષ્ય-પાપ ભોગવવાના છે, ત્યાં નકામા હૈયાશેકણાં ને લોહીબળાપા કરવાની જરૂર નથી. આ મોંઘું જીવન કાંઈ રોદણાં ને બળતરા કરવા માટે નથી વાપરવાનું એ તો જ્યાં કાંઈ એવું થવાનો પ્રસંગ આવે ત્યાં આ જ હિસાબ માંડવાનો કે આમા કુદરતનો કોઈ અધિક નુકસાનથી બચાવવાનો કે બીજો કોઈલાભ કરાવવાનો સંકેત હશે; તેથી જે થાય તે સારા માટે. એમ હિસાબ માંડીને મસ્ત રહેવાનું.’

વાણિકની આ સમજ ડાહાપણના ઘરની છે; કેમકે જગતની વચ્ચમાં જીવન એટલે ઊંચા-નીચા તો આવ્યા કરે હા, મોકશમાં જઈ બેઠા પછી એ નહિ આવે.

હવે જ્યારે જગતનો સ્વભાવ જ હોય કે ઊંચા નીચી દેખાડ્યા કરે ત્યાં સ્વભાવ જનિત વસ્તુ પર નાચ્યાં-ખીલવું શું ? કે હાય ને વોય શી કરવી ?

અજિનો જ્યારે સ્વભાવ જ છે કે એ બાળો, તો પછી કદાચ ભૂલમાલમાં એને હાથ અડી ગયો ત્યાં એમ થોડું જ થાય છે કે હાય ! આ અજિ કેવો કે મારા હાથ બાબ્યા ? એવી રીતે અહીં શું કામ એવું લાગે કે હાય ! આ બારણું કેવું કે ભાંગ્યું ? ઘરના માણસ કેવા કે એ સમરાયું નહિ ?....શું કામ મનને આવું, લગાડવું ? સમજ જ રાખવાનું કે બારણું ને ઘરના માણસ બધું ય જગતની વસ્તુ છે, ને એનો ઊંચા-નીચા થવાનો સ્વભાવ છે તે એ થયા કરે; એમાં સ્વભાવના ઘરની વસ્તુ સામે બળવું શું ? આવું મહામોંઘુમૂલું જીવન બળતરા કરવા માટે નથી.

પ્ર.- શું કરીએ, એવું લમણો લાગે ત્યારે બળતરા તો થાય ને ?

૩.- ના, બલતરા એ નથી કરાવતા, એ તો માત્ર આપણું કશું નુકશાન કરું પ્રતિકૂળ કરે છે, એટલું જ બાકી,

બળતરા કેમ થાય છે :-

બળતરા તો આપણે જાતે જ ઊભી કરીએ છીએ. આપણે માત્ર બગાડ્યું જોઈએ, છીએ, પરંતુ

(૧) આપણા પુષ્યની કચાશ નથી જોતા,-

(૨) જગતની વસ્તુમાત્રનો ઊંચા નીચી થવાનો સ્વભાવ નથી જોતા.
(૩) કોઈ અધિક નુકસાનથી બચવાનો યા કોઈ અણધાર્યો લાભ થવાનો કુદરતનો સંકટે નથી જોતા.

(૪) આ મૌખિક જીવન બળતરા માટે નથી, એ નથી જોતા,

આ ન જોઈએ એટલે બળતરા થાય એ કોણે ઊભી કરી ? આપણા એ ચાર નક્કર સત્ય ન જોવાએ જ ઊભી કરી ને ? નહિતર જુઓ. વાણિકની પત્નીને તો બળતરા થઈ, વાણિકને કેમ ન થઈ ? બહારની હકીકત તો બને માટે એક જ ઊભી થઈ હતી ને ? પરંતુ વાણિકે, આ નક્કર સત્ય જોવાનું રાખ્યું હતું, પછી શું કામ બળતરા કરે ? બળતરા આપણે જ ઊભી કરીએ છીએ, બાધ્ય સંયોગો ગમે તેવા ઊભા થાય.

આપણે જો આ ચાર નક્કર સત્ય સામે જોઈ બળતરા ન કરવી હોય, તો ન થાય; (૧) પુષ્યની કમી, અને (૪) જીવન આ માટે નહિ, આપણું હિત આના પર નહિ.

(૧) સીતાજી વનમાં ઘેલાયા, પણ પુષ્યની કમી જોઈ તો એમણે બળતરા ન કરી.

(૨) સનતુકુમાર ચક્કવર્તીને એકી સાથે શરીરમાં ૧૬ રોગ ઉત્પન્ન થયા, પણ એમણે કાયાનો રૂપનો એવો સ્વભાવ પરખ્યો, તો એમણે બળતરામાં ન પડતાં સીધું ચારિત્ર જ લીધું.

(૩) વાણિક અહીં કુદરતનો સંકટે જુઓ છે કે કદાચ આ નિમિત્તે જ કોઈ મોટા નુકસાનથી બચવાનું યા અચિંત્ય લાભ થવાનો હોય. અને બન્યું પણ એવું જ.

એ રાતનો ચોરો ચોરી કરવા નીકળેલા, ને માલ ચોરીને ભાગતા હતા એમાં પાછળ કોટવાળા દોડ્યા. એ ગભરાયા ક્યાં છુપાવું ? તે વાણિકની ડેલી ખુલ્લી જોઈ માંહી પેઠા અંધારું ધોર હતું. ભેંસનું મડહું દેખી શક્યા નહિ તે સીધા દોડવા ગયા અને પડ્યા એની પર હાથમાંથી થેલીઓ પડી ગઈ એટલામાં જ પાછળ કોટવાળા દોડતા અને અવાજ કરતા આવતા સંભળાયા. એ કાંઈ આ ખુલ્લી ડેલીમાં પેઠા વિના રહેશે ? અને પેસશે તો એ દીવા સાથે હોઈ પકડાયા. વિના રહીશું ? એમ સમજી થેલીઓ શોધવા લેવાની પડતી મૂકી ચોરો ત્યાંથી બહાર નીકળી મૂઢીઓ વાળી ભાગ્યા કોટવાળો આવ્યા, અહીં ડેલીમાં નજર નાખી, પણ ભેંસનું મડહું જોયું ચોર કાંઈ દેખ્યા નહિ, મડદાની પાછળ પડી ગયેલ થેલીઓ ય દેખાઈ નહિ; તે ચોરો પકડવા દોડ્યા આગળ.

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૧૫૭

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૨૦, અંક-૧૬, તા. ૧-૧-૧૯૭૨

બોલો, હવે વાણિકને ત્યાં શું ? સવારે વાણિયશ ઊઠી અંગણામાં જુઓ છે તો થેલીઓ પડી છે. એ ઉઠાવી લાવીને ઘરમાં ખોલી જુઓ છે તો માલ માલ ભર્યો છે. ઘડીને ઉઠાડી બતાવે છે, પૂછે છે ‘આ ક્યાંથી આવ્યું ?’

ઘડી કહે છે, ‘એમ તો શી ખબર પડે કે રાતના શું બન્યું ? પરંતુ લાગે છે કે ગમે તે કોઈ આ લઈને અહીં પેઠો હોય અને અંધારે ભેંસના મડદા સાથે કૂટાઈ પડી જવાથી, હાથમાંથી થેલીઓ પડી ગઈ હોય, પછી પોતે કોઈ ભયથી ભાગી ગયા હોય કોઈ માગવા આવશે તો પૂછુંાછ કરીને દઈ દઈશું, નહિતર માલ તારો.’

જોજો. અહીં હમણાં નીતિ-અનીતિની વાત નથી. ચાલતી, વાત ‘જે થાય તે સારા માટે’ની ચાલે છે.

બાઈ કહે, ‘આ તો ઘડો બધો માલ છે ?’

વાણિયો કહે છે, ‘તે સમજાયું શાના ઉપર ? આ ડેલીનું બારણું તૂટી ગયું હતું તે ભાગનારને સંતાઈ જવા માટે ડેલી ખુલ્લી મળી. એમાં વળી ભેંસનું મડહું, તે મડદા સાથે અથડાયા હશે ગભરાયા હશે કે વળી કાંક ભેંસ ઊઠીને શિંગડાં ઠીકે નહિ, તેથી ભાગી ગયા હશે; અને થેલીઓ અહીં પડી રહી. બોલ. જે થાય તે સારા માટે નહિ ? ટૂંકી દંસ્થિથી આપણાને કાંઈ ખોટું બન્યું કે નુકસાન થયું લાગે, પરંતુ એમાં કુદરતનો કેવો સંકેત હોય, એની શી ખબર પડે ? માટે હવે કબૂલ છે ને કે જે થાય તે સારા માટે ?’ ધણિયાણીએ પોતાની કાનપદ્ધી પકડી કબૂલ કર્યું.

નુકસાન પાછળ કશું ખોટું કરેલું ? :-

પ્ર.- પણ માલ તો ચોરીનો ને ?

૩.- તો શું ડેલીનું બારણું તૂટ્યું, ભેંસ મરેલી પડી, એ નુકસાન શાહુકારીનું છે ? નુકસાન પાછળ શું આ ભવમાં કે પૂર્વભવે કશું ખોટું કર્યું જ નથી, કશું કોઈનું બગાડ્યું જ નથી, તે નુકસાન ગેરવાજબી માની એના પર પોક મૂકો છો, ને એના પર શાહુકારીથી બબડો છો કે કેમ અમારું ગેરવાજબી નુકસાન થાય ?

દણાંત પર આંદુંઅવળું વિચારવાને બદલે મર્મ પકડો કે વાણિક જેવી શ્રદ્ધા છે કે જે થાય તે સારા માટે ? આ હશે તો સાંસારિક જીવનમાં ચિત્તની ઘણા ખેદ, ઘણાં આર્તિધ્યાન અને ઘણા વિકલ્પો વ્યાકૂળતા-વિહ્લવળતા ઓછા થઈ જશે...

ગુરુસો કેમ અટકે ? :-

પહેલું એ વિચારો કે ગુરુસો શાનો થઈ આવે છે ? કશું બગડવા પર, કાંઈ

૧૫૮ ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-“અરિહંત પ્રભુનો જ અનન્ય ઉપકાર કેમ ?” (ભાગ-૪૪)

મનને પ્રતિકૂળ બનતું લાગવા ઉપર. (૧) ત્યાં જો એમ વિચારો કે ‘આ જે થાય છે તે સારા માટે, આમ બનવામાં કંક કુદરતનો સંકેત હશે, માટે ધીરજ ધરો, તો ગુરુસ્થો નહિ ચેડે.’

વળી એમ જો મનને લાગે કે ‘વધુ નુકસાન તો નથી થયું ને ? આટલું જ થયું છે ને ?’ તો પણ એમ તુલનાત્મક દાખિથી જોતાં મન બનેલા પર ઉશ્કેરાશે નહિ. શાસ્ત્ર આ જ બતાવે છે કે તુલનાત્મક દાખિથી જુઓ કે કઠોર શર્જદ જ કહ્યો છે ને ? ગાળ તો નથી દીધી ને ? ગાળ જ દીધી છે ને ? પ્રહાર તો નથી કર્યો ને ? પ્રહાર જ કર્યો ને ? લોહીલુહાણ નથી કર્યો ને ? લોહીલુહાણ કર્યો છે, પણ મારી તો નથી નાખ્યો ને ? અરે ! મારી નાખે છે, પણ મારા અંતરની ધર્મપરિણાતિનો નાશ નથી કરતો ને ?’

(૩) ધ્યાન રાખજો બધી જાતના નુકસાનમાં આ મુખ્ય વિચારવાનું છે કે ‘શું લૂંટાઈ ગયું ? મારા દિલમાંની ધર્મશક્તિ, જિનભક્તિ, વ્રતનોભાવ, ધર્મનોરંગ, એ તો સલામત છે ને ?’

અક્ષય લક્ષ્મીરૂપ ધર્મશક્તિ જો સલામત, પછી બીજું બહારનું બગડે એની શી વિસાત હતી ? અનંતાકાળથી ચાલતી ભવયાત્રામાં જીવે શું નથી ગુમાવ્યું ?

મોટી મોટી દેવવિમાનોની સમૃદ્ધિ ખોઈ છે, મોટ-મોટી સલ્તનતો ગુમાવી છે, અબજો રૂપિયાના ભજના ગુમાવ્યા છે, અભ્યરા જેવી પ્રાણપ્રિય સ્ત્રીઓ ગુમાવી છે, સારી ભેગી કરેલી, પ્રતિષ્ઠા આબરુના કંકરા થયા છે, આજ્ઞાંકિત પુત્ર-પરિવાર ગુમાવ્યા છે...શું શું નથી ગુમાવ્યું ? તો અહીં શેના પર શોક ને કલ્યાંત ?

જે સાચવ્યું રહેતું નથી એ જવા પાછળ રોદણાં ? ને સાચવ્યું રહે છે એ ગુમાવવા પર કોઈ રોદણું નહિ ? નોકર કોઈ ધમધમતો સાચવ્યો રહે એવો નહોતો અને જરા વાંકુ પડતા ચાલ્યો ગયો ત્યાં રોવા બેસે અને સારો દીકરો સાચવ્યો રહે એવો હતો એને તડકાવ્યો એટલે એ ભાગી ગયો, એના પર કશું રોદણું નહિ, આવું તો મૂરખ કરે.

અનંતાભવમાં આપણે બહારનું તો અહીં કરતાં ય ઘણું-ઘણું મોટું ગુમાવ્યું છે,’ દેવલોકના વૈભવ અને સુખ-સંન્માન ગુમાવ્યા છે, અનંતા માનવભવના ય મોટા મોટા રાજ્યપાટ-ભજના-પરિવાર ગુમાવ્યા છે; અહીં પણ બીજા મનુષ્યોમાં જુઓ તો ય દેખાય છે કે આપણી નજર સામે કેટલાય કેવું કેવું ગુમાવે છે, કેટલું ય મૂકી-મૂકી ભરીને ચાલતા થાય છે. તો આપણું થોડું ગયું, બગડ્યું, એના પર રોદણાં-શોક-કલ્યાંત શા કરવા ? શું આ સાચવ્યું રહે છે ? અમર રહેવાનું છે ?

સાચવ્યું રહે એવી ચીજ ધર્મની પરિણાતિ છે, ધર્મની શક્તિ છે, ધર્મનો રંગ

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

છે. એ તો આપણે જાતે ગુમાવીએ, જાતે છોડી દઈએ, તો જ જાય. બીજા કોઈની એ તાકાત નથી કે આપણે સાવધાન હોઈએ અને એ રંગ ગમે તે ભોગે સાચવવા કટીબદ્ધ હોઈએ તો એ એનો નાશ કરી શકે. જેમ પૈસા જવા છતાં પૈસાનો પ્રેમ નથી જતો, બાયડી કે છોકરો મરે છતાં એનો પ્રેમ નથી જતો, એમ કદાચ બહારની આપણી ધર્મકિયા પર પણ કોઈ આકમણ કરે છતાં અંતરનો આપણો ધર્મપ્રેમ ઊભો રહી શકે છે; આપણે ઊભો રાખવો હોય તો રાખી શકીએ છીએ.

માનો ને કે મંદિરે પ્રભુનાં દર્શને જવું છે, ત્યાં ધરવાળાએ કે છોકરાએ કશી ધાંધલ માંડી અંતરાય ઊભો કર્યો, ને આપણે દર્શન ગુમાવ્યાં, છતાં આપણા દિલમાં જિનભક્તિ ઊભી રહી શકે છે. ત્યાં આ સમજ રાખો કે

ધર્મનું સ્વરૂપ બાધ્ય કિયા નહિ, પણ આંતર પરિણાતિ છે. અંતરમાં જિનભક્તિ-દાન-શીલ-તપ-દયાનો પરિણામ જે થાય એ જિનભક્તિ આદિ ધર્મનું સ્વરૂપ કહેવાય.

પ્ર.- તો પછી શું બહાર જિનભક્તિ-દાન-શીલ-તપ-દયાની કિયા કરાય એ ધર્મ નહિ ? એ નકામી ?

૩.- ના, નકામી નહિ, એ આંતરિક તેવા પરિણામને-પરિણાતિને પોષનારી છે. જગાવનારી છે, પોષનારી છે, વધારનારી છે, એ દાખિએ કિયા કામની જ છે, તેમજ વ્યવહારનયથી એ ધર્મ પણ છે. બાકી નિશ્ચયનયથી ધર્મ આંતરિક તેવી પરિણાતિ; એ જ ધર્મનું સ્વરૂપ.

બાધ્ય કિયાથી શું ? :-

આનો અર્થ એ નથી કે ‘ધર્મનું સ્વરૂપ જે આંતર ધર્મપરિણાતિ, એ ઉપયોગી અને વ્યવહારથી બાધ્ય ધર્મકિયા અનુપ્યોગી;’ આવો અર્થ સમજતા નહિ; કેમકે બાધ્યમાં જો એ જિનભક્તિની કિયાદિના બદલે કિયા જો પ્રિયાના શશગાર, ધનના વેપાર-સંચય, વિષયોના વિલાસ અને માલમેવાની ઉજાણી વગેરેની લીધી, તો અંતરમાં પરિણાતિ ધર્મના બદલે મોહ-મૂર્ખ્ય-વિષયાસક્રિયાની પોષાવાની. માટે બાધ્ય ધર્મકિયા કામની છે. માત્ર, એ વખતે આંતરિક તેવી ધર્મપરિણાતિ જાગતી રાખવાનું ન ભૂલાય.

ધર્મપરિણાતિ એટલે ? :-

તો હવે તપાસો કે અંતરમાં જિનભક્તિ-દાન-શીલ-તપ-દયા વગેરે પરિણામ્યા છે ? જો હૈયાનો તદાકાર પરિણામ બન્યો હોય તો એ ધર્મ ભક્તિનો તદાકાર પરિણામ એટલે હૈયું ભક્તિમય બન્યું હોય; હૈયે દાનનો પરિણામ યાને દેવાની રુચિમય થયું હોય; શીલનો પરિણામ એટલે કે હૃદય બ્રહ્મચર્યમય, સદાચારમય વિષયઅરુચિમય અને વિષયત્વાગમય બની ત્રત-નિયમમય થયું હોય, તપ એટલે કે

૧૬૦ ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-“અરિહંત પ્રભુનો જ અનન્ય ઉપકારકેમ ?” (ભાગ-૪૪)

હદ્ય આહારસંજ્ઞા પ્રત્યે ઘૃણામય બની બિયાસણ-એકાસણ-આયંબિલ-ઉપવાસ વગેરેમાં ઠરવારૂપ-મહાલવારૂપ બન્યું હોય; એમ દ્યાનો પરિણામ એટલે કે હૈયું દ્યામય બન્યું હોય, જીવવિરાધના પ્રત્યે બીજા જીવને હુંખ પહોંચાડવા પ્રત્યે અભાવ-અરુચિ-બળતરા ભર્યું બન્યું હોય, તેથી સહેજે દ્યામાં હૈયું ઠરતું થયું હોય. મહાલતું બન્યું હોય. આ જે હૈયાની સ્થિતિ, હૈયાનો પરિણામ એ નિશ્ચયનયથી ભક્તિધર્મ, દાનધર્મ, શીલધર્મ, તપધર્મ, દ્યાર્થર્મ, પછી અને અનુસારે બાધ્ય જે ભક્તિ વગેરેનાં આચરણ થાય તે ય ધર્મ, પણ વ્યવહારથી ભક્તિધર્મ દાનધર્મ વગેરે.

ક્રિયાની અશક્તિમાં ધર્મપરિણાતિ કેમ ટકાવાય ? :-

આ પરથી જ્યાલ આવશે કે મૂળ આપણાં જ તેવા કોઈ અશુભ કર્મના ઉદ્યે બહારમાં અંતરાય આવ્યો, અને આપણે તે તે ધર્મપ્રવૃત્તિ ન કરી શક્યા, તો ય અંતરમાં તેવા તેવા પ્રકારનો ધર્મપરિણામ-ધર્મભાવ-ધર્મપરિણાતિ રાખી શકીએ છીએ. દા.ત. પાસે પૈસા નથી, બહારમાં દાનપ્રવૃત્તિ નથી કરી શકતા, પરંતુ હૈયું ઉછળતું હોય કે ‘જો પૈસા હોય તો દાનમાં ઉછળું છું. એમાંથી ઉછળું, દાન એ જ માનવજીવનનું ફળ છે, માનવતા છે; ગ્રહણ-રક્ષણ કે ભોગ એ ફળ નહિ.’ એમ પાસે પૈસા ન હોવાથી પ્રભુની બાધ્ય ભક્તિ ન કરી શકતો હોય પરંતુ દિલ બોલતું હોય કે ‘પ્રભુ ! મારી પાસે મારું શું છે ? આ મારી કાયા પણ તારી જ છે. ક્યારે સગવડ થાય ને તારી ભક્તિમાં એ સમર્પું !’ એ અંતરનો ભક્તિ પરિણામ છે. આમ ગમે તે સંયોગમાં યાવત્તુ અંતકળે પણ અંદરમાં ધર્મ-પરિણાતિ ઊભી રાખી શકાય છે.

પ્રાણ અને પરિણાતિ :-

કોધને અટકાવવો છે ને ? છેક મૃત્યુ પમાડે એવો કોઈ ઉપદ્રવ આવી ગયો તો પણ ત્યાં આ વિચારવાનું છે કે આમાં મારા પ્રાણ જઈ રહ્યા છે એ જ ને ? મારી અંતરની ધર્મપરિણાતિ-ધર્મશ્રદ્ધા-ધર્મરંગ તો નથી ગયા ને ? એ સલામત તો મારે સબ સલામત ?

(૧) પ્રાણ તો આજે નહિ, તો કાલે પણ જીવાના તો હતા જ, એ કંઈ શાશ્વત કાળ રહેવાની વસ્તુ જ નહિ; અરે ! એક જનમ પછી પણ સાથે ચાલનારી વસ્તુ નહિ; જ્યારે, ધર્મપરિણાતિ સાથે ચાલનારી વસ્તુ છે; વળી

(૨-૩) માત્ર પ્રાણ કંઈ અહીં શાંતિ આપનારી, કે પરલોક સુધારનારી ચીજ પણ નહિ; એ તો ફક્ત અંતરની ધર્મપરિણાતિ જ અહીં તત્કાલ પણ શાંતિ આપે, ભવિષ્યમાં પણ શાંતિ આપે, અને પરલોકે પણ શાંતિ આપે, તેમજ સદ્ગતિ

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-“પ્રવચન મહોદધિ-કૃત્યાં રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

અને અ-સંકિલણ સુખ-સામગ્રી આપે.

પછી જો એવી સ્થાયી અને મંગળકારી ધર્મ-પરિણાતિ મારે સલામત છે, તો પ્રાણ પણ જવા લાગે એવો ઉપદ્રવ આવ્યો તો એમાં કોધ કરી શા માટે પરિણાતિ બગાંદું સામાને ક્ષમાથી નવરાવી ન નાખું કે જેથી મારી ધર્મપરિણાતિમાં વધારો થાય ? અગર જિંદગીભર, બધું ખોવાઈ જનાનું જ, કમાયો હોઉં ને જીવની સાથે ચાલનારી કશી મંગળકારી ધર્મ-પરિણાતિ ન કમાયો હોઉં, તો ય એ જિંદગીના છેડ છેડ તો કમાવાની થાય ?’ ધર્મપરિણાતિનું આ મહાત્વ ખૂબ ધ્યાન પર લેવા જેવું છે.

જુઓ કમઠતાપસના લાકડામાંનો સાપ જિંદગીભર શું કમાયેલો ? કંઈજ નહિ, ધર્મપરિણાતિ કશી જ નહિ, માત્ર પાપે પેટ ભર્યા હશે, જીવતા જીવોને પેટમાં હોયા હશે. પરંતુ અંતકળે શ્રી પાર્શ્વકુમારનાં દર્શન અને નવકારમંત્ર પામવા પર ધર્મપરિણાતિ આવી. અજ્ઞાનતાથી બાળનાર કમઠ તાપસ કે અજ્ઞિ પ્રત્યે કોધ ન કર્યો યા કરેલો છોડી દીધો તો એ અંતકળની ધર્મ-પરિણાતિએ એના આત્માને ઊંચ્યકીને દેવગતિમાં મૂકી દીધો, ભવનપતિ દેવલોકની નાગનિકાયનો ઈન્દ્ર ધરેણેન્દ્ર બનાવી દીધો. એક સામાન્ય દેવની ગતિ ય પામવી સહેલી છે ? ના, અને આ દેવોના રાજા ઈન્દ્રની ગતિ પાખ્યો ! કેટલા સુકૃત પર ? માત્ર અંતકળની ધર્મ-પરિણાતિ પર એ શાના પર. આવી ? બાળનાર ‘કમઠ’ તાપસ પર કોધ ન કરવા ઉપર.

અંતે પણ ધર્મ પરિણાતિ તારે. રાજા તડિકેશના શત્રુ વાનરનું દેખાંત :-

રામાયણમાં પ્રસંગ આવે છે, રાવણના દાદા સુમાલીના દાદા તડિકેશ રાજાને પૂર્વ ભવે મુનિપણે એક પારધીએ શિકાર કરી મારી નાખેલા. મુનિ તો સ્વર્ગ જઈ અહીં તડિકેશ રાજા થયા. પરંતુ પેલો પારધી નરકે જઈ અહીં વાનર થયો, તે ઉદ્ઘાનમાં બેઠેલા આ રાજા પરના વૈરના સંસ્કારથી પાસે બેઠેલી એની રાણીના શરીર પર નહોરિયાં ભરે છે. રાજાએ તરત બાણથી એને ધાયલ કર્યો, એટલે રાણીને છોડી એ ત્યાંથી ધવાયેલો મરવા જેવો થઈ ભાગ્યો; ને થોડે આગળ જઈ મરી જાય છે. હવે બોલો, આ વાનર મરીને સ્વર્ગ જાય ? ના, પણ એ મરીને ભવનપતિ દેવલોકમાં ઉદ્ઘિકુમાર નિકાયનો દેવ થયો. કેમ થયો ? અંતકળે ધર્મ પરિણાતિ આવી તેથી. શી રીતે એ આવા પાપી જીવને આવી ? એ જોઈએ આગળ. પણ અહીં રાજાને ખબર પડી ગઈ કે આ વાનર તો મરીને દેવ થયો. શી રીતે ખબર પડી ? આ રીતે,

રાણીને આ વાનરે નહોરિયાં ભર્યા, એટલે રાજાના માણસો બીજા નિર્દોષ

૧૬૨ ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-“અરિહંત પ્રભુનો જ અનન્ય ઉપકાર કેમ ?” (ભાગ-૪૪)

વાનરોને પણ મારવા લાગ્યા, ત્યાં દેવ થયેલાએ મોટા જંગી વાનરો વિકુલ્યા, અને એ પેલા વાનરોએ મોટા જાડના ઝડ ઉપાડી અનાથી રાજના માણસોને પીટવા માંડ્યા. રાજ ગભરાયો, સમજ્યો કે આવા મોટા જંગી વાનરોએ અહીંનું સર્જન નહિ, આ તો કોઈ દેવી ઉપદ્રવ લાગે છે ત્યારે એ આકાશ સામે મોં ઊંચું કરી હાથ જોડી પૂછે છે, ‘નાથ ! તમે કોણ છો ? ભાઈ સાહેબ ! માફ કરો આ માણસોનો ગુનો.’

દેવ અદ્દશ્યપણે બોલે છે ‘માફ ? આ બીજા વાનરોએ તમારું શું બગાડ્યું હતું તે એને મારો છો ? તમે તો નિર્દોષ એવાને મારો છો, પણ હું ગુનેગાર એવા તમને બરાબર સજા કરવાનો હું. જેથી નિર્દોષને મારવાની ખો ભૂલી જાઓ.’

ત્યાં રાજ હાથ જોડી કરગરતો કહે છે, ‘સજા તો ભાઈ સાહેબ ! થઈ ગઈ હવે આપ કોણ મહાપુરુષ છો એની જરા ઓળખ કરાવો. આ નિર્દોષ વાનરોની રક્ષા કરવા પધારેલા આપ જરૂર કોઈ મહાન આત્મા છો. અને આ સિપાઈઓ નિર્દોષને મારનારા એ અજ્ઞાન મૂઢ જીવો છે. એમના પર દયા કરો, ને આપનો ઉત્તમ પરિચય આપો.’

ત્યારે દેવ અદ્દશ્ય વાણીએ કહે છે, ‘જાઓ પાસેમાં, મુનિભગવંત છે એમને પૂછો.’

મહાત્મા વાનરનો પરિચય આપે છે :-

થયું, રાજ અને લાણવ-લશ્કર-ઉપરયું-મુનિમહર્ષિ પાસે. ધ્યાનસ્થ મહાત્માને જોઈ રાજને અતીવ આનંદ થયો, નમસ્કાર કરીને પૂછે છે, ‘સ્વામિન્ન ! આ વાનરોને ઉપદ્રવ કરનારા અમારા સિપાઈઓને શિક્ષા કરનારી અદ્દશ્ય વ્યક્તિ કોણ ?’

મહાત્મા કહે છે, ‘એજ વાનર કે જેણે તારી રાણીને ઉપદ્રવ કરેલો, અને પછી જે તારા બાણો ઘવાયો તે એ ઘવાઈને મરતો અહીં આવ્યો. મેં એને નવકારમંત્ર સંભળાવ્યો, એથી એ નવકારનાં શુભ ધ્યાનમાં મરીને દેવ થયો, દેવ થઈને ઉપકાર યાદ કરતો એ અહીં મને વંદનાર્થે આવ્યો, અને એમાં એણે તારા માણસોને નિર્દોષ વાનરો પર ઉપદ્રવ કરતા જોયા એટલે એણે એમને શિક્ષા કરી અટકાવ્યા.’

રાજ કહે ‘અહો પ્રભુ ! નવકારમંત્રનો ત્યારે કેવો અદ્ભુત પ્રભાવ કે માત્ર અંતકણે પણ એનું ધ્યાન કરતાં આવા વાનર જેવા જંગલના જીવને પણ સ્વર્ગ જેવી ઊંચી સંદૂંગતિ અપાવે ? ત્યારે ભગવન્ન ! એ વાનરને મારી રાણી પર ઉપદ્રવ કરવાનું શું કારણ !’

મહાત્મા કહે છે, ‘તું પૂર્વ ભવે દત્ત નામનો રાજમંત્રી દીક્ષા લઈ સાહુપણે જંગલમાં કઠોર સાધના કરવા ધ્યાન ધરતો હતો એ વખતે આ વાનરનો જીવ

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૧૬૩

પારધી તે એણે તારો શિકાર કરેલો. એ વૈરથી એ નરકમાં જઈ અહીં વાનર થયો, અને તું સમાધિમાં મરી દેવ થઈ અહીં આવી રાજ થયો. તારાં પર દ્વેષના સંસ્કારથી આ વાનર બનેલાએ તારી રાણી પર ઉપદ્રવ કર્યો પરંતુ ભવિતવ્યતા સારી કે એને અમારો યોગ મળ્યો, સૌખ્યભાવે બોલાતા નવકારમંત્રના શ્રવણ પર એનું દિલ દર્દું, દિલમાંથી દ્વેષ-ગુસ્સો ઓસરી ગયો; પોતે તારાથી મરણતોલ ધવાયો છે છતાં ય તારા પરનો દ્વેષ મૂકી એના અંતરમાં શ્રી નમસ્કાર-મહામંત્રનું ધ્યાન લાગી ગયું. તો સ્વર્ગગતિ મળી.’

શું કહું મહાત્માએ ? વાનરે દ્વેષ મૂકી નવકારમાં ચિત્ત પરોવું એટલે દેવ થયો. જો દ્વેષ ઉભો રાખ્યો હોત તો દેવગતિ શું, મનુષ્યગતિ પણ ન મળે. દ્વેષ નીકળી ઉપશમધર્મની પરિણાતિ અને નવકારમંત્રના માત્ર અક્ષરનું ધ્યાનરૂપ ધર્મપરિણાતિ આવી તો જ દેવલોક મહ્યો કહો, અહીં વાનરે બાધ્યથી શો ધર્મ કર્યો તે દેવ થયો ? બાધ્યથી માત્ર મહાત્મા પાસે ઘવાયેલો જઈને પડ્યો અને એમના નવકાર-ઉચ્ચારણ પર કાન માંડ્યા એટલો જ ધર્મ ને ? એમ તો તમે પણ મહાત્મા પાસે નથી જતા ? એમના મોંઢે માત્ર નવકાર નહિ કિન્તુ બીજી પણ ધર્મની વાત પર કાન નથી માંડતા ? તો શું લાગે છે કે એટલાથી સ્વર્ગનાં પુણ્ય ઉપાર્જન કરી રહ્યા છો ?

પુણ્ય-ઉપાર્જનનો વિશ્વાસ કેમ પડે ? :-

પ્ર.- એ તો શ્રી ખબર પડે ?

૩.- કેમ વિશ્વાસ નથી કે એટલા માત્રથી સ્વર્ગનાં પુણ્ય મળે ? કહોને વિશ્વાસ નથી એટલે તો એની એટલી બધી દિલ દઈને પ્રવૃત્તિ નથી રાખી, જેટલી દુનિયાદારીની દિલથી ધૂમ પ્રવૃત્તિ રાખી છે. નહિતર તો સત્સમાગમ અને સંતપ્તાણીનાં શ્રવણનો શોધી શોધીને લાભ લેવાનું ન રાખ્યું હોત ? ખેર. દુનિયાદારીની ધૂમ પ્રવૃત્તિની વચ્ચે દરિયામાં ખસખસ જેટલી એ પ્રવૃત્તિ રાખવાથી એટલો તો સ્વર્ગનાં પુણ્યનો લાભ મળે ને ?

પ્ર.- હૃદય પલણ્યા વિના લાભ શી રીતે મળે ?

૩.- એ હૃદયનું પલણું એટલે શું ? આ જ ને કે અંતરાત્માના કોઈ દોષ ઓછા થાય અને કોઈ સંદૂંગ સુકૃત જીવનમાં આવે ? કોઈ સંદૂંગ સુકૃત વિચારણામાં આવે ? બસ, આ અંશે પણ દોષત્યાગ અને સંદૂંગ સુકૃત પર મન એ જ ધર્મ પરિણાતિ એના પર સ્વર્ગનાં પુણ્યનો વિશ્વાસ રાખી શકાય. વાનરે રાજ પરનો દ્વેષ ટાણ્યો અને નવકાર પર મન લગાવ્યું એ દોષત્યાગ અને સુકૃતે એને સ્વર્ગનાં પુણ્ય ઉભાં કરી આપ્યાં.

૧૬૪ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“અરિહંત પ્રભુનો જ અનન્ય ઉપકાર કેમ ?” (ભાગ-૪૪)

ધર્મપરિણાતિનો જંગી પ્રભાવ :-

જીવનના માત્ર અંતકળે પણ આટલું આવડયું, બાધથી ધર્મની પ્રવૃત્તિ મામૂલી, પરંતુ અંતરથી ધર્મપરિણાતિ જોરદાર રાખી, તો એ ધર્મપરિણાતિને જીવનભરની પાપપરિણાતિ ઉપર જોર મારી એકવાર તો એનાં ફળને વાયદે મૂકી દીધાં. અને પોતાનું ફળ રોકડું બતાવી દીધું. પાપપરિણાતિનાં ફળ શું ? દુર્ગતિના પાપનાં ભાતાં. ધર્મપરિણાતિનાં શાં ફળ ? સદ્ગતિનાં પુષ્ય. પાપપરિણાતિ તો જીવનભર રાખેલી, એટલે દુર્ગતિનાં પાપ થોકબંધ જમા કરેલાં. એ બધા એમ જ ઊભા રહી ગયાં, અને માત્ર અંતકળની ધર્મપરિણાતિનાં પુષ્યફળ આગળ થયાં. ‘હાજરના સોદે રોકડો લાભ’ ની જેમ તત્કાળ દેવભવ શરૂ થઈ ગયો. તે હવે તો કેમ ? તો કે ધર્મપરિણાતિ પોષ્યે જવાની; એથી પૂર્વની પાપપરિણાતિના કુસંસ્કાર અને પાપ-પરિણાતિનાં અશુભ કર્મ થોકબંધ નાશ પામતા જવાનાં.

‘પરિણાતિ’ એટલે લેશ્યા, ભાવ, ચિત્તપરિણામ, મનના અધ્યવસાય. એ હિંસાઈ અઠાર પાપસ્થાનકના હોય તો એ પાપ-પરિણાતિ છે; ને દયા-અહિસા, સત્ય-નિષ્પાપવાણી વગેરે ધર્મસ્થાનકના હોય, દાન-શીલ-તપ-ભાવનાના હોય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના હોય, તો એ ધર્મપરિણાતિ છે.

વાનરનું આખું જીવન રેઢિયાળ ગયું, લગભગ પાપના અધ્યવસાય, પાપનાં ચિત્તપરિણામ, પાપપરિણાતિમાં ગયું, કેઠ અંતકળની નજીકમાં પણ રાજી પ્રત્યેના પૂર્વના દેખ-સંસ્કારથી એની રાણીને નહોરિયાં ભરવાની પાપલેશ્યા સક્રિય કરી, છતાં ત્યારબાદ ભરવાની આણી ઉપર દેખના ઉપશમની અને નવકાર-ધ્યાનની ધર્મપરિણાતિ ઊભી કરી, તો ફાવી પડ્યો. પૂર્વના પારધીપણાનો માનવ-અવતારે હતો, પણ ત્યાં પાપ-પરિણાતિથી નરક સાધેલી; ને એહી તિર્યચ વાનરને અવતાર હતો, એમાં છેડે કખાય દાબી ધર્મની પરિણાતિ ઊભી કરી સ્વર્ગગતિ સાધી ક્યાં ડહાપણ ? માનવભવમાં કે તિર્યચભવમાં ?

તમે આ ડહાપણ લાવવાનું તિર્યચભવના વાયદે તો નથી રાખ્યું ને ?

‘ના, હમણાં એહી તો પાપપરિણાતિ-પાપલેશ્યા-પાપવિચારો કરી લેવા દો, પછી કોક આવો વાનર જેવો તિર્યચનો અવતાર મળશે ત્યારે ધર્મપરિણાતિ કેળવી લઈશું, તે પણ ત્યાં જીવનભર નહિ, માત્ર અંતકળે એટલે પછી સ્વર્ગ મળીને કલ્યાણ થઈ જશે,’ આવી તો ગણતરી નથી રાખી ને ? કહો ને,

પ્ર.- આવી ગણતરી તો મૂર્ખ રાખે. તિર્યચભવે શો ભરોસો કે મહાત્મા મળશે ? નવકાર સંભળાવશે ? એ સીધેસીધો ગળે ઊતરી જશે અને દેખ વગેરેના ઉપશમ થઈ જશે,...આ બધાનો શો ભરોસો ?

ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૧૬૫

૬.- તો પછી એહી એ જુઓ કે દિવસભરમાં ધર્મની લેશ્યા કેટલી વાર આવે છે ? કેટલો સમય એ ટકી રહે છે ? ને પાપની લેશ્યા કેટલી વાર ? તે ય કેટલો સમય ચાલ્યા કરે છે ? શા સારુ ભૂલા પડો છો ?

હજીય બહારના સંયોગ અને બહારની પ્રવૃત્તિ આપણા હાથમાં ન હોય, પરંતુ ચિત્તની પરિણાતિ તો આપણા હાથની વસ્તુ છે. એને આપણે બગાડવી છે તો જ બગડે; ને સુધારવી ને પવિત્ર રાખવી હોય તો જરૂર સુધરે અને પવિત્ર રહે.

વાનરને રાજાએ મરણાંત કષ આપ્યું, એ સંયોગ વાનરના હાથની વસ્તુ નહોતી, પરંતુ રાજા એટલું જ કરી શક્યો, એના પ્રાણ લઈ શક્યો, કિન્તુ એની લેશ્યાને એની આંતર પરિણાતિને ન બગાડી શક્યો, બગાડેલી ન રાખી શક્યો. એ તો વાનરે સ્વપુરુષાર્થે દેખ ભૂલવાની અને નવકારધ્યાન લગાવવાની ધર્મપરિણાતિ ઊભી કરી તો એ સલામત રહી; અને પરિણામ ? ફળ ? બાણથી ઘવાઈ આવેલા મરણાંત કષ ને મૃત્યુએ એનું કશું બગાડ્યું નહિ; બલ્કે કહો કે એ કષ સત્સમાગમ અને નવકાર મળવામાં નિમિત્ત બની ગયું; અને એના પર ધર્મપરિણાતિ ઊભી થઈ તો એણે સ્વર્ગગતિ દેખાડી.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૨૦, અંક-૧૭, તા. ૮-૧-૧૯૭૨

બસ, કોધને અટકાવવા આ છેલ્લા કોટિનો તુલનાત્મક વિચાર છે કે જેના પર કોધ આવવા જાય છે એ સામો જવ માત્ર મારા પ્રાણ લુંટે છે ને ? મારી ધર્મ પરિણિત તો નથી લુંટતો ને ? જો અંતકલે મારી ધર્મપરિણાતિ સલામત છે, તો પછી મારે શી ફિકર છે ?

પ્રાણનાશે અવશ્ય દુર્ગતિ નથી, કિન્તુ ધર્મ પરિણાતિના નાશ પર જરૂર દુર્ગતિગમન છે.

શ્રેષ્ઠિક અને કૃષ્ણ મહારાજા ક્ષાયિક સમ્યક્તવના ધણી અને તીર્થકરપણાનું પુષ્ય ઉપાર્જન કરી ચુકેલા, એમણે ભરવાના લગભગ છેવટ સુધી ધર્મપરિણાતિ રાખી, પરંતુ બરાબર અંતકળ આવી લાગતાં એ ભૂલીને પાપ પરિણાતિમાં પડ્યા, એ કે પુત્ર શ્રેષ્ઠિક અને દેપાયન તાપસ પર દેખભાવમાં ચંચ્ચા, તો એ પાપ પરિણાતિએ નરક ગતિ દેખાડી, ધર્મપરિણાતિના નાશે દુર્ગતિગમન થયું. બાકી કોઈ મહાત્માઓને ધર્મપરિણાતિ સલામત રહી તો ભલે ઉપદ્રવમાં પ્રાણનાશ થયા, પરંતુ એમના પ્રાણનાશે દુર્ગતિ નહિ, પણ સદ્ગતિ યાવત મોક્ષ દેખાડ્યો.

ચેડા રાજની અંતે પણ ધર્મપરિણાતિ :-

૧૬૬ ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“ધર્મપરિણાતિનો જંગી પ્રભાવ ” (ભાગ-૪૪)

કોણિકે ચેલ્લા માતાના બાપ તે દાદા ચેડા મહારાજાનો ઘણો દ્રોહ કર્યો, તેમાં યાવતું ચેડા રાજાને અનશન કરી જાતે પ્રાણનાશ કરવાનો વખત આવ્યો, ગળે શિલા બાંધી કુવામાં પડતું મૂક્યું, પછી ભલે ત્યાં પાતાલ ઠઈએ, આવી એમને મરવા ન દીધા, જીવતા જ દેવલોકમાં લઈ ગયા, છતાં અહીં તો હવે જીવનભરનું અનશન હતું તે ત્યાં જ અરિહંત પરમાત્માના ધ્યાનમાં રહી પ્રાણ પૂરા કર્યા તો શું હુર્ગિતિ થઈ ? ના, પ્રાણનાશ માત્રથી હુર્ગિતિ ન થાય, ધર્મપરિણાતિના નાશથી હુર્ગિતિ થાય; ત્યારે અહીં તો ચેડા મહારાજાને ધર્મપરિણાતિ સલામત હતી; તેથી એ સ્વર્ગે ગયા.

વાત આ છે કે ધર્મપરિણાતિ જો સલામત તો સદ્ગતિ સલામત.

તે પણ ધર્મપરિણાતિ ભૂલશો નહિ, જો આપણે જતી કરીએ તો જ જાય. એનો નાશ આપણે કરીએ તો જ થાય; બીજાની તાકાત નહિ કે એને નાન કરી શકે. આવી સાચી કલ્યાણમાતા સ્વરૂપ ધર્મપરિણાતિને માત્ર અંતકાળે જ નહિ, પરંતુ જીવનભર ટકાવી રાખવા જાગૃતી જોઈએ પુરુષાર્થ જોઈએ, ધીખતો પુરુષાર્થ જોઈએ.

પ્ર.- આટલું સમજવા છતાં કેમ ધર્મપરિણાતિ ટકતી નથી એટલી અમારા પુણ્યની ખામી જ ને ?

ઉ.- ના, પુણ્ય તો ધર્મપરિણાતિ કેળવવા-ટકાવવાના ઉત્તમોત્તમ સંયોગ આપી દીધા, એનું કામ પૂરું થઈ ગયું, હવે વળી એના પર બીજું કોઈ પુણ્ય શુભકર્મ એવું છે નહિ કે જેના ઉદ્યે ધર્મપરિણાતિ આવે. લાવો બતાવો કુલ ૪૨ પુણ્યપ્રકૃતિઓમાં ક્યાં એવું પુણ્ય છે, કે જેના ઉદ્યથી આંતરક ધર્મપરિણાતિ મળે ? બતાવો કોઈ એવું પુણ્ય હોય તો ? અજ્ઞાનતામાં મોહમૂઢતામાં શું કામ તશાઓ છો ? હજુ કદાચ ૪૨ પુણ્ય પ્રકૃતિઓ કઈ કઈ એની ય ગમ નહિ હોય ને બચાવ કરવા નીકળ્યા કે પુણ્ય હોય તો ધર્મ સૂજે ધર્મપરિણાતિ આવે !

પ્ર.- તો પછી લોકમાં કેમ એવું બોલાય છે કે પુણ્ય હોય તો ધર્મ-સૂજે ?

ઉ.- બોલનારા લોક અજ્ઞાન છે, મોહમૂઢ છે, એમને ધર્મની સૂજની કિમત નથી, ગરજ નથી, એટલે એ સૂજ જોઈતી નથી, મેળવવા યત્ન કરવો નથી. ને ધર્મ ન હોવામાં બહાના તરીકે ખોટી ઢાલ ધરે છે કે ભાઈ ! પુણ્ય હોય તો ધર્મ સૂજે આપણું પુણ્ય નહિ એટલે ધર્મ સૂજતો નથી' આ બચાવ એ ખોટું બહાનું છે. અસલમાં એની કિમત નથી ગરજ નથી, તેથી ધર્મ સૂજતો નથી. પણ એટલું કબૂલ કરવા જોગી મદનંગી ય નથી. કોઈનાં નાણાં વગર લખાણે લઈ આવ્યો હોય, અને અચાનક દેવાળું નીકળી ગયું હોય, તો મરદ માણસ તો શાહજોગ કહે કે હા, મારી

પાસે તમારા આટલા લેણાં છે. પરંતુ અત્યારે આપી શકવા લાચાર છું ! મરદ માણસ હોય તો કબૂલ કરે બાકી શાનો કબૂલે ?'

તો બોલો કબૂલ છે આ કે ધર્મપરિણાતિ ધર્મ સૂજની કિમત નથી અને ગરજ નથી. માટે ધર્મપરિણાતિની નથી તો જાગૃતિ રખાતી કે નથી. એનો ધીખતો પુરુષાર્થ રહેતો. અને બહાનું કઠાય છે, પોતાની બેકદર અને બિનગરજની આડે ઢાલ ધરાય છે કે પુણ્યની ખામી છે માટે ધર્મની સૂજ નથી આવતી ધર્મપરિણાતિ નથી ટકતી. એની ઉંચી કદર હોય અને એના પર એ પામવાની ગરજ હોય' તો એની જાગૃતિ રાખીને શક્ય પુરુષાર્થ થાય પણ પુણ્યની ખામીનું બહાનું ન કઠાય.

દુનિયાદારીમાં ઉદ્યમ કરવામાં ક્યાં પુણ્યનું બહાનું કાઢો છો ? વસ્તુની કિમત અને ગરજ લાગી છે. તો જટ એની જાગૃતિ રહે છે, ને ઊઠીને એનો ધીખતો ઉદ્યમ-પુરુષાર્થ કરાય છે. છોકરો જો એમ કહે કે મારું પુણ્ય નથી એટલે મને ભણવાનો ઉલ્લાસ નથી થતો તેથી ભણતો નથી.' તો શું તમે ચલાવી લો ખરા ? તે એને કહી દો, - બેસ બેસ પુણ્યવાળા; તને ભણતરની કિમત જ ક્યા છે ? ભણવાની ગરજ જ ક્યાં છે ? ગરજ રખડવાની અને લહેર કરવાની છે એટલે એમાં ઉલ્લાસથી દોડે છે. પણ એમાં પછી મૂરખ રહીશા; લોકમાં અભણ બેવકૂફ તરીકે તારી હલકાઈ થશે; અને ધંધો ય નહિ કરી શકે; તેથી ભૂખે મરવું પડશે ભૂખે અથવા મજુરની જેમ હલપાટી કરવી પડશે. માટે ભણતરની કિમત સમજ, ભણવાની ગરજ ઊભી કર; અને ભણવા માંડ' આમ કહી દો ને ?

બસ એવું અહીં સમજવાનું છે. પુણ્ય નથી માટે ધર્મની સૂજ-લેશયા પરિણાતિ નથી એવું કહેનાર તમને એમ ન કહે ? કે “બેસો પુણ્યવાળા ! તમને ધર્મપરિણાતિ-ધર્મસૂજ-ધર્મલેશયાની કિમત જ ક્યાં છે ? એ લાવવાની ગરજ જ ક્યાં છે ? ગરજ વિષમય વિષયોમાં રખડવાની છે, કેમકે કિમત એ વિષયોની લાગી છે, એના સાધનભૂત પૈસા-ટકા-વેપારની કિમત લાગી છે. તેથી એ વિષયોમાં ને સાધનભૂત પૈસા માટે ઉલ્લાસથી દોડો છો. ત્યાં કશું જોવા નથી રહેતા કે મારું પુણ્ય નહિ હોય તો ? ના, એ તો દોડીએ પ્રવૃત્તિ-પુરુષાર્થ કરીએ તો જ મળે. ચાકરી કરે તે ભાખરી પામે.’- આ સૂજ બનાવી રાખ્યું છે; તેથી ત્યાં પુરુષાર્થની કિમત છે, ગરજ છે, એટલે પુણ્ય ન જોતા; જાગતા રહીને પુરુષાર્થ કર્યે જાઓ છો, જ્યારે ધર્મ લેશયાની કિમત નથી, ગરજ નથી, પછી એની જાગૃતિ ય ક્યાંથી હોય ? અને પુરુષાર્થ પણ ક્યાંથી થાય ? પરંતુ ભાન નથી કે;

ધર્મલેશયા-ધર્મપરિણાતિ માટે જ મનુષ્ય ભવ છે. એ વિના પરભવે દીર્ઘકાળ બેઠાલ ભટકવું પડે.

માટે ધર્મની ધર્મપરિણાતિની કિંમત સમજો અને એની ગરજ ઊભી કરો; તેમજ જાગતા રહી ‘પાપ-લેશ્યા-પાપવૃત્તિને આધી રાખી ધર્મલેશ્યા-ધર્મપરિણાતિ જ લાવવાના અને ટકાવવા-વધારે મહેનત કરો.’

એવું માનશો નહિ કે ધર્મપરિણાતિની શી કિંમત છે ? કેમકે ખરી કિંમત જ એની છે. દુનિયાનાં સામ્રાજ્ય મળ્યાની કે ચિંતામણી અને કલ્યવૃક્ષ મળ્યાની ય તત્ત્વથી કશી કિંમત નથી; કેમકે એ જનમ-મરણ ન મિટાવે, રોગ અકરમાત-ઘડપણ ન રોકી શકે, ચિંતા ઉદ્ઘેગ-શોક-ભય ન મિટાવે, સદ્ગતિ ન નક્કી કરી આપે, એ જનમ-મરણાદિ બધાને કાયમ ના ટાળવાની અને સદ્ગતિ પમાડવાની તાકાત ધર્મપરિણાતિમાં છે. કર્મના ઉદ્ય વાંકા હોય ત્યારે સંપત્તિઓ અને સેવાકારી પણ્ણ -પરિવારે બાજુએ ઊભા રહે, અને જીવન વેદના વ્યાકુળતાનો પાર ન હોય એવે વખતે જીવને શાંતિ એ બધા ન આપી શકે એ તો ધર્મપરિણાતિ જ શાંતિ આપી શકે. બોલો ધર્મપરિણાતિની કેટલી બધી કિંમત ? જીવને અંતકણે શાંતિ કોણ આપી શકે ?

શાસ્ત્રકથન સૂચક છે : અંતિમનો વિચાર બધે લાગે :-

જુઓ એટલું ખાસ ધ્યાન રાખજો કે કોધને અટકાવવા માટે જે શાસ્ત્રો આ તુલનાત્મક વિચારનો ઉપાય બતાવ્યો કે મને કઠોર શબ્દ જ કહે છે ને ? પ્રહાર તો નથી કરતો ને ? યા પ્રહાર જ કરે છે ને ? લોહી લુહાણ તો નથી કરતો ને ?...’વગેરે વિચારણામાં ધર્મ-પરિણાતિનો વિચાર માત્ર પ્રાણનાશ પ્રસંગમાં આવ્યો કે મારા પ્રાણ નાશ કરે છે ને ? મારા ધર્મ પરિણાતિને તો નાશ નથી કરતો ને ? એ તો એની તાકાત નથી. ધર્મપરિણાતિને નાશ કરવાનું તો હું કરું તો જ થાય. બીજાની તાકાત નહિ. ત્યારે જો મારે ધર્મપરિણાતિ સલામત તો સબ સલામત; ધર્મપરિણાતિવાળા મૃત્યુથી તો સદ્ગતિ મળવાની. પછી શું કામ સામા પર કોધ કરું ?’ -આમ ધર્મપરિણાતિનો વિચાર તો અહીં માત્ર અંતિમ કાળ માટે આવ્યો; પરંતુ એ સૂચક છે, એ વિચાર તો નાનેથી માંડી મોટા બધા જ પ્રતિકૂલ પ્રસંગમાં લાગુ થઈ શકે છે, અને કોધ વિષ્વળતા અટકાવી શકાય છે.

દા.ત. પહેલો જ નાનો પ્રસંગ કે સામાએ આપણાને કઠોર શબ્દ કહ્યો સહેજ અપમાન કર્યું, ત્યાં આ વિચારી શકાય કે આણો કઠોર શબ્દ જ કહ્યો ને ? મારી ધર્મપરિણાતિને તો નથી બગાડી ને ? ના, એ બગાડવાની એની તાકાત નથી. એ તો હું જાતે બગાડું તો જ બગડે તો પછી બસ, મહાકિંમતી ધર્મપરિણાતિ સલામત છે. પછી સામાએ તુચ્છાકાર્યો, મારું બહારનું માન બગાડ્યું એની શી કિંમત હતી.

મારે જીવન જીતવાનું છે, તરવાનું છે, બહારના માન ઉપર નહિ, પણ મારી

અંતરની ધર્મ પરિણાતિ ઉપર; ને એ સલામત, પણ મારે કોધ કરવાની વિષ્વળતા થવાની શી જરૂર છે ?’ આમ કોધને અટકાવી શકાય.

એ રીતે બધા જ પ્રસંગોમાં વિચારી શકાય, ‘ના, માત્ર મારું અપમાન નહિ, પણ ભલે ને મારા પૈસા લૂંટ્યા, મારી નિન્દા કરી, મારા પર પ્રહાર કર્યો કે મારું બીજું કશું બગાડ્યું,...ગમે તે બગાડ્યું હોય ને ? પણ એમાં કોઈ એવી એવી મોટી ખોટ નથી, કેમકે એ અપમાન વગેરે ન થાય, અને માન રહે. પૈસા રહે માલ રહે, સત્કાર-સુખાકારિતા રહે એની બહુ કિંમત નથી. કારણ કે એથી જીવન નહિ જીતી શકાય, સંસાર નહિ તરી શકાય. કર્મબંધનો ઓછા કરવાનું તો શું, પણ નવા વધતાં અટકાવી શકાતા નથી. જીવન જીતવાનું, ભવસાગર તરવાનું તો ધર્મપરિણાતિથી થાય; એનાથી જ કર્મબંધન નવાં અટકે, અને જુના ઓછા થાય એટલે ધર્મપરિણાતિ જ કિંમતી છે, મહા કિંમતી છે. એ જો સલામત છે તો મારે અપમાન વગેરેથી જરા. દુભાવાની જરૂર નથી.’

ધર્મપરિણાતિનાં આ મહામૂલ્ય વિચારવા ઉપર, જુઓ, પેલા વાનરની હકીકત રાજ તિલ્કેશે મુનિ પાસેથી સાંભળીને શું કર્યું ? જ્યાં એણે જાણ્યું કે આ વાનર તો પૂર્વભવે પારધી થઈ મારો જ શિકાર કરનારો, ને તેથી ઘોર નરકમાં જઈ અહીં આવેલો, છિતાં એ પૂર્વના વૈર સંસ્કાર અને શમ્યા નહિ તો મારી રાણી પર આકમણ કર્યું, ને એથી મારા બાળો વિંધાયો, અહીં સુધી પાપ લેશ્યામાં હતો, પણ મરવા પડ્યો ત્યાં મુનિ મહાત્મા પાસેથી નવકાર સાંભળતા માત્ર અંતિમ કાળે ધર્મપરિણાતિ પાખ્યો, તો ય એણો ઉદ્ધાર થઈ જવા રૂપે મરીને એ દેવગતિ પામી અહીં પરમ ઉપકારી મહાત્માને વંદના કરવા આવ્યો; તો પછી મારી પાસે તો હજુ જીવન છે તો એમાં વિષ્યપરિણાતિ-સુખલાલસા મૂકી, આસક્તિ રાગ-મોહની-પરિણાતિ-લેશ્યા-વલણ મૂકી દઈ આ ધર્મપરિણાતિ જ જગાવવા પોષવા-વધારવાનું કાં ન કરું ?

તિલ્કેશ રાજને આ શુદ્ધ ધર્મની પરિણાતિ માટે સંસાર અકારો લાગ્યો; એણે જોયો કે આ વાનર પૂર્વનો પારધિ અને નરકગામી એને અહીં પણ વૈર દેખ ચાલુ, જો એને ધર્મ ન મળ્યો હતો તો અહીંથી પાછો કેવી ય દુનિયામાં પટકાત; તે માત્ર અંત સમેયે ય ધર્મ પાળવા માત્રથી કેવો સદ્ગતિમાં ચડી ગયો ! ત્યારે ધર્મનો મહિમા કેવો ? અને સંસારના સંયોગોની ખતરનાકતા કેવી ? એ દેખમાં સબડતો હતો, હું રાગમાં સબડું છું સંસારનાં સંયોગો રાગ કે દેખ વિના બીજું શું કરાવે છે ? જ્યારે ધર્મ તારણહાર છે. તો પછી મારે સંસારનું શું કામ છે ? સર્યું સંસારથી આમ વૈરાગ્ય પામી જઈ રાજ સંસારત્યાગ કરી ચારિત્રધર્મમાં ચડી ગયો અને સુંદર ધર્મપરિણાતિથી આત્મકલ્યાણ સાધ્યું.

સુખ સગવડ કેમ ખતરનાક ? :-

રાજાએ ધર્મપરિણાતિ ક્યાં પકડી ? અંતકળે નહિ, પરંતુ રાજ્યપાટના સુખવિલાસ વખતે શું એમાં કાંઈ વાંધો પડ્યો હતો ? કોઈ ખટપટ જગ્ગી હતી ? દુશ્મન રાજા ચડી આવેલો ? રાણીનું આયુષ્ય પુરું થયેલું ? ના, કશું નહિ છતાં મનને લાગી ગયું, કશાય અંતરાય-ઉપદ્રવ-પ્રતિકૂળતા ન હોય એવા રાજશાહી સુખ-સગવડ-વિલાસમાં તો મનમાં રાગ-મોહ-આસક્રિત વગેરેની જ પરિણાતિ રહ્યા કરે છે. કદાચ ધર્મ પર શ્રદ્ધા હોય તો ય જીવને અનાદિની મોહપરિણાતિના ગાઢ સંસ્કારોના જૂથ પડ્યા છે, એને અનુકૂળ સુખ સગવડના સંયોગો મળવા પર એ મોહપરિણાતિ રાગપરિણાતિ-આસક્રિત પરિણામ વગેરે જાગતા રહે છે. મેવા પકવાન્ન સામે આવ્યા તો એની લેશ્યા જાગે છે, ને રાજ્યસિંહાસન પર બેસવાનું આવ્યું, તો અભિમાનની પરિણાતિ અને સન્માનની આસક્રિત પરિણાતિ જાગતી બને છે. સંસ્કારો અંદરમાં પડેલા જ છે, તો હવે એને માત્ર નિમિત્ત મળવાની જરૂર છે. તેવાં નિમિત્ત મળે એટલી જ વાર ! એ સક્રિય થવાના મશીનને સળગતું બોઈલર યા ઈલેક્ટ્રિક મળે કે તરત ફરતું થઈ જાય છે ને ? એમ અસ્ત્ર નિમિત્તો સળગતા બોઈલર કે વિજળી શક્તિ જેવા છે; શાન્ત પડી રહેલ સંસ્કાર યંત્રને ચાલુ કરી દે સંસ્કાર મુજબની પરિણાતિ જાગતી અને વિચારસરણી જટ ચાલુ થઈ ગઈ સમજો. એ ચાલુ થઈ એટલે પછી વાણી અને વર્તાવ એ મુજબના ચાલુ થઈ જતાં કેટલી વાર ? પછી ધર્મશ્રદ્ધા છતાં રાગાદિની પરિણાતિ ઊભી થઈ જાય ત્યાં ધર્મપરિણાતિ ક્યાં રહે ?

આજે નવી પ્રજા મરી રહી છે. કુમારિકાઓ અને યુવાન બાઈઓએ માત્રા મૂકી છે. ઉદ્ભૂત વેશ અને હાવભાવ. યુવાન છોકરા અને મોટી વયવાળાને ય રાગાદિના સંસ્કારને જાગતા કરી રાગાદિની પરિણાતિ જાગતા રાખે એમાં નવાઈ નથી. એમાં કોઈ ધર્મશ્રદ્ધાવાળાય હોય, પરંતુ આ ખતરનાક નિમિત્ત એમને ધર્મપરિણાતિ ભૂલાવી રાગાદિ પરિણાતિમાં મૂકી દે છે. પાછું, એવા રાગ અને કામ-વાસનાની લાગણી એના જ સંસ્કાર વધારતા રહે છે; એટલે ફરીથી એવી છાકટા-વેશવાળીનાં દર્શને વિશેષ રાગાદિ-પરિણાતિને જગાવે છે. એના સંસ્કાર વળી વિશેષ રાગાદિ-પરિણાતિ જગાવે છે. આમ કેવું લાંબું લંગર ચાલે ? વિચારી જોજો.

મગજમાં ભગવાન કરતાં દુનિયા કેમ વધુ રમે છે ?

વધુ એટલે ૮૮ ટકા ભગવાનને કદાચ ૧-ટકો યાદ કરવાનું મળે. એમાંય વળી પ્રલુને યાદ કરતાં વચ્ચમાં દુનિયા કેમ ઘૂસી જાય છે ? દુનિયા ૮૮ ટકા યાદ આવવામાં ભગવાનને પેસવાની જગ્ગા નથી; એક ટકો ભગવાનનું નામ લેવામાં

ભગવાનનાં દર્શન કરવામાં દુનિયાને પેસી જવાની જગ્ગા છે ? કેવી વિટંબણા જવની ? કારણ કાંઈ ?

કારણ આ જ કે દુનિયા તરફ ડાફોળિયાં અને દુનિયાના પદાર્થના ભરચુક વિચારો એ રાગાદિ પરિણાતિને જાગતી, ને જાગતી રાખે છે. એના ધેરા સંસ્કાર વધાર્યે જાય છે, પછી એ ધેરા સંસ્કારો મનને દુનિયામાં રમતું ન રાખે તો બીજું શું કરે ?

「વિવિધ નિમિત્તોમાં રાગાદિ મહિનતાથી બચવાના ઉપાય.」

સંસાર કેમ અસાર છે ? કારણ આ, કે એમાં અનુકૂળ નિમિત્તો જવને રાગના વિચારો દ્રેષના વિચારો અને દ્રેષમાં રમાડે છે, ધર્મ પરિણાતિ ક્યાં ઉભી રહે ?

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૨૦, અંક-૧૮, તા. ૧૫-૧-૧૯૭૨

પ્ર.- દુનિયાની વચ્ચે રહેવાનું છે એટલે એમાં અનુકૂળ પ્રતિકૂળ સંયોગો તો મળ્યા જ કરવાના છે. તો પછી જવનો બચાવ ક્યાં ? જંગલમાં ?

૩.- ના, જંગલમાં નહિ, શહેર કે ગામની વચ્ચમાં રહીને જ બચાવનું કામ કરવાનું છે એ માટે કરવાનું આ;-

દુનિયાનાં નિમિત્તોમાં રાગાદિ પાપભાવોથી બચવાની ઉપાય :-

(૧) વેરાય વધારવો.

(૨) જિનવચનના ખૂબ ગુણ ગાવા.

(૩) દુનિયાનું જેવા જીવાનાં જિજ્ઞાસા આતુરતા ઓછી કરી નાખી ડાફોળિયા રોકી દેવા; તથા હુન્યવી વસ્તુના વિચાર અટકાવવા.

(૪) જવનમાં જરૂરિયાતો ઘટાડી નાખવી.

(૫) શુદ્ધ ભાવો-શુદ્ધ વિચારોની જરૂરિયાત વધારવી.

(૬) વારંવાર અરિહંતાદિ ચારનું શરણ યાદ કરવું.

(૭) દુષ્કૃત નિંદા અને સુકૃત-અનુમોદના વારંવાર કરવી.

(૮) શુદ્ધ ધર્મવાચન શ્રવણ ખૂબ રાખવું.

(૯) વીતરાગ પરમાત્માનાં દર્શન-પૂજાભક્તિ સારી રીતે અને પોતાનાં દ્રવ્યનો ભોગ આપવા પૂર્વક કરવા, અને પ્રભુનું સ્મરણ-દિનરાત્રબાપી તથા જવનબાપી બનાવવા કોશીશ કરવી.

(૧૦) ધાર્મિક આચાર અનુષ્ઠાન ખૂબ સેવવા, અને તે પણ અંતરમાં ધર્મપરિણાતિને જગતી રાખીને, જેથી; સુસંસ્કારબળ વધે.

(૧૧) ધર્મપરિણાતિ એવી કેળવવી કે જ્યાં દુન્યવી એષણાઓ, આસક્તિ અને અહંકાર માનાકંસા ઉભા ન રહે.

આ એકેક ઉપાય આદરવો એ મહાન યોગસાધના છે. એને મામૂલી ગણતા નહિ, કેમકે એ એકેકની સાધના એવું આત્મબળ ઉભું કરે છે કે એ સમૃદ્ધશર્ન જ્ઞાન-ચારિત્ર રૂપી રાજ્યોગની સાધનાને સુલભ અને વેગવંતી બનાવે છે; જેથી અંતે મોક્ષ સાથે જીવનો યોગ થવાનું નિકટ થાય છે. ‘મોક્ષેણ યોજનાદ્વ યોગ’ મોક્ષ સાથે જોડી આપે એ યોગ, દર્શન-જ્ઞાન-ચારિત્ર સીધું આ કામ કરી આપે છે, માટે એ રાજ્યોગ છે. એને સુલભ અને સુદૃઢ કરનાર આ ઉપાયો છે. માટે એ ઉપાયો યોગને સાધના યોગસાધના કહેવાય આવો આ દરેક ઉપાયનો થોડો વિચાર કરી લઈએ.

(૧) નિમિત્તોમાં રાગાદિ મહિનતાથી બચવા પહેલા નંબરમાં વૈરાગ્ય વધારતા રહેવાની જરૂર છે, જેથી દુન્યવી નિમિત્તો આપણને ધર્મપરિણાતિ ભૂલાવી રાગ-દ્રેષ્ણની પરિણાતિ ન કરાવી જાય. એટલું ધ્યાનમાં રહે કે કોઈ પણ ધર્મની પરિણાતિ વૈરાગ્યના પાયા ઉપર ઉભી રહે છે. મનમાં દાનની લેશયા થઈ કે હું દઉં,’ એ શા માટે થઈ ? જો એ દાનથી દુન્યવી નામના માનપાન કે સુખ લેવા માટે થઈ, તો ત્યાં તો એ નામના કીર્તિ વગેરેના રાગથી થઈ; એટલે ત્યાં ખરેખર તો રાગપરિણાતિ આવીને ઉભી રહી; એથી ધર્મપરિણાતિ શી રીતે રહે ? અગર જો ઈધ્યથી થઈ, બીજા દાન કરનારને હલકો પાડવા માટે થઈ, તો તેમાં દ્રેષ્ણપરિણાતિ આવી ઉભી, તો ત્યાં પણ ધર્મપરિણાતિ શાની હોય ? આ બતાવે છે કે જો ધર્મપરિણાતિ રાખવી હોય તો એવા રાગ-દ્રેષ્ણની પરિણાતિ યાને લાગડી વૃત્તિ ન જોઈએ; અને એ વસ્તુ વૈરાગ્યથી બને. વૈરાગ્યથી મનને એમ થાય કે નામના કીર્તિ વગેરેના મોહ શા રાખવા હતા ? એ તો બધું નાશવંત આત્માના ભાવને બગાડનારું છે. કર્મના કચરા અને અનાદિના રાગાદિભાવને વધારનારું છે. લાખ રૂપિયાનો ધર્મ કરીને મારે આત્મઘરે એ કચરા ધાલવા ? સંસારના પદાર્થો ઉપર વૈરાગ્ય હોય, તો એ વિચાર આવે; ને દુન્યવી અનુકૂળ પ્રતિકૂળ સંયોગમાં રાગ દ્રેષ્ણથી બચાવે. વૈરાગ્ય હોવા છતાં ય એવા ભારે દુન્યવી સંયોગની અસર ન થઈ જાય; એટલા માટે વૈરાગ્ય વધારતા રહેવું જોઈએ.

વૈરાગ્ય પ્રતાપે આપત્તિમાં લોડીના આંધણ નહિ પણ સુંદર ધર્મ પરિણાતિ :-
રામ-લક્ષ્મણ સીતાને વનમાં રહેવાનું આવ્યું, નળ-દમ્પંતીને રાજ્યપાટ ગુમાવી

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : ધૂટવાનો મોક્ષો”(ભાગ-૪૪)

જુંગલમાં રખડતા થવું પડ્યું, પરોપકારી સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર અને તારામતીને પોતાના બોલ પર રાજ્ય ગુમાવવાનો અવસર આવ્યો. અને ગુલામી કરવી પરી આ બધાને મનમાં લોહીનાં આંધણ ન મૂકાયા પરંતુ સુંદર ધર્મ પરિણાતિ પ્રકાશમાન રહી કારણ કોઈ ? આજ કે એમના દિલમાં વૈરાગ્ય હતો. જગતના સંયોગોને એ જાણતા હતા કે આ તો શુભાશુભકર્મના ઉદ્યને અનુસરીને ચાલનારી ચીજો છે. આપણા જેવા કર્મના ઉદ્ય હોય એ પ્રમાણે બહારના સંયોગ બની આવે છે. માટે એના પર મદાર નહિ બાંધવાની. મદાર બાંધી રાગ-દ્રેષ્ણથી વિહૂવળ વ્યાકૂળ નહિ થવાનું કે વાહ ! સરસ સંયોગ બની આવ્યો, યા હાય ! બધું બગડી ગયું ! ના, જીવનમાં આ સંયોગોની બહુ કિમત માંડવાની નહિ. કિમત તો ગણો અને સમાધિથી અંતરાત્માની ઉત્તમતા જાળવી રાખવાની છે...” આ ધોરણ પર એ ભયંકર કષ્ટમાં પણ સ્વરથ રહી શક્યા.

કિમત સંયોગોની નહિ, પણ અંતરાત્માની ઉત્તમતાની :-

એમાણે જો બહારના સંયોગને બહુ મન પર લીધા હોત તો મનમાં દ્રેષ્ણ-ઉદ્દેગ કેટલા બધા થાત ? રામના મનને થાત કે આ કેક્યી કેવી કે મને રાજ્ય મળવાના આખા પ્રસંગને ઉલટાવી નાખ્યો ? ના, એમના મનને એવું કશું થયું નહિ એમણે તો બનતું બધું સ્વાભાવિક તરીકે જોયું. કેક્યી વરદાન પ્રમાણે, માગી લે એ સહજ છે. પિતાજી પોતે આપેલા વરદાન પ્રમાણે એની માગણી પૂરી કરે એ ન્યાયયુક્ત છે. ભરત રાજ્ય લે એ પિતૃ વચન અખંડ રહે એ માટે જરૂરી છે. ના પણ, ભરત રાજ્યને નથી સ્વીકારતો તો રામે પોતે વનવાસ સ્વીકારી લઈને પોતાના હાથે એનો રાજ્યભિષેક કરવો એ વાજબી માની કર્યું. પરંતુ વનમાં ભટકવામાં તો કષ્ટ બહુ ના, એ તો કર્મના સંયોગ મુજબ બનવાનું બન્યા કરશે, એમ સમાધાન કરી લીધાં.

રામચંદ્રજી રાજ્યના રાગમાં કે દુઃખના દ્રેષ્ણમાં તણાયા નહિ, ખુશમિશાલ વનમાં ચાલી નીકળ્યા અને વર્ષો સુધી ભટકતા રહ્યા. જગતના સંયોગ પર બહુ મદાર બાંધી હોય તો આ શે બનો ? પણ મૂળમાં વૈરાગ્ય હતો તેથી સમતાભાવની ધર્મપરિણાતિ ટકાવી રાખી મગજ સમતોલ રાખ્યું; મનથી દૂબળા ન પડ્યા

વૈરાગ્ય એટલે દુન્યવી વિષયો પર રાગ ન થાય એમ નહિ પરંતુ એનું બહુ મહત્ત્વ ન લાગે. મનને વારંવાર રટાવ્યા કરવું જોઈએ કે દુનિયાના અનુકૂળ પ્રતિકૂળ પદાર્થોની બહુ કિમતી નથી. સદાના સ્થાયી મારા આત્માને આના નાશવંત સંયોગોથી ઉભા થતા નાશવંત કામચલાઉં સુખ દુઃખથી શી વિશેષતા ? આમ રટાય જવાય, તો તેવા તેવા સંયોગોમાં રાગ દ્રેષ્ણની પરિણાતિ જોર ના કરી જાય, સમતા સમાધિની ૧૭૪ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“વિવિધ નિમિત્તોમાં રાગાદિ...”(ભાગ-૪૪)

ધર્મપરિણાતિ ભૂલવાનું ગુમાવવાનું ન બને. વૈરાગ્યથી બાધને મહત્વ ન આપ્યું પછી બહારના નિમિત્તોમાં રાગ દ્વેષ ઈર્ધ્યા દીનતાદિ કરવાનું નહિ રહે.

(૨) નિમિત્તોમાં રાગાદિથી બચવા બીજો ઉપાય જિનવચનનાં ગુણગાન. વૈરાગ્યની સાથે જિનવચનના. વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વરદેવનાં વચનનાં ખૂબ ગુણ ગાવા જોઈએ, એની સારી અસરથી નિમિત્તોમાં રાગ દ્વેષાદિ મલિન ભાવો કરતાં અટકાશે એના પર ધર્મપરિણાતિ ટકશે. એ ટકાવવી છે ને ? ધર્મપરિણાતિના બળ ઉપર કોધ-દ્વેષ-ખેદ ને હાયવોય અટકાવવા છે ને ? ઠેઠ પ્રાણનાશ સુધીનો ઉપદ્રવ કરવા કોઈ આવે તો પણ ભલે સામો મારા પ્રાણ લુંટો ને ? એ સલામત તો મારે સબ સલામત પછી સામા પર ગુસ્સો શા માટે કરું ? આવા ભાવ રાખી ધર્મપરિણાતિ તો નથી લુંટો ને ? એ ધર્મપરિણાતિના બલ ઉપર પ્રાણનાશ વખતે પણ કોધને અટકાવવો છે ને ? તો મૃત્યુ કરતાં તે પૂર્વનાં સામાન્ય પ્રસંગ-આપત્તિ-ઉપદ્રવ વખતે તો સહેજે ધર્મપરિણાતિ પર મુસ્તાક રહી કોધને અટકાવી શકાય.

કાંઈ પણ કષ્ટ આપત્તિ પ્રતિકૂળ આવી પડતાં મનને એમ થાય કે હું આકુળવ્યાકુળ થઈ ? મારી ચીજ તો ધર્મપરિણાતિ છે ધર્મશક્ષા-ધર્મરાગ છે, ધર્મનું આલંબન છે. એ જો સલામત તો જીત્યા, કશું બગડ્યું નથી. એ જો બગડી ગઈ તો બીજું સલામત રહ્યે પણ હારી ગયા.'

જીવન જીતવા-હારવાનું ધર્મપરિણાતિ ટકાવવા ગુમાવવા પર છે.

આત્માનું બગડવા-સુધરવાનું ધર્મ પરિણાતિ બગડવા-સુધરવા પર છે.

ધર્મપરિણાતિમાં શું શું આવે ? :-

ચિત્તમાં ધર્મપરિણાતિ રહ્યા કરે એની બલિહારી છે. ધર્મપરિણાતિ એટલે માત્ર દેવદર્શન-પૂજન, સાહુવંદના, સુપાત્રદાન, સામાયિક, પ્રતિકમણ, પોષધ કે દાનની શીલની તપની લેશ્યા એટલું જ સમજતા નહિ, અલબત એવી મનોવૃત્તિ, એવી લેશ્યા એ તો ધર્મપરિણાતિ છે જ; કિન્તુ જે જે પાપલેશ્યાએ પાપવિચારો પાપી મનોવૃત્તિઓ છે એ બધાની પ્રતિપક્ષી અર્થાત સામેની શુભ મનોવૃત્તિ એ પણ ધર્મપરિણાતિ છે.

પાપપરિણાતિ અને ધર્મપરિણાતિના થોડા ઉદાહરણ જુઓ :-

કોધનો ભાવ એ પાપપરિણાતિ છે, તો ક્ષમાનો ભાવ એ ધર્મપરિણાતિ છે, હાં, એટલું ધ્યાનમાં રહે કે એ ગુણગાન ઘરનો જોઈએ, નિઃસ્વાર્થ સહજ રૂપનો જોઈએ, એમ તો ઘરાક ગમે તેવા કઠોર શબ્દ બોલી કાઢે, પણ વેપારી ક્ષમાનો ભાવ રાખે છે. પરંતુ તે તો ઘરાક પાસેથી પૈસા કઢવવાના સ્વાર્થ, એટલે એ ભાવ કાંઈ ધર્મપરિણાતિ નથી. એતો સહજ રીતે કોધ ખરાબ લાગે, આત્માનું

ભુવનભાનું અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

ભગાડનારો લાગે, અને ક્ષમાનો ભાવ રખાય, એ ધર્મપરિણાતિ છે.

એમ, ઈર્ધ્યાનો ભાવ એ પાપપરિણાતિ છે. એની સામે ગુણાનુરાગ, પરના સારા ઉપર ગ્રમોદનો ભાવ, એ ધર્મપરિણાતિ છે. એવી રીતે પાપી જીવ પર દ્વેષ એ પાપપરિણાતિ છે. એની સામે એના પર દ્યાનો ભાવ કે બિચારો પોતાનું અને બીજાનું બગાડી રહ્યો છે, એને સદ્બુદ્ધ મળો.’ એ ધર્મપરિણાતિ. એમ, કોઈ સારી ચીજ ખાવાનું મન થયું, એ પાપપરિણાતિ; એની સામે એના ત્યાગની મનોવૃત્તિ થઈ એ ધર્મપરિણાતિ.

આમ અઠારે ય પાપસ્થાનક, આહારાદિ સંજ્ઞાઓ, અધીરાઈ કુદ્રતા, હાય્યમશકરી, અસહિષ્ણુતા, કાયાની જ દાઢિ, વગેરે વગેરે અશુભ ભાવો, એની લેશ્યા એના વિચારો-વિકલ્પો એ બધું પાપપરિણાતિ છે. જ્યારે એની સામેના શુભ ભાવો લેશ્યાઓ મનોવૃત્તિઓ એ ધર્મપરિણાતિ છે. પાપપરિણાતિમાં જીવનને હારી જવાનું થાય. ત્યારે ધર્મપરિણાતિમાં જીવન જીતી જવાનું બને.

નિમિત્તો ઉપસ્થિત થતાં રાગ-દ્વેષ-અભિમાન-ઈર્ધ્યા વગેરે મલિન ભાવોથી બચ્યું છે. તો એ માટે ધર્મપરિણાતિને મજબૂત કરવા જેવી છે. મેલી વૃત્તિઓ અટકાવવા અને ધર્મપરિણાતિ લાવવા ટકાવવા માટે પહેલા ઉપાયમાં વૈરાગ્ય કેળવવો. ધર્મપરિણાતિ ને બીજા ઉપાય તરીકે વૈરાગ્યની સાથે જિનવચનનાં ગુણગાન કરવા.

જિનવચનનાં ગુણગાનને જીવનમાં સ્થાન કેટલું ? દુનિયામાં કેટલીય ચીજોનો અને કેટલાય સગાસ્નેહીઓના કે સારા રૂપાળાના ગુણગાન કરાય છે. પણ જિનવચનનાં અને જિનશાસનનાં ગુણગાન કર્યાં છે ? અરે સર્વ મંગલમાગલ્યં....જૈન જીતિ શાસનમું બોલતી કે સાંભળતી વખતે પણ મનમાં એના ગુણગાન કર્યાં છે ? મનને કર્યાં એમ થાય છે કે અહો ! કેવું વિજયવંતુ જિનશાસન મને મળ્યું ? કેવું સુંદર એ સર્વમંગળનું મંગળ અને સર્વકલ્યાણ સાધક ? સ્વર્ગ સદ્ગતિ મોક્ષે પહોંચાડી આપનારું ?- એમ શાસનના ગુણ ગાયા કરતા રહેવાય; જિનવચનના ગુણ ગાતા રહેવાય, કે કેવી તારક જિનાજ્ઞાઓ ! મંગળકારી જિનવચનો ! જિનવચને કેવા કેવા રંક અને રાજાને તાર્યા ! અભણ અને વિદ્વાનને તાર્યા ! બાલ અને બુઢાને તાર્યા ! કેવા સર્વહિતકારી સર્વ જીવોની દયા, સર્વ પાપનો ત્યાગ બતાવનારાં જિનવચન ! આમ મનથી જિનવચનના ગુણગાન થયા કરતા હોય તો એની સારી અસરથી મલિન ભાવો જાગવા અને પાપપરિણાતિ ઊભી થવી મુશ્કેલ. ત્યારે અહીં સવાલ કરો.—

પ્ર.- જિનવચનનાં ગુણગાન તો કરીએ, પરંતુ ઈદ્રિયોનાં વિષયો તરફનાં અનાદિનાં આકર્ષણ ઈષ વિષયો સામે આવતાં એની આસક્તિ કરાવી જાય છે.

૧૭૬ ભુવનભાનું અન્સાઈક્લોપીડિયા-“વિવિધ નિમિત્તોમાં રાગાદિ...” (ભાગ-૪૪)

એનું કેમ ? એ આસક્તિ તો મહિન ભાવ અને પાપપરિણાતિ જ છે ને ?

ઉ.- વાત સાચી છે કે વિષયોની આસક્તિ એ મહિનભાવ અને પાપપરિણાતિ છે, કિન્તુ

જિનવચનનાં ગુણગાન વારંવાર ચાલતાં હોય, તો દંદિ જાગતી બની જાય.

એ જાગતી દંદિ તો, વિષયો સામે આવતાં જ, જીવને સાવધાન બનાવે કે આ જેર સામે આવ્યાં, જેરી નાગ સામે આવ્યા; પછી આસક્તિ શું કામ ઉઠવા પામે ? પણે અસલમાં જિનવચનનાં એવા હદ્દ્ય વેધી ગુણગાન કર્યાં છે ? દિલમાં આગ કર્યાં સળગી છે કે આ વિષયો કાતિલ જેર છે ? એની ઓળખ કરાવનારાં જિનવચન, અહો કેવા ઉપકારી ! કેવા અમારા તારણહાર ! કેવા દીવા જેવા ! અંધારે દીવો હાથમાં આવ્યા પછી, ને કૂવો સાફ દેખાયા પછી પણ કૂવામાં પડવાનું ? હૈયે આગ લાગ્યા જેવી જિનવચનની કદર થાય, જિનવચનના ગુણગાન થયાં કરે, તો વિષયો મૂવા પડ્યા છે. જરાય આસક્તિ આકર્ષણ ન થાય, ધર્મપરિણાતિ જાગતી રહે.

છતાં માનો કે અનાદિના કુસંસ્કારવશ વિષયો તરફ આકર્ષણ આસક્તિ ઉઠે છે, તો પણ એની જેરરૂપે ઓળખ તો હૈયે જાગતી પડી હોય, એ દેખાઈ આપે છે કે આ હું ખોટે રસ્તે જઈ રહ્યો છું, જેર ખાઈ રહ્યો છું. ક્યાં સુધી આ જેર ખાવાના ?' જો આ ઓળખ ને આ સંતાપ જાગ્રત હોય તો એ પણ ધર્મપરિણાતિ છે, શ્રદ્ધારૂપ ધર્મપરિણાતિ, વૈરાગ્યરૂપ ધર્મ પરિણાતિ, જિનવચનનાં વારંવાર ગુણગાન હોય, જિનવચનની હૈયા પર ભારે અસર હોય, તો આ સહેજે બની આવે. ભરતજી મનહી મેં વૈરાગી કેમ ?

જિનવચનની ભારે અસરવાળા હતા માટે, દિલમાં જિનવચનના મહા ગુણગાન ચાલતા હતાં માટે. એટલે તો સાધ્રીકોના મૌંઢે રોજ જિનવચનના અનુસારે સાંભળવાનું રાખેલું કે તું આંતર શત્રુઓથી હારી ગયેલો છે, માટે ભવભ્રમણનો ભય વધે છે. તો તારા આત્માને વિષયરાગરૂપી શસ્ત્રોથી હણ નહિ.'

રોજ આ શા માટે સાંભળતા હતા ? સાંભળીને શું કરતા હતાં ? આ સાંભળતા હતા તે જાગ્રત રહેવા માટે; સાંભળીને વૈરાગ્યભાવના કરતા ક્યારે આ ચક્કવત્તિપણાના વૈભવી પણ સંસારમાંથી છૂટાય, એ ભાવના કરતા. ચક્કવત્તિના સિંહાસને બિરાજ્યા છે એ ધર્મપ્રવૃત્તિ નથી, પાપવૃત્તિ છે. છતાં એ વખતે આ જાગૃતિ અને વૈરાગ્યભાવના તથા ચારિત્રના કોડ થવા, એ ધર્મપરિણાતિ છે. એ જાગતી હોય પછી નિમિત્તો આવી મળે એથી રાગાદિમાં તશ્શાઈ ન જવાય.'

ખૂબી છે, - પાપમાં બેઠા છતાં ધર્મપરિણાતિ ટકાવી શકાય જો એ પાપની

જિનવચનના અનુસારે ખતવણી કરાય.

દા.ત. પૈસા એ પાપ છે, પણ એ લેવા જતાં, અને કમાઈ લાવેલા સંઘરચતા, મનને એમ થાય કે શું કરું ? મૂળમાં આ ઘરસંસારનું પાપ માંડી બેઠો છું એટલે જીવનનિર્વાહ પૂરતા પૈસા કમાવવા સંઘરવા પડે છે; પણ એથી ચિત્ત સ્વસ્થ સમાધિમાં રહ્યી દેવદર્શન પૂજન આદિ ધર્મકાર્ય કરી શકું તો આ જિનવચન અનુસારે પાપની ખતવણી ધર્મભાવનામાં થઈ, એ વિચારમાં સંસારપાપ પ્રત્યે ધૃણા, વૈરાગ્ય, પૈસામાં પાપબુદ્ધિ, ચિત્તને સમાધિની અપેક્ષા, અને ધર્મકાર્યનો મુખ્ય ઉદેશ, મુખ્ય લક્ષ ને કર્તવ્યભાવના થઈ; એ ધર્મપરિણાતિ છે.

દિલમાં જિનવચનનાં ગુણગાન ચાલુ હોય એ ગુણગાન વાતવાતમાં જિનવચનને આગળ કરાવે. પછી સંસારમાં બેઠા પાપાસ્થાનક સેવવા પડે છતાં એની યોગ્ય ખતવણી કરાય; અને એ ધર્મપરિણાતિમાં જાય.

મેવામીઠાઈ સ્નેહીના દાક્ષિણ્યથી યા પોતાના રાગથી ખાવાનો પ્રસંગ આવ્યો, પણ દિલ કહે કે ધ્યાન રાખજે, જિનવચન કહે છે મેવામીઠાઈમાં જીવન નથી, મરવાનું છે; કેમકે ચાલુ સામાન્ય સાદા ભોજન કરતાં આમાં ચીકણા રાગના સંસ્કાર અને એથી ચીકણા રાગના સંસ્કાર અને ચીકણા પાપકર્મ બંધાય છે, માટે આમાં લંપટ ન થતો, ક્યારે આ પાપ છૂટે ! આવું ખાઉં જ છું તો કાંઈક વળતરમાં આજે રાતે કેટલા નમો અરિહંતાણના જાપ કરી લાઉં ? સર્વ રસત્યાગી જિનેન્દ્ર ભગવાનના કેટલાં દર્શન કરી લાઉં ? કેટલાં સ્તવન ગાઈ લાઉં !.....નવકારસીને બદલે પોરિસી કરું ! આવાં વળતર નક્કી કર. બે દિવસ વિગઈત્યાગ રાખ જીવન એ રસભોગ નથી, રસત્યાગ છે.' આવી દિલની ગડમથલ એ ધર્મપરિણાતિ છે.

અથવા મનને થાય કે આ બીજાના દાક્ષિણ્યથી મીઠાઈ ખાવી પડે છે, પણ અત્યારે આ દાક્ષિણ્યને સાચવી લઈને એથી સામાના ભાવ સચવાતા એનો અવસરે એવો ઉપયોગો કરું કે જેથી સામાને ધર્મમાં પ્રેરક થાઉં, ધર્મમાં સહાયક થાઉં, કેમકે દાક્ષિણ્ય સાચવી લીધાથી સામાના દિલમાં મારા પર સદ્ભાવ બન્યો રહ્યો હોય, એથી એ સદ્ભાવની રૂએ એ મારું કષું માને, મારા ધર્મને અનુસરે.

ધર્મિક કાર્યમાં તો ધર્મપરિણાતિ હોય, કિન્તુ સામાનાં દાક્ષિણ્યથી કે સામાને સમાધિ આપવા માટે દુન્યવી કામ કરે છતાં ધર્મપરિણાતિ હોય. સુલસાનો પ્રસંગ જાણો છો ને સુલસાને પુત્ર નહોતો. છતાં એનું એને તો દુઃખ નહોતું; પણ એનું દુઃખ એના પતિને હતું પતિના દાક્ષિણ્યથી એણે એ દુઃખ ટાળવા ઉપાય લેવાનું કર્યું, પરંતુ હિસાબ આ કે પતિનો ભાવ સદ્ભાવ ટકી રહે તો એને આગળ ધર્મમાં વિશેષ જોડી શકાય. સુલસાનું જીવન જોવા જેવું છે. પછીથી જોઈશું. પહેલાં જે આ

વात चाली છે કે દુન्यવી નિમિત્તોમાં જીવને રાગાદિ પાપભાવોથી બચાવી લેવાના ઉપાય ક્યાં ? એનો વિચાર કરી લઈએ.

ત્યારે પહેલા બે ઉપાય વૈરાગ્યવૃદ્ધિ અને જિનવચનનાં ગુણગાન, એનો વિચાર કર્યો હવે.

(૩) નિમિત્તોમાં રાગદેણિથી બચવા, ત્રીજો ઉપાય આ, કે દુનિયાનું બહુ જોવા જ્ઞાવાની આતુરતા જિશાસા ઓછી કરી નાખો.

એથી ડાફોળિયાં અને જ્યાં ત્યાં મોં ઘાલવાનું કે માથું મારવાનું ઓછું થઈ જાય. આ જો ઓછું થઈ જાય, તો આજુ બાજુ નિમિત્તો ઘણાય ઊભા થતા હોય પણ આપણે કેમ, તો કે એ તરફ ધ્યાન જ નથી, બહારમાં મોં ઘાલવાની તથા જ નથી, એટલે અવધું ! સદા મગન મેં રહણા. આપણા આત્માના વિચારમાં મગન રહેવાનું મુખ્ય છે, પછી બહારમાં જવાનું નથી, તો એ નિમિત્તે સારા ખોટાના વિચાર અને રાગ કે દેખણા ભાવ કરવાના રહે જ શાના ?

બહારમાં જઈએ તો બહારના નિમિત્તે મનના ભાવ બગડે ને ?

જીવનમાં ક્યાં પાપ મોટા ? :-

જીવનમાં ઘણું આમ જ બગાડવાનું થાય છે કે બહારમાં ભટકવું ગમે છે, ને બહાર ભટકતા રહીએ છીએ. જીવનનિર્વહ માટે આરંભ-સમારંભ અને પરિગ્રહ કરીને જેટલું નથી બગાડાનું એટલું આ બહારમાં ડાફોળિયાં, અને માથું મારવાનું કરીને બગાડાય છે. કેમ ? એટલા જ માટે કે આરંભ પરિગ્રહનાં પાપોમાં તો હજી ય એમ થાય કે શું કરું ? સંસાર માંથી બેઠો ધું એટલે આ પાપો સેવવા પડે છે સાધુ મહારાજા સદા સુખી, કેમકે એમને આ પાપો ન સેવવા પડે. અમારે પાપ વિના છૂટકો નહિ, આવું આરંભ પરિગ્રહનાં પાપ વખતે થાય, અને તેથી એમાં એવો રસ ન રહે. પરંતુ ડાફોળિયાં મારવાં, ને જ્યાં ત્યાં માથું મારવું મોં ઘાલવું, એ તો ચાહીને જ થાય છે, તેથી ત્યાં રસ રહે છે, પણ કોઈ બેદ ગ્લાની નથી થતી. માટે એ પાપ મોટાં.

જે પાપમાં રસ રહે, પણ બેદ નહિ, એ પાપ મોટું. તો વિચારી જુઓ કે ધર્મક્ષિયા વખતે ય ડાફોળિયું માર્યું, ત્યાં મનને ક્યાં આધાત લાગે છે કે અરર ! આ મેં શું કર્યું ? મંદિરમાં કોઈના કપડાં કે ચીજવસ્તુ પર નજર ગઈ સારી નરસી લાગી ત્યાં ક્યાં બેદ થયો હાય આમાં ક્યાં મન લઈ ગયો ? એ જોવાનું તો બધું સામાન્યમાં કાઢી નખાય છે; સ્વાભાવિક લાગે છે. જે પાપમાં સ્વાભાવિકતા લાગે, બેદ ન થાય, એ પાપ મોટું ? કે જેમાં મોહમૂઢતા લાગે ગ્લાનિ-બેદ-દુઃખ થાય એ મોટું ?

ડાફોળિયાં એ મોટું પાપ : અનર્થદંડમાં ભયંકરતા :-

અનર્થદંડના પાપ, જેવાં કે ખેલ-તમાશા-સિનેમા, પાના-બાજુ, રાજકથા

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો”(ભાગ-૪૪)

ભોજનકથા, દેશકશા સ્ત્રીકથા, કૂથલીની વાતોચીતો આરંભ સમારંભની સલાહ, દીકરા-દીકરી પરણાવવાની સલાહ.....વગેરે, એ મોટાં પાપ એટલા માટે છે કે એમાં કશું ખોટું કર્યું લાગતું નથી, તેથી એનો રસ બન્યો રહેવાથી (૧) એક તો ભગવાન ભગવાનની ઉપાસના અને ધર્મસાધનામાં એવો રસ જાગતો નથી. તેમજ (૨) બીજું એ કે એ અનર્થદંડનાં પાપોના ધેરા સંસ્કાર પડ્યા કરે તેથી ભવાંતરોમાં એવા પાપાચરણ બહુ ચાલ્યા કરે છે; વળી (૩) બીજું એ કે આ પાપોમાં રસ રહેવાથી ચિત્ત એમાં ચોંટ્યું રહે છે, ધ્યાનરૂપ બને છે, ને એ ધ્યાન કોઈ ધર્મધ્યાન નહિ, પણ આર્તધ્યાન એટલે એ તિર્યંગતિનાં પાપ બંધાવ્યા કરે છે. ખૂબ યાદ રાખો.

ડાફોળિયાં એટલે મન બહારમાં ઠરે છે. આ બહારનો રસ ડાફોળિયાં મરાવી આવાં પાપ લઈ આવે છે.

બસ, આટલા માટે મફતિયું બિનજરૂરી જ્ઞાવા જોવાની આતુરતા જિશાસા, ડાફોળિયા વગેરે અનર્થ દંડ સેવવાનું બંધ કરી દેવું જેથી પછી એ ડાફોળિયામાં જે આજુબાજુના નિમિત્તો પર ધ્યાન જત, તે જાય જ નહિ, તેથી એના પર ઉઠાતા રાગદ્વેષ ઉઠે જ નહિ, ત્યારે અહીં પ્રશ્ન થાય,-

પ્ર.- પરતુ એમ તો એમાં કોઈ સારું નિમિત્ત જોવા મળવાનો લાભ ગુમાવવાનું થાય ને ? ખોટામાં તો બેઠા જ છીએ, પણ થોંટું ય સારું મળતું હોય તે શા માટે ગુમાવવું ?

૩.- ખોટામાં બેઠા નથી, પણ ડાફોળિયાં મારવામાં ખોટામાં પેસવાનું થાય છે. તે થોંટું નહિ, પણ હિસાબ વિનાના રાગ દેખમાં પેસવાનું થાય છે. તે ય વળી રસથી. આમાં ક્યારેક કિંચિત્ સારું મળવાનાં લોભે આટલું બધું ખોટું વહોરવાનું ઊભું કરવાની જરૂર શી ? ડાફોળિયાં ખોટી જિશાસા, બહિર્ભાવ વગેરે ચલાવ્યે રાખવામાં આટલા બધાં નુકસાન ઊભાં કરવાનું થાય છે.

બીજું એ પણ છે કે કદાચ ક્યારેક સારું નિમિત્ત જોવા મળી ય જાય, કિન્તુ એનાં મૂળમાં વૃત્તિ તો બહારમાં ભટકવાની હતી, તેથી તો ડાફોળિયાં મરાતા હતાં; એટલે સંભવ છે કે સારું નિમિત્ત જોવા મળી આવે એમાં, મૂળમાં વૃત્તિ પેલી હોઈ, એવો જ કોઈ બાધ્ય ભાવનો વિચાર આવવા પણ સંભવ રહે. બહુ ધ્યાન રાખવા જેવું છે, બાધ્યવૃત્તિ સારામાંથી પણ નરસો ભાવ ઊભો કરવા જાય છે.

દા.ત. જુઓ પીઠ અને મહાપીઠ મુનિઓ સ્વાધ્યાય ધ્યાનમાં મગ્ન રહેનારા, એમને ચિત્ત બહારમાં ગયું હશે, ને ત્યાં આચાર્ય મહારાજના મુખે બાહુ અને સુબાહુ મુનિથી કરાતી સાધુ સેવા ભક્તિના ગુણ ગવાતા સાંભળવા મળ્યા; કહો એમને આ નિમિત્ત તો સારું જ મળ્યું ને ? છતાં શું અથી એ સારો ભાવ પાખ્યો ? ના, એમના મનમાં અનુમોદના થવાને બદલે ઈર્ઝા થઈ આવી.’ અમારા નહિ, ને એમના ગુણ કેમ ગવાયા ? પાછો એ ઈર્ઝાભાવ ધૂપાવી રાખ્યો એમાં માયા પણ થઈ બોલો, સારાં નિમિત્તમાંથી સારો ભાવ કર્યાં પાખ્યા ?

સારો ભાવ કેમ ન આવ્યો ? કહો, મૂળમાં સ્વાધ્યાય-જ્ઞાનધ્યાનમાંથી ચિત્ત ઉદ્ઘાતી બહારમાં લઈ ગયા હશે તો તે કશું સારું શોધવાની પામવાની દાખિથી નહિ, કિન્તુ બહારમાં જરા મનને ઠરવા માટે લઈ ગયા હોય. આ વૃત્તિથી, પછી સારું નિમિત્ત મળ્યું છતાં મનને ઈર્ઝામાં ઠરવાનું સહેજે બની આવે.

અનાદિ કાળથી મનનું વલશ ઈર્ઝામાં ઠરવાનું છે, અનુમોદનામાં નહિ; દોષમાં દુષ્કૃત્યોમાં દુર્ગુણમાં ઠરવાનું છે, ગુણો સત્યકૃત્યોમાં બીજાના સુકૃતોમાં નહિ, આ ધ્યાનમાં રાખ્યો એ વલશ ખાસ ફેરવવાનું છે.

એટલા માટે તો આત્માનાં ઉત્થાનના બહુ પ્રારંભે ચરમાવર્તમાં આવ્યા પછી સહજમળના ક્ષયને જ ઉત્થાનનું પહેલું પગથિયું કર્યું ત્યાં એનાં લક્ષણોમાં એક લક્ષણ ‘અદ્વેષો ગુણવત્સ ચ’ કર્યું અર્થર્ત ગુણવાન પર દ્વેષ-ઈર્ઝા-માત્સર્ય ન થાય, એ સહજ મલક્ષયનું એક લક્ષણ બતાવ્યું એનું શું રહેસ્ય છે ? આ જ, કે અનંતાનંત કાળથી મન ઈર્ઝામાં ગુણદ્વેષમાં ઠરવાના સ્વભાવવાળું છે, એ હવે બંધ થવું જોઈએ તો ખરેખર ભવમાં અમર્યાદિત ભટકાવનારા સહજમળનો સારો ક્ષય થયો ગણાય. મનનું વલશ હવે ગુણ પત્યે દ્વેષ-ઈર્ઝામાં ઠરવાનું ન રહેવું જોઈએ.

તપાસજો, દિલમાં ક્યારેક, બીજાના ગુણ પત્યે દ્વેષ-ઈર્ઝા નથી આવતા ને ? મન એ દ્વેષ-ઈર્ઝામાં ઠરતું નથી ને ? આપણો રીતભાતથી એની રીતભાત જુદી હોય, દા.ત. આપણો તપ કરતા હોઈએ અને એ જ્ઞાનોપાર્જન કરતો હોય, આ આપણે જ્ઞાનોપાર્જનમાં લાગ્યા હોઈએ, ને એ તપ કરતો હોય, ત્યાં એની કોઈ પ્રશંસા કરે, તો એના ગુણ પત્યે એની પત્યે મનમાં ઓદ્ધા ય ઈર્ઝાભાવ-બળતરાભાવ નથી જાગતો ને ? તપાસજો, જો જાગે છે તો એનું મન એમાં ઠર્યું ગણાય; ને મનનો આ અનાદિનો દુષ્ટ સ્વભાવ છે, અનાદિનું આ મનનું દુષ્ટ વલશ છે કે ગુણ ગુણી પત્યે બળવું, ગુણ ગુણી પત્યેના દ્વેષમાં ઈર્ઝામાં ઠરવું.

બાધ્યમાં ભટકવામાં ઠરવાના આ મનના અનાદિના વલશને લીધે ગુણદ્વેષ ઈર્ઝા વગેરેમાં જઈ છે એ સ્વાભાવિક છે. પછી ડાફોળિયા મારતાં એમાં કદાચ નિમિત્ત સારું પણ જોવામાં આવી ગયું, છતાં મૂળમાં, બહારમાં ભટકવામાં મન ઠરતું હોઈને તો ડાફોળિયાં મરાય છે, એટલે એવા ઠરવાનાં વલશને લઈને સારા નિમિત્ત પર પણ દ્વેષ ઈર્ઝા અહંત્વ વગેરે એક યા બીજા દોષમાં ઠરવાનું બને એ સ્વાભાવિક છે. પીઠ મહાપીઠ મુનિ જ્ઞાનધ્યાનમાંથી મનને ઉંચકીને બહારમાં ઠરવા લઈ ગયા હોઈ પછી બીજાની પ્રશંસા સાંભળતાં એના ગુણની અનુમોદનામાં મન કર્યાં છે ?

ગુણની અનુમોદના તો અંદરમાં ઠરવાની વસ્તુ છે, ત્યારે ગુણ પત્યે દ્વેષ-ઈર્ઝા એ બહારમાં ઠરવાની વસ્તુ છે.

આવું બીજે પણ વિચારી લેજો દા.તા.

સારું ખાવાનો રસ એ બહારમાં ઠરવાનું કહેવાય; ને ત્યાગ તપનો રસ એ અંદરમાં ઠરવાનું ગણાય.

પૈસા કમાવાનો રસ રાખ્યો એ બહારમાં ઠર્યા; પણ ધનોપાર્જન વખતે સમાધિપૂર્વક દેવદર્શન પૂજનાદિ ધર્મક્રિયા તથા દાનાદિ સુકૃતસાધનાનો રસ રાખ્યો એ અંદરમાં ઠર્યા.

બોલો, મન કર્યાં છે ? કર્યાં ટાઢક અનુભવે છે ? (૧) ગુણની અનુમોદનામાં કે બળતરામાં ? (૨) ખાનપાનમાં કે ત્યાગ-તપમાં ? (૩) પૈસામાં કે દાનાદિર્ધમ-સાધનામાં ? (૪) આરંભ-સમારંભમાં કે અહિસામાં ?

આજે તો તમને દેરાસરમાં, પણ ધીના દીવાને બદલે ઈલેક્ટ્રીકના ઝગારા મારતા દીવાનો રસ છે ને ? પેલા કરતા આમાં અભિકાય જીવો કેટલા વધારે ભરે ? ઉપરાંત ત્રસ જીવો ઊડતા જીવો કેટલા મરતા હોય છે ? સ્વીચ દાબીને ઝટ લાઈટ થઈ એ સગવડમાં એવા કેટલા દીવા ? ધીના દીવાના શાંત જ્યોતિમાં વીતરાગ પ્રભુની વીતરાગતા પ્રશાંતતા જોવાનો રસ તો બાજુએ રહ્યો, પણ અહિસાનો ય રસ રહ્યો ? કે આરંભ સમારંભમાં જ રસ ?

ત્યારે જેને મંદિરમાં ય ખોટા આરંભ સમારંભમાં રસ હોય, એમાં મન ઠરતું હોય, અહિસામાં વીતરાગપ્રભુની પ્રશાંત મુદ્રા જોવામાં નહિ એનું દુનિયાદારીમાં ય મન અહિસામાં કર્યાંથી ઠરે ? તો પૂછતા નહિ,-

પ્ર.- જો મંદિરમાં ય અહિસામાં મન ઠરવાનું હોય તો પછી ધીના દીવા અને પાણીના પ્રક્ષાલ પણ શા માટે જોઈએ ? એટલો ય અહિસાને બદલે આરંભ સમારંભનો જ રસ ગણાશે ને વિજણીમાં વધુ હિંસા, તો આમાં થોડો પણ

આરંભસમારંભ તો છે જ ને ?

ઉ.- અલબત ધીના દીવામાં ય આરંભસમારંભ છે. કિન્તુ મોટો ફરક આ છે કે, ધીનો દીવો પ્રભુની ભક્તિ નિમિત્ત કરવામાં આવે છે, ત્યારે વિજળીના દીવાના રસિયા એ દીવા પોતાની આંખ ને મનને ઠારવા માટે કરે છે, માટે એમાં ભક્તિ કરતાં આરંભસમારંભનો રસ પોષાય છે, ને ધીના દીવામાં પ્રભુભક્તિના રસ પોષાય છે.

વિજળીના દીવા કરનારાની પોતાની આંખને એ દીવાની ઝગારા મારતી લાઈટ ગમે છે. માટે એ કરે છે. એમાં તો આંખની ભક્તિ થઈ. જો પ્રભુની ભક્તિનો જ આશય હોય તો તો ઘરેથી નાની કટોરી પણ ધી લાવીને એનો દીવો કરત. પણ આ તો ઘરેથી ધી લાવાની તો વાતે ય શી ? મંદિરમાં લાઈટોના ગોળા ઢોકી મૂકેલા છે, તેથી કેમ ? તો કે હું, દબાવો, ૫-૭-૧૦ સ્વીચો કોના બાપની દિવાળી ? ઈલેક્ટ્રિકનું બીલ ચડશે તો ભરશે, દેરાસરનું સાધારણ ખાતું. આમાં પ્રભુની ભક્તિ ક્યાં આવી ?

ભક્તિ તો પોતાના દ્રવ્યનું સમર્પણ છે.

ઘરે મહેમાન આવ્યા હોય અને એના જ ખરચે શિખંડપૂરી જમાડો તો મેમાનની એ ભક્તિ કરી કહેવાય ? કે એને એનું જમવામાં સગવડ કરી આપી ગણાય ? એમ પ્રભુના જ સાધારણ ખાતાના દૂધ-ચંદન-કેશર-ધૂપ-દીવાથી પ્રભુની પૂજા કરી એ પ્રભુની ભક્તિ કરી કહેવાય ? કે પ્રભુનો પોતાની શોભા માટે એમના દ્રવ્યમાંથી સગવડ કરી આપી કહેવાય ?

હિંસાવણી પૂજા શા માટે ? ઉદેશ અને ફળ જુઓ :-

પ્ર.- બેર ! પણ પોતાના દૂધ-પાણી-દી-ધૂપ વગેરે લાવી પ્રભુ ભક્તિ કરે એમાં હિંસા-આરંભ-સમારંભ તો ખરો જ ને ?

ઉ.- હા ખરો પણ તે હિંસાના આરંભસમારંભના રસથી નહિ કિન્તુ જિન-ભક્તિના રસથી આરંભ સમારંભ છે; ડેક્ટર ઓપરેશનમાં દરદીના પેટ પર છરી ભોકે છે, તે શું હિંસા કરે છે ? ના, કેમકે એનો ઉદેશ હિંસાનો નથી, કિન્તુ દરદીને સાજો કરવાનો છે. એટલે છરી મારવા છતાં રસ છરીથી હિંસા કરવામાં નથી, કિન્તુ દરદીને આરોગ્ય પમાહવામાં છે. બસ, એ જ રીતે એહી વીતરાગની ભક્તિ માટે કરાતા પ્રક્ષાલ, ધીનો દીવો, ધૂપ વગેરેમાં સમજવાનું છે. ત્યાં ઉદેશ, રસ, એ આરંભ સમારંભનો નથી, કિન્તુ વીતરાગની ભક્તિનો છે. એમ કરીને વીતરાગની નજીક આવવાનો અને વીતરાગની મમતા વધારવાનો રસ છે, જેથી ફળમાં એક હિવસ વીતરાગને અતિ નિકટ થઈ જતાં, મમતા વધી જતાં સંસારની

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : ધૂતવાનો મોકો” (ભાગ-૪૪) ૧૮૩

મમતા જ કપાઈ જાય, વીતરાગની જ સેવા કરવાનું એમને સંપૂર્ણ આજી ઉઠાવવાનું જોમ આવી જાય. તેથી સર્વ હિંસાદિ પાપનો ત્યાગવાળું સર્વવિરતિ ચારિત્રશ્વન સ્વિકારી લેવાય. આમ મૂળમાં પ્રભુનો અભિષેક, પ્રભુની આગળ ધૂપ અને ધીનો દીપક, તથા પ્રભુનો ચંદનવિલેપન વગેરે પોતાના ઉત્તમ દ્રવ્યોથી પૂજન કરતાં કરતાં આ સ્થિતિએ વીતરાગની મમતા વધારી સંપૂર્ણ અહિંસામાં જવાય છે. તેથી સમજાય એવું છે કે ધીનો દીવો વગેરે કરવામાં રસ આરંભ સમારંભનો નહિ, પણ વીતરાગની ભક્તિનો છે, વીતરાગની મમતા વધારવાનો છે, અને ફળ સંપૂર્ણ અહિંસા તથા સર્વ પાપત્યાગમાં આવે છે.

અહીં એટલું પૂછો,-

પ્ર.- પણ આ વીતરાગની ભક્તિ-મમતા તો એમનાં સ્મરણ-ગુણગાન તથા વૈરાગ્યવૃદ્ધિ કરવાથી ન બને ? એમાં અભિષેક-ધૂપ-દીપ વગેરેની શી જરૂર ?

ઉ.- જ્યાં સુધી પોતાનાં દ્રવ્યોથી સંસારની મમતા પૂરી પોષાઈ રહી છે ત્યાં સુધી બાળ જીવન તરીકે વૈરાગ્યની વૃદ્ધિ કરશો કેવી રીતે ? એ તો જઈ જઈને ત્રિકાળ પ્રભુસેવામાં એ દ્રવ્યો સમર્પતા રહો તો એક બાજુ સંસાર પર વૈરાગ્ય અને બીજી બાજુ વીતરાગ પર રાગ વધતો ચાલે, મારું બધું મારા માટે ને પ્રભુને મંજુરા,’ એમ કરવાથી વૈરાગ્ય થોડો જ વધે ?

(૨) પ્રભુ કરતાં પૈસા વધુ વહાલાં, એટલે પ્રભુની સેવામાં પૈસા જાઓ એમ નહિ, પણ પૈસાની વૃદ્ધિમાં પ્રભુ કામ આવો એમ ભાવવાથી વીતરાગ પ્રભુ પર સંસાર કરતાં વધુ રાગ શી રીતે થાય ? એ તો મનને એમ થાય કે મારા પ્રભુની આગળ પૈસા શી ચીજ છે ? મારા કામમાં થોડા વાપરું પણ પ્રભુની ભક્તિમાં પૈસા તોડી નાખું. પૈસા આ માટે જ મળ્યા છે કે એથી ઉત્તમ જિનભક્તિ કર્યા કરું, ત્રિકાળ કરું, પર્વ હિવસે વિશેષ કરું. એમ કરતાં કરતાં જ વીતરાગની માયા-મમતા પ્રીતી વધે, પણ પ્રભુને ટીકો દેખાડ્યાથી નહિ.

(૩) મળેલા દ્રવ્યો ઊચો વિનિયોગ સ્થાપન ઉપયોગ કરવાનું સર્વોત્તમ પાત્ર વીતરાગ ભગવાન છે.

એમના ચરણમાં એ સ્થાપિત થાય એટલે તો એ અક્ષય લક્ષ્મીરૂપ બની જય; જાત ભોગ અને સંગ્રહમાં જ લગાવ્યા કરવાથી તો લક્ષ્મી વેડફાવાની, કેદમાં કેદમાં પૂરાવાની, તેમ અંતે તો એ લક્ષ્મી નાશવંત જ રહેવાની, અને એનાથી વીતરાગની ભક્તિ મમતા વધારવાની તક ચાલી જવાની.

ધ્યાન રાખજો કે ગુરુ ત્યાગી છે એટલે એમની ભક્તિમાં એ કિમતી દ્રવ્યો લગાવી શકાતા નથી, એ દ્વારા એની મૂર્ચ્છા ઘટાડી શકાતી નથી. ગુરુ એ સ્વીકારે

૧૮૪ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“વિવિધ નિમિત્તોમાં રાગાદિ...” (ભાગ-૪૪)

જ નહિ ને; અને સ્વીકારે તો એ ગુરુ નહિ. એટલે હીરા માણેકના મુગટ હાર સુધીનાં ઉત્તમ દ્રવ્યો ઠેકાડો પાડવાનું સર્વોત્તમ પાત્ર વીતરાગ ભગવાન છે.

વીતરાગને આભૂષણનું માર્મિક રહસ્ય :-

એમ સમજતા નહિ કે,

પ્ર.- વીતરાગને આ જીવેરાત વગેરે ચડાવવાથી એમની વીતરાગતા ખંડિત ન થઈ જાય ?

ઉ.- ના, કેમકે એમને તો એ કશું ય જોઈતું નથી, તેમ આપણે પણ એ એમના માટે નથી ચડાવતા એ તો આપણી દ્રવ્યમૂર્ચ્છા ઘટાડવા તથા વીતરાગ પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા અદા કરવા, ને પ્રભુ પર ભક્તિ વધારવા માટે ચડાવીએ છીએ; પ્રભુને પોતાને તો આ દ્રવ્યો સાથે કે ભક્તિ પ્રશંસા ગુણગાન સાથે કશી જ લેવા દેવા નથી. નહિતર તો, જેમ કહો છો કે આભૂષણ વગેરેથી વીતરાગની વીતરાગતા હણાય, એમ એ પણ કહોને કે વીતરાગનાં ગુણ-ગાન-પ્રશંસા કરવાથી એમને અભિમાન થઈ જતાં એમની વીતરાગતા હણાય. તથી જેમ આભૂષણ પૂજા નહિ, એમ સ્તુતિ ગુણગાન પૂજા પણ નહિ, એમ કેમ નથી કહેતા ? ત્યારે જેમ માનો છો કે આપણાએ પ્રભુના સ્તુતિ ગુણગાન કરીએ એમાં વીતરાગ પ્રભુને પોતાને કશી લેવાદેવા નથી, એ તો આપણા આત્માને પ્રભુભક્તિ વધારવાનું કાર્ય છે. એવી રીતે માનો કે લાખ રૂપિયાના જીવેરાત ચડાવીએ, લાખો રૂપિયાથી આલીશાન મંદિર બંધાવીએ, એમાં વીતરાગ ભગવાનને પોતાને કશી લેવા દેવા નથી.

મંદિર નિર્માણ કે આભૂષણાદિ તો આપણા દિલમાં પ્રભુભક્તિ વધારવાની એક પ્રક્રિયા છે.

સારાંશ, ધીનો દીવો વગેરે પ્રભુ આગળ ધરાય એ જિનભક્તિ માટે છે; તથી એ ધરવામાં જીવનું લક્ષ્ય જિન-ભક્તિનું ગણાય, પણ દીવા વગેરેથી થતા આરંભસમારંભનું નહિ; હિંસામય આરંભસમારંભના રસથી એ નથી થતું, કિન્તુ ભક્તિના રસથી એ થાય છે. એમ કરી કરીને છેવટે ભક્તિ ઉત્કૃષ્ટ બનતાં પ્રભુ ચરણે બેસી જઈ જીવનમાંથી હિંસા-આરંભ-પરિગ્રહ વગેરે પાપોને સર્વર્થા કાઢી નાખવા એ ઊંચું લક્ષ્ય છે. પછી આ પૂજા-ભક્તિમાં ધીનો દીવો વગેરે કરાય ત્યાં હિંસાનો રસ કર્યાં આવ્યો ?

પ્ર.- પણ આવા દીવા પ્રક્ષાલ વગેરે આરંભમય સાધનથી ભક્તિ ન કરતાં નિર્દોષ વસ્ત્ર અલંકારાદિથી ભક્તિ કરે તો ન ચાલે ?

ઉ.- પરંતુ એવી કિંમતી ભક્તિ કરવાની શક્તિ કેટલામાં ? એમાં તો મોટે ભોગ પૂજા-ભક્તિ વિનાનો જ રહી જાય.

પ્ર.- તો પછી માગ સ્તુતિ-સન્માન-ધ્યાન વગેરેથી જ ભક્તિ કરે તો ન ચાલે ?

ઉ.- એટલેથી જ જો પતાવે તો પછી (૧) પોતાના જ દ્રવ્ય પરથી મૂર્ચ્છા ઉતારવાનું ક્યાં રહ્યું ? તેમજ (૨) જે પ્રભુના પૈસાયે અહીંનું આટલું બધું પામ્યા, એ પ્રભુની પ્રત્યે કૃતજ્ઞતા બજાવવા ભોગ આપવાનું શી રીતે બનવાનું ? તમારે તો જ્યાં લેશ પણ હિંસા આરંભસમારંભ એમાંનું કશું ભગવાનની કે જ્ઞાનની ભક્તિ માટે થાય જ નહિ એવો સિદ્ધાંત એટલે પ્રભુના પ્રભાવે મળેલ બધું જાતની અને કુંભની જ આરતિ ઉતારવામાં કામે લગાડવાનું. મતલબ એનાથી મસ્ત થઈને રંગરાગ મોજમજા જ ઉડાડવાની અને બચેલાની મૂર્ચ્છા જમાવવાની ! ભગવાનને કશું નહિ પણ આમ કાંઈ આત્માનો ઉદ્ધાર થાય નહિ. (૩) એમ, બીજું એ પણ છે કે સંસારના વહાલા વાલેસરી સાથેના પરિચય-સંપર્ક તો સક્રિય રીતે કરતા હોય છે, એમના આવકાર કરાય છે, એમની સરભરા કરાય છે, એમને શોભાવાય છે, ત્યારે આવું બધું કરવામાં દિલમાં પ્રેમ સ્નેહ આદર વગેરે જમતા જાય છે, અને એમના સ્મરણ વારે વારે થઈ આવે છે; તો પછી પરમાત્મા પ્રત્યે પ્રેમ બહુમાન-વિનય-આદર વગેરે જમાવવા કોઈ એમનો સંપર્ક નહિ, કિયા નહિ, અને એ એમજ જાભી પડે ?

પૂજા-ભક્તિની આખી ય પ્રક્રિયા અને વિધિવિધાન તે પણ તન-મન-ધનનો ભોગ આપીને એ પ્રભુના સંપર્ક પરિચય સક્રિય રીતે સાધવા માટે છે.

એમાં એકલા ગુણગાનથી ન ચાલે, સમય અને સંપત્તિનો ભોગ આપીને વિધિ વિધાન આચરવા જ જોઈએ. એમ ત્યાં સાધારણ સ્થિતિનાં ભક્ત પણ ભોગ આપી શકે એવાં દ્રવ્યથી પૂજાભક્તિનાં વિધાન જોઈએ. પછી એમાં એમ વિચારવા ન બેસાય કે આમાં તો થોડી હિંસા આરંભ સમારંભ છે. એ હોય પરંતુ ઉદેશ એ કરવાનો નથી, પણ પૂજા-ભક્તિ કરવાનો છે, વીતરાગ પ્રભુની નિકટ આવવાનો છે, પ્રભુ પ્રત્યે મમતા વધારવાનો છે. ધ્યાનમાં રહે કે કિયાનો ઉદેશ ફરે એટલે કિયા સારીને બદલે નરસીને બદલે સારી થઈ જાય, મારકને બદલે ઉદ્વારક કે ઉદ્વારકને બદલે મારક બને. કોઈ ઓરમાન મા શોક્યના છોકરાને મારી નાખવા માટે મીઠાઈ ખૂબ ખવરાવે, વારંવાર અકરાંતિયાની જેમ ખવરાવે, ને એમ કરતાં છોકરો ધસાતો જાય, ત્યાં એ માતાએ એની ભક્તિ કરી ન કહેવાય. એમ સારો વૈદ દરદી પર ખોરાકનો ભારે અંકુશ મૂકે તો એ ભૂખે મારનાર વેરી ન ગણાય. વેરી પણ અંબું કરે, કિન્તુ એનો ઉદેશ ખોટો છે, વૈદનો ઉદેશ સારો કરી લાંબું જીવાડવાનો છે.

બસ, આ રીતે પ્રભુપૂજામાં પ્રક્ષાલ ધી દીવો, ધૂપ વગેરે કરાય એ ભક્તિને ઉદેશથી છે માટે અને હિંસાની કિયા ન ગણાય એક નાનો દાખલો જુઓ,-

માતાએ છોકરાને પીવા દૂધ આપી દીંદું, અને એટલામાં કોઈ મહેમાન આવી ચડ્યો, ત્યાં છોકરાને ઈસારો કરી એ દૂધનો કપ મહેમાનને અપાવી દે, ત્યાં અલબત હકીકતમાં હવે છોકરાને પીવા દૂધ નહિ રહે, છતાં એ કિયા છોકરાને દૂધ વિનાનો રાખવા માટેની ન કહેવાય કિન્તુ મહેમાનની ભક્તિ માટેની અને ઘરની શોભા વધારવા માટેની કહેવાય છોકરો દૂધવિનાનો રહેશે એ હકીકત હોવા છતાં કિયા એ માટે નહિ, કિન્તુ મહેમાનની ભક્તિ અને કુળની શોભા માટે ગણાય છે. બસ, એ જ રીતે પ્રભુની પૂજા ભક્તિમાં પ્રક્ષાલ ધૂપ-ધીનો દીવો વગેરેમાં થોડી હિંસા છે એ હકીકત હોવા છતાં એ કિયા. વિધાન હિંસા માટેનું નહિ, કિન્તુ અનંત ઉપકારી પરમાત્માની ભક્તિ માટેનું જ કહેવાય.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૨૦, અંક-૨૦, તા. ૨૮-૧-૧૯૭૨

સવાલ આ છે કે

દિલને રસ શેમાં છે ? દિલ ક્યાં ઠરે છે ? જાતના રંગરાગ-ભોગ વિલાસમાં ? કે પરમાત્મ-ભક્તિમાં લગાવવામાં ? ચિત્ત ક્યાં ઠરે ? ક્યાં ટાઢક અનુભવે ? બહારમાં કે અંદરમાં ?

ખાનપાન-રંગરાગમાં રસ એ બહારમાં ઠરવાનું ગણાય, અને ભક્તિ-ત્યાગ-તપમાં ઠરવાનું થાય એ અંદરની વસ્તુમાં ઠરવાનું ગણાય.

જગતમાં નિમિત્તો કેઈ પ્રકારના મળવાના, એમાં રાગ-દ્વેષ દીનતા-અભિમાન વગેરે કલુષિત ભાવોથી બચવું છે, તો અનો એક ઉપાય આ છે કે બહારનું બહું જોવા જાણવાનો રસ પડતો મૂકો, ડાફોળિયાં મારવાનું બંધ કરો. અના રસમાં તો પછી કદાચ નિમિત્ત કોઈક સારું પણ આવી જાય છતાં જીવનો બહારમાં ભટકવાનો રસ અને બહારમાં ફરવાનો સ્વભાવ જીવને બહારની નરસી વૃત્તિમાં લઈ જવાનો સંભવ રહેશે. પીઠ અને મહાપીઠ મુનિઓ એમ તણાઈગયા બાહુ-સુબાહુ મુનિઓની શુરૂઆતે પ્રશંસા થતી સાંભળી અનુમોદના ન કરતા ઈર્ઘ્યમાં ચંડ્યા. સુંદર શાસ્ત્ર સ્વાધ્યાયમાંથી બહાર ડાફોળિયું મારવા જતાં બહારનો રસ બહારમાં સ્વભાવ પોષાય છે. પછી એ રસ એ સ્વભાવ અનુમોદનાને બદલે ઈર્ઘ્ય કરાવે એ સ્વાભાવિક છે.

નિમિત્તોમાં રાગ-દ્વેષાદિથી બચવા વૈરાગ્ય, જિન-વચનનાં ખૂબ ગુણગાન એ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો”(ભાગ-૪૪) ૧૮૭

બે ઉપાયની જેમ ત્રીજો ઉપાય આ, કે બહારનો રસ અને મઝિતિયું જોવા જાણવાની આતુરતા ઓછી કરો; જેથી બહારમાં ચિત્ત જાય નહિ, ને નિમિત્ત અસર કરવા ન પામે.

(૪) નિમિત્તોમાં રાગાદિથી બચવા ચોથો ઉપાય, આ કે જીવનમાં જરૂરિયાતો ઓછી કરો.

જરૂરિયાત જેટલી વધારે એટલા પ્રમાણમાં નિમિત્તો અસર કરી જાય છે. બહું જરૂરિયાતો એટલે બહુંની ગરજ કરવી પડે. એ કરવામાં નિમિત્તો તો આવ્યા જ કરતા હોય છે, તેથી એ જીવને રાગ દ્વેષ હર્ષ-ઉદ્દેગ વગેરે મહિન ભાવોમાં તાણી જાય છે. માટે.

આદર્શ ગૃહસ્થજીવન આ, કે જીવન જરૂરિયાત બહું ઓછી.

કદાચ પ્રભળ પુષ્યનો યોગ હોય એટલે મળી તો ઘણું જાય પરંતુ પોતાના મનથી અને બહું જરૂરી ન ગણે. તો જ એ તેવા નિમિત્ત ઊભા થતાં આકુળ વ્યાકુળ નહિ થાય. દા.ત. પુષ્યશાળી ઘરના વડીલની સારી સરભરા થતી હોય, પણ જો પોતાના મનથી એ બધું પોતાને જરૂરી ગણ્યા કરે, તો એમાં ખામી પડતાં આકુળ વ્યાકુળ થશે. દા.ત. સૂવાની ગાદી આવી સારી ઊંચી અને સફાઈદાર જ જોઈએ.’ એવું વડીલે પોતે માન્યા પછી ક્યારેક જો નોકરે કે ઘરના માણસે એમાં ગફલત કરી નાખી તો વડીલના મનમાં સંતાપ ઊભો થશે.

આ સંતાપ જેવી તેવી ગાદીના લીધે નથી હોય; એ તો પોતે માનેલી વધુ પડતી જરૂરિયાતના લીધે છે.

જો વડીલે પોતાના મનથી એ બહું જરૂરી ન માન્યું હોય તે એમાં ખામી પડતાં આકુળવ્યાકુળ ન થાત, સમજત કે મારે ક્યાં એ જરૂરી હતું જ ? મારે તો ગમે તેવું ચાલે. અવસરે મળતું તો બધું ય હોય, પણ જો પોતાનું મન કબજ્જામાં હોય અને માને કે આ સારુ શું કે સામાન્ય શું આપણો તો ગમે તે ચાલે, તો પછી સારાને બદલે સામાન્ય આવી જતાં ખેદ સંતાપ શા સારું થાય ? જગતની વચ્ચેનું જીવન છે, એટલે અવરનવર કેવાં ય નિમિત્તો તો આવ્યા જ કરવાનાં, ત્યાં રાગાદિ કલુષિત ભાવોથી એ જ બચી શકે કે જેને જરૂરિયાતો ઓછી હોય. જરૂરિયાતો વધારવામાં લુંટાવાનું છે.

વિજ્ઞાને જરૂરિયાતો વધારી પાપ ને દુઃખ વધાર્યા :-

આજે સાવધાન રહેવા જેવું છે. વિજ્ઞાની શોધોએ સગવડો બહું ઊભી કરી નાખી તેથી માણસને મન જરૂરિયાતો વધી ગઈ. એથી પાપ અને દુઃખ બંને વધ્યા. હવે એવાં નિમિત્તોમાં રાગાદિથી શી રીતે બચી શકે ? તમારા વડવાઓનાં જીવન ૧૮૮ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“વિવિધ નિમિત્તોમાં રાગાદિ...”(ભાગ-૪૪)

કરતાં આજનાં તમારા જીવન પરથી આ માપી શકો છો ને કે વડવાઓને કેટલી જીવને જરૂરિયાતો હતી ? ને તમારે કેટલીક છે ? સુખી કોણ ? એ કે તમે ? જીવનમાં હાલતાં ને ચાલતાં તેવા તેવા નિમિત્ત ઊભાં થયે, ચિંતા-સંતાપ-વ્યાકુળતા એમને વધારે કે તમારે ? તમારે વધું થવાનું કારણ શું ? આજ કે આજની વૈજ્ઞાનિક સગવડો દેખીને મનથી જરૂરિયાતો વધારી દીધી.

તો બોલો વિજ્ઞાને શું આયું ? સુખ-શાન્તિ કે સંતાપ-વ્યાકુળતા ? સગવડો વધારી વધારીને જીવોને જરૂરિયાતો વધારી દીધી, પછી કેમ ? તો કે હવે એની પાછળ નિમિત્તો વશ જિંદગી સુધી ચિંતા-સંતાપ-વ્યાકુળતામાં સળગ્યા કરો....

પૂર્વ મહર્ષિઓ અભૂત નહોતા, ઘણી-બધી વિદ્યાઓ જાણતા હતા છતાં એને જગતના ચોરામાં બુલ્લી ન કરી કેમકે, એથી જીવની જરૂરિયાતો વધી જતાં શાંતિનું જીવન અલોપ, અને સંતાપીને શેકામણ ઘણી; એવું એ જાણતા હતા. કોર્ટ-કચેરી રગડા-ઝગડા હોંસોતોસી વગેરે આજે વધી ગયું શાના પર ? વિજ્ઞાને વધારી આપેલી સગવડોના લીધે. જીવન-જરૂરિયાતો વધારી દીધી એના પરસ્તો. તો સરવાળે સંતાપ-વ્યાકુળતા-રગડાઝગડા વધારી આપનાનું વિજ્ઞાન શ્રાપણુપ ગણાય ? કે આશીર્વાદ રૂપ ? ડાદ્યા થઈને વિજ્ઞાના ગુણ ગાતા નહિ.

બસ, નિમિત્તો વચ્ચે રાગાદિ મહિન ભાવોથી બચવા આ ઉપાય છે કે જરૂરિયાતો ઓછી કરી નાખો.

જીવનમાં જરૂરિયાતો બહુ ઓછી હોવી એ એક વરદાન છે. વરદાનમાં ન ધારેલું મળે, એમ આમાં ન ધારેલ સિદ્ધિ થાય છે. સુખનો ઠગલો મળે છે. બહુ જરૂરિયાતવાળાને કદાચ પુણ્ય યોગે બહુ મળી જાય, તો પણ સંતોષ નહિ. હજી બીજું જરૂરી બાકી લાગે છે. અને તે બધું તો મળતું નથી તેથી સંતાપ અનુભવે છે. ત્યારે બહુ ઓછી જરૂરિયાતવાળાને પુણ્ય વધું આપી દે, તો પણ એમાં એને રસ નથી, એટલે એનાથી સુકૃતો સાધી લેવા તરફ લક્ષ જાય છે. જાતને જ જરૂરિયાતો ઘણી હોય એ શું સુકૃત સાધવા જાય ?

આજી જરૂરિયાત એ સુકૃત આડે શ્રાપણુપ છે.

આજે એવાં ઘણા શ્રીમંતો છે કે જે પોતાને મળેલાના પ્રમાણમાં સુકૃત નથી સાધી શકતા કેમકે જાતને જરૂરિયાત મોટી. લાખવાળાને લાગે છે કે પાંચ લાખ જરૂરી છે. ને પાંચલાખ વાળાને લાગે છે કે ૧૫-૨૦ લાખ જરૂરી છે. ત્યારે એટલા વાળાને એથી વધારે અને વધારેવાળાને એથી ય વધારે જરૂરી લાગે છે. આ પોતાને જ બહુ પ્રમાણમાં જરૂરી લાગતું હોય એ શી રીતે સુકૃતમાં ખરચી શકે. એમને તો જરૂરી મેળવવા મથવું, એ જ કામ, પછી દાન, ધર્મ ક્યાંથી

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૧૮૮

લાવે ? કદાચ ક્યારેક દાન સુકૃત કરે તો ય એ કેટલું ? પોતાની પાસે હોય એમાંથી કોઠારમાંથી કડછી જેટલું.

જ્યાં એમ લાગી ગયું કે મારે મોભા પ્રમાણે આટલું જોઈએ અથવા લાગ્યું કે આજે સારી સુખ-સગવડો મળે છે. તો અગવડ શા માટે ભોગવવી ? તો પછી જરૂરિયાતોનો ઢેર થાય છે. ચિત્ત વિશેષ રૂપે જડ જરૂરિયાત-સગવડ-અનુકૂળતા વગેરેમાં જાય છે, એથી આર્તધ્યાન, નિમિત્તો મળતાં રાગ યા દ્વેષ યા બેદ, અને જરૂરી માનેલા અંગે પછી કોધ-અભિમાન-માયા, લોભ-મમતા-આસક્તિ વગેરે કખાયો સુલભ બને છે.

ચિત્તમાં જડની બહુ જરૂરિયાતો એક એવા રોગ છે કે ત્યાં ધર્મ કરતી વખતે પણ સાધ્ય ચૂકી સાધન-સગવડના વિચાર બહુ રહે છે. ત્યારે દુન્યવી જીવનમાં તો સાધ્ય પરમાત્મા અને પ્રભુની આજ્ઞા શો યાદ આવે ?

તપાસી જોજો આ અનુભવ છે કે નહિ ? ચિત્ત જ બહુ જરૂરિયાતવાળું, એટલે ધર્મ કરતાં ય શાન્તિ નથી રહેતી. દા.ત. દેવદર્શન કરવા ગયો તો પહેલું એ જોયા કરશે કે બહુ ભીડ નથી ને ? કોઈ દર્શનની આડે નથી આવતું ને ? લાઈટનો ઝગારો છે ને ? પ્રભુની આંગી આભૂષણ નથી ઉતરી ગયા ને ?....આવું તો બીજું કેટલું ય.

‘અટ્યા પણ આવું આવું જ જોયા કરીશ તો પછી ભગવાનમાં ચિત્ત ક્યારે લઈ જઈશ ? આ શું જોયા કરે છે કે કોઈ આડે નથી ઊભું રહેતું ને ? એના બદલે એ જો ને કે એકવાર સહેજ પણ દર્શન મળી ગયાં, તો પછી એની સાથે જ ચિત્ત હવે પ્રભુમાં, પ્રભુના ગુણોમાં, પ્રભુના ઉપકારોમાં, પ્રભુની આજ્ઞામાં લાગી ગયું ને ? સાધનામાંથી તરત સાધ્યમાં જા, સાધનમાંજ શું બહુ ભટક્યા કરે ?’

આવું એને કોણ કહે ? કોણ સાવધાન કર્યા કરે ?

પ્રભુદર્શનમાં શું વિચારવું ? :- પ્રભુદર્શનમાં કોઈ આડે ન આવે અને દર્શન થાય એ સાધન છે, પણ એ દર્શનનું સાધ્ય છે પરમાત્માની વિચારણા; જેવી કે પ્રભુએ પરમાત્મા બનવા કેવી કેવી ઘોર તપસ્યા ઉગ્ર ચારિત્ર પાણ્યા ? નિર્વસ્ત્ર શરીરે ટાઢ-મચ્છર-માખી વગેરેના અને બીજા કેવા કેવા પરિસહે તથા ઉપસર્ગો સહન કર્યા ? પ્રભુમાં કયા કયા ૧૮ દોષો નહિ ? પ્રભુને જનમથી માંડીને દેવો દીદ્રોએ કેવા સન્માન્યા ? એ બધાંમાં ય પ્રભુ કેવા અતિશય વિરાગી-અનાસક્ત અને નિરપેક્ષ હતા ? પ્રભુએ સાચાં તત્ત્વ, સાચો મોકાબાર્ગ, સાચું આત્મ-સ્વરૂપ વગેરે બતાવવાનો કેવો અનન્ય ઉપકાર કર્યો ? દર્શન-પૂજન-સ્તુતિ-સ્મરણ વગેરેમાં ઉત્કૃષ્ટ આલંબન બનવાનો પણ પ્રભુનો કેવો અને કેટલો બધો ઉપકાર ?’

૧૯૦ ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-“વિવિધ નિમિત્તોમાં રાગાદિ...” (ભાગ-૪૪)

જરૂરિયાતોમાં જ બહુ ફરે, એ સાધ્ય શું સાધે ? :-

આવી આવી વિચારણા ચાલે એ પ્રભુમાં ચિત્ત લાગ્યું કહેવાય. પરમાત્મામાં ચિત્ત એ સાધ્ય છે, લક્ષ્ય છે. પણ ચિત્ત એમાં રહેવાને બદલે એમાં રમવાને બદલે બાધ્ય સાધનોમાં જ ફર્યા કરે, બાધ્ય જરૂરિયાતોમાં જ કર્યા કરે, એ ટેવદર્શનનાં ધર્મ કરવા છતાં શું પામે ? ત્યારે હુન્યવી જીવનમાં પણ ચિત્તને જરૂરી ઘણું લગાડી રાગ્યું હોય, ત્યાં માનવજીવનનાં ઊચા લક્ષનો વિચાર તો રહે જ શાનો ? એને તો ત્યાં શું કે ધર્મમાં શું બહુ જરૂરિયાતોના પાપે તેવાં તેવાં નિમિત્ત મળતાં રાગ-દ્રેષ્ટ-હર્ષ-શોક વગેરે સુલભ બને છે. પછી ત્યાં એ લક્ષમાં જ શાનું આવે કે હું આ રાગાદિ કરવામાં આ જીવનનું ઊંચું લક્ષ્ય રાગ-દ્રેષ્ટાદિનો શક્ય નિગ્રહ ‘મનનું પદ પદ પર નિર્મળી કરણ’ વગેરે ભૂલી જાઉં છું ? એ તો જરૂરિયાતો જ ઓછી હોય તો નિમિત્તો મળતાં ચિત્ત એના પર વિચાર જ નહિ કરે જેથી રાગાદિ જાગે નહિ, જીવન લક્ષ્ય સચવાય.

બહુ જરૂરિયાતોનું માનસભવનું ઉચ્ચ લક્ષ્ય ભૂલાવી દે છે.

માટે હુન્યવી જીવનમાં તો ખરું જ, પણ ધર્મ સાધનામાં પણ ખોટી જરૂરિયાતો ન રાખો. દા.ત. ભગવાનની પૂજા કરવા જાઓ ત્યાં પણ એવું ન રાખે કે મારે અમુક જ ભગવાન પૂજામાં જરૂરી કેમકે એમ જરૂરી માનવા જતાં, નથી ને કોઈએ વહેલા જઈ એ જ ભગવાનને પૂજનમાં લીધા, તો એ જોઈને મનમાં કષાય થશે, જેદ થશે પણ ‘ના, મારે તે ગમે તે અરિહંત ભગવાન ચાલે આ હિસાબ હોય તો તેવાં નિમિત્તમાં દુષ્ટ ભાવથી બચાય.

એમ વ્યાખ્યાન શ્રવણમાં પણ બેસવાની અમુક જ જગા જોઈએ, પ્રતિકમણમાં પણ અમુક જ જગા જોઈએ, એવી જરૂરિયાતો નહિ રાખવાની. નહિતર નિમિત્ત મળતાં રાગ-દ્રેષ્ટ-સુલભ થવાના. એના બદલે ના, મારે પ્રભુની વાણી કાન પર લેવી છે, ને હૃદયમાં ઉતારવી છે; તે ગમે ત્યાંથી સાંભળી શકાય એવી જગા ચાલે, પ્રતિકમણમાં મારે પાપોના પશ્ચાત્તાપ કરવા છે. એ માટે ગમે તે બેસવાની જગા જોઈએ.’ આટલું જ લક્ષ રખાય.

સામાન્ય એટલે ઓછું ભણેલા પણ મુનિઓ કામ કાઢી ગયા તે આ અતિ અથવા જરૂરિયાતો પર કેમકે

બહુ જરૂરિયાતો નહિ એટલે લાભ એ, કે એ નિમિત્તના કષાયો નહિ; ઉપશમભાવ સતત ચાલુ; અને એ જ મોક્ષને સુલભ બનાવે છે.

ત્યારે બહુ ભણેલો હોય, પણ જો બહુ જરૂરિયાતો રાખી હશે તો એ નિમિત્તના કષાય સુલભ, તેથી ઉપશમભાવ દુર્લભ, અને મોક્ષ પણ દુર્લભ.

સાંસારિક જીવનમાં પણ આ બહુ ધ્યાન રાખવાનું છે, કે મનને બહુ વસ્તુઓ જરૂરી ન લાગે. મને માન મળવું જ જોઈએ. મારું બધાએ માનવું જ જોઈએ. મારે અમુક અમુક સગવડો જોઈએ જ,’ આઠ કલાક આરામ જોઈએ જ,’..... વગેરે વગેરે જરૂરિયાતો રાખવામાં ક્યાંક ને ક્યાંક નિમિત્ત મળતાં મનમાં કષાય ભભૂકી ઉઠે છે; અતિમાન કોટે લાગ્યું રહે છે, દીનતા દિલમાં રમે છે. આ આગોમાં ઉપશમભાવ ક્યાંથી લાગે ?

એટલે જ આ વાત છે કે નિમિત્તો તો મળ્યા જ કરવાનાં. એ વખતે રાગાદિ દુષ્ટ ભાવોથી બચવું હોય, ઉપશમભાવ સાચવવો હોય, તો પહેલેથી જરૂરિયાતો જ ઘટાડી નાખો.

(પ) પાંચમો ઉપાય આ કે શુભ ભાવો અને શુભ વિચારોની જરૂરિયાત વધારો. તો જ નિમિત્તોમાં રાગાદિથી બચાય.

જરૂરિયાત વધારવાની એટલે મનને એમ લાગ્યા કરે કે મારે આની બહુ જરૂર છે, આના વિના મારે ન ચાલે.’ આવું શુભ ભાવો. અને સારા વિચારો વિચારસરણી માટે લાગે. મનથી એની ખૂબ જરૂર લાગતી હોય એટલે સ્વાભાવિક છે કે એવાં એવાં નિમિત્ત આવી પડતા શુભ ભાવ શુભ વિચારોને બહુ જરૂરી માનતું મન ખાસ કરીને શુભ ભાવ શુભ વિચાર કરવા લાગશે અને એથી રાગદ્રેષ્ટ ઈર્ધ્યા-મદ-દીનતા વગેરે મલિન ભાવથી બચી જશે.

ત્યારે આ વિચારવા જેવું છે કે

શું આપણાં મનને આ શુભ ભાવો શુભ વિચારો બહુ જરૂરી લાગ્યા છે ?

‘જરૂરી લાગવું એટલે શું એ તો સમજો જ છો ને ? કે જ્યાં મનને એમ થાય કે આવા વિના ન ચાલે, આ તો જોઈએ જ આ કેમ રહી ગયું ? ઊઠી લાવવા દે, લઈ આવવા દે અને. આજે શરીરના દૂલ્ખણાને દવાઓની બહુ જરૂર લાગે છે તો ખીસામાં કે પાકિટમાં ગોળીઓની સીસીઓ ડબાઓ સાથે લઈ ફરે છે. થોડું થાય ને નાખ એક ગોલી મોંમાં, થોડું થાય ને નાખ વળી બીજી સીસીમાંથી એક ગોળી મોંમાં એમ ચાલ્યા કરે છે. એ ભૂલાતું જ નથી; કેમકે જરૂરી લાગ્યું છે. સારો વિદ્યાર્થી ભણેલું વારંવાર યાદ કરવું જરૂરી માને છે તો ચાહી ચાહીને એ મનમાં ફેરબ્યા જ કરે છે, રટણ કર્યા જ કરે છે. બીજું યાદ કરવાનું હજુ કદાચ ભૂલશે પણ આ નહિ ભૂલે.

શુભ ભાવ જરૂરી લાગ્યાનાં લક્ષણ :-

બસ, આ રીતે આપણા મનને શુભ ભાવો અને સારા વિચારો જરૂરી લાગવા જરૂરી જોઈએ. એમ થવું જોઈએ કે બીજા વિના ચાલે, પણ આના વિના

ન ચાલે. આ શુભ ભાવો શુભ વિચારો તો મનમાં વારે વારે લાવવા જ જોઈએ. ક્યાંક મનમાં ભાવ ખરાબ આવ્યા યા વિચાર પાપના ચાલ્યા તો ઝટ ખટકો થાય કે ‘અરે ? આ હું ક્યાં ચાલ્યો ? કેમ શુભ ભાવ રાખવા રહી ગયા ? કેમ શુભ વિચાર ભૂલ્યો ? લાવ લાવ, એને ઉભા કરવા દે.’ સારા વિદ્યાર્થીને ભાણેલાની વારે વારે રટણાની જેમ શુભ ભાવો ને શુભ વિચારોની રટણા રથા કરે, તો મનાય કે મનને એ જરૂરી લાગ્યા છે.

અનોપભાઈ શ્રાવક :-

ભરુચમાં અનોપભાઈ શ્રાવક આવા એક આગેવાન શ્રાવક હતા, શુભ ભાવના ખપી. એમને ત્યાં લગ્નનો પ્રસંગ આવ્યો એમાં નાત જમાડવાનું નક્કી કર્યું હતું. પછી નાતના એક બીજા ભાઈને ત્યાં લગ્ન પ્રસંગના હિસાબે એ ભાઈને નાત જમાડવાનો વિચાર થયો. પરંતુ એને નાત અનોપભાઈના કરતાં પહેલી જમાડવી હતી, પણ પેલી નાત તો નક્કી થઈ ગયેલી તે હવે કેમ ફરે ? ન્યાયસર કાંઈ બને એવું નહોતું એટલે એ ભાઈએ અનોપભાઈની વિરુદ્ધ ગમે તેમ વાતો કરવા માંડી, બખાળા કાઢવા માંડ્યા, અનોપભાઈ મોટા શેઠ એટલે શું થઈ ગયું ? શું અમે નાતમાં નથી ? અમારો શું હક નથી ? નાત મારી પહેલી જમશે...’

અનોપભાઈની ઉદારતા :-

દાચા માણસો સમજે છે કે આનો ખોટો ધમ-ધમાટ છે. પરંતુ એની સાથે કોણ લડવા જાય ? એમાં થોડું એમ ચાલ્યા પછી અનોપભાઈના કાન પર આ વાત આવી. આ તો શુભ ભાવના ખપી, ને શુભ વિચારની જરૂરતવાળા શ્રાવક; અને જરૂર એટલે તો સમજો જ છો ને કે જેની જરૂર એ પ્રસંગ પર તો ખાસ સાધી લેવાય ? અનોપભાઈ અહીં શુભ ભાવ શુભ વિચારને શું કામ ચૂકે ? મારે આની જરૂર છે. તો આમાંથી એ જ મેળવી લઉં,- આ જ હિસાબવાળા એ શ્રાવક એટલે એમણે દિલમાં પેલા આડા માણસ માટે જરાય કોધ કે દેખનો મહિન ભાવ ઘાલ્યો નહિ. એમણે તો મૈત્રીભાવ ઉદારતાનો જ ભાવ ચ્યમકાવ્યો. મનને એમ થયું કે હોય, એ પણ આપણો ભાઈ જ છે, તો એને નાત જમાડવાની હોંશ હોય તો ભલે એને પહેલો ચાન્સ મળે. સ્થિતિએ મોટો શ્રીમંત નથી, છતાં એને નાત જમાડવાના કોડ થાય છે, તો એના કોડ પહેલાં પૂરાં થવા જોઈએ. એમણે કેરી અભિમાનના ઘરના તુચ્છ વિચાર કર્યા નહિ કે જમાડ્યું ? એ શું પહેલાં જમાડતો હતો ? જાગવું મોડું છે, ને પહેલાં જમાડવું છે ! ભલે ને મારી વિરુદ્ધ લવારા કરતો એનું જરાય ચાલવા ન દઉં. બહુ ગરબાડ કરશે તો ઉખડી જશે.’ ના, આવો કોઈ વિચાર નહિ. એ અભિમાનના વિચાર છે તુચ્છતાના અશુભ વિચારે છે, ને અનુપભાઈને એની

જરૂર નથી એમને તો શુભ વિચારની જરૂર છે. તેથી સામાની આડાઈ કે પોતાની વિરુદ્ધ બખાળાને મહત્વ જ ન આપ્યું, કશી સ્વમાનહાનિ માની નહિ,

પણ સામાને એક કોહિલા જીવ તરીકે ન્યાય આયો, હોય એ પણ જીવ છે, એને ય કોડ થાય આપણે એના કોડ પૂરા કરવાના.’

મૈત્રી ક્ષમા આદિ શુભ ભાવની અને સ્વાર્થના નહિ પણ પરાર્થના શુભ વિચારની જ એમને જરૂર લાગેલી છે, તેથી પ્રસંગ મળતાં એ શુ કામ ચૂકે ? અનોપભાઈ તરત બીજી સવારે ઉઠીને દેવદર્શન કરવા નીકળ્યા ત્યારે પેલા ભાઈના ઘરે પહોંચ્યા. પેલો ક્ષણ ભર તો હેબતાઈ જ ગયો કે હું જેની વિરુદ્ધ બોલું છું એ મોટા શેઠ મારા ઘરે ચાલીને આવે છે ?’ એ સફાળો ઉભો થઈ ગયો, શેઠને આવકાર્ય પધારો શેઠ પધારો. ઘરમાં લાવીને બેસાડ્યા ગાદી પર.

પૂછે છે ‘મને આપને ત્યાં બોલાવી લેવાને બદલે આપ આટલે પધાર્યા ?

‘હા મારે કામ હોય એટલે તો મારે જ આવવું જોઈએ ને ?’

‘તો ય શું ? આપ મોટા માણસ આપના કામ માટે પણ અમને નાનાને ઘરે બોલાવી શકો છો. ફરમાવો મારા લાયક સેવા ?

અનોપભાઈ કહે, કાલે મારા સાંભળવામાં આવ્યું કે આપને ત્યાં લગ્ન પ્રસંગ આવે છે, ને આપને નાત જમાડવાની છે.’

આ ભાઈ કહે, ‘હાજ શેઠ ! વાત સાચી છે.’

અનોપભાઈ કહે છે, ‘તો જુઓ, અમારે ત્યાં પણ પ્રસંગ નક્કી થઈ ગયેલો છે. છતાં તમારી નાત પહેલી જમશે, ને અમારી પછી આટલું નક્કી કરાવવા આવ્યો છું. તમારો બાબો-બેબી એ મારા જ છે, એટલે એની શોભા એ મારી જ શોભા છે. એમાં કશો સંકોચ રાખશો નહિ કે અનોપચંદનું પહેલું નક્કી થયેલું કેમ ફરે ? અનોપચંદ પોતે આ બચ્યાને પણ પોતાનાં જ માનીને જમણ ફેરવે છે એટલે ફરે. માટે જુઓ હોં તમારે ત્યાં નાત પહેલી જમશે.’

આ સાંભળીને એ ભાઈ ક્યાં ઉભા રહે ? અનોપચંદ શેઠની આ ઉદારતા અને તે પણ પોતાના ઘરે સામેથી ચાલી આવીને કરાતી જોઈને એની આંખમાં ઝળજળિયાં આવી ગયા. પોતે આવા ઉદાર શેઠની વિરુદ્ધ કાઢેલા બખાળા માટે ભારે પસ્તાવો થયો, આંખમાં પાણી સાથે હાથ જોડીને કહે છે.-

‘શેઠ ! માફ કરજો મને આપને મેં પહેલાં ઓળખ્યા નહિ; ને બહાર ગમે તે બોલ્યે રાખ્યું. જમણ આપનું જ પહેલું રહે આપે પહેલું નોંધાવેલું, એટલે આપ હક્કાર છો, ને એમાં હું ખુશી છું.’ દુર્જનનાં હૃદય પરિવર્તન થાય ? થાય.

સજજના બોલ અને વર્તાવ એ એવી મૈત્રી એવા સ્નેહભાવ અને એવી

ઉદારતાભર્યા હોય છે કે સામાનાં દિલને પીગાળી નાખે.’

એવા સજજન બનવું હોય તો શુભ ભાવો અને શુભ ભાવનાઓનો બહુ ખપ રાખવો જોઈએ, એની બહુ જરૂર રહેવી જોઈએ, એનો બહુ ખપ અને જરૂર એટલે શું, એ સમજો છો ને ? જીવનમાં સારી મનમાની સુખ-સગવડો, પૈસાટકા, માન-સન્માન ઊંચા ખાનપાન વગેરેની જેટલી જરૂર નહિ એટલી શુભ ભાવ અને શુભ ભાવનાની ખાસ જરૂર લાગે. જીવનમાં ઓછું વધતું તો મજા કરે, અનુકૂળ-પ્રતિકૂળ તો આવ્યા જ કરે, પરંતુ મુખ્ય લક્ષ આ હોય કે મારે ખાસ ખપ શાનો છે ? દુષ્ટ રાગ-દ્રેષ્ટિભાવો ટાળીને વૈરાગ્ય જિનભક્તિ-ક્ષમા-મૈત્રી વગેરે શુભ ભાવ રાખ્યા કરવાનો એ માટે શુભ ભાવનાઓમાં રમતા રહેવાનો. તો પછી જો આનો ખાસ ખપ હોય, આ જો ખાસ જરૂરી લાગતા હોય, તો એનું મુખ્ય ધ્યાન રાખું. બહારનું તો ભાગ્યાધીન છે. ત્યાં દિલના ભાવ બગાડવાથી બહારનું સુધરી જવાનું નથી, કે સારું મળી જવાનું નથી. એ તો ભાગ્યને અનુસારે બનવાનું છે. માટે ભાવ શા સારું બગાંહું ?

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૨૦, અંક-૨૧, તા. ૫-૨-૧૯૭૨

પ્રતિકૂળ આવી પડે ત્યાં શુભ ભાવને ટકાવવા માટે શુભ ભાવના ભાવવી જોઈએ એમાં શું કરવાનું ? ચાર શરણ લેવાં, દુષ્કૃતગર્હ કરવી સુકૃત-અમુમોદના કરવી મૈત્રી આદિ ૪ ભાવના વારંવાર ચિંતવાિ, અનિત્યાદિ ૧૨ ભાવના ભાવવી, મહાપુરુષોના જીવન વિચારવા, તીર્થયાત્રાઓનું સ્મરણ કરવું. ઉપદેશમાળા વગેરે શાસ્ત્ર વિચારવા એમ ધ્યાં કરવાનું આવે.

(૧) પહેલું તો અરિહંતાદિ ચારના શરણ સ્વીકારવા ‘પ્રભુ ! હું અભૂત છું. મારે તમારું શરણ છે. સિદ્ધોનું શરણ છે, સાધુનું શરણ છે, સર્વજ્ઞકથિત ધર્મનું શરણ છે,’ આ શરણ સ્વીકારી દુષ્કૃતગર્હ અને સુકૃત-અનુમોદના કરવાની.

શ્રી પંચસૂત્ર શાસ્ત્ર કહે છે, ‘આ ગ્રણેય વસ્તુ ત્રિકાળ કરવી જોઈએ, અને વધારામાં ચિત્તમાં જ્યારે જ્યારે કાંઈ રાગ-દ્રેષ્ટ-કોઘાદિ કષાયોના સંકલેશ થઈ આવે. અર્થાત એની વધુ પડતી લાગણીઓ થઈ આવે ત્યારે ત્યારે આ વારંવાર કરવી જોઈએ, આજના આપણા સત્ત્વહીન મનમાં એવા રાગના કે દ્રેષ્ટ-અરુચિના ઉછાળાનું પૂછવું જ શું ? જરાક શી ઉદ્ભૂત વેશ અને અંગોપાંગનું પ્રદર્શન કરનારી બાઈ દાણિમાં આવી ત્યાં કામના ઘરની મોહની લાગણી ઉપસી આવવામાં વાર શી ? સત્ત્વ નહિ, એટલે મહિનતા કોણ રોકે ?

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ-કષાય રોકો : દૂષ્ટવાનો મોકો” (ભાગ-૪૪) ૧૯૫

સત્ત્વહીન મનમાં મામૂલી નિમિત મળતાં રાગ દ્વેષ કામ વગેરે મેલી વૃત્તિ ઝટ ઝબકી પડે છે.

(૬) નિમિતોમાં રાગાદિથી બચવા આ એક ઉપાય કે સત્ત્વ કેળવો.

મન સાત્ત્વિક હોય તો મામૂલી પ્રસંગમાં ઝટ રાગાદિ વશ નહિ બને. એ તો ઝટ તુલનાથી જોશે કે જગતમાં મહાન આત્માઓને જે સમૃદ્ધિઓ મળી હતી. સન્માન મજ્યાં હતાં, સત્તા મળી હતી, એની આગળ આ મને મળતું શી વિસતામાં છે ? એમણે એટલા ઊંચા લાભોમાં પણ રાગાંધ, મોહમૂઢ કે અભિમાની થવાનું નથી કર્યું, તો મારે મામૂલી લાભોમાં ધેલામેલા ને ગર્વિષ શું થવું ? એમ મહાપુરુષોને આપત્તિઓ પણ ભારે આવી અરે ! સ્વેચ્છાએ વહોરી પણ લીધી; રામ-લક્ષ્મણ-સીતાએ રાજશાહી સુખો સ્વેચ્છાથી છોડી વનવાસ સ્વીકારી લીધો. વનમાં ક્યાં વૈભવ-સગવડ-સામગ્રીના છલબલિયાં હોય ? પહેર્યે લૂગડે ભટકવાનું અને કોઈના ધરે જમવાનું છતાં એમણે દુઃખ-હાયવોય-ચિંતા નથી કરી તો મારે એવી તે કઈ આપત્તિ છે કે હું રોવા બેસું ? એવો કયો જુદ્ધ છે, કે મનમાં દ્રેષ્ટ-ઉદ્ભેગ-નિરાશા-નીસાસાના કયરા ધાલું ?’ આમ તુલનાથી જોતા વિચરતાં મનમાં સત્ત્વ આવે.

(૨) શુભ ભાવના તુલનાની :-

ત્યારે આ પણ એક શુભ ભાવના છે કે તુલનાથી પૂર્વ પુરુષોની સંપત્તિ વિપત્તિઓ યા સમકિતી દેવતાઓ અને નરકના સમકિતી જીવોની સંપદ્દ-વિપદ્દ જોઈ ભાવવું વિચારવું કે ‘મારે આમાનું કશું નથી પછી શા ઉન્માદ કે શા ઉકળાટ કરવા ?’

જગતના જીવનમાં ઊંચુનીયુ આવો, પણ મન ઊંચુનીયુ ન બનો.

મન ઊંચુનીયુ ન થાય એ સત્ત્વ. સત્ત્વથી ચિંતાઓ. કષાયો અટકે.

જીવનમાં સત્ત્વની કિમત છે. લાખો રૂપિયાના ઢેર પાસે હોય પણ સત્ત્વ નહિ હોય, તો કેઈ ચિત્ત-ભય-શંકા તથા મદ-અભિમાન-પ્રપંચ વગેરે કષાયો મનને એવા કોરી ખાશે, એવા એ વારે વારે સળગતા રહેશે કે જીવને જ્ય જ નહિ પડવા દે. ત્યાં સત્ત્વ હોય તો જ એવી ખોટી ચિંતાઓ, ખોટા ભય, ખોટી શંકાઓથી બચાય.

સત્ત્વ કેમ ચલાયમાન થાય છે ? દુનિયાના તુચ્છ પણ માન-સન્માનને તુચ્છ પણ સુખ-સગવડ ખૂબ ગમે છે, તેથી જરાક કોઈએ મોટાભાઈ !’ કહીને બોલાવ્યા એટલે કુલાશજી ફૂલાઈ ગયા, પછી ભલેને પેલો કશું કામ કઠાવી લેવા જ કે ઠગવા જ કહેતો હોય ! ‘અલ્યા ! આટલામાં શું ફૂલાવુ ? ભગવાનને જગત સન્માનતું હતું છતાં એમને લેશ અનો ગર્વ નહોતો. અહીં કશું તને મોટા જગતે સન્માન આપ્યું ? કે કયો આખા ગામે તને સન્માયો ?’ ના, પણ તુચ્છ સન્માન પર પણ

૧૯૬

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“સત્ત્વ કેળવા” (ભાગ-૪૪)

அதિ રાગ છે, એની ય લંપટા છે, તેથી તો ચાહીને બીજા પાસેથી પોતાના માટે બે સારા શબ્દ ઉભા કરે છે. એ કરવા માટે સામાની આગળ કોઈની નિંદા કરવા કોઈનું ધસાતું બોલવા કોઈનું કાપવા, સામાને ગમતાની ખોટી પ્રશંસા કરવા કે તુચ્છ જાતબડાઈ હાંકવા જીબડી ફર્યા જ કરે છે.

નિંદા-ચુગલી-આળ-આરોપ-આપબડાઈ આ બધા ગલીય પાપો છે, હૈયાને કાળુભેશ કરનારા છે. હજુ ય હુરાચાર કરનારને મનમાં લાગશે કે આ હું ખોઢું કામ કરી રહ્યો છું, પણ આ નિંદા-ચુગલી વગેરે કરનારને મનમાં લેશ પણ એમ લાગતું નથી કે આ હું ખોઢું કરું છું. ઉત્તમ માનવજીએ અને આર્થ અવતારે આ શું ?' ત્યારે,

જે, પાપમાં અરેકારો ન થાય, સંતાપ અફસોસી ન થાય, એ પાપ ગલીચી-ગોળારા-ચીકણાં કહેવાય.

નિંદાદિ ગલીય પાપ કેમ થાય છે ? મૂળમાં તુચ્છ સારાપણું લેવાની લાલસા લંપટા છે માટે.

આ લાલસા-લંપટા મૂકો, તો નિંદાદિ અટકે. શાસ્ત્ર તુચ્છ સુખ-સન્માનના લાલચુ જીવોને તીવ્ર તામસ પ્રકૃતિના ગણે છે. મધ્યમના લાલચુ એ અલ્પ તામસભાવવાળા છે. ત્યારે સંકલેશ રહિત ત્યાગના ઉચ્ચ સુખના અભિલાષી એ સાત્ત્વિક પ્રકૃતિના હોય છે. એમને દુન્યવી ઊંચા પણ ભોગ-વૈભવનાં સુખ સંકલેશભર્યા હોઈ ગમતા નથી.

વિચારજો કઈ પ્રકૃતિમાં આપણો નંબર લાગે છે ? ચાલો અત્યાર સુધી ગમે તેમાં પણ હવે કઈ પ્રકૃતિમાં હંમેશા નંબર લગાડવો છે ? સાત્ત્વિક પ્રકૃતિ-બહાર બજારમાં વેચાતી નથી મળતી હો, તો પછી ક્યાંથી લાવવાની ? જંગલમાંથી ? ગુજરાતી ખાણમાંથી ? ના, બહાર એ ક્યાંય ન મળે; સિદ્ધગિરિ પરથી કે મહાવિદેહમાં ભગવાન સમવસરણમાંથી મળે કે નહિ ? ના, પ્રકૃતિ એ બહારની વસ્તુ જ નથી, આત્માની અંદરની વસ્તુ છે. અંદરમાંથી જેવી બહાર કાઢીએ તેવી દેખવા મળે. અલબત્ત સાત્ત્વિક પ્રકૃતિ બહાર કાઢવામાં શ્રી સિદ્ધગિરિ, ભગવાનનું સમવસરણ અને શાસ્ત્ર તથા સંત પુરુષનું આલંબન કામ કરે છે. એ જોઈને સાંભળીને મહાપુરુષના ચારિત્ર સાંભળીને અંદરમાંથી સત્ત્વ બહાર સુધી આવે. પણ એ તો સહાયક થયા, બાકી મૂળમાં તો અંદરમાં જ ભર્યું પડેલું સત્ત્વ છે, તે બહાર કાઢવાનું છે, વિચાર-વાણી વર્તવિમાં એનો ઉપયોગ કરવાનો છે.

દશાર્થભદ્ર સત્ત્વ પ્રગટાયું :-

રાજા દશાર્થભદ્ર મહા ઋષિ ઠઠારા સાથે મહાવીર પ્રભુને વંદન કરવા

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૧૮૭

ચાલ્યો ને મનમાં સંતોષ માને છે કે આવી રીતે વંદના કરવા જવાનો લાભ તો મને જ મળ્યો હોય; કોઈએ આવા ઠાઠથી વંદન કરવા જવાનું નહિ કર્યું હોય.’ પરંતુ ત્યાં તો નગર બહાર નીકળતાં ઊંચે આકાશમાં જુઓ છે તો પોતાના કરતાં લાખોગુણા ઊંચા ઠાઠથી ઠંડને વંદનાર્થે આવતો જુઓ છે. થયું, જોતા જ મોતિયાં મરી ગયા. ક્યાં ૫૦૦ હાથી ને ક્યાં ૬૪૦૦૦ હાથી ? ક્યાં પોતાના એક હાથીને એક જ સૂંઠ, ને એના પર બે ખાલી ખમ દંતૂશળ ? ત્યારે ક્યાં ઠંડના હાથીએ હાથીએ ૮-૮ સૂંઠ, ને એકેકી દંતૂશળ ખાલી કોરો ધાકોર નહિ, પણ ૮-૮ વાવડીવાળો, જે એકેક વાવડીમાં લાખ-લાખ પાંખીના આઈ આઈ કમળ ને દરકે પાંખડી પર નૂત્ય કરતા દેવ દેવી !

હવે આ જોઈને દશાર્થભદ્રને પોતાના ઠાઠનો સંતોષ મદ ગર્વ ક્યાં ઊભો રહ્યો હતો. પછી શું કે મારો શો ઠાઠ છે ? વાહ ! કેવો ઠંડનો ઠાઠ ! મારા પ્રભુના કેવા ઊંચા ભક્ત ! અનુમોદના તો થઈ પણ, પછી શું માંડવાળ કરી કે ભાઈ ! પ્રભુને ઊંચા ઠાઠથી વંદન કરવાના આપણા શા ગજા ?’ ના, જોયું કે ઠંડનો આ ઠાઠ ઊંચો તો શું મારી પાસે કોઈ ઊંચો ઠાઠ છે ? હા, છે, સર્વ પાપત્યાગ પૂર્વક ચારિત્ર લઈને પ્રભુના ચરણે કરાતું જીવન સમર્પણ એ ઊંચો ઠાઠ, ઊંચી ભક્તિ છે.’

પણ કરવા તો એકાએક જ બધું મૂકવું પડે. મોઢું રાજ્યસુખ, ૫૦૦ રાણીઓના સુખ, ઊંચા વૈભવ વિલાસનાં સુખ, આ બધું એકદમ જ મૂકવું પડે તે ય એમાંના કોઈની ય સાથે વાત વિચાર કે કશાની ય ગોઢવણ-બ્યવસ્થા કરવાની ભાજ્યાડમાં ઊતર્યા વિના જ. આ કેમ બને ? બને, સત્ત્વથી બને.

સત્ત્વ આત્માની અંદર ભર્યું પડ્યું છે. જ્યારે એ બહારમાં વિકસાવવાનું હોય છે, અને જેણે જેણે સત્ત્વ બહારમાં વિકસાવવાનું કર્યું છે, એ કાઈ કોઈ બહારની ચીજમાંથી ઉધાર ઉધીનું માગી લાવીને નહિ, કિન્તુ પોતાની અંદરમાંથી જ બહાર કાઢીને....ભમણામાં રહેવા જેવું નથી કે શું કરીએ ?’ આ ખમ છે, સત્ત્વ આપણી અંદરમાં જ છે. સત્ત્વ ઉપર આવરણ ચંચ્ચું છે. મિથ્યા શાનનું મોહનું અને વીર્યાતરાયનું એ ફગાવી દઈએ એટલી જ વાર.

મેઘકુમારમાં સત્ત્વ હતું, ત્યારે તો રાજશાહી સુખવિલાસ સમજને જ ફગાવી દઈ, ત્રિલોકનાથ મહાવીરપ્રભુ પાસે ચારિત્ર લીધેલું. પણ પછી સત્ત્વ પર મિથ્યાશાનનું આવરણ ચરી ગયું કે આ સંથારામાં મુનિઓના પગની ધૂળ સહન કરવાનું આપણું ગજું નહિ. આપણે તો ઘરે જઈ આરામથી પલંગમાં પોડીશું.’ આ નિર્ધાર કરી પ્રભુને જણાવવા આવ્યા.

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“સત્ત્વ કેળવા” (ભાગ-૪૪)

દ્યાળું પ્રભુએ જીવે આના કરતા અનંતગુણાં વેઠેલાં નરકનાં દુઃખ સમજાવ્યા, મેધકુમારે પોતે પૂર્વના જ તિર્યચ હાથીના ભવે નાના સસલાને બચાવવા એક પગ ઊંચો અઠી દિવસ રાખેલ, તેમજ કારમા ભૂખ તરસ અને અકડામણ સાથેના મૃત્યુ સુધીનાં દુઃખ વેઠેલા એ બધું યાદ કરાયું, જેના ફળરૂપે આ ઉચ્ચ ભવ મળ્યો. ઊંચા સુખ મળ્યા, ઉપરાંત સર્વત્યાગની પુણ્યવૃત્તિ મળી. તો હવે આટલા મામૂલી કષ્ટમાં શું કામ કાયર બનવું ? શું કામ મહાત્માની તારણહાર પવિત્ર ચરણજને સ્પર્શનેન્દ્રિયના પાપે કષ્ટરૂપ માનવી ?' એ સમજાવ્યું.

પ્રભુએ શું કર્યું ? સત્ત્વ આપ્યું ? ના સમજુતી આપી.

પ્ર.- પણ સમજુતી એજ સત્ત્વ ને ?

ઉ.- ના, તો તો લ્યો આ જ સમજુતી તમને ન મળી ? મળી, તો પછી સત્ત્વ મળી ગયું, હવે ઊઠો છોડો સંસાર કેમ નથી ધૂટો ?

કહો, સમજુતી મળી. પણ સત્ત્વ નથી પ્રગટ્યું. તો સમજ રાખો, સત્ત્વ બહારથી ક્યાંયથી નથી મળવાનું. અંદરમાં ભંડારી મૂકેલું પડ્યું છે, મોખ હોય, ને આ સમજ હોય, તો એને બહાર પ્રગટ કરો. મેધકુમારે એ કર્યું, જોયું.-

સત્ત્વ વિકસાવવા વિચારણા :-

હું ? જનાવરના અવતારે આટલા બધા ઉહાપણવાળો અને સાત્ત્વિક, તે અહીં હવે ઊંચા માનવ અવતારે અને પ્રભુને પામીને મૂઢ થાઉં ? કાયર બનવું ? ના, જરાય નહિ,' એ વિચારે છે કે, તોડી નાખું આ ઈદ્રિયોની વિધાયસક્તિનાં પાપને. હાથીના અવતારે દ્યા ખાતર સ્વેચ્છાએ મરણાન્ત કષ્ટ ઉદાવી લેનાર એનો એ જ હું છું. હવે તો ભગવાન મળી ગયા છે. ભગવાન મળી ગયા પછી ભવના ફેરા નહિ ઊભા રહેવા દઉં, ભવના ફેરામાં ફસાવી રાખનાર આ શરીર અને ઈદ્રિયો તો બીજે પણ મળેલ, કિંતુ ત્યાં ભગવાન નહોતા મળ્યા, ત્યારે અહીં જો ભગવાન મળી ગયા છે તો વિશેષતા શી, જો ભટકાવનારા એ શરીર ઈદ્રિયોના સુખવિલાસ ઊભા જ રાખવાના હોય તો ? ના, પ્રભુ મળ્યાને સફળ કરીશ. કષ્ટ-તપથી શરીરની અને ત્યાગથી ઈદ્રિયોની સુખમોજને તોડી નાખીશ. મારા પ્રભુએ પણ એજ કર્યું છે. તો જ પ્રભુ બન્યા છે. ત્યારે એનો સેવક હું પાછો પડું ?'

બસ, અંદરમાં સત્ત્વ હતું જ, એને બહાર કાઢ્યું. મહા તપસ્વી મહા યોગી મહા ધ્યાની બની ગયા. રાજી દશાઈબદ્રે એ જ કર્યું. અંદરના સત્ત્વને બહાર કાઢ્યું પ્રભુ પાસે હજ ગયા નથી, પ્રભુની વાણી સાંભળી નથી, પણ પ્રભુને ઊંચા ઠાઠથી વંદના કરવાનો કરેલો નિર્ધાર ઊભો રાખ્યો એને અમલમાં મૂકવા સર્વત્યાગ કરવો જોઈએ. એ કરવા આડે શું નહે છે ? કમ તાકાત ? સંયોગ ? રાજીપણું ?

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૧૮૮

ત્યાગનો કષ્ટનો બિન-અભ્યાસ ? સંસારનો રાગ ? શું નહે છે ? કશું નડતું નથી. આ બધા તો બહાનાં છે. સર્વત્યાગની કમ તાકાત ક્યાં છે ? કોઈ પાકીસ્તાની જેવો જુલ્ઘગાર જીવતાં જ મૃત્યુનો ભય પમાડતાં જ સર્વત્યાગ કરાવી દે છે. તો જીવને એ અપનાવી જ લેવો પડે છે. કમ તાકાતનું બહાનું ક્યાં કામ લાગે છે ? એમ સંયોગો, રાજીપણું, બિન-અભ્યાસ વગેરેને ય એ ભૂલાવી દે છે કોઈ એવા રોગ અક્સમાત જુલ્ઘ કે પરલોક્યાત્રા વખતે, પૂર્વે કષ્ટ સહ્યવાનો કશો અભ્યાસ નહિ છીતાં, મહા કષ્ટ સહાય જ છે ને ? સંયોગવાળાના સંયોગ ઊડ્યા, રાજાઓના રાજ્ય-રાજીપણાં ગયા, સુખશીલની સુખશીલતા સુંટવાઈ ગઈ, છતાં જીવતા રહીને એ બધું સહી લીધું ને ?

બહાનાં કોની સામે ? પોતાના આત્માનાં જ કલ્યાણ સાધવાની વાત આવે ત્યાં બહાના ? ખરી વાત એ છે કે અંદરનું સત્ત્વ બહાર કાઢવું નથી. તામસભાવમાં ને સત્ત્વહીન દશામાં જીવવું છે, જીવવું ગમે છે. ઉદ્ધાર શે થાય ?

જુઓ, તામસભાવથી કેવાં કર્તવ્ય ભૂલાયાં ?

પાંચ તિથિએ એક એકસાંનું ય કરવું નથી. રોજ કે ૧૦ તિથિ એક પ્રતિકમણ કરવું નથી, તિથિએ લીલોતરી છોડવી નથી. દિવસભર ખાવાનો મોકળો છતાં શ્રાવક થઈને ટેસથી રાત્રેય ચગરવું છે. માસિક ધર ખર્ચનો દસમો ભાગ પણ પ્રભુભક્તિમાં લગાવવો નથી. મહિનામાં ૨૦ દિવસ પશુક્રિયાના ખુલ્લા છતાં ૧૦ તિથિય બ્રહ્મચર્ય પાળવું નથી. આ બધામાં શું નહે છે ? કમતાકાત ? સંયોગો ? ખોટા બહાના છે. અંદરનું સત્ત્વ બહાર કાઢવું નથી એ નહે છે.

સત્ત્વ-રજસ્-તમસ્ ગ્રાણ પ્રકૃતિઓ આત્માની જ છે, બહારથી ભાડૂતી લાવેલી નહિ. એમાં તમોભાવ અને તમોભાવ-મિશ્રિત રજોભાવને ખંખેરી નાખવાના, અને સત્ત્વ-સાત્ત્વિકભાવને બહાર પ્રગટ રાખવાનો છે. સત્ત્વ વિકસાવો તો કઠિન પણ સાધના સહેલી બની જશે. દશાઈબદ્રે પોતે જ પોતાનાં અંદરનાં સૂતેલા સત્ત્વને જાગતું કર્યું, સણસળાવ્યું, જુસ્સો પ્રગટ થઈ ગયો, અને સવારી પ્રભુની પાસે પહોંચતાં જ ઈંડ જોતો રહી ગયો અને રાજાએ સર્વત્યાગ કરી ચારિત્ર લઈ લીધું, લઈને ઉત્કૃષ્ટ ઠાઠથી પ્રભુને વંદન કરવાનો સંતોષ માણ્યો. માટે સત્ત્વ વિકસાવો તો બધું સહેલું થઈ જાય.

સત્ત્વ વિકસાવવામાં આવે તો ખોટા નિમિત્તો મળતાં રાગ-દ્રેષ્ટ-આસક્રિત-ઇઝર્સ વગેરે દુષ્પ ભાવો પણ ઉઠતાં અટકાવી શકાશે.

સત્ત્વ વિકસાવવા શું કરવું ? :-

પ્ર.- પણ આટલું સાંભળવા છતાં સત્ત્વ વિકસે જ નહિ ત્યાં શું થાય ?

૨૦૦ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“સત્ત્વ વિકસાવવા શું કરવું ?” (ભાગ-૪૪)

૩.- તો કહ્યું ને કે ચાર શરણાં વારંવાર સ્વીકારો. શાસ્ત્રે આ પ્રારંભિક ઉપાય બતાવ્યો છે. રોજ ત્રિકાળ તો એ કરો જ. પણ વધારામાં જ્યારે જ્યારે રાગાદિ દુષ્ટ ભાવો જોર મારે ત્યારે ત્યારે એ વારંવાર કરો. મનમાં લાવો, ‘પ્રભુ ! હું નિઃસત્ત્વ હું કે આ રાગાદિને વશ થાડું હું, હું મૂઢ હું શું કરવું એ સમજાતું નથી. મારે તમારું શરણ છે. સિદ્ધ ભગવાન ! મારે તમારું શરણ છે સાધુ ભગવંતો ! મારે તમારું શરણ છે. સર્વજ્ઞકથિત ક્ષમા નિસ્પૃહતાદિ ધર્મ મારે તારું શરણ છે. અરિહંતાદિ ચારે ય ! મને તમે જ બચાવનાર છો. જગતના કર્મપીઠિત જીવોને તમે જ બચાવો છો, તો હું તમારે શરણે હું.’

આ શરણ સ્વીકાર સાથે જન્મ-જન્માંતરના દુષ્ટત્યોની ગર્હન-નિંદા-પશ્ચાત્યાપ તથા મહાપુરુષોના સુકૃતોની અનુમોદના કરતા રહેવાનું.

વારંવાર આ શરણ-સ્વીકાર, દુષ્ટતગાહ્ય અને સુકૃત અનુમોદન તથા ભવ્યત્વાદિ ભાવોને પરિપાક કરે છે, એને પકાવે છે, એટલે એક કાર્યોનુભૂત બને છે, મહામિથ્યાત્વાદિ પાપનો નાશ કરવા પૂર્વના પાપાનુંધો અશુભ અનુંધોને તોડી નાખવા સમર્થ બને છે. આત્માઓ એમ જ મહાત્મા બન્યા છે.

મરુદેવા માતા દીકરા ઋષભદેવને જોવા આવ્યા, પ્રભુએ ન સામે માતાને લેવા જવાનું કર્યું કે ના કોઈ દેવને યા માણસને સામે માતાને મોકલ્યો. માતાને ખોટું લાગ્યું ‘હું હજાર વરસ જેની ખાતર રોતી બેઠી, એ હવે હું સામે મળવા આવું હું તો મને એ બોલાવતો નથી ? રીસ ચરી પણ શું એ પછીથી ત્યાં જ હાથીના હોદે કેવળજ્ઞાન પામ્યા, તે એ રીસ રાખીને પામ્યા ? ના, રીસ રાખીને વીતરાગ ન બનાય, ને વીતરાગ બન્યા વિના કેવળજ્ઞાન ન પમાય. ત્યારે

માતાને રીસ ચરી હતી ને કેવળજ્ઞાન શી રીતે પામ્યા ? કહો, ચતુશરણ સ્વીકાર આદિ ત્રણ ઉપાયથી.

આ રીતે પામ્યા કે મરુદેવા માતાને મનમાં તરત આવ્યું કે હું શાની મમતા કરું હું કે દીકરો મારો ને મને બોલાવતો નથી ? જગતમાં કોણ કોનું છે ? કોઈ પોતાનું નથી. સૌ જુદા છે, મરી મરીને દરેક જણ ચાલતું થાય છે, નથી બીજાને સાથે લઈ જતું કે નથી બીજો સાથે જતો. બધા સંબંધ ફોક. નવા જન્મે નવા સંબંધ મેં ખોટી મમતા રાખી, ને એથી જ ખોટી રીસ કરી- આમ દુષ્ટતગાહ્ય કરી.

વળી ચિંતયું કે ઋષભદેવ તો વીતરાગ છે. નિઃસ્નેહી છે અને મને બોલાવવાનો રાગ શું કામ કરે ? સ્નેહ શું કામ દાખવે ? રાગ-સ્નેહનો કચરો રાખ્યો હોત તો ઘરમાંથી નીકળી ચારિત્રમાર્ગ જત જ શું કામ ? ધન્ય છે એની વીતરાગતાને ! ત્યારે તો ગ્રાણ ભુવનના દેવો એને આવીને પગે પડે છે. સેવે છે.’-

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

૨૦૧

આમ પ્રભુનાં સુકૃતની અનુમોદના કરી.

વળી એ અન્યત્વભાવનાથી મમતા રીસ વગેરેને ખોટા માન્યા એ સર્વજ્ઞકથિત નિર્મભત્વ ધર્મનું શરણ લીધું વીતરાગ અરિહંતના નિર્મભત્વ સદ્ગુરી સુકૃતને સારું માન્યું સુકૃતની અનુમોદના કરી, પોતે એના આ સેવનને નક્કી કર્યું, એ અરિહંતનું શરણ લીધું.

ચતુઃશરણ સ્વીકારાદિનો કેટલો પ્રભાવ ? :-

આમ અરિહંતાદિનો શરણ સ્વીકાર, દુષ્ટતગાહ્ય અને સુકૃત-અનુમોદનાએ મરુદેવા માતાના તથાભવ્યત્વને પકવી નાખ્યું,- મોકાની યોગ્યતાને અને વીતરાગ બનવાની યોગ્યતાને પકાવી, એ પાકેલી યોગ્યતાએ પાપકર્માની જંજરો તોડી, પાપપ્રતિધાત કર્યો, એથી જટ ગુણભીજનાં આધાન થયા, અહિસાદિની પરિભાવના, દિલથી એનો સ્વીકાર, દિલમાં એનું ભાવન, અને ઉચ્ચ શુક્લ ધ્યાન, બધું સુલભ કરી દીધું. એના પ્રતાપે ત્યાં જ વીતરાગ બની કેવળજ્ઞાન પામ્યા, ને એટલામાં જ કુદરતી આયુષ્ય પૂર્જ થઈ જતાં મોક પદ પદ પામ્યા ! ચાર શરણનો સ્વીકાર વગેરેનો કેટલો પ્રભાવ ?

સટોડિયાને જેમ બે ઘડીના લિયા-દિયાના બોલમાં હજારો લાખોની કમાણી, એમ અહીં મરુદેવા માતાને એ ઘડીના આ ચિંતનમાં ઠેઠ કેવળજ્ઞાન સુધીની કમાણી થઈ ! દુનિયાના સહ્યામાં તો નફાનું નક્કી નહિ, ખોટ પણ જાય; જ્યારે અહીં તો નિશ્ચિત એકાંતે લાભ; કેમકે આમાં સહ્યો નથી, લોટરી નથી લગાવાની કિન્તુ બધું Scientific and Mathematical વૈજ્ઞાનિક અને ગણતરીબદ્ધ છે, એ શી રીતે ? આ રીતે, -

શ્રી પંચસૂત્ર શાસ્ત્ર કહે છે,

(૧) જીવ અનાદિ; ભવ અનાદિ; ભવ પણ અનાદિ કર્મસંયોગથી બનેલો છે.

(૨) આ ભવનો ઉચ્છેદ શુદ્ધ ધર્મથી થાય.

(૩) શુદ્ધ ધર્મની સચોટ પ્રાપ્તિ પાપ કર્મના હટાવાથી બને.

(૪) પાપકર્મનું હટવું તથા-ભવ્યત્વાદિ ભાવ પાકવાથી થાય.

(૫) તથા-ભવ્યત્વાદિ ભાવ પાકવાનાં સાધન ત્રણ, ચતુઃશરણસ્વીકાર, દુષ્ટતગાહ્ય, અને સુકૃત આસેવન બસ, આ ત્રણ સાધન અજમાવતા જવાય, તેમ તેમ તેમ તથા ભવ્યત્વાદિ ભાવ પરિપક્વ થતા આવે, ને પાપ કર્મ યાને અશુભ અનુંધો નાચ થાય, શુભ અનુંધ વધે, દર્શન મોહનીય અને ચારિત્રમોહનીય કર્મનું જોર ધટું આવે, એના ઉપર જ શુદ્ધ સચ્ચાર્થશર્ણ સહિત ચારિત્રધર્મની પ્રાપ્તિ અને વિકાસ થતો જાય. ઉત્કૃષ્ટ વિકાસ વીતરાગ સર્વજ્ઞ બનાય; પછી તો એ

૨૦૨ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“સત્ત્વ વિકસાવવા શું કરવું ?” (ભાગ-૪૪)

ભવનું આયુષ્ય ભોગવાઈ ગયે સીધો મોક્ષ. ત્યારે એ પૂછો છો કે-
પ્ર.- અહીં તથાભ્યત્વ એટલે શું ?

ઉ.- ભ્યત્વ સમજો છો, જીવનો એ સ્વભાવ છે. જીવ બે જીતના ભ્ય
અને અભ્ય, એક મોક્ષ પામવાને યોગ્ય, બીજા અયોગ્ય ભ્યમાં ભ્યત્વ,
અભ્યમાં અભ્યત્વ, આ સ્વભાવ એ અનાદિ કાળથી જ જીવમાં લાગેલા હોય,
એટલે કોઈના બનાવ્યા ભ્ય કે અભ્ય બનતા નથી. યા ક્યારેક સંયોગવશ તેવા
બની જવાનું નથી હોતું એ તો અનાદિથી ભ્ય એ ભ્ય તે મોક્ષ ન પામે ત્યાં
સુધી ભ્ય, ભ્ય અભ્ય ન થાય, અભ્ય એ કદાપિ એ ભ્ય ન બને. એ
અનાદિથી અભ્ય, તે સદાને માટે અભ્ય.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ” વર્ષ-૨૦, અંક-૨૨, તા. ૧૨-૨-૧૯૭૨

જીવ-જીવનું ભ્યત્વ કેમ જુદું ? :-

હવે બધા ભ્ય જીવમાં ભ્યત્વ એટલે મોક્ષ પામવાની યોગ્યતા હોય છે,
એ પાક્તી જાય તેમ તેમ મોક્ષમાર્ગની ઊંચી ઊંચી સાધના આવતી જાય, મોક્ષ
પામવાની ભૂમિકા વધતી જાય, મોક્ષ-અવસ્થાની નિકટ નિકટની અવસ્થા સરજાતીની
આવે. પરંતુ એ ઊંચી ઊંચી માર્ગસાધના કરવાનું કોઈને કેવા કાળે કેવી સામગ્રીથી
કેવા વિધિ વિધાને થાય, ત્યારે બીજા ભ્યને એથી જુદા કાળે જુદી સામગ્રીથી,
જુદાં વિધિવિધાને થાય. આ બેદ કોણ પાડે છે ? કહો એ દરેકની યોગ્યતા જ એવી
એવી, એ આ બેદ પાડે. જીવ જીવની યોગ્યતા જ એવી કે ઉત્થાનકારી સાધનામાં
અમુક અમુકજ કાળ સામગ્રી વગેરે ઉપયોગી થાય. એટલે બધા ભ્યમાં મોક્ષની
યોગ્યતા ખરી, પરંતુ વ્યક્તિગત યોગ્યતા જુદા જુદા સ્વરૂપની. આ વૈયક્તિક
યોગ્યતા યાને ભ્યત્વ એ તથાભ્યત્વ કહેવાય.

એટલે હવે જુઓ કે કોઈ બે જીવની તથાભ્યતા એવી એવી જુદી હોય કે
એકને અમુક સામગ્રીથી અમુક કાળે યોગ્યતા પાકી વિકાસ થાય ને બીજાની એથી
ન થાય એવું બને પ્રભુના સમસરણમાં આવનાર સાંભળનારા ભ્ય ઘણા, પણ એ
બધાયને કાંઈ એક સરખી રીતે ભ્યત્વ પાડે નહિ; કારણ કે દરેકની તથાભ્યતા
જુદી જુદી તે અમુક અમુક ખાસ કાળ-સામગ્રીની અપેક્ષા રાખનારી હોય છે,

એટલી વાત ખરી કે તથાભ્યતારૂપી યોગ્યતા પાડે એટલે પાપકર્મ તૂટતા
આવે છે, અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થતી જાય છે. આ પકવવાનાં સાધન આ ગ્રાણ,
ચારશરણ સ્વીકાર વગેરે એ સાધન અજમાવવાથી કર્મોમાં રહેલા અશુભ અનુબંધો

ભુવનભાનું અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોક્ષ” (ભાગ-૪૪) ૨૦૩

નાશ પામે, યાને દુષ્ટ ભાવ પેદા કરવાની બીજશક્તિ નાથ થતી આવે છે, તેમ
શુભ અનુબંધ યાને શુભભાવો પકાવે છે. કહો કે આ જ યોગ્યતા પાકવાની પ્રક્રિયા
છે.

માટીમાં ઘડાની યોગ્યતા પાકવાની પ્રક્રિયા :-

માટીમાં ઘડો બનવાની યોગ્યતા છે, પણ જ્યાં સુધી એ જમીનમાં દટાયેલી
પડી છે. ત્યાં સુધી ઘડો બનવા તરફ કશી પ્રક્રિયા નથી એટલે યોગ્યતા અભજ
અપકવ પડી રહી. હવે જ્યાં કુંભાર એને ખોદીને બહાર કાઢવા માટે ખોદવાની
કિયા શરૂ કરે છે ત્યાં એ કિયા એ યોગ્યતા પાકવાની કિયા શરૂ થઈ ગણાય. તે
જેમ જેમ માટી ખોદવી, બહાર કાઢવી, ગધેડે ચડાવવી, સ્થાને લાવીને નાખવી,
કૂટવી, પલાણવી, ગુંદરવી, ચાક પર ચડાવવી, ચાકડો ધુમાવીને હાથેથી ઘડતા
રહેવું,...વગેરે કિયા ચાલે, એમાં યોગ્યતા વધુ ને વધુ પાકતી જતી કહેવાય. તે
કેઠ ઘડો બની જાય ત્યાં યોગ્યતા પૂર્ણ પકવ બની જઈ હવે કાર્યમાં પરિણામ પામી
ગઈ કહેવાય. હવે માટીમાં ઘડાની યોગ્યતા નહિ કહેવાય, પણ ઘડાપણું જ આવ્યું
ગણાય. જોજો યોગ્યતા અભજ પડી નથી.પાકી, કુંભારના શ્રમે પાકી છે.

એવું ભ્યત્વમાં છે. ભ્ય જીવમાં ભ્યત્વ એ મોક્ષ પામવાની યોગ્યતા છે,
તે ભ્યત્વ એમ પદ્ધું પદ્ધું નથી પાકતું, એને જીવ પરિશ્રમ પ્રયત્ન પુરુષાર્થ કરીને
પકવવું પડે છે. એટલે જો એમ નિરાંત વાળીને બેસો કે આપણામાં ભ્યત્વ હશે
તો એમ જ પાકી જશે, તો ભૂલા પડશો. દુનિયાભરમાં જુઓ તો દેખાશો કે
ઉપાદાનમાં કાર્ય બનવાની યોગ્યતા એમજ નથી પાકતી, પરંતુ ઉપર કોઈની પ્રક્રિયા
થાય તો પાડે છે, ને કાર્ય બને છે, એ કામ ભ્યત્વને પકવવાનું કામ આપણા
જીવન ઉપાદાનમાં રહેલી યોગ્યતા યાને ભ્યત્વ ઉપર કરવાનું છે. આપણે એને
પકવવાનો પ્રયત્ન કરવાનો પુરુષાર્થ કરવાનો છે. ,

ભ્યત્વ પકવવાનો પુરુષાર્થ ચતુઃશરણના સ્વીકાર આદિથી શરૂ થાય !
ત્રિલોકનાથ વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થીકર દેવ, એમના ધર્મ કે એ ધર્મના પાલક સાધુ
પત્યે જરા આકર્ષણ થયું કે અહો કેવાં સુંદર દેવ કેવો મહાન જૈનધર્મ ! કેવા
જૈનધર્મના ત્યાગ. તપસ્વી સાધુ ! તો ય એ જે લેશ પણ શરણભાવ આવ્યો, એ
મોક્ષની યોગ્યતા હવે પાકવા તરફ ગણાય, પછી આગળ આગળ સાધનાની પ્રક્રિયા
દ્વારા એ યોગ્યતા યાને એ ભ્યત્વ વધુ ને વધુ પકવ બનતું બનતું, અંતે જીવની
મોક્ષ અવસ્થા પ્રગટ થતાં, એમાં પરિણામ પામી ગયું ગણાય હવે જીવમાં ભ્યત્વ
નહિ. મોક્ષની યોગ્યતા નહિ, પણ ખુદ મોક્ષ જ આવ્યો કહેવાય. જેમ માટીની
યોગ્યતા ઘડો અવસ્થા બની એમ જીવનું ભ્યત્વ મોક્ષ અવસ્થારૂપ બની ગયું.

૨૦૪ ભુવનભાનું અન્સાઈક્લોપીડિયા-“સત્ત્વ વિકસાવવા શું કરવું ?” (ભાગ-૪૪)

પ્ર.- મોક્ષ પામેલા સિદ્ધ બનેલા ભવ્ય જીવમાં હજુ ભવ્યત્વકાયમ માને તો શો વાંધો ? ભવ્યત્વ તો અનાદિસિદ્ધ સ્વભાવરૂપ હતું. તો એ સ્વભાવ નાશ કેમ પામે ?

કાર્ય થયે યોગ્યતા નાટ મોક્ષ થયે ભવ્યત્વ નાટ :-

ઉ.- ત્યાં ભવ્યત્વ માનવામાં વાંધો એ કે હવે ભવ્યત્વનું સ્વરૂપ શું ? કપકું થોડું પણ મેળું છે. ત્યાં સુધી અનામાં શુદ્ધ થવાનું યોગ્યતા છે, પરંતુ જ્યાં એ સંપૂર્ણ શુદ્ધ થઈ ગયું, પછી એમાં હવે શુદ્ધ થવાની યોગ્યતા શી ? હવે અનામાં શુદ્ધિની યોગ્યતાનું કોઈ સ્વરૂપ જ નથી. દૂધમાંથી ધી બની ગયા પછી હવે એ ધીમાં ધી બનવાની યોગ્યતા શી ? હવે ધી બનવાની યોગ્યતાનું કોઈ સ્વરૂપ જ ધીમાં નથી ત્યારે, સ્વરૂપ વિનાની વસ્તુ તો આકાશકુસુમ વંધ્યાપુત્ર ગર્દબશિંગ, વગેરેની માફક અસત ગણાય. એમ સિદ્ધ મુક્ત બની ગયેલામાં ભવ્યત્વ યાને મુક્ત બનવાની યોગ્યતા જેવી વસ્તુ જ નથી. અર્થાત ભવ્યત્વનું સ્વરૂપ જ નથી. અજ્ઞાનમાં-ઇજ્ઞાસ્થમાં જ્ઞાની કેવળજ્ઞાની બનવાની યોગ્યતા કહેવાય પણ કેવળજ્ઞાનમાં કેવળજ્ઞાની બનવાની યોગ્યતા શી કહેવાય ?

ત્યારે હવે સવાલ એ રહ્યો કે ભવ્યત્વ તો અનાદિસિદ્ધ સ્વભાવ છે. એ નાશ કેમ પામે ? પરંતુ અહીં આ સ્વભાવનું જુઓ કેવું છે. એ સ્વરૂપ એમજ પડી રહે છે ? ના, એ વિકસર થતું જાય છે, પાકતું જાય છે. ત્યારે જેમ જેમ એ યોગ્યતા વિશેષ પક્ષવ બને તેમ તેમ એ વિશેષ પક્ષવ વખતે પૂર્વની અપક્ષવ યોગ્યતા એમ જ ઊભી રહેલી ગણાય ? ના, જેમ અભાસ બાળક એક ચોપડી ભણ્ણો ત્યારે એનામાં પૂર્વની ભણતર યોગ્યતા એમ જ ઊભેલી નહિ, પણ ર જ ઉજ ચોપડી ભણવાની વિશેષ યોગ્યતારૂપ બનેલી ગણાય, એમ અહીં પણ પ્રાથમિક ભવ્યત્વ, હવે જીવની આગળ પ્રગતિ પર, વિશિષ્ટ ભવ્યત્વ રૂપ બન્યું કહેવાય. એમ આગળ વિશિષ્ટ ભવ્યત્વ, રૂપ બન્યું કહેવાય એમ આગળ વિશિષ્ટ વિશિષ્ટ બનતાં અંતે એ મોક્ષયોગ્યતા મોક્ષ અવસ્થારૂપ બનતાં અંતે એ મોક્ષયોગ્યતા મોક્ષ અવસ્થારૂપ બની જાય.

આમાં બે વાત આવી (૧) ભવ્યત્વ એ અનાદિનો સ્વભાવ સંદર્ભ નાશ ન પામ્યો પણ કાર્યમોક્ષ અવસ્થારૂપમાં પરિણામ પામી ગયો; અને (૨) હવે રૂપક ફરી ગયું એટલે પૂર્વ ભવ્યત્વ અવસ્થા ઊભી ન રહી. કચરામાં રમી આવેલું બાળક શુદ્ધ થવાને યોગ્ય ગણાય પણ એ બરાબર નાખ્યું ધોયું પછી તો એ શુદ્ધ થવાને યોગ્ય નહિ, કિન્તુ શુદ્ધ જ ગણાય.

આ પરથી એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે ભવ્યત્વ આપણાંમાં હોવા છતાં

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂર્વાનો મોકો” (ભાગ-૪૪) ૨૦૫

એને જો વારંવાર ચાર શરણનો સ્વીકાર દુષ્કૃતગર્હ અને સુકૃત આસેવન દ્વારા પક્ષવતા જઈએ તો એ વિશિષ્ટ વિશિષ્ટ પક્ષવ ભવ્યત્વ બનતું જાય અને એ આગળ આગળની ઉન્નતિની ભૂમિકા સરજનારું બને. વાત આ છે કે ભવ્યત્વ તો છે ત્યાં અનાદિનું છે જ, પણ એને પક્ષવવાનું કામ કરે એ જીવને એ હોયેલું લેખે લાગે ત્યારે એ પક્ષવવાનાં કાર્યમાં પહેલું શું કરવાનું ? આ ચાર શરણનો સ્વીકાર આદિ ત્રિપુટી કાર્ય કરવાનું છે.

જુઓ સુદર્શન શેઠને શૂળીનું સિંહાસન થાય એવા અદ્ભુત શીલપાલનના મૂળમાં શું હતું ? આ જ ગ્રાણ ચતુઃ શરણ સ્વીકાર આદિ. પૂર્વ જીવનમાં એ આજ ઘરમાં સુદર્શના પિતા અર્હદ્વાસના ઢોરા ચારનારો નોકર હતો. અને નોકર ઢોરને ચરાવવા લઈ જવાનું કામ કરતો હતો. એક દિવસે ઢોર ચરાવિને લઈ આવતાં નદી કિનારે એક મુનિનો ધ્યાનમાં ઊભેલા જોયા. મનને થયું કે આટલી બધી શિયાળાની કડકડતી ઠંડીમાં આ શી રીતે આમ ઊઘાડા જેવા ઊભા રહી શકેશે ? રાત તો પડવા આવશે તો કેટલું ઊભા રહેશે ? ધન્ય છે આમના સહન કરવા ક્યાં અમારી કંગાળ સ્થિતિ ને ક્યાં આવું પરાકમ,

આ શું કર્યું ?

મુનિના સુકૃતની અનુમોદના, અને કંગાળતારૂપી પોતાના દુષ્કૃતની ધૃષ્ટા.

પછી એ ઘરે પહોંચ્યો. રાતના સૂતાં મનને વિચાર થાય છે કે અરે ! મારે આટલું બધું ઓઠદે ટાઢ શમતી નથી, તો એ મહાત્મા શી રીતે સહન કરતા હશે ? આમાં પણ દુષ્કૃતગર્હ અને સુકૃત અનુમોદના સવારે પાછો સીમમાં ગયો. ત્યાં એ જ મુનિને ધ્યાનમાં ઊભેલા જોયા આશ્રયનો પાર નથી.

પાસે જઈને પૂછે છે, આપ શી રીતે આ કડકડતી ટાઢ સહન કરી શકો છો ?

એટલામાં સૂર્યોદય થયો એટલે મુનિને સંકલ્પ પૂરો થયો તેથી નમો અરિહંતાશ બોલી ધ્યાન પારીને વિદ્યાધર મુનિ હતા, એટલે વિદ્યાબળે આકાશમાં ઊરી ગયા.

આ નોકર સમજ્યો કે મારા સવાલના જવાબમાં નમો અરિહંતાશ બોલ્યા, માટે લાગે છે કે આ કોઈ મોટો મંત્ર છે, અને એના પ્રભાવે આટલું બધું સહન કરવાનું ને આકાશમાં ઊડવાનું થાય છે.” બસ આ સમજ પર એણે ત્યારથી જ નમો અરિહંતાશની અથાગ શ્રદ્ધા સાથે રટણા શરૂ કરી દીધી.

અજ્ઞાણી રીતે અરિહંતનું શરણ લીધું.

અરિહંતને ઓળખતો નથી, પણ મનને થયું કે આ કોઈ મહાન શક્તિ છે જેના પ્રભાવે આટલી બધી કડકડતી ઠંડી સહન થઈ શકે છે. તો પછી મારે નકામો

૨૦૬ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“સત્ત્વ વિકસાવવા શું કરવું ?” (ભાગ-૪૪)

સમય ગુમાવવાનો શું કામ ? કે આડાઅવળા ફાંઝા શા મારવાં ? આ જ રટવા દે, આનાથી બધું સિદ્ધ થશે. આટલો મહાન મંત્ર મળ્યો છે. તો હવે તો ‘મારે આ જ ખરેખરું, આજ શરણ’ આનું નામ શરણ સ્વીકાર.

શરણ-સ્વીકાર એટલે.

(૧) બેકાર નકામો સમય જતો ખટકે, એનો શરણમાં ઉપયોગ કરવાનું મન થાય.

(૨) આડા અવળામાં ફાંઝા મારવા એ મૂર્ખતા લાગે, મૂઠના લાગે અને એ બંધ કરવાનું દિલ થાય. તથા

(૩) શરણભૂતને જ એક ખરેખરો આધાર માની એને જ વળગવાનું દિલ બની જાય; દિલ એને સોંપી દેવાય.

વિચારજો અરિહંતને શરણ માનો છો ને ? આવી રીતે માનો છો ?

(૧) બેકાર સમય જતો ખટકે છે ? હવે એ બેકાર ન ગુમાવતા, એમાં અરિહંતનું સ્મરણ રટણ કરો છો ?

(૨) જ્યાં કશું વળવાનું નહિ, મળવાનું નહિ (i) એવા ડાફોળિયા (ii) ખોટી ખોટી જિજ્ઞાસા, આહુ અવળું આચરણકુચડ જેવા જાણવા સાંભળવાની લગન અને પ્રવૃત્તિ (iii) ક્યાંક મફતિયા માથું મારવાનું (iv) અતિ તુચ્છ લાભમાં ભારે સમય બગાડવાનું, (v) તુચ્છ નુકસાન આપત્તિમાં લાંબો વખત હાયવોય ઈત્યાદિ નથી કરતા ને ? ત્યાં બધે અરિહંતનું સ્મરણ રટણ ચલાવો છો ને ?

(૩) મારે અરિહંત જ એક આધાર છે., જેના આલંબને મહાબ્લાષીઓ તર્યારી છે; જેનું મહાબુદ્ધનિધાન ગૌતમસ્વામી આદિગણધરદેવો અને ઉમાસ્વાતિ, સિદ્ધ-સેનિદ્વાકર, હરિભદ્રસ્સૂરિ, હેમચંદ્રસ્સૂરિ આદિ મહાવિદ્ધાન આચાર્ય મહારાજાએ શરણનું પક્ષચું હતું, જે અરિહંતદેવના ચરણમાં મોટા સનકુમારાદિ ચક્કવર્તી, અભય કુમારાદિ મહામંત્રી અને શાલિભદ્રાદિ મહાશ્રીમંતોએ જીવન સોંપી દીધા, એ અરિહંત પરમાત્મા મને મળ્યા પણી મારે બીજો શો વિચાર કરવાનો હોય ? મારે તો એજ ત્રાણ, એ જ પ્રાણ, અને એ જ શરણ આવું એમને જ દિલ સોંપાઈ ગયું છે ?

પેલા નોકરને આ સ્થિતિ બની છે. એ તો હવે ચડ્યો નમો અરિહંતાણની રટણાએ. જંગલમાં ય એ અને ઘરે ગયા પણી પણ એ જ રટણાં. ત્યારે શેઠ અહૃદ્દાસ પૂછે છે, ‘અરે ! ભલા માણસ આ શું રટે છે.

નોકર કહે શેઠ ! એ તો મને મહાત્મા પાસેથી મહાન મંત્ર મળ્યો છે. એમ કહી એણે બધી વાત કરી, એમાં એણે આ લગાડી દીધું કે “મેં પૂછ્યું બાપુજી ! તે તમે આટલી બધી ટાઢ ખુલ્લા જેવા શરીરે શી રીતે સહન કરી શકો છો ? ત્યારે

ભુવનભાનુ અન્સાઈકલોપીયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

એમણે મને જવાબમાં નમો અરિહંતાણાં કહી એ આકાશમાં ઊરી ગયા. એટલે એમણે જ મને આ મહામંત્ર આય્યો.”

અહૃદ્દાસ મહાન શ્રાવક છે. એ સમજ ગયા કે મહાત્માએ તો ધ્યાન પારવા નમો અરિહંતાણાં બોલ્યા હશે, પણ આ ભદ્રક જીવે એમ માન્યું કે મને મહામંત્ર આય્યો. તો ભલે હવે એની એ શ્રદ્ધા કાયમ રહો એનો બુદ્ધિભેદ કરવાની જરૂર નથી. એમ વિચારી એમણે નોકરની પ્રશંસા કરી કે બહુ સારું થયું તારે,’ અને સમર્થન કર્યું કે ખુશીથી તું ત્યારે એ રટણા રાખ, તારું કલ્યાણ થશે.’

બસ, શેઠ તરફથી નોકરને ઉપબૂછણા મળી, સમર્થન મળ્યું, પ્રસંસા મળી, એટલે તો નમો અરિહંતાણાંની રટણા વધુ શ્રદ્ધા વધુ આદર વધુ સમર્પણથી એણે ચલાવ્યે રાખ્યી. આનો અર્થ શો ? આ જ કે મહામંત્ર પ્રત્યે એનો શરણભાવ વધ્યો. એમાં વચ્ચમાં વચ્ચમાં પેલા મહાત્મા યાદ આવે છે. એમનું કડકડતી ટાઢને અજબ સહન કરવાનું યાદ આવે છે, પોતાની પામર કંગાળ અસહિષ્ણું દશા પર દુઃખ પણ થાય છે; આ સુકૃત-અનુમોદના અને સ્વદુષ્ટતગર્હી સાથે છે.

તો આ વધતો શરણભાવ શું કરી રહ્યો છે ? કહો એના તથા ભવ્યતવનો વધુ ને વધુ પરિપાક કરી રહ્યો છે; અર્થાત મોક્ષ પામવાની યોગ્યતાને અધિકારિક પકાવી રહ્યો છે. એમાં શી પ્રક્રિયા થાય ?

ભવ્યતવના પરિપાકમાં પ્રક્રિયા આ થાય, કે અશુભ અનુબંધો છેદાતા જાય અને શુભ અનુબંધ ઊભા થતા આવે. આ વસ્તુ આ શરણસ્વીકાર - દુષ્કૃતગર્હી સુકૃતાનુમોદનથી થાય.

અનુબંધ એટલે :-

અનુબંધ શબ્દથી મુંજાશો નહિ, એનો ભાવ સમજાય એવો છે એ તે કે બીજશક્તિ ડાંગર બહુ જુની ન થઈ ગઈ હોય. તો એમાં બીજશક્તિ હજી ઊભી છે, એટલે એ વાવવાથી નવી ડાંગર ઊગે. એના વાવેતરમાં વળી નવી ડાંગર ઊગે એના વાવેતરમાં વળી નવા ડાંગર ઊગે એમ ચાલ્યા કરે. પરંતુ જો ડાંગર બહુ જુની થઈ ગઈ તો ખલાસ, બીજશક્તિ નષ્ટ પણી એના ચોખા કાઢી ખાઈ જાઓ એટલું જ, આગળ કશા નવા પાક નહિ.

એમ કર્મમાં આવું છે. એમાં અનુબંધ યાને બીજ શક્તિ ઊભી હોય તો એ કર્મના વિપાકમાં તેવા ભાવ અને નવાં કર્મ બંધાય, એના વિપાકમાં વળી એવા ભાવને નવા કર્મ એમ પરંપરા ચાલે. પરંતુ જો પહેલેથી કર્મના આ અનુબંધ જ તોડી નાખ્યા, તો પેલી જુની ડાંગર ચોખાની જેમ એમ કર્મના વિપાકને ભોગવી લો એટલું જ, પણ એ વખતે એવા ભાવ નહિ તેમ નવાં એવા કર્મના સર્જન

નહિ.

શ્રીપંચસૂત્ર શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે ચતુશરણ સ્વીકાર વગેરે ત્રણ સાધનાના વારંવારના ઉપયોગથી અશુભ અનુબંધ છેદાઈ ગયા પછી એ અશુભ કર્મ ફળ વિપાક પણ અલ્ય દેખાડે છે. અને એ કર્મવિપાક વાંજિયો નીવડે છે. અહીં પ્રશ્ન થાય.

પ્ર.- અનુબંધ તો છેદાયો, પણ કર્મ તો ઉલ્લંઘ જ છે, તો પછી એ પોતાનું ફળ અલ્ય કેમ દેખાડે ?

ઉ.- જ્યારે આ પ્રસિદ્ધ ફળ અલ્ય આવે, તો એ પરથી સૂચિત થાય છે કે ચતુશરણ સ્વીકાર દુષ્કૃતગાહ્ના અને સુકૃત અનુમોદન એ ત્રણ ઉપાય એવો સુંદર શુભ ભાવ પેદા કરે છે કે જે અશુભ કર્મના રસમાં અપવર્તના યાને ઘાત ઓછાશ ઘટાડો કરે છે, તેથી એનું ફળ અલ્ય આવે છે.

કર્મનું ફળ અલ્ય કે બહુ એનું માપ એના રસોદર્ય પર મપાય છે.

અલ્ય બહુ રસોદર્યના દેખાન્ત :-

દા.ત. માનો કે શરીર પર ગુમહું થયું, પણ એની એવી પીડા નથી, તો એ અલ્ય રસવાળું અશાતા વેદનીય કર્મ ગણાય. ત્યારે જો શરીર પર નાની ફોલ્ટી થઈ હોય પણ ધોરી નસ ઉપર હોય અને બહુ બેંચાતી હોય બળતી હોય તો ત્યાં અશાતા વેદનીય કર્મ બહુ યાને ઉગ્ર રસવાળું ગણાય. એવી રીતે દા.ત. ત્રણ દિવસથી દુકાને મોડા જતા ગુમાસ્તા પર શેઠે ગુસ્સો તો કર્યો, મોટા અવાજે નોકરને દપકો આપ્યો. પણ શિક્ષારૂપે ત્રણ રૂપિયા દંડ કર્યો, ત્યાં એ ગુસ્સો ઓછા રસવાળો કહેવાય. જ્યારે બીજો શેઠ એવી સ્થિતિમાં બહુ જોસથી બોલે નહિ, પણ મહિનાનો અડધો પગાર કાપી લેવાનો દંડ કરે, તો એ કોધમોહનીય કર્મ બહુ રસવાળું ઉગ્ર રસવાળું કહેવાય.

આમ ફળ અલ્ય કે બહુ એમ મંદ કે ઉગ્ર રસ પર મપાય અને આ શાસ્ત્ર ચતુશરણાદિ ઉપાયથી અશુભ કર્મના મંદ અલ્ય ફળ યાને રસનું કહે છે, એ પરથી સૂચિત થાય છે કે એ શરણસ્વીકાર વગેરે ત્રણ ઉપાયથી કર્મના અશુભ અનુબંધ તો તૂટે જ છે, ઉપરાંત કર્મનો રસ પણ કપાય છે.

નિકાચિત કર્મને શી અસર ? :-

પ્ર.- પરંતુ કર્મ નિકાચિત હોય તો રસ ન કપાય, પછી આ તુ ઉપાયથી શો લાભ ?

ઉ.- કર્મ નિકાચિત હોય તો એનો રસ નથી કપાતો, છતાં શ્રી ધર્મપરીક્ષા શાસ્ત્રમાં પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજ્યજી મહારાજ કહે છે કે દુષ્કૃતગાહ્નનો ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૨૦૮

પ્રભાવ એવો છે કે ઉત્સૂત્રભાષણ આદિ પાપથી બાંધેલાં સાનુબંધ કર્મ એ ફળમાં જે અનંતસંસારિતા લાવે તે દુષ્કૃતગાહ્નથી અટકી જાય છે; કેમકે વારંવાર દુષ્કૃતગાહ્ન કરવાથી કર્મના અનુબંધ છેદાઈ જતાં હવે નિરસુબંધ બચેલું કર્મ ભોગવતી વખતે એવી બુદ્ધિ બગડતી નથી, નવાં એવા ભવવર્ધક કર્મ બાંધવાના હોતા નથી. અહીં એક પ્રશ્ન થાય.

ઉત્સૂત્રભાષણના ભયંકર પાપ પર શી અસર ? :-

પ્ર.- શાસ્ત્ર ઉત્સૂત્રભાષણનું ફળ તો અનંત સંસાર ભમણ કહે છે. ગચ્છના ભેટ બહુ નયણ નિહાળતાં, તત્વની વાત કરતા ન લાજે’ કહેનાર શ્રી આનંદધનજી મહારાજ પણ સમજે છે કે સૂત્રવિસુદ્ધ કહેનાર સાથે અભેદ ઐક્ય ન રખાય કેમકે સૂત્રવિસુદ્ધ બોલવું માનવું એ ઉત્કૃષ્ટ પાપ છે. એ જ ત્યાજ એમણે કહ્યું (૧) પાપ નહીં કોઈ ઉત્સૂત્રભાષણ જિશ્યો, કે (૨) ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરિખો,’ સૂત્ર એટલે સસૂત્રતા સૂત્રાનુસારિતા, આજ્ઞાનુસારિતા જિનાજ્ઞા જેવો કોઈ ધર્મ નહિ, ઉત્સૂત્ર-ભાષણ જેવું કોઈ પાપ નહિ. કેમકે એનું ફળ અનંતસંસાર તો શું એવું પાપ સેવાઈ ગયા પછી દુષ્કૃતગાહ્નથી એ અનંતસંસાર મિટે ? જો મિટે તો ઉત્સૂત્રભાષીને અનંતસંસારનો નિયમ કર્યા રહ્યો ?

ઉ.- આનો જવાબ એ જ ધર્મપરીક્ષા શાસ્ત્રમાં કર્યો છે કે એવાં ઉગ્ર ઉત્સૂત્રભાષણનું પાપ કરીને આવેલાને દુષ્કૃતગાહ્ન સૂજીતી જ નથી. એવા ઉગ્ર પાપથી બાંધેલા કર્મ એવાં સાનુબંધ હોય છે. કર્મમાં એવા અનુબંધ પડેલા હોય છે કે જે દુષ્કૃતગાહ્નની સદ્દબુદ્ધિ જાગવા જ ન દે. પછી અનંત સંસારિતા મિટવાની વાતે ય શી ? એવા અનુબંધ તો જીવને દુબુદ્ધિમાં જ રાખ્યા કરે છે. તેથી એવા જીવને નવાં નવાં કર્મ અને નવાં નવાં ભવની પરંપરા ચાલુ રહેવાથી અનંતભવમાં ભમણ થાય છે.

આ ઉપરથી સમજવા જેવું છે કે જિનશાસન જૈનધર્મ પાભ્યાની જેટલી વડાઈ છે, એટલી એ પાભ્યા પછી ઉત્સૂત્રભાષણ, જિનેશ્વર ભગવાનની નિંદા, ભગવાનની મૂર્તિની મૂર્તિપૂજાની કે ભગવાને ફરમાવેલ સમ્યગ્ આચાર-અનુષ્ઠાનની નિંદા જેવાં પાપ સેવવાની ભયાનકતા છે.

શાસન પાભ્યા તે તો અનંત સંસારનો ઉચ્છેદ કરી આપે એ એની વડાઈ. ત્યારે એ પાભ્યા પછી આવાં ઉત્સૂત્રભાષણ જિનનિંદાદિ પાપ સેવાય એ અનંત સંસાર વધારી આપે એ એની ભયાનકતા.

આનું કારણ એ કે એવાં ઉગ્ર પાપ અશુભ કર્મ તો ચીકણાં બંધાવે, ઉપરાંત એમાં અનુબંધ પણ એવી સ્થિતિના સરજ આપે કે જે પછીથી દુષ્કૃતગાહ્ન આદિ

કરવાની યોગ્યતા જ ન રહેવા દે અર્થात એની સદ્ભુદ્ધિ જ ન જાગવા દે., માટે એવા પાપ ભૂલેચૂકે પણ ન સેવાઈ જાય કદાચ ભૂલભાલ અજ્ઞાનતામાં અજ્ઞાણે સેવાઈ ગયું તો જરૂર એની નિંદા, પશ્ચાત્પાપ, ગુરુ આગળ એની આલોચના પ્રકાશન અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી લેવાય એ કાળજી સાવધાની રાખવાની છે.

ગુરુ આગળ પાપના ઈકરાર નહિ, તો શલ્ય રહે, શલ્યથી પાપ-ભવ-પરંપરા :-

સમજુ રાખો કે અહીં જીવતાં છીએ ત્યાંસુધીમાં ગુરુ આગળ એ પાપનો ઈકરાર કરવાની અને પ્રાયશ્ચિત્ત માગી લેવાની તક છે. પણ ભવ પૂરો થયો, મરીને ચાલ્યા બીજે, પછીથી ત્યાં અહીનાં પાપ યાદ જ નહિ આવે, એટલે પછી ગુરુ આગળ આલોચના પ્રાયશ્ચિત્તનો અવસર જ ક્યાંથી મળવાનો? પાપ તો સેવ્યાં પણ જો આલોચના-પ્રાયશ્ચિત્ત ન કર્યા તો આત્મામાં, એ પાપના શલ્ય પડી રહે છે. પછી એ શલ્યના યોગે આગળ આગળના ભવોમાં પાપસેવન ચાલ્યા કરે છે.

ભવ આલોચનાની મહત્તમા :-

આ ભ્યાનકતા સમજુને તો પાપભીરુ આત્માઓ માન મેલી મદ ઠેલી ગુરુ આગળ ભવાલોચના કરે છે; દિલનાં ધૂપાં પાપ પણ ગુરુને યથાસ્થિત અને બળતાં હદયે કહી દે છે, અને પ્રાયશ્ચિત્ત લઈ અને વહન કરે છે. એમને આ મોટો ડર છે કે જો ગુરુની આગળ પ્રગટ ન કરતાં અહંકારથી સ્વમાનહાનિના ભયથી દિલની અંદરમાં રાખી મૂક્યા. તો મર્યાદા પછી એ શલ્યરૂપ બની ગયેલા પાપ બીજા ભવે યાદ નહિ આવવાના, તેથી એનું નિરાકરણ નહિ થવાનું; એટલે એના પર પાપસેવન દુખુદ્ધિ ભવભ્રમણ ચાલવાનું.

આપણામાં અનંતસંસાર-ભ્રમણ ન હોવાનું કેમ મનાય ? :-

ત્યારે ઉત્સૂકૃ-ભાષણ જેવું પાપ ઉત્ત્ર ભાવે સેવાઈ ગયું તો એના યોગ ઊભાં થયેલા સાનુબંધ કર્મ વળી એવાં કે પછીથી બીજા ભવોમાં દુખૃતગર્હ જ ન આવવા દે. ત્યારે અહીં જો આપણને દુખૃતગર્હ થાય છે, શાસ્ત્ર ઓળખાવેલ જીણામાં જીણા પણ દુખૃતને ખોટા ખરાબ માનવાનો તથા એના પર સંતાપ બળતરા કરવાનો અને આ જન્મ કે જન્માન્તરોનાં એવાં આપણાં સમસ્ત દુખૃતનો 'મિશ્યામિદુક્કં' કરવાનો ભાવ આવે છે, તો આ આશાસન લઈ શકીએ કે આપણામાં હવે પૂર્વના એવા કોઈ ઉત્સૂકૃ ભાષણ જેવાં પાપના અનુબંધ નહિ રહ્યા હોય નહિતર તો શુદ્ધ દુખૃતગર્હની બુદ્ધિ જ ન થાય. પૂછો.-

પ્ર.- તો પછી માત્ર એકવારની દુખૃતગર્હથી આશાસન મળી જાય છે, પછી વારંવાર દુખૃતગર્હનું શું કામ ?

૬.- અનંતસંસારી નહિ, પણ અનેક ભવો સર્જનારા અનુબંધ પડ્યા હોય, એનું શું ? માટે કહો, દુખૃતગર્હ વારંવાર કરતા રહેવાથી, અને સાથે અરિહંતાદિ ચારનો શરણ સ્વીકાર તથા મહાપુરુષોનાં સુકૃતોની અનુમોદના વારંવાર કરતા રહેવાથી અશુભ કર્મના અનુબંધ વિચ્છેદ પામતા આવે છે. એમ અનુબંધ છેદાઈ ગયા પછી બાકી રહેલ નિરનુબંધ કર્મ ભોગવતાં દુખુદ્ધિ નહિ, મલિન ભાવ નહિ, તેથી એ ભોગવટો નિષ્ફળ જાય છે, નવી પાપપરંપરા ચાલતી નથી.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૨૦, અંક-૨૩, તા. ૧૯-૨-૧૯૭૨

મહાવીરપ્રભુનાં કર્મ કેમ હલકાં પડી ગયાં ?

મહાવીર પ્રભુએ વચ્ચા ભવોમાં અને ખાસ કરીને ત્રિપુષ્ટ વાસુદેના ભવમાં સાનુબંધનકર્મ કેટલાંય ઉપાજ્યા હશે, પરંતુ પછીથી ૨૨ મા ભવે તેમજ ૨૩માં પ્રિયમિત્ર ચક્રવર્તીમુનિના ભવમાં અને ૨૪માં નંદન રાજર્ષિનાં ભવે એટલી બધી દુખૃતગર્હ કર્યે રાખી, એટલું બધું ચાર શરણગ્રહણ અને સુકૃત-આસેવન કર્યે રાખ્યું કે એથી એમના પૂર્વના ભારે પણ કર્મોમાં રહેલ અનુબંધો છેદાઈ ગયા, તેથી જો કે હજુ એવાં કેટલાંય કર્મ ઊભા છે, ઇતાં એ નિરનુબંધ અને અત્ય ફળવાળાં બની ગયાં અત્યફળમાં એનો ભોગવટો એટલું જ, પણ પછી નવી કર્મ પરંપરા નહિ. તેથી ૨૭માં શ્રી મહાવીરપ્રભુના ભવે ચારિત્ર-સાધનાનાકાળે એ જટિલ કર્મો વરસી ગયા. ઘણું, ભયંકર ત્રાસ પીડા-વેદના આપી ગયાં. પરંતુ એ કર્મ વાંઝિયા રહીને મર્યાદા કેમકે એ કર્મોમાં અનુબંધ રહ્યા નહોતા, પૂર્વ ભવોની વારંવારની દુખૃતગર્હ આદિથી એ વિચ્છેદ પામી ચુક્યા હતા;

અનુબંધરહિત કર્મવિપાકનાં લક્ષણ :-

પ્રભુને હવે અહીં એવા અનુબંધ વિનાનાં કર્મ ભોગવતાં જુઓ કેવી સ્થિતિ;-

(૧) લેશમાત્ર પણ દુખુદ્ધિ નહિ;

(૨) દુઃખો દેનાર પ્રત્યે જરાય કોથ નહિ;

(૩) દુઃખમાં લેશ પણ કંટાળો ઉદ્દેગ કે હાયવોય નહિ;

(૪) ‘હું અનંતબળી અને આ સામો દૂબળો મને દુઃખ દે ? મારું અપમાન અવગણના કરે ?’ એવું લેશમાત્ર પણ અભિમાન નહિ;

(૫) કાયાની કે સુખ-આરામની સહેજ પણ મૂર્ખ્ય નહિ;

(૬) લેશ પણ આત્મધ્યાન-આકૃષણતાચ્યાકૃષણતા સંકલ્પવિકલ્પ કે ભય નહિ.

આ બધું શાનું ફળ ?

અશુભ અનુબંધો વિચ્છેદ પામી ગયાનો આ પ્રભાવ કે કોઈ વાતનો ઉકળાટ નહિ, ને પૂર્ણ સ્વસ્થ મન બન્યું રહે તેથી નવો કર્મબંધ નહિ.

પ્રભુની આ સ્થિતિ; ત્યારે, આપણે જરા જરા હુખમાં તકલીફમાં અશગમતામાં ઉકળી ઊઠીએ છીએ, સંતાપ-કંટાળો-કખાય-દુધ્યાન અને સંકલ્પ વિકલ્પ કરીએ છીએ, નવા દુખની આગાહીથી ભડકીએ ભયભીત બનીએ છીએ, એ બધું શાથી ? હુખથી નહિ, હુખ ચીજ એવી છે કે એ બધું એવું કરાવે માટે નહિ કિન્તુ એ હુખને લાવનાર આપણાં કર્મ અશુભ અનુબંધવાળા છે માટે. એટલે અશુભકર્મના ઉદયમાં મનને જો હુખ લાગતું હોય તો આ સમજ રાખવાનું કે એ કર્મ અશુભ અનુબંધવાળા છે, તેથી હુખ લાગે છે, મન બગડે છે, હુખ લાગે એ મનનો બગાડો છે, એ પાપ છે. પાપ પૂર્વના અનુબંધથી ચાલુ રહે છે.

આ વિવેક બહુ જાળવવા જેવો છે કે બધાય ઉકળાટ મનનો બગાડો છે. દુખુદ્ધિ છે, અને એ અશાતાદિ કર્મ કે કર્મજનિત હુખના લીધે નહિ, પણ કર્મમાં રહેલા અશુભ અનુબંધના લીધે છે.

મોટી ટી.બી. કેન્સર કે લક્વો યા અક્સમાત અને એ લાવનારાં કર્મ બુદ્ધિ નથી બગાડતાં, ઉકળાટ નથી કરાવતાં, પરંતુ એ કર્મનાં રહેલ અનુબંધ એ કખાય દુખુદ્ધિ-દુધ્યાન કરાવે છે. માટે પહેલું કામ કર્મો તોડવા કરતાં કર્મોના અશુભ અનુબંધો તોડવાનું કરવા જેવું છે; અને તે ગદ્ગદ દિલથી ચાર શરણ સ્વીકાર, બળતા કકળતા દિલે આ જન્મ પૂર્વ જન્મોનાં સમસ્ત દુષ્કૃતોની ગર્હ અને સુકૃતોનાં અનુમોદન-આસેવનથી થાય; વારંવાર એ કરતા રહેવાથી અને એ ત્રાજ ઉપાયોનો પાવર વેગ વધારતા રહેવાથી થાય.

સુદર્શન શેઠને ઘોર આપત્તિમાં ય હુખ દુખુદ્ધિ કેમ નહિ ? :-

પેલો સુદર્શન શેઠનો જીવ નોકર કડકડતી ઠંડીમાં ખુલ્લા જેવા શરીરે રાતભર નદી કાંઠે ધ્યાનમાં રહેલ, મુનિ પાસે સવારે નમો અરિહંતાણ સાંભળવા મળ્યા પછી અરિહંત શરણ સ્વીકાર, મુનિના સુકૃતની અનુમોદના અને પોતાની ઠંડી નહી સહી શકવાની પામરતા વગેરે દુષ્કૃતની ધૂણા-ગર્હમાં એવો લાગી ગયો છે કે એમાં એના ભારે અશુભ અનુબંધ છેદાઈ રહ્યા છે. તો જ અનું એ ફળ આવવાનું છે કે સુદર્શનના ભવમાં રાણી અભયા તરફથી આપત્તિ આવતાં કે રાજા તરફથી શૂણીની સજા ફરમાવતા, નગર વચ્ચે થઈને અપમાન ભરેલી સ્થિતિએ લઈ જવાતાં, અને ઠેઠ શૂણી ઉપર ગોઠવાતાં ક્યાંય હુખ દુધ્યાન, દુખુદ્ધિ નથી થતી, મન બગડતું નથી, લેશપણ ઉકળાટ-વ્યાકુણતા-ખેદ કે કખાય નથી. આ શાનું ફળ ? અનુબંધ છેદાઈ ગયાનું.

વાતવાતમાં પાપકર્મને રુઓ છો, પણ કર્મોમાં રહેલા અશુભ અનુબંધોને ક્યાં રુઓ છો ? શું એ નોકર ભણેલો છે ? વિદ્વાન છે ? ના, ઢોરા ચારનારો શાનો વિદ્વાન કે ભણેલો હોય ? છતાં જોવાની ખૂબી છે કે જે એક નમો અરિહંતાણ ની ભારે રઠ, શ્રદ્ધા અને સતત રટણામાં છે એમાં અરિહંતનું શરણ મહાત્માના સુકૃતની અનુમોદના અને સ્વદ્ધૃતની ગર્હ ગર્ભિત રીતે સુંદર પોષાતી રહેવાથી એ અશુભ અનુબંધોનો અજબ વિચ્છેદ અને શુભ અનુબંધોનું ઉપાર્જન અદ્ભુત કરતો રહ્યો છે. એના ગજબનાં ફળ સુદર્શન શેઠના જીવનમાં જોવા મળે છે. ત્યારે

આપણે તો એ નોકર જેવા ગમાર અભણ નહિ, પણ ભણેલા છીએ ને ? પણ ઉહાપણનો ભણતરનો ને વિદ્વતાનો હિસાબ શો માંડવો ? આના પર ખૂબ વિચાર કરવા જેવો છે.

દાહ્યાપણું ભણેલાપણું પાપના અનુબંધો તોડવામાં છે એ માટે ચતુઃશરણસ્વીકાર સુકૃતામોદના-દુષ્કૃતગર્હા કરવામાં છે.

નોકર પર આપત્તિ :-

એક વાર એવું બને છે કે સુદર્શનશેઠનો જીવ નોકર ઢોર ચરાવવા લઈ ગયો છે. એમાં ઢોર નદીના સામા કિનારે પહોંચી ગયા હતા. ત્યાં એની નજર પડી. એને લાગ્યું કે ઢોર ક્યાંક જંગલમાં ન જતા રહે તેથી સામે પાર જાઉં. પરંતુ વરસાદના દિવસ હશે તે નદીમાં પૂર આવેલું એથી હવે તરીને સામા કિનારે જવા માટે એણે એક ભેખડ પર ચીડી નદીમાં જોરથી ભૂસકો માર્યો. થયું એવું કે જગા ઉપર એણે જોરમાં ભૂસકો લગાવ્યો એ જગાએ નદીમાં એક લાકડાનો ખૂટો અણીદાર ઊભો ચિટકેલો, તે આ નોકર પાણીમાં ઊંઘો પડતાં બરાબર એનું પેટ આ ખીલા પર જ પડ્યું; જોસ્થી પડ્યું એટલે ખીલો પેટ ફાડીને શરીરની અંદર ભોકાઈ ગયો.

માણસની ધારણા શી કામ લાગે ? ધારણા બહાર એવા સાહસ થઈ જાય છે કે જે ભારે પડી જાય. સાહસ ખેડવાની કલ્પના ય ન હોય, મનને લાગતું હોય કે; આ તો સહેજ પણ એ ભયંકર સાહસ નીવડે.

સહેજ વાતના સાહસમાં સીતા ગઈ :-

નરવીર રામ-લક્ષ્મણના ચોકી પહેરા નીચે વનમાં સુરક્ષિત રહેનારી સીતાને રાવણ શી રીતે ઉઠાવી લઈ જઈ શકે ? પણ ઉઠાવી ગયો ને ? શી રીતે ? આવા અજાણ્યે સહેજ વાતના સાહસમાંસ્તો.

વાત એમ બની કે રાવણની બેન સૂર્પનખા રામ-લક્ષ્મણ પર મોહિત થઈ ગયેલી, પણ બેમાંથી એકેય અને સ્વીકારી નહિ, તેથી ગુસ્સે થઈ એણે રાવણને ચડાવ્યો કે તારા અંતઃપુરમાં શો માલ છે ? તને શોભતી રાણી કરવી હોય તો

સીતાને કર ! બસ રાવણ એની પાસેથી સીતાનું સૌંદર્ય વગેરે સાંભળી ઉઠ્યો, આવ્યો જંગલમાં જ્યાં રામ વગેરે રોકાયા છે. પણ જુઓ છે કે આમ આમના રક્ષણામાંથી સીતાને ઊપાડી શકાય નહિ. એટલે રાવણો પાસેના નગરના રાજીની સામે યુદ્ધ જાહેર કર્યું. એ રાજીએ રામની સહાય માણી.

રામચંદ્રજી કહે ‘હું જાઉ સહાય માટે.’

લક્ષ્મજી એના બહુ આગ્રહ પર અંતે કહે છે ‘જો તને જરૂર લાગે તો સિંહનાદ કરજે. હું સહાયમાં આવી જઈશ.’ રાવણ ગુમપણે આ સંકેત સાંભળી લે છે.

બસ, આટલી જ વાત, રામચંદ્રજી ગયા, ભારે સામનો કરે છે; એમાં એને લક્ષ્મણની સહાયની જરૂર નથી. પરંતુ રાવણે અહીં જંગલમાં નજીક આવી સિંહનાદ કર્યો.

સીતા લક્ષ્મણજીને કહે ‘જાઓ જાઓ ભાઈ પર આપત્તિ લાગે છે, સહાયમાં જાઓ !

લક્ષ્મણજીને રામ પાછો પડે એ વાતમાં વિશ્વાસ નથી પડતો. છતાં સીતાનો આગ્રહ છે એટલે ગયા. ત્યાં રાવણને તક મળી બિસ્કુટ બાવાનો વેશ કરી સીતાજી પાસે ભિક્ષા માગવા આવ્યો. જેવા સીતાજી ઝુંપડીમાંથી બહાર આવ્યા કે એમને ઉઠાવી વિમાનમાં નાખી લઈ ચાલ્યો.

અહીં જુઓ સીતાને રામને મોકલવામાં સાહસ કરે છે’ એવો ઘ્યાલ નહોતો; પરંતુ સાહસ મોટું થઈ ગયું; એના પર જાણો છો ને કે રામ-રાવણનું કેવું યુદ્ધ મચ્યું ? આ પ્રસંગ જાણ્યા પછી આપણાને લાગે કે સીતાજીએ એ સાહસ કર્યું, રામને મોકલવા જોઈતા નહોતા. અથવા રામે એમને સાથે લઈ જઈ જે રાજીની સહાયમાં ગયા એના કુટુંબમાં એમને મૂકી દેવા જેવા હતા.’ પરંતુ આ તો સીતાનું અપહરણ અને રામ રાવણનું યુદ્ધ બન્યા પછી લાગે છે. બાકી પહેલાં લાગણીના આવેશમાં ન લાગે; સિંહનાદ સાંભળી રામ પર આપત્તિ સમજાય એટલે સહેજે એમને બચાવી લેવાની સીતાજીને લાગણી થઈ આવે. તેમ એ કટોકટીનો મામલો દેખાય એટલે તાબડતોબ સહાયની જરૂર લાગે. પછી મનને સહેજે થાય કે અહીં થોડા વખત એકલા પડવામાં શું બગડી જવાનું છે ? ખરી વાત એ છે કે કર્મ અને ભવિતવ્યતા ભુલાવે છે.

તો શું સાહસ કરવું ? ના, આંધળું વિચાર વિનાનું સાહસ ન કરાય.

પરંતુ બહુ વિચારીને કામ કર્યું, પછી ભાગ્યયોગે કદાચ એ ખોટા સાહસરૂપ નીવક્યું, તો અફસોસી ન કરતાં કર્મ અને ભીવિતવ્યતાનો એ ખેલ સમજી ચિત્તને

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૨૧૫

સમતોલ રાખવું. તો જ ચિત્ત અસમાધિમાં ન પડે.

નહિતર તો ખોટા કલ્યાંત થાય, આર્તધ્યાન થાય, હૃદય ઉકાળા થાય. એથી હતાશા જીવને મુડદાલ બનાવી હે. બગડેલામાં તો કાંઈ સુધરે નહિ, કર્યું ન કર્યું ન થાય, ને ઊલટું ઉકળાટ બીજા ચાલુ કામને બગડે. માટે ના, બન્યું તે બન્યું, હવે કેમ ? તો કે હવેનું સારું બજાવો. પેલાનો અફસોસ છોડો.

સાહસ થઈ જવા પર આ વિચારો કે ભવિતવ્યતાએ થવાનું થયું. હવે એના અફસોસને બદલે હાથ પરનું સારું બજાવો.

સીતાજીએ એ કર્યું, રાવણને ત્યાં શીલ સાચવવાનું જ કર્યું. એટલા માટે તો ત્યાંથી હનુમાનજીની ખાંધે બેસીને ન ગયા. ઉકળાટમાં હોત તો ભાગવાનું મન થાત, શીલની મર્યાદા ચુકાત.

આગળ પણ જુઓ,-સીતાજીને પછીથી પણ રામે કાઢી મૂકવા છે, કેમકે લોક રાવણના ઘરે રહી આવેલી સીતાને રામે સંઘરવા પર રામની નિંદા કરે છે. રામ લક્ષ્મણજીને કહે છે. પણ લક્ષ્મણો એમાં ના પાડવાથી રામે સેનાપતિને કારણ સમજાવી કર્યું. સીતાને સંમેત શિખરજી યાત્રાના નિભિતે લઈ જાઓ અને વચ્ચમાં જંગલમાં એમને છોડી દેજો.

સેનાપતિએ સીતાને આવીને કર્યું સ્વામીનો આદેશ છે, તમને શિખરજી યાત્રા કરાવવાની છે. માટે પદ્ધારો રથ તૈયાર છે.

સીતા અહીં કશો વિચાર કરવા રહેતા નથી કે મને એકલીને કેમ મોકલે છે ? યાત્રામાં પતિ યા લક્ષ્મણજી સાથે હોય તો સારું, ના આ કશો વિચાર જ નહિ; કેમકે સેનાપતિની વફાદારી અને સુશીલતા સમજે છે એથી જ રામને કે લક્ષ્મણને પૂછવા ય જવાનું કર્યું નહિ. એ તો સીધા રથમાં બેસી ઉપડ્યા. આ કેવું સાહસ ?

બસ, ભરજંગલમાં સેનાપતિએ એમને કર્યું ‘સ્વામીનો આદેશ છે કે લોકો વાત કરે છે કે રાવણને ત્યાં એકલા રહી આવેલા સીતાને રામચંદ્રજી જેવા સારા રાજાએ હવે કેમ સાથે રખાય ? માટે આપને જંગલમાં છોડી દેવાના છે. ઈક્વાન્ક્વાન્શને કલંકરૂપ હોવાથી તમને છોડી દેવા પડે છે. બાકી રામચંદ્રજી પોતે આપને મહાસતી માને છે, ને હું પણ એમ જ માનું છું પરંતુ મને વિકાર છે કે પાપી પેટની ખાતર નોકરપણાને લીધે આ આપને ત્યજ દેવાનું ગોળારું કૂત્ય મારે કરવું પડે છે. આવું કરવું પડે એના કરતાં મારું પાપી પેટ કેમ ફૂટી નથી જતું ?’

બોલો, હવે અહીં સીતાજી શું કરે ? શું અફસોસી કરવા બેસે કે ‘મેં આ એકલીએ યાત્રા કરવાનું સાહસ કર્યાં કર્યું ? કેમ હું પતિને કે દિયરેને સાથે લેવા ભૂલી ? હાય ! મારા કયાં ભોગ લાગ્યા કે પતિના આ ભરોસે રહી ?’ શું આવો

૨૧૬ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“અનુબંધ એટલે” (ભાગ-૪૪)

કલ્પાંત કરતી બેસે ? ના, એ શાણા હતા જોયું કે આમાં પૂર્વ કર્મ અને ભવિતવ્યતા જ કામ કરી રહ્યા છે તો કર્મ અને ભવિતવ્યતાએ જે બનાવ્યું તે ખરું. મારાં કર્મ જ એવાં હશે કે આમ બની આવ્યું એમાં પતિનો કે લોકોનો શો દોષ ? હવે તો મારે આવી પેટલું સાચવવાનું સારી રીતે બજાવવાનું.”

શું બજાવવાનું ? આ જ કે સેનાપતિને આશાસન આપવાનું કે તું સ્વામીની આજા બજાવે એ તારા માટે શોભતું અને હું પણ સ્વામીની આજા બજાવું એ મારા માટે શોભતું. વળી એ સ્વામીને કહેવાનો સંદેશો માગે છે. તો સંદેશો ધર્મના ઘરનો આપવાનો કષાયના ઘરનો નહિ.

ત્યારે જુઓ કે આટલી બધી પવિત્ર છતાં રામ તરફથી છેહ અને જંગલમાં એકલી અટૂલી તરછોડાઈ જવાની ભયંકર આપત્તિમાં સીતા શો સંદેશો આપે છે.

સંદેશ આ કે “લોકની નિંદાથી તમે મેન છોડી તો ભલે; પણ કાલે ઉઠીને લોકો તમારા ધર્મની નિંદા કરે કે રામે આવો ધર્મ કેમ રાખ્યો છે ?” તો એવી લોકની નિંદાથી ધર્મને છોડવામાં તો મારા કરતાં સવાયી પત્ની તમને મળી શકશે. અને એથી કાઈ તમારો મોક્ષ નહિ અટકે. પરંતુ આવો ધર્મ જો છોડવો તો એથી સવાયો તો શું પણ એની હરોળનો ય કોઈ ધર્મ નહિ મળે અને તમારો મોક્ષ અચૂક અટકી પડશે.”

સીતાજીએ ઘોર આપત્તિમાં શું શું ટાણ્યું ? :-

જુઓ કેવો સંદેશો ? મન કેટલું બધું સ્વસ્થ અને તત્ત્વ-રમણતાવાનું રાખ્યું હશે ત્યારે એક પણ હલકા બોલ વિના આટલા ઉંચા ઉમદા બોલ નીકળે ને ? ઘટના કેટલી બધી ગંભીર અણાંયિતી અને મહાદુઃખદ બની છે ? આ પરિસ્થિતિમાં હૈયું સ્વસ્થ રાખવું સહેલું છે ?

(૧) અત્યારે તો કેટલાય લોહી ઉકાળા ચાલતા હોય, (૨) વથાનો પાર ન હોય, (૩) દીનતા અપરંપાર આવી જાય, (૪) કલ્પાંત અને કાકલુદીભરી વિનંતી કરવાનું બને. (૫) પોતાના સાહસ માટે પારાવાર ખેદ થાય....પરંતુ નાં, એમાંનું કશું નહિ. અહીં તો એક જ હિસાબ છે કે ભવિતવ્યતાએ જે સરજ્યું તે બરાબર. કર્મ જે કર્યું તે વધાવી લેવાનું પછી કલ્પાંત શાનો ? હવે તો જે આવી પડ્યું છે એને બરાબર બજાવો; આજ એક ગણતરીએ ગણતરી પર સંદેશો દેવાનું આવી પડ્યું છે તો એ કામ બરાબર બજાવવાનું

માણસ અહીં ભૂલે છે. બીજાના ખરાબ લાગતા વ્યવહાર પર ઉકળાટે ચડી પોતે પણ ખરાબ વ્યવહાર આચરે છે. કર્મ અને ભવિતવ્યતાને જ આગળ કરે તો પોતાના ભાગે રહે તો સારો વ્યવહાર ન ચૂકે.

કર્મ અને ભવિતવ્યતાના અટલ સર્જન પર વિશ્વાસ મૂકાય. આશાસન લેવાય તો સહન કરવાનું સત્ત્વ જીલે, દિલ સમતોલ મન સ્વસ્થ અને હૃદય લેશ પણ ઉકળાટ વિનાનું રાખવા સત્ત્વ જગ્યા ઉઠે.

આમાં ભણતર-વિદ્ધના કે પદનો ડિસાબ નથી. જુઓ પેલો નોકર નહીંમાં ઝંપલાવતાં પેટમાં મોટો ઝીલો ભોકાઈ ગયો. આમ નહીંમાં જ ભયંકર મરણાન્ત કષ્ટ આવ્યું ત્યારે આ ઝંપલાવવાનું સાહસ થયું ને ? હવે શું કરે ? શું રોવા બેસે કે હાય ! આ સાહસ મેં ક્યાં કર્યું ? એમ રોવા જાય તો તો સાથે જ વેદનાનું રોદણું હોયવોય, આર્તધ્યાન સાથે જ લાગે. પછી એમાં મરતાં ગતિ કર્દી ?

સારા પણ મરુભૂતિ બનવાનું બન્યા પછી ભૂલ્યા તો ફેંકાઈ ગયા દુર્ગતિમાં.

પાર્શ્વનાથ પ્રભુ પહેલા ભવમાં મરુભૂતિ એક સારા શ્રાવક હતા, પણ મરીને તિર્યંગતિમાં હાથી કેમ થાય ? મરવા પહેલાં એ ગયા હતા તો અનાડી દુરાચારી ભાઈ કમઠને ખમાવવા માટે. રાજાએ ના પાઢેલી કે ‘આવા અનાડીની પાસે જવા જેવું નથી; છતાં હું આ ભાઈના દુઃખમાં નિમિત્ત કાં બન્યો ?’ એ બળતરાથી ખમાવવા ગયેલા એટલે સાહસ તો થયું જ. કેમકે જ્યાં જમીન પર મસ્તક નમાવી ખમાવે છે ત્યાં પેલાએ ગુસ્સામાં એમના માથા પર પથ્થરની શિલા ઠોકી, માથું ફૂટ્યું, મરવાનું આવ્યું.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૨૦, અંક-૨૪, તા. ૨૬-૨-૧૯૭૨

સાહસ પર આર્તધ્યાન સુલભ : તેથી તિર્યંગતિ સુલભ :-

મરુભૂતિ શ્રાવક સારા છે. દુષ્ટાચારી અનાડી પણ ભાઈને ખમાવવાની બુદ્ધિથી ગયેલા છે, પરદુઃખમાં પોતે નિમિત્ત બન્યા તેની બળતરાથી સાચું ખમાવી રહેલ છે. શું આવી ઉત્તમતાવાળા એ મરીને તિર્યંગ હાથીની ગતિમાં જાય ? પણ ગયા એ હકીકત છે. એ પરથી એમ લાગે કે એમને મરતાં આર્તધ્યાન થયું હશે. મનમાં એમ થયું હોય કે હાય ! રાજાએ તો સલાહ નહોતી આપી, ને મેં સાહસ ક્યાં કર્યું ? આમ તો સલાહ પર રોવાનું થાય એ શાથી ? શિલાથી માથું ફૂટવા પર ભયંકર પીડા દેનાર અશાતા કર્મનો અશુભ અનુબંધને લીધે અલબત ઉત્તમતાને લીધે કમઠ પર દ્રેષ તો ન કર્યો હોય, પરંતુ પીડાની હાય વોય થઈ હોય. દ્રેષ અને સામાને મારી ફૂટી નાખવાની બુદ્ધિ આવે તો તો એ રૌદ્રધ્યાન બની નરકમાં જ લઈ જાય. પરંતુ તેમ ન બનતાં તિર્યંગતિ પાચ્યા એટલે આર્તધ્યાનમાં મૃત્યુ થયું મનાય. આ સૂચ્યે છે કે સાહસ ન કરો. સાહસ પર આર્તધ્યાન સુલભ રહે છે. કારણ

સ્પષ્ટ છે:-

બની ગયેલ ખોટા સાહસ પર રોદણું સહેજે થઈ આવે છે. સાહસથી આવેલી પીડાની હાયવોયમાં મન લાગી જતાં પછી ભગવાનમાં, નવકારમાં, અંતિમ આરાધનામાં મન લાગતું નથી.

એ તો ઊંઘાડી વાત છે કે મન દુઃખની હાયવોયમાં હોય તો પરમેષ્ઠીને નમસ્કારમાં કે અરિહંતાદિનું શરણ ગ્રહણ કરવામાં, યા હુષ્ટગર્હા-સુકૃતાનુમોદનામાં ન હોય. મન એક ઠેકાણે હોય, બે ઠેકાણે નહિ. એક શુભ યા અશુભ બંને ભાવમાં નહિ. માટે જ આ સાવધાની રાખવા જેવી છે કે મન શુભ ભાવમાં રાખવું હોય તો અશુભ ભાવને મનમાં પેસવા જ ન દેવો.

મરવાના સમયે તો ભાવ અને ગતિનો ક્ષણ વારનો જ સોઢો હોય છે. એટલી ક્ષણ મનને મક્કમતાથી, અશુભ ભાવ રોકી, શુભ ભાવમાં રાખો જીવનબેડા પાર, જીવનનૈયા સદ્ગતિના કિનારે.

પેલા અર્હદ્વારાસના નોકરને આ આવક્યું, સાહસ થઈ ગયેલું, ખીલાએ પેટ ફાડી જાલિમ વેદના ઊભી કરી છે. પરંતુ હવે સાહસને રોવાનું નહિ. વેદનાની હાયવોય નહિ, એણે તો નમો અરિહંતાણની રટણા જ લગાવી. પાસે કોઈ નિર્યામજા કરાવનાર નથી, ‘ભાઈ ! જોજો હો, નવકારમાં ધ્યાન રાખજો, અરિહંતને જ યાદ કરજો’ એવું કોઈ કહેનાર છે નહિ પાસે. છતાં આપમેળે, નમો અરિહંતાણનું ધ્યાન; તે ય પેટ ચીરાયાની જાલિમ વેદનામાં કોડા કરે છે આ ? અભણ ગંમાર નોકર તે ય જનમનો જૈન નહિ, જૈનપણાના આચારનું પાલન નહિ, વ્યાખ્યાનો સાંભળેલા નહિ. તમે ? ભણેલા, શાણા, જનમથી જૈન જૈનાચાર પાળનારા, વ્યાખ્યાનોના શ્રોતા, તો પછી તમારાં મનમાં કેટલું રટણ અરિહંતનું જોઈએ ? આપત્તિમાં તો ખાસ કેવું રટણ જોઈએ ? ઘ્યાલ આવે છે કાંઈ ?

સારાસારીમાં ય ‘નમો અરિહંતાણં’ નું ધ્યાન જો મોંઘું પડે છે, પછી કપરી સ્થિતિમાં એ સસ્તું-સુલભ ક્યાંથી થશે ?

બોલો, દિવસમાં કયાં કયાં અને કેટલીવાર અરિહંત યાદ આવે છે ? યાદ લાવવા હોય તો જ્યાં જ્યાં કંઈ સારું અનુકૂળ મળી આવ્યું મનગમતું બની આવ્યું ત્યાં ત્યાં શું એમ યાદ આવે ખરું કે આ મારા અરિહંત પ્રલુના પ્રભાવે બની આવે છે. પૂર્વ એમની ભક્તિ કરી હશે તેથી આ બની આવે છે; તે ભક્તિનો વિષય બનેલા એમના પ્રભાવે જ આ બને છે. એમની મહેર ઊતરી રહી છે. નમો અરિહંતાણં. અરિહંતા મેં સરણાં...’

આ યાદ કરવાની ટેવ પાડો કે વારે વારે અરિહંત યાદ આવે. પેલા નોકરે,

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૨૧૮

જાણો છો ને, વારે વારે ‘નમો અરિહંતાણં’ યાદ કર્યું છે.

સારાસારીમાં બહું યાદ કરેલો નવકારઆદિ કપરા સમયે જલ્દી યાદ આવવો સુસંભવિત છે. નદીમાં પડતું મૂક્યું તે ય ‘નમો અરિહંતાણં’ ના રટણ સાથે સંભવ છે, એવો વિચાર હોય કે ‘નદીમાં પૂર છે, કદાચ કાંક થઈ જાય તો ? માટે આ ન ભૂલવા હે. આમે ય આ તો મારે ખરેખરો મંતર છે.’ આવી સમજ સાથે પડતું મૂક્યું હોય, પછી ખીલે પેટ ફાટવાની આપત્તિ આવી તો ય શું ? એ મંત્ર નથી. ભૂલવાનો. અરે ! પૂરમાં તથાઈ ગયો હોત તો ય આ જ યાદ કરવાનું હતું તો પછી એના બદલે પેટ ફાટ્યું તો ય આ જ રટણ હોય ને ? આમ પહેલાં એને આપત્તિની સહેજ કલ્પના હોય, ને આપત્તિ આવી તો અસામાધિ- હાયવોય ન કરતાં એ રટણ રહી.

નોકરની પરિસ્થિતિ અને વૃત્તિનું વિશ્લેષણ (Analysis) કરો તો આ પ્રશ્નનો ઉત્તર ઘ્યાલમાં આવશે કે.

મરુભૂતિને અરિહંતની સારી રટણ છતાં અંતે એ કેમ ભૂત્યા ? :-

પ્ર.- એમ તો મરુભૂતિ સારા શ્રાવકે જીવનમાં અરિહંતને સારા યાદ કર્યા હશે, છતાં અંત સમયે કેમ ચૂક્યા ?

૩.- એનું આ કારણ કહી શકાય,-

મરુભૂતિ સારી બુદ્ધિથી ખમાવવા ગયેલા, પરંતુ કલ્પના નહોતી કે આવી આપત્તિ આવશે. બહું તો કદાચ મનને એમ હોય કે હું ખમાવું ને સંભવ છે ભાઈને ન ગમે, કડવા શબ્દ બોલે પણ તેથી મારે શું ? મારે તો મારું દિલ ફોરું કરી દેવું. મારે ખમાવવાની ફરજ બજાવી લેવી.’ બસ, ‘ભાઈ કમઠ તરફથી બહું તો કર્કશ શબ્દની આપત્તિ આવે,’ મરુભૂતિને મનમાં આટલું જ આવ્યું હોય ત્યાં બીજી કોઈ ભારે આપત્તિની કલ્પના નથી ને ભયંકર આપત્તિ આવી. હવે શું કરવાનું ? ખમાવવાની બુદ્ધિ છે. એટલે સામા પર દ્રેષ્ટ ન થાય; પણ જ્યાં શરીર પર ભયંકર આપત્તિની કલ્પના જ નથી. ને આપત્તિ આવી, તો એની ચિંતા ગલાનિ-હાયવોય થવાનો પૂરો સંભવ છે. અલબત હાયવોય થાય જ એવો નિયમ નથી, પણ થઈ જાય અને તેથી અરિહંતની રટણ ભૂલાઈ જાય તો એ સહજ છે ત્યારે પેલા નોકરને નદીના પૂરના હિસાબે આપત્તિની કલ્પના હોય તેથી આપત્તિ આવતાં રટણ ન ભૂલાય.

અણાંથી આપત્તિમાં દુર્ધાન-અસમાધિનો સંભવ છે, માટે જો પહેલેથી આપત્તિનો સંભવ ચિંતવી રાખ્યો હોય, તો આપત્તિ આવતાં અસમાધિથી બચાય. આ સંસારમાં આપત્તિની સંભાવના ધારી રાખવી જરૂરી છે. મનને આ બેઠેલું જ

૨૨૦ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“અનુબંધ એટલે” (ભાગ-૪૪)

હોય કે સંસાર આપત્તિઓનો ભરેલો છે. એમાં આપત્તિની નવાઈ નથી.

આત્માના ખજને કોને ખબર આપત્તિદાયક કેવાં ય કર્મ પડ્યાં હોય, અને કેવા અણધાર્ય સમયે એ કેવાંય ઉદ્યમાં આવી જાય ?

ભવિતવ્યતાના ઘાટ કલ્પનાબહારના હોય છે. એ કેવો ય વિચિત્ર યોગ સરજે ને કેવી ય આપત્તિ ખરી થાય ?'

જગતના સારા સંયોગે-સંયોગમાં આપત્તિ સંભવિત છે.

તેથી બધે એની ઘટતી ધારણા કરી શકાય છે. આમ, આપત્તિ સહેજે ધારી રાખેલી હોય તો બે જ્યાં સુધી કોઈ આપત્તિ ન આવી તો ત્યાં સુધી આ ધારણા અંગે કોઈ નુકશાન નથી. પરંતુ જો કોઈ આપત્તિ આવી તો એ અણચિંતી નહિ બને, મન માનશે કે મેં તો ધારેલી જ હતી. તો જો હવે એ આવી છે તો મુંજવણ હાયવોય કરવાની જરૂર નથી. અરિહંતની કે નવકારનીરટણા રાખવા દે.'

અણચિંતી આપત્તિમાં તો હાયવોય અસમાધિનો સંભવ છે. માટે જો આપત્તિની સંભાવના રાખી મૂકી હોય તો બહુ ઉપયોગી નીવડે છે. જો એવી સંભાવના ન રાખતાં હૈયું નિશ્ચિત રાખ્યું હોય કે આપણે કાઈ વાંધો નથી; તો પછી એકાએક આપત્તિ આવી પડતાં ચિંતને કલેશનો પાર નથી રહેતો. મનને એમ થાય છે કે 'અરેરે ! આ આપત્તિ ક્યાં આવી ? મારે આ હુંબ ? હવે શું કરું ? હાય ! મારા ગ્રહ કેવા નબળા ?.....' આમ હાયવોય વિઝ્વળતાનો પાર નહિ. આના બદલે જો પહેલેથી જ આપત્તિની સંભાવના રાખી હોય તો એ આવી પડતાં મન કહે છે કે એ તો હું આરતો જ હતો કે આપત્તિ કદાચ આવે. હવે એ આવી તો ભલે આવી; સંસાર જ એવો છે, આપત્તિઓનો ભરેલો છે. પછી ત્યાં ખેદ શો કરવો ? મને અરિહંત-સિદ્ધ-સાધુ-ધર્મનું શરણ લેવા દે. 'અરિહંતા મેં સરણાં' સિદ્ધા મેં સરણાં....નમસ્કારમંત્ર રટવા દે.'

આપત્તિની પહેલેથી સંભાવના રાખવાથી આમ ચિંત હાયવોયમાં નથી પડતું; અને શરણસ્વીકાર દુષ્કૃતગર્હ સુકૃત-અનુમોદના તથા મહામંત્રસમરણ વગેરે કર્તવ્ય લાગે છે. ત્યારે એ જુઓ કે આપત્તિની સંભાવના ક્યાં નથી ?

કેવી કેવી આપત્તિની સંભાવના :-

દા.ત. શરીર સાદું રૂપાણું નિરોગી અને બળવાન મળ્યું છે. પરંતુ કોઈ રોગ અકર્માત યા વયની અવસ્થાથી એ નરસું કદુપુ થવા સંભવ છે; એમ રોગિષ અને દૂબળું બનવા ય સંભવ છે.

એમ આરામી સુખાકારિતા અલ્પઆયાસ સારી મળેલ છે, પરંતુ જીવનના સંયોગો ફરી જાય, તો ધંધા વગેરેમાં વધુ મહેનત કરવી પડે, એ સંભવિત છે.

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

બેનોને પરિવાર વધી જાય તો પણ એવો સંભવ.

એમ, પૈસા ઠીક મળ્યા છે; કે મળી રહે છે. પરંતુ આજે, જુઓ છો ને કે સરકાર કેવા કેવા ટેક્ષ નાખે કેવા કેવા કાયદા લાવે છે ! અમલદારોની જોહુકુમી કેવી વધે છે ! બજારના સંયોગ કેવા ફરી જાય છે મોંઘવારી અને અછત કેવી વધે છે !....આમાં પૈસા અને આવકને આપત્તિનો સંભવ ક્યાં નથી ?

એમ, આબરૂ પ્રતિષ્ઠા સારી ચાલતી હોય, સન્માન સારાં મળતાં હોય, પરંતુ કોને ખબર કાલે કેવાં અશુભકર્મ ઉદ્યમાં આવે ? સીતાજીને અણચિંત્યા કર્મ ઉદ્ય આવ્યા ને ? અથવા કદાચ પોતાના હાથે એવું ખોઢું સાહસ થઈ જાય, કોઈ ભૂલ-ગફલત થઈ જાય, તો આબરૂ જવાનો સંભવ છે, પ્રતિષ્ઠા હલકી પડવાનો સંભવ છે. એમ કોઈ વિરોધી જ પાકે, દીકરો જ નાદાન અને આહુઅવળું કરનારો નીકળે, અને આપણી પ્રતિષ્ઠા હલકી પડે એ પણ સંભવિત છે.

ત્યારે છોકરો આવી મળ્યો. પણ હરક હરક શાનો કરાય ? કોને ખબર એનું આયુષ્ય કેટલું હોય ? વહેલા મૃત્યુનો સંભવ કેમ નહિ ? અગર આપણે જ વહેલું જવાનું થાય ત્યારે પણ એની કાચી વય વગેરે કારણે આપણને મરતાં પારાવાર વિઝ્વળતાનો સંભવ છે. અથવા છોકરો બિમાર રહ્યા કરવાનો ય સંભવ; યા ગંભીર બિમારીનો કયારેક ભોગ બનવાનો, અથવા મૂર્ખ ઉદ્ધત ઉલ્લંઠ નીકળવાનો, કોઈ ખોઢું સાહસ અવળંગાઈ કરી સરકારી કે એવા કોઈ ફાંસલામાં પડવાનો, અથવા એની વહુ સાસુના માથે છાણાં થાપે એવી આવવાનો,...આવી એક યા બીજી આપત્તિ આવવાનો સંભવ છે.

એમ, વિદ્વત્તા હોશિયારી સારી મળી હોય, પરંતુ એમાં પણ શેરને માથે સવાશેર કોઈથી પદ્ધાડ ખાવાનો કે પાછા પડવાનો અથવા કોઈ રોગ વિશેષથી જીાનતંતુ નબળા પડી જવાનો, કે હોશિયારીના લીધે જ કશું કરવા ગયા ને ઉપાધિ-ફસામણી આવી પડવાનો સંભવ છે.

એમ પત્ની સારી મળી, પરંતુ કાલે એના ભાવ બદલાઈ જવાનો, યા બિમાર પડી જવાથી સેવાકરીને બદલે સેવાગ્રહી બનવાનો અથવા આપણા તેવા કોઈ બોલથી એનું હંદ્ય ભાંગી જવાનો કે પુત્રવધુના ત્રાસથી એ હેરાન હેરાન થઈ જવાનો, યા પત્ની પોતે જ પુત્રના પક્ષમાં પડી આપણી વિરોધી થવાનો...આવો આવો આપત્તિનો સંભવ છે.

આમ, સંસારમાં આપત્તિની સંભાવના ક્યાં નથી ? એ સંભાવના જો પહેલેથી સમજ રાખી હોય તો આપત્તિ આવી પડતાં હાયવોય ન થાય.

બાકી જો પહેલેથી મનમાં નિશ્ચિતતા જ રાખી અને પછી અણચિંતી આપત્તિ

આવી, તો તો હાયવોય, અસમાધિ કલ્પાંત વિદ્ધવળતા કખાયો વગેરે કેટલું ય થવાનો સંભવ છે.

અજાંચિતી આપત્તિ આ ખરાબીઓ સરજે છે. માટે તો શાસ્ત્રકારોએ સાધુને પણ એવા પ્રસંગ ઊભા થવાના સંયોગમાં મૂકાવાની ના પાડી છે. દા.ત. ગામમાં મારી-મરકી-અશિવનો કે સાપ આગ વગેરેનો ઉપદ્રવ થાય તો ચોમાસામાં પણ ત્યાથી વિહાર કરી જવાનું કહ્યું. એમ વિશેષ જ્ઞાનીના વિહાર કાળમાં અમર્યાદિત અનાગાર અનશન કરવાની ના પાડી. ઉપવાસના પચ્ચકખાણ પણ એક સાથે વધુમાં વધુ સોળ જ ઉપવાસનાં કરાવવાનું રાખ્યું આ બધાની પાછળ શો હેતું છે ? આ જ કે એમ ન કરતાં સાહસ કરવા જાય તો અજાંચિતી આપત્તિ આવતાં અસમાધિ દુર્ધર્ણન સંકલ્પ થાય, એ સૂચવવું છે. માટે જ અજાંચિતી આપત્તિ લાવનારા સાહસ કરવા ના પાડી.

મોટી આપત્તિ વખતે ચિત્તમાં સમાધિ રાખવાનું, ચિત્ત સ્વસ્થ ને હાયવોય વિનાનું રાખવાનું બધાનું ગજું નહિ. છતાં વગર નોતર્યે આપત્તિ કદાચ આવી પડે તો શાંતિથી સહી લેવાય એટલા માટે પહેલેથી નાના નાના પરિસહ સહન કરવાનો અભ્યાસ પાડવાનો છે. ભૂખ લાગી છે અને ખાવાનું તૈયાર થવાને થોડી વાર છે, તો શાંતિથી સહન કરવાનું શીખો. તરસ લાગી છે, ને પાણી મળતાં વાર છે, તો શાંતિથી સહવાનું શીખો. ઠંડી પડી પણ ઓફવાનું ઓછું મળ્યું છે. અથવા ગરમી પડી પણ શીતળ હવા છે જ નહિ તો શાંતિથી સહી લો. કોઈએ આકોશ કર્યો અપમાન અવગાશના કરી, માખી મદ્દર વધી ગયા, તે વિનાનું સ્થાન મળતું નથી, રોગ તાવ વગેરે પીડા આવી તરત જ મટે એમ નથી,... ઈત્યાદિ પ્રસંગમાં ચિત્તને રાગદ્વષ બેદઉદ્દેગ ન થવા દેતાં શાંતિ રાખી સહવાનું વધાવી લો તો આપત્તિમાં સમાધિ રહે એવો અભ્યાસ પડશે.

પ્ર.- પરંતુ એવું સહવાનું કેમ બની શકતું નથી ?

ઉ.- આવા નાના નાના પરીષહો સહવાની ચાવી આ કે વિચારવું,

(૧) સહું એટલું પાપકષ્યના લાભમાં છે.

(૨) સહવામાં સત્ત્વ ખીલે છે. વ્યાકુળ થવામાં સત્ત્વ હણાય છે.

(૩) મહાપુરુષોએ ભયંકર સહું છે ને હું એમના ખાનદાનનો છું તેથી ન સહું તો ખાનદાની લાજે.

(૪) આટલું નહિ સહું તો આગળ પર મોટી આપત્તિ શે સહીશ ?

આમ, વિચારતા રહી નાની નાની આપત્તિ પીડા તકલીફ આકુળ વ્યાકુળ થયા વિના શાંતિથી સમાધિથી સહી લેવાની જરૂર છે. પછી આમ તો મોટી

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

આપત્તિ ચાહીનો ઊભી ન કરીએ, પરંતુ અચાનક આવી પડે, તો પેલા નાના કષ વખતના સમાધિના અભ્યાસથી અહીં સમાધિ રાખવા પ્રયત્ન થાય.

બાકી ખોટાં સાહસ કરીને મોટી આપત્તિ વહેરવાની નથી તેમ એમ જ સાહસ કર્યા વગર જ મોટી આપત્તિ આવી પડી તો એનાં રોદણાં, કે હાયવોયમાં ન પડતાં, શાંતિ સમાધિ માટે આ વિચારવાનું કે બન્યું તે બન્યું હવે એને રોવાને બદલે વર્તમાનનો સહુપયોગ કરી લાઉં.

સમાધિ માટે વર્તમાનનો સહુપયોગ આ, કે (૧) નવકારમંત્ર પંચપરમેષ્ઠીને નમવા સાથે રટાય, (૨) શુભ ભાવનાઓ કરાય, (૩) મહાપુરુષનાં ચિરિત્ર યાદ કરાય.

મરુભૂતિ એ ભૂલ્યા, પેલા નોકરે આ કર્યું, નમો અરિહંતાણનો અભ્યાસ રાખેલો હતો, એટલે ખીલાથી પેટ ફાટતાં જ એની રટાય લગાવી હાય નહિ, વોય નહિ, અરિહંતને નમસ્કાર, અરિહંતનું શરણ, પેલા મહાત્મા કડકડતી ઠંડીમાં આખી રાત્રિભર કેવું સહન કરતા હતા એની અનુમોદના બસ, આમાં નોકર-કાળ-કરીને એ જ પોતાના-શેઠના-દીકરા-તરીકે જનખો એ જ સુદર્શન શેઠ. નવકારમંત્ર અરિહંતશરણ અને સુફૃત-અનુમોદનાનો પ્રભાવ કેવો ? એથી બની ગયેતી વસ્તુને ન રોતાં વર્તમાનને સમાલી લેવાનો પ્રભાવ કેવો ?

સુદર્શન શેઠનાં પરાક્રમણને તો જાણો છો ને ? ઊંચું શ્રાવકજીવન, ઉચ્ચ સદાચાર, મિત્રપત્ની કપિલાએ એકાંતમાં ફસાવી લોભાવ્યા છતાં જરાય લોભાવ્યા નહિ. હું તો નપુસક છું કહી બહાર નીકળી ગયા. વળી શ્રાવક જીવનમાં પર્વતિશિઅ પોષધ, તે પણ ક્યારેક ગામ બહાર શૂન્ય ઘરમાં રાત્રિભર ધ્યાનના અભિગ્રહ સાથે પોષધ આ પણ મહાપરાક્રમ છે.

એમાં અભ્યારાણીએ સુદર્શનને પોષધ-ધ્યાનમાં રહેલાંને ઊંચકાવી પોતાના મહેલનાં એકાંતમાં મંગાવી ફસાવ્યા, લોભાવ્યા, ફાવે એવા હાવભાવ ચાળા કર્યા, ચેષ્ટાઓ કરી, છતાં સુદર્શન શેઠને એક રુંવાડેય વિકાર નથી, નિર્વિકારપણે અભિગ્રહવાળા ધ્યાનમાં ઊભા છે. જોવા જેવું છે મહેલમાં એકાંત છે, રાજાની રાણી એટલે સૌઢર્ય, વેશ વગેરે કેવા હોય ? પાછી એ લુબ્ધ થઈ વિનવણી કરે છે. એમાં એ ચેનચાળા કરવામાં શું બાકી રાખે ? વળી રાતનો સમય એટલે વિકારનો સમય છે. આ બધું છતાં સુદર્શન શેઠને રુવાડે વિકાર નથી. કેટલી બધી આત્મ-મગનતા ! કેવી આત્મ-સ્વરૂપ દસ્તિ ! કેવું વીતરાગ પરમાત્મા ચિંતન ! એમ ને એમ તો વિકારવશ ન થતાં આ રાખવું હજી ય સહેલું છે, પરંતુ લોભાવનારું નિમિત્ત મળતાં વિકાર ન જાગવા એ કઠિન છે. માટે જ સુદર્શન શેઠનું આ

૨૨૪ સુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“સુદર્શન શેઠનાં પરાક્રમણે” (ભાગ-૪૪)

સંયોગમાં નિર્વિકાર રહેવાનું ગજબ પરાક્રમ છે ! આમાં રાણી હવે મોટો ભય આપી માની જવા કહે છે. છતાં એ ભયની જરાય ગભરામણ નહિ, લેશમાત્ર વિકાર નહિ, મનથી પણ સહેજે ય આચાર ભણ થવાની વાત નહિ, કેટલું ગજબ પરાક્રમ ?

પછી તો રાણીએ ખોટી હે હો હા કરી મૂકી, સુદર્શનને પકડી રાજા પાસે લઈ જવાયા. રાણીએ આરોપ ચડાવ્યો. રાજા શેઠને હીકીકત પૂછે છે પરંતુ સાચી હીકીકત કહેતાં, રહે ! રાજા તરફથી રાણીને દુઃખ આવે તો ? એ હિસાબે સુદર્શન શેરે મૌન પકડ્યું : રાજાએ શૂળીએ ચડાવવાની સજા કરી છતાય મૌન કેટલું ! ગજબ પરાક્રમ ?

સિપાઈઓ શેઠને અપમાનિત રીતે નગર વચ્ચેથી લઈ જાય છે, લોક શેઠની નિંદા કરે છે, છતાં ય અને શેઠને છેવટે ઉભી અણીદાર શૂળી પર લઈ જઈ બેસાડે છે. છતાં પણ લાવ હવે તો જઈને રાજાને સત્ય હીકીકત કહી દેવા દે ?' એવું મન સરખું થતું નથી ગજબ પરાક્રમ ?

આ બધાં પરાક્રમએ કોનું ફળ-? કહો પૂર્વ ભવની નમો અરિહંતાણાંની રટણાનું. અરિહંત સાધુના શરણ લીધાનું. સાધુ મહાત્માનાં સુકૃતની અનુમોદના કર્યાનું અને અકાળ દુઃખદ મૃત્યુ જેવી આપત્તિ વખતે પણ એ જ રાખ્યાનું.

નિમિત ખરાબ આવી પડે ત્યાં રાગ-દ્રેષ્ટથી, હર્ષ-ખેદથી, સંકલ્પ વિકલ્પ-આકુળતા વ્યાકુળતા અને વિકારથી બયનું છે ? તો આ કરો, અરિહંતાદિ ચારાનું શરણ વારંવાર સ્વીકારો, વારંવાર મહાપુરુષોનાં સુકૃતની અનુમોદના કરો, જગતની દીનતા-પામરતા-રાગ-મોહ વગેરે દુષ્કૃતોની નિંદા-ગર્હણ-ઘૃણા કરો.

જાતની ત્યાગ તપમાં કાયરતાને રુઓ, પણ ગર્વ ન કરો :-

શું સમજ્યા ? જાતની ગર્હણ-નિંદા-ઘૃણા કરવાની જાતની પામરતા રોવાની, પણ ત્યાગ-તપ-કષ્ટ-વગેરેમાં કાયરતા પામરતા રાખી ઉપરથી અભિમાન નહિ કરવાનું, અને જ્ઞાનીના કહેલા માર્ગની ઉપેક્ષા-અવગણના નહિ કરવાની. અભિમાન શું ? અભિમાન આ, કે હું કાંઈ કાયર નથી, પામર નથી, ત્યાગ-તપ નહિ, તો બીજું દાન-જ્ઞાન-ધ્યાન કરું દ્યું ને ? આ વિચારણા આ માન્યતા, આ બોલ, એ અભિમાનના છે. એમાં કાયરતાના દુષ્કૃતની નિંદા-ગર્હણ નથી ત્યારે નિમિતમાં રાગાદિથી બચાવનાર દુષ્કૃતની નિંદા-ગર્હણ નથી. ત્યારે નિમિતમાં રાગાદિથી બચાવનાર દુષ્કૃતગર્હણ છે. એ વિના કેમ ચાલે ?

「ધાર્મિક વાંચન」

નિમિતોમાં રાગદ્રેષ અને હર્ષ-ખેદથી બચાવનાર વળી એક ઉપાય ખૂબ ખૂબ ધાર્મિક વાંચન છે; ધાર્મિક શ્રવણ છે.

એટલું ધ્યાનમાં રહે કે એ વાંચન કરતાં સહેજ પણ શૃંગાર વિલાસનું એક નાનું વાક્ય પણ વાંચવામાં ન આવી જાય એવું નાનું ચિત્ર પણ દેખાવમાં ન આવી જાય. નહિતર એટલું પણ ખતરનાક છે, કે બીજા સારા વાંચનની અસર દ્બાવી દેશે; કેમકે અનાદિનો અભ્યાસ એવા શૃંગારદિ ઊંધાનો છે. એને તો જરાક નિમિતે મળતાં એ ઉત્તેજિત થતાં વાર નહિં. આજે તો શૃંગારી વાંચન બહુ વધી ગયું. આજની નવી પ્રજાનું એમાં મોત થઈ રહ્યું છે. આજના ધાર્મિક પણ લેખ-કથા-લખનારે આ પરિસ્થિતિ ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે; અને લખાણમાં સહેજ પણ શૃંગારી, વિલાસી-વાસનોતેજક ન આવી જાય એની ખાસ તકેદારી રાખવા જેવી છે. સામાં વૈરાગ્ય અને બ્રહ્મચર્યની ભાવના જગાવી શકવાની તાકાત નથી. પછી વાસનોતેજક વિલાસી લખીને સામાનું શું ભલું કરી શકવાના ?

થોડાં શૃંગારી લખાણ આકર્ષણ કરાય ? :-

માણસ અહીં ભૂલ ખાય છે; એ સમજે છે કે પ્રજા બહારનું શૃંગારી વાંચવાના રસવાળી છે, માટે અનું આકર્ષણ કરવા અને જાળવવા આપણે પણ ધાર્મિક લેખન કે ભાષણમાં થોડું શૃંગારી પીરસો એથી વાંચશે-સાંભળશે.' પરંતુ અહીં એ જોવાનું છે કે એ થોડું પણ શૃંગારી વાંચી-સાંભળીને સામાં જે બૂરી અસર ઊભી થઈ, એને તરત બૂંસી નાખી વૈરાગ્યની કામ-ઘૃણાની બ્રહ્મચર્યની જવલંત અસર ઊભી કરવાની તમારામાં તાકાત છે ? જો લેખન ભાષણથી એ કરી શકતા નથી, તો પેલી બૂરી અસરથી સામાનું કેવું મોત થશે ? એના કરતાં એવું ન બોલવું ન લખવું શું ખોઢું ?

આજની ધાર્મિક ગણાતી નોવેલ-નવલિકાઓથી આમ ચેતતા રહેવા જેવું છે. લેખકને વૈરાગ્યના વિષયને મહેકાવતાં જે નથી આવડતું એ વિલાસના વિષયને મહેકાવતાં આવડે છે. એવાં લખાણ વાંચીને શું મળવાનું ? અનાદિની વાસનાને ઉતેજન ? કે એનો છાસ મળવાનો ?

શાસ્ત્રોમાં શૃંગારના વર્ણન છે, પરંતુ :-

એથી પૂર્વચાર્યોની લખેલી ચરિત્ર કથાઓ વાંચવી સારી. ઉપમિતિશાસ્ત્રમાં સંસારી જીવને આકર્ષવા અર્થકથા કામકથાનું થોડું ભાષણ આવ્યું છે, પણ પછી તરત જ ધર્મકથા ધર્મપુરુષાર્થના વિષયને એવો મહેકાવ્યો છે કે પેલી અર્થવાસના

કામવાસના બિચારીના મહત્વના ભાગીને ભુક્કા કરી નાખ્યા છે.

સજાયોમાં ય, વિરાગી દીક્ષાથીને દીક્ષા ન લેવા માટે માતા કે પત્નીએ સમજીવતાં સંસારના સુખ વિલાસની લાલચો બતાવેલી વર્ણવી છે. પરંતુ પછીથી દીક્ષાથીઓએ દાખવેલા સુખસાધનાની નાશવંતતા અને ભયંકર દુઃખદાયિતા તથા વિલાસોની બિભત્તસતા અને ફળમાં ભવભ્રમણ વગેરે એવાં વર્ણવ્યાં છે, કે એ સાંભળનારનું કલેજું કંપી થરથરી ઉઠે.

શાસ્ત્રોમાં પણ રાજ્યાઓ અને શેઠ શાહુકારોનાં સુખનાં વર્ણન પછી એની પાછળના ભયંકર દુઃખના વર્ણન એવાં કર્યા છે કે એ સાંભળતાં દિલ ધૂજુ ઉઠે, સુખસાહ્યબી-રંગવિલાસ ભતરનાક સમજાય.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૨૦, અંક-૨૫, તા. ૪-૩-૧૯૭૨

પરંતુ જો આવો ધૂજરો કરાવવાની તાકાત ન હોય અને વિલાસનાં મહેકાવનારાં વર્ણન કરે, તો એ શ્રોતા કે વાંચકને શું આપે? સંસારના જીવો આમે ય અનાદિના કુસંસ્કારોથી ઈંડ્રિયોનો વિષયો પાછળ પાગલ તો છે જ, એમાં વળી એને અર્થ કે કામનાં ગળચટાં વર્ણન સાંભળવા રૂપી દારુ પીવા મળે, પછી પાગલતા કેવી ફાલેકૂલે? એમાં એના કેવા સત્યાનાશ સરજાય? માટે,

સંસારના વાસનાદ્વારા જીવોની તો દયા ખાવા જેવી છે.

એની વાસના કેમ મોળી પડે, એના કષાયો કેમ શરે એવા જ પ્રયત્ન કરવા જેવા છે. એને એવાં જ ભાષણ કે લખાણ પીરસવા જેવા છે. આવાં પ્રવચન કે લખાણ ધાર્મિક ગણાય. એવાં ધાર્મિક પ્રવચનનાં શ્રવણ અને એવાં ધાર્મિક લખાણનાં વાચનથી નીતરતા વૈરાગ્યનો સારો રસ ઊભો થાય, એવાં શ્રવણ વાચનમાં સારો પરોવાયો રહે તેથી અસત્ત નિમિત્તોમાં તશાવાનું ન થાય.

નિર્દ્ય ઘાતકી અને ફૂર, એવા પણ મોગલ સપ્રાટ અકબર બાદશાહને જગદ્ગુરુ હીરસુરીશ્વરજી મહારાજ પાસેથી સતત એવું શ્રવણ મળ્યું તો એ શ્રવણે બાદશાહને પલાળી નાખ્યો, દયાળું અને કોમળ દિલનો બનાવી દીધો.

અઢાર દેશના રાજા કુમારપાળને એવાં શ્રવણ તથા યોગશાસ્ત્ર વગેરેનાં વાંચને જબરદસ્ત ધર્મત્વમા શ્રાવક ઉપરાંત જિનશાસનનો ભારે મોટો પ્રભાવક બનાવી દીધો. એમને એ વાચન અને એનાં મનનમાં એવી લયલીનતા લાગી કે ખોટાં નિમિત્તોથી રાગ-દ્રેષ્ટ-તૃષ્ણા લાલસા વગેરે જાગવાનું સૂક્ષ્મ ગયું. એવા ગજબના શુભ સંસ્કાર અને પુણ્ય ઊભાં થઈ ગયા કે અહીં સાહુજીવન નહિ પામેલા, સાધુને

ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો: ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૨૨૭

જ યોગ્ય એનાં શાસ્ત્ર નહિ ભણેલા, છતાં એ હવે આવતી ચોવીસીમાં પહેલા ભગવાનના ગણધર બનશે! અને માત્ર ત્રિપદી પરથી સ્વયં દ્વાદશાંગી આગમોની રચના કરશે! તેમ એ જ ભવમાં મોક્ષ જશે! અને માત્ર ત્રિપદી પરથી સ્વયં દ્વાદશાંગી આગમોની રચના કરશે! તેમ એ જ ભવમાં મોક્ષ જશે! ગુરુવાણી શ્રવણ તથા યોગશાસ્ત્ર વગેરે ધાર્મિક શાસ્ત્રોનાં વાંચનનો કેટલો બધો પ્રમાણ?

નિમિત્તોમાં રાગ-દ્રેષ્ટ-કામ-કષાયોથી બચવા માટે આ પણ એક ઉપાય છે કે દિલના ઉછળતા ભાવ અને જાણણાટી સાથે ધાર્મિક આચાર-અનુષ્ઠાન-તંત્ર-નિયમ વગેરે ખૂબ આચરવા.

એથી લાભ આ, કે

(૧) જીવ એમાં ગુંથાયેલો રહેવાથી એવા શુભ સંસ્કાર પામે છે કે જે ક્યારેક આવી પડતા અસત્ત નિમિત્તમાં અને શુભ ભાવના અને શુભ વિચારો કરાવે છે.

(૨) બીજું એ, કે એમાં ગુંથાયેલો હોઈ એવાં નિમિત્તોમાં ઈંડ્રિયો કાયા કે મન લઈ જવાની અને કુરસદ પણ નથી. જીવન-નિર્વાહ અને કુટુંબ સંચાલન પૂરતું એવા સંયોગોમાં મૂકાવું પડે ત્યાં પણ દિલ બબરદાર સાવધાન અને જાગતું રહે છે. પછી નિમિત્ત અને શું કરી શકે? એનામાં શી ખરાબી ઊભી કરી શકે.

મન સ્વર્ચ રાખનારી શુભ ભાવનાઓ

જીવન જીવતાં આવડે, તો દુઃખ ગયું :-

જીવન બહુ ટુંકુ છે, એમાં મળેલું મન બહુ નાજુક છે; નાજુક મન જરા જરામાં મોટા ભાગે અશુભ વિચારવાનું, લાગણીવાનું અને અશુભ ધ્યાનવાનું બની જતાં વાર નથી લાગતી, અને એની ભાવી અનેક ભવો માટે ગંભીર અસરો ઊભી થાય છે ટૂંકા જીવનમાં મનની આ પ્રવૃત્તિ જે સતત ચાલુ રહે છે એનાં પરિણામ ભવિષ્યના દીર્ઘ કાળ સુધી ભોગવવાના રહે છે. આ પરિસ્થિતિમાં વિશેષ સાવધાન તો આના અંગે રહેવા જેવું છે કે મન અશુભ વિચારો, અશુભ લાગણીઓ અને અશુભ ધ્યાનમાં ન રમ્યા કરે. એથી એવાં ચીકણાં અશુભ કર્મ અને ભયંકર કુસંસ્કારો નહિ ઊભા થવાથી પરલોક એવો બગડતો નથી, એ લાભ તો છે જ ઉપરાત્ અહીં પણ જીવન એવું દુઃખ નથી બનતું.

ભૂલશો નહિ, જીવન ગરીબાઈ રોગ વગેરેથી જે દુઃખ નથી બનતું એ ચિત્તનાં દીનતા ઈર્ષ્ય સંકલ્પ વિકલ્પો આકુળતાવ્યાકુળતા અને આર્તધ્યાનથી બને છે. ગરીબી છતાં પણ જે દીનતા નથી. આકુળવ્યાકુળતા નથી તો માણસ એવો દુઃખી નથી. ચિત્તની સ્વસ્થતા જબરદસ્ત કામ કરે છે. ત્યારે જીવન જીવવાની કળા

૨૨૮ સુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“ધાર્મિક વાંચન” (ભાગ-૪૪)

આવડતી હોય તો આ ચિત્ત સ્વાસ્થ્ય ગમે તેવા બાબુ સંયોગોમાં ઊભું રાખી શકાય છે.

જીવન જીવવાની કણા શી ? આ જ , કે હર્ષ-દીનતા-ઈર્ષા-સુદ્રતા-અહેંકારાદિ કષાયો વગેરેને અટકાવવા એથી ચિત્તની આ સ્વસ્થતા ઊભી રાખી શકાય છે. ને તેથી દુઃખ ગયું.

નિમિત્તોનો લીધે ચિત્ત બગડે છે. ગરીબ કે રોગી પણ માણસ જ્યારે કશા કામમાં વગે હોય છે. ત્યારે જો એ ગરીબી વગેરે નિમિત્તો પર ધ્યાન નથી જતું તો એ વખતે મનમાં આકૃપતાવ્યકૃપતા દીનતા વગેરે નથી સ્કૂરતાં, તો એ વખતે દુઃખ નથી લાગતું. એ બતાવે છે કે ગરીબી કે રોગ હ્યાત છતાં ચિત્ત જો કલેશમાં નથી તો દુઃખ નથી લાગતું. એટલે હવે સવાલ આ છે,-

પ્ર.- એવા રોગ ગરીબીના કાળમાં વગ્રતા ન હોય, ચિત્ત એમાં રોકાદ ગયેલું ન હોય એ વખતે પણ ચિત્તનું ધ્યાન કોઈ બાબુ નિમિત્ત પર તો જાય ને ? તો ત્યાં એ નિમિત્તથી ચિત્તમાં કલેશ કેમ અટકાવાય ? ત્યાં તો સહેજે કલેશ ઉભા થઈ જાય છે. એમ કેમ અટકે ?

૩.- નિમિત્તો પર ચિત્તના કલેશ અટકાવવા માટે અનેક ઉપાયો આપણે પૂર્વ જોઈ આવ્યા છીએ. એમાં એક ઉપાય એ જોયો કે શુભભાવનાઓમાં ચિત્તને રમતું રાખવાનો ખૂબ અભ્યાસ રાખવો જોઈએ. એવી શુભભાવના શી શી કરવી એમાં એક એ જોયું કે મૈત્રી-પ્રમોદ-કરુણા અને મધ્યસ્થ ભાવનાને ભાવ્યા કરવી જોઈએ એકાદ દિવસ સવારથી આ કરવાનો સંકલ્પ કરી જુઓ, અને આખા દિવસ સવારથી બને તેટલી વાર આ ભાવવાનો અનુભવ કરી જુઓ પછી જુઓ કે ચિત્તના કેટલા કલેશ TENSION મટે છે. વારંવાર આ ભાવવાનું કે

- સર્વનું ભલું થાઓ,
- જીવો બિચારા કર્મવશ દુઃખી છે, પાપી છે, .
- કોઈનું પણ સારું સુકૃત-સદ્ગુણ અભિનંદનીય છે.
- બીજાની હલકાઈ મારે વિચારવાની જરૂર નથી કેમકે એથી મારું મન હલકું અધમ બને છે.

આ ચાર વારંવાર ભાવવાનું એક દિવસ કરી જુઓ. પછી રાત્રે સુતાં તારવણી કાઢો કે એથી કેટલો લાભ થયો, ચિત્ત કેટલું હળવું શાંત અને શીતળ રહ્યું. મનને માટે આ મહાન રસાયણ છે, વસાણું છે એથી મનની તુષ્ટિપુષ્ટિ વધે છે. દા.ત.

જ્યાં આપણા આશ્રિતો ખૂલભાલ કરતા હોય ત્યાં જો મનમાં આ કરુણાભાવના ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : હૂપવાનો મોકો” (ભાગ-૪૪) ૨૨૮

લાવો કે આ બિચારા જીવ કર્મવશ ભૂલે છે, ‘સંબ્રે જીવા કર્મવસ ચચુદહ રાજ ભરમંત’ ‘સર્વ જીવો બિચારા કર્મવશ ભૂલ કરીને ચૌદ રાજલોકમાં ભટકે છે,’ આ કરુણાભાવના લાવો એ જ વખતે મન હળવું થવાનો અનુભવ થશે મનમાં દ્રેષ્ણને કલેશ નહિ ઊભો થાય.

કલ્યાણ અધિકાર વાપરો :-

એમ માનો કે આપણા પર કોઈ વૈર વિરોધ રાખે છે; ત્યાં આપણે કાંઈ એના પર અધિકાર નથી અજમાવી શકતા કે એ એના દિલમાં વૈર-વિરોધ ન જ રાખે. તો શું હવે એના વૈર વિરોધથી આપણે બળ્યા કરવું ? ના આપણે મૈત્રીભાવના ચિત્તવાદી કે એનું ભલું થાઓ,’ એમ સમજી રાખવું કે જેમ એને વૈરવિરોધ દુર્ભાવ રાખવાનો અધિકાર વાપરવો છે, એમ આપણે મૈત્રી ભાવના ભાવવાનો કલ્યાણ અધિકાર વાપરવો છે. પણ એ વાપરવો ન વાપરવો એમની ખુશી કિન્તુ એ ન વાપરે તેથી મારે શું કામ ન વાપરવો ?

અધમ અધિકાર મૂકીને, ઉત્તમ અધિકાર વાપરવામાં જ સજ્જનતા છે, ઉત્તમતા છે, જીવનની સફળતા છે.

મારે મારી ઉત્તમતા જાળવવી છે, સજ્જનતા સાચવવી છે. જીવન નિષ્ફળ નથી જીવનું, તો હું સૌના ભલાની મૈત્રીભાવના જ ચિંતવું. આમ મૈત્રીભાવનાથી ચિત્તનાં કલેશ સંતાપ અટકાવી શકીએ. એવી રીતે દુઃખી પર દ્રેષ્ણ-નિષ્ફરતા ન કરતાં બિચારો એ કર્મવશ છે એમ ચિત્તવી એના પર દ્યા લાવી શકીએ તેથી આપણું મન ઝોરું રહે.

એમ, કોઈ સ્વાર્થી-કૃપણ માણસને કાંક સારુ મળી જાય. યા ભલે સ્વાર્થવશ, પણ કોઈ સારું કામ પણ કરી આવે, ત્યાં આપણા મનમાં એની અનાડિતા સ્વાર્થીધતા કૃપણતા આગળ આવીને એની સારી પ્રાપ્તિ કે કોઈ સુકૃત પર ઈર્ષા થવા જાય છે, ચિત્ત સંતાપ-બળતરામાં પડે છે. પરંતુ એ વખતે જો મનમાં પ્રમોદભાવના લાવીએ અને એમાં વિચારીએ કે મારે એની હલકાઈ જોવાનું શું કામ છે ? એથી મારું મન બળે એમ શો લાભ થવાનો હતો ? માટે એનું સારુ જ જોઈ ખુશી કેમ ન અનુભવવી ? હું દ્રેષ્ણ-સંતાપ-બળતરાથી તો બચ્યું ? આમં આપણું ચિત્ત કલેશથી બચે.

ચોથી ઉપેક્ષાભાવના કેમ જરૂરી ? એમાં શું વિચારવું ?

એમ દુનિયામાં કેટલાયની એક યા બીજી ખામી જોઈ ચિત્ત વ્યકૃત થાય છે. આ આવા કેવા છે ! પેલા કેમ આવું કરે છે ?....વગેરે વગેરે બીજાની ખામી જોઈ જોઈ ચિત્ત કલેશમાં પડે છે, બળે છે. શી જરૂર છે ભાઈ ! એની ? આંખ મીયો

મનમાં એવા બીજાની હલકાઈના વિચાર ઘાલવા બંધ કરી દો હલકાઈના વિચારથી મન હલકું બને છે. વિચારો કે મારે બીજાની હલકાઈ વિચારી મારા મનને હલકું નથી કરવું ચાલવા દો. જગત મોટું છે, એમાં જીવો કર્મવશ ખામીવાળા તો હોય તો ભલે એમ ચાલે મારે એની કથા કરવાની જરૂર નથી. મારે મારા આત્માનું વિચારવાનું ધ્યાનું છે. એ પેલું વિચારવા જતાં ચૂકી જઈશ. મારો કોઈ જગત પર પ્રભાવ નથી કે જગત દોષ-દુષ્ટા ખામી ન જ રાખે.

મોટા તીર્થકર ભગવાન પણ જગતના બધાનું જ સુધારી શક્યા નથી. વીસમાં તીર્થકર શ્રી મુનિસુવ્રત ભગવાનની હ્યાતી છે. અને પોતાની સેવામાં દેવો હાજર છતાં પાલક પાપીએ ૫૦૦ મુનિઓને પીલી નાખ્યા, ભગવાને કેમ દેવતાને મોકલી એને ન અટકાવ્યો ? કહો, જગતના અયોગ્ય જીવોનું સુધારી શકાતું નથી. તો પછી હું શા સારુ બીજાના દોષ ખામી-હલકાઈ જોયા કરું ને બધ્યા કરું ? મારે એ જોવી જ નથી, પછી એનો સંતાપ નહિ, ચિત્તકલેશ નહિ.” આમ જુઓ કે,

(૧) મૈત્રી-કરુણા-પ્રમોદ-ઉપેક્ષા ભાવનાથી બાધ્ય નિમિત્તો પર ચિત્તકલેશ અટકાવી શકાય.

પરંતુ એ શુભ ભાવના અવસર પર સુલભ ક્યારે બને ? ત્યારે જ કે એને મનમાં વગર નિમિત્તે પણ વારંવાર ભાદ્ય કરીએ.

(૨) વૈરાગ્યભાવનામાં શું ચિંતવવું ? :-

એવી એક શુભ ભાવના વૈરાગ્યની છે. વૈરાગ્યભાવનામાં આ ચિંતવવાનું કે

(૧) જગતમાં વાસ એ જન્મ-મરણની દુઃખદ આપત્તિથી ભરેલો છે, જેમાં માંધાતા જીવને પણ ન ગમતું મૃત્યુ પામવું પડે છે. અને ન ગમતી યોનિમાં જન્મ લેવો પડે છે. તો એવા નિર્ગુણ જગતવાસમાં કઈ વસ્તુ હોશિયારી પર ગુમાન કે સંતોષ લેવા જેવા છે ?

(૨) જગતના સંયોગો નાશવંત છે તો એના કામચલાઉ ટકાવ પર મોહ શો કરવો ? કેમકે અંતે એ ઝુંટવાઈ જઈને જીવને દુઃખી કરવાના છે.

(૩) કાયા-માયા દુઃખ અને પાપમાં નિમિત્ત બને છે. તો એના પર મોહ શો ?

(૪) એટલે શુભ ભાવના ગીજ રીતે આમ થાય કે

(૫) જીવને જે કાયા માયા વગેરે મળે છે, એ પોતાને દુઃખ અને પાપ કરાવનારા બને છે. તેમજ વધારામાં બીજા જીવોનાં પણ દુઃખ અને પાપમાં નિમિત્ત બને છે. તો પછી સ્વ-પરને દુઃખી અને પાપમળ કરનારી કાયા-માયા કદાચ ક્ષણિક સુખ-આનંદ દેખાડે એમાં શું સારું માની મન મેલું કરવું ?

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂલવાનો મોકો” (ભાગ-૪૪) ૨૩૧

એમ સ્વ અને પરને દુઃખ અને પાપમાં નિમિત્ત બનનારી વસ્તુ કાયા-માયા પર શા ફૂલાગુણ બનવું ? મહાપુરુષોએ પોતાની કાયાને પાપમુક્ત બનાવી દીધેલી, પરંતુ જો એના નિમિત્તે બીજો જીવ દ્વેષ-હિંસાઈ પાપમાં પડતો તો એ પણ એમને ખૂબ ખટકતું. મનને એમ થતું કે અરેરે ! કેવી આ ગોજારી કાયા કે બીજા જીવને પાપ કરાવી એને બિચારાને ધોર નરકાઈ દુઃખમાં ધસડશે ! ધન્ય છે તે સિદ્ધ ભગવંતોને કે જેમણે મોક્ષ પામી કાયાના સંગ કાયમ માટે છોડી દીધા, તો એ હવે કોઈના ય પાપમાં નિમિત્ત નથી બનતા !’ આમ એ પોતાની ધર્મનિષ્ઠ બનેલી કાયા પર પણ વૈરાગ્ય વધારતા.

મહાપુરુષોની મરણાંત કષ્ટમાં કેવી ભાવના ?

સમરાદિત્યના જીવ ચોથા ભવમાં ધ્યાનસ્થ ધન્યકુમાર મુનિને લબાડ પત્નીએ એમની આસપાસ જીવતા ચિતા ખડકી સળગાવ્યા ત્યારે એ મહામુનિએ આ જ ભાવના કરી, કે અફસોસ ! આ મારી કાયા કોઈ બિચારા જીવને દ્વેષવશ હિંસાના પાપમાં નિમિત્ત બની રહી છે ધન્ય છે. ધન્ય છે ! સિદ્ધ ભગવંતોને કે જેમણે કાયા જ નથી રાખી, તો કોઈને ય પાપમાં નિમિત્ત થતા નથી. અર્ણિકાપુત્ર આચાર્યે પણ નદી ઉપર દેવતાથી ભાલે પરોવાતાં આજ બેદ કર્યો કે અરે ! આ મારી કાયાનું લોહી નીચે પરીને અસંખ્ય પાણીના જીવોને નાશ કરી રહ્યું છે ! કેવી આ પાપકાયા !

શું આ બંનેની કાયા તો સંયમ નિષ્ઠ હતી, છતાં એવી ય કાયા પર રાગ નહિ, પણ વૈરાગ્ય ! તે ય આગથી આવા જીવતા બળાઈ જવાની કે જીવતાં ભાલે ભોંકાઈ જવાની ધોર વેદના વખતે ! દ્વેષ-ધિક્કાર-વૈરાગ્ય બાળી કે વીંધી નાખનારા દુષ્ટ ઉપર નહિ, પણ પોતાની કાયા ઉપર.

ત્યારે આ વિચારવા જેવું છે કે એવા કોઈ ગ્રાસ વેદના રિબામણ વખતે તો નહિ, પણ કાયાને સુખ શાન્તિ વખતે ય આવો કાયા પર વૈરાગ્ય થાય છે. ખરો ? કે

કાયા પર વૈરાગ્યનો વિચાર :-

અરે ! ધિક્કાર છે આ કાયાને કે (૧) કેવી એ મારા જીવને પટ્ટકાય જીવોની લિંસામાં ધસડી રહી છે ! (૨) કેવી એ મને અઠાર-પાપસ્થાનકમાં લઈ જઈ રહી છે ! (૩) કેવી એ કુટુંબ અને બીજાને મોહ કરાવી એમને કાળા પાપ બંધાવી રહી છે ! (૪) કેવી એ પત્નીને વિષયસંગના પાપમાં ધસડી રહી છે ! (૫) તથા એકેક સંગ વખતે ૮-૯ લાખ ગર્ભજ મનુષ્યજીવોની હિંસામાં વપરાઈ રહી છે.

આવો કોઈ કાયા પર બેદ ? વૈરાગ્ય ? ધિક્કાર ? આ ભાવના એ શુભ

૨૩૨ લુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“ધર્મિક વાંચન” (ભાગ-૪૪)

ભાવના છે. એના વારંવારના અભ્યાસથી સંસ્કાર એવા સરસ જામે કે પછી કોઈ નિભિત પર રાગ-દ્રેષ્ટ-ઈઞ્ચ-મદ ઊઠવા જતાં જ મનને એમ થાય કે આ રાગાદિની ખરાબી મૂળ કર્દી જાતની કેવા સ્વરૂપની મારી કાયા પર વહોરવાની ? પાપરૂપ કાયાની ખાતર શા સારુ એ બિનજરૂરી ખરાબીઓ મનમાં ઘાલું ?'

શુભ ભાવનાનો અભ્યાસ હોય તો અવસરે એ ખરાબીથી બચાય.

(૪) પૂર્વોત ત્રણ પ્રકાર ઉપરાંત ચોથી રીતે શુભ ભાવના મહાપુરૂષોના જીવન પર આ રીતે કરવી.

(૪) શુભ ભાવના માટે પૂર્વના મહાપુરૂષોનાં જીવનમાંથી વીણી વીણીને.

(i) એમણે સહર્ષ સહેલી આપતીઓ ભેગી કરી નોંધી રખાય,

(ii) વિવિધ પ્રસંગે એમણે ઉચ્ચારેલા સુયોગ્ય બોલ ભેગા કરી નોંધી રખાય;

(iii) પ્રસંગોપાત એમની શુભ ભાવનાઓ તથા શુભ વિચારો ભેગા કરી નોંધી રખાય.

(iv) એમણે બીજાને આપેલી કિંમતી આત્મહિતની સલાહ અને ઉપદેશો ભેગા કરી નોંધી રખાય; તથા

(v) એમણે જીવનમાં દાખવેલ આચરેલ વિવિધ સત્તુ પરાકમ સુકૃતો સદ્ગુણો ભેગા કરીને નોંધી રખાય.

પછી એ નોંધો વારંવાર વંચાય, વિચારાય, કંઠસ્થ કરી એ બધાને વારંવાર મનમાં પલોટાવાય. આ પણ મહાન શુભ ભાવનારૂપ બને.

એક મહાવીર પ્રભુના જ જીવનમાંથી જો આ પાંચ તારવણી કાઢી રાખી એને વિચાર્યા કરો ને ? તો ય અદ્ભુત ભાવનાબળ અને સુસંસ્કારબળ ઊભું થાય. પછી એ અવસરે અવસરે ગમે તેવા નિભિતો પર પણ મનને દીનતા-ભેદ-ઈઞ્ચ-દ્રેષ્ટ-અભિમાન વગેરે ખરાબીઓથી બચાવી લે.

એવું (૨) ઋષભદેવ ભગવાનના પૂર્વ ભવોમાંથી પણ, (૩) રામચંદ્રજી અને સીતાજીના જીવનમાંથી, (૪) સમરાદિત્યના ભવોમાંથી, તથા (૫) ભરહેસર બાહુબલીની સજાયમાં ગણાવેલ મહાપુરૂષો અને મહાસતીઓના જીવનમાંથી ઢગલાબંધ મુદ્દા નોંધી રાખવા જેવું અને વારંવાર વિચાર્યા કરવા જેવું મળી આવે. આ શા માટે ? આટલા માટે, કે જીવને પૂછો,

(૧) ઊંચી માનવબુદ્ધિનો ઊંચો સદૃપ્યોગ કરી લેવો છે ?

(૨) મહાકિંમતી માનવ-સમયને લેખે લગાડવો છે ?

(૩) મળેલા મહાપુરૂષોનાં આલંબનને સફળ કરવાં છે ?

(૪) મનને પારાવાર રાગ દ્રેષ્ટાદિ ખરાબીઓથી બચાવતા રહેવું છે ?

(૫) અવસરે અવસરે જાતે સુયોગ્ય અને અવસરોચિત વિચારણા વાણી અને વર્તાવ રાખવા છે ? તેમ આશ્રિતોને અને બીજાને એવી સુયોગ્ય સલાહ આપવી છે ?

(૬) જીવનમાં મુંઝવણા આપત્તિના પ્રસંગોએ સારું આશ્વાસન જોઈએ છે ? તો આ કરો,-

જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે મહાપુરૂષોનાં જીવનચરિત્રમાંથી પૂર્વે કહેલ પાંચ મુદ્દાઓની જુદી જુદી નોંધ કરતા રહો; અને એને વાંચતા વિચારતા રહો એમાં જેટલું મોઢે થાય તે બધું યાદ કરી કરીને મનમાં રટતા રહો, આજે ગુજરાતી ભાષામાં એવા સારા પુસ્તક ઘણા મળે છે. એમાંથી સુખપૂર્વક આ થઈ શકે.

એક ત્રિપણી શલાકા પુરુષ ચરિત્રમાં કુલ દશ પર્વમાં ૨૪ તીર્થકર ભગવાન, ૧૨ ચક્વતરી, ૮ બળદેવ, ૮ વાસુદેવ, અને ૮ પ્રતિવાસુદેવનાં ચરિત્રો છે. એમાં એક માત્ર ઉમાં પર્વમાં જૈન રામાયણનું વર્ણન છે. એના પરથી આ પાંચ મુદ્દાએ નોંધ કરવા ઢગલો મશાલો મળે એમ છે. કુલ દસે પર્વમાંથી તો અટળક વસ્તુઓ નોંધી શકાય પાંચમાંથી એકેક મુદ્દા પર અલગ અલગ નોટ રખાય. એકેક નોટમાં બધા ચરિત્રોમાંથી એકેક જ મુદ્દા પરનો વિષય નોંધતા રહેવાય. બીજા મુદ્દાનો વિષય બીજી નોટમાં નોંધાય. એવી પાંચ નોટ બને. આમ એકેક નોટ એકેક વિષય પર થોકબંધ માલ મશાલો પૂરો પાડનારી બને.

મહાપુરૂષોની આપત્તિઓની નોંધ શું આપે ? :-

દા.ત. એક નોટમાં માત્ર આપત્તિઓ નોંધતા ગયા. તો એમાં મહાપુરૂષોએ સહર્ષ સહેલી આપત્તિઓની નોટમાં કેટલાય ચરિત્રોમાંથી કેટલાય મહાપુરૂષોના અનેકાનેક આપત્તિ પ્રસંગો નોંધેલા હોય. હવે વિચારો કે જુદા જુદા મહાપુરૂષો પર આવેલી આપત્તિઓ એમાં સંણંગ વાચવા મળે, તો એ વાંચતા વાંચતા દેખાય કે મહાપુરૂષો પર કેવી કેવી ભયંકર આપત્તિઓ વરસેલી ને એમાં મનને કેટલું બધું સ્વસ્થ-સમતોલ અને સ્વચ્છ રાખેલુ !

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૨૦, અંક-૨૬, તા. ૧૧-૩-૧૯૭૧

ત્યારે વિચારો કે (૧) એક તો મહાપુરૂષો પર વરસેલી આપત્તિઓ એક પછી એક સંણંગ વાંચવા મળે એથી એની સામે આપણી આપત્તિઓ સંકટો દુઃખો કેવા મામૂલી લાગે ? ઉપરાંત (૨) બીજું એ કે એમણે એ આપત્તિપ્રસંગો પર

રાખેલી સ્વસ્થતા અને સ્વચ્છ મન જોઈ આપણને એનું અનુકરણ કરી મન સ્વસ્થ અને સ્વચ્છ રાખવાની કેવી સરસ પ્રેરણા મળે ? એથી કેવી સુંદર લાઈનદોરી મળે ? એથી આપણે આપણાં કષ્ટ-હુંઘ પીડા આપત્તિ વખતે કેવી મજેની સમતા સમાધિ અને પ્રશસ્ત વિચારણા રાખી શકીએ ?

એમાં વળી આ નોટના વારંવાર વાંચનથી એ આપત્તિઓ સંગ યાદ રહી ગઈ હોય તેથી પછી જ્યારે જ્યારે એ મનમાં યાદ કરીએ ત્યારે જાણો એ સિનેમા ચિત્રપટની જેમ નજર સામે દેખાવા માટે ! એમાં સાથે જાણો મહાપુરુષોએ આપત્તિમાં ધીરતા સ્વસ્થતા રાખી પ્રસત્ર ઉભેલા દેખાય ! એ બધું જોતાં તો આપણા મનમાં એક પાવર એક શક્તિ, એક એક સામર્થ્ય ઉસું થઈ જાય, જેના યોગે આપણને આપણી આપત્તિ કાંઈ વિસાતમાં ન લાગી આપણું ચિત્ત સ્વસ્થ શાંત સમતોલ બની જાય. ક્ષાશવાર તો લાગી જ જાય કે આપણને કોઈ જાણો આપત્તિ જ નથી ! આપણે ઓલ રાઈટ છીએ. સારા મજેમાં છીએ ! પછી ક્ષાશભરનો આ અનુભવ વારંવાર યાદ કરી જાળવતાં આવડવો જોઈએ. એ પેલી અનેકાનેક આપત્તિઓ અને એમાં મહાપુરુષોની ધીરતા પ્રસત્રતા તથા મનની નિર્ભળતા-સ્વસ્થતા-પ્રસત્રતાને વધારેવાર ટકાવવાનું આવડે. મૂલ વાત આ છે કે માનસિક ક્ષેત્રમાં એક નહિ પણ અનેકાનેક મહાપુરુષો અને એમની આપત્તિઓ આબેહુબ દેખાયા કરવી જોઈએ; અને એ સંગ એના વાંચનથી બને.

વર્તમાન જગતની તુલનાથી શાંતિ :-

અહીં જ જુઓને માનો કે ધંધામાં બહુ પૈસા ખોયા, એ આપત્તિ આવી પરંતુ નજર સામે જો એવી બે ચાર વ્યક્તિ દેખાય કે જેની અઢળક સંપત્તિ નાણ થઈ ગઈ હોય અને આજે એ ભીખ માગવા જેવી સ્થિતિમાં હોય જ્યારે આપણે તો હજુ ધરવ્યવહાર ઠીકઠીક ચાલતો હોય. તો એ દુખી વ્યક્તિઓને જોતાં આપણને કેવી હુંફ મળી જાય ? મન કેવી ધીરતા સ્વસ્થતા અનુભવે ? મનને એમ થાય કે ઓહો ! ત્યારે મારે આમની આગળ શી આપત્તિ છે ? આ બિચારાના ફનાફાતિયા થઈ ગયા છે ! ત્યારે મારું ટહું હજુ હજુ ચાલે છે.

એમ આપણા કોઈ નાનકડા અપમાન આગળ બીજાને મળતાં ધોર અપમાન દેખાય, આપણા કોઈ રોગની સામે બીજાને જાલિમ રોગ પીડી રહ્યા દેખાય; એમ આપણને કશી અગવડની આગળ બીજાને પીડી રહેલી ભારોભાર અગવડ દેખાય, તો એ વખતે આપણને આપણા અપમાન રોગ અગવડ છતાં કેવી શાંતિ સ્વસ્થતા પ્રસત્રતા મળી જાય ? બસ, આ શાલ્લોમાંથી મહાપુરુષો પર વરસેલી નાની મોટી આફકો નોટમાં એક પછી એક નોંધે ગયા હોઈએ અને તે સંગ વાંચવા મળે,

એ વખતે, યા વારંવાર વાંચીવાંચીને કંઠસ્થ થઈ ગયેલ એ યાદ કરીએ તે સમયે જાણે એને નજર સામે આબેહુબ જોઈએ, તો એથી આપણી ગરીબી કે પૈસાની ખોટ યા અપમાન રોગ અગવડ વગેરેમાં પણ આપણને કેવીક શાંતિ સ્વસ્થતા પ્રસત્રતા અનુભવાય ?

વાંચેલાનો પ્રયોગ :-

નજર સામે તો લાવો, રામ સીતા લક્ષ્મણ જંગલમાં ભટકતા બન્યા છે, ત્યાં એમને કઈ પાલખી રથ હાથીની સવારી છે ? માઈલોના માઈલો પગે ચાલતા ફરે છે ! હવે તમારે કોઈ વાર મોટર ખોટકાઈ ગઈ, યા એટલું મોટરનું પુણ્ય નથી તો પણ ભાડુતી રીક્ષા-ગાડી બસ ન મળી અને ૨-૪ ફ્લાંગ પગે ચાલતાં જવું પડ્યું, તે ત્યાં પેલું રામ સીતા લક્ષ્મણનું માઈલોના માઈલો પગે ચાલતા જવાનું નજર સામે આબેહુબ જોતાં એ શી વિસાતમાં લાગે ? પેલાને એમ સહર્ષ જતા જોઈ આપણને આપણા પગે ચાલી જવામાં શું દુઃખ લાગે ?

આ પાછું એકલું રામ-સીતા-લક્ષ્મણનું જ નહિ, પરંતુ નળ અને દમયંતીનું, હરિશ્ચંદ્ર અને તારામતીનું અથવા ચારિત્ર લઈ ચાલી નીકળેલા સનત્કુમાર ચક્રવર્તી જેવાનું, યા રાજ સિદ્ધરાજના ભયથી ભાગતા કુમારપાણનું, તથા કેટલાય નિર્ધન થઈ પરગામ પગપાળા ચાલી નીકળેલા પૂર્વના શ્રાવક-શ્રાવિકાનું પગે ચાલતા જવાનું દેખાય, તો એ પરથી જતને ક્યારેક વાહન વિના ચાલતા જવાનું આવ્યું એમાં દુઃખ શાનું લાગે ? મન શા માટે એમાં કચ્ચવાટ કે બેદ અનુભવે ? એ તો મન કહે પેલાઓની આગળ મારે વળી આ શું મોટું દુઃખ છે ? ચાલ ચાલી કાઢ હોંશથી. મોટરમાં બેસી જાણું છું તો ચાલી પણ જાણું છું.

આ તો ગણિતના હિસાબ છે, ૫૫૮૪૨ની રૂકમ આગળ ૨૨ કે ૧૨૨ એ કોઈ વિસાતની રૂકમ જ ન લાગે; એમ મહાપુરુષોએ જે જાલિમ કષ્ટ વેઠ્યાં આપત્તિ-અગવડ ભોગવી, એની આગળ આપણાં કષ્ટ આપત્તિ-અગવડ કશી વિસાતમાં ન લાગે. દુઃખનાં રોદણાં શું રોયા કરો ? ગણિતના આ હિસાબ માંડો.

વાંચન કરી કરીને મહાપુરુષોની નોંધી લીધેલી અનેક આપત્તિઓની એક નોટ વાચવા યાદ કરવા પર આ આપણી આપત્તિ-અગવડ-કષ્ટમાં ચિત્ત સમાધિ રાખવાની વાત થઈ.

(૨) મહાપુરુષોનાં સુકૃતો-પરાક્રમોની નોંધ શું આપે ? :-

એવા ચરિત્રો વાંચીને મહાપુરુષોએ કરેલા સુકૃતો અને પરાક્રમોની નોંધ કર્યે ગયા હોઈએ, અને પછી એ નોટ વારંવાર વાંચીએ વિચારીએ તો એથી આપણા સુકૃત કેવા મામૂલી લાગે ? ત્યાં અના પર અભિમાન શા થાય ? નામના

શી કમાવાનો મોહ થાય ? કે સંતોષ વાળીને બેસવાનું મન શાનું થાય ? અથવા એ મહાપુરુષોનાં મહાન સુકૃત પરાક્રમો વાંચી આપણને સુકૃતની પરાક્રમની કેવી સરસ પ્રેરણા મળે ?

સુકૃત પરાક્રમોના દાખલા :-

દા.ત. વિમળશાહ મંત્રીએ ૧૮ કરોડ રૂપિયા ખરચીને બંધાવેલ દેલવાડા મંદિર, મંત્રી વસ્તુપાલ તેજપાલે કારીગરોને સાંજ પડવે પત્થરનો ભૂકો પાડે એટલો મહેનતાણામાં ચાંદી જોખી આપી આપીને રૂપિયા સાડા બાર કોડના ખરચે બંધાવેલ દેલવાડા મંદિર, ધરણશાહ પોરવાલે ૮૮ કરોડ રૂપિયાના ખર્ચે બંધાવેલ રાણકપુર મંદિર,...એમ વિકમાદિત્ય રાજાએ કોડેના કોડે રૂપિયા ખરચી કાઢેલ સંઘયાત્રાઓ નજર સામે આવે, એ પરથી આપણા કોઈ સુકૃતમાં (૧) અભિમાન કે સંતોષ શાનો થાય ? (૨) કીર્તિની શી લાલસા રહે ? (૩) અથવા આપણને સુકૃતની કેવી સુંદર પ્રેરણા મળે ?

ભામાશાઅે રાણા પ્રતાપ આગળ દેશ અને હિન્દુ સંસ્કૃતિ ટકાવવા માટે ૧૨-૧૪ વર્ષ પ્રતાપનું લશકર નભે એટલો પોતાનો લગભગ ભંડાર ઠાલવી દીધો.

રાજા કાશીનરેશો પ્રજાને યુદ્ધની હાડમારીથી બચાવવા ઈર્ઝાળું દુશ્મન કોશલનરેશને પોતાનું રાજ્ય સોંપી દઈ પોતે જંગલમાં ચાલ્યો ગયો.

વાલી રાજાએ અભિમાનથી આજ્ઞા મનાવવા આવેલા રાજા રાવણ પર વિજય મેળવવા છતાં રાવણને માર્દી આપી, પોતાનું રાજ્ય પોતાના ભાઈ સુગ્રીવને રાવણની આજ્ઞા હેઠળ રાખી સોંપી દીધું, અને પોતે રાવણ પ્રસંગથી વૈરાગ્ય પામી, સંસાર ત્યાગ કરીને ચારિત્ર લઈ નીકળી પડ્યા અને માસખમણો સુધીની ઘોર તપસ્યાઓ આચરવા લાગ્યા.

આ કેવાં કેવાં અદ્ભુત સુકૃત-પરાક્રમ ?

એમ, શાલિભદ્રે માથે મહાવીર પ્રભુ એકલાને બદલે રાજી શ્રેણિક પણ માલિક છે, એને ખ્યાલ આવવા પર મનમાં વ્યગ્રતા અનુભવી કેવો પ્રભુ પ્રત્યેનો અનન્ય શરણભાવ ! મનને ખૂબ લાગી આવ્યું,

બોલો તમારે પણ માથે પ્રભુ સિવાય માલિક, કે સત્તાધીશ કેટલા કરવા પડે છે ? તો પ્રભુની પ્રત્યે એવો શરણભાવ છે કે મારે તો માલિક એક ભગવાન જ ? આ વળી બીજા ત્રીજાને ક્યાં માલિક કરવા પડે છે ? મનને લાગી આવે છે ખું ? મન કશી વ્યગ્રતા અનુભવે છે ? ના, કોઈ શેઠ માલિક સારું રણવી આપતો હોય, કોઈ ઓફિસર સત્તાધીશ પરમિટ વગેરેની સારી સગવડ કરી આપતો હોય પછી ભલેને લાંચ ખવરાવીને તે એ શેઠ એ ઓફિસર વહાલાહેમ માલિક

લાગે છે. તો પ્રભુ પ્રત્યે અનન્ય શરણભાવ કર્યાં છે ?

અરે ! પ્રભુ પ્રત્યે અનન્ય તો નહિ, પણ બીજા પત્ની-પુત્ર શેઠ વગેરેના જેટલો ય શરણભાવ છે ખરો ? મનને જે એમ લાગે છે કે મારે આ પત્ની આધાર છે, પુત્ર આધાર છે. શેઠ આધાર છે. એવું મારે પ્રભુ આધાર હોવાનું મનને લાગે છે ખું ? જુઓ એમને એમ હા નહિ કહેતા ? પેલા બધા કેવા આધાર ભૂત લાગે છે, ને એ લાગ્યા પછી એમની પાછળ કેવો હોંશે હોંશે અટળક ભોગ અપાય છે ? એમના પર કેટલો પ્રેમ ઉછળે છે ? એમની બિમારી વગેરેમાં મન કેટલું આકુળ-વ્યાકુળ થાય છે ? એની તુલનામાં ભગવાન માટે વિચારજો ભગવાનની પાછળ એટલો બધો અટળક ભોગ હોંશે હોંશે અપાય છે ખરો ? એવો ભારે પ્રેમ ઉછળી પડે છે ? મંદિરમાં ભગવાનના પખાળમાં ખાસું દૂધ ને થોંણું પાણી નહિ, પણ ખાસું પાણી ને નામનું દૂધ જોઈ મનને લાગી આવે છે ખું ? એમ અતિ અલ્ય કેશરવાળા ચંદન મેલાં અંગ લૂંછણા તે ય ભીનાલચ, પ્રભુના અંગે આંગી વરખ નહિ, આવું બધું એક નોકરને પીરસાય એવું ભગવાનને પીરસાતું જોઈ મન જિન્ન થાય છે ખું ? ભગવાન ભારે આધાર લાગે છે ને ? છેવટે અંતે એ જ મારે શરણ છે એવું લાગે છે ને ?

આધાર શરણ લાગ્યા શેને કહેવાનું હશે ? શબ્દથી તો બોલી કઢાય કે મારે પ્રભુનું શરણ છે, મારે પ્રભુ આધાર છે,’ એમાં ક્યાં પૈસા લાગે છે ? પરંતુ શરણ લાગવા પર માથે કાંઈ ભાર જવાબદારી આવે ? દિલ કાંઈ ભોગ આપવાનું જરૂરી માને ? દિલમાં હેત ઊભરાય ? જેવું પરિવારને એવું ભગવાનને ન દેવાતાં દિલ હુંબી રહે ?

જ્યારે ભગવાન પર હૈયામાં હેત ઊભરાતું હોય ત્યારે તો એમની સામે હુનિયા તુચ્છ અસાર માલ વિનાની લાગે.

બોલો, પ્રભુ એવા શરણ એવા આધાર લાગે છે ? ન લાગતા હોય તો લગાડો. આ ઉત્તમ માનવ જન્મ અને માનવ મન એ માટે છે કે પ્રભુ એ અનન્ય શરણ અનન્ય આધાર લગાડી દઈએ. ધન એટલા માટે છે કે એમની ભક્તિમાં ભારે વરસાવતા રહીએ. માનવ તન-મન-ધન-દૃદ્ધિયો અને હૈયાનો આ સદૃપ્યોગ કરી લો. કરો, એ બધું એક વાર હાથમાંથી સરકી જવાનું છે. આ ઉત્તમ સાધનો ગુમાઈ ગયા પછી એ ક્યાં કરશો ?

શાલિભદ્રે પ્રભુને એક માલિક ધાર્યા છે, એ જ શરણ ને એ જ આધાર માન્યા છે. એટલે હવે માથે શ્રેણિક માલિક હોવાનું જાણવા મળતાં મન દુભાય છે.

વગ्र થાય છે. પાછું એમ વગ્ર થઈને બેસી રહેતું નથી. મન ચક્કું ત્યાગની ભાવનામાં જોજો, કેવા વૈભવ છતાં ? દેવાંગના સમી ઉર રમણીઓ અને દેવતાઈ જર-ઝેરત-વસ્ત્ર-ખાનપાનાદિની મોજ વખતે સર્વત્યાગની ભાવના થાય છે !

શાલિભદ્રના મનને થયું કે જો મહાવીર પ્રભુને એકને જ સ્વામી તરીકે રાખી મારે એમના જ સેવક બન્યા રહેવું હોય, તો આ નાશવંત અને ઠગારા-ભોગ-સુખોની લંપટા ખોટી છે. આ મને જીવનના સરવાળે શું પરખાવવાના હતા ? પ્રભુનાં ચરણે બેસી સર્વ પાપના ત્યાગ પૂર્વક મારા પ્રભુએ ખુદે કરેલી ધોર તપ અને ઉગ્ર સંયમની આરાધના નજર સામે રાખી, મહાતપ અને ચારિત્ર માર્ગની આરાધના કરી લઉં તો આ સુંદર માનવભવનો સુંદર સાર પામી જઉં; અને જે કર્મની પરાધીનતાએ આ મારા જેવા જ બે હાથ બે પગવાળા રાજાની ગુલામી ઉપરાંત મૃત્યુ સમયે એકાએક સર્વ વૈભવ તથા ભોગ સુખોનો અંત છે, તથા પુનઃ જન્મ-પુનઃ મરણની વિટંબણા ઉભી રહેવાની છે, એ કર્મબંધોનો સર્વનાશ કરી દઉં.'

બસ, ઉઠ્યા આ વિચારથી. વહાલસોયી માતા, પ્રેમાળ ચરણસેવિકા દેવાંગના સમી ઉર યુવાન પત્નીઓ અને દેવતાઈ નિત્યનવી નવાણું પેટીના દિવ્ય જર-ઝેરત પોશાક અને ખાનપાન આદિના સુખોને એક તણખલાની જેમ તિલાંજલિ આપી દીધી; પ્રભુની પાસે ચારિત્ર-જીવન સ્વીકારી લીધું. હવે તો કાયાનો પણ મોહ નથી રાખવો, એટલે છદ્દ અહુમ અહ્નાઈ પાખમણ અને માસખમણ સુધીની ધોર તપસ્યા સાધવા લાગ્યા. એમાં વળી મનને પણ આડાવળા વિકલ્પોમાં નથી જવા દેવું એટલે દિનરાત શાસ્ત્રસ્વાધ્યાયનો લગાતાર પુરુષાર્થ કર્યે ગયા. ત્યાગ અને તપથી થોડા જ સમયમાં કાયા સાવ ખખડી જતાં અંતે જીવન પર્યતનું અનશન ઝુકાવી દીધું ! શાલિભદ્રનાં આ કેવાં પરાકરમ ?

ચારિત્રો પરથી જેમ આપત્તિના પ્રસંગો અને એમાં ભવ્ય સમાધિના આત્મ-પરાકરમના અનેક મહાન પુરુષોના દાખલા એક સાથે નોંધયેલા વાંચવા મળે એમ સંપત્તિના પ્રસંગમાં પણ ત્યાગ વૈરાગ્યના ભવ્ય પરાકરમના આવા શાલિભદ્ર વગેરેના દાખલા નોંધયેલા વારંવાર વાંચવા-વિચારવા મળે. એથી કર્મમાં કર્મ પોતાની તુચ્છ સંપત્તિ પરના મદ અભિમાન પડતા મૂકાઈ જાય. ઉપરાંત વૈરાગ્ય, શક્ય ત્યાગ-દાન-પરમાર્થ ખીલી ઉઠે; ને પાપોનો ત્યાગ થતો આવે. મનને એમ થાય કે એમણે સર્વપાપ છોડ્યા, તો હું શું થોડા ય પાપ ન છોડું ?

ત્રીજી નોંધ ભાવનાઓની :-

(3) ચારિત્રો પરથી અલગ અલગ નોંધમાં ત્રીજી નોંધ મહાન આત્માઓએ અવસરે અવસરે ચિંતવેલી શુભ ભાવનાઓની નોંધ મળે. દા.ત.

સનત્કુમાર ચક્કીની રોગ પર ભાવના :-

સનત્કુમાર ચક્કવર્તીએ, શરીરમાં સોળ રોગ એકી સાથે ઉત્પત્ત થઈ જતાં, શું વિચાર્યુ ? શી ભાવના કરી ? આવી કે ‘આ રોગો એ તો થર્મોભિટર છે, તાવદર્શક છે. એ આત્માની અંદરના કર્મતાવને બતાવે છે. તો પછી, થર્મોભિટર-ને ઝાટકીને એની ડીચી ઉતારવા કરતાં અંદરના તાવની ડીચી ઉતારવા દે. એ ઉતારવાને માટે અહિંસા, સંયમ અને તપ અંજ ઉપાય છે; તો એ જ ઔષ્ધોપચાર કરવા દે.

એમ, રોગો એ તો મારા મિત્ર છે. એ આવ્યા તો ભલે આવ્યા કેમ કે એ છે ત્યાં સુધીમાં કર્મશત્રુનો નિકાલ થતો રહેશે. એ બંધા કર્મશુશ્ર આત્મા પર ચિટકી પડેલા, તે આવા રોગ સદ્યા વિના જાય નહિ, તો સાંદું છે આ રોગો દ્વારા કર્મનો નિકાલ અહીં જ થતો જશે.

એમ, એકાએક રોગો આવ્યા એટલે કાયાનો વિશ્વાસ ખોટો; તો પછી છ બંડની ઠકરાઈ નવનિધિના ખજાના અને સુંદર રૂપવાળી રાણીઓ વગેરે પરિવારના વિશ્વાસ શી રીતે સાચા હોય ? આ વિશ્વાસ પણ ખોટા મૂક આ વિશ્વાસધાતીના સંગ.’ આ સનત્કુમાર ચક્કવર્તીની ભાવના.

એમ સીતાજીનો રામે જંગલમાં ત્યાગ કરાવ્યો એ વખતે એમણે કરેલી ભાવનાની નોંધ થાય. એવી રીતે પછીથી અનિ પ્રવેશનું દિવ્ય કર્યા બાદ જ્યજ્યકાર થઈ બહુ મોટા માનપૂર્વક ઠરીઠામ બેસવાનો અવસર આવ્યો ત્યારે સંસારત્યાગની કરેલી શુભ ભાવનાની નોંધ થાય.

વાલી રાજાએ રાવણને હરાવ્યા પછી કરેલી વૈરાગ્ય અને ત્યાગની ભાવના નોંધાય.

આખુના મંદિરનું કામ ઠબુક ઠબુક બહુ ધીરી ગતિએ થવા પર અનુપમાએ વસ્તુપાળને આપેલ ચીમકી ઉપર વસ્તુપાળે કરેલી ભાવનાની નોંધ થાય.

વિજ્ય શેઠ કૃષ્ણપક્ષના બ્રહ્મચર્યના પોતે કરેલ નિયમની વાત કરતાં, પરણીને હમજાં જ આવેલી અને પોતાને શુક્લ પક્ષના બ્રહ્મચર્યના નિયમવાળી વિજ્યા શેઠાણીએ કરેલી ભાવના; એમ પછીથી વિજ્યશેઠ કરેલી ભાવનાની નોંધ કરાય.

ધરણશેઠને નલિનીગુલ્મ વિમાન સ્વખમાં દેખાયું તો જાગીને એના જેવું જિનમંદિર કરાવવાની કરેલી ભાવના નોંધાય.

મેઘકુમારના જવ હાથીએ સસલાને બચાવવા જે ભાવના કરી; બચાવવા અહી દિવસ પોતાનો પગ ઊંચો રાખી પછી પડી જતાં ભૂખે તરસે મરવાનું આવ્યું એ વખતે કરેલી ભાવનાની નોંધ કરાય.

આવી આવી તો ઠગલાબંધ ભાવનાઓની નોંધ એકજ નોટમાં સરળંગ વાંચવા વિચારવા મળે. એના પર આપણા દિલમાં કેવી કેવી દાનની ત્યાગની શીલ પ્રત નિયમની તપસ્યાની ક્ષમાની વગેરે વગેરે ભાવનાઓ ઊંઠે ?

મનને સ્વચ્છ કરવું છે ? તો આ કરો. મહાન પુરુષોએ જુદા જુદા પ્રસંગોમાં જે ભાવનાઓ કરી એને આ રીતે પહેલાં નોટમાં એકત્રિત કરી એને વારંવાર વાંચી કંઈસ્થ જેવી કરો.

ઘણી ભાવનાઓ યાદ કરવાની રીત :-

એટલી બધી શે કંઈસ્થ થાય ?' એમ પહેલેથી ગચ્છાં મૂકૃતા નહિ. પહેલાં બે જ ભાવનાને મનમાં યાદ કરો. પછી ત્રીજી ભાવના લઈ એને મનમાં રટી લઈ પછી પૂર્વની બે રટેલી સાથે એને યાદ કરો એક વાર, બે વાર ત્રણ વાર.....ત્રણે સાથે યાદ કરો. પછી વળી ચોથી ભાવના યાદ કરી લઈ ચારને ધુંટો એ કરતાં કરતાં પાંચમી, છ્ટી...એમ વધુને વધુ યાદ થતી જશે. એમાં ય પહેલી ચારને એ કે બાજુ રહેવા દઈ નવી ચાર ભાવના તૈયાર કરવાની. પછી પૂર્વની ચાર, અને આ ચાર, એમ આઠ સંભારી જવાની. આ રીતે યાદ કર્યે જતાં ચાર ચારના કેટલાય જોડકા કંઈસ્થ થઈ જશે, આ એક દિવસનું કામ નથી, હો, રોજ રોજ જેમ થોડી થોડી લખાતી જાય તેમ તેમ યાદ કરતા રહેવાનું; અને બીજા પૂર્વના દિવસોની યાદ કરી આ દિવસની નવી કંઈસ્થ કરવાની. આમ રોજ ૨, ૩, કે ૪ ભાવના વધારતા જાઓ, પછી જુઓ એક જ મહિનામાં કેટલો ભંડોળ ભાવનાઓનો ભેગો થાય છે. મનમાં સરળંગ ચાલે એટલે તો એક સારા ચિંતનનો માલ તૈયાર થયો. એ પછી તો ગમે ત્યાં જરા મન નવરું થયું કે એને આ ભાવનાઓનાં સમરણમાં કામે લગાડો, પછી જુઓ કે એની મન પર કેવી કેટલી ચમત્કારિક અસર થાય છે ! મન કેવું સ્વચ્છ બનતું આવે છે !

મન સ્વચ્છ એટલે સમજો છો ?

મન સ્વચ્છ એટલે કે જેમાં હાયવોય, સંકલ્પ વિકલ્પો, ભય, ઈર્ઝિ-મદ-માયા, કામ-કોધ-લોભ, હતાશા કે હરખના ઉન્માદ વગેરે કશું ન હોય. એ બધું મનની અસ્વચ્છતા છે. જીવનનો એકેક દિવસ તપાસો તો એમાં કેટલી ય અસ્વચ્છતા ચાલતી દેખાશે. આથી શું સુખશાંતિ છે ? યા શું જીવનની શોભા છે ? જીવનની મંગળમયતા છે ? ના તો પછી એ ચલાયે રાખવામાં મન દુભાતું નથી ? ભલે ને પૈસાના ઠગલા હોય, કે મોટા પરિવાર પર ઢકરાઈ હોય, યા દુનિયા બહુ સન્માનતી હોય, પરંતુ જો તમારા દિલમાં ગમે તે ભય, શંકા, સંતાપ વગેરે ચાલ્યા કરતા હોય તો જીવનની એથી શી વડાઈ ? જીવનની વડાઈ સ્વસ્થતાથી શાંતિથી

છે, ને એ મન સ્વચ્છ હોય તો બની આવે.

મનની સ્વચ્છતા માટે શુભ ભાવનાઓ એ સાખુનું કામ કરે છે. મનમાં એ ચાલ્યા કરે તો મન ધોવાતું આવે છે. સ્વચ્છ થતું આવે છે. આ શુભ ભાવનાઓ પૂર્વના મહાન પુરુષોના જીવનોમાંથી મળી રહે છે. એ તારવી તારવીને નોટમાં એકત્રિત કરી રાખી અભ્યસ્ત કરી રાખી હોય તો મનમાં એને વારંવાર પલોટી શકાય.

(૪) ચોથી નોંધ સુવચનોની :-

જીવનચરિત્રો પરથી એવી એક તારવણી, મહાન આત્માઓએ જુદા જુદા પ્રસંગે જે ભવ્ય વચ્ચે ઉચ્ચાર્યા હોય, એની થઈ શકે. એ પણ આપણને અવસરે શું બોલવું કેમ બોલવું, કેટલું બોલવું વગેરે ધણું ધણું શિખવી જાય છે.

દાખલા તરીકે જુઓ કે :-

વાલી રાજાના બોલ :-

વાલી રાજાએ રાવણ જ્યારે એને આજ્ઞામાં આવી જવાનું કહ્યું, ત્યારે શો જવાબ આપ્યો ? આ જ કે તારા અને મારા પૂર્વજીને મિત્રતાનો સંબંધ ચાલ્યો આવે છે; તે રાખવા હું તૈયાર છું બાકી સ્વામી સેવકભાવનો લોભ શા સારુ કરે ? વાલી રાજા પાસે જબરદસ્ત બળ છે, પરંતુ એથી કોઈ ઉદ્ધત, ઉધાણાં અભિમાનભર્યા બોલ કાઢવા નથી. કોઈ પણ ત્રાહિતને આ યોગ્ય વચ્ચે લાગે. રાવણે એ ન સ્વીકાર્યા, તો એને અંતે પસ્તાવું ફરજું.

રાવણ લડવા આવ્યો ત્યાં પણ વાલીના કેવા સુંદર બોલ ! એ કહે છે જો રાવણ ! તું ય શ્રાવક છે એને હું પણ શ્રાવક છું જગડો આપણા બેને છે, લશકર લશકરને નહિ. તો આપણા બંનેના વિવાદમાં નાહક બીજા નિર્દોષ મનુષ્યોનો સંહાર શા સારુ આપણે શ્રાવક થઈને થવા દેવો જોઈએ ! આપણે બંને એકલાં જ લડી લઈએ.’

આવા અવસરે શ્રાવક શું બોલે તો યોગ્ય ગણાય એ આમાંથી શીખવા મળે છે.

ચેડારાજાના બોલ :-

ચેડા મહારાજાએ પણ કોણિકે હલ્લ વિહલ્લને સોંપી દેવા કહ્યું ત્યારે કેવા યોગ્ય બોલ કહ્યા ? એમણે કહ્યું-

‘હલ્લ વિહલ્લ મારા શરણે આવેલા છે. એક શ્રાવક શરણાગતનો દ્રોહ કેમ કરી શકે ? તારે એમની પાસેથી દેવતાઈ હાર અને સેચનક હાથી જોઈતો હોય તો એ કહે છે તેમ રાજ્યમાંથી એક ભાગ એમને આપ, તો એ તને સોંપી દેવા તૈયાર છે. બાકી તું અન્યાયથી એ માગે, તો શી રીતે એ તને દે ?....’

સીતાના બોલ :-

સીતાને રામે જંગલમાં મૂકાવી દીધી ત્યારે સીતાએ રામને સંદેશામાં કેટલા બધા ભવ્ય બોલ કહેવરાવ્યા છે ! ‘હું જંગલમાં મૂકાઈ એમાંત્મારો નહિ કિન્તુ મારાં પૂર્વના અશુભ કર્મનો દોષ છે. પરંતુ લોક નિદાથી તમે ભલે મને છોડી, પણ કાલે ઊરીને લોક તમારા ધર્મની નિંદા કરે, તો ય આ ધર્મને તમે છોડતા નહિ, મને છોડવામાં તમારો મોક્ષ નહિ અટકે, પણ જૈન ધર્મ છોડવામાં તમારો મોક્ષ જરૂર અટકી જશે. આ બોલમાં કેવો ધર્મપ્રેમ અને દોષ કરનાર પતિ ઉપર પણ એક આત્મીય જન તરીકેની લાગણી નીતરી રહી છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૨૦, અંક-૨૭, તા. ૧૮-૩-૧૯૭૨

શ્રીપાલકુમારનું રાજ્ય કાકા અજિતસેને બથાવી પાહેલું, અને નાના બે વર્ષના શ્રીપાલને એ મારી ન નાખે એટલા માટે માતા બાળને લઈને ભાગેલી. પણ હવે શ્રીપાલ મોટી ઉમરના અને દસ આજ્ઞાંકિત રાજાઓને ફોજ સહિત સાથે લઈ કાકા અજિતસેન ઉપર ચડી આવ્યા, પરંતુ લડાઈ લડતાં પહેલાં કહેવરાવ્યું, આ, કે-

શ્રીપાળના બોલ :-

‘કાકાજ ! તમે આટલા વરસ મારું રાજ્ય સંભાળી રાખ્યું એ તમારો ઉપકાર માનું હું પણ હવે આ ભતીજો મોટો થઈ ગયો છે તે એ રાજ્ય સંભાળી શકશે. તેથી હવે તમારે કષ લેવાની જરૂર નથી; રાજ્ય સાંચી દઈ નિરાંતે આપ આત્મહિતની સાધના કરો.’

આ બોલમાં કેવી સૌભ્યતા કૃતજ્ઞતા અને ઔચિત્ય ઝળહળે છે !

કૃષ્ણ વાસુદેવની દ્વારિકા દૈપાયનદેવે બાળી મૂકી. માત્ર કૃષ્ણ અને બળદેવ બે જ જણ બળતા બચી ગયા ને પહેર્યે લુગડે ચાલી નીકળ્યાં જંગલમાં. ત્યાં કૃષ્ણ મોટાભાઈને કહે છે, ‘ભાઈ ! આ શું થઈ ગયું ? આપણે ત્રણ ખંડના સમ્રાટ રાજ આજે રખડતા ભિખારી ?

બળદેવના બોલ :-

બળદેવજી કહે છે- ‘કૃષ્ણ ! પ્રભુની વાણી મિથ્યા ન થાય. બાકી હવે બની ગયેલ હકીકત પર શોક કરવો રહેવા દે. ભવિતવ્યતાના નિર્ધારિત ભાવ કોણ મિથ્યા કરી શકે છે ? હવે તો આપણે વર્તમાન સમયને ધર્મશ્રદ્ધા અને શુભ ભાવથી સારો બનાવવો રહ્યો એમાં જ આપણી બુદ્ધિમત્તા. દેવતા બધું બાળી શક્યો છે, પરંતુ આપણી બુદ્ધિને થોડી જ બાળી શક્યો છે ? તો એ આપણને જ સર્વાહક સ્વાધીન બુદ્ધિમાં મર્દનીગીથી આપણાં જ ઉપાર્જલા કર્મનાં ફળને કેમ વધાવી ન

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ-કખાય રોકો : હૂટવાનો મોકો” (ભાગ-૪૪)

લેવા ? બુદ્ધિમાં શા સારુ રાંડીરાંડ અબળાની જેમ રોદણાં ઘાલવા ? જિનેશ્વરદેવ પ્રત્યેની ભક્તિના ભાવ કેમ ન વધારવા ?

ભયંકર આપત્તિ વખતે બળદેવજીના આ કેવા તત્ત્વપૂર્ણ બોલ છે ! કેવા ઉત્સાહવર્ધક અને સત્કર્તવ્ય પ્રેરક બોલ છે.

ભોજુકુમારને કાકા રાજ્ય મુંજે ભત્રિજો બહુ લોકપ્રિય બન્યો છે તો રખેને એ મને પદભ્રાષ્ટ કરી રાજ્ય લઈ લે તો ?’ એ ભયથી દિવાન દ્વારા મારા સાથે મારી નખાવવા મોકલ્યો પણ દિવાન ડાખ્યો છે, એ આ નરરતનાં નાશ કરવા નથી હિચ્છતો; એટલે મારાને ખાનગી કહી દીધું છે કે ‘ભોજને જંગલમાં લઈ જઈ રાજના હુકમનો અમલ કરવાનું કહી ભોજ શું કહે છે એ સાંભળી લેજે, ને પછી ભોજને ગુમપણો પાછો લઈ આવી મારા ભોયરામાં દાખલ કરી દેજે’ મારો એ પ્રમાણો એને લઈ જઈ રાજનો હુકમ કહે છે.

હવે ભોજુકુમારના યોગ્ય બોલ જુઓ.

ભોજ માથું નમાવી કહે છે, ‘તો પછી ચલાવ તારી તલવાર આ મારી ગરદન પર મહારાજાનો હુકમ હું એમનો અતિપ્રિય અને વિનીત પુત્ર જેવો ન માનું, તો પછી પ્રજા શી રીતે માનશે ?’

ભોજના કેવા વિનયભર્યા અને સ્વસ્થતાભર્યા બોલ ? એ કુદરતનું સત્ય રજુ કરે છે કે વડિલનું વચ્ચન અતિ નિકટનો માણસ ન પાણે તો દૂરના તો શો પાણે ?

માટે પૂછે છે, તો તમારે મહારાજાને કંઈ સંદેશો કહેવો છે ?’

ભોજ કહે,- સંદેશો એટલો કહે જે કે મોટા મોટા યુધિષ્ઠ અને બળી રાજ કે ચક્રવર્તી રાજાઓ જેવા પણ કોઈ જ મરીને આ પૃથ્વીને સાથે નથી લઈ ગયા, પણ મને લાગે છે કે તમે મરતી વખતે આને સાથે લઈને જવાના હશો.’

જુઓ આમાં પણ કોઈ દીનતાની વાણી નથી કે હું તો તમારો કેટલો બધો વિનય અને અદબ જાળવનારો ! ત્યારે તમે મારો આ દોષ કરો છો ? વગર ગુને મને મારી નખાવો છો ? ‘ના, કોઈ દીનતાનું વચ્ચન નહિ, પણ રાજ્યલોભમાં અંધ બનેલા કાકાને એક ચિમકી કે મોટા માંધાતા તો મરીને રાજ્ય સાથે ન લઈ ગયા, પણ તમે મરીને રાજ્ય સાથે લઈ જવાના હશો તેથી જ આ આશ્રિતનો દોષ કરો છો. પરંતુ સમજુ રાખો કે તમારી સાથે પણ આ રાજ્ય સંપત્તિ નથી આવવાની, તો એની ખાતર હવે પછી આવા કોઈ પાપ કરશો નહિ. નહિતર રાજ્ય તો અહીં રહેશે, પણ પાપ સાથે ચાલશે.

ભોજના બોલમાં જગતને માટે કેવો સુંદર બોધ પાઈ સમાયેલો છે કે

જે માન-મર્ત્યા અને વૈભવ વિલાસ એકવાર મૂકીને જ મરવાનું છે, ને જે

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“વાંચેલાનો પ્રયોગ” (ભાગ-૪૪)

સાથે નથી જ ચાલવાનાં એની ખાતર કાળાં પાપ શા સારુ કરવાંકે જે સાથે જ ચાલવાના ?

માણસ જો આ બરાબર સમજ રાખે તો પાપ બુદ્ધિ અને પાપાચરણથી તેમજ મદ અને માયા પ્રપંચથી જાતે જ જાતની બરબાઈ કરતો અટકી જાય

જ્યારે ધર્મનો ઉપદેશ સંભળાવનાર મળે ત્યારે તમે જ કહો છો ને કે આ સમજમાં તો બધું આવે છે, પણ એનો અમલ કેમ નથી થતો ? પરંતુ સાથે આ જો સમજ રાખો કે

ધર્મના ઉપદેશ પર અમલ નહિ થવાનું કારણ લક્ષ્મી લાડી અને વિષયોની આંધળી આસક્તિ છે; અને આ અંધ આસક્તિથી જાતે જ પોતાની બરબાઈ સર્જવાનું થાય છે. એ લક્ષ્મી વગેરે તો અહીં જ રહેવાના, ને અંધ આસક્તિના ઘોર પાપના પોટલાં સાથે ચાલવાનાં.

જો આ સમજો, તો એ આસક્તિ ઓધી કરી ધર્મ આચરાય. ભોજુકમારના બોલમાં કેવો સુંદર બોધપાઠ છે !

ભરત ચક્રવર્તીને હજુ ૮૮ ભાઈ આજા નીચે નથી આવ્યા તેથી ચક્રરત્ન શસ્ત્રશાળાની બહાર ઊભું રહે છે. પણ અંદર પ્રવેશ નથી કરતું સુષેષા સેનાપતિ ભરતને એ સમજાવીને કહે છે કે હવે ચક્રરત્ન અંદર લેવું હોય તો ભાઈઓ સાથે લડીને એમને આજાવશ કરી લો.' ત્યારે જુઓ ભરત શું કહે છે,-

ભરતના યોગ્ય બોલ :-

ભરત કહે છે, શું ? ભાઈઓ સાથે લડવાનું ? એટલે કદાચ એ યુદ્ધમાં ખપી ય જાય, તો શું મારે એમને મારી નાખવાના ? મારે એ મોખ નથી. રાજ્ય સુખ પણ જે ભાઈઓ વગેરે કુટુંબને સાથે રાખીને જ માણી શકાય. એમને જ મારી નાચ્યા પછી સુખ શું માણવાનું ? ભલે ચક્ર બહાર રહે; ભાઈઓ સાથે મારે લડવું નથી.'

ભરત ચક્રવર્તીના બોલમાં કેવો વિવેક ભર્યો છે !

પ્ર.- તો પછી ભરતે કેમ લડવાની તૈયાર કરી ?

ઉ.- એનું કારણ, સેનાપતિએ ઊંધા કાન પકડાવ્યા. સેનાપતિ કહે,- "સાહેબ ! આ કાંઈ સ્વાર્થ માટે નથી લડવાનું. આમાં દિલ્હિબિન્દુ બીજું છે. આપ આવો અસાધારણ દિલ્હિજય કરીને આવ્યા, છતાં આ નાના ભાઈઓમાં આટલો ય વિનય નથી કે 'લાવો મોટાભાઈ પાસે જઈને એમનાં ગજબના પરાકમ માટે અભિનંદન કરી આવીએ.' આ અવિનયથી પિતાજીના નિર્મળ ફળને કલંક લાગે છે. તેથી ભાઈઓને આપે વિનય શીખવવાની ફરજ છે. એ ફરજ અદા કરવા માટે

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ-કખાય રોકો : દૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૨૪૮

પહેલાં શાંતિથી એમને કર્તવ્યનું ભાન કરાવવું, અને તેમ છતાં જો એ કર્તવ્ય સમજવા તૈયાર ન હોય, તો બળથી પણ એમને કર્તવ્યની સમજ કરાવવી જોઈએ.'

સેનાપતિના આ ચાલાકીભર્યા બોલ પર ભરત ભોળવાયા, અને એ રીતની સમજ આપી દૂતને ભાઈ પાસે મોકલ્યો. બાકી પૂર્વના એમના બોલ હદ્યના જ હતા અને સુયોગ હતા.

ચાલિત્રશાસ્ત્રોમાં તો ધામઠામ આવા યોગ્ય બોલ મહાન આત્માઓના મુખમાં મૂકાયેલા પડ્યા છે. એ બધા બોલને જો એક નોટમાં નોંધી નોંધી એકત્રિત કરો અને એ વારંવાર વાંચતા રહો, તો એક તો અવસરને યોગ્ય શું શું બોલવું જોઈએ, એ ખૂબ શીખવા મળે, તેમ જ બીજું એ કે એ વચ્ચનોમાંથી ઘણી હિતશિક્ષા તારવી શકાય.

આપણી મૂળ વાત એ પર ચાલે છે કે તેવાં તેવાં નિમિત્તો આવી પડતાં આપણો રાગ દ્વેષ મદ-મોહ-મત્સર વગેરે ખરાબીઓ ચિત્તમાં ઊઠતી કેમ અટકાવી શકીએ ? એના ઉપાય શા શા ? એમાં આ ઉપાયની વિચારણા થઈ રહી છે કે શાસ્ત્રોનું વાંચન શું કરવાનું ? તો કે પહેલું સહેલામાં સહેલું કાર્ય આ કે મહાપુરુષોના ચાલિત વાંચતા જવા અને સાથે જુદી જુદી નોટમાં એમના આપત્તિ પ્રસંગો, એમની સંપત્તિ સમૃદ્ધિઓ, એમણે કરેલી શુભ ભાવના તથા અવસરે એમણે ઉચ્ચારેલા સુયોગ બોલ નોંધતા જવાનું; એને વારંવાર વાંચતા રહેવાનું અને એવું મુખપાઠ કરી લેવાનું પછી એ મનમાં સંણગ ચાલ્યા કરે.

નોંધથી બીજાને પણ સમાધિ આપી શકાય :-

આ મહાપુરુષોની આપત્તિ, સંપત્તિ, વગેરે એકેક ચીજ થોકબંધ યાદ હોય એનો અદ્ભુત પ્રભાવ જુઓ કે આપણે તો શું, પણ બીજો કોઈ કશી આપત્તિ આવવા પર મુંઝાતો હોય એને આપણે પાસે બેસીને શાંતિથી કહી શકીએ કે

જુઓ ભાઈ ! તમારે આપત્તિ ખરાબ આવી. તો હવે સાથે એ જુઓ કે પૂર્વ પુરુષોને કેવી કેવી આપત્તિઓ આવેલી અને એમાં એમણે કેવું ધૈર્ય અને કેવી તત્ત્વ વિચારણા રાખેલી.

એમ કહીને પછી આપણે મુખપાઠ જેવી કરેલી મહાન આત્માઓ પરની આપત્તિઓ લાઈનસર કહેવા માંડીએ અને સાથે એમણે દાખવેલ ધૈર્ય અને રાખેલ તત્ત્વ સમજ પણ કહેતા જઈએ, તો સામા માણસને કેટલી બધી રાહત મળી જાય ? કેવી એના ચિત્તને સમાધિ મળે ?

એમ ને એમ એકલું એટલું જ કહીએ કે ભાઈ ! હિંમત રાખો, બન્યું હવે ન બનવાનું થવાનું છે ? તો પછી ફોગટ ચિત્તકલેશ શા માટે ? હવે ધીરજ રાખો;

૨૪૬ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“વાંચેલાનો પ્રયોગ” (ભાગ-૪૪)

આટલું કહીએ એથી કાંઈ મુંજાઈ હતાશ થઈ ગયેલા સામાને રાહત ન મળે. પરંતુ જો પૂર્વ પુરુષોની આપત્તિના દાખલા પર દાખલા સંભળાવ્યે જઈએ, તો એથી સામાને હિંમત આવી જાય, મનને લાગે કે તો પછી મારે તે શી એવી મોટી આપત્તિ છે? અને જે આપત્તિ આવી છે. એના પર હું પણ પૂર્વ પુરુષની જેમ તત્ત્વ વિચારણા અને હિંમત રાખી શકું આમ એના મનને રાહત થઈ જાય.

દા.ત. કેઠને દીકરી કે પત્ની ગુજરાતી ગયાની આપત્તિ આવી, ત્યાં જો એને સગર ચક્કવર્તીના ૬૦ હજાર પુત્ર એક સાથે મરી ગયાની આપત્તિ સંભળાવીએ કૃષ્ણ વાસુદેવ ત્રણ ખંડના માલિકને દ્વારિકા બળી ગયા પછી પુત્રો અને પત્નીઓ બધું જ ગયાની આપત્તિ સંભળાવીએ, સુણાવીએ, રાજ હરિશ્ચંદ્રને રાજ્યપાટ ગયા પછી પત્ની તારામતી તથા પુત્ર રોહિત વેચાઈ જવાની આપત્તિ આવી તે વર્ણવીએ, સાથે એ બધાનાં ધૈર્ય અને સુયોગ્ય વિચારણાનાં વર્ણન કરીએ, તો સામાને કેટલી બધી હિંમત આવી જાય?

(પ) પાંચમી નોંધ ઉપદેશોની :-

આમ મહાન આત્માઓની આપત્તિઓની સંગં નોંધ મુખપાઠની જેમ તૈયાર હોય, સંપત્તિઓની, શુભ ભાવનાઓની તથા સુયોગ્ય બોલની સંગં નોંધ મુખપાઠ હોય, એનો અલબેલો પ્રભાવ છે. એવી એક નોંધ મહાપુરુષોના ઉપદેશોની કરવાની એ પણ ઉપદેશોની કરવાની એ પણ ઉપદેશો નોટમાં થોકબંધ ભેગા થાય એ વાંચી વાંચીને કંઠસ્થ જેવા કરતા જાય, અને પછી વારંવાર એનું સ્મરણ કરતા રહેવાય તો મન પર એની ખૂબ અસર પડે; -

નોંધોથી વખતે લાભ :-

એ નોંધો મુખપાઠ થઈ વારંવાર યાદ કરાય તો અનાદિના કેટલાય કુસંસ્કારો આત્મા પરથી ધોવાતા જાય, અને સુસંસ્કારો ઉભા થતા જાય. આના પરિણામે પછી પ્રલોભક કે ખોટાં નિમિત્તો આવી મળતાં ચિત્તમાં રાગ-દ્રેષ્ટાદિ ખરાબીઓ નહિ ઉઠે.

ત્યારે, ચરિત્રાંશોમાં થોકબંધ ઉપદેશો ભરેલા છે એ બધાને એક નોટમાં એકનિત કરવાના છે. ત્રિપણી શલાકા પુરુષચરિત્રમાં ચોવીસ ભગવાનના મુખમાં જુદી જુદી રીતના ઉપદેશ મૂકેલા છે. એવા આચાર્ય મહારાજો તથા મુનિમહારાજોના ઉપદેશ મૂકેલા છે. એ બધાની ટૂંકી યા વિસ્તારથી નોંધ એકજ નોટમાં સંગૃહિત થાય એ એક ડેવો ખજાનો બને?

બસ, નિમિત્તોમાં રાગ-દ્રેષ્ટાદિ ખરાબીઓથી બચવા અનેક ઉપાયો વિચાર્ય છે. એને અમલમાં મૂકી એ ખરાબીઓથી બચો, અને જીવનનો આ એક જબરદસ્ત લહાવો કમાઈ લો, એ જ મંગળકામના.

‘એકાદ પણ ધર્મસાધનાને મજબૂત પકડો’

‘મહાનલ ! એકજ દે ચિનગારી’ એટલે ? :-

કહે છે ને કે એકજ ચિનગારી બસ છે. પછી આગ વધતાં વાર નહિ. એટલે જ ભક્તજન પ્રભુને પ્રાર્થના કરે છે, ‘મહાનલ ! એક જ ભક્તજન પ્રભુને પ્રાર્થના કરે છે, ‘મહાનલ ! એકજ દે ચિનગારી.’

પ્રભુ વીતરાગ છે, એટલે કે રાગાદિ પ્રત્યે મહા અનલ છે, આગ છે. એમાંથી એક ચિનગારીરૂપ વૈરાગ્ય મળી જાય પછી તો એ વધતાં વધતાં વીતરાગતારૂપી મહા અનલે જઈ ઠરશે. એટલે જ કહેવાય છે કે જીવનમાં એક પણ નાને શુષ્ણ લાવી બરાબર પકડી રાખો. એના પર આગળ જતાં મોટો શુષ્ણ-વિસ્તાર થશે.

મહાપુરુષનાં જીવનમાં જુઓ તો દેખાશે કે એમણે પૂર્વભવે એક નાની સાધના બરાબર પકડેલી તો એમાંથી પછીના ભવે શુષ્ણવિસ્તાર ધર્મ વિસ્તાર થઈ ગયો.

નયસારને જંગલમાં મુનિ પાસેથી દેવ-ગુરુ-ધર્મની ઓળખ મળી એ મરતાં સુધી બરાબર પકડી રાખી, તો પછી મરીયિના ભવે ભરતયક્કવર્તીના શુષ્ણિયલ પુત્ર થયા, અને પેલો ધર્મવિવેક ફાલ્યો ફુલ્યો તે આદીશર પ્રભુનાં સમવસરણનું નિમિત્ત મળતાં એના મનને થયું કે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૨૫, અંક-૩૫, તા. ૧૪-૫-૧૯૭૭

‘એકાદ પણ ધર્મસાધનાને મજબૂત પકડો’

સમવસરણ જોતાં મરીયિની વૈરાગ્ય વિચારણા :-

‘મારા દાદા ઋખભટેવ ભગવાને ધર્મ કર્યો એમાંથી આ સમવસરણ, આ ચાંદી-સુવર્ણ-રત્નમય ગણ ગઢ ! એના મથાળે પ્રભુને આ અષ્પ્રાતિહાર્ય ! દેવલોકમાંથી હોંશે હોંશે આ દેવદેવીઓનાં આહીં પ્રભુની સેવામાં આગમન ! આ પરસ્પર વિરોધી સિંહ-હરણ, સાપ-મોર ઉંદર-બિલાડી વગેરે જંગલી-શહેરી પ્રાણીઓનાં પણ શાંતિથી-મિત્રતાથી એક બીજાની પાસે બેસીને ટગર ટગર પ્રભુ-દર્શન અને પ્રભુની વાણીના શ્રવણ પર મસ્તક ડેલવાં !.... વગેરે ઐશ્વર્યનાં સર્જન થયાં તો

જો ધર્મના મૂળ પર જ ડાળપાંખરૂપી સંપત્તિ ઐશ્વર્યની ઝાકજમાળતા સરજાય

એ ધર્મનો કેટલો ગજબ પ્રભાવ !

સંપત્તિ-ઐશ્વર્ય એ તો ધર્મભૂળ પર ડાળપાંખળાં. મારે પિતાજીના ધરમાં રાજશાહી વૈભવ વિષયોની સંપત્તિ એ પણ પૂર્વના ધર્મભૂળ પરનાં જ સર્જન છે, તો હવે મારે ધર્મરૂપી મૂળમાં વળગવું ? કે સંપત્તિરૂપ ઉપરનાં ડાળપાંખળાને વળગી બેસી રહેવું ? મૂળ સલામત તો ઉપરનું બધું સલામત માટે મારે ધર્મ જ મુખારક છો, ચારિત્રધર્મને જ હું સેવું. સંપત્તિ ઐશ્વર્ય તો આ દેવતાઓને પણ મળે, પરંતુ એમને ચારિત્રધર્મ ક્યાં મળે છે ? એ તો માત્ર આ મનુષ્યભવની જ લહાણ છે, મનુષ્યભવનાં જ મળી શકે. તો પછી મૂળભૂત ચારિત્રધર્મને જ કાં ન સેવું ? બસ, નયસારના ભવમાં દેવગુરુ ધર્મની ઓળખ પર એની માત્ર લગન ઊભી કરેલી, તો અહીં મરીચિના ભવે એ વિસ્તરી અને ચારિત્રધર્મની આરાધનામાં જીવન જુકાવ્યું. ભરતચક્કિના બીજા પુત્રપૌત્રો તો હજુ સમવસરણ પર ચઢી પ્રભુની વાણી સાંભળ્યા પછી વૈરાગ્ય પામી ચારિત્રધર્મ લેવાના અભિલાષી બનશે, પરંતુ આ મરીચિ તો સમવસરણનાં પગથિયા ચહતાં જ સંપત્તિ અને ધર્મનો વિવેક કરી વૈરાગ્ય પામીને ચારિત્ર લેવાનો ત્યાં જ સંકલ્ય કરી લે છે ! નયસારના ભવમાં એક નાના ગુણમાંથી આ કેવો જબરદસ્ત ગુણવિસ્તાર !! નાની ધર્મલગ્નમાંથ કેવો મોટો ચારિત્રધર્મ સ્વીકાર !

બસ, આ કરો, જીવનમાં એકાદ પણ ગુણને એકાદ પણ ધર્મને વળગી જાઓ. પાકી વફાદારી અને અનન્ય હોંશથી, બીજી વસ્તુ માટે ન હોય એવી હોંશથી એને પકડી રાખો, પછી જુઓ એ કેવો ફાલે ફૂલે છે.

મોટાની સેવાનું એક દણ્ઠાં.

રાજ શ્રેષ્ઠીકિના વખતમાં એક ગામડાનો છોકરો બિચારો ભલો-ભોળો, તે એને જાંજી સમજ નહિ, એટલે માતાએ એને શીખબ્યું કે ‘જો બચ્ચા ! તારે કલ્યાણ કરવું હોય તો મોટાની સેવા કરતો રહેજે.’

કલ્યાણમાતા વિના આ કોણ શીખવે ? માતા તો ફૂતરા-ગધેડાના બચ્ચાને પણ હોય છે. પરંતુ એ એને પાળી પોખી મોટો કરવા તથા સંસારી જીવન જીવા શિખવવા સિવાય બીજું શું શીખવે છે ? શું માનવી માતા અને તે પણ આર્થ માતા શ્રાવિકમાતા આટલું જ કરીને બેસી રહેવાની હોય ? કે એ કલ્યાણમાતા બનીને ગુણશિક્ષણ આપનારી હોય ?

જાણો છો ને કે ગર્ભિણી સીતાજી પતિ રામચંદ્રજીથી વનમાં તરછોડાએલા છતાં પછીથી જન્મેલા પુત્ર લવણ અંકુશને જ્યારે મોટા થઈ પિતાના એ જુલભ જાણ થતાં પિતાની સાથે યુદ્ધ કરવા ને એમને હરાવવા માટે જવા માતા પાસે ભુવનભાનુ અન્સાઈક્લોપ્ાડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૨૪૮

આશીર્વાદ માંગે છે ત્યારે એમને સીતાજીએ શું કહ્યું ? ‘હા, જાઓ, ખુશીથી, તમારા અભિમાની પિતાને બતાવી આપો’ એવું ન કહ્યું. કેમકે એમાં દીકરાનું કલ્યાણ શું ? એ તો કહે છે ‘વરીલ પિતાજ સામે લડવા ન જવાય, તમારે જવું હોય તો ય તો એમનાં દર્શન-નમસ્કાર માટે જાઓ.’

કેવી ધન્ય માતા ! ત્યારે વિચારવા જેવું છે કે આમ કહેવા પાછળ સીતાજીએ પોતાનું દિલ પતિ પ્રત્યે કેવું ઉંખ વિનાનું રાખ્યું હોશ ! પતિ રામચંદ્રજીએ કામ કેવું કર્યું છે ? ગર્ભિણી અવસ્થામાં નિર્દોષ મહાસતી સીતાજીને જંગલમાં એકલા અટુલા જંગલમાં તરછોડી દેવાનું. આવા પણ પતિની પ્રત્યે સીતાજીનું દિલ ઉંખિલું નહિ. માટે તો જ્યારે આગળ પર દિવ્ય કર્યા પછી અજિની ખાઈ પાણીનું સરોવર બની ગઈ, લોકોએ મહાસતીનો જ્યયજ્યકાર પોકાર્યો, અને રામચંદ્રજી પોતાના અપરાધની ક્ષમા માગતાં કહી રહ્યા છે કે ‘અમે તમારા પર ભારે અપકાર કરેલો, અમને ક્ષમા કરજો,’ ત્યારે સીતાજીએ, જાણો છો, કેટલો અદ્ભુત જવાબ આપ્યો છે !

દિવ્ય પાર કરવામાં રામ ઉપકારી ! :-

સીતાજી કહે છે,- ‘તમે અપકારી નથી ? તમે તો મારા ઉપકારી છો. આ અજિન પાણી થઈ ગયું એ તમારા જ પ્રભાવે; કારણ કે મારા દિલમાં તમે હતા તો જ આ અજિન પાણી બની બની . જો દિલમાં તમારા બદલે બીજાને ઘાલ્યા હોત, તો અજિન પાણી બનવાની શી વાત ! અજિન તો મને ભસ્મીભૂત કરી નાખત ભસ્મીભૂત ! તો તમે જ મારા દિલમાં હોઈને મારા માટે અજિન પાણી થઈ જાય એ શું તમારો ઓછો ઉપકાર છે ?’

હવે વિચારો, જો સીતાજીના દિલમાં પતિ પ્રત્યે પોતાની હકાલપદ્ધી કર્યાનો ઉંખ હોત, દિલ ઉંખિલું હોત, તો પતિને મહાઉપકારી ઠરાવનાર આ બોલ નીકળત ? ઉંખ હોત તો તો આવું કંઈક બોલાવત કે ‘લ્યો માથું વાઢી નાખ્યા પછી ક્ષમા માગવી છે !’ પણ કર્મ પર અટલ વિશ્વાસવાળા સીતાજીએ રામ પર ઉંખ રાખ્યો જ નથી એટલે રામને શાના દોષિત ગણે ? ને ભૂતકાળની વાત શાની યાદ કરે?

સીતાજીના દિલમાં પતિએ જંગલમાં હકાલપદ્ધી જેવી ભયંકર આપત્તિ આપ્યાનો ઉંખ અને મહાસતી છતાં અસ્તીની ઝ્યાતિ જેવી જબરદસ્ત નાલેશી કર્યાનો ઉંખ કેમ નહિ ?

એકજ કારણ, કે પોતે એ આપત્તિ અને નાલેશી પતિએ કર્યાનું માનતા જ નથી. એ તો પોતાનાં કર્મ કર્યાનું માને છે. ‘દુઃખમાં જ્યાં કર્મ જ જવાબદાર હોય, ત્યાં દોષ દેખાય તો એને, ઉંખ રખાય તો એ કર્મની પ્રત્યે; પણ બિનજવાબદાર

૨૫૦ ભુવનભાનુ અન્સાઈક્લોપ્ાડિયા-“એકાદ પણ ધર્મસાધનાને...” (ભાગ-૪૪)

પતિને કે લોકને શી રીતે દોષ દેવાય ? એમની ગ્રત્યે ઉંખ શાનો રખાય ?' કેવી સુંદર તત્ત્વ દિણ ! કેવું સુંદર સત્ય અવલોકન ! વાત તો સાચી જ છે કે,

આપણાં પોતાના પૂર્વોપાર્કિંગ અશુભ કર્મ વિના આપણું કોઈ બગાડનાર નથી. કોઈ આપણું પ્રતિકૂલ કરનાર નથી.

ધલ શેઠ શ્રીપાલનું ઘણું બગાડવા મથ્યો હતો, પણ શ્રીપાલને એવાં અશુભ કર્મ હતાં નહિ, તેથી એમનું કશું બગાડી શક્યો નહિ. ઉલટું શ્રીપાલને પોતાના શુભકર્મનો સારો ઉદ્ય હોવાનું ખરાબ થવાને સ્થાને જ સારું થતું ગયું !

એમ મયણાને ય અશુભ કર્મ નહોતા, તો પિતાએ એના પર ગુસ્સે થઈ કોછિયા સાથે પરણાવીને એનું મહા ખરાબ કરવા પ્રયત્ન કર્યો, પરંતુ એનું કશું ખરાબ ન થયું, ઉલટું પોતાના શુભકર્મ સાબૂત હતા તેથી એમાં જ સારું થયું કોછિયામાં જ ઉત્તમ રાજકુમાર શ્રીપાલ સાંપરી ગયો ! જેના પર પછીથી બાપને પોતાના અકાર્ય બદલ ભારે પસ્તાવો કરવાનો અવસર આવ્યો. પોતાનાં અશુભ કર્મ વિના પોતાનું બગાડનાર કોણ જન્મ્યો છે ?

દામનકર્તું દષ્ટાન્ત

દામનકે પૂર્વે ભવે મુનિને દાન દીધું છે, પણ જરા ખચકાઈ ખચકાઈ તેથી એને અશુભ કર્મ બંધાયા છે પણ તેવાં ધોર કર્મ નહિ. તેથી એનો શેઠ અહીં એનું ભારે બગાડવા મથે છે, પણ બગાડી શકતો નથી. ઉલટું દાનના શુભ કર્મને લીધે દામનકર્તું સારું જ થતું આવે છે, મંદ અશુભ કર્મ એટલે આપત્તિ આવી દેખાય, પણ તીવ્ર અશુભ નહિ તેથી એવું બગડે નહિ. એટલે જ આ ધ્યાન રાખવા જેવું છે.

દાન વગેરે ધર્મ કરો, પણ દિલમાં કોઈ ખચકામણા-શંકા-દ્રેષ વગેરે રાખ્યા વિના; નહિંતર દાનના ફળમાં ખચકામણ આદિ થશે.

દાનનું ફળ શુભ, પરંતુ એમાં ખચકામણ વગેરેનાં અશુભનું મિશ્રણ થશે. મમ્માણે પૂર્વે મુનિને દાન દીધેલું, પરંતુ પછી નિંદા હાયવોય કરેલી. પૂજામાં બોલો છો ને કે

'મુનિવરને મોદક પડિલાભી, પછી કરી ઘણી નિંદના રે,
જિનરાજકું સદા મોરી વંદના રે.'

તો મમ્માણને ફળમાં શુભની ભારે સંપત્તિ મળી, રતનો બળદિયો ! કિન્તુ અશુભના હિસાબે ભયંકર મૂર્ખ્ય-હાયવોય-શોકનું મિશ્રણ મળ્યું; જેનાં પરિણામે સાતમી નરકમાં પતન થયું. ધર્મ કરો, પણ ચોખ્યો નિર્મળ; એમાં શંકા-કુશંકા કરો નહિ, હાયવોય નહિ, દુન્યવી ફળની આશંસા નહિ.

દામનકર્તે એવાં તીવ્ર અશુભ કર્મ હતા નહિ, એટલે એવી આપત્તિ નથી

ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો: ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

આવતી, પરંતુ નાનાં અશુભ છે એ એનો ભાવ ભજવી જાય છે. એ જન્મેલા સારા ધરમાં, પણ અશુભના ઉદ્યે માતાપિતા મરી જતાં એકલાને ખાલી હાથે પરગામ નીકળી જવું પડેલું. તે આવ્યો એક શેઠના ધરે, અને ધરમાં નોકરીએ રહ્યો. એકવાર બે મુનિ ત્યાં બિક્ષાર્થે આવ્યા છે, તે આને જોઈને એક મુનિ બીજાને કહે છે ‘આ છોકરો ભાગ્યશાળી છે, આ ધરની વિપુલ સંપત્તિનો માલિક થશે.’

શેઠ આ સાંભળી ગયો, એને લાગ્યું કે મહાત્મા ખોટું બોલે નહિ. તો શું આ વાસણ માંજનાર નોકર મારો વારસદાર થાય ? ના, ના, ના, એણે નોકર દામનકર્તે મારી નખાવવાનો વિચાર કર્યો. શેઠ વિચાર કરીને બેસી ન રહ્યો પણ તરત ચંડાળને ખાનગીમાં કહી દીધું કે ‘આ છોકરાને જંગલમાં લઈ જઈ મારી નાખજે. હું તને ખૂબ ધન આપીશ’

ચંડાળને હવાલે દામનક :-

ચંડાળ લોભમાં પડી આવું ગોળાકું કૃત્ય કરવા તૈયાર થઈ તો ગયો, અને છોકરાને ગમે તેમ ફોસલાવી ગામ બહાર લઈ ય ગયો, પરંતુ ત્યાં દામનકર્તું પુણ્ય જોર કરે છે, તે ચંડાળ છોકરાની નિર્દોષ અને હસમુખી મુખમુદ્રા દેખી પીગળી ગયો. એના મનને થયું કે ‘આ છોકરો શેઠના ધરમાં નોકર છે તેથી શું થઈ ગયું ? નોકર હોવા માત્રથી થોડો જ ગુનેગાર છે, યા દુશ્મન છે ? આવા બિચારા નિર્દોષ છોકરાને મારી નખાવાય ? શેઠ પાગલ છે. પણ ભલે શેઠની બુદ્ધિ ભાષ થઈ, મારી બુદ્ધિ સલામત છે. હું કાંઈ આવા નિર્દોષ બાળકને મારી નાખું નહિ.’

તેથી ચંડાળ કહે છે ‘જો ભાઈ ! તારા શેઠનો તને મારી નાખવાનો મને હુક્કમ છે પરંતુ હું તને મારું નહિ છતાં તારે હવે શેઠના ધરે પાછા ન જતાં અહીંથી આગળ ચાલ્યા જવાનું તો જ તને ન મારું.’

દામનકર્તે તો પ્રાણ બચે છે તેથી શું કામ શેઠને ત્યાં પાછો વળવાનું મન થાય ? ચંડાળે છોડી દીધાથી એ ચાલ્યો આગળ.

બોલો ચંડાળ એ કસાઈ ? કે શેઠ એ કસાઈ ? અહીં ચંડાળ દ્યાળું બની ગયો, અને શેઠ કસાઈ જેવા બની ગયેલો ! કેમ આવો મોટો ફરક ? કહો, (૧) શેઠમાં સ્વાર્થની વાસના જોરદાર ઊછળી કે ‘મારે આ નોકરના હાથમાં મારી મિલકત ન જવા દેવી’ સાથે, (૨) અભિમાન ઉદ્ઘયું કે ‘હું ઊંચા કુળનો તે આવા હલકા માણસને મારો વારસદાર કેમ બનવા દઉં ?’ તેમ (૩) શ્રીમંતાઈનો મદ ચડ્યો કે ‘મારી પાસે પૈસા છે તો એના જોર પર નોકરને તો ક્યાંય ઉરાડી દઉં ?’

સંસાર આટલા જ માટે ભયંકર છે, કે

(૧) એમાં કરપીણ કૃત્ય કરવા સુધી લઈ જનારી ગોળારી સ્વાર્થવાસના જોર

૨૫૨ ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“એકાદ પણ ધર્મસાધનાને...” (ભાગ-૪૪)

કરી જાય છે.

(૨) ખોટાં અભિમાન માનલાગણી ઉછળી આવે છે.

(૩) કરપીણ કૃત્ય કરાવનાર શ્રીમંતાઈ વગેરેના મદ તરવરી ઉઠે છે.

આવા સંસાર પર પ્રેમ થાય ? કે નફરત ?

ત્યારે, ચંડાળમાં માનવતા જણકી ઉડી કે આવા સારા માણસને વગર વાંકે કેમ મરાય ?' શેઠ અને વગર વાંકે મરાવી નાખવાનું કરતો હતો એ અની માનવતાના ખોળિયે શિકારી પશુતા હતી. કેટલીકવાર બહારની પરિસ્થિતિ જુદી હોય છે, અને હૃદયની સ્થિતિ એનાથી વિપરીત હોય છે. વાત આ,

હૃદય આપણે ધાર્યું સારું કે નરસું કરી શકીએ.

આપણે માનવ બનવું છે, તો તેવું હૃદય બનાવી શકીએ.

પેલા દામનક ચાલતાં ચાલતાં પહોંચ્યો દૂર એક ગોકુળમાં ગોકુળ શેઠનું જ હતું, પણ આને ખબર નહિ, તેથી ત્યાં નોકરીએ રહેવા ગયો, ને ગોકુળમાં અને નોકરી પર રાખી લેવામાં આવ્યો.

ભવિતવ્યતા કેવું કામ કરે છે ! (૧) નોકરીને જે શેઠ ઈચ્છે તેમ નથી, એજ શેઠના ગોકુળમાં નોકરી ! તેમજ (૨) જે શેઠ નોકરને પોતાની હકુમતમાં હોયે મરાવી નાખવાની પેરવી કરે છે, એના જ સંકાળમાં અજાણ્યે ભરાઈ જવું પડે છે. ત્યારે આપણને એમ લાગે કે 'આ બધું અકસ્માત બની આવે છે.' ના અકસ્માત નહિ; પરંતુ તેવી ભવિતવ્યતારૂપી કારણના હિસાબે બની આવે છે. કારણ વિના કાર્ય બને નહિ. અહીં કારણભૂત તત્ત્વ છે ભવિતવ્યતા. ભવિતવ્યતા પણ એક પદાર્થ છે. દામનકને ચંડાળે છોડી દેવો, અને નોકરે એવા જ રસ્તે ચાલવું કે જ્યાં શેઠનું ગોકુળ આવે, ને પાછું પોતે જાણતો ન હોય કે આ એજ શેઠનું ગોકુળ છે,'.....બળવાન ભવિતવ્યતા આ બનાવી દે છે.

આ ઉપરથી આપણા જીવનમાં જ્યારે જ્યારે આવી કલ્પના બહારની કોઈ અનિષ્ટ વસ્તુ બની આવે ત્યારે આ પણ એક આશાસન લેવાય કે 'હોય ભવિતવ્યતા બળવાન છે, એને મોટા ચમબંધી ફેરવી કે અટકાવી શકતા નથી. તો હું કોણ માત્ર ?'

અનિષ્ટને ભવિતવ્યતાનાં સર્જન તરીકે વધાવી લેવાય તો ચિત્તમાં સમાધિ જળવાઈ રાખવા એ અત્યંત જરૂરી.

સમાધિ એટલે ? :-

સમાધિ એટલે ચિત્તને વિલ્લણ ન થવા દેવું, હર્ષના ઉન્માદમાં કે શોકની દીનતામાં ન પડવા દેવું, શોકના સંતાપમાં ન પડવા દેવું. આ એટલા માટે જરૂરી ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-'પ્રવચન મહોદધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો'(ભાગ-૪૪) ૨૫૩

છે કે (૧) ખાસ તો આત્મા એથી આર્તધ્યાનમાં સપદાઈ માત્ર મનના વાંકે તિર્યંચગતિના પાપ ન ઉપાર્જે; તેમજ (૨) એ અસમાધિના કુસંસ્કારનો વારસો ન લઈ ચાલે. બાકી વિલ્લણતા-દીનતા-સંતાપ અહીં છતી સુખ સામગ્રી જીવને સુખનો શાંતિનો અનુભવ નથી કરવા દેતી. આવી અસમાધિ-વિલ્લણતા અસ્વર્થતાથી બયવા ગમે તેવા અનિષ્ટ મામલા ઉપર પણ મનને મનાવી લેવું જોઈએ જેથી મન વિલ્લણ ન થાય.

અનિષ્ટમાં વિલ્લણતાથી બયવા મન મનાવી લેવું એનું એક સાધન છે ભવિતવ્યતાનો વિશ્વાસ અને વિચાર.

ભવિતવ્યતા પર વિશ્વાસ હોય તો મનને એમ થાય કે 'ભવિતવ્યતા બળવાન છે. ભવિતવ્યતા જ એવી કે અમુક રીતે જ આવી ઘટના બની આવે. જો એમ જ નિર્ધારિત હોય તો મારે એ જોઈ શા માટે ગ્રંચાનીયા થવું ? શા માટે વિલ્લણ થવું ? મારી વિલ્લણતાથી કાંઈ બન્યું ન બન્યું નહિ થાય, કે બનવાનું અટકાવી નહિ શકાય. પછી વિલ્લણતામાં મનને ફોગટ બાળવું શા સારુ ?

પેલા દામનકની ભવિતવ્યતા જ એવી છે કે શેઠની એને ખત્મ કરવાની ચંડાળને ભલામણ છતાં ચંડાળની દયાથી એ ધૂટવ્યો; છતાં હવે આગળ ચાલતાં પાછો શેઠના જ ગોકુળમાં પહોંચ્યો, અને ત્યાં એને નોકરી મળી ! નોકરી પુણ્યથી મળે, પરંતુ તે તો ગમે ત્યાં મળી શકે. ત્યારે અહીં શેઠના જ ગોકુળમાં નોકરી શાથી મળી ? ચંડાળનું નગરના એવા દરવાજા બહાર છોડી દેવું કે જેથી એ દિશામાં આગળ ચાલતાં શેઠનું જ ગોકુળ આવે ! આ કોણે ગોઠવી રાખ્યું છે ? કહો,

પુણ્યથી સારું મળે, પરંતુ એમાં ચોક્કસ પ્રકારના સંયોગો ભવિતવ્યતા જ કરી આપે છે.

જુઓ અહીં બીજી રીતે પણ ભવિતવ્યતા કામ કરી રહી છે,-આગળ જે સારું ફળ પુણ્યથી આવવાનું છે, તે અહીં જ નોકરી રહે તો જ આવવાનું છે. આ ગોઠવાણ કોણે કરી ? ભવિતવ્યતાએ.

પુણ્યનું કામ માત્ર સારું આપવાનું, પણ તે અમુક રીતે જ મળે, અમુક જ પ્રકારના ચોક્કસ સંયોગ ગોઠવાઈને મળે, એ કામ ભવિતવ્યતાનું, પણ પુણ્યનું નહિ. પુણ્યકર્મ પર કાંઈ એવું લખાયેલું નથી હોતું કે એ સારુ મળવામાં અમુક પ્રકારના જ સંયોગ બની આવે. એ બની આવવાનું ભવિતવ્યતાને લીધે જ થાય છે. અસ્તુ.

પેલો દામનક ગોકુળમાં નોકરી રહ્યો છે ત્યાં એક દિવસ શેઠ ગોકુળમાં

આવી ચંડો છે, ને એ દામનકને ત્યાં નોકરીમાં જોઈ ચોંકી ઉઠ્યો કે ‘અરે ! મેં આને તો મારી નાખવા ચંડણને સોંપી દીધેલો, તે પાછો અહી જીવતો ઉભો છે ? ને તે વળી મારે ત્યાં જ નોકરીમાં ?’ શેઠ ચોંકી તો ઉઠ્યો પરંતુ ત્યાં પોતાનાં છોકરાને એમ કેમ કહેવાય કે ‘આને તો મેં મારી નાખવા ચંડણને સોંપેલો તો તે કેમ અહીં નોકરીએ રાખ્યો ?’ આવું ગ્રગટ કરાય નહિ, છતાં મન દુભાયા કરે છે કે ‘આને જીવતો કેમ રખાય ?’ જીવતો રહે તો મારી ઋદ્ધિનો વારસો લઈ બેસે.’

શેઠ એક વાર તો પાછો પડ્યો છે, પરંતુ વીંછી ડંબિલાપણું ન મૂકે એમ એ ઉંખ નથી મૂકતો. એ વિચારે છે કે ‘એર ! પણ આનો હવે બીજી રીતે નિકાલ કરી નાખું. ડંબિલાપણું ભૂંડી ચીજ છે. પાપનું શાલ્ય એ ડંબિલાપણું છે. એ છૂટે નહિ. ગમે તેટલો પાછો પડે, ઢોકર ખાય, છતાં હૈયામાં શાલ્ય સલામત, તો પાછું પાપ કરાવે. માટે જ ધ્યાન રાખવા જેવું છે કે

પાપનું શાલ્ય ન રાખો; પાપની ચોંટ ન રાખો
રાવણ ને અભિમાનની ચોંટ :-

રાવણને હૈયે અભિમાન-પાપની ચોંટ હતી તો ‘સીતાજી પોતાને વશ થાય એમ નથી’ એમ નિશ્ચિત જાણવા છતાં વિચારે છે, -આને એમ ને એમ કેમ જવા દઉં ? એમાં મારું માન ઘવાય તેથી રામ-લક્ષ્મણ સાથે લડી એમને હરાવી પકડી લાવી પછી સીતાનું દયાદાન કરું કે ત્યો, જંગલના રખડતાઓ ! આ લઈ જાઓ તમારી સીતાને. દયાથી તમને લઈ જવા દઉં છું.’ અભિમાનની કેવી ચોંટ ! કેવો ઉંખ ! પછી પણ લડાઈમાં બધી વાતે હારવા છતાં અને પોતાનું છેલ્યું દૈવી શસ્ત્ર સુદર્શનચક્ર લક્ષ્મણનું ગળું છેદી નાખવા મોકલેલું, તે ગળું છેદી નાખવાને બદલે લક્ષ્મણના શરણો અના હાથમાં જઈ પડ્યું, અને હવે લક્ષ્મણને જુઓ અભિમાનની ચોંટ નથી તો કેવા ઉદાર બોલથી એ છેલ્લી તક આપે છે કે,

લક્ષ્મણના ઉદાર બોલ :-

‘જો રાવણ ! આ તારું જ ચક હવે મારાં શરણો છે. એ પરથી તું સમજી શકે છે કે હવે તારા પર આ ચક છોકું તો તારી શી દશા થાય ? માટે હવે તાચો થઈ સીતાજીને સોંપી દે, અને સુખેથી તારું રાજ્ય ભોગવ સીતાજીને ઉપાડી લાવવાનો અને અત્યાર સુધી તારે ત્યાં ગોધી રાખવાનો તારો ભયંકર પણ ગુન્હો અમે માફ કરીએ છીએ. જો સીતાજીને નહિ સોંપે તો આ ચક છૂટ્યું સમજ, પછી રાજ્યપાટ-પરિવાર અને પ્રાણ સુદ્ધાં બધું જ તારે નષ્ટ થઈ તું યમરાજના મોંમાં ધકેલાઈ જઈશ.’

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૨૫, અંક-૩૬, તા. ૨૧-૫-૧૯૭૭

ના, અભિમાનની પકડ છે, શાને સાંભળે ? શાનો ગશકારે ? અભિમાનમાં અંધ છે (૧) હું પરાકમી છું. (૨) કંઈક માંધાતાઓને મેં ધૂળ ચાટતાં કર્યા છે. (૩) આ મારું ચક છે; (૪) અત્યાર સુધી એણો મારી સેવા બજાવી છે એ મને શાનું ઠગે ? અને (૫) મારા પર આવે તોય મને અને પકડી લેતાં ‘શી વાર ? પકડતાં આવડે છે ને ?’ આવું આવું વાક્યે વાક્યે અભિમાન છે. પરંતુ

અભિમાનના અંધાપાથી બોલાયેલા દરેક વાક્યમાં જૂઠ છે.

કેમકે જુઓ, દરેક વાક્યમાં કેવો અંધાપો ને જૂઠ છે,-

(૧) ‘હું પરાકમી છું’ એ વિચારમાં અને ખબર નથી કે પરાકમ કાયમનું નથી હોતું નહિતર એક વખતના પરાકમી બીજી વખતે દૂબળાં ન પડ્યા હોત. પરાકમ શુભ કર્મના અને વીર્યાતરાયના ક્ષયોપશમના ઘરની વસ્તુ છે, ને એ બંને શાશ્વત નથી હોતા. પણ અભિમાનના અંધાપામાં પરાકમ શાશ્વતું લાગે છે.

(૨) વળી વિચાર્યુ ‘મોટા માંધાતાઓને મેં ધૂળ ચાટતા કરી દીધા છે.’ ‘પણ અંધાપામાં એ ન જોયું કે શેરના માથે સવાશેર પણ હોય.’ કદાચ આ લક્ષ્મણ સવાયો હોઈ શકે, ને એ જ મને ધૂળચાટતો કરી નાખે’ પરંતુ અભિમાનમાં આ ન દેખાય.

(૩) વળી વિચાર્યુ, ‘આ ચક તો મારું જ છે.’ આ અંધાપામાં એ નથી જોતો કે ‘તારું જ હોત તો કેમ એ લક્ષ્મણની પાસે બેસી જાત ?’

(૪) એમ, ‘મારી ચક સેવા કરી છે એટલે મને ન ઠગે’ આ ધારણા પણ ખોટી છે. અભિમાનમાં એ નથી દેખતું કે ‘ચક એ સંસારની વસ્તુ છે, ને જ્યાં આખો સંસાર ઠગારો છે ત્યાં એની વસ્તુ કેમ ઠગારી ન હોય ? ચક પણ એક લક્ષ્મી છે, ને લક્ષ્મીએ કોને નથી ઠગ્યા ? પરંતુ અભિમાનનો અંધાપો આ શાનું દેખવા દે ?

(૫) ત્યારે ‘ચક તો મારી પાસે જ રહેતું હતું, એટલે હવે લક્ષ્મણો એ મારા પર છોડ્યું મારી પાસે આવે તો મને એ પકડી લેતાં કેટલીવાર ?’ આ પણ ખોટી ધારણા છે. કેમકે હવે એ લક્ષ્મણનું થઈને બેહું છે. એટલે પોતાનું નથી રહ્યું. પોતે તો હવે પર થઈ ગયો; અને ચકનો સ્વભાવ એવો છે કે પરનું ગળું છેદી નાખે; એટલે પોતે છેદાઈ જ જાય.’ પણ અભિમાનના અંધાપામાં આ કાંઈ સૂઝતું જ નથી.

જેમ કોધી આધળો; એમ અભિમાની આંધળો છે, એ ખરેખરું હોય તો દેખવા દે નહિ

આવા અભિમાનની પકડ કર્યાં લઈ જાય ? કહે વિનાશાના આરે.

બસ, રાવણ અભિમાનની પકડ છોડવા તૈયાર નહિ, તેથી લક્ષમણે એના પર ચક છોડતાં જ્યાં એ રાવણની નજીક આવ્યું અને રાવણો હાથ લંબાવી એને પકડી લેવા યત્ન કર્યો ત્યાં તો એ ઝટ વળાંક લઈ રાવણની પાછળ જઈ એણો એનો ગરદન છેદી નાખી, પાછું પહોંચી ગયું લક્ષમણ પાસે, અભિમાનની પકડે શું આપ્યું. રાવણ વિનાશના આરે જરૂરીને વિનાશના દરિયામાં ઢૂબી ગયો. હવે ?

‘દશ શિર રાવણ રડવડાં, ચાંચ દીધે શિર કાગ રે,

દેવ ગયા સવી ભાગ રે, ન રહ્યો માનનો છાગ રે,

-સહજાનંદી રે આતમા’

પેલો શેઠ ‘આ ગરીબડા દામનકને મારો વારસદાર ન થવા એને મારી નખાવું’ એવી આપમતિની પકડમાં એક વાર એને મારી નખાવવાનો પેંતરો નિષ્ફળ ગયેલો જોવા છતાં અહીં ગોકુળમાં એને જીવંત જોઈ ફરીથી મારી નખાવવાનો નવો નુસખો વિચારી લે છે, એ કેવો નાદાન કે પેલાના પુષ્યના લેખમાં મેખ મારવા ધારે છે ?

પોતાના અશુભકર્મના લેખમાં અને બીજાના શુભકર્મના લેખમાં મેખ મારવા ધારવું એ નાદાનિયત છે, મૂર્ખાઈ છે.

સીતાજીએ આ નાદાનિયત ન કરી, જોયું અશુભ કર્મના લેખ અમલી થઈ ગયા છે, અપયશ અને જંગલમાં હકાલપણી આવી ઊભા છે તો હવે એના પર મેખ મારવા અર્થત્તુ એનાથી બચવા આડાઅવળા ફંઝા મારવા કે આદુંટેદું કરવું નકામું છે. સીતાજીને ભયાનક પરિસ્થિતિમાં પણ એવા કોઈ પેંતરા રચવા નથી, આપણે એવા અશુભ કર્મનો ઉદ્ય આવી લાગે તો શું કરીએ ? એના લેખમાં મેખ મારવા માટે પેંતરો રચવા જરૂરી ને ? પણ ખબર નથી કે આપણે ધારીએ કે હું અશુભોદ્યને અટકાવી દઉં, ‘કિન્તુ એ અકાટ્ય અશુભકર્મ ન જ અટકે, અને કરેલી માયા અને રચેલા પેંતરા મહાપાપ માથે પડી જાય. તેથી ડહાપણભર્યું એ, કે

અશુભોદ્યમાં પાપ ન કરતાં, પરમાત્મ-ભક્તિમાં લાગી જવાય, જેથી મહાલાભો મળે,

સંભવ છે કે (૧) દૂબળા અશુભ તૂટી જાય, અને (૨) આપણને પરમાત્માની નિકટ બનવાનો લાભ મળે, (૨) આપણને પરમાત્માની નિકટ બનવાનો લાભ મળે, પરમાત્મા સાથે પ્રીતિ-માંડવા-પોષવાનો મહાન લાભ થાય, શ્રદ્ધા જોઈએ કે ‘અશુભ તો ટળવાનાં હશે ત્યારે જ ટળશે, એમાં મારી બહાદુરી નહિ, ચાલે.’ ત્યારે અશુભ ભાગ્યના લેખમાં મેખ મારવા જે કાંઈ આડાઅવળા પ્રપંચ-પેંતરા કર્યો

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ-કખાય રોકો: દૂબળાનો મોકો” (ભાગ-૪૪)

તેના જ્ઞાલિમ કુસંસ્કાર અને પાપના થોક માથે પડવાના. એના બદલે જો પરમાત્માના અચિંત્ય પ્રભાવ પર શ્રદ્ધા રાખી એમની ભક્તિ કરી હશે તો એ અશુભના વિપાકનું જોર નરમ પાણી દેશે, એ અશુભને અશુભાનુંધી નહિ બનવા દે; ને વધારામાં નવી પુષ્યભરતી થશે, પાપક્ષય થશે. વગેરે કેટલા બધા મહાન લાભ ! આમ નાદાનિયતથી બચી જવાય.

શેઠનો દામનકને મરાવવા નવા પેંતરો :-

પેલો શેઠ નાદાન બન્યો રહે છે. તેથી એક વાર પાછો પડ્યો છતાં હજુ ફરી વાર દામનકને મારી નખાવવાનો પેંતરો કરે છે. ગોકુળથી પાછો આવી ગોકુળમાં રહેલા પોતાના પુત્ર પર ચિંઠી લખી મોકલે છે કે ‘દામનકને તરત વિષ દઈ દેજે.’ આ ચિંઠી ખાસ માણસ દ્વારા મોકલે છે.

અહીં બન્યું છે એવું કે શેઠની વિષા નામની પુત્રી ગોકુળમાં રહેલી, તે બહાર ફરવા નીકળી છે, ને જ્યાં પેલો માણસ ઘરેથી આવી અહીં ગોકુળની બહાર પહોંચી થાક્યો પાક્યો જાડ નીચે વિસામો કરવા સૂતો છે, ત્યાં વિષા આવી લાગે છે. માણસને ઓળખી લે છે કે ‘આ તો આપણો જ માણસા;’ તે એની પછેડીએ કાંઈક બાંધેલું જોઈ ગાંઠ ખોલી જુએ છે તો પેલી ચિંઠી જોઈ ચિંઠી વાંચતા અંયબો પામી કે ‘આપણા જ માણસ દામનકને વિષ દેવાનું ! દામનક રૂપે રૂપાળો નવયુવાન, એ એને ગમી ગયો છે એટલે માની લે છે કે આ લખાણમાં વિષાને બદલે વિષ લખાવું લાગે છે, ગમે તેમ પણ કાનો રહી ગયો છે.’ તે એણે આંખના કાંજળને સળી પર લઈ એનાથી વિષ પર કાનો વધારી દીધો, ચિંઠી માણસની પછેરીને ગાંઠી દીધી.

જુઓ દામનકનું બળવાન ભાગ્ય શું કામ કરે છે ! શેઠને એ ભાગ્યના લેખમાં મેખ મારવી હતી, પરંતુ દામનકના બળવાન ભાગ્ય આગળ એની મજાલ શું છે ? માણસ જાગીને ચિંઠી લઈ ઉપડ્યો ગોકુળે શેઠના પુત્ર પાસે; ચિંઠી આપી. છોકરો જુએ છે કે બાપના હાથના અક્ષર છે, તો બીજો વિચાર શું કરવાનો હોય ? અને દામનકની હોશિયારી, ગુણિયલતા તથા સુંદર રૂપ દેખી ખુશી થયો કે ‘વાહ ! મારા બાપુજીએ દામનકને તુરત વિષ દઈ દેજે’ એમ લખી બેન માટે મૂરતિયો સારો શોધી કાઢ્યો ! તો હવે શુભે શીધ્યમ્. શા માટે વિલંબ કરું ?’ બાજુના ગામમાંથી જોખીને તેડાવી બેન વિષાનું દામનક સાથે લગ્ન પતાવી દે છે; ને ઘરે બાપ પર એમ કર્યાની ચિંઠી મોકલી દે છે,-’ આપે લખું તે પ્રમાણે દામનકભાઈને આપણી વિષા તરત દઈ (પરણાવી) દીધી છે.’

શેઠ આ જાણી કર્યાં ઉભો રહે ? એને વહેમ ગયો કે ‘મેં તો વિષ દેવાનું

૨૫૮ સુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“લક્ષ્મણના ઉદાર બોલ” (ભાગ-૪૪)

લખેલું, તો શું ઉતાવળથી સુલમાં વિષનું વિષા લખાઈ ગયેલું ?' હૈયામાં એ ભારે શોક કરવા માંડ્યો કે 'હાય ! આ શું બની ગયું ? મારે તો દામનકને મરાવી જ નાખવો હતો, ને આ તો જમાઈ બની બેઠો. કેવું મારું કમનસીબ કે આ મર્યો નહિં!' શાનો શોક ? મારી નહિં શકવાનો શોક !

સંસાર કેટલો ખરાબ છે કે એ માણસને ખોટા કાર્ય કરવાનો વિચાર તો કરાવે તો કરાવે, પરંતુ કદાચ એ કાર્ય ન બની શક્યું તો એના પછીથી પારાવાર પસ્તાવો કરાવે છે.

આ કરાવનાર પણ સંસાર છે. એટલે ? ખરાબ કાર્ય કરવાના વિચારનાં ધોર પાપ તો બંધાય જ. પણ હવે ન બન્યું એમાં પસ્તાવાના વિચારથી પણ ધોર પાપ બંધાવાનાં.

'હાય ! મારાથી મોકા પર સારું કામ ન થયું !' એ પસ્તાવો સારો; પણ 'હાય ! મારાથી ખૂન, જૂઠ વગેરે ન થયું !' એવો ખરાબ કામ ન બન્યાનો પસ્તાવો એ ભયંકર છે. સંસાર જ એવો છે કે આવાં આડાં વેતરણ કરાવે. ભાનભૂલા જીવને એ ખબર નથી કે 'હજી ય કોને ખબર તારું ધારેલું દુષ્ટ કામ બનશે કે કેમ ?' ફોગટ પાપિષ વિચાર, પાપિષ સંતાપ, પાપિષ મનોરથ શા સારું કરે ?

શેઠ હજી મનોરથ કરે છે કે. 'ઐર, દામનક જમાઈ બની બેઠો, પણ હજી છોપું નહિં.' તે જમાઈ થઈને આવ્યો, શેઠને પગે પડ્યો, પરંતુ શેઠ અંદરમાં દાંત કચ્કચાવે છે. પોતાની છોકરી વિધવા થાય એની એને પરવા નથી, દયા નથી. બસ, 'દામનકને મારી નખાવું' એ જ એક લેશ્યા છે. મરાવી શકવાનો નથી, એટલું બધું દામનકનું પુણ્ય સતેજ છે, પરંતુ

એક ખોટી આપમતિની પકડ પકડાઈ ગઈ એ કેટલી ખતરનાક !

પછી ત્યાં વિચાર નથી રહેતો કે આપમતિમાં તણાય છે ખરો, કિન્તુ ભવિતવ્યતા અને કર્મ તારી સામે થયેલા હશે ત્યાં તારી આપમતિનું શું ઊપજવાનું છે ?

શેઠનું ઊપજ્યું ? દામનકનું ભાગ્ય જોરદાર હતું તેથી શેઠના આપમતિના પ્રયત્ન નિષ્ફળ ગયા. એમાં દામનકને ભવિતવ્યતા પણ કેવી અનુકૂળ કે માણસનું ચિહ્ની લઈને રસ્તામાં આડા પડવું, અને પુત્રી વિષાનું બરાબર ત્યાં આવવું ને ચિહ્નીની તરફ ધ્યાન જવું.

ભવિતવ્યતા કહો, કે ભાવીભાવ કહો, એ આ કામ કરે છે કે ચોક્કસ પ્રકારના સંયોગ અણધાર્યા બનાવી આપે.

પછી ત્યાં ભાગ્ય આ કામ કરે છે કે એના પર હીણભાગીને અવળું બને અને ભાગ્યશાળીને સવળું પડી જાય.

હવે ત્યાં હીણભાગીએ સૌભાગીને અવળું બનાવવા ગમે તેટલા ધમપછાડા કર્યા હોય એ શા કામ લાગ્યા ? પોતાને અવળા પડ્યા ને ?

કર્મના લેખમાં મેખ મારવા માણસ ફાંઝા મારે એ નકામા છે. મહેનત માથે પડે છે, વળતું કાંઈ નથી, ને વધારામાં નિરાશા-હતાશા-હાયવોય અને પાપકર્મનાં જમેલા ભેગા થાય છે, યાવત્ત રાવણની જેમ સર્વવિનાશ આવીને ઊભો રહે છે. સીતાજી આ સમજતા હતા માટે એવું કાંઈ ન કરતાં પતિ તરફથી હકાલપદ્ધી થઈ, તો વધાવી લીધી. ક્યાં સુધી ? કે પછી જન્મેલા લવણ-અંકુશ મોટા થાય છે ત્યાં સુધી પણ એને એ કહેતા નથી કે 'તમારા પિતાજીએ મારી કેવી દશા કરેલી !'

સીતાજીએ કર્મનાં લેખ ક્યાં સુધી વધાવ્યા ?

કે પોતે સાવ નિર્દોષ છતાં પતિ લોકવચનથી કાઢી મૂકે છે તો ય પોતાના દિલમાં પતિ પ્રત્યે અભાવ નથી લાવતા. આપણે ય આપત્તિમાં કહીએ તો ખરા કે 'મારા જ કર્મનો દોષ' પરંતુ બહારથી જેના થકી આપત્તિ આવી દેખાતી હોય એના પર સદ્ભાવ બન્યો રહે ખરો ? એના પર આપણા દિલમાં કચ્ચવાટ-અરુચિ-અભાવ ન થાય ? જો અભાવ થતો હોય તો દિલની અંદર એને દોષ દીધો કે નહિં ? વળી મનની અંદર જે નક્કી કરાય છે કે 'હવેથી આમની સાથે પ્રસંગ પાડવો નહિં,' એ શું સમજી ને ? આ સમજીને કે આ 'આમનાથી આપણે સહજવાનું આવે છે માટે એમની સાથે બોલચાલ ન રાખવી.' તો સમજમાં શું હૈયું એ નથી બોલતું કે 'આપણી આપત્તિમાં આ ભાઈ કે બેન કારણ ?' એવું હોય ત્યાં એકલા કર્મને જ દોષ ક્યાં દીધો ? દોષ વ્યક્તિને પણ દીધો.

સીતાજી અને પુત્રો :-

ત્યારે સીતાજીના દિલમાં માત્ર કર્મને જ દોષ દેવાનું બેહું છે, એટલે રામચંદ્રજીને નહિં; એટલે જ રામચંદ્રજી પર સીતાજીને અભાવ નથી થતો. એટલે જ પેટના દીકરા આગળ વર્ષો વીતવા છતાં ક્યારે ય રામચંદ્રજી પ્રત્યે કચ્ચવાટ વ્યક્ત નથી કરતા ! દિલમાં એ કચ્ચવાટ હોય તો શબ્દ દ્વારા બહાર કાઢે ને ? હવે જ્યારે દિકરા બહારથી જાણી લાવી પૂછે છે,-

'હું મા ! તને અમારા પિતાજીએ કાઢી મૂકેલા ?'

'ના ભાઈ ના, તમે આવું ક્યાંથી શીખી આવ્યા ?'

'તે તું તો અમને ન કહે, પણ અમે બહારથી જાણી લાવ્યા છીએ. બોલ સાચું કે નહિં ?'

સીતાજી કહે છે એ જાણ્યું ખોણું. મને તો મારાં કર્મ જ ઘરત્યાગ કરાવેલો !

‘તે મા ! તું તો મોટા મનની તે એમજ કહે. પણ હવે તું અમને આશીર્વાદ આપ કે એમ એમની સાથે લડાઈ કરી જતીને એમને બતાવીએ કે ‘આ સીતાજીના કોઈ રખેવાળ નહિ એટલે એમને કાઢી મૂકેલા ? હવે અમે એમના રખેવાળ તૈયાર થઈ ગયા છીએ. હવે બતાવો તમારું પાણી ?’

જો સીતાજીના દિલમાં રામ પ્રત્યે અભાવ હોત તો મંજુરી આપી દેત. પણ અભાવ હતો જ નહિ, તેથી લવણ-અંકુશને કહે છે,-

‘બેટા ! બાપુજીની સામે લડવા ન જવાય. એમના દર્શને જવું હોય તો જાઓ મારા આશીર્વાદ છે.’

કેવી કલ્યાણમાતા ! દીકરાનાં કલ્યાણની જ સલાહ આપે છે; ખોટી અ-કલ્યાણની સલાહ નહિ. કારણ સ્પષ્ટ છે,-

હૈયામાં કોઈ ખોટી બળતરા હોય તો સામાને અહિતની સલાહ અપાય છે. ‘કર્મ કર્યું થાય,’ એવી કર્મ પર અટલ શ્રદ્ધા ધરાવનાર સીતાજીના હૈયામાં હકાલપણી અંગે રામચંદ્રજી અંગે કોઈ બળતરા નથી. પછી શું કામ અહિતની સલાહ નીકળે ? જીવન જીવવાની આ વડાઈ છે કે હૈયામાં ખોટી બળતરા થવા જ ન દઈએ.

પ્ર.- જીવનમાં કાંઈ ને કાંઈ અરુચાંતું બને એટલે બળતરા થાય એ તો સ્વાભાવિક છે. એ કેમ અટકે ?

ઉ.- બળતરા અટકાવી શકાય એ માટે આ વિચારવું,-

બળતરા અટકાવવા શું વિચારવું ? :-

(૧) ભગવાનનાં વચન પર તને શ્રદ્ધા છે ? ભગવાન કહે છે. કર્મફળ અવશ્ય ભોક્તવ્ય છે તો કર્મના નિર્ધારિત ફળ બનાવ પર રોવું શું ? રોવાથી વળે શું ?

(૨) મહાપુરુષોને યાદ કરું રાજા શ્રેણિક સગા દીકરા કોણિકના હાથે જેલમાં પૂરાયા ને કોરડા ખાય છે; છતાં એની બળતરા ન કરી. કેમકે ભગવાનનાં વચન પર શ્રદ્ધા જોરદાર છે. તો મારે એની અપેક્ષાએ કઈ મોટી આપત્તિ છે કે બળતરા કરું ? રામ-સીતા, નળ-દમયંતી, પાંડવો,... વગેરે માત્ર પહેર્યે લુગડે વનમાં મુક્ષયા, છતાં એની બળતરા નહિ. તો મારે એવું શું છે ?

(૩) બળતરા કરું એના કરતાં એમાં જે બીજા લાભ છે, તેમજ આ સિવાય જે સારી પ્રામિસો છે એની અનુમોદના કાં ન કરું ? જે અરુચાંતી વસ્તુ પર બળતરા થાય છે એ અરુચાંતું બીજી દ્રષ્ટિએ કેમ સારું છે ? એ શોધી કાંદું.

બળતરાનો સમય નકામો બગાંદું એના કરતાં આ સમયમાં કોઈ નવકાર સ્મરણ, તીર્થયાત્રા-સ્મરણ છે એની અનુમોદના કાં ન કરું ? જે અરુચાંતી વસ્તુ પર બળતરા થાય છે એ અરુચાંતું બીજી દ્રષ્ટિએ કેમ સારું છે ? એ શોધી કાંદું.

બળતરા ગમતું ગયાની કે ન બન્યાની કરું છું એના કરતાં એમ વિચારું કે ‘આની પાછળ પૂર્વ જિનભક્તિની કચાશ રહી ગયેલી એ કારણ છે. તો બળતરા એ કચાશની જ ન કરું ? જેથી અહીં જિનભક્તિની કચાશ પૂરી કરાય, શક્ય એટલી વધુ જિનભક્તિ કરાય.’

ગમતું ગયાની બળતરા સત્ત્વને હણો છે :-

બળતરામાં સત્ત્વ હણાય છે.

સત્ત્વ બધુ કિંમતી ચીજ છે. સત્ત્વથી જ જોરદાર ત્યાગ-તપ-સંયમ થઈ શકે છે. સત્ત્વ જોરદાર ઉપર જ ઉગ્રપરીષહો અને ધોરઉપસર્ગ પણ સમાધિથી સહન થાય; જેના પર સત્ત્વથી જ શુકલથ્યાન અને કેવળજ્ઞાન લાધી શકે છે. આવા કિંમતી સત્ત્વને નાહક શા સારુ તુચ્છ બળતરાથી હણું ? મારા જ સત્ત્વને હું જ હણું ?

બહારનું બગડે એ કર્મના અપરાધે. સત્ત્વ હણાય એ મારા પોતાના જ અપરાધે.

સત્ત્વ બળતરાથી હણાય. તો શા સારુ સત્ત્વને હણનારી બળતરા કરું ?

આવી આવી વિચારણાથી બળતરા અટકાવી શકાય. સીતાજીએ ગર્ભિણી અવસ્થામાં વનમાં ધકેલાઈ જવાના ધોરકષ્ટ પર પણ બળતરા ન કરી. તો જ હવે પુત્રોને કહી શકે છે ‘બાપજીને પગે પડવા જવું હોય તો જાઓ પણ એમની સાથે લડવા નહિ.’ કલ્યાણની સલાહ આપી કલ્યાણમાતા નીવડે છે.

પેલી કલ્યાણમાતાએ અલ્ય ક્ષ્યોપશમ અલ્ય બુદ્ધિશક્તિવાળા પુત્રને કહ્યું ‘તારાથી બીજું કાંઈ ન બને તો ય આ કર, મોટાની સેવા કરતો રહે, એથી તારું કલ્યાણ થશે.’

પુત્રે શિખામણ વધાવી લાધી. જીએ છે કે ‘બાપજી મોટા છે, કેમકે બધા એમને નમે છે.’ તેથી બાપજીની સેવામાં લાગી ગયો. અલ્યબુદ્ધિવાળાનું આ સુખ કે કહ્યું જટ માની લે.

વડીલો આગળ અને સાધુજનો આગળ આપણી જાતને અલ્યબુદ્ધિવાળા સમજાએ તો એમની સલાહ માથે ચડાવાય. એમનું કહ્યું માની લેવાય. પણ અભિમાન આડે આવે છે. જાતને સારા બુદ્ધિમાન માની દોઢ ઉહાપણ કરવાનું મન થાય છે. પરંતુ ભાન નથી કે એમાં કેટલું ચુમાવવાનું થાય છે. ઈતિહાસમાં જોઈએ તો દેખાય કે

કેટલાય માણસ દોઢ-ડહાપણથી કેવા કેવા વિનાશ પામ્યા !

‘હું પણ સમજદાર હું, મારામાં અક્કલ છે, મને આ ઠીક નથી લાગતું’ એમ અભિમાનના માર્યા વરીલ કે સાધુજનની સલાહ માથે નથી ચડાવવી અને પોતાની સવાયી અક્કલ માનવી છે એ દોઢ-ડહાપણ છે, આપમતિ છે, અભિનિવેશ-દુરાગ્રહ છે.

રાજી ત્યાં એડવર્ડ :-

બ્રિટિશ સલ્તનનો સમ્રાટ રાજા બનેલો ત્યાં એડવર્ડ લેડી સિભસનની પ્રેમમાં પડેલો હતો એની સાથે લગ્ન કરવા હતા કે કર્યા હશે પાલમિન્ટે સલાહ આપી કે એ બાઈ અમીર કુંદુંબની નથી, તેથી એની સાથે સંબંધ નહિ રખાય. કાં તો એને છોડો, કાં સમ્રાટ રાજાપણું છોડો, ત્યાં એડવર્ડ છોડવું પડ્યું. શી વડાઈ રહી ?

રધુવંશમાં રાજા સોદાસ થઈ ગયો. એક અવસરે અણાઈ મહોત્સવનો પ્રસંગ આવ્યો. આખા રાજ્યમાં અમારિ જાહેર થઈ. મંત્રીઓએ રાજાને કહ્યું આપણા ઈક્ષવાકુંવશમાં રિવાજ છે કે જિનેન્દ્રમહોત્સવમાં અમારિ પાળવાની, ને પ્રજાની પાસે પળાવવાની. માટે આ દિવસોમાં માંસાહાર ન કરશો.' પરંતુ સોદાસને જ્ઞાતીને ચડસ, તેથી આપમતિમાં ખાનગી માંસાહાર કરવા લાગ્યો. આમ તો બહાર માંસ મળે પણ નહિ, પરંતુ ખાનગીમાં જીવ મરાવી માંસાહાર કરે પરિણામ શું આવ્યું? જીવતા બાળકને મરાવી મરાવી અનું માંસ ખાનારો નરભક્તી રાક્ષસ જેવો બની ગયો, અને અંતે મંત્રીઓને ખબર પડતાં પદભ્રષ્ટ કરીને જંગલમાં રખડતો થઈ ગયો તો આપમતિ અને દુરાગ્રહે ક્યાં લઈ જઈ મક્ક્યો ?

કુલવાલક મુનિ એક મહાતપસ્વી સાધુ છતાં આપમતિમાં ગુરુનો અવિનય કરે છે, તો એમાં અંતે ગુરુદેશી અને સમુદ્ભાય બહાર થયો અને આગળ વધતાં વેશ્યાના ફંદામાં ફસાયો તે સંયમબ્રાષ્ટ થયો તો થયો પરંતુ આગળ વધતાં કોણિકાના વચ્ચનથી વિશાલા નગરીના મુનિસુત્રતસ્વામી ભગવાનના સ્તૂપને તોડી નખાવનાર બન્યો !! એટલે એ સમ્યકૃતવથી પણ ભાષ થયો.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૨૫. અંક-૩૭.તા. ૨૮-૫-૧૯૭૭

આપમતિ ક્યાં લઈ જઈ મૂકે છે ? આપમતિમાં એક પગથિયું ચૂકો પછી નીચે નીચે ગબડતા આવવાનું બને છે. કોઈ પ્રસંગ આવ્યો માનવતામાંથી પણ ભણ થવાય છે. એટલા જ માટે,

આપમતિ ખોટી, વડીલની સલાહ સારી

પેલો ભલો ભોળો છોકરો માતાની સલાહ માની લે છે કે ‘મોટાની સેવા કરવી.’ એ હિસાબે જુએ છે કે માતા પણ પિતાને નમે છે તેથી પિતા મોટા છે, એટલે એમની સેવામાં લાગી જાય છે. હવે બન્યું ઓવું કે પિતાને એક વાર કામ પડયું. તે ગામના મુખી પાસે જાય છે, ને મુખીને પહેલાં નમસ્કાર કરે છે. છોકરો બાપની સેવામાં છે એટલે એ બાપની સાથે આવ્યો છે. તે આ જુએ છે.

સેવામાં શું શું આવે ?

સેવામાં રહેવું શેને કહેવાય ? માત્ર બે ચાર કામ કરી આપવા એને નહિ. સેવા એટલે તહેનાતમાં રહેવું. એમાં બધી જાતનો વિનય સાચવવો પડે. મોટા શેઠ કે મોટા રાજાનો વિનય સાચવવો પડે. મોટા શેઠ કે મોટા રાજાની સેવામાં રહેનારા, જીઓ, શું શું કરે છે ? મોટા ઉઠે તો પોતે ઊભો થાય, મોટા જરાક નામ પોકારે કે તરત ‘જી’ કહીને એમની પાસે જાય; મોટા બહારથી આવતા દેખાય કે ઝટ સામો લેવા જાય ને નમસ્કાર કરી સાથે આવે; મોટા બહાર જતા હોય તો સાથે જાય....સેવા એટલે બધી વાતોમાં મોટાનો વિનય કરવો, મોટાનું કાર્ય બજાવવું, તથા મોટાની શોભા વધે એમ કરવું પછી સેવામાં મોટાની ઈચ્છાને અનુવર્તવાનું તો સહેજે હોય.

આ ઈચ્છાનું અનુવર્તન પણ મોટી ચીજ છે. કેટલીય વાતમાં પોતાને રુચ્યતું જુદું હોય, અને મોટાને એ ટીક ન લાગતું હોય છતાં તેમ ન કરવા આજ્ઞા ન કરતા હોય, એવા અવસરે પોતે મોટાની ઈચ્છાને અનુસારે એ પોતાને રુચ્યતું મૂકી દેવું, યા પોતાને ન રુચ્યતું પણ મોટાને રુચ્યતું જોઈ કરી લેવું, એ વાતે વાતે સહેલું નથી. કેટલીક વાર મોટા પોતાની રુચિ ઈચ્છા ય ન બતાવતા હોય છતાં એમનાં સિદ્ધાંત આદર્શ જોઈ એને અનુસરવું એ ય બધું સેવામાં આવે. એ પણ સહેલું નથી તેથી. જ કલ્યાં.-

‘सेवाधर्मः परमगहनो योगिनामध्यगम्यः ।

સેવાધર્મ સમજવો પણ ઘણાં ઉંડો છે

મોટા ગણાતા યોગીઓને પણ એ ન સમજાય. એટલે તો સાધુજીવનમાં ત્યાગ કરવો સહેલો, તપ સહેલો, જ્ઞાનધ્યાન સહેલું અરે ! પરીષણ ને ઉપર્સર્જ સહેલા, પરંતુ સેવાધર્મ કઠણ છે. સેવાધર્મમાં ગુરુનો બધા પ્રકારનો વિનય આવે; ગુરુની આશાતના ટાળવી એ પણ વિનય, અને ગુરુનો અવર્જનાદ અટકાવવો એ પણ વિનય, તેમજ પોતે ગુરુનો યશવાદ ફેલાવવો એ ય વિનય. એટલે જો લોકમાં પૌતાનો યશ ગવાતો હોય, પણ લોકમાં ગુરુની કિંમત ન અંકાતી હોય ત્યાં

જો પોતે આંખ મિંચામણા ઉપેક્ષા કરે કે ‘લોકને આપણે શું કહેવા જઈએ ?’ તો ત્યાં એ ગુરુનો વિનય ચૂક્યો ગણાય. એમ કહેતા નહિ,-

લોકમાં ગુરુની કિંમત કેમ વધારાય ? :-

પ્ર.- લોકને આપણે શું કરી શકીએ ?

ઉ.- આપણે લોકોમાં ગુરુનાં એવાં ગુણગાન કરી શકીએ, ગુરુની કિંમત વધારી શકીએ કે ‘મારામાં જો તમે કાંઈક સારું દેખતા હો, તો તેમાં મારી કશી વડાઈ-હોશિયારી નથી. એ તો ગુરુનો જ ઉપકાર છે. એમણે મને બે અક્ષર શિખવાડ્યા, તો જ આ પાખ્યો છું એમના વિના તો હું ક્યાંય રખડતો હોત ! અને એના વિના હું કેવો ય અભૂત હોત ! કેવા ગુરુ ! કેવા એમના અનુપમ ગુણો !...’ આવું આવું અવસરે અવસરે બહાર બોલતા રહીએ, એમા ગુરુની તેવી તેવી વિશેષતાઓ ગાતા રહીએ તો લોકને એમ થાય કે ‘ઓહો ! આમના ગુરુ આવા વિશિષ્ટ કોટિના ? વાહ ભાઈ વાહ ! ચેલા કરતાં ગુરુ સવાયા ! હોય જ ને ? આવા ગુરુ હોય ત્યારે જ આવા શિષ્ય હોય ને ?’ આમ લોકમાં ગુરુની કિંમત અંકાય ગુરુનો યશવાદ થાય.

ગુરુની આ સેવા છે. સહેલી કે કઠિન ? પોતાનો ખૂબ યશ ગવાતો હોય, બહુ માન મળતું હોય ત્યાં ભૂલા પડી જવાય છે ખરું જોતાં ગુરુને યાદ કરવામાં ગુરુને યશ આપવામાં ગુરુના ગુણ ગાવામાં પોતાને કાંઈ માન મળવામાં ઓછા નથી આવતી. દુનિયા એવી ગાંડી નથી કે તમે એક સારું કામ કર્યું અને યશ ગુરુને કે પિતાને આખ્યો એટલે દુનિયા તમારા ગુરુને કે પિતાને મહાન માની તમને કુછ નહિ માને. ના દુનિયા આવું નહિ માને. એ તો માનશે કે ‘બાપ કેવા સારા, ગુરુ કેવા સારા, કે આવો સારો પુત્ર આવો સારો શિષ્ય તૈયાર કર્યો !’ આમ તમને માન તો મળે જ છે, પણ વધારામાં ગુરુને યાદ કરવાથી કૃતજ્ઞતાના મહાન ગુણની સાધના થાય છે; ગુણિયલતાનો ગુણાનુવાદનો મહાન લાભ મળે છે.

સાચી કમાણી ધન-માલ કે સત્તા-સન્માનની નહિ :-

ત્યારે વિચારો, આ જીવનમાં ખરી કમાણી શી ? નાણપાણી કે સત્તા-સન્માન કમાયા એ નહિ, કેમકે એ તો એક દિ’ ખોવાઈ જવાના છે. અને એનાં નિમિત્તે કરેલ હિંસા-જૂર આદિ ધરખમ પાપો અને કષાયો, એ આગળ થવાના છે, જે એના કુસંસ્કારો પાડી ભાવી ભવોમાં પણ પાપો-કષાયોની પુનરાવૃત્તિ કરાશે ! અહીં ય પાપિણ જીવન અને પરલોકે ય એ જ અહીં પણ કષાયી જીવન અને પરલોકે પણ એ જ. જીઓ ને અહીં ય પાપિણ ને કષાયી જીવન કેમ મળ્યું છે ? કહો, પૂર્વભવે ધન-માલ અને સત્તા-સન્માનનાં નિમિત્તે એ જ કર્યું છે, પાપો અને

કષાયો પછી એની અહીં પુનરાવૃત્તિ થાય એમાં નવાઈ શી ? એના મૂળમાં ધન વગેરેની કમાણીને ખરી કમાણી માની એ છે. માટે ધન-માલ-સત્તા સન્માનની કમાણી એ સાચી કમાણી નથી.

સાચી કમાણી કૃતજ્ઞતાદિ ગુણોની; સાચી ગુણાનુવાદ વગેરે સુદૃતોની.

કેમકે એના સુસંસ્કાર આત્મામાં જમા થાય છે, ને પરભવે એ સુદૃતોનું પુનરાવર્તન કરે છે. જરૂર પડ્યે જેમ પાપો કષાયોમાં પરભવમાં ગુણાકાર થઈને પુનરાવર્તન, તેમ આ સુદૃતો પણ ભવાન્તરે ગુણાકાર થઈને પ્રગટી નીકળે છે ત્યારે કૃતજ્ઞતા-ગુણાનુવાદ વગેરે સુદૃતોથી મનને શાંતિ મળે છે. પ્રસંગતા મળે છે ધન વગેરેની કમાણીમાં તો એને સાચી કમાણી માન્યાથી અશાંતિ ઊભી થાય છે. સાચવવાની ચિંતા, ચોરાવાનો કે ખર્ચાઈ જવાનો ભય સંતાપ વગેરે કેટલીય અશાંતિ ઊભી કરે છે.

ત્યારે આ પારખવા જેવું છે કે આપણે સારી કમાણી કઈ માનીએ છીએ ? ધનની કે ધર્મની ? માનપાનાદિની કે સુદૃતની ?

આસ્તિક, ધર્મત્વા શેને સાચી કમાણી માને ?

કઈ કમાણી પર મુસ્તાક બને ?

કઈ કમાણી પર હુંફ લે ?

અને નાસ્તિક, અધર્મી જીવ કઈ કમાણીને સાચી કમાણી માને ? કઈ કમાઈ પર મુસ્તાક બને ? કઈ કમાણી પર હુંફ લે ?

આના ઉપરથી માપ નીકળે છે કે ધર્મી-અધર્મિનું લક્ષણ શું ? આસ્તિક-નાસ્તિકનું લક્ષણ શું ? પૈસાની કમાણી પર મુસ્તાક બને, હુંફ અનુભવે કે ‘હાશ, નિરાંત થઈ પૈસા સારા મળી ગયા !’ એ આસ્તિક ? કે નાસ્તિક ? એ ધર્મત્વા ? કે અધર્મી ? કોઈના સામે જોતા નહિ. પોતાના આત્મામાં વિચારી જોશે.

આસ્તિક બનવું છે તો કાયાને નહિ પણ પોતાના આત્માને મહત્વ-મુખ્યતા દેવી જોઈએ.

બોલવું છે ‘હું આત્માને માનું છું’ ને શરીરને મહત્વ આપવું છું, શરીરને મુખ્ય રાખવું છે, તો પછી આત્માને માન્યો શી રીતે ગણાય ? આત્માને માનવાનું કાંઈ પ્રતીક હોય કે નહિ ? માણસ અવસરે પાણેશીનાં કામ કરવા પડે તો કરે છે, પરંતુ એના દિલમાં પોતાના હુંબની મુખ્યતા રહે છે, મહત્તા રહે છે, કેમકે એને પોતાના માને છે. પોતાને માન્યાનું પ્રતીક શું ? આજ કે એનાં કામને વેઠ ન માને. ‘મારે આમનું કરવાનું આવ્યું’ એમ ન માને, જ્યારે પાણેશીના કામમાં મારે આમનું કરવાનું આવ્યું એમ માને છે. માટે જ પોતાનું કરીને જે રાજી થાય છે, એવું પારકાનું કરીને નહિ.

બસ, આસ્તિક આ કે જેને પોતાની કાયાની નહિ, પણ આત્માની મુખ્યતા રહે. કાયાને પર માને, ને

આત્માને સ્વકીય માને. તેથી કાયાના લાભનું કરતી વખતે વેઠ માને, ને આત્માના લાભનું કરવા વખતે હોય, ઉલ્લાસ હોય, બજરમાં જવું પડે ત્યારે પગ જોરમાં ન ઉપડે.

ધાર્માતા પોતાના પુત્રની જેટલી સેવા નથી કરતી એટલી રાજપુત્રની કરે છે. છતાં એને મન મહત્ત્વ કોની ? એને મુખ્ય કોણ ? પોતાના પુત્ર ? કે રાજપુત્ર ? મહત્ત્વ પોતાના પુત્રની છે એ, ભલેને પોતાના પુત્રને જરાય રોવા ય દેતી હોય, ‘ધણકો ય કરતી હોય, ને રાજપુત્રને જરાય રોવા ન હે એટલો બધો હુલાવે-હુલાવે, ક્યારે ય હંપકો ન હે, મીઠા વહાલના જ બોલ સંભળાવે, છતાં એને પોતાનો નથી માન્યો. એનો પોતાના દિલમાં મહત્ત્વ મુખ્યતા નથી એટલી પોતાની દીકરાની છે, એ તમે માનો છો ને ? માટે તો દા.ત. સાપ નીકળે, યા મકાનને આગ લાગે અને રાજપુત તથા પોતાના પુત્ર બંનેને બચાવી શકાય એમ હોય તો પોતાના જ પુત્રને લઈને ચાલતી થશે. આમ શાના લીધા બને ? કહો દિલમાં સ્વપુત્રની મુખ્યતા-મહત્ત્વને લઈને.

આસ્તિકનું પ્રતીક આત્માની મહત્ત્વ :

એનું પ્રતીક સુકૃત કમાણીને કમાણી માને :-

બસ, આ રીતે આસ્તિક આત્મા, ભલે ને કાયાને સંભાળવા-સંભાલવા સંસારની વેઠ કરતો હોય, પરંતુ એની આસ્તિકતાનું પ્રતીક શું ? આ કે એના દિલમાં મુખ્યતા-મહત્ત્વ કાયા કે એના સંસારની નહિ, પણ પોતાના આત્માની જ હોય. આનું પ્રતીક શું ? આ એક પ્રતીક કે એને મન કમાણી કાયા સાથે સંબંધિત ધન-સન્માનની નહિ, પણ આત્મા સાથે સંબંધવાળા ગુણો-સુકૃતોની હોય. ગુણ કેળવવા મળ્યો દા.ત. પોતાના અપરાધી કોઈના પર ગુસ્સો આવવો સુલભ હતો, પણ મન વાળી લઈ એના પર ક્ષમા રાખી ક્ષમા દાખવી, તો એમાં ક્ષમાગુણ કેળવવા મળ્યો ત્યાં માને કે આ મારે કમાણી થઈ. એમ દાન કરવાની તક મળી ને ધનનો લોભ જતો કરી દાન દીધું. સદ્ગુરુના સમાગમે વિષયરંગ પર અંકુશ મૂકી વ્રત નિયમ લીધા, અવસર આવ્યો ને આહારસંક્ષા કાબુમાં લઈ તપ્યો. ત્યાં માને કે આ મારે કમાણી થઈ.

આવું ગુણો-સુકૃતોની કમાણીને કમાણી માનવાનું પાછું વાંઝિયું ન હોય, પોકળ ન હોય, પણ અવસરોચિત શબ્દમાં ને એને અનુરૂપ દિલમાં એ વ્યક્ત થાય. જુઓ,-

અનિશ્ચર્માને મન સુકૃત કમાણી એ વૈભવ :-

અનિશ્ચર્મા ગુણસેનરાજકુમાર તરફથી થતી મશકરીથી કંટાળેલો ભાગીને દૂર

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

દેશ જઈ તપોવનમાં માસખમણના પારણો માસખમણ કરનારો તાપસ બન્યો છે. હવે ગુણસેન રાજ થઈ વર્ષો પછી આ દેશમાં આવી આ તાપસની મહાતપસ્યા જીણીને વંદનાર્થે આવ્યો છે પછી વાત થતાં રાજ પૂછે છે,-

‘ભગવાન ! આપ આટલી મોટી તપસ્યા શી રીતે કરી શકો છો ?’

મહાતપસ કહે ‘જો ભાઈ ! જગતમાં ગ્રાણ પ્રકારના માણસ હોય છે, ઉત્તમ પુરુષો સ્વરૂપિથી ધર્મ કરે છે,

મધ્યમ પુરુષો બીજાની પ્રેરણા પામીને ધર્મ કરે છે.

પણ અધમ પુરુષો પ્રેરણા પામવા છતાં ય ધર્મ નથી કરતા.

તો આમાં મને મધ્યમ કોટિનો સમજ.

રાજ ગુણસેન પૂછે છે, ‘તો હે ભગવાન ! આપને આવડા મોટા તપ ધર્મની પ્રેરણા કોણો કરી ?’

તાપસ કહે, ‘કલ્યાણમિત્ર ગુણસેને.’ રાજ પોતાનું નામ સાંભળીને ચોંકી ઊઠે છે. એના મનમાં ભૂતકાળનાં પોતે કુમાર અવસ્થામાં પુરોહિતપુત્ર અનિશ્ચર્માની કરેલી મશકરી-સત્તામણીના સંભારાણા ખડા થઈ જાય છે. એટલે એ સમજી જાય છે કે, ‘અનિશ્ચર્માએ એ સત્તામણીના હિસાબે જ તાપસપણું લીધું હશે, છતાં એ મને હાલ ઓળખી શક્યા નથી તો પણ પરોક્ષમાં ય મને કલ્યાણમિત્ર તરીકે ઓળખાવે છે ! તો લાવ જોવા દે એમને મેં તપ માટે શી પ્રેરણા કરી, એ શું બતાવે છે?’

રાજ પૂછે છે ‘હે ભગવાન ! તે આપને કલ્યાણમિત્ર ગુણસેને શી પ્રેરણા કરેલી તે આપ આટલો મોટો તપધર્મ કરવા પામ્યા ?’

માણસની જિજ્ઞાસાવૃત્તિ કેવી વધુ પડતી હોય છે ! જાણી તો લીધું કે ‘અનિશ્ચર્મા ગુણસેનને પોતાને ઓળખી શક્યા નથી તેથી જ ત્રાહિતને વાત કરતા હોય એમ કહે છે કે ‘કલ્યાણ મિત્ર ગુણસેનની પ્રેરણાથી જંગી તપ કરવા પામ્યા. આ હિસાબે તો પરોક્ષમાં ય તાપસ ત્રાહિતની આગળ ગુણસેનને ‘કલ્યાણમિત્ર’ શબ્દથી એક સારા માણસ તરીકે ઓળખાવે છે,’ આ જાણી લીધા પછી હવે જુનું પોપણું ઊઝેડવાની જરૂર શી ? શી પ્રેરણા’ જાણવાની ઈચ્છા શા માટે ? પણ

જીવની ફિજુલ યા વધુ પડતી જિજ્ઞાસા-આતુરતા-ખણજની કુટેવ જીવને નિરૂપ્યોગી કે નુકશાનકારક વસ્તુમાં બેંચી જાય છે.

ડાફોળિયાનું કારણ ફિજુલ જિજ્ઞાસા :-

માણસ મકાનની બારીએ કે ઝુબે ઊભો ઊભો રસ્તા પર જોયા કરે છે શું જેબું છે ભાઈ ? ખાસ કશું જ નહિ, છતા ફિજુલ જિજ્ઞાસા એને ડાફોળિયાં મરાવે છે, પછી એમાં મળે શું ? લગભગ એવું એવું જ કે રાગ-દ્રેષ કરાવે, વાસનાને

૨૬૮ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“લક્ષ્મણના ઉદાર બોલ” (ભાગ-૪૪)

ઉતેજિત કરે. ખોટી જિજ્ઞાસા-આતુરતા કેવી ભયાનક છે, કે દા.ત. બારી ઉભા સામા મકાનની બારીમાં જોવા માટે નજર નાખી ને કદાચ એવું જ જોવા મળે કે બાઈ કપડા પહેરતી હોય, યા યુગલ પ્રેમ કરતું હોય, કે ગુરુસે ભરાયેલા વડીલ પત્ની કે પુત્રાદિને પીઠતો હોય, તો આવું કાંઈક દેખાય પછી મન સાબૂત રહે જરૂર નથી? કે મોહ યા દ્રેષ્માં પડી જાય?

ફિજૂલ જિજ્ઞાસા-આતુરતા એ પાપ છે, મનને સખણું રહેવા દે નહિ.

આતુરતા કરે છે જોવા દે સામે શું ચાલે છે? અને કોણ શીખવે કે ‘અત્યા ભાઈ! આવી આતુરતા કરીને શું કરવું છે? આતુર થઈ જોવાનું તો કર્યું, પરંતુ એ એ જોઈને તારે શું કરવું છે? તને કયો લાભ થાય છે? નથી ને એવો કોઈ તીવ્ર રાગ, તીવ્ર મોહ, તીવ્ર કામ, તીવ્ર દ્રેષ્મ મગજમાં ઊઠી ગયો તો આગળ કશું કરવા નહિ પામે તો પણ કેવા ચિકણાં અશુભ કર્મ બાંધીશ? ના આ કશો વિચાર જ નથી એટલે આંખ મળી છે ને, તે જ્યાં ત્યાં ભટકાવી રહ્યો છે.

કવિ પ્રભુને આત્માની હુદશી કહે છે,-

‘વિષ આધા વિષ ભોગવ્યાં જી, ફોગટ કર્મ બંધાય;
આર્તધ્યાન મિટે નહિ જી, ક્રીજે કવણ ઉપાય

રે જિનજી ! મુજ પાપીને તાર.’

ડાફોળિયાં મારી મારીને મગજમાં કેટલાય કચરા-ભૂસા ભર્યા હોય એટલે પછી કેઈ જાતના પાપવિકલ્પો ચાલ્યા કરે ને આર્તધ્યાનની ધારા વહેતી રહે, એમાં નવાઈ નથી, આજે છાપાં વાંચવાના ચડસમાં જીવ શું કરી રહ્યો છે? ન જોઈતા કામ-કોધ-લોભના કાળા કૂચુડાં મન અને આત્મા પર લગાવી રહ્યો છે. કેમ આટલો ચડસ? ખોટી આતુરતા-જિજ્ઞાસાને લીધિસ્તો.

ખોટી આતુરતા પાછળ આંખ અને કાન દાટ વાળે છે.

જીવને વાતોચીતો કેમ ગમે છે? કારણ ખોટી આતુરતા છે કે ‘લાવો વાતમાં બેસીએ તો કાંઈક જાણવા મળશે.’ જેમ આંખના ડાફોળિયાં, એમ કાનનાં ઘરેથી પ્રભુદર્શને નીકલ્યો, તો મનમાં જો એ જ લગની રાખે કે ‘જીઉં વીતરાગનાં દર્શન કરું’ તો તો મંદિરમાં પ્રભુનાં દર્શન પ્રભુ પર આંખ ચોંટી પડીને થાય, પરંતુ રસ્તામાં ડાફોળિયાં મારતો મારતો ચાલે, તે ઠેઠ મંદિરની અંદર પેઠે ત્યાં પણ ડાફોળિયાં, તો એ હવે ભવે ને પ્રભુની સામે આવીને ઊભો, પણ પ્રભુ પર આંખ ક્યાંથી ચોંટી પડે? પ્રભુદર્શન ઠરીને ક્યાંથી થઈ શકે? જીવનમાં એવાં હજારો પ્રભુદર્શન થઈ જવા છતાં હજ આજે પણ ઠરીને દર્શન નથી થતું ને? ને કારણ હુનિયાનું જોવાની ખોટી આતુરતા તે આજે પણ પ્રભુનાં દર્શનની વચ્ચમાં ય આંખ ભગવાન પરથી બીજે ચાલી જાય છે.

જીવને શિખામણા :-

ખોટી આતુરતાએ આંખે અને કાને આત્માનો સત્યાનાશ સરજ્યો છે. માટે હવે એ આતુરતાથી જરા પાછા વળી જવાની જરૂર છે; મૂળ પાયામાં ખોટી આતુરતાને જ બંધ કરવા જેવી છે. જીવને સમજાવી દેવું જોઈએ કે ‘આ સંસારમાં અનંતકાળ ભટકતાં ધાણું ધાણું જોયું - સાંભળ્યું, તે ય અનંતીવાર હુનિયાનું જોઈ નાખ્યું, સાંભળી નાખ્યું, હવે બસ કર. તું જે જોઈ સાંભળીને જાણવા માગે છે એમાં કશો લાભ નથી. ‘હુનિયાનું જુઓ ને રુઓ’ ના સોદા છે; શાંત બેઠેલા મનને રાગ દ્રેષ્મ-મોહના ઉકળાટ કરાવવાનો ધંધો છે. મને તો લાગે છે, કે

અંતરમાં ધર્મ પરિષમવાનું અને વીતરાગ પ્રભુ પર પ્રેમ વસવાનું આ એક લક્ષણ છે કે ખોટી આતુરતા અને ડાફોળિયા બંધ થઈ જાય. ઓછા થઈ જાય.

તમને પ્રભુ ગમે છે? પ્રભુ પર તમને પ્રેમ છે? તો ફિજૂલનું જોવા-સાંભળવાની આતુરતા શા માટે થાય છે? શા માટે ખોટાં ડાફોળિયાનો ચડસ છે? પ્રેમ છે? ડાફોળિયા મારવા કેમ ગમે છે?

સુલસાની પરીક્ષા કરવા અંબડપરિચાજક નગરના દરવાજે દરવાજે જીવતા જાગતા જીદા જીદા દેવનાં રૂપમાં આવે છે; ને નગર આખું એ સમજે છે કે ‘હું? એ દેવ કેવા દેખાતા હશે? એ જાણીને મારે શો ઉપયોગ છે? મારે અંતરથી મારા મહાવીર પ્રભુને જોયા કરવા છે, એમાં આ દર્શન વળી શા ઉપયોગમાં આવવાનું હતું? ઉલટું, એટલો સમય પ્રભુદર્શન-ચિંતન ગુમાવીશ.

અસદૃદ્શન મગજમાં પેઢું એ સદૃદ્શનની ને સત્યચિંતનની વચ્ચમાં દખલ કરશે. માટે અસદૃદ્શન ન કર્યું સારું.

(૧) પ્રભુ પર રાગ ફિજૂલ આતુરતાને કેમ તોડે? :-

સુલસાએ આમ પોતાના મનમાં ખોટી આતુરતા જ ન જાગવા દીધી, પછી શું કામ બીજા દેવ જોવા જાય? ન ગઈ, ને અંબડની પરીક્ષામાં પાસ થઈ ગઈ. અંબડને અનું સમ્યગ્દર્શન માપવું હતું. એની સુદેવ પરની શ્રદ્ધાનો કયાસ કાઢવો હતો, તે કાઢી લીધો કે આ બાઈને અરિહંત પ્રભુ પર અનન્ય રાગ છે., ભરચ્યક ઉછળતો રાગ છે, એટલો બધો કે એના એ હૈયામાં બીજા દેવને જોવાની આતુરતા પૂરતો પણ રાગ રહેવાની જગા નથી, એટલે ઠાંસી ઠાંસીને વીતરાગ મહાવીર પરમાત્મા પર રાગ ભર્યો છે!

પરમાત્મા પ્રત્યે રાગ ઊભો કર્યા પછી તો પરમાત્માનાં સ્વરૂપને, એમના જીવનને, એમના ગુણો અને સામર્થ્યને, તથા એમના ઉપકરને, ઉપકરીની અંતર્ગત એમનાં વચ્ચનોને જોવા-જાણવાની અને ચિંતવવાની કેટલીય આતુરતા હોય. ત્યાં

પછી દુનિયાનું ફિજૂલ જોવા-જાણવાની કુરસદ જ ક્યાંથી હોય ?

એટલે જ મોટી ઉપાધિઓ અને જવાબદારીવાળા મહારાજા કુમારપાળ અને મંત્રી પેથડશા જેવા પણ ખોટી આતુરતાને પોષનારા નહિ, તેથી જ પરમાત્માની ભક્તિ કલાક દોઢ કલાક સુધી એકતાન થઈને કરી શકતા. પરમાત્મા પર એવો હદ્યમાં ભરચુક રાગ હતો કે ત્યાં દુનિયાનું બધું તુચ્છ લાગતું. પછી એ તુચ્છ ફિજૂલ જોવા જાણવાની આતુરતા નહિ, જોવા-જાણવાનો રાગ નહિ.

(૨) ધર્મ પરિણાતિ ફિજૂલ આતુરતાને કેમ તોડે ? :-

એમ, જેને અંતરમાં ધર્મ પરિણામ્યો હોય, હૈયે ધર્મ ફરસ્યો-સ્પર્શ્યો હોય એને પણ ખોટી આતુરતા ઉઠે નહિ; કેમકે હૈયે ધર્મ સ્પર્શ્યો પછી ધર્મની એટલી બધી ઉપાદેયતા લાગે છે, કર્તવ્યતા લાગે છે, કે દિલ જાણે બેબાકળું બની જાય છે કે આ પાપભરેલા સંસારી જીવનમાં ધર્મ ક્યાં ક્યાં કરું ! કેવી કેવી રીતે કરું ! ધર્મની આ લગનમાં એને ફજૂલનું જોવા જાણવાની આતુરતા જ શાની રહી ? વિચારથી-વાણીથી અને વર્તાવથી ધર્મ કરવાની તક શોધતાં એને બીજી વાતની કુરસદ જ નથી કે એ મફન્તિયું જોવાં આંખ નાખે ને સાંભળવા કાન ધરે.

નવી પત્નીના પ્રેમની જેમ ધર્મનો પ્રેમ હૈયે સ્પર્શ્યો પછી ફિજૂલ આતુરતાઓ નહિ :-

જુઓ, નવી રૂપાળી મનમાની પત્ની સાથે બગીચામાં ગયેલા પતિની આસપાસ જોવાનું ધાર્યું છે, છતાં પત્નીની લગનમાં એને બગીચાનું જોવાની આતુરતા ય ક્યાંધે ? ને કુરસદ પણ ક્યાં છે ? એને તો પત્નીનું રણિયામણું સુખ અને કાયા જોવામાં, એના મીઠા બોલ સાંભળવામાં અને ‘આને કેમ રાજી કરું ? આની શી શી સેવા કરું આને શું શું ગમે ?....’ વગેરે ચિંતવવામાં લીનતા છે, પછી શાની બીજી ફિજૂલ આતુરતા ઉઠે ? એની સાથે પ્રેમાલાપ કરવામાં કશા ડાફોળિયામાં નહિ, કશી બીજી આતુરતા ય નહિ.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૨૫, અંક-૩૮, તા. ૪-૬-૧૯૭૭

હૈયે ધર્મ ફરસ્યા પછી જીવની આવી દશા હોય. એક દુનિયાનો માણસ પત્ની પર હૈયે પ્રેમ ફરસ્યા પછી પત્ની અંગેના જ ચિંતનમાં વાકુળ હોય તો ધર્મ જીવ હૈયે ધર્મનો પ્રેમ ફરસ્યા પછી ધર્મ અંગેના ચિંતનમાં વાકુળ ન બને ?

અંતરાત્મભાવનો એક ઉપાય : ડાફોળિયાં બંધ :-

ધર્મમાં રસ રાખવો છે ?

ગંભીર બનવું છે ?

સતત તત્ત્વચિંતન ચલાવવું છે ?

રાગાદ મહાદોષો અને હસામશકરી આદિના તુચ્છ આનંદોથી બચવું છે ?

તો ફિજૂલ વસ્તુ જાણવાની આતુરતા જિજાસા અને ડાફોળિયા બંધ કરી દો. ત્યારે એનો સમય વેકફાતો બચે એમાં તત્ત્વચિંતન થઈ શકે. કમમાં કમ ૫-૧૫ નવકાર સ્મરણ થઈ શકે, અને વધારામાં મન બાધ્યભાવમાં જતું બચે, તેથી એના કુસંસ્કારનો બોજ ન વધે પછી જીવ અંતરાત્મભાવમાં ઠરે. આ માટે ખોટી આતુરતા -જિજાસા રોકવી જરૂરી.

ગુણસેન રાજાને જિજાસા થઈ કે ‘જો કે મેં તો આ મહાતાપસની નાની વયે મશકરી કરી છે, છતાં એ મને કલ્યાણમિત્ર તરીકે તપમાં પ્રેરક માને છે, તો લાવ જોઉં તો ખરો કે એ ગુણસેને શી પ્રેરણા કરી કહે કે ‘ભાઈ ! પ્રેરણા આ , કે એ મારી મશકરી કરતો હતો જેથી કંટાળીને મારે તપોવન અને તપનો આશ્રય લેવો પડ્યો; તો એ સાંભળીને રાજાના મનને શું થાય ? સંભવિત છે કે ‘આવો મહાતાપસ થવા છતાં હું આણે વર્ષો જુનું શાલ્ય દિલમાં રાખી મૂક્યું છે ? આવું મનને થવા જાય ? ને એમાં મહાતાપસ પરના સદ્ગુરૂ-બહુમાન ઓછા થાય. આવું બની આવે એમાં કહો, ફિજૂલ જિજાસા કરીને શો સાર કાઢ્યો ? ફિજૂલ જિજાસા આતુરતા ખોટી અસ્તુ.

અહીં તો આ મહાતાપસ છે ને ? એઝે રાજાની જિજાસા કે ‘આપને ગુણસેને શી પ્રેરણા કરી ? એના જવાબમાં કહ્યું,- ‘મહાનુભાવ ! પ્રેરણા અનેક પ્રકારની હોય છે, એમાંથી ગમે તે એક પ્રેરણા કરી.’

મહાતાપસની કેવી ગંભીરતા છે ! રાજાને ગુણસેન તરીકે એ ઓળખતો નથી તેથી ગ્રાહિત માણસ સમજે છે; છતાં એ એની આગળ દિલનો બફારો કાઢતો નથી. એઝે દિલમાં ખેદેખ મશકરી ને એક વિટેંબણા તરીકે રાખી નહિ હોવાથી કિન્તુ તપમાં ચડવાની એક પ્રેરણા માની હોવાથી એ શું કામ બફારો કાઢે ?

અનિષ્ટને પણ કોઈ શુભનાં નિમિત્ત તરીકેની દષ્ટિથી જુઓ તો અનિષ્ટકારી એ ઉપકારી લાગે.

દષ્ટિ ફેરવો એટલે દુઃખ એ સુખ અને સુખ એ દુઃખ :-

પ્ર.- મશકરી એ શુભ તપનું નિમિત્ત ? રાજકુમારે કાંઈ તપમાં ચડાવવાના આશ્રયથી મશકરી નહોતી ચલાવી પછી ભલે કુલપતિના ઉપદેશ પર પોતે પોતાના વિવેકથી તપમાં ચડી ગયો, પણ મશકરી તો વિટેંબણાનું જ નિમિત્ત હતી ને ?

૩.- રાજકુમાર તરફથી વિટેંબણારૂપ હોવા છતાં હવે તાપસની દષ્ટિ ફરી

ગઈ છે. દસ્તિ ફેરવો એટલે દુઃખ એ સુખ અને સુખ એ દુઃખ લાગશે. દસ્તિ કેવી ફેરવીને તાપસ હવે એને જ ગુણકારી માને છે એ હમણાં આગળ સમજાશે. જ્યાં ગુણસન રાજાએ આ સાંભળ્યું ત્યાં એને લાગ્યું કે અહો ! મારી મશકરી કરવાની આદતને આ એને ગુણરૂપ લે છે ? હું અપરાધી છું, ને આ મહાન તાપસ મને ઉપકારી માને છે ! તો લાવ, હવે મને મારી ઓળખ આપવા દે.’

એમ વિચારીને રાજા કહે છે. ‘ભગવાન ! તો જેને આપ તપમાં પ્રેરણાકારી કલ્યાણમિત્ર ગણો છો એ પાપી ગુણસેન નહિ પણ અગુણસેન હું પોતે જ છું’

ગુણસેનની ઓળખ પર તાપસનો જવાબ :-

તરત મહાતાપસ અભિનશર્મા કહે બોલી ઉઠે છે ‘તરત એવું મા બોલ, જે તે મને આટલો મોટો તપનો વૈભવ કમાવી આપ્યો એ તું અગુણસેન શાનો ? તું તો મહાગુણસેન છો.’

વિચારજો મહાતાપસ શું કહી રહ્યો છે. એક ‘પૂર્વ’ વર્ષ જેમાં ૭૦૫૬૦ અબજ વર્ષ જાય, એવા લાખો પૂર્વ સુધી તાપસ સતત અખંડ રીતે માસખમજના પારણે માસખમજા કર્યે ગયો તે માસખમજો કેટકેટલી ઘોર તકલીફ જાતે ઉઠાવીને કર્યા, છતાં જશ આપે છે રાજાને કે આવા જંગી તપનો વૈભવ તેં કમાવી આપ્યો અસલ તો ગુણસેન એવી પ્રેરણા તો કરી નથી કે ‘તું જા તપ કરવા લાગ, તરું કલ્યાણ થશે; એણે તો ગધેઠે બેસાડી ફેરવવાની અને છોકરાઓમાં હુરિયો બોલાવવાની મશકરી કરી છે. છતાં અભિનશર્મા કેમ આને જશ આપી કલ્યાણમિત્ર તરીકે ઓળખાવે છે ? કારણ એક જ , કે તપને એ સાચો વૈભવ માને છે, ને એ સમજે છે કે એ કમાવવાની તક મૂળ ગુણસેનની બાળરમત ન ચાલી હોત તો અભિનશર્મા પિતા પુરોહિતના ઘેર જ બેસી રહી પિતાના પગલે પગલે, આગળ જતાં એક પુરોહિત ગૃહસ્થ બન્યો હોત. ત્યાં આવો તપવૈભવ કમાવવાની વાતે ય શી ? એમ અભિનશર્મા સમજે છે. એટલે,

નિમિત્ત ગમે તેવું, પરંતુ જો એમાંથી સરવાળે સારો આત્મહિતનો લાભ થયો, તો ઉત્તમ જીવો એનો ઉપકાર માને છે.

વેદનાદાતા કર્મક્ષયમાં ઉપકારી :-

જીઓ ખંધકમુનિ ગજસુકમાલ વગેરે મહામુનિઓ, જીવતા ચામડી ઉતારવી, માથે ધીખતી સગડી મૂકવી, વગેરે મરણાન્ત ઘોર વેદના આપનારને, મહાઉપકારી માનતા ! ‘એ તો વળી સખાઈ મિલિયો ભાઈ થકી ભલેરો રે,’ એમ વિચારતા ! કારણ ? વિપુલ કર્મક્ષયરૂપી વૈભવની કમાઈમાં એ નિમિત્ત બન્યા. એ જોતા કે ‘આવો જબરદસ્ત કર્મક્ષયરૂપી આત્મહિતની કમાણીનો લાભ આવી વેદના

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : છૂટવાનો મોકો”(ભાગ-૪૪) ૨૭૩

સધ્યા વિના ક્યાં થવાનો હતો ? શરીરને પંપાળીને હુલાવી હુલાવીને કે પાલિસ-માલિસ કરીને જટિલ કર્માંનો કષય થોડો જ થાય છે ? એ તો કારમી વેદના સહીને થાય; ને એ વેદના આવા ઉપદ્રવકારી વિના ક્યાંથી મળે ? માટે જટિલ કર્માંના કષયના વેદનાદાન દ્વારા નિમિત્ત થનાર આ તો અમારે પરમ ઉપકારી કહેવાય.’

વ્યવહારનો દાખલો જીઓ :-

મોત માટે ઝેર આપનાર ઉપકારી :-

મુંબઈમાં બે ભાઈ રહેતા. એમાં એકને વાળાનું અસધ્ય દરદ ઉપર્યું. બીજો ભાઈ બિચારો નોકરી ય કરે અને એની સેવા પણ કરે, દવાદારુ લાવી વપરાવે, પરેજી પથ્ય સચ્યવાવે. પરંતુ દરદ ઓદ્ધું થવાને બદલે વધતું ચાલ્યું તે રાતના ઉંઘ પણ ન આવે ને વેદનાથી ચીસોચીસ પાડે. ભાઈ શાંતિ આપવા જાય ત્યારે એ કહે ‘મોટા ભાઈ ! સહન થતું નથી શું કરું ! તમને ય હું કેટલા હેરાન કરી રહ્યો છું ! હવે મને ઝેર આપી દો, મુંનું તો મને શાંતિ થાય.’

જાલિમ કર્મ જાયારે રુકે છે ત્યારે ચમરબંધીની ય શરમ કે દયા રાખતા નથી, હદ બાહાર પીડે છે.

કર્મ આપ્યા દુઃખ પર જાતે મનથી દુઃખ વૃદ્ધિ :-

સનતકુમાર ચક્કવર્તી જેવાને એકી સાથે એકાએક સોળ રોગ ઉત્પત્ત થઈ ગયા. ભગવાન મહાવીરસ્વામીને ગોશાળાની તેજોલેશયાએ છ મહિના લોહીના આડાની પીડા આપી. આ ઉપરથી બે વાત શીખવા મળે છે કે, -

(૧) કર્મ બાંધતા પહેલાં જ ચેતતા રહો, કર્મગી-બંધના કારણભૂત કખાયો અને હિંસાઈ પાપોને અટકાવો.

(૨) બીજું એ, કે કોઈ પણ દુઃખ આપત્તિ આવી પડે ત્યારે જરાય હાય વોય ન કરતાં ‘આ મારાં જ કર્મનું ફળ છે, ને ફળ ભોગવતાં કર્મકચરો દૂર થઈ રહ્યો છે’ એ વિચારી શાંતિ સમાધિ રાખો.

જીવન જીવતાં આ બે વસ્તુ ધ્યાનમાં રહે, અમલમાં રહે, તો મજાલ કોની છે કે જીવને દુઃખી કરી શકે ? દુઃખ આવે પણ મન દુઃખી ન બને. નહિતર તો કર્મ આપ્યા દુઃખ ઉપર મન દુઃખી કરવામાં આપણી જાતે જ દુઃખમાં વધારો કરીએ છીએ તે ભલું હોય તો મનનું દુઃખ વધતાં ઠેઠ મરવા સુધીના વિચાર આવી જાય છે.

પેલો વાળાના રોગવાળો ભાઈ રોગથી ત્રાસી રહ્યો છે, તે મોટાભાઈને કહી રહ્યો છે ‘ભાઈ ! સહન થતું નથી. આના કરતાં તો તમે મને ઝેર આપી દો.’ ભાઈને પણ લાગી રહ્યું છે કે ‘આવે ત્રાસ ધંધો છે. એનાથી એ સધ્યો જતો નથી, અને મારાથી એ જોયો જતો નથી. માટે હવે તો આવે ઝેર આપીને આ દરદથી

૨૭૪ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“જીવને શિખામજા”(ભાગ-૪૪)

ધૂટકારો અપાવું. આખી રાત બિચારો જ્યારે ત્રાસ ભોગવે છે, તો દહાડે હું તો નોકરીએ જાઉ એટલે મને જોવા ન મળે, બાકી આને આખો દિવસ પણ ત્રાસ કેટલો હશે? હવે તો આ બિચારો મરે તો ત્રાસથી ધૂટી સુખી થાય.'

શું મોટા ભાઈનો આ વિચાર બરાબર છે? ના, કેમકે એ એ જોવું ભૂલી જાય છે કે હાયવોયમાં મર્યાદ પછી એ કદાચ કોઈ એવા તિર્યંચના અવતારમાં જઈ પડ્યો કે જ્યાં જનમથી ત્રાસ હોય તો ક્યાં એનો ત્રાસથી ધૂટકારો થયો? ક્યાં ત્યાં સુખી થયો?

ત્યારે મરવા ઈચ્છનારને પણ જ્યારે ઝેર શરીરની નસેનસમાં વ્યામ થયા પછી ભયંકર વેદના કરે ત્યારે હાયવોય વધી જાય, મનને એમ થાય કે ‘અરેરે! આના કરતાં તો પેલું દરદ સારું હતું કે એમાં આ લ્હાયો નહોતી, આ નસોની તંગ ઝેંચામણ નહોતી, હાય હાય! ક્યાં મેં ઝેર ખાધુ?....’ આમ દરદની પીડા કરતાં ઝેરથી મરણાન્ત કષ્ટની પીડા અસમાધિ ભયંકર વધી જાય એમ બનવાનો પૂરો સંભવ છે. તેથી એ રોગી ભલે ઝેર માગે, પણ ઝેર કેમ દેવાય?

પરંતુ મોટો ભાઈ એની રાતોના ત્રાસ જોઈ કકળી ઊઠ્યો છે, તેથી હવે દરદથી ધૂટકારો કરાવવા જીવનથી ધૂટકારો કરાવવાનું ધારી બજારમાંથી અફીણ લાવીને ભાઈને આપતાં કહે છે ‘આજે વૈદે દવા બદલી છે. કદાચ વધારે કડવી લાગશે. પણ શાંતિ થઈ જવા સંભવ છે.’

અફીણથી વાળાનો રોગ ગયો.

એમ અફીણ આપીને મોટો ભાઈ નોકરીએ ગયો, મનમાં ધારણા છે કે સાંજે આવીશ ત્યારે આના રામ રમી ગયા હશે પરંતુ બન્યું ઊંધું. રોગીએ અફીણને દવા માની ખાઈ લીધું જ્યાં એ પેટમાં જઈ પજખ્યું કે એણે વાળના દરદનો સામનો કર્યો. વાળો એક પ્રકારનું ઝેર છે; તેથી શરીરને એણે બીજો અપાય ન કર્યો. બીજુ નુકસાન કર્યું નહિ, ને દિવસો પછી દરદ મટવાથી એને ઘસધસાટ ઊંઘ આવી ગઈ.

બોલો, આ જ્ઞાયા પછી વાળાનો રોગ હોય તો અફીણ ખાવાની હિંમત ચાલે? ના, ભાઈ સાબ! પેલાને ભલે રોગ મટ્યો હોય પણ એમે તો અફીણથી મોત પામીએ તો? આવો ડર રહે છે, કારણ? મનમાં અંકિત થઈ ગયું તે કે અફીણ મોત લાવે, અફીણ મારનારું’ બસ, આ રીતે સમજ રાખવાનું છે કે વૈરાગી થયેલા ગુણસાગરને સાધુના સમાગમમાં નહિ, પણ ભલે ચોરીમાં હસ્તમેલાપ કરતાં કરતાં કેવળજ્ઞાન થયું! પરંતુ આપણાથી આવો અખતરો ન કરાય. કેમકે પાણિગ્રહણ તો ડૂબાડનારું છે, તારનારું નહિ’ એવું આપણા મનમાં વસેલું જોઈએ.

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો: ધૂટવાનો મોકો”(ભાગ-૪૪) ૨૭૫

જીવન માટે ઝેરનો અખતરો નહિ એમ ધર્મ માટે પાપક્રિયાનો અખતરો ન કરાય.

ભરત ચક્કવતીને આરિસાભવનમાં ભલે કેવળજ્ઞાન થયું, પણ આપણાને ભય રહેવો જોઈએ કે ભોગ ભૂમિ મને ભવમાં ડૂબાડે તો? અસ્તુ.

પેલો મોટોભાઈ સાંજના આવીને જુઓ છે તો ભાઈ સૂતેલો છે. પહેલાં તો એ સમજે છે કે મરી ગયો હશે. પરંતુ પાસે જઈ જોયું તો નસકોરાં બોલે છે. એને થયું કે ‘આ શું?’ ભાઈને એ જગાડે છે ત્યાં ભાઈ આળસ મરડી બેઠો થાય છે, ને મોટોભાઈને ખુશી થતો થતો પૂછે છે, ‘ભાઈ! આજે વૈદે કેવી સરસ દવા આપી કે મારા વ્યાધિ તદ્દન મટી ગયો લાગે છે? મને હવે કશી વેદના નથી. કેટલીય રાતો ઊંઘ વિના ગયેલી, તે આજે મને ઘસધસાટ ઊંઘ આવી ગઈ!’ મોટો ભાઈ કહે, ‘ભાઈ! ખરેખર તું દવા બધી ખાઈ ગયેલો!’

આ કહે ‘હા હા, હા, એમાં પૂછવાનું શું? તો ત્યારે તો આ દરદ ગયું લાગે છે.’

‘જો ભઈલા! આ દવા વૈદે નહોતી આપી; હું જ બજારમાંથી લઈ આવેલો.’

‘ઓહો! તો તો મોટોભાઈ! આટલા દિવસ કેમ મને રિબાતો રાખ્યો? પહેલાં જ લાવવી હતી ને? શું પહેલાં ખબર નહોતી?’

મોટો ભાઈ હસે છે. પેલો પૂછે ‘કેમ હસો છો? શું હું અજુગતું બોલ્યો?’

મોટાએ ખુલાસો કર્યો ‘ભાઈ રે! તને પહેલાં શું લાવી આપું? આ તો મેં તારી ભયંકર અસદ્ય પીડા જોઈ તને એમાંથી ધૂટકારો મળે એટલા માટે બજાર માંથી અફીણ લાવીને તને આપેલું, તારું મૃત્યુ થાય તો સારું જેથી પીડાથી બચે. પણ ભગવાનની કૃપા કે અફીણે તારા રોગનું ઝેર જ સાફ કરી નાખ્યું, જેર ઝેરને મારે એવું થયું.’

નાનો ભાઈ કહે છે, ‘ઓહો ભાઈ! તમે કેટલા બધા ઉપકારી કે મારો રોગ મટાડી મને નવું જીવન આખ્યું! બોલો,

‘મોત માટે ઝેર આપનારો ઉપકારી? કે ભયંકર અપકારી?’

આવો સવાલ એમજ પૂછો તો શો જવાબ આપો? અપકારી જ ને? પણ અહીં આ પ્રસંગ વિશેષને લઈને નાનો ભાઈ મોટાને મહા ઉપકારી માનતો કહેતો હોય તો ખોટું નથી ને? ત્યાં શું એ એમ જોવા જાય કે ‘ઝેરથી ભલે મને આરોગ્ય મળ્યું, પણ મોટાનો આશય તો મને મારી જ નાખવાનો હતો ને? માટે એને કાંઈ

૨૭૬ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“જીવને શિખામણ”(ભાગ-૪૪)

હિતેથી ન કહેવાય. ‘આવું એ ન જુએ ને ? કેમ વારું ? કહો, એને ઝેરથી જે ભયંકર દરદ અને વેદનાથી છૂટકારો મળ્યો એની એના મનને મોટી કિંમત છે.

નાનાભાઈ અને અભિનિતાની સરખામણી :-

બસ, આપણી વાત આ હતી કે અભિનિતાની મોટો તપ વૈભવ મળ્યો એની એને મન મોટી કિંમત છે, તેથી ભલે એ ગુણસેન રાજકુમારની મશકરી ન સહી શકવાથી ભાગેલો, અને તાપસ બની આ તપ કરવા પામેલો, પણ એ તપવૈભવ કમાવામાં ગુણસેનને પ્રેરક કલ્યાણમિત્ર માને ઉપકારી માને એમાં ખોટું શું છે ?

પેલો ભાઈ જેમ મોટાનો મોત આપવાનો આશય નથી જોતો, પણ એના જ ઝેરપ્રોગ પર પ્રામ થયેલ મનગમતું આરોગ્ય જુએ છે, એમ અહીં અભિનિતા મહાતાપસ ગુણસેનનો પૂર્વનો સત્તામણીનો આશય નથી જોતો, પરંતુ એના મશકરી પ્રયોગ પર જ પોતાને સરવાળે પ્રામ થયેલ મનગમતો તપ વૈભવ જુએ છે ;

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૨૫, અંક-૩૮, તા. ૧૧-૬-૧૯૭૭

પણી ગુણસેનને ઉપકારી કેમ ન લેખે ?

આ બહુ શીખવા જેવું છે કે આપણને કોઈ લાભ થઈ ગયો પરંતુ કોઈએ આપણું કાંઈ વાંકુ કરવાનું નિમિત્ત પામીને થયો તો ત્યાં લાભ તરફ દિલ્લી રાખીને સામાને એમાં નિમિત્ત બન્યો માની એને ઉપકારી માનીએ, પણ એને અપરાધી માની એના પર કખાય ન કરીએ, દ્વેષ ન કરીએ, કદાચ દેખની ગાંઠ બાંધી રાખી હોય તો તે છોડી નાખીએ, અને દ્વેષથી બચીએ.

એટલે જ આપણા અપરાધીના અપરાધની ગાંઠ છોડવા અને એના પરના દ્વેષથી બચવા આ એક ચાવી મળી કે એ અપરાધ નિમિત્ત આપણને કોઈ લાભ થયો કે નહિ એ શોધી કાઢવાનું. વિચાર કરતાં દેખાશે કે આમ બાબ્ય લાભ ન દેખાતો હોય તો પણ આપણને એ અપરાધ નિમિત્ત જ ક્ષમા-સમતા કેળવવાની તક મળે છે. સામો સારાસારી રાખે એમાં એના પર શી ક્ષમા-સમતા કેળવવાની ? એ તો એ અપરાધી બને છે તેથી એના પર ગુસ્સો થઈ આવવા સંભવ છે એટલે ત્યાં ગુસ્સાને દબાવી ક્ષમા કરવાથી તક ગણાય. હવે જો આ ક્ષમાને બહુ કિંમતી લાભરૂપે જોઈએ તો સામાને એમાં નિમિત્તભૂત બની ઉપકારી બનવાનું મનાય, ઉપકારી તરીકે લેખાય.

દ્વેષથી બચવા ચાવી સામાઠી આપણને લાભ શોધો; કમમાં કમ ક્ષમાનો લાભ જોવો.

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : છૂટવાનો મોકો” (ભાગ-૪૪)

ક્ષમા રાખીએ એમાં આપણું સત્ત્વ વિકસે છે.

એ સત્ત્વ વિકસના લાભમાં ય સામો નિમિત્ત બનવાનું માની એને ઉપકારી લેખી શકીએ.

એમ, સામાનો અપરાધ ટેખી એની સાથે સંબંધ બંધ કર્યો અને સાધુસમાગમ-જપ-સ્વાધ્યાય-પ્રભુભક્તિ વગેરે ગમે તેમાં વધુ લાગ્યા, તો એ લાભ થયો માની એમાં સામાના અપરાધને એને ઉપકારી લેખી શકીએ.

આમ, આપણા લાભને મહત્ત્વ આપી સામા તરફથી થયેલી આપણી સત્તામણીને એમાં નિમિત્તભૂત ગણી સામાને પ્રેરક કલ્યાણમિત્ર લેખીએ. અભિનિતા આ કરી રહ્યા છે. તેથી ‘આ સામે પૂછનાર પોતે જ ગુણસેન છે કે જેણે નાનપણે મશકરી-સત્તામણીઓ કરેલી ને તેથી પોતાને ભાગી જવું પડેલું,’ એ હવે ખબર પડી જવા છતાં એના પર દ્વેષ નથી કરતો. અરે ! એની ઓળખ પડવા પહેલાથી એને પ્રેરક કલ્યાણમિત્ર માની રહ્યો છે, કેમકે એની દિલ્લી કમાયેલા જંગી તપવૈભવ પર છે.

જુઓ, અભિનિતા તપને મહાન વૈભવ ગણી રહ્યો છે. તપનો વૈભવ અટલે સંપત્તિ શું । ધન એ સંપત્તિ નહિ, સત્તા નહિ, પરંતુ તપ એ સંપત્તિ.

આત્મહિતકર ગુણો અને સાધુસેવા-પ્રભુભક્તિ, દ્યા-દાન-શીલ-તપ આદિ સુકૃતો એ બધું સાચી સંપત્તિ.

એટલે આ સમજુ રાખનારને કમાણી શાની લાગે ? ધન-માલની નહિ, સત્તા-સન્માનની નહિ. ‘ખાદું પીધું એટલું બાપનું. પૈસા ઘર ભેગા કર્યા એટલા બાપના સત્તા-દક્કાઈ ચલાવી એટલી બાપની,’ આવા આવા કમાઈના હિસાબ એને ન હોય. એ તો સમજે છે કે

(૧) ખાદું-પીધું એ તો પુણ્યમાંથી ખોવાઈ ગયું.

(૨) પૈસા ઘરભેગા કર્યા એટલું પુણ્ય વટાવાઈ ગયું, એટલી પુણ્યહુંડી ખોખું થઈ ગઈ.

(૩) સત્તા-દક્કાઈ ચલાવી એટલું પુણ્ય પરવારી ગયું.

આ બધામાં તો કમાયા નહિ, ગુમાવ્યું. એના બદલે

(૧) રસોનો વિષયોનો ત્યાગ કર્યો, તપ કર્યો, એ કમાયા.

(૨) દાન દીધાં, પરોપકાર કર્યા, ભક્તિ કરી, એ કમાયા.

(૩) ચતુર્વિધ સંધની સેવા કરી, અવસરે અવસરે ક્ષમા, નમ્રતા, લઘુતા રાખી, એ કમાયા....યાવત્ત સંયમ સામાયિક દર્શન-જ્ઞાનના પર્યાય વધ્યા એ કમાયા.

કેમકે (૧) આમાં પુણ્યાનુબંધી પુણ્યના થોક કમાયા, તેમજ પરભવે ગુણાકાર થાય એવા આ ગુણો સુકૃતોના સુસંસ્કારના ગંજ કમાયા.

૨૭૮ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“ક્ષમા રાખીએ એમાં આપણું..” (ભાગ-૪૪)

ગુણો અને સુકૃતો એ જ આપણી સાચી સંપત્તિ, સાચી કમાણી એટલા જ માટે કે એથી,

- (૧) પુષ્ય અને સુસંસ્કારના ઢેર વધે,
- (૨) આત્મા ગુણિયલ અને સદગતિની પરંપરાવાળો થાય.
- (૩) પાપક્ષય અને ભવસંતતિ ક્ષયવાળો બને.

જૈનકુળમાં જન્મીને શિક્ષા મળવા જેવી હોય તો આ સાચી કમાણીની શિક્ષા મળવા જેવી છે. કોણ જૈન માબાપ સંતાનને આ શિક્ષા આપે છે? કોઈ વિરલા; બાકી તો માબાપો ‘પૈસાની કમાણી એ કમાઈ’ના પાઠ ભજાવે છે, ‘સ્કૂલ-કોલજનું સારું ભણી ડીગ્રી મેળવી એ કમાયા’ના સૂત્ર પઢાવે છે. ‘સુખે સારું ખાંધુપીધું, પહેર્યુ-ઓફચું-ભોગવ્યું એ જીવનની મોજ મેળવી’ ના શિક્ષણ આપે છે. જ્યાં ગળથુંથીમાંથી જ આ કમાણીમાં જ કમાણી મનાવાય ત્યાં પછી છોકરા-છોકરી મોટા થયે એ જ માનતા રહેવાના, અને એની પાછળ અને આગળ ધૂમ પાપો ને ધૂમ ક્ષાયો કરતા રહેવાના, એ સહજ છે. એને સાચી કમાણીનો ઘ્યાલ પણ શાનો આવે? તેમજ એ કમાણી કરવાનું દિલ પણ ક્યાંથી થવાનું? ને પ્રયત્ન પણ ક્યાંથી થવાનો? કદાચ જીવનમાં ધર્મ કરશે તો તે પણ ધર્મની કમાણી સાચી કમાણી માનીને નહિ કિન્તુ એનાથી આગળ પર હુન્યવી સુખ-સમૃદ્ધિની કમાણી સારી થાય એ સમજને. અરે! જિંદગીના છેવાડા સુધી ય કદાચ ધર્મ તરીકે ધર્મની સાચી કમાણી માનવાનું એનાં ભાગ્યમાં નહિ. અંતે નવકાર ગણશે-સાંભળશે એ ય પછી ધૂખમય દુર્ગતિના જનમ ન મળે પણ સુખમય સારો ભવ મળે એ ગણતરીએ.

પ્ર.- તો શું સારો જનમ દીઘવો એ ખોટું છે? ?

૩.- જનમ ‘સારો’ કોને કહો છે? જેમાં દુનિયાના સારા વૈભવ અને વિષયસુખોની શાંતિ મળે એને? ભૂલા પડી ગયા, આવું સારાપણું માનવાનું ય સાચી કમાણીની સમજના અભાવે કરાય છે. નહિતર તો સમજતા હોત કે

જનમનું સારાપણું સાચી કમાણી પર ગણાય.

સાચી કમાણી શી શી?

આ જનમમાં આપણે કેટલી સાચી કમાણી કરી અર્થાત્ આત્મસંપત્તિ કેટલી કમાયા એટલો આ જનમ આપણને સારો નિવડ્યો ગણાય. એમાં રૂપિયા કેટલા કમાયા એ ન આવે, પરંતુ દાન કેટલું દીધું, કેટલી વાર દીધું એ આવે. એમ રંગરાગ કેવા ખેલ્યા એ નહિ, પરંતુ ત્યાગ પ્રત-નિયમ કેટલા આચર્યા એ આવે. એવી રીતે રોજ કેટલા ટંક ખાંધું એ ન આવે, પરંતુ કેટલા ટંકનો પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ કર્યો તપ કેટલો કર્યો એ આવે. એવી રીતે ગુસ્સા-અભિમાન-પ્રપંચ કેટલી વાર

રોકીને ક્ષમા-નમ્રતા લઘુતા-નિખાલસતા કેટલી કરી, એ આત્મસંપત્તિમાં આવે. એ પણ ધ્યાન રાખવાનું છે કે આપણે મન કિંમત આ આત્મસંપત્તિની કમાણીની હોવી જોઈએ. તો જ એ વધુ વધુ કમાવાનો લોભ રહે, અને એ કમાયેલા પર એવી હુંફ હોય કે જીવનમાં બીજી પૈસા વગેરેની ન્યૂનતાનું જરાય ધૂખ ન લાગે. એ ધૂખ ન લગાડવા આ ઉપાય છે. માટે કહો,

ધન વગેરેની તંગીનું ધૂખ ન લાગે એ માટે હૈયે આત્મસંપત્તિની કમાણીની હુંફ રાખવી.

‘ધર્મ-ગુણો-સુકૃતોરૂપી આત્મસંપત્તિ હું આટલી કમાયો છું, મારે શી ચિંતા છે?’ -આ હુંફસ્ક્ષા કરે એને એમ થાય કે ‘પૈસા ઓછા છે, કે ઓછા મળે છે યા પરિવાર બરાબર નથી, યા બહાર માન ઓછું મળે છે, શરીર રોગી છે; તેથી શું રોવાનું? એ કાંઈ મારી સાચી સંપત્તિ જ નથી, સાચી કમાણી જ નથી. જીવનની સફળતા યા સારાપણું કાંઈ આ ધન-પરિવાર આદિ પર નથી. એ પૂર્વ કર્મના હિસાબ ચૂકતે કરે છે. એને કોણ સંપત્તિ માને? કોણ કમાણી માને? શું?

ધન-પરિવાર આદિ એ પૂર્વ કર્મના હિસાબ ચૂકતે કરે છે, માટે એ સંપત્તિ કે કમાણી નહિ.

માટે જ ગરીબી-એકલદોકલપણું-અપમાન-અવગણના યા રોગ-અગવડ-અપરાધીનતા વગેરેમાં કશું ધૂખી થવાનું નહિ, કેમકે એ પૂર્વ કર્મના હિસાબ ચૂકતે કરે છે. ત્યારે એ સ્થિતિમાં ય જે દેવદર્શનાદિ પ્રભુભક્તિ-સાધુસેવા-નવકારજાપ, દ્યા-પરોપકાર પ્રત-નિયમ-સામાચિક વગેરે જે આચર્યા એ નવા શુભ કર્મના હિસાબ માંડી આપે છે માટે એ સાચી કમાણી છે, સાચી સંપત્તિ છે અને એ હિસાબ જ આગળ પરલોકે આવે છે. રૂપિયા લાખો-કરોડો કમાયા એ સાથે ન આવે, કેમકે ઓઝે તો પૂર્વ ભવના શુભ કર્મના હિસાબ ચૂકતે કરી દીધા પરંતુ નવલાખ નવકાર સમરણ કમાયા એ સાથે આવે કેમકે એથી નવા શુભના હિસાબ મંડાઈ ગયા. જે પરભવે ચૂકતે થશે તેમ નવા શુભસંસ્કાર જમા થઈ ગયા જે પરલોકમાં નવાં ધર્મખાતાં ખોલી આપશે, અર્થાત્ ધર્મસાધનાઓ ઊભી કરી આપશે.

જૈનધર્મ હૈયે વસ્યો છે? તો આ આત્મ સંપત્તિની જ કમાણીને સાચી કમાણી લેખો, અને હૈયે એની હુંફ ધરો.

વિદ્યાપતિ શેઠ પાસે ધન ધશું હતું, પરંતુ એને એ ખરી સંપત્તિ માનતો નહોતો તેથી એક રાતે જ્યારે સ્વભાવમાં લક્ષ્મી દેવીએ કહ્યું ‘આજથી દશમે દિવસે જઈશ’ ત્યારે એને હૈયે જરાય આધાત ન લાગ્યો. એને અફસોસ એટલો થથો કે અરેરે! આ ધનસંપત્તિ તો મારી સાચી સંપત્તિ હતી જ નહિ, પણ સાચી સંપત્તિ

દાનસંપત્તિ, એ તો મેં કમાઈ જ નહિ. છતાં ખેર ! આ સારું થયું કે લક્ષ્મી દેવીએ મને જગ્રત કર્યો; હવે એ સંપત્તિ કમાઈ લઉં.'

સવારે શ્રાવિકાને સ્વધની વાત કરીને પૂછે છે, 'કેમ બોલો શું કરવું છે ?' શ્રાવિકા કહે 'તમે શું વિચાર્યું છે ?'

શેઠ બોલ્યા, 'મેં ? મને તો એમ થયું કે આ અત્યાર સુધી થાપ ખાધી. જીઓ, આ સંપત્તિ સાચી સંપત્તિ નહોતી, કેમકે એ તો પૂર્વના પુણ્યકર્મનો હિસાબ માત્ર ચૂક્યે થયો હતો એને આપણે આપણી સાચી સંપત્તિ માની બેઠા. કોઈ દેવાદાર દેવાના રૂપિયા પાંચ હજાર શાહુકારને ત્યાં જમા કરી આવે એ થોડી જ પોતાની સંપત્તિ શાહુકારને ત્યાં પડેલી ગણાય ? એ તો હિસાબ ચૂક્યે થયો કહેવાય. એ તો હવે નવા રૂપિયા ભરી આવે તો નવો હિસાબ મંડાય, ને સંપત્તિ ગણાય; કેમકે આગળ ઉપર મજબૂરે એ મળે...એમ અહીં આ સંપત્તિ મળી એ તો હવે પૂર્વનું એટલું ખાતું સરભર થયું, હિસાબ ચૂક્યે થયો. એ તો હવે જો એનાથી દાન-પરોપકાર સુકૃત કરીએ તો એનો નવો હિસાબ મંડાયો ગણાય, ને એ આપણી સાચી સંપત્તિ સાચી કમાણી કહેવાય.

પરંતુ અત્યાર સુધી આપણે ભૂલા પડ્યા, તે આ લક્ષ્મીને સાચી સંપત્તિ માની દાન-સુકૃત કાંઈ કર્યા નહિ, સાચી કમાણી કરી નહિ. તેથી મારું મન તો એમ કહે છે કે હજુ લક્ષ્મી દેવી તો દસમે દહાડે જવાનું કહે છે ને ? પણ આપણે આજે જ બધી ય લક્ષ્મીનું દાન સુકૃત કરી લઈએ; કાલ કોણે દીઠી છે. આજ ભાઈ ! અત્યારે. પછી ખાવા ધાન તો ધરમાં પડ્યું છે, જોઈશું આગળ શું થાય છે. પણ આજે જીવતા છીએ ને લક્ષ્મી હાથમાં છે તો અત્યાર સુધી ભૂલેલા આપણે ઠેકાણે તો આવી જઈએ ? લક્ષ્મી ગયા પછી કે જીવન ગયા પછી તો રાત પડી ગઈ. પછી તો અંધારે ગોતા જ ખાવા પડે.

'રાતનો ભૂલ્યો માનવી, દિવસે માર્ગે આય,
પણ દિનનો ભૂલ્યો મૂરખો રાતે ગોતા ખાય.'

શેઠ કહે છે કે 'જીઓ મારો વિચાર આ છે. તમને જચે છે ?'

શ્રાવિકા કહે 'હા, હા, હા તમે વાત એક નંબરની કરી, ખરું સુઝાડ્યું, સુકૃત એજ સાચી સંપત્તિ ને સાચી કમાણી છે. તે વળી આ ધર્મ પામ્યા છીએ માટે સૂર્જે છે તો હવે એજ કરીએ.'

શ્રાવક ધન્યવાદ આપતા કહે છે. ધન્ય તમને ! મારાં કેવા અહોભાગ્ય કે આવા તમે જીવનસાથી મણ્યા.'

બસ, પંચમહાજન અને બીજા અર્થાંઓને બોલાવી શેઠ-શોઠાણીએ બધી સંપત્તિનો

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૨૮૧

પરમાર્થ કરી નાખ્યો. એ નિરાશાંસભાવે કર્યો, તેથી પુણ્યાનુંબંધી પુણ્યના થોકની કમાણી થઈ. એમાં ઉધારો નહિ. સુકૃત-દુષ્કૃત જે કરો એની તત્કાલ જ પુણ્ય કે પાપકમાણી ઊભી થઈ જ જાય; એમાં ઉધારે નહિ, વાયદો નહિ. રોકડાનો હાજરનો સોદો. કેવો હોય ? માલ સામે જ નાણાં,

શેઠ-શોઠાણી આખો દિવસ પરમાર્થ કરવાનું કામ પતાવી રાતે નિરાંતે ઊંઘા; કેમકે સાચી સુકૃતકમાણીની જબરી હુંફ આવી ગઈ.

તમે નિરાંતે ઊંઘો છે ? શાની હુંફ ઉપર ? હુંફ ન હોય, પણ ચિંતા હોય તો સુખે સુવાનું ન થાય. તો બોલો, સુખે સુખો છો ને ? કઈ હુંફ ઉપર ? કૂત્રિમ કમાણી ઉપર જ ને ? કમાણીની સંપત્તિની બાન્તિ ઉપર જ ને ? ભૂલશો નહિ, કે

જેમ માટીની સંપત્તિ એમ વિષયસુખો એ પૂર્વ કર્મના હિસાબ ચૂક્યે છે માટે એ સાચી કમાણી નહિ.

સુખમાં રાજુ એ ત્યાગમાં રાજુ નહિ :-

શું સુખ ભોગવ્યું એ કમાયા નહિ, ગમાયા. એટલા સુખનો કર્મનો હિસાબ ચૂક્યે થયો. એટલું પુણ્ય મૂડીમાંથી સરી પડ્યું. શું આપણે રાજુ રાજુ થઈ જવાનું ? જ્યાં સુધી આ રાજ્યો છે ત્યાંસુધી દાન અને ત્યાગનો રાજ્યો નહિ આવે. એ તો,

સુખને પુણ્યનો હિસાબ ચૂક્યે થયો સમજે એને ત્યાગનો ઉલ્લાસ આવે; ને તો જ ત્યાગની સંપત્તિ કમાઈ લેવાનું મન થાય, ને લેવાય. એ જ સાચી કમાણી.

દાન કરતાં મૂર્ચર્છા ત્યાગ ઊંઘો :-

શેઠ સાચી કમાણી કરી લીધી એની હુંફમાં નિરાંતે ઊંઘા. એટલું જ નહિ પણ એ પહેલાં ગયા ગુરુ પાસે. અને હવે વધુ પડતી સંપત્તિની આશા પણ ન રહે આશાના ત્યાગની સાચી કમાણી થાય એ માટે પરિગ્રહપરિમાણ પ્રત લઈ લીધું. કમાઈને દાનના સુકૃત કરતાં આ મૂર્ચર્છા સંકોચના વ્રતની મોટી કિમત છે. પેલામાં તો યથેચું કમાવાની વૃત્તિ એ મોહું પાપ છે. મળે એટલું લેવું બાકી રાખવું નહિ. 'લાખો થઈ ગયા, પણ હજુ મળે એમ છે ને ? ચાલો લેવા,' એ મોહું મૂર્ચર્છનું પાપ છે. પછી દાન કરે એ સુકૃત કમાઈ ખરી. પણ મહામૂર્ચર્છની પાપકમાઈ સાથેની. જ્યારે પહેલેથી મૂર્ચર્છા પર ભારે કાપ એ મોટી સુકૃતકમાઈ છે, માટે જ લાખોનું દાન કરનાર શ્રાવક કરતાં સાધુ ઊંચા છે, કેમકે એમણે સંદર્ભ મૂર્ચર્છા ત્યાગ કર્યો છે.

૨૮૨ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“ક્ષમા રાખીએ એમાં આપણું..” (ભાગ-૪૪)

પેલા શેઠ પરિગ્રહપરિમાણથી મૂર્છાત્યાગનું પ્રત લીધું. પછી એ ય સાચી કમાણીનું હુંફમાં નિરાંતે ઊધા પરંતુ સવારે જુએ છે તો ભંડાર ભેટી રીતે ભરાઈ ગયો છે, હવે શું કરવું ? હવે તો એ જંગી રકમ કરેલા પરિગ્રહપરિમાણની બહારની હતી, એટલે કાયદેસર રખાય નહિ, અને શેઠને ખપતી પણ નથી, તેથી બીજો વિચાર શાનો કરવાનો ? એ જ દિવસે એનો દાનમાં ફેસલો .

નવ દિવસ નવો ભંડાર, નવું દાન :-

એટલું બધું દાનમાં ઉધાળીને શેઠ-શેઠાણી ઓર ઝુશી થાય છે કે ‘વાહ ! આ પણ ઠીક પુણ્યાનુંધી પુણ્યનો થોક કમાવવાનો અવસર મળ્યો !’ વળી પાછો રાતના ગેબી રીતે ભંડાર ભરાઈ ગયો ! તો પછીના દિવસે એનો દાનમાં નિકાલ કરી નાખ્યો ! એમ નવ દિવસ ચાલ્યું, અને શેઠ-શેઠાણીને પુણ્યાનુંધી પુણ્યના અને દાનસંસ્કારના ગંજના ગંજ ખડકાયા, બંનેને આ સુફૂતસંપત્તિ ભરયક કમાઈ લેવાની મળી એનો પારાવાર આનંદ છે.

તમને આનંદ શાનો ? ભરયક માટીની સંપત્તિ (લક્ષ્મી) કમાઈ લીધાનો ? કે ભરયક સુફૂતોની સંપત્તિ કમાઈ લીધાનો ? કહેતા નહિ,

પ્ર.- પણ અમારી પાસે એવા પૈસા જ નથી ને ?

૩. છતાં જૈન શાસ્ત્રની ખૂબી છે કે બીજી રીતે સુફૂતસંપત્તિ કમાઈ શકો, ક્યા ક્યા સુફૂત કમાવા સુલભ ? :-

(૧) બોલો, નાનું પરિગ્રહ પરિણામવત કમાઈ લેવું છે ? એ સુફૂતસંપત્તિ છે ‘ના, એ તો કેમ બને ? કદાચ વધુ મળી જાય તો ?’ એમ કહો છો.

તો ચાલો લલાટ-પરિસ્થિતિ માપી જુઓ કેટલા વધુ મળે એમ લાગે છે ? એટલી રકમનું પરિમાણપ્રત લઈ લો. હજ ય જો પ્રત નથી લેતા તો સમજી રાખો કે હજ ય બીજી બે પાંચ કે ૨૫-૫૦ લાખ વધુ મળવાની આશાના દોરને લટકીને જગતમાં જે અબજો પરાધોની લક્ષ્મી છે એની અવિરતિનું ઘોર પાપ માથે ઊભું રાખી એ અવિરતિના નિમિત્તે પ્રતિસમય અઠળક પાપકર્મ બાંધી રહ્યા છો ! માટે પરિગ્રહપરિમાણપ્રતમાં આવી જાઓ, અને એ સાચી સંપત્તિની કમાણી પ્રતિસમય હસ્તગત કરતા ચાલો.

(૨) લો બીજી સુફૂતકમાઈ;-જેમની પાસે સારા પૈસા છે, એ જોઈને રાજ થવાનું રહેવા દો; મનને કહો, ‘રાજ થઈશ તો કોઈના દાન ઉપર, પણ સંપત્તિ ઉપર નહિ કે વાહ ! આની પાસે પૈસા સારા છે.’ આવી પાપ-અનુમોદના નહિ

કરવાની એ પાપાનુંમોદના કરવાનો ત્યાગ એ પણ એક મહાન સુફૂત કમાઈ છે. બોલો ખપે એ ? શાની ખપે ? સંપત્તિ જ જડ ધનની હોવાનું સમજાય છે, ત્યાગની નહિ; ત્યાં ‘અસ્ત્ર સંપત્તિની અનુમોદનાનો ત્યાગ એ મહાસંપત્તિ છે.’ એ શી રીતે સમજાય ? ને એ કમાઈ લેવાનું કરાય ?

(૩) લ્યો પૈસાની વાત છોડો; સાચી સંપત્તિ મૈત્રી ભાવનાની છે જેટલી વાર મનમાં જગતના જીવો પ્રત્યે અને વિશેષ વિરોધી પ્રત્યે મૈત્રીભાવના ભાવો, મનમાં લેશમાત્ર વૈર-વિરોધભાવ ન લાવો હૈયે જેટલો સ્નેહ પરિણામ ઉભરાવો, એટલી આ સંપત્તિ કમાણી થતી જાય. બોલો આ ખપે ? પછી સગાભાઈ સાથે કે બીજા સાથે અભોલા કર્યા હશે એ મૂકી દેવાના.

વગર પૈસે સુફૂતસંપત્તિ-સુફૂતકમાઈ જોઈએ તો આ મૈત્રીભાવ-મૈત્રીભાવનાની સંપત્તિ છે, કમાણી છે.

મૈત્રી ભાવ-ભાવના વચ્ચે ફરક :-

મૈત્રીભાવ એટલે હૈયામાં સામા પ્રત્યે સ્નેહનો ભાવ.

મૈત્રીભાવના એટલે ‘સામાનું ભલું થાઓ,’ એ શુભેચ્છા.

અનિશર્મા આ કરી રહ્યો છે, મશકરી કરનાર ગુણસેનને હવે ઓળખી લીધો છે, છતાં એના પર વૈરભાવ રાખ્યો નથી કે લાવતો નથી. તપવૈભવની કમાણીને મહાકમાણી માની એની ભારે હુંક ઉપર એમાં ગમે રીતે તે મૂળ નિમિત્ત બનનાર ગુણસેનને કલ્યાણમિત્ર માનતો એ શું કામ વૈરભાવ રાખે જ ?

બસ વાત આટલી છે કે ધન વગેરેની સંપત્તિ-વૈભવને સંપત્તિ-વૈભવ માનવાનું પડતું મૂકો અને ગુણો-સુફૂતો-સદ્ગુણભાવનાઓ જેમ જેમ કમાતા જવાય, તેમ તેમ એ સંપત્તિ વધી રહી છે, વૈભવ વધી રહ્યો છે, એ માનતા જાઓ.

લક્ષ્મીદેવીનું પુનઃ દર્શન :-

પેલો વિધાપતિ શેઠ, તિજોરીમાં નવ દિવસ સુધી ધન ભરાતું જાય છે, એને સાચી સંપત્તિરૂપ નહિ ગણતાં એનું સંપૂર્ણ દાન કરી રહ્યો છે એ દાનને સંપત્તિ તરીકે કમાણાનું માની રહ્યો છે. એનો આનંદ છે, પરંતુ નવમા દિવસની રાત્રીએ લક્ષ્મીદેવીએ સ્વખનમાં દર્શન દઈ કર્યું.

‘શેઠ ! તમે રોજનું રોજ ભલે બધું દાનમાં દઈ દો છો પરંતુ એમાં તો ઉચ્ચ ભરયક પુણ્ય ઊભું થઈ ગયું, ને એ પુણ્યથી હું તમને બંધાઈ ગઈ છું એટલે આ દાનની પૂર્વની તમારી ઘસાતા પુણ્યની જે સ્થિતિ પર મેં કહેલું કે હું દશમા દિવસે જવાની છું તે હવે સ્થિતિ બદલાઈ ગઈ, અતિ ઉગ્ર ભાવનાભર્યા દાનથી વર્તમાનમાં ફળે એવા ઉગ્ર પુણ્યવૈભવની સ્થિતિ ઊભી થઈ છે કે એનાથી બંધાઈ ગયેલી હું

હવે જઈ શકું એમ નથી.’ એમ કહીને લક્ષ્મી અંતર્ધાન થઈ ગઈ.

આ કહેવાનો શો અર્થ થયો ? એ જ કે શેઠ ગમે તેટલી દાનમાં લક્ષ્મી ઉરાડી દે તો ય નવી લક્ષ્મી હાજર જ રહેવાની.

પ્ર.- તો તો પછી અધિક દાનકમાણી વધતી રહેવાનો લાભ મળે એ સારું ને ?

ઉ.- ના, કેમકે એમાં દાન તો પછી પણ પહેલાં તો પરિગ્રહ પોતાના નિયમની બહાર ભરતો રહેવાનું નક્કી થયું ને ? ને દાનની કમાણી કરતા પ્રતપાલનની કમાણી એ મોટી કમાણી છે, એને ધક્કો લગાડીને પેલી દાનની નાની કમાઈને મહત્વ અપાય નહિ. એટલે ?

‘નિયમ બહાર પરિગ્રહ ભલે આવો, પછી એને હું દાનમાં દઈ દઈશ’ એવું હિંદુઓ નહિ, કરાય નહિ, કેમકે એમાં પહેલાં તો પ્રતભંગ જ વધાવી લિધો ! પણ

પ્રતભંગ વધાવવાના આલંબને ધર્મ કરાય નહિ, કે ધર્મના આલંબને પ્રતભંગ વધાવી લેવાય નહિ.

પ્રતપાલન એ મોટો ધર્મ; દાનાદિ સુકૃત એ નાનો ધર્મ છે.

અર્થાત્ ‘પરિગ્રહપરિમાણપ્રત ભાંગીને ભલે પરિગ્રહ આવો એટલે એનું સારું દાન કરીશ’ એવું કરાય નહિ. અથવા

‘દાન સુંદર થઈ શકે માટે પરિગ્રહપરિમાણપ્રત ભલે ભાંગીને પરિગ્રહ આવવા દઉં, એવું મનમાં ય લવાય નહિ.

કેમકે પ્રતપાલન એ મોટો ધર્મ છે. ને દાનાદિ સુકૃત એ નાનો ધર્મ છે. મોટા ધર્મના ભોગે નાનો ધર્મ કરવાનો હોય નહિ. માટે તો

સાધુ મહારાજ કેસર-મીઠાઈ ધી વગેરે અચિત દ્રવ્ય વહોરી લાવીને એનાથી પ્રભુભક્તિ કરતા નથી, પ્રભુ આગળ પૂજાર્થે ધરતા નથી; કેમકે એ એ માટે વહોરી લાવે એમાં પહેલાં તો પોતાનું પરિગ્રહત્વાગનું મહાપ્રત ભંગાય. વહોર્યું ત્યાંથી પ્રભુને ન ધરે ત્યાં સુધીમાં એ પોતાના પરિગ્રહદુપ થઈ ગયું એટલે, એમાં મહાપ્રત ભાંગ્યું ગણાય, ત્યાં પછી ભલે પ્રભુ ચરણે દાન કરે એ ધર્મ શાનો ? પ્રતના ભોગે ધર્મ હોય નહિ, પ્રતભંગનું આલંબન કરી દાનાદિ ધર્મ હોય નહિ.

એ જ રીતે ગૃહસ્થને ભલે સર્વેસર્વા પરિગ્રહત્વાગનું મહાપ્રત નથી, પરંતુ પરિગ્રહપરિમાણ કર્યું છે એ પ્રત તો છે જ. એનું ઉત્તંધન કરીને અધિક પરિગ્રહ લાવે તે દાનમાં દઈ ન હે ત્યાંસુધી તો એ પોતાનો પરિગ્રહ કહેવાય, ને એમાં એટલો સમય પ્રતભંગ થયો ગણાય. એના આલંબને એના ટેકે અર્થાત્ એ વધાવી લેવા ઉપર પછીથી દાન સુકૃત કરે એમાં ધર્મ કર્યો શાનો કહેવાય ?

આ ઉપરથી સમજ લેવા જેવું છે કે પરિગ્રહ પરિમાણપ્રત કરી લીધા પછી

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

ને એટલા પરિમાણનો પરિગ્રહ મળી ગયા પછી વેપાર ચાલુ રાખવો કેટલો વ્યાજબી છે ? કેમકે જ્યારે એ તો ખબર છે કે આ વેપારમાં કમાઈ થવાની છે, એટલે કમાઈ થતાં જ પરિગ્રહ વધવાનો. ત્યાં પેલું પરિગ્રહપરિમાણપ્રત કર્યાં સચ્ચવાવાનું ? ત્યાં જ પ્રત ભાંગ્યું, પછી અધિક પરિગ્રહનું દાન કરવા નીકળે એનો શો અર્થ ? ભૂલશો નહિ,

ધર્મ કરીને પણ પવિત્ર મનોવૃત્તિ જાળવવાની છે.

કહો, પવિત્ર મનોવૃત્તિ એ સાધ્ય છે, ધર્મપ્રવૃત્તિ એ સાધના છે.

‘ઉપવાસ કરું એટલે સારું પારણું મળે’ એ આશયથી ઉપવાસ કર્યો એમાં શું કર્યું ? સારા પારણાની મનોવૃત્તિએ અપવિત્ર મલિન મનોવૃત્તિ છે. એના માટે ઉપવાસ કર્યો એ ઉપવાસનો ધર્મ પવિત્ર મનોવૃત્તિનું સાધન ન બન્યો. માટે એને ધર્મ જ ન કહેવાય. ધર્મ તો મનને પવિત્ર પવિત્રતર બનાવવા માટે કરવાનો છે. ઉપવાસો કરતા રહીએ એટલે બહુ આહારસંજ્ઞાની મલિન મનોવૃત્તિ દબાતી આવે, ને તપની પવિત્રમનોવૃત્તિ ઊભી થતી જાય, વધતી જાય. આ માટે ઉપવાસ કરવાના, બહુ ખાઉં-પીઉં’ ની લત ધડે. પણ અહીં તો સારા પારણા માટે જ ઉપવાસ કર્યો એટલે ઉલટું, ઉપવાસ એ મનોવૃત્તિ બગાડવાનું સાધન બન્યો.

આમ ઉપવાસ એ સારો ધર્મ હોવાનું દેખાય, પણ સારા પારણા માટે કર્યો એમાં મનોવૃત્તિ બગડી; એ રીતે દાન એ સારો ધર્મ હોવાનું દેખાય, પરંતુ એ માટે પરિગ્રહપરિમાણપ્રત ભાંગનારા પરિગ્રહ-ગ્રહણની મનોવૃત્તિ થઈ એ ખોટી; એ મલિન અપવિત્ર મનોવૃત્તિ થઈ.

ધર્મ કરવા માટે કે ધર્મ કરીને મનોવૃત્તિ બગાડાય નહિ.

દાન માટે ચોરી, એમ પરિગ્રહ પ્રતભંગ ખરાબ :-

એમ તો દાન માટે ચોરી કરે એ શું પવિત્ર મનોવૃત્તિ છે ? ચોરી કરીને પૈસા લાવું એટલે સારું દાન થાય એમ ધારીને ચોરીથી પૈસા લાવે અને એ પૈસા દાનમાં દઈ હે, તો એવા દાન પાછળ જેમ મનોવૃત્તિ ખરાબ છે, એમ પ્રત ભાંગીને અધિક પરિગ્રહ લાવું એટલે દાન થાય’ એ દાનની પાછળ પણ મનોવૃત્તિ ખરાબ છે. મન બગડેલું છે. આ ‘ધર્મ કરવા માટે મનોવૃત્તિ બગડી’ નો દાખલો.

એમ ‘ધર્મવૃત્તિ બગાડાય’ નો દાખલો આ, કે ધર્મ કરે ભગવાનની પૂજાભક્તિ કે નવપદ ઓળી વગેરે કરે, પણ એના ફળમાં પૈસા જેવી હુન્યવી વસ્તુની આશા-આકાંક્ષા રાખો, ત્યાં એ ધર્મ કરવા પર જ ધનાદિની તૃષ્ણા વધી, એ મનોવૃત્તિ બગડી ધર્મ કરવા પર એમ ધર્મ કરીને પોતાની વડાઈ ગાતો રહે, દા.ત. ‘મેં આટલું દાન કર્યું,’ એમાં અભિમાન આવ્યું, માનાકાંક્ષા આવી, એ આ ધર્મ કરીને

૨૮૬ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“ક્ષમા રાખીએ એમાં આપણું..” (ભાગ-૪૪)

આવી; ને એ અભિમાન-માનાકંસામાં મનોવૃત્તિ બગડી.

મેલી મનોવૃત્તિ હોય ત્યાં ધર્મ-ધર્મપરિણાતિ નહિ.

માટે તો બ્રાહ્મી-સુંદરીના જીવ પૂર્વભવે પીઠ-મહાપીઠમુનિ કે જે ઉચ્ચ સંયમના પ્રભાવે મર્યાદા પછી અનુત્તરવિમાનમાં દેવ થવાના છે, એમણે બાહુ-સુબાહુમુનિથી કરાતી ભક્તિ-વૈયાવચ્ચ પર ગુરુએ એમની પ્રશંસા કરી તે સહન ન કરી, મનમાં દીર્ઘા આવી, માયા આવી, એ મનોવૃત્તિ મેલી થઈ. તેથી જ એ વખતે એમના દિલમાંથી ધર્મ-ધર્મપરિણાતિ ખસી ગઈ માટે જ ત્યાં સ્ત્રીવેદનું પાપકર્મ બાંધ્યું, સ્ત્રી-વેદકર્મ કર્યાં બંધાય ? ચોથા ‘સમ્યક્તવ’ના ગુણસ્થાનકે નહિ, તો પછી છઢા ગુણસ્થાનકે બંધાવવાની વાતેય શી ? એ તો હતા રજા ગુણસ્થાનકે બંધાય. એનો અર્થ એ, કે એ વખતે પીઠ-મહાપીઠે સંયમ અને સમ્યક્તવનો ધર્મ ગુમાવ્યો. વિચારજો મનોવૃત્તિ બગાડ્યાનું ફળ.

જોજો મલિન મનોવૃત્તિની કેવી જહંગીર શાહી કે જે સાધુપણાનાં કપડાં વ્રતો-ચર્ચાં ચાલુ છતાં અંતરમાંથી સંયમ-સમ્યક્તવની ધર્મપરિણાતિ ખત્મ કરી નાખે છે !

દાન માટે પણ વ્રતભંગ ચલાવી લેવામાં મનોદશા મલિન :-

આ ધર્મ કરવા સાથે મનોવૃત્તિ બગાડ્યાનો દાખલો.

એટલે (૧) ધર્મ કરવા માટે, યા (૨) ધર્મ કરવા પર, અથવા (૩) ધર્મ કરવાની સાથે મનોવૃત્તિ ન બગાડાય. એની પૂરેપૂરી તકેદારી જોઈએ. બસ, ધર્મ કરવાનો એટલે ધર્મની આગળ, પાછળ, કે ધર્મ કરવા વખતે શુદ્ધ ધર્મની જ લેશ્યા રહેવી જોઈએ. એને મલિન મનોદશાથી અભડાવાય નહિ; નિર્મળ મનોદશા જ અંડ જળવાવી જોઈએ.

પેલો વિદ્યાપતિ શેઠ આ વિચારી રહ્યો છે કે આ લક્ષ્મીદેવી કહે છે કે ‘હું તો તારા ઉદાર દાનના પુણ્યથી બંધાઈ ગઈ છું તેથી હવે જઈ શકું નહિ. તો એનો અર્થ એ, કે જેમ ગયા નવ દિવસ સુધી ધન આચ્યે ગયું અને દાનધર્મ કરતો ગયો તો પુણ્ય ખૂબ વધ્યું એમ હજુ પણ અહીં રહું તો એમજ સર્વદાન રોજ કરતો રહીને ધર્મ તો થાય એમ છે, પરંતુ રોજ ધન પહેલાં તો સ્વીકારાઈ જ જાય એમાં મારું પરિગ્રહપરિણામ-વ્રત ભાંગે ને એ ચલાવી-વધાવી લેવામાં મનોવૃત્તિ મલિન થઈ જાય. માટે હવે જયારે લક્ષ્મીદેવી નિશ્ચિત બંધાઈ ગયાનું કહે છે, તો પછી માટે અહીંથી ગય્યતી કર્યે જ છૂટકો, અહીં ખાલી પણ ભંડાર રાખીને રહું તો એમાં ધન ભરાય ને ? બસ, પહેરે લુગડે અહીંથી નીકળી જાઉં.’

કેટલી ઊંચી મનોદશા છે ! જેનશાસન સાથેના માનવભવની કેટલી બલિહારી

છે ! એની આપણાને કદર જોઈએ.

જો ઊંચી નિર્મળ મનોદશા જાળવીએ તો જેનશાસન સાથેના આ માનવભવની કદર કરી મૂલ્યાંકન કર્યું કહેવાય.

મનોદશા જો મલિન કરવી છે, તો જેનશાસનની શી કદર કરી ? એમ તો અભવી ય શાસનને અથડાઈ જાય, અરે ! ચારિત્ર પણ લઈ એવું ઊંચું પાળે કે એના પ્રતાપે નવગ્રેવેયકમાં જાય, પરંતુ મનોદશા મલિન, તેથી એઝો શાસનની શી કદર કરી ?

શાસનની કદર કેટલું સારું કરો છો એના પર નહિ, પણ કેટલા સારા બનો છો એના પર છે

સારા બનવા માટે મનોદશા-મનોવૃત્તિ પવિત્ર જોઈએ.

અંગ્રેજ માં કહે છે,-

To appear good is nothing, to do good is something to think good is better, but to be good is best.

અર્થાત સારા દેખાવું એની કશી કિંમત નથી, સારું કરવું-આચરવું એની કાંઈક કિંમત છે, સારું ચિંતવવું એ વધુ સારું છે. પરંતુ સારા થવું એ શ્રેષ્ઠ છે. સારા થવાનું સારી મનોદશા રાખવા પર આધારિત છે.

(૧) માત્ર ‘સારા દેખાવું’ એમાં તો સારું કરવાની કશી પડી નથી હોતી, પ્રાપંચ-ચાલાકી કરીને સારામાં ખપવાનો ધંધો છે. ત્યારે

(૨) ‘સારું કરવામાં’ આચરણથી સારો ખરો પરંતુ એ કરવાનું કોઈ મેલા આશયથી હોઈ શકે. ‘ફલાંશે પાંચ હજારનો ઓચ્છવ કરી શાબાશી લીધી, તો હું પંદર હજાર ખરચીને એવો જશ લાઉં, કે એ જાંખો જ પડી જાય.’ અને એ પ્રમાણે કરી બતાવે, ત્યાં સારું કર્યું ખરું પરંતુ અંદરની મનોદશા ખરાબ. એટલે એ સારું કરી છૂટ્યો ખરો, છતાં એ સારો નહિ.

(૩) ‘સારું ચિંતવનારો,’ એકલું સારું કરીને બેસી રહેનારો, પણ મનથી સારું ચિંતવનારો નહિ, એના કરતાં વધુ સારો છે, સારું ચિંતવનારો કદાચ સંયોગવશ સારું ન ય કરી શકે છતાં એ સારો છે.

(૪) ‘સારા થવામાં’ અંતરથી સારા થવું પડે છે. કેટલીકવાર એવું બને કે અંતર મલિન હોય, છતાં પાપના ભયથી ચિંતવન સારું કરતો હોય. દા.ત. ગુરુભક્તિ કરવી છે તેથી એના વિચાર કરતો રહેતો હોય કે ‘કેવી કેવી રીતે મારા ગુરુની ભક્તિ કરું.’ પરંતુ ગુરુભક્તિ કરવા સાથે કોઈક વાર ગુરુને સંભળાવતો યા મનથી માનતો હોય કે ‘આ તો હું છું તે આપનું આટલું સચ્ચવાય છે. બીજાનું આ ગજું

નહિ,' તો એમાં અંદરની મનોદશ મલિન ગણાય; એથી એ સારું ચિંતવવા છતાં સારો બનેલો ન ગણાય. એમ કહેતા નહિ, કે

પ્ર.- ગુરુની એટલી બધી ભક્તિ કરવા છતાં કેમ સારો નહિ ?

ઉ.- કારણ આ છે કે બહુ ગુરુભક્તિ કરીને પોતાના દિલમાં એમ માનવું, જોઈએ કે 'ગુરુ મારા બહુ ઉપકારી કે મારી આટલી સેવા જીલી મને સેવાનો લાભ લેવા દે છે. આ બીજા કોઈ નહિ પણ ગુરુ છે તો જ મને ગુરુસેવાનો લાભ મળે છે.' જ્યારે અહીં એમ માની-મનાવી રહ્યો છે કે 'હું ગુરુનું કરું હું' એનો અર્થ એ, કે 'આ સેવામાં ગુરુ મારું ભલું કરી રહ્યા છે' એમ નહિ, પણ 'ગુરુનું ભલું હું કરી રહ્યો હું !' ગુરુનો પાડ પોતાના માથે નથી લેવો, પણ ગુરુના માથે પોતાનો પાડ ચાડવવો છે. આમાં સેવાની બહુ ચિંતવના કરવા છતાં એટલે કે સારું ચિંતવવા છતાં એ દિલથી સારો બન્યો નથી.

દિલથી સારો એટલે નમ્ર લઘુતાવાલો, કૃતશ, પરાર્થવૃત્તિ, ગુણગ્રાહી, પરગુણપ્રમોદશાલી વગેરે.

એ અહીં ક્યાં છે ? 'ગુરુનું હું બજાવું હું' એમ માનવામાં પોતાના દિલમાં લઘુતા ક્યાં રહી ? પોતે સેવાકારક તરીકેના અભિમાનની ગુરુતા આવી. એમ કૃતજ્ઞતા ક્યાં ? ગુરુનો ઉપકાર પોતાના માથે લે, તો એની સામે પોતાની કૃતજ્ઞતાનો વિચાર આવે. એમ પોતાની વડાઈ મનમાં બેઠી છે ત્યાં ગુરુગુણપરગ્રમોદને સ્થાન જ ક્યાં !

પેલા વિદ્યાપતિશેઠની મનોદશ સારી છે, તેથી પરિગ્રહ પરિમાશપ્રત ભાંગવું નથી, પછી ભલે પોતે પરિગ્રહ મેળવવાનો પોતે કોઈ ધંધો ન કરતાં માત્ર પુણ્યયોગે કોઈ દેવમાયા કે ગેબી રીતે પરિગ્રહ આવે છે તે સ્વીકારીને એનાં મોટાં દાન થઈ શકે છે. પરિગ્રહને રાખીને મૂકવા નથી, દાનમાં જ દઈ દેવો છે, એટલે આમ સારાપણું દેખાય, પરંતુ પોતાના પરિગ્રહ પરિમાશપ્રતને, પહેલા તો પરિગ્રહને સ્વીકારી લેવામાં અંતરથી સારાપણું ન રહે, એમાં તો અંતર અર્થાત્ મનોવૃત્તિ મનોદશ મલિન થાય છે.

દાન ખુશીમાં છુપી પરિગ્રહ-ખુશી ખરાબ :-

વળી વિદ્યાપતિ શેઠ અને શેઠાણી એ પણ જુઓ છે કે 'આમ ચલાવી લેવામાં ને દાનને જ 'બહુ સારુ બહુ સારું' એમ જોવામાં, આપણે કાંઈ વીતરાગ નથી એટલે છૂંપું છૂંપું પૈસાના પરિગ્રહને સારો માનવાનું થાય. 'વાહ ! ઠીક પૈસા આવ્યા, દાનની ખુશીમાં છુપી પરિગ્રહખુશી ન નભાવાય.'

પૈસા-પરિગ્રહ તો ભયંકર જેર છે, કેમકે એની ખુશીમાં સ્વને ભૂલવાનું થાય.

દાન દેવું છે માટે એ ચલાવી લેવાય નહિ. આ જીવ સંસારમાં ભટકતો રહ્યો એમાં આ પણ એક કારણ છે કે પરિગ્રહમાં ખુશી માની બેઠો છે; ને ખુશી આકર્ષણ એ સંજ્ઞા છે, એથી પરિગ્રહસંજ્ઞા પોષાતી રહી છે.

પરિગ્રહ એ 'પર' વસ્તુ છે, એની ખુશીમાં સ્વ-સ્વકીય વસ્તુને ભૂલી જવાનું થાય છે, 'સ્વ' એટલે આત્માની પોતાની વસ્તુ ત્યાગ છે વૈરાગ્ય છે, અનાસક્રિત છે; પરિગ્રહને સહેજ સ્વીકારી લેવા જતાં યા દાન માટે પણ સારો માનવા જતાં એ અનાસક્રિત થવાય છે.

આપણે કાંઈ દાનની ધૂનમાં બિહામણા પરિગ્રહને સોહામણો માનવો મોખ નથી.

માટે ઊઠો અહીંથી આ 'છોડી પરગામ જ ચાલો.' વિદ્યાપતિ શેઠ અને શેઠાણી નવમા દિવસની રાત્રિના સ્વખ પછી પરિગ્રહપરિમાશપ્રતના ભંગથી બચવાનો વિચાર કરી દશમા દિવસે ધર છોડી પરગામ ચાલતા થઈ ગયા. પરંતુ કહે છે ને કે નસીબ બે ડગલાં આગળ ચાલે છે ? તે એ જે નગરના પાસે પહોંચવાના છે તેનો રાજા અચાનક અપુત્રિયો મરી ગયો છે. તે, મંત્રીઓએ નવો રાજા બનાવવા ભાગ્યશાળીની શોધ માટે શાશ્વતારેલી સાંદળી કાઢી છે. સાંદળીને આખા નગરમાં કોઈ પસંદ ન આવ્યો મંત્રીઓને ચિંતા થઈ છે કે 'શું કોઈ યોગ્ય ભાગ્યવાન નહિ જરૂર ?'

એટલામાં પેલા શેઠ-શેઠાણી એ નગરની બહાર પહોંચી વીસામો લેતા બેઠા છે. ત્યાં સાંદળી નગરની બહાર નીકળી બરાબર આ શેઠ પાસે આવી એમના મસ્તક પર કલશ ઢોળે છે, અને સુંદરી ચામર વીજે છે, લોકોએ ભારે જ્ય જ્ય નાદ પોકાર્યો; અને શેઠનું નામ પૂછી લઈ 'વિદ્યાપતિ મહારાજાકી જ્ય હો જ્ય હો' નો નાદ ગગનમાં પસર્યો.

શેઠની હવે શી સ્થિતિ થઈ ? શેઠની જગાએ બીજો કોઈ હોય તો એને તો મનમાં ગિલગિલિયાં ભારે થાય કે 'વાહ ! આવી લોટરી લાગી ગઈ ? હેં મોટું રાજ્ય જ મળી ગયું ?' એમ હુરખનો પાર ન હોય સંસારના રસિયા જીવને મફતમાં મોટી રાજ્યસંપત્તિ મળી રાજા બનવાનું મળતું હોય એમાં તો રાજીનો રેઝ થઈ જ્ય ત્યારે અહીં શેઠ ગભરાઈ ગયા કે 'હાય ! પરિગ્રહપ્રત બચાવી લેવાનું અહીં ક્યાં રહેશે ?' આ તો ધરના બદ્ધા વનમાં ગયા, તો વનમાં લાગી આગ' જેવું થયું. નાની પરિગ્રહ બલાથી ધૂટવા ધર છોડ્યું તો અહીં મહાપરિગ્રહની બલા કોટે વળ્યે છે ! શું કરવું ?'

શેઠને ભારે ગભરામણ એ પણ છે કે 'જો રાજા થવાનો ઈનકાર કરું તો

હજ રાજનું મહદું પડી રહ્યું હશે, નવો રાજા ન જાહેર થાય ત્યાં સુધી એ મહદું કાઢે નહિ, અને નવો રાજા મંત્રીઓ હવે પાછા ક્યાં શોધવા જશે અને શી રીતે તરતમાં મળશે ?

આમ શેઠને બે ગભરામણ થઈ; ત્યાં લાગશે કે,

પ્ર.- પોતાને પરિચહેરત ભંગ ન થાય એ જોવાનું ને ? રાજા કોણ થશે અની ચિંતા શા માટે ?

કૃ.- એનું કારણ આ છે કે રાજ્યની ચિંતામાં પ્રજાના રક્ષણની ચિંતા છે. કેમકે કોઈ દુશ્મન રાજને નથી ને જો ખબર પડી કે આ રાજ્ય રાજ્યવિહોણું છે. તો એ લશ્કર લઈ ચડી આવે, ને અહીં એક હુકમકારક રાજા વિના વેરવિભેર જેવું થઈ જવાથી સામો વ્યવસ્થિત હલ્લો થાય નહિ, ને દુશ્મન સેના લૂંટફાટ ચલાવે તો પ્રજા ભારે સંકટમાં મૂક્ખાઈ જાય. આ વિચારથી શેઠ ચિંતામાં પડ્યા ગભરાઈ ગયા છે.

પરંતુ શેઠે જે નવ દિવસ રોજને રોજ ભરાયેલા ભંડાર આખાનું રોજ ને રોજ જે દાન કરેલ છે એનાથી એક બાજુ તો ઉત્ત્ર પુણ્ય વધી ગયું છે. તે બીજી બાજુ પોતાની ધર્મશ્રદ્ધા વધી ગઈ છે. પોતાને ધર્મશ્રદ્ધા તો હતી જ માટે દાન દેતા હતા, પરંતુ એમ દાનથી શ્રદ્ધાને સહીય કરવા જતાં અમલી કરવા જતાં શ્રદ્ધાને વેગ વધી રહ્યો હતો. સામાન્યથી આ નિયમ છે,-

શ્રદ્ધાને કિયાથી અમલી કરતાં કરતાં શ્રદ્ધા વધુ સતેજ બનતી જાય.

દા.ત. વ્યવહારમાં કોઈ વેપારી પર શ્રદ્ધા છે કે આ પ્રામાણિક છે, પછી એની પાસેથી માલ લેતો જાય અને એમાં પ્રામાણિકતા દેખાતી જાય, તેમ તેમ એ વેપારી પર શ્રદ્ધા વધે છે. એમ જો શ્રદ્ધા છે કે ભૂખ કરતાં ઓછું ખાવાથી અને હલું ભોજન લેવાથી તબીયત બહાલ રહે છે, અને પછી એ પ્રમાણે અમલ કરતો ચાલે ને સુંદર સ્વાસ્થ્યનો અનુભવ કરતો જાય, તો એની એ શ્રદ્ધા વધતી જાય છે.

એવી રીતે જો તપધર્મની શ્રદ્ધા છે કે

જીવનમાં તપ એ ચિત્ત સમાધિ પ્રેરક અને મહા કલ્યાણકારી છે.

અને પછી તપ કરી કરીને એ શ્રદ્ધાને અમલી બનાવતો જાય, તો તપધર્મ પરની શ્રદ્ધા ઓર વધે છે, આ વસ્તુ અનુભવની છે, અનુભવગમ્ય છે. અનુભવ ન કરે એને તો કાં એમ થાય કે ‘તપથી ભૂખે મરીએ એમાં વળી ચિત્તને સમાધિ-પ્રસન્તા મળતી હશે?’ અથવા એમ થાય કે ‘બાઈ ! જ્ઞાનીઓએ કહ્યું તો છે, એટલે એમાં શંકા ન થાય, પણ આપણને અનુભવ નથી થતો, ‘અરે ભલા આદમી ! અનુભવનો પ્રયત્ન કરવો નથી તો અનુભવ ક્યાંથી થાય ? બાકી નિષ્ઠાથી તપ કરનારાનાં જીવન જો, કે

ભુવનભાનુ અન્સાઈકલોપીયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

એમના ચિત્ત કેવી સુંદર સમાધિ અને પ્રસન્તા અનુભવે છે !

આ જ વાત છે, -

શ્રદ્ધા પ્રમાણે અમલ કરતા જાઓ તો અનુભવ થવા માંડશે અને શ્રદ્ધા વધતી જશે.

દાનધર્મ પર શ્રદ્ધા છે કે જીવનને પરિગ્રહ કે એનો ઉપભોગ અજવાળનાર નથી, પરંતુ પરિચહેનું દાન અજવાળનાર છે, અને પછી એ શ્રદ્ધાનો અમલ કરવારૂપે દાન કરતા રહેવાય, તો દાનધર્મની શ્રદ્ધા વધુ વિકસવર બને છે.

વિદ્યાપતિ શેઠને દાનધર્મની શ્રદ્ધા આમ અમલથી વધુ જોરદાર બની છે, તેમજ આજે દાનમાં ભંડાર આખો ખાલી કર્યો છતાં બીજે દિવસે ભંડાર ભરેલો જોતાં પુણ્ય ખૂબ વધી ગયાની કલ્યાણ પર પણ એ પુણ્યના કારણભૂત દાનધર્મની શ્રદ્ધા જોરદાર છે.

આમ શેઠને પુણ્ય અને ધર્મશ્રદ્ધા ખૂબ વધી ગયા હોવાથી, અત્યારે થતી ગભરામણ એ પુણ્ય અને શ્રદ્ધાના પ્રભાવે શાની લાંબી ટકે ? ગભરામણ તો આમ ગઈ, કેમકે ત્યાં આકાશવાણી થઈ કે,-

‘શેઠ ! રાજ્યગાદી પર રાજા તરીકે ભગવાન શ્રી જિનેશ્વર દેવની પ્રતિમાનો રાજ્યાભિપેક કરી દો.

બસ, શેઠને માર્ગ જડી ગયો, તરત પોતે ત્યાં સાંઢળી પર જઈ જિનપ્રતિમાનો રાજા તરીકે રાજ્યાભિપેક કરાવે છે. પછી રોજ રાજદરબારમાં રાજ્ય સિંહસન પર પ્રતિમાને બિરાજમાન કરી પોતે એમના મંત્રી તરીકે કામ કરે છે. એટલે પછી મનથી એમ સમજે છે કે ‘અહીં હું રાજા જ નથી એટલે રાજ્યભાજાનો એ કાંઈ મારો પરિગ્રહ નથી, મારી એના પર કશી માલિકી જ નહિ, તેથી મારું પ્રત અકંધં રહેશે,’ એમ સંતોષ માને છે.

શાના પર આ ? આ શેઠના હૈયે જૈનશાસન વસ્તુ છે તેથી પરિગ્રહ પરિમાણવતને સાચી સંપત્તિ લેખી પ્રત પાલનને સાચી કમાણી સમજે છે, અને હૈયે એના પર એવી હુંક છે કે એની સામે ભરેલા ભંડારને કે મોટા રાજ્યને પણ જતું કરવામાં લેશ પણ કચવાટ નથી, ઊલટું હૈયે ધરપત છે.

હૈયે જૈન શાસન વસ્તુ હોય તો સુકૃત કમાઈને જ સાચી સંપત્તિ મનાય અને એના પર ભારે હુંક રહે. આ હુંકથી દુન્યવી અનુકૂળતાની કમીમાં હુંઘન લાગે.

‘હું તપની કમાઈ, દાન-સુકૃતોની કમાઈ, ક્ષમાદિની કમાઈ, એને સાચી સંપત્તિ માનું છું’ એમ બોલવું સહેલું છે. પરંતુ એ હૈયે ખરેખર સંપત્તિ તરીકે વસી

૨૮૨ સુવનભાનુ અન્સાઈકલોપીયા-“ક્ષમા રાખીએ એમાં આપણું..” (ભાગ-૪૪)

ગયું છે એની ખાતરી આ, કે એની એવી હુંફ રહે કે એની હ્યાતીમાં દુન્યવી બીજી કમીનામાં કમી ન દેખાય, બીજી અનુકૂળતા ઓછી હોય એનું બહુ દુઃખ ન લાગે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૨૫, અંક-૪૨, તા. ૧૬-૭-૧૯૭૭

બોલો, વાતવાતમાં અરતિ-ઘેદ-ઉદ્ઘેગ-સંતાપ થાય છે ને ? ‘આ માણું જરા ગરમી પડવા માંડી.’ ‘હાય ! મોંઘવારી વધી,’ ‘અરેરે ! કપદું ફાટ્યું. આ કપડાં મેલાં થયાં,’ બાબો હજી બહારથી આવ્યો નહિ ! ‘શેઠ કેવો ? જરા જરામાં તપે છે !’ ‘ફલાણાને ત્યાં ગયા, પણ માળે બરાબર આદર ન કર્યો !....આવા આવા કેઈ સંતાપ ચાલે છે ને ? કેમ ચાલે છે ! હૈયે હુંફ આ બધી વાતની અનુકૂળતાની છે, આ બધું બરાબર વ્યવસ્થિત હોય તો હૈયામાં શાન્તિ રહે છે. ક્યારે ય હૈયાને શાન્તિ સાચી આત્મસંપત્તિ કમાયાની નથી કેળવી. ‘ચાલો, દેવાધિદેવ પરમાત્માનાં દર્શન-સ્મરણ સારાં થયાં ફિકર નહિ.’ જીવનમાં આટલાં પ્રત-નિયમ થયાં છે, ચિંતા નહિ.’ આટલી પ્રભુભક્તિ થઈ સાધુસેવા થઈ, સાધર્મિક ઉદ્ધર થયા,... આટલું ધર્મ ખાતે ખરચી સુકૃતલાભ મળ્યો....સારું થયું આટલું કમાયા ?’ આવી આવી આત્મસંપત્તિ કમાયા, સારો લાભ મળ્યો એની હૈયામાં હુંફ નથી એટલે દુન્યવી તુચ્છ બાબતોના ઘેદ-સંતાપ હૈયાને બાધ્યા કરે છે.

હૈયે હુંફ કોઈ ત્યાગ કમાયાની. કોઈ તપસંપત્તિ કમાયાની, કોઈ ક્ષમા સમતા કમાયાની જ હોય, તો નાશવંત દુન્યવી અનુકૂળતા ઓછી મળી એનો સંતાપ શાનો થયા કરે ? એ શાનું મન પર આવ્યા કરે ? પરંતુ,

જડમુખી દષ્ટિ આત્મસંપત્તિ સાધવા છતાં એને બહુ લેખામાં નથી આવવા દેતી.

જેમ લોભી વેપારી બધું રૂપિયા-આના-પાઈમાં માપે એમ જડમુખી દષ્ટિવાળો બધું જડની અનુકૂળતામાં માપે છે. પેલાને કશું કોઈનું કરવાનું આવે, તો એ જ જોવાનું મન થાય કે ‘આમાં આપણાને કશો પૈસાનો લાભ ખરો ?’ એમ આ જડમુખો જીવ પણ એ જ જોયા કરે છે કે, આપણાને દુન્યવી અનુકૂળતા રહે છે ખરી ? દુન્યવી પ્રતિકૂળતા ટળે છે ?’ મોટું સંવત્સરી પ્રતિકમણ કરવા ગયો તો એ નહિ જુએ કે ‘પાસે બેસીને બધું બરાબર સંભળાય છે ?’ ‘એ તો એ જોયા કરશે કે ‘દૂર બારી પાસે પવન સારો આવે છે ને ? માટે ત્યાં બેસું.’ બિમારી આવી કે બીજું કોઈ કારણ આવ્યું તો મનને આ ખુશી ધરશે કે ‘ચાલો આજે ચૌદશે તપથી બચ્યા, છૂટે મોઢે ખાશું.’ આમાં છે કોઈ તપસંપત્તિની હુંફ ? ના,

ભુવનભાનુ અન્સાઈકલોપીયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો”(ભાગ-૪૪)

સારું ખાઈ શકાશે એની હુંફ લાગે છે. કેવી દુર્દીશા આવા ઊંચા માનવ અવતારે ! આવા સારા શ્રાવકજીવનમાં કે સાધુજીવનમાં કેવી દુર્દીશા !

તપને સંપત્તિ જ ન લેખાય. કમાવાની વસ્તુ જ ન દેખાય, એ શું અહીં દુર્દીશા નથી ?

કરોડો માણસોને જે આ શાસન નથી મળ્યું એથી જ બિચારાને તપ એ સાચી કમાણી સાચી સંપત્તિ સમજવાનું નથી મળ્યું, એ તને શાસનની રૂએ સમજવાનું મળ્યું એની કદર નથી ? તે તપ ગુમાવી ખા-ખા કરવાનું મળવા પર ખુશી થાય છે, હુંફ રહે છે ? આ કેવી દુઃખ દુર્દીશા ! તપ સંપત્તિ જ ન માને, પછી એ સારી કમાઈ લેવાની તાલાવેલી જ ક્યાંથી હોય ? જડમુખાને બધી જડની અનુકૂળતાઓ મળ્યાની કિંમત એટલે એ જ કમાઈ લેવાની તાલાવેલી. ‘અલ્યા પણ આ તપસંપત્તિ-દાનસુકૃતસંપત્તિ કમાઈ લેવાની હોંશ અહીં નહિ રાખે, તો પણી ક્યાં ભેસના ભવમાં એ કમાઈ લેવાની હોંશ રાખીશ ? અરે ત્યાં કમાવવાની હોંશ ક્યાં ? આ તપસુકૃત વગેરેને સંપત્તિ માનવાની સમજ પણ નહિ હોય.

પેલા વિદ્યાપતિ શેઠને પોતાનું પરિગ્રહક્રત જેમ જેમ બરાબર પળાતું જાય, મોટા પરિગ્રહ પાપથી જેટલું બચાતું જવાય, એટલી સાચી કમાઈ થતી દેખાય છે; માટે હોંશ-હુંફ એ વ્રતની છે, એ મહાપરિગ્રહત્યાગની છે. એટલે હવે ઘરના ભંડાર છોડી નીકળી જાય છે, એમાં નિરાંત અનુભવે છે, ‘હાશ ! બલા ટળી’ એમ છુટકારાની ખુશી અનુભવે છે. પરંતુ હવે તો પાછું મોટી રાજ્યસંપત્તિની બલા માથે આવી એટલે મુંજાય છે. અપુત્રિયો રાજ મરી ગયેલો, તેથી નવો રાજ પસંદ કરવા મંત્રીઓએ સાંઢણી કાઢેલી ને ? તે એણે શેઠના ઉપર કળશ ઢોળ્યો. એટલે રાજપણું માથે આવ્યું. પછી ત્યાં ખજાને ધન કેટલું ? અઢળક ! એની હુંફ આવે ? કે ગભરામણ ?

બોલો તમને આ ધન-સંપત્તિ મળી નથી કે મળવાની પણ નથી, છતાં ‘કરોડોનું ધન’ એવું સાંભળવા મળતાં હૈયે કેવું સંવેદન થાય છે ? હુંફનું કે ગભરામણનું ? ‘અહાહા ! કેટલું બધું સરસ અઢળક ધન !’ એવું મનને થાય ? કે ‘અરરર ! કેટલો મોટો નરકદાયી ભાર !’ એમ ગભરામણ થાય ?

આભદ્રમંત્રી મોટો વિજ્ય કરીને આવી એમાં પ્રામ થયેલ અઢળક મિલક્ત રાજ કુમારપાળને ચરણે ધરે છે ત્યારે રાજ એ મંત્રીને કોડ યા લાખોની સંપત્તિ ભેટ કરે છે. પરંતુ આભડ એ લઈને ઘર તરફ જતાં રસ્તામાં યાચકો માગવા આવે છે, તો ઘરે પહોંચતા પહેલા બધું જ દાનમાં દઈ છે. જો હૈયે એ વિપુલ સંપત્તિની હુંફ હોય તો બધું તો શું, પણ અડધું ય શું, ચોથા ભાગનું ય તરતમાં ને તરતમાં

૨૮૪ ભુવનભાનુ અન્સાઈકલોપીયા-“ક્ષમા રાખીએ એમાં આપણું..” (ભાગ-૪૪)

દાનમાં જાય છે ? કેમ નહિ ? એની હૈયે ભારે હુંફ રહે. ત્યારે

આભડને એ સંપત્તિની ગભરામણ છે, ને દાનસંપત્તિની હૈયે ભારે હુંફ છે.

તે અવસર મળ્યો તો બધું લુંટાવીને મોટી દાન સંપત્તિ મોટી જૈનધર્મ પ્રભાવનાની સંપત્તિ કમાઈ લેવાની ભારે હોંશ ! લોકો જૈનધર્મની વાહવાહ કરે ને, કે ‘વાહ ! આ લોકોનો કેવો સરસ જૈન ધર્મ કે આ ઉદારતા, આ દયા, આ દાન શીખવે છે !’ આ ધર્મની વાહ વાહ એ શાસનપ્રભાવના, એમાં હુંફ એને સાચી સંપત્તિ માની એ કમાઈ લેવાની હોંશ, તે એ કમાઈ લેવા માટે બધું લુંટાઈ દેવામાં લેશ પણ સંકોચ નથી !

આ બધું સાંભળીને તમને શું મનમાં એમ થાય છે ખરું કે ‘આપણો આવો ધન્ય દિવસ ક્યારે આવે !’ ભલે ને બનવાનું નથી, પણ આટલા કોડ પણ ન થાય ? કોડ પણ થાય, તો પેલાની સુકૃતની ભારે અનુમોદના થવા સાથે જાતને માટે એવા સુકૃતની માન્યતા આવે અને શુભ ભાવના થાય, એમાં પણ સાચી સંપત્તિની કમાણી છે.

મહાપુરુષોનાં સુકૃતો વખાણી આપણા જીવનમાં લાવવાના કોડ, એ પણ સુકૃતનાં બીજનું વાવેતર છે, બીજ પર અંકુર છે.

‘બીજ સત્ત્રણંસાદિ, તચ્ચિન્તાદ્યકુર સમુદ્ગ્રામः’

કોઈ પણ ગુણ કે સુકૃતનું બીજ એની સમ્યક્ પ્રશંસા આકર્ષણ છે; અને એના પર ‘એ કેમ મળે !’ એવી ચિન્તા-અભિલાષા કોડ થાય એ એ બીજમાંથી અંકુર ઝૂટ્યો ગણાય.

એટલું સમજી રાખજો કે તમારા તો ભાગ્યની અવધિ નથી કે જૈન ધર્મ મળ્યાથી માત્ર તમને આવા મહાપુરુષોનો ઈતિહાસ મળ્યો છે જેમનાં અવ્યલ અવ્યલ સુકૃતો છે. એ મળ્યા પણી શું તમને એની પ્રશંસા મૌંદી પડે છે ? તો શું એના કોડ મૌંદા પડે છે ? ભલે આપણે ભગવાનમહાવીરપ્રભુએ સંગમ દેવતાના જે ધોર ઉપસર્ગ-ત્રાસ અનુભવ્યા તે ન અનુભવી શકીએ પરંતુ એની પ્રશંસા કરવામાં ખમવું પડે ? તો શું ‘મને ક્યારે આવું સહવાનું ખમવાનું મળે !’ એવો કોડ કરવામાં ય ખમવું પડે છે ? પરંતુ ખાટલે મોટી ખોડ, આવા ઉપસર્ગ સહનને સંપત્તિ માનવાનો પાયો જ નથી. એટલે જ સહન કરવાનું ન હોય, એ કમાઈ લાગે છે.

પેલા શેઠને રાજ્યસંપત્તિ મળ્યાની હોંશ નહિ, હુંફ નહિ, પણ ગભરામણ છે કે ‘હાય ! આ બલા આવી, તો મારા પ્રતાનું શું ?’ ત્યાં જ આકાશવાણીથી જિનમૂર્તિનો રાજ્યગાઢી પર અભિષેક કરવાનો આદેશ મળતાં ખુશી થયો, ને એ

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

પ્રમાણે કર્યું. હવે રાજ કોણ ? જિનેશ્વર ભગવાન. તો પોતે શું ? પોતે એના મંત્રી.

મંત્રીગારી બજાવતાં વિદ્યાપતિશેઠ પોતાના પ્રતને એવું સુંદર સાચબ્યું કે ‘રખેને ખજાનામાંથી એક પૈસો પણ મારી માલિકી તરીકેનો ન લેવાઈ જાય, ન ખરચાઈ જાય !’ બસ, આ એક પ્રતને પણ મજબુતાઈથી પકડી રાખ્યું, પ્રલોભનોને પાર કરીને પકડી રાખ્યું, તો એ પાંચમા હવે મોક્ષે ગયો. આ એક સમજવા જેવું છે કે

એકાદ પણ ધર્મને ધર્મ સાધનાને મજબુત પકડી રાખો, તો એમાંથી ય મહાન ઉત્ત્રતિ સધારો.

પેલા ભલાભોળા છોકરાની, જુઓ, એમજ ઉત્ત્રતિ થાય છે, એના કારણમાં માતાએ શીખબ્યું ‘વડીલ જનની સેવા કરતો રહેજે તારું કલ્યાણ થશે.’ તો એ સૂત્ર એણે પકડી રાખ્યું એટલે હવે જુઓ એની કેવી ઉત્ત્રતિ થાય છે !

છોકરો બિચારો ભલો ભોળો. જાજી સમજ નહિ. સમજવાની શક્તિ નહિ. એટલે માતાએ જોયું કે જીવનમાં શાસ્ત્રોની સમજપૂર્વક વિશેષ હિત સાધી શકાય એવું આ સાધી શકશે નહિ, તેથી એને આ બહુ સામાન્ય શક્તિથી સમજ શકાય એવું વડીલજનની સેવા કરવાનું આ, કરી શકશે, ને એથી એનું ભલું થશે. તેથી માતાએ પુત્રને આ શીખવેલું.

જોજો વડીલજનની સેવા કરવાનું બહુ સામાન્ય બુદ્ધિથી પણ સમજ શકાય એવું છે, પરંતુ એથી કાંઈ વડીલજનની સેવા એ બહુ સામાન્ય સાધના નથી. ‘જ્યવીયરાય સૂત્રમાં’ એને ‘ગુરુજણ પુઆ’ અર્થાત્ ગુરુજનની પૂજા તરીકે એક લોકિક સૌદર્ય કહ્યું છે. અને એ સધાય તો જ લોકોત્તર સૌદર્યના અધિકારી બની શકાય, એમ એના વિવરણમાં મહર્ષિએ સ્પષ્ટતા કરી છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૨૫, અંક-૪૩, તા. ૨૩-૭-૧૯૭૭

‘લોકિક સૌદર્ય’ એટલે સર્વસામાન્ય લોકોએ માન્ય કરેલ ધર્મ એ આવ્યા વિના લોકોત્તર સૌદર્યની અર્થાત્ જિનશાસન-માન્ય ધર્મની પ્રાપ્તિ થઈ શકે નહિ એવો શાસ્ત્રકારોનો આશય છે. મોટો ચારિત્રધર્મ લેવો હોય તો ય પહેલાં ગુરુજન પૂજા અર્થાત્ વડીલજનની સેવા કરતા રહેયું જોઈએ; અને નાનો ધર્મ દેવદર્શન જેવો પણ કરવો હોય તો પણ આ ગુરુજન પૂજા પહેલી હોવી જોઈએ. આનું કારણ પૂછો.

૨૮૬ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“ક્ષમા રાખીએ એમાં આપણું..” (ભાગ-૪૪)

ચારિત્ર કે દેવદર્શનમાં ય ગુરુજન પૂજા કેમ જરૂરી ? :-

ચારિત્રજીવનમાં તો ગુરુ સેવા સર્વેસર્વ આરાધવાની છે, અલબત્ત બીજી સંયમ-સાધુચર્ચા-તપસ્યા શાસ્ત્રસ્વાધ્યાય વગેરે આરાધના ખરી, પરંતુ ગુરુસેવા એ એકડો છે; ગુરુસેવા એ પાયો છે, મૂળ છે, એના પર જ બીજી આરાધનાઓની ઈમારત ટકે, આરાધનારૂપી વૃક્ષ લીલુછમ રહે. ગુરુસેવા એ રત્ન ભાજન છે. એમાં આરાધનાઓ અને ગુણોરૂપ રત્નો ભરાય.

ગુરુસેવાને શું સમજો છો ?

અભણ અને અલ્યશક્તિવાળાને ય ગુરુસેવા તારણહાર છે. માટે જ એ ખૂબ ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે આ સમજે એને ‘ચારિત્ર લેવાનું છે તે ગુરુસેવા માટે,’ એ હાડોહાડ લાગી જાય. માત્ર નહિ ભણેલા માટે કે ભણવાની ઓછી શક્તિવાળા માટે જ નહિ, કિન્તુ ભણવાની સારી શક્તિવાળા માટે પણ હૈયે આ લખાઈ ગયું હોય કે મેં આ ચારિત્ર લીધું કે લેવું છે તે ગુરુની સેવા માટે. જીવનમાં ત્રાજ સેવ્ય છે, આરાધ છે, દેવ ગુરુ અને ધર્મ. ત્રાજની સેવા કરવા માટે જ આ જીવન છે. જેટલી જેટલી એ સેવા કરતી જાય એટલી એટલી જીવ્યાની સફળતા.

મનુષ્યપણે શા માટે જીવવું છે ?

તો કે શુદ્ધ દેવ-ગુરુ-ધર્મની સેવા માટે

એટલે જીવતાં જીવતાં શોધતાં જ રહીએ કે ‘મને દેવ-ગુરુ-ધર્મની સેવા કર્યાં મળે છે !’ અને જ્યાં જ્યાં એનો મોકો દેખાય ત્યાં ત્યાં એ સેવા કરતાં રહીએ તે ય કાયાથી ન મળે તો વચ્ચનથી. વચ્ચનથી ન મળે તો ય મનથી સેવા કરતા રહેવાનું. વારંવાર મનને થાય કે

આ જનમ દેવસેવા ગુરુસેવા અને ધર્મસેવા માટે જ છે.

વચ્ચનથી સેવા કેવી રીતે ?

આ રીતે, કે કામ સંસારનું ચાલતું હોય, પરંતુ એ વખતે દેવાધિદેવની કે ગુરુની યા ધર્મની પ્રશંસા કરીએ; કામનો, કામની સફળતાનો જશ એમને આપીએ; એમના ઉપકારની પ્રશંસા કરીએ.

મનથી સેવા શી રીતે ?

મનથી સેવા આ રીતે કે ધાર્મિક કાર્ય વખતે તો મન એમાં જ હોય, પરંતુ સાંસારિક કાર્ય વખતે ય મનમાં એની સાથે દેવ-ગુરુ-ધર્મની કોઈને કોઈ કરી જોઈએ; અને એ પ્રમાણે દેવ ગુરુ કે ધર્મને મહત્વ મળે એ રીતનો વિચાર કરીએ. દા.ત. સાંસારિક કામ કોઈ મોહમાયાનું કામ છે, તો ત્યાં વિચારીએ.

‘કેવી મારી કમનસીબી કે આ જનમ દેવ-ગુરુ-ધર્મની સેવા માટે, પણ મારે

ભુવનભાનુ અન્સાઈકલોપીયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

એ મૂકી આ પાપની વેઠ કરવી પડે છે !’ અથવા

‘પ્રભુએ પાપ કરવાની ના પાડી છે, ને મારે પાપ કરવા પડે છે, એ આ ભવની કેવી વિટંબણા !’ અથવા

સાંસારિક મોહમાયાની પ્રવૃત્તિ વખતે મનને એમ થાય કે

‘મારા સાચા સગાં દેવ ગુરુ અને ધર્મજિનો છે. છતાં આ મારી કેવી ઘેલછા કે એ મૂકી મારે કામચલાઉ અને સ્વાર્થભર્ય હુન્યવી માણસોને મારાં સગાં કરવા પડે છે ! જીવ ! જોજે આમાં વિશ્વાસ ન મૂકીશ યા આમનાથી હુંઝ-આશાસન ન લઈશ કે ‘ચાલો નિરાંત થઈ સારા સગા મળી આવ્યા.’

‘અંતરસે ન્યારો રહે, જિમ ધાવ ખેલાવત બાળ,’

સાંસારિક સગાને સંભાળતા પૂર્વ પુરુષોની આ દાણિ હતી. વર્તમાનમાં વિવેકી પુરુષોની આ દાણિ છે, એટલે તો જ્યાં કદાચ એવા નિકટના અને ઉપયોગી સગાનું મૃત્યુ થયું, તો એમને હૈયે કશો શોક વિખવાએ નથી થતો. એને પહેલેથી જ અંતરથી ન્યારો ગણતા. દેવ-ગુરુ-ધર્મ-ધર્મને જ અંતરથી સાચા સગા ગણતા. હુન્યવી સગા માટે તો એક ગ્રાહિત મહેમાન જેવી દાણિ. એટલે એનો વિયોગ થતાં મનને થાય કે

‘આવ્યો હતો કોઈ પરુણલો, એના અવસરે ચાલ્યો જાય’

‘એમાં રોવાનું શું ? પોતાનું કશુ ગુમાવાઈ ગયું, એવું માનવાનું શાનું ?’ આ મનને પાડી સમજ રહેતી.

સીતાજીની વનમાં મૂકાતાં ભાવના :-

સીતાજીની, ખરેખરા, મહાસતી છતાં, અસતી તરીકેની અપકીર્તિ થઈ અને વનમાં હકાલપદ્ધી થઈ ત્યારે એમણે મનમાં નક્કી કરી લીધું કે ‘શું પતિ કે શું દિયેર વગેરે હુન્યવી સગા, એ મારા તો પરજન, સ્વજન નહિ; સ્વજન તો મારા દેવ-ગુરુ-ધર્મ. માટે અવસર આવ્યે આ કલંક ઊતરી જતાં હુન્યવી સગાને પડતા મૂકી મારે મારા સગા દેવ-ગુરુ-ધર્મમાં ભળી જવાનું, સંસાર છોડી ચારિત્ર લઈ લેવાનું.

સાંસારિક પ્રવૃત્તિ વખતે આવા ને આવા કોઈ વિચાર દેવ-ગુરુ-ધર્મના લાવવાના, જેથી એ વખતે પણ દેવ-ગુરુ-ધર્મ ની મનથી સેવા થતી રહે.

વાત આ છે કે,

માનવભવમાં જીવવાનું દેવ-ગુરુ-ધર્મની સેવા માટે છે.

તેથી જ્યાં ને ત્યાં એક યા બીજા પ્રકારે એ સેવા કરતી રહે. હવે જો જીવન આખાનું આ લક્ષ્ય છે, તો સાધુજીવનાનું તો આ લક્ષ્ય તો બરાબર સાખૂનું જ રહેવું જોઈએ ને ? એટલે પછી ચારિત્ર લેવાનું અને પાળવાનું તે ગુરુની સેવા

૨૮૮ ભુવનભાનુ અન્સાઈકલોપીયા-“ક્ષમા રાખીએ એમાં આપણું..” (ભાગ-૪૪)

માટે એ વાતમાં પ્રશ્ન જ શાનો રહે ? મનમાં એવું આવે જ શાનું કે ‘મારે તે જ્ઞાનાભ્યાસ કરી આગળ વધવાનું કે ગુરુની સેવા કરતો બેસી રહેવાનું ?’ મનમાં આવું આવતું હોય એ શાથી ?’

પ્ર.- ગુરુસેવાને મુકી જ્ઞાનાભ્યાસ કરવાનું મન કેમ થાય છે ?

ઉ.- એટલા માટે કે માથે ગુરુ કર્યા છે તે ગુરુને સેવવા માટે નહિ, પણ ગુરુ જ્ઞાનાભ્યાસ વગેરેની સગવડ કરી આપે એટલા માટે. એને ખબર નથી. કે આ આર્થમાનજીવન દેવ-ગુરુની અખંડ સેવા માટે છે, સાંસારિક જીવનમાં દેવ-ગુરુધર્મને ચોવિસે કલાસ સેવવાનું નથી બની શક્તું, તે સાધુજીવનમાં સારુ બની શકે; એટલા માટે તો ચારિત્ર ગ્રહણ અને ચારિત્રપાલન છે, તો પછી સાધુ થયા એટલે મુખ્ય લક્ષ્ય આ સેવાનું જ હોય ને ? એમાં ય સાધુ અંકિયન-અપરિગ્રહી એટલે એમને ગૃહસ્થની જેમ મૂર્તિસ્વરૂપ મળતા દેવાધિદેવની દ્વયથી સેવા નહિ; ને ભાવથી સેવા અર્થાત ચૈત્યવંદન છે, તે અમુક સમય જ હોય. પરંતુ ગુરુ તો જીવંત છે, સાક્ષાત્ છે, એટલે એમનું સાંનિધ્ય ચોવિસે કલાક રહે છે. તેથી એમની સેવા ચોવિસે કલાક મળી શકે છે. ચારિત્ર-જીવન જ્યારે અખંડ સેવાને માટે જ છે, તો એ સેવામાં અખંડપણે સજાગ રહેવું જોઈએ, જેમ દેવાધિદેવ આરાધ્ય, એમ ગુરુ આરાધ્ય છે.

‘અહોમાર્ય આપણાં કે આ ભવમાં આવા દેવ આવા ગુરુ મળ્યા ! એ મળ્યા તે સેવવા માટે મળ્યા છે.

- આ લક્ષ ચોવિસે કલાક જાગતું રહે, તો પછી ગુરુસેવાનો લાભ ઉઠાવવા કેટકેટલો તલસાટ રહે ? કેટકેટલી જાગૃતિ રહે ? જેમ જેમ સેવા કરાતી રહે તેમ તેમ જીવન કૃતકૃત્ય થતું દેખાય, અને એ કૃતકૃત્યતા પર, એ સફળતા થવા પર આનંદ આનંદ હોય. જુઓ આમાં પછી ખૂબી છે કે, આમાં ગુરુ પાસેથી બદલો લેવાનું મન ન થાય, હક ન કરાય કે ‘મેં ગુરુનું આટલું કર્યું, તો ગુરુ મારું કેમ ન કરે ? જે લોકો ગુરુસેવા નથી કરતા. એમના ગુરુ પક્ષપાત કેમ કરે છે ? મારી કદર ન કરતાં કેમ એમનું વધુ સાચવે છે ?...’ આવી આવી ગુરુ પાસેથી બદલાની અભિલાષા અને ગુરુ બીજાનું વધારે સાચવે એની ફરિયાદ ન કરાય. કારણ સ્પષ્ટ છે, -

જ્યારે ગુરુસેવા પોતાના જીવન લક્ષ્ય તરીકે સાધી રહ્યો છે, ત્યારે આ લક્ષ્યસિદ્ધિની કર્માંદ થઈ જ ગઈ; પછી ગુરુ તરફથી ગુરુ પાસેથી બદલાની કે પોતાના પર પક્ષપાતની અપેક્ષા જ ન હોય.

ગુરુસેવા ગુરુને ત્યાં જ્ઞાન નથી કરાવાતી :-

જો આ અપેક્ષા રહે છે તો એનો અર્થ એ, કે પોતે ગુરુને સેવીને ગુરુને ત્યાં પોતાનું કાંઈક જ્ઞાન કરાવી રહ્યો સમજે છે, નોકર શેઠની સેવા કરે છે એ સેવા જ્ઞાન કરાવવાની સમજથી કરી રહ્યો છે. તેથી મહિને પગારના બદલાની આશા રાખે છે. પરંતુ અહીં ગુરુસેવા જો જીવનનું એક લક્ષ્ય સમજીને અર્થાત્ એક સંપત્તિ કર્માવાની સમજીને કરી રહ્યો છે, તો જીવનમાં આટલી કર્માઈ સિદ્ધ થઈ. એનો અર્થ એ, કે ગુરુસેવામાં પોતાના ખાતે જ્ઞાન કર્યું. ગુરુ ખાતે નહિ. પછી ગુરુ પાસેથી બદલો માગવાનો શેનો હોય ?

વ્યવહારમાં શું કરો છો ? કોઈને ત્યાં રૂપિયા જ્ઞાન કરાવે, તો તો એની પાસેથી વળતે સમયે એની પાસેથી માગવાને હક ગણો છો; પણ પોતાની પાસે જ રાખ્યા હોય તો સામા પાસેથી માગવાનો હક નહિ. એવી રીતે જો અહીં ગુરુસેવા કરી, એ ગુરુને ત્યાં જ્ઞાન કરાવતા હો તો તો ગુરુ પાસેથી વળતે સમયે સેવા માગવાનો હક રહે. પરંતુ જેમ પેલા રૂપિયા આશામીને ત્યાં નહિ, પણ પોતાને ત્યાં જ રાખ્યા હોય તો આશામી પાસેથી માગવાનો હક ન રહે, એમ અહીં આપણો ગુરુસેવા કરી એ જો આપણા જ સુકૃત તરીકે, આપણો ત્યાં મૂકી તરીકે રાખી, તો પછી ગુરુ પાસેથી એનો બદલો માગવાનો હક શાનો રહે ?

પ્રભુભક્તિ જો સુકૃતસંપત્તિ, તો અહીં બદલો ન મંગાય :-

આવું જ પ્રભુભક્તિમાં છે. પ્રભુની ભક્તિ જો આપણી એક સુકૃતસંપત્તિ તરીકે રાખી, તો પછી પ્રભુ પાસે એવું માગવાનો હક નથી રહેતો કે ‘પ્રભુ ! મેં તારી આટલી ભક્તિ કરી છે, તો એના બદલામાં મને પૈસા આપજે, પુત્ર આપજે, રોગ નિવારણ આપજે...’ ઈત્યાદિ માગવાનો હક નહિ; અને જો એવું માગ્યોએ છીએ તો ત્યાં આપણો સમજવું જોઈએ કે ‘આપણે પ્રભુભક્તિ કરીને આપણી સુકૃતસંપત્તિ ઊભી નથી કરતા, પરંતુ જેમ પૂજારી પ્રભુની પેઢીમાં પોતાની સેવા જ્ઞાન કરાવે ને એના બદલામાં પગાર માગે, એ જ રીતે આપણે પણ પૂજારીની જેમ પ્રભુને ત્યાં આપણી પૂજા જ્ઞાન કરાવીએ છીએ ! એટલે જેમ પૂજારી પ્રભુની પૂજા કરે એ કાંઈ ધર્મ નથી કરતો, એમ પૂજાનો બદલો માગનાર આપણે પ્રભુની પૂજા કરીએ એ કશો ધર્મ નથી કરતા. જેમ પૂજારીને પ્રભુપૂજા કરવા છતાં પરભવની કશી પુણ્ય-મૂકી નથી ઊભી થતી, એમ આપણને પણ એવી પૂજાથી કોઈ પુણ્યની મૂકી નથી ઊભી થતી’ એવી આપણને સમજ થવી જોઈએ, જેથી દિલને ધક્કો લાગી, એ ભક્તિનું વેચાણ બંધ થાય. વાત આ છે, -

ધર્મ કરો એમાં જાતની સુકૃતસંપત્તિ-પુણ્યમૂકી ઊભી કરે, પણ એને અહીં વટાવવાનું કે બીજા પર અહેસાન ઊભું ન કરો.

સુકૃતસંપત્તિ વધારવાનો ઉદેશ રાગાદિ દુષ્કૃતનાશ :-

કોઈ પૂછે ‘ધર્મ કેમ કરો છો ?’ તો કહેવાનું ‘મારી સુકૃતસંપત્તિ વધારવા,’ પણ એમ નહિ કહેવાનું કે ‘ભગવાન મને અહીં કે ભવાંતરે સારું આપે. એટલા માટે ધર્મ કરું છું,’ ત્યારે પૂછો,-

પ્ર.- સુકૃતસંપત્તિ વધારીને ય પરભવે સુખ જ જોઈએ છે ને ?

૩.- સુકૃતસંપત્તિ વધારવાનો ઉદેશ પરભવે સુખ ખરીદવાનો નથી, પરંતુ આત્મામાંથી દુષ્કૃતરાગ અને દુષ્કૃતકચરા ઓછા કરવાનો અને સરવાળે સુકૃત સંપત્તિની પરાકાખાએ પહોંચી, સર્વથા દુષ્કૃતરહિત અર્થાત् રાગાદિરહિત વીતરાગ બનવાનો છે.

આ ઉદેશ ગંભીરતાથી વિચારવાનો છે. જેથી એના જીવનમાં કરાતી સુકૃતકરણી પર અસર પડે.

ધર્મ શા માટે કરીએ ? સુકૃતસંપત્તિ વધારી દુષ્કૃતકચરા ઓછા કરવા ધર્મ કરીએ.

તપ વગેરેના ઉદેશ કયા કયા ? :-

તપ કરીએ એ તપસંપત્તિ વધારી ખાનપાનના રાગરૂપી દુષ્કૃતકચરાને ઓછા કરવા, ખાનપાનના રાગને કાપવા.

દાન કરીએ એ લક્ષ્મીના રાગ દુષ્કૃત ને ઓદ્ધં કરવા માટે.

દાનમાં સુપાત્રભક્તિ કરીએ એ સુપાત્ર મુનિના સંયમને ટેકો આપવા, અને સંયમની અનુમોદનાનું સુકૃત વધારી અસંયમ-ધરવાસ-પાપરથાનકસેવાના રાગદુષ્કૃતને કાપવા માટે કરીએ.

અનુંદ્પાદાન કરીએ એમાં દ્યાની સંપત્તિ વધારતાં જીવહિસા આરંભ સમારંભના રાગ દુષ્કૃતને કાપવાનું કરીએ.

જિનવાણીશ્રવણ કરીએ શાસ્ત્ર ભણીએ એ શાન કરવા માટે. શાન ન ચેતે તો પણ એ શા માટે કરીએ ? કહો,-

શાસ્ત્રપઠન કે બીજો કોઈ ધર્મ પણ કરીએ એ જિનાશાપાલન રૂપી સંપત્તિ વધારવા કરીએ, ને એ કરતાં મિથ્યાશાસ્ત્રના આચાર કે યથેચ્છાચારના દુષ્કૃત કાપવા માટે કરીએ.

શું ? શાસ્ત્રગાથા જેમ જેમ ગોખતા જઈએ કે શાસ્ત્ર જેમ જેમ વાંચતા જઈએ, તેમ તેમ કદાચ એ મોઢે ન ચડ્યું તો પણ મનને તો થાય કે ‘ચાલો, આટલું આટલું જિનાશાપાલન કમાતા જવાય છે !’ આ પણ સુકૃતસંપત્તિ છે.

બોલો, આમાં ક્યાં ક્યાંય સુકૃતસંપત્તિ વધારવાનું પરલોકના સુખ માટે આવ્યું ? ના, દુષ્કૃતકચરા સાફ કરવા માટે આવ્યું. ને એમ કરતાં કરતાં સર્વથા ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો : ધૂટવાનો મોકો”(ભાગ-૪૪) ૩૦૧

દુષ્કૃત અટકીને વીતરાગ દશા આવે. એટલે હવે વિચારવા જેવું છે કે ‘એમ ધર્મ કરવાનો ડેકો લઈને ફરીએ, ત્યાં આ સુકૃતસંપત્તિ વધારવા અને દુષ્કૃત ઓછા કરવાનો ઉદેશ છે ?

વાત આ હતી કે પેલી માતાએ ભલાભોળા પુત્રને શિખામણ આપી કે ‘મોટાની સેવા કરતો રહેજે, કલ્યાણ થશે.’ એમાં સેવા કરીને મોટા પાસેથી કશો બદલો નથી જોઈતો. પરંતુ કલ્યાણ સંપત્તિ વધારવી છે. છોકરો એ રીતે બાપની સેવા કરે છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૨૫, અંક-૪૪, તા. ૩૦-૭-૧૯૭૭

હવે એક વાર એવું બન્યું કે કાંઈક કામ પડતાં બાપ ગામનાં મુખી પાસે જાય છે, છોકરો પણ સાથે છે, ત્યાં એણે જોયું કે બાપ જઈને પહેલાં તો મુખીને પ્રણામ કરે છે, એ પરથી એણે કલ્યાણ કરી કે ‘મારા બાપ કરતાં આ મોટા માણસ લાગે છે, માટે જ બાપાજી આને નમસ્કાર કરે છે. માતાએ મને શીખવી રાયાંયું છે કે મોટાની સેવા કરવી, તો હવે મારે આ મોટા મુખીની સેવા કરવી જોઈએ.’ તેથી એ માત-પિતાને પૂછી મુખીની સેવામાં લાગી ગયો., આમાં મુખી મને કાંક પગાર આપશે, બદલો આપશે, એવી એને કોઈ અપેક્ષા નથી. માત્ર એક હિસાબ છે ‘જીવનમાં મોટાની સેવાથી કલ્યાણ થાય, માટે સેવા જ કરતા જ રહેવાનું.’ આ હિસાબ પર મોટા મુખીની પણ સેવા કરી કશું ખાટવાની ઈચ્છા કે આશા શાની ? ત્યારે એને ઘર કેવું મળ્યું હશે ? માતા પિતા જીવતા સારું સારું પહેરવા-ઓફવાની કે સારા પેસા ભેગા કરી સંઘરી રાખવાની કિંમત નહિ આંકતા હોય ત્યારે જ આ છોકરાને પણ એવી લત નહિ હોય ને ? એની કિંમત નહિ હોય ને ? માટે કહો,

સારાં ખાનપાન-ઠઠારા-માલમિલકતની બહુ કિંમત ન આંકવાનું જોવા મળે, તો સંતાન પણ એની કિંમત ન આંકે; ને એથી ઉપરની સેવા-સદ્ગુણ-સદાચારની કિંમત આંકે,

ઘરના વાતાવરણની મોટી અસર પડે છે. માબાપ જો ખાવકલા, તો છોકરાં પણ ખાવાની કિંમત આંકવાના. માબાપ જો પેસા જ ગણ-ગણ કરનારા, કે ઠઠારા જ કરનારા, તો સંતાન પણ પેસાનું યા ઠઠારાનું જ મહત્વ આંકનારા બનવાના. એના બદલે જો માબાપ ત્યાગી તપ્સ્વી, દાન શોધતા ફરનારા ને દેતા રહેનારા, યા સાદાઈ જ પસંદ કરનારા, તો છોકરા-છોકરીમાં એ વારસો ઉત્તરવાનો. અલબત્ત

૩૦૨ ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“ક્ષમા રાખીએ એમાં આપણું..” (ભાગ-૪૪)

એમને બહાર અસતુ સમાગમ ન રહે એ ધ્યાન રાખવું જોઈએ. બાકી માબાપે આ પરથી સમજવા જેવું છે કે ‘સંતાનના હિત માટે પણ આપણે જાતે ખૂબ સંયમ રાખી ત્યાગી-તપસ્વી-દાની અને સાંહું જીવન ગાળનારા બનવું જોઈએ.

આજે જુઓ માબાપ રાતના અગિયાર-બાર વાગ્યા સુધી વાતો-કૂથલી કરતા બેસે છે, તો છોકરા છોકરી પણ એ જ શીખે છે. પછી માબાપ તો માથે જવાબદારીના હિસાબે ભલેને વહેલા ઉઠે. પણ છોકરા મોડા ઉઠનારા હોય છે, ત્યારે

મોડા સૂર્ધ મોડા ઉઠવાનાં નુકસાન કેવા ભયંકર !

વાતોચીતોમાં બાધ્યભાવ પોષણ :-

(૧) વાતોચીતો-ગાધ્યાસાધ્યા લગાવતા બેસવું એ નર્યો બાધ્યભાવ છે. એમાં આત્માનું અને અધ્યાત્મભાવનું સરાસર વિસ્મરણ છે, ભલે કદાચ એ પ્રભુભક્તિ કે પ્રતિકમણ યા જાપ કરીને વાતોચીતો કરવા બેસતો હોય, પણ ત્યાં બાધ્યભાવ આવવાથી અને જીવને અનાદિનો એનો રસ હોવાથી, ત્યાં આત્માનું સરાસર વિસ્મરણ થવાનું. પેલી ધર્મસાધનાની અસર ઉડી જવાની. પછી ત્યાં પ્રભુભક્તિ આદિમાં જે રસ નહિ, એવો આ વાતોચીતોમાં ભારે રસ આવવાનો. વાતો-ચીતો-ગામગપાટા મારી મોડા સૂવામાં કેવું ભયંકર નુકસાન !

મોડા ઉઠવામાં પ્રભુ સાથે તાર બાંધવાનું ગુમાવાય :-

(૨) બીજું નુકસાન એ, છે કે મોડો ઉઠે એટલે પરોઢિયે બ્રાહ્મમુહૂર્તમાં પરમાત્મા સાથે તાર બાંધવાનો જે સોનેરી અવસર, તે ગુમાવાનું થાય. આ પણ કેવું ભયંકર નુકસાન ? માંડ મળેલ આ માનવ અવતારમાં જ જે આ અવસર તે ગુમાવી દેવાય, એનો પછી આરોવારો ક્યાં ? ઉદ્ધાર શી રીતે થાય ?

આજે જણા-જણાની ફરિયાદ છે કે ‘અમને ધર્મમાં રસ નથી આવતો; પરમાત્મા પર દિલ નથી ઉછળી પડતું.’ પરંતુ જો પરોઢિયે પ્રભુની સાથે તાર ન મિલાવતા હોય, ધર્મની ઉચ્ચ ભાવનાઓ ન કરતી હોય, ત્યાં પ્રભુ પર દિલ શાનું ઉછળી પડે ? ધર્મમાં રસ શી રીતે આવે ? પરોઢિયાના સમયે શીતલ વાતાવરણ હોય છે, તેથી પરોઢિયે મન કોમળ રહે છે; એટલે જ પ્રભુની સાથે મનને સહેલાઈથી જોડી શકાય છે.

તે સૂર્યોદય થઈ ગયો, સૂર્યના તાપથી વાતાવરણ ગરમ થવા માંડયું પછી એમાં પ્રભુ સાથે ગમે તેટલું દિલ મેળવવા મથો, કે ધર્મભાવનાઓ કરવા મથો, પણ પરોઢ જેવો રસ નહિ આવે, પરોઢ જેવી દિલની ગદ્ગદતાથી દિલના તાર ઝાંઝાણવા સાથે પ્રભુ સાથે જાણે સાક્ષાત્ વાતચીત કે શુભ ભાવના નહિ થાય.

ઉલટું, પ્રભુ સાથે હેયાના તાર જોડવાના. પરોઢ જેવા કોમળ સમયે ઉંઘતા રહેવાથી કે હુન્યવી જળોજથામાં પડવાથી આત્મા સુસ્ત અને જડનો અનુરાગી બને છે. પછીથી એ મોઢેથી દેરાસર જાય તો ય સુસ્તિથી જવાનો, ઉપલદ્ધિયા દિલથી જવાનો. વહેલા પરોઢિયે જાગીને પ્રભુની સાથે તાર બાંધી દિલને ભક્તિભાવિત કર્યું નથી, પછી મોઢેથી એ મંદિરે કેવું દિલ લઈને જવાનો ?

ભક્તિથી દિલને ભાવિત કરો :-

ભૂલશો નહિ, દિલને સારાભાવથી ભાવિત કરવું પડે છે. દિલમાં એક વાર સારો ભાવ લાવ્યા એટલે માત્રથી દિલ કાંઈ ભાવિત ન થાય. ‘ભાવિત’ એટલે વાસિત, રંગાયેલું દાતણ કે રૂમાલ કસ્તૂરીથી વાસિત કરવે થાય છે ? આખી રાત કસ્તૂરીના ડાબડામાં મૂકી રખાયું હોય ત્યારે. કસ્તૂરીના નજીક ખાલી એકવાર લઈ ગયાથી વાસિત ન થાય. એમ અહીં દિલને સારા ભાવથી ભાવિત કરવા માટે દિલમાં એનો વારંવારનો અભ્યાસ જોઈએ. તે પણ ભાવ હૃદયસ્પર્શી જોઈએ. તો જ એની દિલ પર ભાવના લાગે. આ હૃદયસ્પર્શી પ્રભુભક્તિનો ભાવ જગાવવા પરોઢિયાનું શાંત અને શીતલ વાતાવરણ સુયોગ સુસમર્થ છે. તેમાં ય દિવસો શું, મહિનાના મહિનાઓ પ્રભુભક્તિનો શુભ ભાવ કર્યે ગયા હોઈએ ત્યારે દિલ અનેનથી ભાવિત થાય. પરંતુ રાતના મોડે સુધી ગામગપાટા મારવા હોય ને મોડા સૂર્ધ મોડા ઉઠવું હોય એ વહેલી પરોઢે આ ક્યાંથી કરવા પામે ? માબાપ જો એવા મોડા સુધી વાતોચીતો કરી મોડા સુનારા હોય તો છોકરા છોકરી એ જ શીખે ને ? માબાપ અને મોટા વરેરાઓથી જેવું ઘરનું વાતાવરણ, તેવી દીકરા-દીકરી પર અસર પડે, ને તેવા તેવા ભાવોથી એ ભાવિત થવાના.

પૂર્વકણાં જીવન કેમ ઉચ્ચ્ય ? :-

પૂર્વના કાળે સારા ઘરોમાં આ રાતના મોડે સુધી રદ્દી વાતો કરવાનું નહિએતું. તેથી પરોઢિયે વહેલા ઉડી જતા અને ભગવદ્ભક્તિ-સ્મરણ કરતા. તો દિલ અનેનથી સારા ભાવિત થતાં; એટલે પછી મંદિરમાં સારા ભાવોલ્લાસ અને ધર્મની કિયાઓમાં ધર્મનો રસ રહેતો એથી જીવન પણ બહુ ધંધલ-ધમાલ વિનાના ઉચ્ચ શાન્ત અને પવિત્ર ચાલતાં. જેવા માબાપનાં, તેવા સંતાનનાં; કેમકે ધરમાં વાતાવરણ જ એવાં.

છોકરો રાજાની પાસે :-

પેલા છોકરાને પણ ધરમાં વાતાવરણ સારું, તેથી એનું જીવન વિનયવાણું. માતાએ કહ્યું ‘મોટાની સેવા કરતો રહે, કલ્યાણ થશે, તો એ શિખામણ વિનયથી માની લઈ પહેલાં પિતાની ને હવે મુખીની સેવામાં લાગી ગયો છે. એમાં એકવાર

મૂખીને શહેરમાં રાજાની પાસે જવાનું થયું. છોકરો મૂખીની સેવામાં છે એટલે સાથે ગયો.

મોટાનીસેવા શેનું નામ ?

મોટા બહાર જાય છે તો સાથે જવું જોઈએ, જેથી મોટાનું બહાર ગૌરવ દેખાય, આબરૂ વધે.

સેવા એટલે શું માત્ર પગચૂપી ? સેવા એટલે શું મોટાનું માત્ર કામ કરી આપવું ?

ના, એમની આબરૂ વધે, યશ વધે, બહારમાં ગૌરવ દેખાય, એવું કરીએ, મોટાની પ્રશંસા કરીએ, એ બધું ય મોટાની સેવા છે. મોટાના દિલને શાતા આપીએ, એમની ચિંતા ઓછી કરીએ, એમના દિલના સંતાપ ટાળીએ, એ બધું ય મોટાની સેવા છે.

બોલો, મોટાની આવી સેવા કરો છો ? સંતાનને આવી સેવા સમજાવો છો ? સમજાવવી હોય તો પહેલાં પોતે અમલ કરી બતાવવો જોઈએ. નાનાઓ કેટલું તો આપણી પ્રવૃત્તિ જોઈને શીખે છે. સારા કુળવાન ઘરોના બાળક એવા સેવાકારી વિનયવાળા....વગેરે શી રીતે થયેલા દેખાય છે ? આ જ રીતે, કે એ ઘરમાં બીજાઓને મોટાની એવી સેવા વિનય વગેરે કરતા દેખે છે માટે. તેથી પહેલાં તો જાતે સેવા વિનય આદિ કરતા રહેવું જોઈએ. પછી સંતાનને થોડી ઓછી સૂજ પડતી હોય ત્યાં સેવાનો ભાવ, સેવાના પ્રકાર અને એના લાભ સમજાવવા જોઈએ. સંતાનને ખવરાવી-પીવરાવવી મોટા કર્યા, ભણાવ્યા-કરાવ્યા એટલેથી બસ નથી, પણ એને વડીલોની સેવા ખાસ સમજાવી જોઈએ.

સેવા-વિનયાદિ વિનાનું જીવન એ અનાર્ય જીવન પશુજીવન છે.

આજે ભારતમાં ઝડપથી પાશ્વાત્ય પદ્ધતિનું જીવન કેમ આવ્યું ? બચ્ચાને શિક્ષણમાંથી માતપિતા વગેરેનો વિનય સેવા આદિનું શિક્ષણ બંધ કરવામાં આવ્યું તેથી. આજે બતાવો શિક્ષણના પુસ્તકમાં, આના પાઠ છે ? માસ્તરો પાઠ વિના પણ આ શીખવે છે ખરા ? ત્યારે જ્યાં પાયાના ગુણ વિનય સેવા વગેરે ન શીખવાય, પછી બિજુ ગમે તેટલું શિખવવામાં આવે એથી આર્ય માનવતા ક્યાંથી વિકસે ?

પેલો છોકરો મૂખીની સાથે ઢાકોર રાજ પાસે ગયો છે. ત્યાં જુએ છે કે મૂખી રાજને જુકીને પ્રણામ કરે છે. તેથી એને લાગ્યું કે મૂખી કરતાં આ રાજ મોટા છે. તેથી એને લાગ્યું કે ‘મૂખી કરતાં આ રાજ મોટા છે.’ તો મારે, માતાએ મોટાની સેવા કરવાનું કહ્યું છે એ હિસાબે, આ રાજાની સેવામાં રહેવું જોઈએ, ‘એમ

વિચારીને મૂખીને એ વાત સમજાવી રાજાની સેવામાં રહેવાની રજા માગે છે.

મૂખી તાહો માણસ છે એટલે જુએ છે કે ‘જ્યારે આની માતાએ પોતાની સેવામાંથી મુક્ત કરી આને મારી સેવામાં આટલા જ માટે રહેવા દીધો છે કે આ મોટાની સેવા કરે; તો પછી હવે આને મારાથી મોટા રાજાની સેવા કરવી છે તો મારે પણ આને મારી સેવામાંથી મુક્ત કરવો જોઈએ;’ એ હિસાબે છોકરાને રાજાની સેવામાં રહેવાની ખુશીથી રજા આપે છે.

ઉહાપણ કોનું નામ ?

પાછળવાળાએ શુભ ઈરાદાથી ભોગ આપીને પણ જે વિવેકભર્યું કામ કર્યું છે, એવું આપણે કરીએ, એ ઉહાપણનું કામ છે.

માતાએ પોતાની સેવાનો ભોગ આપીને છોકરાને શુભ ઈરાદાથી મૂખીની સેવામાં રહેવાની રજા આપવાનું વિવેકભર્યું કામ કર્યું છે, તા મારે પણ આને રાજાની સેવામાં રહેવા દેવાની રજા આપવી જોઈએ.

ત્યારે જુઓ, આ સૂત્ર, આ હિસાબ, કેટલો ઉપયોગી છે ! દાન-પરોપકાર, ત્યાગ-તપસ્યા, શીલ-સંયમ વગેરે કરવાની વાત આવે ત્યારે મનને આંચકો લાગે છે ? તો આ વિચારો કે ‘પૂર્વ પુરુષો અને વર્તમાનના કેટલા સારા માણસોએ શું કર્યું છે ? આ જ, કે ભોગ આપીને પણ શુભ ઈરાદાથી આ દાન-પરોપકાર વગેરેના વિવેકભર્યા કામ કર્યા છે, તો પછી આપણે, પણ એ કાર્ય કરવા જોઈએ, કરીએ એમાં ઉહાપણ છે, પૂર્વ પુરુષોનો એ દાન, એ ત્યાગ, એ શીલ-સંયમ કરવામાં (૧) કાંઈ અશુભ ઈરાદો નહોતો, તેમ (૨) એ કરવામાં એમણે ભોગ ઓછો નથી. આખ્યો, (૩) એ કામ વિવેકભર્યું નહિ એવું ય નથી. તો પછી આપણને એ કરવામાં આંચકો શા માટે આવે ?

આ પ્રેરણાસૂત્ર છે. ‘મહાજનો યેન ગતઃ સ પન્થાઃ’ એનો ભાવ આ જ છે. ત્રણ વસ્તુ જોવાની,

પૂર્વપુરુષોએ કર્યું એમાં

(૧) શુભ આશય હતો ?

(૨) ભોગ આપેલો ?

(૩) કામ વિવેકભર્યું છે ?

(૧) આશય શુદ્ધ :-

દા.ત. પૂર્વ પુરુષોએ જાતે એકલેપંડે બધો ખરચ કરીને મોટાં જિનમંદિર બંધાવ્યા, તો શું એમાં આશય ખોટો હતો ? મંદિર પર કયાં પોતાનું નામ ન કોતરાવ્યું, તકતી ન મરાવી, ત્યાં આશય માનપાન મેળવવાનો કયાં રહ્યો ?

આશય તો માત્ર જિનભક્તિ કરવાનો અને પોતાની લક્ષ્મીને યોગ્ય ઉચ્ચ પાત્રમાં ઠેકાણે પાડવાનો રાખેલો.

(૨) વિવેકભર્યું કાર્ય :-

ત્યારે શું મંદિર-નિર્માણ-જિનભક્તિ કામ એ વિવેકભર્યું નથી ? કહો, મહાવિવેકભર્યું છે. મહાવિવેક આ, કે એનાથી ત્રણલોકના નાથ પરમાત્માની ભક્તિ થાય છે, તેમજ આ મંદિરને પામીને હવે હજારો લાખો ભવી જીવો અધ્યાત્મભાવને પોષણે, ધર્મસેવા કરશે; જીવનમાં પરમાત્માનું આલંબન લઈ દોષો-પાપો ઓછા કરતા આવશે. અસ્તુ .

છોકરો શ્રેણિકસમાટની સેવામાં :-

છોકરો હવે ઠાકેર રાજાની સેવામાં રહી ગયો છે. એમાં એક વાર એ રાજાની સાથે સમાટ રાજ શ્રેણિકની પાસે જાય છે. ત્યાં વળી જુએ છે કે રાજ શ્રેણિકને જુકીને પ્રણામ કરે છે. તેથી છોકરાને લાગ્યું કે ‘આ રાજ શ્રેણિક મોટા માણસ લાગે છે. નહિતર આ મારો રાજ એને જુકે શાનો ? બસ, તો મારે તો માતાની શિખામણ છે કે ‘મોટાની સેવા કરતો રહેજે, ’ તો પછી મારે શ્રેણિકની સેવામાં લાગી જવાનું.’ આ હિસાબે હવે એ નાના રાજાની રજ માગી લઈ મહારાજ શ્રેણિકની સેવામાં લાગી જાય છે.

અહીં એને હુંક પણ છે, કેમકે એ જુએ છે કે મહારાજ શ્રેણિકની સેવામાં બીજાઓ પણ કેટલાય લાગેલા છે. એટલે એના મનને એમ થાય છે કે ‘ચાલો સેવા માટે આ સ્થાન સારું મળ્યું, અને માતાની સલાહનો અમલ પણ થાય છે.

સમૃહની હુંક મોટી ચીજ છે : ભાવોલ્લાસનું મોટું કારણ.

સિદ્ધગિરિ પર પોષ-માહમાં યાત્રાએ જાઓ, એના કરતાં ફાગણ તેરસે કે કારતકી ચૈત્રી પૂનમે યા અભાત્રીજે યાત્રાએ જાઓ એમાં ભાવોલ્લાસ કેટલા બધા જાગે છે ! ચાર જણાની સાથે પોષધ કરો એના કરતાં ચારસોની સાથે પોષધ કરો એમાં ભાવોલ્લાસ કેટલા બધા જાગે છે ! એકલા અહૂમ તપ કરો એના કરતા સો બસો જણાની સાથે કરો એમાં અહૂમ કેટલો બધો ફોરો અને કેટલા બધા ભાવથી ભર્યો થાય છે ! પર્યુષણાની આરાધનામાં કેટલા બધા ઊછળતા ભાવોલ્લાસ ! આ બધાનું કારણ શું ? સમૃહની હુંક એ ભાવોલ્લાસનું મોટું કારણ છે.

માટે તો ‘ભાઈ ! આપણે તો ત્રણમાં શાન્તિથી આરાધના થાય’ એમ આંધળિયા કરીને ત્રણના સમૃહમાં દીક્ષા લે છે, એ પછીથી મોટા સમુદ્યામાં દીક્ષા લેનારના ભાવોલ્લાસ ચડતા રંગના જોઈ પસ્તાય છે કે ‘હાય ! આપણે ક્યાં આંધળિયા કરીને આ ત્રણમાં પડ્યા ?’

સમૃહની બલિહારી છે. એ અનેરો આનંદ ને અનેરું શિક્ષણ આપે છે. સમૃહવાસમાં કેટલા લાભ :-

માટે તો પૂર્વે કન્યા દેતા તે પહેલા નંબરમાં ભર્યા ઘરમાં દેતા. ત્યાં ‘હાય ! ભર્યા ઘરમાં તો મારી દીકરીને કેટલાની વેઠ કરવી પડે ? બિચારી સૂકાઈ જ જાય, દુઃખી જ થઈ જાય,-’ આવા ગોલા લેખાના હિસાબ નહિ માંડતા; આંધળા ગણિત નહિ મૂક્તા. કેમકે એ જોતા કે કદાચ દીકરીને વધારે કામ કરવાનું આવશે તો.

- (૧) એને વ્યાયામ સારો મળશે;
- (૨) ધરણાનો સદ્ધભાવ-સહાનુભૂતિ મળશે;
- (૩) ભર્યા ઘરમાં અનેકોની સારી પ્રવૃત્તિથી પ્રેરણા મળશે;
- (૪) અનેકો તરફથી અવસરોચિત સલાહ-સૂચન-ઠપકો મળવાથી સારું ઘડવા-શીખવાનું મળશે.

(૫) સહન કરતાં કરતાં ખડતલ બનશે.

(૬) સમૃહમાં શીલ સારું સચ્યવાશે.

(૭) સ્વેચ્છાચાર પર સમૃહમાં નિયંત્રણ રહેશે.

સમૃહ-આલંબનમાં આવા કેટકેટલા મહાન લાભ છે. માટે જ સમૃહનો આપણા પર ઉપકાર છે.

મોટા સમુદ્યામાં જે શીલ-સંયમની રક્ષા થાય, એ બે ત્રણના ચુપમાં ક્યાંથી થાય ? તેથી જો કે શીલ-સંયમ પાળીએ આપણે, મહેનત ચીવટ આપણી, પરંતુ એમાં સમૃહનો-સમુદ્યાનો મોટો ઉપકાર છે. મોટ સમૃહમાં ભવ્ય ભાવથી આરાધના કરીએ એમાં સમુદ્યાનો ઉપકાર છે.

પેલો છોકરો રાજ શ્રેણિકની સેવામાં ઘણાને રહેલા જોઈ હુંક અનુભવે છે કે ‘વાહ ! અહીં કેવો સારો યોગ મળી ગયો !’ તે સેવા કરવામાં અને વિશેષ ઉલ્લાસ આવે છે.

એમાં એક વાર ત્યાં વિચરતા જગદુગુરુ તીર્થકર ભગવાન મહાવીરસ્વામી પધાર્યા, એટલે મહારાજ શ્રેણિક પ્રભુને વંદનાર્થે અને પ્રભુની વાણી સાંભળવા ગયા. સાથે પરિવારમાં આ છોકરો પણ ગયો છે. એ ત્યાં જઈ જુએ છે કે

મહારાજ શ્રેણિક ભગવાન મહાવીરદેવ પાસે જઈ પગમાં પડીને વંદના કરે છે. આ છોકરો આ જોઈને પોતે પણ વંદના કરીને વિચારે છે કે ‘આ મહાવીર ભગવાન મહારાજ શ્રેણિક કરતાં પણ મોટા લાગે છે, મોટા તો રાજ એમને પ્રણામ કરે છે. તો પછી મારે તો મોટાની સેવા કરતા રહેવાની માતાની સલાહ છે એટલે મારે મહાવીર ભગવાનની સેવામાં રહી જવું જોઈએ.’ તેથી શ્રેણિક રાજને પૂછી

લે છે કે ‘મારે મહાવીર ભગવાનની સેવામા રહેવું છે, રહું ?’

શ્રેણિક મહારાજા ક્ષાયિક સમ્યક્તવના ધણી, એ આને ના પાડે ?

સમકિતીને મન દેવાધિદેવ અને ગુરુ એ સર્વસ્વ છે. એ પોતાનું બધું એ પોતાનું નહિ, પણ દેવગુરુનું સર્વસ્વ માને છે.

શ્રેણિકને મન અભયકુમાર પ્રભુનો : તેથી ભલે પ્રભુની સેવામાં જાય :-

આ માન્યતાવાળા શ્રેણિક પોતાની ચોવિસે કલાક સેવામાં રહેલા છોકરાને જો ભગવાનની સેવામાં જવું છે તો શું ના પાડે ? જાણો છો ને કે પોતાનો પાટવીકુમાર અને પ્રધાનમંત્રી તથા અદ્ભુત બુદ્ધિનિધાન અભયકુમાર જ્યાં દીક્ષા લેવાની એટલે કે ભગવાનની સેવામાં રહી જવાની રજા માગે છે, ત્યાં જો કે રાજાને હવે પોતાની ઉંમર થઈ એટલે અભયકુમારને રાજ્યગાદીએ બેસાડી નિવૃત્તિ લેવી છે, અને પ્રભુભક્તિમાં લાગી જવું છે, તેમજ અભયકુમાર જેવો સુયોગ્ય અને સર્મથ બીજો એક પણ રાજપુત્ર દેખાતો નથી એને રાજ્યગાદી સંભાળી લેવા આગ્રહ કરે છે, છતાં અભયકુમાર જો દીક્ષાની રજા માંગે છે, તો શ્રેણિક તરત જ દીક્ષાની હા પાડી દે છે, ને વરઘોડે ચઢાવી અભયકુમારને દીક્ષા અપાવવા પ્રભુ પાસે લઈ આવે છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૨૫, અંક-૪૫, તા. ૬-૮-૧૯૭૭

કેમ વારુ ? કારણ આ જ, કે સમકિતીને મન પોતાનું બધું એ પોતાનું સર્વસ્વ નહિ, પણ એ દેવગુરુએ આપેલું અને દેવગુરુનું સર્વસ્વ લાગે છે; એટલે ? આ, કે શ્રેણિકને મન અભયકુમાર પોતાનો નહિ, પણ પ્રભુ મહાવીરદેવનો; તેથી અભયકુમારની પોતાની ઈચ્છાથી જ્યાં એમની સેવામાં જવાની વાત આવી. અભયકુમારને પ્રભુની સેવામાં અર્પવાની વાત આવી, એટલે તરત અર્પા દેવાને તૈયાર. અભયકુમાર પર પોતાનો હક જ નથી માનતા, એટલે પોતાને અભયની બહુ જરૂર છતાં જ્યારે એ પોતે પ્રભુની સેવામાં જવાની ઈચ્છા બતાવે છે, તો એને રોકવાનો પોતાનો કશો ખોટો હક નહિ લગાવવાનો. ‘અભયકુમાર શું, આખું રાજ્ય, રાણીઓ ખજાનો વગેરે બધું પ્રભુનું, બધા પર પ્રભુનો હક, -આ હદ્યની સચોટ માન્યતા હોવાથી વિના-સંકોચ ‘અભય પર પ્રભુનો હક છે તો ભલે એ પ્રભુની સેવામાં જાય’ એ અભિલાષાથી અભયકુમારને તરત દીક્ષાની સંમતિ આપી દે છે, અરે ? પોતે જ એનો દીક્ષા વરઘોડો કાઢી પ્રભુ પાસે લાવીને પ્રભુને સોંપી દે છે. વાત આ છે,-

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો: ધૂટવાનો મોકો”(ભાગ-૪૪) ૩૦૮

સમકિતી પોતાની પાસેના બધા પર પોતાનો હક નહિ પણ પ્રભુનો જ હક માને છે, તેથી અવસરે પુત્રને પણ પ્રભુની સેવામાં સાનંદ સમર્પે છે.

આ તો પુત્રને અર્પા દેવાની વાત છે, પરંતુ જરૂર પડ્યે આખું રાજ્ય સોંપી દેવાની વાત હોય ને, તો ય સમકિતી તૈયાર. અરે ! દેવગુરુની સેવામાં પ્રાણ પણ ન્યોધાવર કરવાની વાત હોય તો ય એ માટે તરત તૈયારી.

સમકિતી એટલે શું સમજો છો ?

સમ્યક્તવના હજ ગુણોનો અભ્યાસ કરો તો સમકિતીનું મહત્વ સમજશે.

હજ ગુણોમાં એક ગુણ દેવગુરુની વૈયાવચ્ચ છે. સમ્યક્તવના ત્રણ લિંગ, એટલે કે ત્રણ ચિહ્ન ૧. અનહદ તત્ત્વ-ધર્મ-શ્રવણશરસ, ૨. ચારિત્રની તીવ્ર ભૂખ, ૩. દેવગુરુ વૈયાવચ્ચ.

(૧) તરુણ સ્ત્રી પરિવરેલો સુખી ચતુર માણસ ગાંધર્વના ગીત સાંભળવા જેવો રસિયો હોય, સમકિતી ધર્મ સાંભળવા તત્ત્વ સાંભળવા એથી અધિક રસિયો. એટલો બધો અને ધર્મશ્રવણનો રસ હોય છે. ને તમને ?

(૨) અટવી ઉત્તરેલા ભૂખ્યા બ્રાહ્મણને જેમ સુંદર ઘેબર અતિપ્રિય એમ સમકિતીને ચારિત્ર અતિપ્રિય. પેલાને મન ઘેબરનું ભોજન એટલે બીજા બધાં ભોજનકરતાં શ્રેષ્ઠ ભોજન લાગે, ને એની આગળ બીજા ભોજન કૂચા લાગે, તેમજ એ મળવાની શક્યતા દેખાય ત્યાં એનો ભારે તલસાટ હોય, એમ સમકિતીને ચારિત્ર એટલે દુન્યવી બધી સંપત્તિ કરતાં શ્રેષ્ઠ લાગે. તેમજ આ માનવભવમાં જ એ પામવાની શક્યતા જોઈ, એનો એનો ભારે તલસાટ હોય છે. ને તમને ? ના ? તો સમ્યક્તવ ક્યાં ?

સમ્યક્તવનાં લક્ષણ ક્યારેક હોય કે ન હોય. છતાં સમકિત હોય; પરંતુ સમ્યક્તવનાં લિંગ ન હોય તો સમ્યક્તવ નહિ.

(૩) સમકિતી જીવ દેવ-ગુરુની વૈયાવચ્ચ કરવામાં વિદ્યાસાધકની જેમ અત્યંત રસિયો અને ઉધમી-ઉજમાળ હોય એવો રસિયો વૈયાવચ્ચ કેવી કરે ? ‘ના, હું મંજુરા વગાડીશ, પણ પ્રભુ ! તમારી પૂજામાં મારા પૈસા નહિ ખરચું.’ એવી સેવા ભગવાનની કરે ? કે ‘ના, હું દૂધ એટલું નહિ મળે તો જાતે નહિ પીઓ, પણ પ્રભુ ! તમારી અભિષેક પૂજામાં તો દૂધ જરૂર લગાડીશ, એવી વૈયાવચ્ચ કરે ? કેવી વૈયાવચ્ચ કરે, એ બોલો.

સમકિતી જીવ દેવ ગુરુની સેવામાં વિદ્યા-સાધકની જેમ તૂટી પડે.

વિદ્યાસાધક વિદ્યાસાધવામાં કેવો તૂટી પડે ? છ છ મહિના ત્યાગ-તપ-ભૂખ-તરસ વગેરે ભારી કષ્ટો વેઠીને ને વિદ્યામંત્રના જપમાં, ધ્યાનમાં ઊંઘ હરામ

૩૧૦ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“મોડા સૂઈ મોડા ઉંદવાના....”(ભાગ-૪૪)

કરી ઉજગરણ કરીને પણ રાતદિવસ મચ્યો રહે ને ? કેમ વારું ? સમજે છે કે ‘આ વિદ્યા સિદ્ધ થાય, વિદ્યાદેવી તુષ્માન થાય, એટલે પછી બંદાની જગતમાં બોલબાલા!’

બસ, તો પછી સમકિતી આત્મા દેવ-ગુરુ ઉપર કે ‘આ દેવ-ગુરુને મરત વૈયાવચ્યથી બરાબર આરાધું તો બસ, મારા આત્માની જીહોજલાલી છે ! મહાન અભ્યુદય અને અંતે મોક્ષ છે’ એટલે પછી એ પેલા વિદ્યાસાધકની જેમ દેવ-ગુરુની સેવામાં કેમ તૂટી ન પડે ? સમકિતી માને છે કે

‘વિદ્યાસિદ્ધ થાય એટલે મારી બોલબાલા ! એમ દેવગુરુસેવા સિદ્ધ થાય એટલે મારા આત્માની જીહોજલાલી !’

હૈયે દેવગુરુની સેવા-વૈયાવચ્યના ભાવ ઊછળતા રહેતા હોય એટલે મોકો મળતાં એમની સેવામાં કેવો લાગી જાય ? અરે ! મોકો આવવાનું શું, સેવાને શોધી શોધીને કરવાની ધગશ ધરાવતો હોય. ત્યારે સેવાને શોધતો ફરતો હોય એને શું એક યા બીજી રીતે સેવા કરવાનું ન સાંપડે ? પ્રાયઃ સાંપડી જાય. એટલે જ તો તમે સેવાની શોધમાં નથી રહેતા ને ? બીક છે કે ‘કદાચ શોધતાં સેવા મળી જાય તો સેવા કરવાની માયે આવી પડે.’ કદાચ કંક કામ બતાવે તો ?’ બોલો, જ્યારે જ્યારે સાધુનો યોગ થાય ત્યારે શું એમને કહો ખરા કે ‘સાહેબ ! સેવાનો લાભ દો.’

સમકિત આ માગે કે ‘વિદ્યાસાધકની જેમ દેવગુરુની સેવામાં ઉજમાળ રહે.’ એટલે સમકિતી શ્રેણિક જુએ છે કે ‘અભ્યકુમારને મારા દેવાધિદેવ મહાત્મીર ભગવાનની સેવામાં જવું છે; હું પોતે એવી દેવસેવા નથી કરી શકતો; તો આ દીકરો ખુશીથી મારા નાથની સેવામાં જાય ? એમ વિચારી તરત દીક્ષા અપાવી દે છે.

આ શ્રેણિક જ્યારે પેલો છોકરો કહે છે કે ‘મારે તમારી સેવામાંથી ભગવાનની સેવામાં જવું છે,’ ત્યારે એને ના પાડે ? તરત હા પાડી દીધી ‘જ દીકરા જ, પ્રભુની સેવા તો મારે કરવી છે, પણ હું એવી સેવા નથી કરી શકતો, તો તું તો ખુશીથી પ્રભુની સેવામાં જા.’

દેવગુરુ સેવાની ધગશ બીજા પાસે ય સેવા કરાવવામાં હંમેશા ખુશી :-

અલબુત અહીં શ્રેણિકને અભ્યકુમારના અને છોકરાના કલ્યાણની કામના છે તેથી એમણે પ્રભુની સેવામાં જવાની હા પાડે છે, પરંતુ એમ હા પાડવામાં આ પણ કારણ છે કે ‘મારા પ્રભુની સેવા હું ન કરી શકું તો બીજાની પાસે તો જરૂર કરાવું.’ પોતાની સેવાની ધગશમાં અંતર્ગત આ સમાયેલું છે કે બીજા સેવા માટે ઉત્સુક છે તો પોતે એમાં હંમેશા ખુશી હોય અને ટેકો આપનાર હોય.

તમને, તમારો દીકરો ભગવાનની ગુરુની સેવામાં જવા માગતો હોય તો, આનંદ થાય ને ? એની વાત વધાવી લો ને ? કે શું મનને એમ લાગે કે ‘દીકરો દેવગુરુની સેવામાં જાય તો પછી મારી સેવા કોણ કરશે ?

સ્વાર્થની જ માયા હોય એ સંતાનની દેવગુરુ સેવાની ઈચ્છા ન વધાવી શકે.

સમકિતી તો પોતે ઊઠીને સંતાનને દેવ-ગુરુ-સેવામાં જોડે :-

આ તો સંતાન ગુરુના પ્રભાવે જાતે દેવગુરુ સેવા માટે તૈયાર થયો હોય ને રજા માગે એની વાત છે. એમાં ય જ્યારે ના પાડે, તો પછી માબાપ પોતે ઊઠીને તો એને એ માટે તૈયાર કરવાની વાતે ય શી ? સ્વાર્થમાયા ભયંકર છે. કુદ્ર વર્તાવ કરાવે.

ત્યારે જુઓ, સમકિતીની રીતરસમ કેવી ઉદાર અને ઉમદા હોય છે !

આર્થરક્ષિતની માતા, આર્થરક્ષિત પંડિત થઈને આવે છે એ વખતે શું કરે છે એ જાણો છો ? આર્થરક્ષિતનું સામૈયું રાજ્ય તરફથી કરાવવામાં આવે છે. આર્થરક્ષિતનું આખું કુટુંબ સામૈયું જોવા ગયું છે, પણ એની માતા નથી ગઈ. કેમ વારું ? દીકરાને મદ નથી ચડવા દેવો, દીકરો જે કરી આવ્યો છે એમાં સંમતિ નથી બતાવવી. આ સમકિતી માતા કહેવાય ? દીકરાનું આટલું ભય સન્માન થતું હોય, ને એમાં રાજ્યપો નહિ ? એમાં જોડવાનું નહિ ? પણ હિસાબ દીકરો સંસારમાયામાં ભૂલો ન પડી જાય, દેવગુરુધર્મની સેવા કરવાની અહીં જ મળી શકતી અણમોલ તકને દીકરો મોહમાયામાં વેડફી ન નાખે, એનો છે. તેમજ માતાને પોતાના સ્વાર્થની વસ્તુ દેવગુરુ ધર્મની સેવામાં સમર્પી દેવાની માંઘેરી તક છે. એ તક સાધવી ચૂકી ન જવાય, માતાને એનો હિસાબ છે.

એટલે જ દીકરાને એ માટે જગાડ્યે છે, તેથી સામૈયામાં ન ગઈ, યાવ્તુ આર્થરક્ષિત ઘરે આવી માતાના પગમાં પડ્યો ત્યાં સુધી પણ રાજ્યપો નથી બતાવતી; અને જ્યાં દીકરો પૂછે છે ‘મા ! આખું ગામ રાજ છે ને તું રાજ નથી ?’ ત્યાં માતાએ એને જગાડવાનો મોકો દેખ્યો, એટલે માતા કહે છે, -

‘ગામ તારી માતા નથી એટલે રાજ થાય. હું તો તારી માતા છું તે તું પેટની વિદ્યા પાપની વિદ્યા ભણી આવ્યો એથી રાજ ન થાઉં. કેમકે એથી તું મદ, અન્યની હલકા આરંભ-સમારંભ વગેરે કરીને દુર્ગતિના પલ્લે પડી જાય, શું એમાં માતા રાજ થાય ?

આર્થરક્ષિત પૂછે ‘તો શું ભણું તો તું રાજ થાય ?’

‘દીકરા ! દસ્તિવાદ ભણો તો રાજ થાઉં.’

‘કોણ ભણાવે ?’

‘તારા મામા તોસલિપુત્ર આચાર્ય.’

શું બતાવ્યું માતાએ ? દણ્ણિવાદ ભજવાનું. એ કાંઈ એમ ન ભજવા મળે. એ તો જીવનભર માટે સાહુદીકા લે સાહુ થાય, એકડે એકથી ધર્મનું ભણે, પછી પણ ગુરુને એની એવી યોગ્યતા દેખાય તો આગળ વધતાં દણ્ણિવાદ ભજાવે ! માતા આ જુએ છે કે ‘આ ભજાવાના નિમિત્તે અને સંસારની ભયંકર મોહમાયા છોડી સાહુ થવા દે ને ? પછી એ મારા દેવાધિદેવ અને ગુરુની પૂર્ણ સેવામાં તો લાગે જશે ? દેવગુરુના પસાયે જ મને મળેલું રતન, દેવગુરુની સેવામાં જાય એ જ મારું અહોભાગ્ય ! નહિતર એ સેવા મૂકી મારી સેવામાં રહે એ મારું કમભાગ્ય !

મા શું વિચારી રહી છે ? ‘દીકરો દેવગુરુની સેવા મૂકી મારી સેવામાં રહે એ મારા કમભાગ્ય.’ દીકરો માતાપિતાની સેવા કરે એ માતાપિતાનો પુણ્યોદય ગજાય છે, ત્યારે આ માતા એને પોતાનું કમભાગ્ય ગણે છે, પાપનો ઉદ્ય ગણે છે. કયા પાપનો ઉદ્ય ? મોહનીય પાપકર્મનો ઉદ્ય. હુન્યવી મનગમતી વસ્તુ પર રાગ થાય એ મોહોદય છે, પાપોદય છે.

ત્યારે દીકરો દેવ-ગુરુ-ધર્મની સેવામાં જાય એ માતાપિતા માટે કયો પુણ્યોદય? દાનાંતરાયના ક્ષયોપશમરૂપી પુણ્ય. કેમકે એ ક્ષયોપશમ થવાથી દેવગુરુની સેવામાં આપી દેવાનું મન અને આપી દેવાની પ્રવૃત્તિ થાય એ મહાન દાન થયું. એ જ મહાન પુણ્યોદય ગજાય.

જુઓ ભગવાનની પૂજામાં તમારું પોતાનું કિંમતી દ્રવ્ય વાપરો એ પરમ પાત્રમાં દાન છે. અરે ! તમારી સામાન્ય સ્થિતિ હોય અને અલ્ય કિંમતી દ્રવ્ય પૂજામાં ધરો, તો એ પણ પરમ પાત્રમાં દાન છે.

એટલે પણ પ્રભુનાં ચરણે દાન શી રીતે થયું ? (૧) મોહનીયકર્મના અને (૨) દાનાંતરાયકર્મના ક્ષયોપશમથી થયું.

મોહનીયનો ક્ષયોપશેમ ન હોય અને દાનાંતરાયનો ક્ષયોપશમ હોય તો દેવાનું મન તો થાય, પરંતુ અપાત્રે-કુપાત્રે દેવાનું મન થાય. દે છે ને આજે બીજે તીજે દાન ? કેમ અરિહંત પરમાત્માની ભક્તિમાં અરિહંત દેવે કહેલ સાત ધર્મક્ષેત્રોમાં દાન નહિ ? કારણ આ જ કે મોહનીયનો ક્ષયોપશમ નહિ પણ મોહનીય કર્મનો ઉદ્ય છે એટલે મોહથી બીજે તીજે આકર્ષણ થાય છે. વીતરાગ પરમાત્મા અને સાત ધર્મક્ષેત્રો તરફ આકર્ષણ થવા માટે મોહનીય કર્મનો ક્ષયોપશમ જોઈએ એ હોય અને સાથે દાનાંતરાય કર્મનો ક્ષયોપશમ હોય તો ત્યાં દાન દેવાય; ત્યાં ભક્તિમાં અપાય.

હવે જો દાનાંતરાયનો ક્ષયોપશમ નહિ, પણ ઉદ્ય હોય, તો મોહક્ષયથી

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ-કખાય રોકો: ધૂટવાનો મોકો” (ભાગ-૪૪)

પ્રભુ પ્રત્યે આકર્ષણ થવા છતાં એમની ભક્તિમાં પૈસા ધૂટે નહિ; અલબત્ત પ્રભુભક્તિમાં પૈસા ન ધૂટવા પર હૈયામાં ભારે બળતરા હોય; કેમકે પ્રભુની પ્રત્યે આકર્ષણ છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૨૫, અંક-૪૬, તા. ૧૩-૮-૧૯૭૭

વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ હોય તો એની સેવા પ્રેમથી કરાય છે, ને સેવા ન થઈ શકે તો બળતરા થાય છે. એમ દેવગુરુની સેવામાં સમજવું.

પત્ની પ્રત્યે જો આકર્ષણ છે તો કેવી પ્રેમથી એની સેવા થાય છે ! અને જો સંયોગવશ સેવા નથી થઈ શકતી દા. ત. પત્ની બિમાર છે અને ધંધા પૂરતું એને છોડી બજારમાં જવું પડતું હોય, તો દિલ બળે છે કે ‘હાય ! આવી આની બિમારીમાં હું પાસે નથી બેસી શકતો ને ધંધે જવું પડે છે !’ એમ પત્નીને સારી સાડીની ઈચ્છા થઈ, ને પતિને તેવા પૈસાનો સંયોગ નહિ હોવાથી નથી ખરીદી લાવી શકતો, તો દિલ બળે છે કે ‘હાય ! બિચારી કોઈક દિવસ માગે ને હું નથી લાવી આપી શકતો !’

એમ પ્રભુ પ્રત્યે જો આકર્ષણ છે, ને દાનાંતરાય કર્મના જોરે પ્રભુની ભક્તિમાં દ્રવ્ય નથી લગાવી શકતો, તો એની હૈયે ભારે બળતરા થાય કે ‘અરે ! કેવો હું ભાગ્યહીન કે મારા પૈસા ભોગમાં પૂરા ખરચું દ્ધન ને પૈસાથી મારા બૈરી-છોકરાને પ્રસર રાખું હું, પણ મારા પ્રભુની ભક્તિમાં કશું નથી ખરચતો ! કેવો મારો પાપી દાનાંતરાયનો ઉદ્ય ! કેવો મારો પાપોદય !’

આમ ન ખરચાયાની બળતરા હોય તો કહેવાય કે શુદ્ધ દાનાંતરાયનો ઉદ્ય છે. પરંતુ જો બળતરા જ ન હોય તો તો માનવું પડે કે પ્રભુ પ્રત્યે આકર્ષણ જ નથી, એટલે મોટો ગુનો તો મોહનીયકર્મનો ઉદ્ય છે.

જીવનમાં તપાસજો, ભગવાનની પૂજા-ભક્તિમાં પોતાનું દ્રવ્ય ન લઈ જતા હો, ને દેરાસરના દૂધ-કેસર વગેરેથી પૂજા પતાવતા હો, તો દિલમાં સ્વદ્રવ્ય ન લગાવાની બળતરા થાય છે ખરી ? કે

‘હાય ! આ મારા પૈસા, મારું દ્રવ્ય શું કામ લાગવાનું ? કેવળ મારા અને મોહાંધ કુટુંબના જ કામમાં જાય ? મારા પ્રભુની ભક્તિમાં પ્રભુની શોભામાં નહિ ? તો હાય ! આ પૈસા કેવા ગોજારા !’ આવી કોઈ બળતરા થાય ખરી ? શું ખબર નથી કે આપણું આ બધું પ્રભુના પ્રભાવથી જ પાચ્છા છીએ તો પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતારૂપે પણ પ્રભુને ચડાવવું જોઈએ ? વળી અહોભાગ્ય કેવા કે આવા પરમપાત્ર

૩૧૪ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“મોડા સૂઈ મોડા ઊરવાના....” (ભાગ-૪૪)

પ્રભુ મને પૂજવા મળ્યા ! તો નાશવંત દ્રવ્યનું પરમપાત્રમાં ભરપૂર દાન-પ્રદાન કરવું જોઈએ ? આ ખબર તો છે, છતાં પ્રભુપૂજામાં પોતાનું દ્રવ્ય ધૂટતું નથી એમાં શું દાનાંતરાય કામ કરી રહ્યા છે ? કે મોહ કામ કરી રહ્યા છે ? લખી રાખો

પરમ પવિત્ર પ્રભુના ચરણે પોતાનું દ્રવ્ય ન ગયાની બળતરા નથી, તો એ દાનાંતરાયનો ઉદય નહિ પણ મોહનો ઉદય છે. ને

બળતરા ભારોભાર છે, પણ દ્રવ્ય પ્રભુપૂજામાં ધૂટતું નથી, તો એ દાનાંતરાયનો ઉદય છે.

આવું જ પુત્રની બાબતમાં છે. પુત્ર પ્રભુની સેવામાં ન દઈ શકાય એની બળતરા હોય અફસોસી હોય, તો એમાં શુદ્ધ દાનાંતરાયનો ઉદય કહેવાય, પાપોદય ગણાય; અને દેવાની વૃત્તિ થાય તો એ પુણ્યોદય ગણાય. આ પુણ્યોદય એટલે દાનાંતરાયનો કષ્યોપશમ.

શ્રેણિક રાજા, અભ્યકુમાર જયાં પ્રભુને પૂછી આવી દીક્ષાની રજા માગે છે, ત્યાં તરત જ રજા આપી દે છે, અભ્યકુમારનો વરધોડો કાઢી પ્રભુ પાસે લઈ જઈ દીક્ષા અપાવી દે છે ક્ષાયિક સમકિતી છે ને ? સચ્ચકત્વનાં ત્રણ લિંગમાં એક લિંગ દેવગુરુની વૈયાવચ્ચ છે. દીકરો પોતાના ગણેલા દેવાધિદેવ અને ગુરુ મહાત્માર પરમાત્માની સેવામાં જાય છે. આ મોકો મળ્યો છે તો એને સેવામાં જવા દેવામાં શાનો આંચંકો કે આનાકાની હોય ? આ તો પુત્રે દીક્ષાની રજા માંગી ને બાપે રજા આપી એની વાત થઈ.

હવે એથી આગળ વધીને જુઓ, આર્થરક્ષિતે પોતે કાંઈ માતા આગળ માગણી નહોતી કરી કે ‘મારે દીક્ષા લેવી છે, મારે ગુરુની સેવામાં જવું છે.’ એ તો કાશી કે પાટલીપુત્રમાં દર્શનવિદ્યા ભણીને સંસારવાસના લઈને આવ્યો છે. એટલે તો પોતાનું રાજા તરફથી સન્માન થતાં ને આખા નગરને રાજુ રાજુ જોતાં, અંતરમાં સંસારવાસના કેટલી બધી કૂદતી હોય ? પોતે રાજુ થઈ ગયો છે, એટલે હવે ઘરે આવી માતાને રાજુ ન જોતાં દુઃખી થાય છે. આર્થરક્ષિતના રાજ્યપામાં કયાં ધર્મવાસના આવી ? કયાં દીક્ષાની ભાવના આવી કે દીક્ષાની રજા માગે ?

આર્થરક્ષિતની માતાની ભવ્ય વિચારણા :-

પરંતુ માતા પક્કી શ્રાવિકા છે, સમકિતધારિણી છે. એનામાં દેવગુરુની વૈયાવચ્ચનો ગુણ સ્ફુરાયમાન છે, એટલે એ વિચારે છે કે આવો મહાબુદ્ધિશાળી દીકરો જો દેવાધિદેવની એટલે કે શાસનની સેવામાં જાય તો મારો કેવો જબરદસ્ત પુણ્યોદય ! જો દેવાધિદેવની એટલે કે શાસનની સેવામાં જાય તો મારો કેવો જબરદસ્ત પુણ્યોદય નહિતર તો મેં વિષય સેવાનું પાપ કરીને દીકરો મેળવ્યો, ને

ભુવનભાનુ અન્સાઈકલોપીયા-“પ્રવચન મહોદધિ-કષાય રોકો : ધૂટવાનો મોકો” (ભાગ-૪૪) ૩૧૮

હવે એ પાછો જાતે વિષયસેવામાં લાગી જઈ વિષયસેવામાં દૂબી જનારી પ્રજાની પરંપરા સંતાનપરંપરા ચાલવામાં નિમિત્ત થવાનો, એ કેટલું ભયંકર ? દીકરાને સંસારમાં બેઠો રાખી એક તો દેવાધિદેવ પરમોપારી પરમાત્માની સેવા ગુમાવું ? ને બીજું પાપ સંતાન-પરંપરા ચલાવું ?

માતા આ વિચાર પર અને પુત્રના આત્મહિતની વિચારણા પર, બને તો મહાબુદ્ધિશાળી પુત્રને શાસનને ભેટ કરવા જુઓ કેવી હોશિયારીથી પુત્રને ઊભો કરી દે છે ! એ પુત્રના માતૃપ્રેમગુણનો લાભ ઉકાવે છે. દીક્ષાનું નામ પાડ્યા વિના દીક્ષા તાણી લાવે એવા દીકરાના વિદ્યાપ્રેમને ઉત્સેધિત કરવા કહે છે,-

‘આખું ગામ રાજુ થાય કેમકે એ કાંઈ તારી મા નથી હું તારી મા આમાં રાજુ ન થાઉં’

આર્થરક્ષિત કહે છે ‘તો હું શું ભાણું તો તું રાજુ થાય ?’

મા કહે ‘તું દસ્તિવાદ ભણે તો રાજુ થાઉં.’

આર્થરક્ષિત કહે, ‘કોણ ભણાવશે’

માતા કહે છે, તારા મામા ! તોલસીપુત્ર આચાર્ય મહારાજ ભણાવશે !

જુઓ, આમાં દીક્ષાની વાત કેવી અંતર્ગતરૂપે ઘૂસાડી દીધી ? જુઓ છે કે દીકરો મને રાજુ કરવા તૂટી મરે એવો છે, પછી શું કામ બાકી રાખવું ? શું કામ ઓછેથી પતાવવું ?

મોટા પંડિતને મન પણ માતા એટલે ? :-

ત્યારે આર્થરક્ષિત બ્રાહ્મણકુળમાં જન્મેલા છતાં આ શ્રાવિકા માતાને પહેલી રાજુ કરવા સજજ છે. નહિતર તો બ્રાહ્મણ કુળ બ્રાહ્મણ પિતા કાકા વગેરે તો જેટલા ભણતરની અપેક્ષા રાખે એટલા ભણતરમાં તો પારંગત થઈને આવ્યો છે. ને એ બધા રાજુ થઈ ગયા છે, પછી શું કામ એક માતાના રાજ્યપા સામે જુઓ ? પણ ના, મૂળ જન્મદાત્રી માતાનો બીજા કરતાં ઘણો મોટો ઉપકાર છે, એમ સમજે છે, તેમજ આર્થ વિદ્યાએ એવું ભણાવ્યું છે. તેથી માતાને પહેલી રાજુ કરવી છે. એટલે દસ્તિવાદ મામા તોસલિપુત્ર આચાર્ય ભણાવશે એ જાણી લઈ તરત સ્વીકારીલે છે કે ‘કાલે વહેલી પરોઢે ઊઠીને હું એમની પાસે દસ્તિવાદ ભણવા ચાલ્યો જઈશ.’

ભલા ભોળાને આ કયાં ખબર છે કે ‘દસ્તિવાદ તો દ્વાદશાંગી-જિનાગમમાંનું ચૌદ પૂર્વોને સમાવતું બારમું અંગ છે, ને એ ગુરુ બધા સાધુ તો શું પણ ઓછી તાકાત અને ઓછી પાત્રતાવાળા સાધુને ય ન ભણાવે ?’ છતાં મનમાં એ ગમે તે ભોગે ભણવાનું નક્કી કર્યું છે એટલે ગુરુ પાસે પહોંચતાં ને વંદના કરી દસ્તિવાદ

૩૧૬ ભુવનભાનુ અન્સાઈકલોપીયા-“મોટા સૂઈ મોટા ઊઠવાના...” (ભાગ-૪૪)

ભજાવવાની વિનંતી કરતાં જ્યાં ગુરુ કહે છે કે ‘એ તો સાધુને જ ભજાવાય, ત્યાં બીજો કશો વિચાર જ ન કરતાં, માતાએ આ સમજને જ કહ્યું હશે ને ? એમ માની લઈ વિના વિલંબે ત્યાં જ એ જ વખતે દીક્ષા લઈ સાધુ બની જાય છે. ને જૈનાગમ એકે એકથી ભજાવા લાગી જાય છે, તે દણ્ણિવાદના ચૌંદ પૂર્વશાસ્ત્રમાં ઠેઠ દશમાં પૂર્વને ભજાવા સુધી પહોંચી જાય છે.

મહાન કેમ બનાતું હશે ? મહાન ભોગ આપીને પણ મહાજાન મેળવવાના પરાક્રમથી.

બોલો, આર્થરક્ષિતની માતાની દેવ-ગુરુ સેવા કેવી કે એ સેવામાં દીકરાના વગર માયે દીકરાને પોતે ઉપરથી પ્રેરીને એ સેવા માટે સોંપી દે છે !

પેલો ઓલિયો પુત્ર હવે સમ્રાટ શ્રેણિકની સેવા સુધી આવી પહોંચ્યો છે, પરંતુ ત્યાં વળ્ણી જ્યાં જોયું કે આ રાજા તો મહાવીર પ્રભુને નમે છે, એટલે કલ્યાણ કરી કે ‘તો મહાવીરપ્રભુ સમ્રાટ કરતાં ય મોટાં તેથી માતાના વચનને અનુસારે હવે મારે પ્રભુની સેવામાં લાગી જવાનું.’ એમ નક્કી કરી મહારાજા શ્રેણિકની રજા માગે છે, એટલે શ્રેણિક શાના ના પાડે ? એ તો જીએ છે કે આ છોકરો મારા પ્રભુની સેવામાં જવા ચાહે છે ને ? ત્યાં મારે મારો સ્વાર્થ નહિ જોવાનો સ્વાર્થ જોવો હોય તો પરલોકહિતકારી સ્વાર્થ સાધવાનો. તે દેવગુરુની સેવામાં મારા પ્રભુની સેવામાં મારું સમર્પણવાથી સધાય. માટે આ છોકરો ભલે પ્રભુની સેવામાં જાય ‘એમ વિચારી રાજાએ આવા વિનયી સેવાભાવી પણ છોકરાને રજા આપી દીધી કે તું ખુશીથી પ્રભુની સેવામાં જા.’

છોકરો આવ્યો મહાવીર પ્રભુની પાસે, ને વિનંતી કરે છે ‘પ્રભુ ! મારે આપની સેવામાં રહેવું છે, મને રજા આપો.’

ભગવાન કહે ‘મહાનુભાવ ! એમે સંયમી ધીએ સંયમીની સેવામાં રહેવા માટે સંયમી સાધુ થવું પડે. સંયમી જ સંયમીની સેવા કરી શકે. કેમકે સંયમી પાપથી સર્વથા નિવૃત્ત હોય, એ પાપમાં રહેલાની સેવા કેમ લઈ શકે ? તથી સંયમીની સેવા અસંયમી કરી શકે નહિ. તું અસંયમી છે. સંયમી બને તો સેવા મળે’

હવે શું કરે છોકરો ? એ ભગવાનને પૂછે છે ‘પ્રભુ ! સંયમી એટલે ?’

ભગવાન કહે છે,

‘સંયમ એટલે હિંસાદિપાપો પ્રતિક્ષાથી સર્વથા બંધ કરી દેવા અને કષાયો પર અંકુશ મૂકી દેવો સમભાવમાં આવી જવું.’

છોકરાને સંયમ સમજમાં આવી ગયું. એને હવે સમજાઈ ગયું કે ‘પ્રભુની

વાત સાચી છે કે સંયમીની સેવા સંયમી જ કરી શકે; કેમકે અસંયમીને તો પાપના ત્યાગની પ્રતિક્ષા જ નહિ એટલે હિંસાદિપાપ હાલતાં ને ચાલતાં કરી નાખે; તેથી એ સેવા કરવા જાય એમાં એના દ્વારા થતી હિંસા સેવા કરવાનારના માથે ચરે તો ? બસ, મારે જો પ્રભુની સેવા કરવી છે. તો મારે સંયમી બનવું જ જોઈએ.’ એમ વિચાર કરીને પ્રભુને કહે ‘પ્રભુ ! મને સંયમ આપો.’

ભગવાન મહાવીર પ્રભુએ એને સંયમ આપ્યું. છોકરો સાધુ બન્યો ભગવાનને એને સ્થિર સાધુઓને સોંઘ્યો. એમણે એને સંયમની તાલિમ અને જ્ઞાન આપવા માંડ્યું. એમાં એને સમજવા માંડ્યું કે,

‘ભગવાનની મોટામાં મોટી સેવા એમની આજાનું પાલન છે, આજાપાલનની પરાકાષ્ઠાએ પહોંચવું એ છે;

એટલે તો એ જિનાજ્ઞાને સમજવામાં અને શક્ય એનું પાલન કરવામાં તન્મય થઈ ગયો. વિચારવા જેવું છે કે એક નાનો ધર્મ પણ માણસને કેટલો આગળ વધારી શકે છે ! અલબત્ત એને બરાબર પકડી રાખવો જોઈએ, પછી તો એની આત્મા સાથે સગાઈ થઈ સમજો ને વડનું બીજ ઊગી વધવા માંડ્યું સમજો. પેલા છોકરાને માતાએ એટલો ધર્મ શીખવ્યો કે ‘મોટાની સેવા કરતો રહેજે. તારું કલ્યાણ થશે,’ ને એ એણે બરાબર પકડી રાખ્યો કેવો પકડી રાખ્યો ? વહાલસોયા બાપ કરતાં મૂખી મોટા છે તો વહાલસોયા બાપને ય મૂકી મૂખીની સેવામાં લાગ્યો. મૂખી ગામના છે છતાં એમના કરતાં રાજા મોટા લાગ્યા, તો પરગામ પણ રાજાથી સેવામાં ગયો....એમ કરતાં કરતાં પ્રભુ મોટા છે તો એમની સેવામાં જવા સંસારત્યાગ પણ કરી દીધો; અને એમાં વિચરતા તીર્થકર ભગવાનની સેવા એટલે કે એમની આજાની સેવા કરી તરી ગયો.

એકાદ પણ ધર્મને મજબૂત પકડી રાખ્યો એ કુમશઃ સંસાર તરી જાય એમાં શું આશ્રય ?

કલ્યાણમાતા પુત્રને ‘કલ્યાણ કરવું હોય તો મોટાની સેવા કરતો રહેજે’ એવી માતાની શિખામણ પરનું દણાંત પૂર્ણ થયું. પુત્રે આ એક સેવાનું સૂત્ર પકડી રાખ્યું, તો ‘મોટા, એથી મોટા....’ એમ કરતાં કરતાં ઠેઠ મહાવીર ભગવાનની સેવા સુધી એ પહોંચી ગયો, ને એમ એકાદ ધર્મને પણ મજબૂત પકડી રાખ્યો તો ભવ પાર કરી ગયો.

